

માધ્યમિક કોર્સ (અભ્યાસક્રમ)

૨૨૪ - નામાના મૂળતત્વો

કોર્સ કો-ઓર્ડિનેટર
ડૉ. પિયુશ પ્રસાદ

ભાષાંતર સહયોજક
ડૉ. રાજેશ કુમાર



રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાન

(એમ.એચ.આર.ડી, ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા)

અ- - ૨૪-૨૫, ઇન્સિટિયુશનલ, એરીયા સેક્ટર - ૬૨ નોઈડા - ૨૦૧૩૦૮ (ઉ.પ.)

વેબસાઈટ : www.nios.ac.in, ટોલ ફોન નં. ૧૮૦૦૧૮૦૫૩૮૩

© રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાન

(કોપી)

સલાહ સમિતી

ડૉ. એસ.એસ. જેના	ડૉ. કુલદીપ અગ્રવાલ	શ્રીમતી ગોપા બિશ્વાસ	ડૉ. સોનીયા બહેલ
ચેરમેન એન.આઈ.ઓ. એસ., નોઈડા	ડાયરેક્ટર (એકેપ્ટેમેન્ટ) એન.આઈ.ઓ. એસ., નોઈડા	જોઈન્ટ ડાયરેક્ટર (એકેપ્ટેમેન્ટ) એન.આઈ.ઓ. એસ., નોઈડા	આસીસ્ટન્ટ ડાયરેક્ટર (એકેપ્ટેમેન્ટ) એન.આઈ.ઓ. એસ., નોઈડા

અન્યાસકમ સમિતી

ડૉ. જી.પી. અગ્રવાલ	પ્રો. કે. રવિશંકર	શ્રી ચરન સિંઘ સવિતા	ડૉ. તી. કે. પાંડે
ચેરપસન પ્રિન્સીપાલ, એસ.એલ. કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી	પ્રોફેસર, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, ઇન્દ્રીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, ન્યુ દિલ્હી	એસો. પ્રોફેસર(નિવૃત્ત), શ્યામલાલ કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી	એસો. પ્રોફેસ, બી.આર. આભેડકરકોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી
ડૉ. આર.પી.તુલસીઅન	ડૉ. આર.કે.ગુમા	ડૉ. નસીબ અહેમદ	ડૉ. બી.પી. સાહુ
એસો. પ્રોફેસર, શહીદ ભગતસિંહ કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી	એસો. પ્રોફેસર, પી.જી.ડી.એ.વી. કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી	આસી. પ્રોફેસર, જામીયા મિલીયા ઈસ્લામિયા, ન્યુ દિલ્હી.	આસી. પ્રોફેસર, ખાલસા કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી
ડૉ. ઓ.પી.મહિન્દા	શ્રી એસ.એમ.સિંઘ	શ્રી સંજીવ કુમાર	શ્રી એસ.કે. શર્મા
એસો. પ્રોફેસર, શહીદ ભગતસિંહ કોલેજ, (પી.જી.) કોલેજ, રાજસ્થાન	પી.જી.ટી. ગવનર્મેન્ટ સ્કૂલ પટના (બિહાર)	લેક્ચરર કોમર્સ, ગવનર્મેન્ટ સર્વોદય બાલ વિદ્યાલય, કિશનાનગર, દિલ્હી	પી.જી.ટી. ગવનર્મેન્ટ સ્કૂલ દિલશાદ ગાર્ડન, દિલ્હી

વિષય નિષ્ણાત સમિતી

ડૉ. જી.પી. અગ્રવાલ	ડૉ. સુનિલ કુ.ગુમા	ડૉ. તી. કે. પાંડે	ડૉ. આર.પી.તુલસીઅન
પ્રિન્સીપાલ, એસ.એલ. કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી	એસો. પ્રોફેસર, એસ.ઓ.એમ. એસ. ઇન્દ્રીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, ન્યુ દિલ્હી	એસો. પ્રોફેસ, બી.આર. આભેડકરકોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી	એસો. પ્રોફેસર, શહીદ ભગતસિંહ કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી
શ્રી ચરન સિંઘ સવિતા	શ્રી એસ.કે. શર્મા	ડૉ. અજય ગર્ગ	ડૉ. નેહા અગ્રવાલ
એસો. પ્રોફેસર(નિવૃત્ત), શ્યામલાલ કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી	પી.જી.ટી. ગવનર્મેન્ટ સ્કૂલ દિલશાદ ગાર્ડન, દિલ્હી	પી.જી.ડી.એ.વી. ઈવનીંગ કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી	ફાઈનાન્શીયલ એક્સપર્ટ, જી.આઈ.એલ. (ઇન્ડીયા) લિમિટેડ, વિજયપુર, એમ.પી.
ડૉ. એ.કે. સિંઘ	ડૉ. એસ.કે.બંસલ	ડૉ. પિયુષ પ્રસાદ	ડૉ. આર.કે.ગુમા
આસી. પ્રોફેસર, શહીદ ભગતસિંહ કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી	લેક્ચરર કોમર્સ (નિવૃત્ત) કોમર્સાયલ કોલેજ, દરીયાગંજ, ન્યુ દિલ્હી	એકેપ્ટેમેન્ટ ઓફિસર, એન.આઈ.ઓ. એસ., નોઈડા	એસો. પ્રોફેસર, પી.જી.ડી.એ.વી. કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી, દિલ્હી

સંપાદક સમિતી

શ્રી એસ.એસ. શેરાવત	ડૉ. એસ.કે.બંસલ	શ્રી એલ.આર. પાઠક	શ્રી સંજીવ કુમાર
ટેચ્યુટી કમિશનર (નિવૃત્ત), કેન્ટ્યુયિયલ વિદ્યાલયા સંગઠન, ન્યુ દિલ્હી	લેક્ચરર કોમર્સ (નિવૃત્ત) કોમર્સાયલ કોલેજ, દરીયાગંજ, ન્યુ દિલ્હી	એજયુકેશન ઓફિસર (નિવૃત્ત) એન.સી.ટી., ન્યુ દિલ્હી	લેક્ચરર કોમર્સ, ગવનર્મેન્ટ સર્વોદય બાલ વિદ્યાલય, કિશનાનગર, દિલ્હી

ગ્રાફિક્સ, કવર ડિઝાઇન અને ડી.ટી.પી.

શ્રી મહેશ શર્મા	એમ.કે. કોમ્પ્યુટર્સ, હુકાન નં. ૧૮, ડી.ડી.એ. માર્કેટ, ભેરા એન્કલેવ, પાંચમ વિહાર, ન્યુ દિલ્હી - ૧૧૦૦૮૭
-----------------	--

અધ્યક્ષશ્રીનો સંદેશ

પ્રિય અભ્યેતા/વિદ્યાર્થી

સતત પરિવર્તિત થતા જતા જન-સમાજની જરૂરીયાતો કેટલાંક જુથોની સમય સાથે પરિવર્તિત થવાની પદ્ધતિ અને આવડતને પરિપૂર્ણ કરવા માટે જરૂરી અપેક્ષાઓ અનુસાર બદલાય તે અનિવાર્ય બાબત ગણાય. શિક્ષણએ પરિવર્તન માટેનું એક અદું ઓજાર છે. યોગ્ય સમયનું અને યથાયોગ્ય શિક્ષણ જ સમાજની મહત્વાકંશાઓની આપૂર્તિ કરવા ઉપરાંત નવીન સમસ્યાઓનો સામનો કરવા તેમજ તે માટે જોઈતી હિંમત કેળવવા સારુ વ્યાવહારિક પરિવર્તનની આવશ્યકતા હોય છે. અવાર નવાર તેમજ તબક્કાવાર રીતે પાઠ્યક્રમોમાં જરૂરી ફેરફારો દ્વારા અસરકારક રીતે આવું સધ્યાં પરિવર્તન કરી શકાય. કોઈ પણ જડ (અપરિવર્તન શીલ) પાઠ્યક્રમ આવો કોઈજ હેતુ પાર પાડી શકે નહીં. કારણ કે તે આવી કોઈ વૈયક્તિક અથવા સામાજિક (સામૂહિક) જરૂરીયાતને પોખાતો હોતો નથી.

એકમાત્ર ઉક્ત હેતુસર સમગ્ર રાષ્ટ્રના કેળવક્ષીકારોએ સમયાનારે એકઠા થઈને આવા પરિવર્તન માટે જરૂરી ચર્ચા-વિચારણાઓ કરવી જોઈએ. આથી જ એક ચર્ચા-વિચારણાની ફલશુદ્ધિ રૂપે રાષ્ટ્રીય પાઠ્યક્રમ માળખા (NCF 2005) ની રચના કરવામાં આવી છે. તેણે વિવિધ કક્ષાઓ જેવી કે પાયાની પ્રાથમિક, માધ્યમિક તે મજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંદર્ભે વિષદ ચર્ચા-વિચારણાઓને અંતે એક ભૂમિકા તૈયાર કરી છે.

ઉક્ત તમામ -રાષ્ટ્રીય તથા સામાજિક બાબતોને ધ્યાનમાં રાખી ને અમે તાજેતરમાં માધ્યમિક કક્ષાનો પાઠ્યક્રમ અધ્યતન તેમજ જરૂરીયાત અનુસારનો બની રહે એ રીતે સુધાર્યો છે આમ તો અભ્યાસ સામગ્રીનું ઉત્પાદન એ NIOS કાર્યક્રમો મુક્ત વિદ્યાલયી કે દૂરવર્તી શિક્ષણનો એક સર્વાંગી તથા અતિઆવશ્યક ભાગ ગણાય. એ ન્યાયે અમે ખાસ કાળજી રાખીને આ અભ્યાસ સામગ્રી તમારા જેવા ઉપયોગ કર્તા (અભ્યેતાઓ) માટે તે મેત્રીપૂર્ણ, રસપ્રદ તથા અતિઆવશ્યક બની રહે તે માટે પૂરતો પ્રયાસ કર્યો છે.

આ સંદર્ભે અત્રેઆ અભ્યાસ સામગ્રીને રસપ્રદ તથા તમારી જરૂરીયાત મુજબની બનાવવામાં મદદકર્તા તમામ વિષ્યાત વિતજનોનો આભાર માનું છું. આશા રાખું કે તમને પણ તે અસરકારક તેમજ તન્મય કરી દેનાર બની રહેશે.

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાન વતી અત્રે હું આપ સર્વેને અત્યંત ઉજ્જવળ તેમજ સફળ ભાવી માટે શુભકામનાઓ પાઠવું છું.

ડૉ. એસ. એસ. જિતના
અધ્યક્ષશ્રી, NIOS

નિયામક શ્રીની નોંધ

પ્રિય અભ્યેતાઓ / વિદ્યાર્થીઓ

રાષ્ટ્રીય મૂક્ત વિદ્યાલયી સંસ્થાન (NIOS) નો એ હંમેશનો પ્રયત્ન છે કે તે તમને અવાર નવાર નવો તેમજ તમારો જરૂરીયતને પહોંચી વળે તેવો અભ્યાસક્રમ આપે. હવે અમે માધ્યામિક કક્ષાના તમામ વિષયોના અભ્યાસક્રમ સુધારી રહ્યા છીએ. આ સંદર્ભે તમને નવો અભ્યાસક્રમ આપવાના હેતુસર અમે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન) તેમજ વિવિધ રાજ્યોના માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જુદા જુદા વિષયો સંદર્ભે મસલતો યોજી છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું શૈક્ષણિક સંશોધન અને તાલીમ માટેની રાષ્ટ્રીય સંસ્થાને આધારે ઘડાય છે. આમ વ્યાપક અને તુલનાત્મક અભ્યાસ બાદ અમે જીવનને સુસંગત તેમજ સરળ એવાં અભ્યાસક્રમ ઘડીએ છીએ. રાષ્ટ્રના જાણીતા શિક્ષણવીદો / કેળવણીકારોને સાથે લઈને તેમના માર્ગદર્શન અંતર્ગત અમે અભ્યાસક્રમોને સુધારીને અધ્યતન બનાવતા રહીએ છીએ.

આ ઉપરાત અમે શૈક્ષણિક-અભ્યાસક્રમ સાગ્રી પર પણ નજર રાખતા હોઈએ છીએ. અમે એમાંની જૂનીપૂરાણી તથા નકામી થઈ ગયેલી માહિતી રદ કરીને તેની જગ્યાએ નવીન તથા સુસંગત બાબતો તેમાં ઉમેરીને આ અભ્યાસક્રમને આકર્ષક તેમજ અસરકારક બનાવતા રહીએ છીએ. ભારતીય સંસ્કૃતિ અને વારસાનો વિષય વાસ્તવમાં રસપ્રદ અને આનંદદાયક છે જેનાથી તમને નવાં નવાં ક્ષેત્રોમાં આપણા દેશના પ્રદાનનો ખ્યાલ આવશે.

મને આશા છે કે અત્રે તમારા માટે ઘડાઈ રહેલ આ અભ્યાસ સામગ્રી સાચેજ રસપ્રદ અને નવું જાણવાની ઉત્કંઠાવાળી બની રહેશે. આ સંદર્ભે તમારા કોઈપણ સૂચન આવકાર્ય છે.

મારા તરફથી આપ સર્વને સુખી એન સફળતાવીની અભ્યર્થના.

 A.
Kuldeep Patel

(ડૉ. કુલદીપ અગ્રવાહ)

નિયામક શૈક્ષણિક

આપની સાથે બે બોલ

પ્રિયવિદ્યાર્થીઓ,

નામામ વિષયને માધ્યમિક સ્તરેરજૂ કરતા હું હર્ષની લાગણી અનુભવુ છું . નામામ વિષયમાં આપ સૌનું સ્વગત છે.

તમે જાણો છો કે નામાની વિવિધ પ્રવૃત્તિઓવચ્ચે પ્રત્યક્ષકે પરોક્ષ સંબંધ છે. આપડી આજુબાજુના વાતાવરણથીઆપણે ઘણું બધું શિખવા મળે છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને બદલા તાવાતાવરણ યોગ્ય વાતાવરણ જ્ઞાન મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નામાનો પરિચય, આમનોંધ, પેટાનોંધ, ખાતાવહી, કાચું સરવૈયું, ઘસારો, વાર્ષિક છિસાબો અને કોમ્પ્યુટર નામું જેવા પાઠોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વિષયમાં હ મોડ્યુલ્સ આપવામાં આવ્યા છે. જેમાં નામાનો પરિચય આમનોંધ, ખાતાવહી કાચું સરવૈયું, ઘસારો, અનામત અને જોગવાઈ, નાણાંકીય પત્રકો અને કોમ્પ્યુટર નામું, દરેક પાઠને વિદ્યાર્થીઓ વાંચી સમજી શકે તે રીતે તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં સાદી ભાષા, સુવ્યવસ્થિત ચિત્રો અને કોઠાઓ આપવામાં આવ્યા છે. જે વિષય વસ્તુને યોગ્ય રીતે પ્રસ્તુત કરે છે. તે સાથે સ્વાધ્યાયમાં એક વાક્યમાં જવાબ આપો, ખરા પાઠની પાછળ પ્રશ્નોના છેલ્લા જવાબો પણ આપવામાં આવ્યા છે.

મને આશાથેકેઆ પાઠ તમને પસંદ પડશે અને તમારા જ્ઞાનમાં વધારો કરશે તેથી પરીક્ષાની તૈયાર સારી રીતે થઈ શકશે.

પરીક્ષામાં નામાનું પેપર ૧૦૦ ગુહાનું હોયછે. એક આદર્શ પ્રશ્ન પત્ર છેલ્લે આપવામાં આવ્યું છે. તેના ગુણ પ્રદાન યોજના પણ દર્શાવવામાં આવી છે. જે તમે તમારી જ્ઞાન ચકાસણી કરી શકશો. તમે તમારા જવાબો ગુણ પ્રદાન યોજના સાથે સરખાવી તુલનાત્મક અભ્યાસ કરી શકશો.

તમને સૌને ભવિષ્યના પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ.

ડૉ. પિયુશ પ્રસાદ

એકેડમીક ઓફિસર

રાખ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાન

alkaranipiyush@rediffmail.com

અભ્યાસ સામગ્રીના ઉપયોગની રીત

અભિનંદન, હવે તમે સ્વયં અભ્યાસુ બનવાનો પડકાર સિવિકાર્યો છે. NIOS એ પ્રત્યેક ડગલે અને પગલે તમારી સાથે રહીને માનસશાસ્ત્રીય ફલે, નિષ્ણાતોની સહાયથી તમને ધ્યાનમાં રાખીને અભ્યાસ સામગ્રી તૈયાર કરી છે. સ્વયંશક્ષણના માળખાનું અને અનુસરણ કરવામાં આવેલ છે. જો અને આપેલી સૂચનાઓ ધ્યાનમાં રાખશો તો તમે તેનો મહત્વમાં લાભ ઉઠાવી શકશો. અભ્યાસ સામગ્રીમાં અને નીચે દર્શાવેલ ચીન્હો તમને ચોક્કસ માર્ગદર્શક બની રહેશે.

શિર્ષક (મથાળુ): તેમાં સમાવિષ્ટની સ્પષ્ટ સૂચના આપે છે. માટે તે અવશ્ય વાંચવુ.

પ્રસ્તાવના : એ તમને પાઠથી અવગત કરાવશે અને સાથેસાથે ગત પાઠ સાથે સાંકળી પણ રાખશે.



હેતુઓ / ઉદ્દેશ્યો: તે પાઠના અભ્યાસ બાદ નિષ્પન્ન થયેલા (નીપજેલા) અને અપેક્ષિત જ્ઞાનની કેફિયત આપશે. જે તમે મેળવી ચૂક્યા હોવાથી તેને અવશ્ય વાંચીને ખાત્રી કરો કે તમે તે મેળવ્યું છો (કે નહીં?)



નોંધ : પ્રત્યેક પૃષ્ઠની બાજુમાં હાંસીયામાં પૂરતી જગ્યા આપવામાં આવી છે. જેથી તમે ત્યાં જરૂરી મુદ્દા કે નોંધ ટપકાવી શકો.



પાઠસંલગ્ન પ્રશ્નો : પ્રત્યેક વિભાગને અંતે ઘણા ટૂંકા અને જાતે જ તૈયાર કરી શકાય તેવા પ્રશ્નોનારો આપેલ છે. જે તમને તમારી પ્રગતિ ચકાસવામાં મદદરૂપ બનશે. તેને જરૂરથી ઉકેલશો (હલ કરશો) એની સફળ પૂર્ણતાથી તમને ધ્યાલ આવશે કે તમે આગામનો અભ્યાસ શરૂ કરી શકો તેમ છો કે તમારે જે તે પાઠનો ફરી અભ્યાસ કરવો જરૂરી છે.



તમે શું શીખ્યા ? : એમાં તમને પાઠના મુખ્ય મુખ્ય મુદ્દાઓ ટૂંકમાં આપ્યા છે. જે તમને પાઠનો સારાંશ જ્ઞાવાવી પુનરાવર્તન કરાવશે. તેમાં તમને તમારા પોતાના મુદ્દા પણ તુંબાની છૂટ છે.



પાઠના પ્રશ્નો: આ એવા લાંબા અને ટૂંકા પ્રશ્નો છે જે તમને સમગ્ર પાઠની સ્પષ્ટ સમજ આપવા માટેની તક પૂરી પાડશે.



શું તમે જાણો છો? : આ ખાનું તમને વધારાની માહિતી પૂરી પાડે છે. ખાનામાંની વિગતો અગત્યની હોય છે અને તેના પર ધ્યાન આપવું જોઈએ. તે મૂલ્યાંકન માટે નથી તે ફક્ત તમારું સામાન્ય જ્ઞાન વધારવામાટે છે.



જવાબો : તમે પ્રશ્નોના જવાબ કેટલા સાચા આપ્યા છે, તે જાણવામાં મદદરૂપ થશે.



પ્રવૃત્તિઓ : વિચારને (ધ્યાલને) પૂર્ણ કરવાના આશયથી કેટલીક પ્રવૃત્તિઓની ભલામણ કરવામાં આવી છે.

વેબસાઈટ : વેબસાઈટ તમને વધારાનો અભ્યાસ પૂરો પાડે છે. જેમાં જરૂરી માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે. તમે વધુ જાણકારી મેળવવામાટે તેનો ઉપયોગ કરી શકો છો.

વિષયસૂચિ

મોડ્યુલ-૧: પરિચય અને મૂળભૂત સિદ્ધાંતો

પાઠ ૧	નામાનો પરિચય	૧
પાઠ ૨	નામાનાં સિદ્ધાંતો	૧૮
પાઠ ૩	પરિભાષિક શબ્દો	૩૩

મોડ્યુલ-૨: આમ નોંધ અને પેટા નોંધ

પાઠ ૪	હિસાબી સમીકરણ	૪૫
પાઠ ૫	દ્વિનોંધી નામાપદ્ધતિ	૫૨
પાઠ ૬	આમનોંધ	૮૬
પાઠ ૭	રોકડ મેળ	૧૦૪
પાઠ ૮	બંક સિલક મેળ	૧૨૮
પાઠ ૯	ખરીદ અને વેચાણ નોંધ	૧૪૭

મોડ્યુલ-૩: ખતવણી અને કાચું સરવૈયું

પાઠ ૧૦	ખતવણી	૧૬૮
પાઠ ૧૧	કાચું સરવૈયું અને હિસાબી ભૂલો	૧૮૩

મોડ્યુલ-૪: ઘસારો, અનામત અને જોગવાઈ

પાઠ ૧૨	ઘસારો	૨૦૮
પાઠ ૧૩	અનામત અને જોગવાઈ	૨૨૮

મોડ્યુલ-૫: નાણાંકીય પત્રકો તૈયારકરવા

પાઠ ૧૪	નાણાંકીય પત્રકો (હવાલાવગર)	૨૪૦
પાઠ ૧૫	નાણાંકીય પત્રકો (હવાલા સાથે)	૨૪૮

મોડ્યુલ-૬: કોમ્પ્યુટર પર નામું

પાઠ ૧૬	કોમ્પ્યુટર પર નામું	૨૭૮
પાઠ ૧૭	ટેલીનો પરિચય	૨૮૮
	નમૂનાનો પ્રશ્નપત્રક	૨૯૬
	ગુણ પ્રદાન	૩૦૩

મોડયુલ -૧

મહિતામ ગુણ

૨૦

અભ્યાસના કલાકો

૪૮

પરિચય અને પાયાની સંકલપનાઓ

આધુનિક સમાજમાં નામું અનિવાર્ય બની ગયું છે. આ મોડયુલ વિદ્યાર્થીઓને નામાના વિવિધ પારિભાષિક શબ્દોનો અર્થ, નામાનો અર્થ, ઉદેશો અને હિસાબી ચોપડા લખવા (લેખીત નોંધ) તથા નામાના લાભ અને મર્યાદાઓ અને બંને વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરશે. મોડયુલ શીખનારનો નામાના કોગમાં વપરાતા વિવિધ પારિભાષિક શબ્દો અને વ્યવહારોની સમજ આપશે અને મેળવેલા જ્ઞાનના આધારે તે નામું લખવાનું શીખશે.

પ્રકરણ-૧ : નામાનો પરિચય

પ્રકરણ-૨ : નામાની સંકલપનાઓ અને વ્યવહારો

પ્રકરણ-૩ : નામાના પારિભાષિક શબ્દો

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકળપનાઓ



નોંધ

નામાનો પરિચય

૧

નામાનો પરિચય

તમે હુકાનદારને માલ વેચીને નફો મેળવતા જોયા જ છે. હુકાનદાર રોકટેથી કે શાખ પર માલ વેચે છે, વિતરક (સાખાયર) પાસેથી માલ ખરીદે છે. લાઈટ બિલ, ટેલિફોન બિલ કે કામદારને વેતન ચુકવે છે... વગેરે આ બધા જ ધંધાકીય વ્યવહારો છે જેમાં નાણા સંકળાયેલા છે. રોજેરોજ આ પ્રકારના વ્યવહારો મોટી સંખ્યામાં થતા હોય છે. ધંધાદારી ધંધાના બધા જ વ્યવહારોને મૌખિક રીતે યાદ રાખી શકતો નથી તેથી તે વ્યવહારોની લેખીત નોંધ (હિસાબી ચોપડા લખે છે) રાખે છે કે જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકે. વેચાણ કર્તા હિસાબી મુદતના અંતે (સામાન્ય રીતે એક વર્ષના અંતે) ધંધામાં કેટલી કમાણી થઈ તે આજવા ઈચ્છે છે. વેચાણકર્તાને પોતે કેટલી રકમ વિતરકને ચુકવી અને તેના ગ્રાહકોએ તેને કેટલી રકમ ચુકવી એ પણ આજવા માંગે છે. જો વેચાણ કર્તા વર્ષ દરમ્યાન કરેલા ધંધાના વ્યવહારોની લેખીત નોંધ વ્યવસ્થિત રીતે રાખતો હશે તો તેને આ પ્રકારની અન્ય માહિતી પણ મળી રહેશે. આને હિસાબી ચોપડો જાળવવો (બુક ક્રીપીંગ) કરે છે. આ હિસાબી ચોપડાની માહિતીને વર્ગીકરણ કરી ઢૂંકા સાર સાથે પદ્ધતિસર નોંધવાની જરૂર પડે છે. આને નામું કહે છે આ પ્રકરણમાં તમારે હિસાબી ચોપડા જાળવવાના તથા નામાનો ઉપયોગ, અર્થ અને ઉદેશો શીખવાના છે.



હેતુઓ :

આ પ્રકરણનો અભ્યાસ કરીને તમે...

- ધંધાકીય વ્યવહારોનો અર્થ સમજાવી શકશો
- હિસાબી ચોપડા જાળવવાનો અર્થ સમજાવી શકશો
- હિસાબી ચોપડા જાળવવાની જરૂરીયાત જાણી શકશો
- હિસાબી ચોપડા જાળવવાના ઉદેશોનું વર્ણન કરી શકશો
- નામું ની વ્યાખ્યા કરી શકશો
- નામાની વિવિધ શાખાઓ સમજાવી શકશો
- નામાના ઉદેશોની ચર્ચા કરી શકશો
- નામાના લાભ અને મયર્યાદાઓ જણાવી શકશો
- હિસાબી ચોપડા જાળવવા અને નામા વચ્ચેનો તફાવત જણાવી શકશો



નોંધ

- નામાની માહિતીનો ઉપયોગ કરનારા લોકોને તથા નામાની વિવિધ માહિતીનો ઉપયોગ કરવાનું જાણી શકશો

૧.૧ ધંધાકીય વ્યવહારો

તમે તમારા ધરમાં થતા વિવિધ વ્યવહારો જુઓ છો. ઉદાહરણ તરીકે, શાકમાળની ખરીદી, શાળાની ફીની ચુકવણી, ટેલિફોન બિલની ચુકવણી, ભાડાની ચુકવણી વગેરે.. ધરમાં જેમ અનેક વ્યવહારો થાય છે તેમ ધંધામાં એના કરતા અનેક ગણા વ્યવહારો થાય છે.

ચાલો, આપણે નજીકની સ્ટેશનરીની હુકાનની ગતિવિધિઓનું અવલોકન કરીએ. એક ગ્રાહક આવે છે, તે રજીસ્ટરની ખરીદી કરી તેના નાણા ચુકવે છે, ત્યારબાદ બીજો ગ્રાહક આવે છે. તે પાઠ્યપુસ્તકની ખરીદી કરી તેના નાણા ચુકવે છે. થોડા સમય બાદ તીજો ગ્રાહક આવીને સ્ટેશનરીની અલગ અલગ વસ્તુઓ ખરીદે છે, જેવી કે લખવા માટેનું પેડ, પેન્સીલ, પેન.. વગેરે. આ બધો સામાન તે શાખ પર (ઉધાર) ખરીદે છે પછી વિતરક (સપ્લાયર) આવે છે. તે વિવિધ સ્ટેશનરીની વસ્તુઓ લઈને આવે છે અને હુકાનદારને તેનું બીલ આપે છે. હુકાનદાર બીલ લે છે અને એક મહિના પછી બીલના નાણા ચુકવવાની ખાતરી આપે છે. આ બધા ધંધાના કેટલાક મહત્વના વ્યવહારો છે. ધંધામાં આવી કેટલીયે ગતિવિધિઓ થતી હોય છે. તમે એ પણ જોયું હશે કે આ બધા ધંધાકીય વ્યવહારોમાં માલના બદલામાં નાણાની ચુકવણી કે ભવિષ્યમાં ચુકવણીની ખાતરી સંકળાયેલી છે. આ વ્યવહારોમાં કેટલીક મહત્વની લાક્ષાણિકતાઓ છે જે નીચે મુજબ છે.

- ૧) ધંધાકીય વ્યવહારો એ ધંધાકીય પ્રવૃત્તિ છે
- ૨) ધંધાકીય વ્યવહારોમાં માલ (વસ્તુ) કે સેવા (જેવી કે વાહનવ્યવહાર, સંગ્રહ કરવો, પેકીંગ વગેરે) ની લેવડેવડ સંકળાયેલી હોય છે જે નાણા માટે અથવા નાણાની સમકક્ષ વસ્તુ માટેકરવામાં આવે છે.
- ૩) આ બધા વ્યવહારો નાણામાં મૂલ્ય આંકી શકાય તેવા પ્રકારના હોય છે
- ૪) રોકડ ધંધાકીય વ્યવહારોમાં માલ કે સેવા નાણાનાં બદલામાં મેળવવામાં આવે છે.
- ૫) શાખ (ઉધાર) પરના ધંધાકીય વ્યવહારોમાં માલ કે સેવા મેળવવામાં આવે છે પરંતુ નાણાની ચુકવણી કે નાણાની પ્રામી ભવિષ્યમાં થતી હોય છે.
- ૬) બધા જ ધંધાકીય વ્યવહારોની નોંધ નામાના ચોપડામાં કરવામાં આવે છે.

મોડચુલ - ૧

પરિચય અને પાણીની
સંકલ્પનાઓ



નોંધ

નામાની પરિચય

તમે કદાચ નોંધ્યું હશે કે ઉપરોક્ત ધંધાકીય વ્યવહારો ગાણિત (આઉટસાઇડ) સાથે કરવામાં આવે છે. કેટલીક વાર ધંધાકીય વ્યવહારો માલિક સાથે પણ થાય છે. ઉદાહરણ તરીકે નયને રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડ મૂડીથી નાની હુકાન શરૂ કરે છે આના બદલામાં માલિક નયનને ધંધાના માલીકીપણાના હક મળે છે. બીજુ ઉદાહરણ જુઓ, નયન રૂ. ૫૦૦૦/- નો માલ પોતાના અંગત વપરાશ માટે હુકાનમાંથી લે છે. આ એક પ્રકારનો ધંધાકીય વ્યવહાર છે. અહીં માલીક રૂ. ૫૦૦૦/- ની ડિમ્પટનો માલ મેળવે છે, જ્યારે ધંધાનો માલીક પાસેથી રૂ. ૫,૦૦૦/- મેળવવાનો હક છે. તમે એમ કહી શકો કે ધંધાકીય વ્યવહારો ગાણિત અને માલીક સાથે સંકળાયેલા છે. હવે ધંધાકીય વ્યવહારોની વ્યાખ્યા આ મુજબ કરી શકાયઃ માલ, સેવા કે અન્ય કોઈપણ પ્રવૃત્તિ નાણા કે નાણાના જેટલા જ મૂલ્યના બદલામાં કરવામાં આવે છે તેમાં નાણાની સાટાપદ્ધતિ (બદલા પદ્ધતિ) પણ સંકળાયેલી હોય છે. સાદા શબ્દોમાં કહીએ તો આર્થિક (નાણાકીય) સ્વરૂપની તમામ પ્રવૃત્તિઓ કે વ્યવહારોનો સમાવેશ ધંધાકીય પ્રવૃત્તિમાં થાય છે.

તમે જાણો છો કે એક ધંધાદારી / વેપારી / દિવસ દરમ્યાન વિવિધ વ્યવહારો કરે છે જે માના કેટલાક વ્યવહારો તેના અંગત હેતુઓ માટેના હોય છે. ઉદાહરણ તરીકે નયન પોતાના ભિત્રો સાથે ડિલ્મ જોવા જાય છે. આ તેનો અંગત વ્યવહાર છે અને તે ધંધાકીય વ્યવહાર નથી. ધંધાકીય વ્યવહાર એ છે કે જે ધંધા પર અસર કરે છે. આથી ધંધાકીય વ્યવહારની નોંધ ધંધાના ચોપડે કરવામાં આવે છે. માલીકે કરેલા અંગત વ્યવહારો જેનાથી ધંધાના નાણા પર કોઈ અસર થતી નથી તેની નોંધ ધંધાના ચોપડામાં કયાંય કરવામાં આવતી નથી. ધંધાકીય વ્યવહારો અને અંગત વ્યવહારોને અલગ તારવવાની બાબત ધંધાકીય વ્યવહારની લેખીતા નોંધ કરવામાં ઘણી મદદરૂપ બને છે.



પાઠ સ્વાધ્યાય ૧.૧

- ૧) નીચે આપેલા વિધાનોમાં સાચું વિધાન તથા ખોણું વિધાન શોધો.
- ૨) હુકાનમાં જ એક જગ્યાએથી બીજુ જગ્યાએ માલ ખસેડ્યો એ ધંધાકીય વ્યવહાર છે
- ૩) નફો એ માલીકનો તેની ધંધાકીય પ્રવૃત્તિ માટે મળતો બદલો છે.
- ૪) ભિત્ર પાસેથી અંગત ઉપયોગ માટે શાખ (ઉધાર) પર માલની ખરીદી એ અંગત વ્યવહાર છે
- ૫) નીચેના વ્યવહારોને આર્થિક વ્યવહાર અને બીજા-આર્થિક વ્યવહારમાં વર્ગીકૃત

નામાનો પરિચય

કરો.

- ૧) રફ્ફેક્ટ રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડથી ધંધો શરૂ કર્યો
- ૨) તેણે રૂ. ૫૦,૦૦૦/- બેંકમાં જમા કર્યા
- ૩) રૂ. ૧૦,૦૦૦/-નો માલ રોકડથી ખરીદો
- ૪) તેણે પોતાની પત્નીને સાડી ખરીદવા સારુ રૂ. ૧,૦૦૦/- હુકાનના નાણામાથી આપ્યા
- ૫) તેણે કૌટુંબીક પ્રસંગમાં હાજરી આપી અને રૂ. ૩,૦૦૦/-ની કિંમતની ભેટ મળી
- ૬) તેણે પોતાના વેર કામ કરતા નોકરને પોતાના ખીસ્સામાંથી રૂ. ૫૦૦/- પગારના ચુકવ્યા

મોડચુલ - ૧
પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



૧.૨ ચોપડો લખવો / લેખીત નોંધ રાખવી

કેટલાક લોકો ચોપડો અને નામું બંનોને એકસમાન ગણે છે પણ લેખીત નોંધ રાખવી (ચોપડી લખવી) અને નામું બંનો એકમેકથી જુદા છે. લેખીત નોંધ મુખ્યત્વે આર્થિક માહિતીની નોંધ છે કે જે વ્યવહાર ધંધાકીય રીતે નોંધપાત્ર છે અને કમિક છે. લેખીત નોંધ નાણાકીય વ્યવહારોની પદ્ધતિસરની નોંધ છે અને તે સંસ્થાની નાણાકીય નોંધ સચોટ અને અપણું રાખે છે. જ્યારે નામું મૂળભૂત રીતે (પ્રાથમિક રીતે) માહિતીની પદ્ધતિસરની નોંધ, માહિતીનું વગ્નિકરણ અને માહિતીનું તારણ છે તથા ધંધાના આંતરીક અને બાહ્ય વપરાશકારો માટેનું અર્થઘટન છે. છિસાબનીશ (એકાઉન્ટન્ટ) હંમેશા લેખીત નોંધ રાખનારાને દિશાસૂચન કરે છે તથા તેના કાર્યનું વિશ્લેષણ કરે છે.

લેખીત નોંધ રાખવાની જરૂરીયાત (અનિવાર્યતા)

ધંધાકીય વ્યવહારોની નોંધ રાખવાની પારદર્શક પદ્ધતિ કે જે ધંધાના વ્યવહારોને સ્પષ્ટ બનાવી રાખે તે ધંધા માટે મહત્વપૂર્ણ બાબત છે. લેખીત નોંધ રાખવાની જરૂરીયાતને નીચે મુજબના મુદ્દાઓને આધારે સમજ શકાય.

- એ.) આર્થિક સ્થિતિની આકારણી કરવામાં મદદરૂપ બને છે : ધંધાકીય વ્યવહારોની નોંધ રાખવાથી ધંધાદારીને તેના ધંધાની નાણાકીય સફળતા અને નિષ્ફળતા ઉપર નિયમના રાખવામાં ધંધાકીય વ્યવહારોની લેખીત નોંધ મદદરૂપ બને છે. તમે પોતે કયાં છોતેની તમને જણ ન હોય તો તમે કયાં જશો / જઈ રહ્યા



મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ



ઇથોતે જાણી શકશો નહીં. એટલા માટે ધંધાના હેતુઓ સિદ્ધ કરવા અને અણધાર્ય નુકસાનથી બચવા માટે ધંધાની વર્તમાન આર્થિક સ્થિતિનું ચિત્ર સમજવું ધણું મહત્વનું બની રહે છે.

- બી) ધંધાકીય નિષ્ઠાઓ લેવામાં મદદરૂપ બને છે: લેખીત નોંધ ધંધાના ભવિષ્યના નિષ્ઠાઓ લેવામાં મદદરૂપ બને છે. ધંધાકીય નિષ્ઠાઓ ભૂતકાળમાં પ્રામ થયેલ નાણાકીય પરિણામોને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે અને આ ત્યારે જ શક્ય બને જયારે આપણે હિસાબી ચોપડાઓ વ્યવસ્થિત રીતે નિભાવતા છોય. ચોક્કસ તારણો અને આર્થિક માહિતી વિના સોંપવામાં આવેલ કાર્યની અસરો વિશે અનુમાન કરવું ધણું કઠિન છે.
- સી) આવક વેરાના હેતુઓ માટેની નોંધ તરીકે : ધંધાદારીને હિસાબના ચોપડા રાખવાથી આવક વેરો પરત મેળવવા માટેની રકમ ચોક્કસાઈપ્પુર્વક નક્કી કરવામાં મદદ મળે છે. પ્રત્યેક ધંધાદારીએ અચૂક રીતે આવક વેરામાંથી બાદ મેળવવાની અરજી કરવી પડે છે અને આવક વેરો ચૂકવવો પડે છે. વ્યવસ્થિત નોંધોને કારણે કરવેરાની રકમ નક્કી કરવામાં સરળતા રહે છે અને વિના વિલંબ સમયસર નોંધ કરી શકાય છે.
- ડી) અંદાજપત્ર તૈયાર કરવું : જૂના વ્યવહારોની નોંધ આવનાર વર્ષ (નવા વર્ષ) નું અંદાજપત્ર તૈયાર કરવામાં મદદરૂપ બની રહે છે અંદાજપત્ર ધંધામાં તમને સલામત બનાવી રાખે છે અને બીનજરૂરી ખર્ચ પર કાપ મૂકવા મદદરૂપ બને છે.
- ૪) કરવેરાની આકારણી કરવી : વ્યવસ્થિત રીતે હિસાબોની નોંધ કોઈપણ જાતના વિલંબ વગર પે-રોલ, આવક વેરાની રકમ અને વેચાણ વેરાની રકમ નક્કી કરવામાં મદદરૂપ બને છે જો તમે ભાગીદારીમાં ધંધો કરતા હો તો ધંધાકીય વ્યવહારોની ચીવટથી નોંધ રાખવાથી ભાગીદારીવાળા ધંધામાં નફાની વહેંચણીમાં ઉભા થતા બીનજરૂરી પ્રશ્નોને હુર રાખી શકાય છે.

આમ, સુવ્યવસ્થિત રીતે હિસાબી ચોપડા નિભાવવાથી કઈ પ્રવૃત્તિઓ નફાકારક છે તથા કયા ખર્ચ બીનજરૂરી છે તે નક્કી કરી શકાય છે ધંધાદારી બીનજરૂરી ખર્ચને ટાળી શકે છે અને ધંધાને આર્થિક રીતે સધાર બનાવવાની આશા સાથે અસરકારક અંદાજપત્ર બનાવી શકે છે જો કે બધા જ મફકારના ધંધામાં હિસાબી ચોપડા અતિ મહત્વનો ભાગ ભજવે છે.

નામાનો પરિચય

હિસાબી ચોપડા નિભાવવાના હેતુઓ

હિસાબી ચોપડા નિભાવવાની જરૂરીયાત સમજ લીધા બાદ ચાલો હવે તેના હેતુઓ વિશે ચર્ચા કરીએ.

- એ) ધંધાની કાયમી નાંંધ રાખવી : ધંધાકીય વ્યવહારોની હિસાબી ચોપડે વ્યવસ્થિત રીતે નાંંધ રાખીને વધો સુધી નાંંધ તરીકે સાચવી રાખી શકાય છે.
- બ્લી) ધંધાનો નફો કે નુકશાન (ખોટ) જાણવો : હિસાબી ચોપડે નાંંધાયેલી માહિતીને આધારે વિવિધ પત્રકો (સ્ટેટમેન્ટ) તૈયાર કરાય છે જે આખરી નામુ (ચોખ્ખો હિસાબ) કહેવાય છે આ પત્રકો પેકીનું એક પત્રક કે જેને આવકવેરા પત્રક અથવા નફ-નુકશાન ખાતુ કહેવામાં આવે છે જે ધંધાનો નફો નિશ્ચિત કરવામાં મદદ કરે છે.
- સ્લી) ધંધાની આર્થિક (નાણાકીય) સ્થિતિ જાણી શકાય છે : હિસાબી ચોપડા સરવેયુ (બોલેન્સ સીટ) તૈયાર કરવામાં અને ધંધામાં રોકાણ કરેલી ચોખ્ખી (ખરેખર) મૂડી નક્કી કરવામાં મદદરૂપ થાય છે.
- દી) ધંધામાં થયેલી કુલ ખરીદી અનો કુલ વેચાણની માહિતી પૂરી પાડે છે : ધંધાદારીને ધંધામાં થયેલ કુલ વેચાણ અનો કુલ ખરીદી જાણવામાં રસ છે કે જે તેની વેચાણ અંગોની વ્યૂહરચના (નીતિઓ) માટે નિર્ણય કરવામાં મદદરૂપ બને છે.
- દી) ધંધાના લેઝાદારો અને દેવાદારો અંગોની માહિતી પૂરી પાડે છે : ધંધાદારીને પોતાને કોને અને કેટલું દેવું ચુકવવાનું છે તથા બીજાની પાસે પોતાનું કેટલું દેવું પાછું વાળવાનું બાકી છે તેની માહિતી જાણવામાં હિસાબી ચોપડો મદદ કરશે.
- એફ) માલના પુરવઠાનો જથ્થો અને કિંમત જાણી શકાય છે પુરવઠાની સ્થિતિ જાળવવા સારુ પુરવઠાનો જથ્થો અને કિંમત જાણવા જરૂરી છે જો હિસાબી ચોપડો યોગ્ય રીતે નિભાવવામાં આવ્યો હોય તો જ પુરવઠાની સ્થિતિ નક્કી કરી શકાય.



પાઠ સ્વાધ્યાય ૧.૨

નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો

- ૧) હિસાબી ચોપડો ધંધાકીય વ્યવહારોની પદ્ધતિસર અને મહત્વપૂર્ણ રીતે નાંંધ

મોડચુલ - ૧
પરિચય અને પાયાની
સંકલનાઓ



મોડચુલ - ૧

પરિયય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાનો પરિયય

કરવા સાથે સંકળાયેલ છે.

- ૨) હિસાબી ચોપડો નિભાવવો (લેખીત નોંધ) અને નામું બંને સમાન અર્થ ધરાવતા પારિભાષિક શબ્દો છે.
- ૩) હિસાબી ચોપડો નિભાવવો (લેખીત નોંધ) એ નામું કરતા વિશાળ અર્થ ધરાવતી સંકલ્પના છે.

૧.૩ : નામું

નામાને યોગ્ય રીતે ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ભાષાનું મુખ્ય કાર્ય સંચારના સાધન (માધ્યમ) તરીકે વર્તવાનું છે. નામું ધંધાના હિત સાથે સંકળાયેલા જુદા જુદા પક્ષો (એકમો) વચ્ચે ધંધાકીય વ્યવહારોની માહિતીનું આદાનપ્રદાન કરે છે. નામાની નોંધની મદદથી ધંધાનો નફો કે નુકશાન નક્કી કરી શકાય છે તથા નિશ્ચિત સમયના અંતે (એક વર્ષના અંતે) ધંધાની આર્થિક (નાણાકીય) સ્થિતિ જાણી શકાય છે અને આ પ્રકારની માહિતીની ધંધામાં રસ ધરાવતા દરેક પક્ષકારો (એકમો) વચ્ચે આપ-લે કરી શકાય છે. નામાનું કાર્ય આર્થિક એકમો વિશે મૂળભૂત રીતે નાણાકીય લક્ષણ ધરાવતી સંખ્યાત્મક માહિતી પૂરી પાડવાનું છે કે જે આર્થિક નિષ્ઠાઓ કરવા માટે જરૂરી હોય છે.

અમેરીકન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્ટીફાઈડ પબ્લિક એકાઉન્ટસ (એઆઇસીપીએ) દ્વારા ૧૯૬૧ માં નામાનો અર્થ અને તેની વ્યાખ્યા કરવામાં આવ્યા :

નામું એ આંશિક રીતે પણ નાણાકીય સ્વરૂપના હોય તેવા ધંધાકીય વ્યવહારો અને ઘટનાઓને યોગ્ય રીતે અને નાણાના સંદર્ભમાં નોંધવાની, તેનું વર્ગીકરણ કરવાની અને તારણો કાઢવાની તથા તે પરથી પરીણામોનું વિશ્લેષણ કરવાની કળા છે.

અમેરીકન એકાઉન્ટિંગ એસોસીએશન (એએએ) નીચે મુજબ નામાની વ્યાખ્યા આપે છે

નામું એ આર્થિક માહિતીને ઓળખવાની (પિછાવાની), માપન કરવાની અને તેની આપ-લે કરવાની પ્રક્રિયા છે જે આ માહિતીનો ઉપયોગ કરનારાઓને (સત્ય) હકીકત આધારીત ચુકાદાઓ અને નિષ્ઠાઓ માટેનો અવકાશ પૂરો પાડે છે.

નામાની શાખાઓ : નામાની ગ્રાં શાખાઓ છે

- ૧) નાણાકીય (આર્થિક / હિસાબી) નામું: નાણાકીય નામું ધંધામાં થયેલા નાણાકીય વ્યવહારો, તેના તારણો અને તેના અર્થઘટનની નોંધ કરે છે અને તેના પરિણામો તેનો

નામાનો પરિચય

ઉપયોગ કરનારાઓને પૂરા પાડે છે ચોકકસ (નિશ્ચિત) સમયગાળામાં ધંધામાં થયેલ નફો કે નુકશાન તથા નિયત તારીખે ધંધાની સ્થિતિ દર્શાવે છે.

- બી) પડતર (ખર્ચ) નામુ : તે ઉત્પાદન કરેલ વસ્તુનો ઉત્પાદન ખર્ચ કે પૂરી પાડવામાં આવેલ સેવાઓનો ખર્ચ (મૂલ્ય) નક્કી કરવામાં મદદરૂપ બને છે અને સંચાલકોને નિષ્ણય લેવામાં મદદ કરે છે.
- સી) વ્યવસ્થાપન નામુ : વ્યવસ્થાપન નામુ ભંડળ, ખર્ચ તથા નફો સાથે સંકળાયેલ માહિતી એકઠી કરવાનું કામ કરે છે. તેથી સંચાલકોને નિષ્ણય લેવા સક્ષમ બનાવે છે.

તે હાલના પાઠ્યકમમાં માત્ર નાણાકીય નામાનો અભ્યાસ કરવાના છે.

નામાના હેતુઓ :

નામાના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે

- એ) પદ્ધતિસર નાંધ રાખવી : નામુ નાણાકીય વ્યવહારોની પદ્ધતિસરની નાંધ રાખવાનું કામ કરે છે જેવા કે માલની ખરીદી, માલનું વેચાણ, રોકડની પ્રાપ્તિ અને રોકડ ચૂકવણી
- બી) નફો કે નુકશાન નક્કી કરે છે : નામુ ધંધામાં થયેલ ચોખ્યો કુલ નફો અને નુકશાન નક્કી કરવામાં મદદ કરે છે જો ધંધામાં થતી આવક અને જાવકની નાંધ વ્યવસ્થા રીતે રાખવામાં (કરવામાં) આવતી હોય તો જ હિસાબી મુદતના અંતે નફો કે નુકશાન જાણી શકાય છે.
- સી) ધંધાની આર્થિક (નાણાકીય) સ્થિતી નક્કી કરે છે : ધંધાદારીને માત્ર ધંધાકીય પ્રવૃત્તિઓના પરિણામો જાણવામાંજ નહિ પણ તેની સાથે સાથે તેના ધંધાની નાણાકીય સ્થિતિ શું છે તે જાણવાનો પણ રસ હોય છે. એટલે કે ધંધો હાલ કંઈ સ્થિતિએ છે? બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ધંધાદારીએ પોતાના ધંધા માટે અન્ય પાસેથી ઉછીના નાણા કેટલા લીધા છે (દેવું) અને કેટલા ઉછીના નાણા બીજાઓએ તેની પાસેથી લીધા છે જે વસુલવાના છે તે સ્થિતી જાણી શકાય છે.
- ડી) યોગ્ય નિષ્ણયો લેવા માટે જરૂરી માહિતી પૂરી પાડે છે : ધંધાના માલીક સીવાય જુદા જુદા અન્ય લોકો પણ ધંધાની સ્થિતિ જાણવાની ઈચ્છા રાખે છે જેમ કે આવક વેરાના અધિકારીઓ, સંચાલક મંડળ, બેંક, દેણાદારો વગેરે આ બધા લોકોને નામાની પદ્ધતિ મારફતે તેમની જરૂરીયાત મુજબની અધિકૃત માહિતી પૂરી પાડવામાં આવે છે.

મોડચુલ - ૧
પરિચય અને પાયાની
સંકલનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાના ફાયદા :

- એ) હિસાબો મૌખિક રીતે યાદ રાખવા પડતા નથી : કારણ કે હિસાબી ચોપડે બધા જ નાણાકીય વ્યવહારો (બનાવો)ની નાંખ કરવામાં આવે છે. નામાના ચોપડા એ ઔતિહાસિક પુરાવા (રેકોર્ડ) ની ગરજ સારે છે. કોઈપણ સમયે જરૂરી કોઈપણ માહિતી ખૂબ જ સરળતાથી નાંખોના આધારે મળી શકે છે.
- બી) જરૂરીયાત મુજબ માહિતી મળી રહે છે : ધંધામાં રસ ધરાવતા જુદા જુદા લોકો જેવા કે માલિકો, દેખાદારો, દેવાદારો વગેરે સમયાંતરે જરૂરી માહિતી મેળવે છે કે જે તેઓને નિષ્ણિય કરવામાં મદદરૂપ થાય છે.
- સી) સંચાલકોને ધંધી રીતે સહાય કરે છે : સંચાલકોને પૂરી પાડવામાં આવેલ નામાની માહિતી તેઓને ધંધાના આયોજન અને ધંધાની બધી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા અંગે યોગ્ય નિષ્ણિયો લેવામાં મદદ કરે છે.
- ડી) તુલનાત્મક અભ્યાસ કરવાની સાગવડ (વ્યવસ્થા) પૂરી પાડે છે: નામાની માહિતીની મદદથી ધંધાના ચાલુ વર્ધના દેખાવ અંગેની તુલના તેના ઝુતકાળના દેખાવ સાથે કે તેના જેવા જ ધંધાકીય એકમ સાથે કરી શકાય છે. આ પ્રકારના તુલનાત્મક અભ્યાસ થકી ધંધાના સંચાલકો ઉપયોગી તારણો કાઢે છે તથા ધંધાના દેખાવમાં સુધારો કરવા પ્રયત્નો કરે છે.
- ઇ) આધારરૂપ પુરાવા તરીકે કાર્ય કરે છે : પદ્ધતિસરના ધંધાના હિસાબોની નાંખ (નામાના ચોપડા) વિવાદના તિક્સાઓમાં કોઈમાં પુરાવા તરીકે રજુ કરી શકાય છે અને તેનો પુરાવા તરીકે સ્વીકાર કરવામાં આવે છે.
- એફ) કરવેરાની બાબતો : સરકાર વિવિધ કરવેરા વસૂલ કરતી હોય છે જેવા કે કસ્ટમ ડયુટી, એક્સાઈજ ડયુટી, સોલ્સ ટેક્સ, ઇન્કમ ટેક્સ, વ્યવસ્થિત રીતે નિભાવવામાં આવતા નામાના ચોપડાની હિસાબી માહિતી સરકારી કરવેરાની ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદરૂપ બને છે.
- જ) ધંધાનું મૂલ્ય નક્કી કરે છે : ધંધો વેચવો હોય તેવા પ્રસંગે નામાના ચોપડા (હિસાબો) ધંધાનું ખરુ મૂલ્ય નક્કી કરવામાં મદદ કરે છે.

નામાની મયોદાઓ :

- એ) હિસાબી નામુ વેક્ટિવ્યક નિરૂપણને સ્વીકારે છે: નામુ સંકલ્પનાઓ આધારીત છે અને તે સર્વ સામાન્ય સ્વીકૃત સિધ્યાંતોને અનુસરે છે. પરંતુ કોઈપણ એક વસ્તુ માટે એક કરતા વધારે નિરૂપણના સિધ્યાંતો જોવા મળે છે આ બાબત

નામાનો પરિચય

દ્વિનાંધી નામાપદ્ધતિના સિધાંતો (જાએપી) ના માળખામાં જ વૈકલ્પિક માપદંની પદ્ધતિ સ્વીકારે છે. ઉદાહરણ તરીકે ધંધાનો આખર સ્ટોક નીચેના પેકી કોઈપણ એક પદ્ધતિથી અંદાજવામાં આવે છે. ફોકો (ફસ્ટ ઇન ફસ્ટ આઉટ) લીફો (લાસ્ટ ઇન ફસ્ટ આઉટ) સરાસરી કિંમત પડતર કિંમત વગેરે.... પણ તેના પરથી મળતા પરિણામો તુલનાત્મક હોતા નથી.

- દિસાબી નામુ દિસાબનીશના અંગત પૂર્વઘોની અસરવાળુ હોય છે નામુ વ્યક્તિગત (અંગત) પૂર્વઘોની અસરવાળુ હોય છે જેમ કે એક દિસાબનીશ જે મીટક્ટનું જીવનમૂલ્ય પ વર્ષ અંદાજે તો જ મીટક્ટનું જીવનમૂલ્ય બીજો દિસાબનીશ દ વર્ષ પણ અંદાજે અને મીટક્ટનો ધસારો અંદાજવાની પદ્ધતિ પણ બસે દિસાબનીશની જુદી જુદી હોઈ શકે.
- દિસાબી નામુ બીન આર્થિક (નાણાકીય) વ્યવહારોની નોંધ રાખતુ નથી : દિસાબી નામુ બીન આર્થિક (નાણાકીય) વ્યવહારોની નોંધ રાખતુ નથી. ઉદાહરણ તરીકે ધંધામાં તીવ્ર સ્પષ્ટિનો મુકાબલો ધંધાએ હાંસલ કરેલ યાંત્રીક સંશોધન, કમચારીની પ્રામાણિકતા અને કાર્યક્રમના વગેરે અગત્યની બાબતો પ્રત્યે ધંધાના સંચાલકો ઊંડો રસ ધરાવતા હોવા છતાં નામામાં આ પ્રકારની બાબતોની નોંધ કરવામાં આવતી નથી.
- દિસાબી નામુ સમયાંતરની માહિતી પૂરી પાડતું નથી : દિસાબી નામાની રૂચના એવી છે કે તે પગકો (સ્ટેટમેન્ટ)ના સ્વરૂપમાં (સરવેયુ અને નફો નુકશાન ખાતુ) દિસાબી વર્ષના મુદ્દતના અંતે એટલે કે વર્ષના અંતે માહિતીની જરૂર હોય છે કે જેથી જ્યારે ધંધાનો દેખાવ સારો ન હોય ત્યારે આયોજન કરી શકે અને યોગ્ય પગલા લઈ શકે.

મોડચુલ - ૧

પરિચય અને પાયાની સંકલનાઓ



નોંધ



મોડિયુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાનો પરિચય

૧.૪ લેખીત નોંધ અને નામુ વચ્ચેનો તફાવત :

તફાવતના મુદ્દા	લેખીત નોંધ	નામુ
(૧) હેતુઓ	લેખીત નોંધ (ચોપડો લખવાનો) હેતુ ધંધાકીય વ્યવહારોની નોંધ રાખવાનો છે	નામાનો ધ્યેય ધંધાની માહિતી રાખવાનો, ધંધાની આવકની ગાળતરી કરવાનો અને ધંધાની નાશાકીય સ્થિતિ નકકી કરવાનો તથા ધંધાના તારણો (પરિણામો)
(૨) કાર્ય	લેખીત નોંધનું કાર્ય ધંધાના વ્યવહારોની નોંધ કરવી તેનાં વળ્ણકરણ તેનું તારણ કાઢીને વિશ્લેષણ કરવું અને તેના પરિણામા રજૂ કરવાનું	નામાનું કાર્ય ધંધાના વ્યવહારોની નોંધ કરવી તેનાં વળ્ણકરણ તેનું તારણ કાઢીને વિશ્લેષણ કરવું અને તેના પરિણામા રજૂ કરવાનું
(૩) વ્યાપ	લેખીત નોંધનો વ્યાપ મયોદિત છે	નામાનો વ્યાપ બહોળો છે
(૪) જરૂરી શાનની કક્ષા	આ માટે માત્ર નામાના નિયમોનું શાન હોવું જરૂરી છે.	નામુ લખવા માટે ઉચ્ચ અને ઉંડી સમજ જરૂરી છે
(૫) નોંધ કરવાનો આધાર (પાયો)	ધંધાના વ્યવહારો નોંધવા વાત્યાર અને અન્ય સહાયક દસ્તાવેજો તૈયાર કરવાના હોય છે.	નામુ લખવા માટેના આધારની ગરજ લેખીત નોંધ (હિસાબનો ચોપડો) સારે છે
(૬) તબક્કો (ચરણ)	તે પ્રાથમિક (પ્રાયમરી) તબક્કો (ચરણ) છે	તે અંતિમ (ફાઈનલ) તબક્કો (ચરણ) છે
(૭) સંકળાયેલા		મુખ્યત્વે ઉચ્ચ કક્ષાના લાયકાત ધરાવતા હિસાબી કારકુનો મુખ્યત્વે



નોંધ

૧.૫ નામાની માહિતીનો ઉપયોગ કરનારાઓ (ઉપયોગ કર્તાઓ)

નામુ મૂળભૂત રીતે (પ્રાથમિક રીતે) માલીકો અને સંચાલકો માટે અગત્યતા ધરાવે છે એ સીવાય પણ બીજા લોકો છે જે નામાની માહિતીનો ઉપયોગ કરે છે આ ઉપયોગ કર્તાઓ નીચે મુજબ છે.

- એ) રોકાણકારો અને સક્ષમ રોકાણકારો : જે વ્યક્તિ ધંધામાં રોકાણ કરવા હોય છે તો ધંધાની નફકારકતા અનો આર્થિક સ્થિતિ જાણવાની હિચદા રાખે છે. મૂળભૂત રીતે, રોકાણકારોને ધંધામાંથી મળનાર ડિવીડન્ઝની રકમમાં રસ હોય છે. એ માટે તેઓ ધંધાની નફકારકતાને જાણવાની હિચદા રાખે છે કે જે ધંધાના પાછલા વખોના આવક પગકો (ઇન્કમટેક્શ સ્ટેટમેન્ટ) ના આધારે તેમને પ્રાપ્ત થાય છે.
- બી) લેણદારો : લેણદારો એવી વ્યક્તિઓ છે કે જે ધંધામાં શાખ વધારે છે (માલ કે સેવા પૂરી પાડે છે). તેઓ ધંધાની સ્થિતિ જાણવા હિચદુક હોય છે કે ધંધામાં તેમની સાથે થેલ કરાર મુજબ વ્યાજ અને મૂડીની ચુકવણી નિર્ધારીત સમયે થઈ શકે તેમ છે કે નહિ. તેઓનો મુખ્ય રસ ધંધાના એકમની પ્રવાહિતતા અને નફકારકતામાં રહેલો હોય છે.
- સી) ધંધાના માલીકો (પ્રોપોર્ટર): ધંધાદારીઓ ધંધાના માલીકો છે કે જે નફકાના ઉદ્દેશથી ધંધો શરૂ કરે છે. તેમને પોતાના ધંધાની સ્થિતિ જાણવામાં રસ હોય છે કે નફકો થાય છે કે ખોટ જાય છે ધંધાની નફકારકતા અનો આર્થિક સધ્યરતા ધંધાના માલીકો કે જેમણે પોતાના નાણા ધંધામાં રોકયા છે તેમના માટે પ્રાથમિક રીતે મહત્વની બાબત છે.
- ડી) કર્મચારીઓ : કર્મચારીઓને ધંધાના નાણાકીય પગકો જાણવામાં રસ હોય છે કે જેમાં નફકાની વહેંચણી અનો બોનાસની યોજનાઓની માહિતી હોય છે. ઉપરાંત તેઓ જે કંપનીમાં નોકરી કરી રહ્યા છે તેના શેર તેઓએ ખરીદ કરેલ હોય તેવા કિસ્સામાં તેઓનો આ બાબતોમાં રસ વધી શકે છે. તેઓને વેતનમાં કે પગારમાં વધારો, ઓવર ટાઇમનું ચુકવણું, મેરિકલની સુવિધાઓ અને તેમની માંગ - આ બાબતોમાં રસ હોય છે કેમકે આ બધી બાબતોનો આધાર નફકારકતા છે જે આવક-પગકમાં (ઇન્કમટેક્શ સ્ટેટમેન્ટમાં)



મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાનો પરિચય

દર્શાવવામાં આવે છે.

- ઇ) ગ્રાહકો : તેઓ કંપની ઉત્પાદનની વોરન્ટી પૂરી કરશે કે નહી અને ભવિષ્યમાં પણ ઉત્પાદન ચાલુ રાખશે કે નહીં તથા કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી વસ્તુ કે સેવામાં તેમને કેટલો લાભ મળશે તે જાણવા ઉત્સુક હોય છે.
- એફ) સરકાર : સરકાર ધંધાના એકમના નાણાકીય પત્રકોમાં કરવેરાના ખાતાના પત્રકો, મજૂરીના ખાતા અને કોરોરેટના નિયમોના ખાતા જાણવાનો રસ ધરાવે છે. આનું કારણ એ છે કે સરકારની પ્રવૃત્તિઓ અને કલ્યાણ યોજનાઓ કરવેરા દ્વારા એકનિત થયેલા નાણા પર આધારિત હોય છે તેથી ધંધો નક્કી કરાયેલ કરવેરા સમયસર ભરપાઈ કરે છે કે નહી તે જાણવા તેઓ દર્શાવે છે.
- ગ) સંશોધકો : ધંધાકીય એકમનો અભ્યાસ નાણાકીય દાખિથી કરવાના હેતુસર તથા અર્થતંત્ર પર તેની સમગ્ર અસર શું પડે છે તેનો અભ્યાસ કરવા સંશોધકોને નામાની માહિતીની જરૂર પડે છે. આ માહિતીને આધારે તેઓ નવી નીતિઓ અને આયોજન ઘડી શકે છે.



પાઠ સ્વાધ્યાય ૧.૩

૧) ખાલી જગ્યા પૂરો.

- ૧) નામુ એ..... ની ભાષા છે.
- ૨) નામાના કેવળ એવા જ વ્યવહારોની નોંધ લેવાય છે જે સ્વરૂપના હોય.
- ૩) જગારે..... મયાંદા પૂરી થાય છે ત્યાંથી નામાની શરૂઆત થાય છે
- ૪) અંગત (વ્યક્તિગત) પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે.
- ૫) કેવળ ધંધાકીય વ્યવહારોની જ નોંધ રાખે છે

૨) બાહુ વૈકલ્પિક પ્રશ્નો :

- ૧) નીચેના પેકી કયો નામાનો લાભ છે ?
- એ) તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે
- બી) તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે
- સી) તે વિશ્વાસપાત્ર પુરાવો ઉભો કરવાનું કાર્ય કરે છે

નામાનો પરિચય

- ૧) તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે
- ૨) નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ?
- એ) મૌખિક વ્યવહારનું લેખીત સ્વરૂપ રૂપાંતર છે
- બી) તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે
- સી) તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે
- ૩) ધંધાનું મૂલ્ય (કિંમત) જાળવા મદદ કરે છે
- ૪) નીચેનામાંથી કઈ બાબત નામાની મર્યાદા છે ?
- એ) ધંધાનું મૂલ્ય નક્કી કરે છે
- બી) તે અંગત પૂર્વગ્રહોથી અસર અસ્તા હોય છે .
- સી) તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે
- ૫) તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે
- ૬) હિસાબી ચોપડા લખવાની (લેખીત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચુ છે?
- એ) હિસાબી ચોપડા (લેખીત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે
- બી) હિસાબી ચોપડા એ ખાતાવહીમાં લખવાના વ્યવહારો છે.
- સી) હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની કમાનુસાર કરેલી નોંધ છે
- ૭) ઉપરોક્તમાંથી એક પણ નહીં
- ૮) નફો કે નુકશાન નક્કી કરવાનું કાર્ય :
- એ) નામાનો ઉદ્દેશ્ય છે
- બી) નામાનો લાભ છે
- સી) નામાની મર્યાદા છે
- ૯) નામાની જરૂરીયાત છે
- ૧૦) હિસાબી ચોપડો નોંધે છે કે જે...
- એ) બધા બનાવો ધંધાને અસરકર્તા હોય

મોડચુલ - ૧
પરિચય અને પાયાની
સંકલનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાના પરિચય

- બી) બધા જ ધંધાકીય વ્યવહારો હોય
- સી) ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય
- ડી) કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય
- ૭) નીચેનામાંથી કયો વ્યવહાર ધંધાકીય વ્યવહાર નથી ?
- એ) ધંધાથોર્ઝ ખરીદેલો માલ
- બી) માલનું વેચાણ
- સી) વેચાણ વેરાની ચુકવણી
- ડી) ધંધાના માલીકના ઘરના વેરાની ચુકવણી
- ૮) નીચેનામાંથી કયો લાભ નામાના નથી ?
- એ) ધંધાના દેખાવ (પરફોર્મેન્સ) ની સરખામણી પૂરી પાડે છે
- બી) ભરોસાપાત્ર પુરાવો ઉભો કરવાનું કાર્ય કરે છે
- સી) અંગત પૂર્વિશ્વાસી અસર ચેત્તા હોય છે
- ડી) મૌખિક સ્વરૂપનું લેખીત સ્વરૂપમાં રૂપાંતર છે



તમે આટલું શીખ્યા :

- ધંધામાં સતત વ્યવહારો થતા રહે છે. સમય પસાર થતા ધંધાના તમામ વ્યવહારોને મૌખિક યાદ રાખવા આ પ્રકારના તમામ વ્યવહારોની કુલ અસરથી ગણતરી કરવાનું શક્ય નથી. જેવા કે નફો કે નુકશાન, આથી નામું રાખવાની (લેખીત નોંધ રાખવાની) જરૂરીયાત ઉભી થઈ.
- ધંધાના આંતરિક અને બાહ્ય બંને પ્રકારના લોકોના ઉપયોગ માટે ધંધાકીય એકમની માહિતીની જરૂર રહે છે.
- નામું એ આર્થિક વ્યવહારો અને બનાવોને ઓળખવા (નક્કી કરવું) નાણાના એકમમાં માપવું નોંધવું, વગ્નીકરણ કરવું, તારણ કાઢવું, વિશ્લેષણ કરવું, અર્થઘટન કરવું અને તેના પરિણામો રજૂ કરવાની પ્રકીયા છે.
- નામાના ઉદ્દેશ્યો : પૃથ્વિસર નોંધ રાખવી, નફો કે નુકશાન તથા નાણાકીય સ્થિતિ નક્કી કરવી અને યોગ્ય નિર્ણય કરવા સારુ રસ ધરાવતી વ્યક્તિઓને

નામાનો પરિચય

નામાની માહિતી પૂરી પાડવી.

- છિસાબી ચોપડા નિભાવવા એ નામાનો એક ભાગ છે તે નામાના કાર્યોની નોંધ છે અને તે વળીકરણના તબક્કા સુધી સીમીત છે.
- છિસાબી ચોપડા એ લાંબી યાંત્રિક પ્રક્રિયા છે તેમાં નાણાકીય વ્યવહારોનું વિશ્વેષણ સમાવિષ નથી જ્યારે નામામાં વિવિધ પત્રકો તૈયાર કરવામાં આવે છે, જેવા કે મીલકતાં, દેખુ (જવાબદારીઓ) અને ધંધાના કાર્યશીલતાના પરિણામો.
- જુદા જુદા લોકો જેવા કે માલીકો, સંચાલકો, લેણદારો, ધીરાણ આપનાર, કરવેરા અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ધંધાકીય એકમની નામાની માહિતીમાં રસ ધરાવે છે.
- વ્યવસ્થિત રીતે પદ્ધતિસર નામું લખવાના ઘણા લાભ છે જેવા કે વિશ્વાસપાત્ર પુરાવો રજુ કરવાનું કાર્ય, ચુકવવાપાત્ર કરવેરાની જવાબદારી નક્કી કરવામાં મદદ કરે છે. નામું ઘણી મર્યાદાઓ પણ ધરાવે છે જેવી કે અંગત પૂર્વઘણોની અસર પડે છે. ધંધામાં મહત્વ ધરાવતા બીન આર્થિક વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી વગેરે.



પાઠ્યાંત સ્વાધ્યાય :

- 1) છિસાબી ચોપડા (લેખીત નોંધ) નિભાવવાનો અર્થ શો ? છિસાબી ચોપડા રાખવાની જરૂરીયાત જણાવો
- 2) નામાની વ્યાખ્યા આપો તેના ઉદ્દેશો કયા કયા છે ?
- 3) સરકાર અને રોકાણકારોને નામાની માહિતી કઈ રીતે ઉપયોગી છે ?
- 4) નામું અને છિસાબી ચોપડા (લેખીત નોંધ) વચ્ચેનો તફાવત શોધો
- 5) નામાના લાભ અને મર્યાદાઓ સમજાવો
- 6) ધંધાકીય વ્યવહાર એટલે શું ? તેના પાંચ ઉદાહરણ આપો
- 7) નામાની વિવિધ શાખાઓ સમજાવો
- 8) કર્મચારીઓને નામું કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો

મોડચુલ - ૧

પરિચય અને પાયાની સંકલનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાના પરિચય



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

૧. ૧ (૧) (૧) ખોટુ (૨) સાચુ (૩) સાચુ (૪) સાચુ
(૨) (૧) ધંધાકીય (૨) ધંધાકીય (૩) ધંધાકીય (૪) બીજી ધંધાકીય (૫) બીજી ધંધાકીય
(૬) બીજી સંધાકીય
૨. ૨ (૧) સાચુ (૨) ખોટુ (૩) ખોટુ (૪) ખોટુ
૩. ૩ (૧) (૧) ધંધાકીય (૨) નાણાકીય (૩) હિસાબી ચોપડા (૪) હિસાબી નામુ
(૫) હિસાબી ચોપડા
- (૨) (૧) સી (૨) સી (૩) બી (૪) સી (૫) એ (૬) બી (૭) કી (૮) સી

તમારા માટે પ્રવૃત્તિ :

બે નાની ધંધાકીય સંસ્થાઓની મુલાકાત લો તેમના હિસાબનીશ તથા હિસાબનીશ અધિકારીઓને મળો તેમની ખાતા લખવાની પ્રવૃત્તિઓને જાણો.



નામાની સંકલ્પનાઓ (પારિભાષિક શબ્દો) અને વ્યવહારો

ગત પ્રકરણમાં તમે છિસાબી નામાનો અર્થ અને ઉદ્દેશો વિશે અભ્યાસ કર્યો. કેટલાક નામાની કેટલીક સંકલ્પનાઓ અને વ્યવહારો એવા છે જેને લાંબાગાળા સુધી અનુસરવામાં આવે છે. આ સંકલ્પનાઓ નામાનો મૂળભૂત પાયો રચે છે. આ બધી સંકલ્પનાઓ (પારિભાષિક શબ્દો) વર્ણના અનુભવથી સિધ્ય થયા છે અને તેથી તે સાર્વત્રિક સ્વીકૃત નિયમો છે અને તે નામાના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતો (Generally Accepted Accounting Principle) (GAAP) તરીકે ઓળખવામાં આવે છે. નામામાં જ્યારે ખાતાના ચોપડાઓમાં વ્યવહારોની નોંધ કરવામાં આવે છે ત્યારે ઘણી બધી સંકલ્પનાઓ અને વ્યવહારોનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકરણમાં તમે નામાની સંકલ્પનાઓ અને વ્યવહારો શીખશો.



હેતુઓ :

આ પ્રકરણના અભ્યાસ દ્વારા તમે નીચેની બાબતો કરી શકશો.

- નામાની સંકલ્પનાઓ (પારિભાષિક શબ્દો) નો અર્થ સમજવો.
- નામાની મહત્વની (નોંધપાત્ર) સંકલ્પનાઓ સમજ શકશો : જેવી કે ધંધકીય એકમ, નાણાનો માપદંડ, ચાલુ એકમની સંકલ્પના અને બેવડી અસર.
- નામાના વ્યવહારોનો અર્થ સમજ શકશો.
- નામાની સંકલ્પનાઓ જેવીકે એકસૂત્રતાનો સિધ્યાત, સાર્થકતાનો સિધ્યાત અને રૂઢીચુસ્તતાના સિધ્યાતનો અર્થ અને મહત્વ સમજ શકશો.

૨.૧ નામાની સંકલ્પનાઓ

નામાની સંકલ્પનાઓ એવા મૂળભૂત અંદાજો, નિયમો અને સિદ્ધાંતો સાથે સંકળાયેલ છે કે જે રોજબરોજના ધંધકીય વ્યવહારોની નોંધ કે નામું તૈયાર કરવામાં આધાર કે પાયા તરીકે કામ કરે છે.

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાની સંકલ્પનાઓ (પારિબાધિક શાદી) અને વ્યવહારો

નામાની મુખ્ય સંકલ્પનાઓ :

- ધંધાકીય એકમની સંકલ્પના
- નાણાંકીય માપનાની સંકલ્પના
- ચાલુ એકમની સંકલ્પના
- વ્યવહારોની બેવડી (દ્વિ) અસરની સંકલ્પના

૨.૨ ધંધાકીય એકમની સંકલ્પના

આ સંકલ્પના એમ માને છે કે, નામાના હેતુઓના સંદર્ભમાં ધંધાકીય એકમ અને તેના માલિકો બંને જુદાં એકમો છે. જેથી, માલિકોના ધંધાકીય અને અંગત વ્યવહારો અલગ ગણાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે ધંધાનો માલિક ધંધામાં નાણાંતુ રોકાણ કરે છે ત્યારે ધંધામાં તેની નોંધ ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી તરીકે થાય છે. એ જ રીતે, માલિક જ્યારે રોકડ/માલ ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે લે છે ત્યારે તે ધંધાકીય ખર્ચ ગણાતો નથી. આમ, નામાની નોંધ નામાના ચોપડામાં ધંધાકીય એકમના દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે, નહિ કે માલિકના દ્રષ્ટિકોણથી. ચાલો એક ઉદાહરણ તપાસીએ, કુ. સાંક્ષીર્ણ રૂ. ૨,૦૦,૦૦૦ થી ધંધો શરૂ કર્યો. તેણીએ રૂ. ૨૦,૦૦૦ નો માલ ખરીધો, રૂ. ૧૦,૦૦૦ નું ફર્જિયર ખરીધું, રૂ. ૫૦,૦૦૦ નાં ખાન્ટ અને મશીનરી ખરીધાં અને રૂ. ૧૦,૦૦૦ હાથ પર સિલક રહી. આ બધું ધંધાની મિલકતા છે નહિ કે ધંધાના માલિકની. ધંધાકીય એકમની સંકલ્પના મુજબ રૂ. ૨,૦૦,૦૦૦ એ ધંધાની મૂડી ગણાશે, કે જે ધંધાનું ધંધાના માલિક પ્રત્યેનું દેવું (જવાબદારી) છે.

હવે તેણીએ ધંધામાંથી પોતાના ઘર વપરાશને માટે રૂ. ૫,૦૦૦ રોકડા અને રૂ. ૫,૦૦૦ નો માલ લે છે. તેણીએ ધંધામાંથી જે રોકડ અને માલ ઉપાડ્યાં તે તેણીનો અંગત ખર્ચ છે તે ધંધાનો ખર્ચ નથી. આ ઉપાડ તરીકે ઓળખાય છે. આમ, ધંધાકીય એકમની સંકલ્પના જણાવે છે કે ધંધો અને ધંધાના માલિક એ બે બિના એકમો છે. આ પ્રમાણે ધંધાના માલિકે પોતાના માટે કે પોતાના કુટુંબ માટે કરેલો ખર્ચ એ ધંધાના ખર્ચ તરીકે નહિ પરંતુ ઉપાડ તરીકે ગણવામાં આવશે. જો કે ધંધો અને તેનો માલિક આ સંકલ્પના મુજબ બે બિના એકમ ગણવામાં આવતાં હોવાથી નામાના ચોપડામાં બંને વચ્ચે થયેલા વ્યવહારો નોંધવામાં આવે છે.

મહત્વ :

ધંધાકીય એકમની સંકલ્પનાના નીચેના મુદ્દા તેના મહત્વ વિશે જણાવે છે.

- આ સંકલ્પના ધંધાનો નજો નક્કી કરવામાં મદદ કરે છે કારણકે ફક્ત ધંધાકીય ખર્ચ અને ઉપજની જ નોંધ કરવામાં આવે છે અને અંગત અને વ્યક્તિગત વ્યવહારોને અવગાણવામાં આવે છે.
- આ સંકલ્પના હિસાબનીશને માલિકના અંગત કે વ્યક્તિગત ખર્ચની નોંધ રાખતા અટકાવે છે.
- ધંધાના ક્રાંતિકોષથી ધંધાકીય વ્યવહારોની નોંધ રાખવાની કે અહેવાલ આપવાની સગવડ પૂરી પાડે છે.
- આ સંકલ્પના નામાની સંકલ્પનાઓ અને સિદ્ધાંતોમાં મૂળભૂત પાયાની સંકલ્પના છે.



પાઠ સ્વાધ્યાય ૨.૧

નીચેની ખાલી જગ્યા યોગ્ય શબ્દ કે શબ્દો વડે પૂરો.

- (i) નામાની પાયાની સંકલ્પનાઓ નામાના પાયારુપ છે.
- (ii) સંકલ્પના ધારે છે કે ધંધાકીય એકમ અને તેના માલિકો બંને બિન એકમો છે.
- (iii) પોતાના અંગત વપરાશ માટે માલિકે ધંધામાંથી લીધેલ માલ કહેવાય છે.

૨.૩ નાણાંકીય માપનની સંકલ્પના

આ સંકલ્પના મુજબ બધા જ ધંધાકીય વ્યવહારો નાણાંના સંદર્ભમાં એટલે કે જે તે દેશના ચલણના સંદર્ભમાં જ હોવા જોઈએ. આપણા ભારત દેશમાં આ વ્યવહારો રૂપિયા માં થાય છે. આમ, નાણાંકીય માપનની સંકલ્પના મુજબ જે વ્યવહારોને નાણામાં દર્શાવી શકાય તેની નોંધ નામાના ચોપડામાં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રૂ. ૧,૦૦,૦૦૦ નો માલ વેચ્યો, રૂ. ૫૦,૦૦૦ નો કાચો માલ ખરીધો, રૂ. ૨૦,૦૦૦ ભાડું ચૂકવ્યું વગેરે બધું જ નાણાંના મૂલ્યમાં જ દર્શાવાય છે, અને તેથી તેમની નોંધ નામાના ચોપડામાં કરવામાં આવે છે. પણ જે વ્યવહારો નાણાના સંદર્ભમાં દર્શાવી શકાતા નથી તેવા વ્યવહારોની નોંધ નામાના ચોપડામાં કરવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે, કર્મચારીની નિષ્ઠા, પ્રમાણિકતા અને વિશ્વાસપણું વગેરે બાબતો ધંધાના નજી અને નુકસાન પર

મોડચુલ - ૧
પરિચય અને પાયાની સંકલ્પનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિચય અને પાણી
સંકલ્પનાઓ



નોંધ

નામાની સંકલ્પનાઓ (પારિબાધિક શાદી) અને વ્યવહારો

અસર કરતી હોવા છતાં પણ નામાના ચોપડામાં નોંધવામાં આવતી નથી, કારણ કે આ બધી બાબતોને નાણાના મૂલ્યમાં આંકી શકતી નથી.

આ સંકલ્પનાનું બીજુ પાસું એ છે કે વ્યવહારોની નોંધણી ભૌતિક એકમોમાં નહિ પરંતુ નાણાંકીય એકમમાં જ રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ૨૦૧૧ ના વર્ષની સંસ્થા પાસે ૫ એકર જમીન પર કારખાનું સ્થાપેલું છે જેમાં ૧૦ રૂમનું કાર્યાલય, ૨૦ અંગત કોમ્પ્યુટર, ૩૦ ઓફિસ ખુરશી-ટેબલ, ૫૦ કિલો કાચો માલ વગેરે. આ બધું અલગ અલગ એકમમાં છે, પરંતુ નામાના હેતુ માટે આ બધી વસ્તુઓ નાણાંના મૂલ્યમાં જ લખાય છે જેમ કે, રૂપિયા () માં આ બાબતમાં કારખાનાની જમીનની કિંમત રૂ. ૬ કરોડ, કાર્યાલયનું મકાન રૂ. ૫ કરોડ, કમ્પ્યુટર્સ રૂ. ૫ લાખ, ઓફિસનાં ખુરશી ટેબલ રૂ. ૧ લાખ અને રૂ. ૧૫ લાખનો કાચો માલ. આમ, સંસ્થાની મિલકતની કુલ કિંમત રૂ. ૧૧ કરોડ અને રૂ. ૨૧ લાખ ગણાય. આમ, જે વ્યવહારોને નાણાંમાં મૂલ્યવી શકાય (દર્શાવી શકાય) તેની જ નોંધ નામાના ચોપડામાં કરાય છે પણ જેને જથ્થામાં દર્શાવી શકાતા હોય તેવા વ્યવહારો નોંધવામાં આવતા નથી.

મહત્વ

નાણાંકીય માપનની સંકલ્પનાના નીચેના મુદ્દા તેનું મહત્વ દર્શાવે છે.

- આ સંકલ્પના હિસાબની શાની નોંધ કરવી અને ન કરવી તેની દોરવણી આપે છે.
- ધંધાકીય વ્યવહારોને એકસૂત્રતામાં નોંધવામાં મદદ કરે છે.
- જે ધંધાના બધાજ વ્યવહારોને નાણાંના મૂલ્યમાં જ દર્શાવવામાં આવ્યા હોય તો ધંધાકીય એકમ મારફતે તૈયાર કરેલા હિસાબોને સમજવામાં સરળતા રહે છે.
- આ સંકલ્પના એક જ એકમના બે જુદા-જુદા સમયગાળા દરમ્યાન ધંધાની સ્થિતિની તુલના કરવાની કે બે જુદા-જુદા એકમની એક જ સમયગાળે તુલના કરવાની સગવડ પૂરી પાડે છે.



પાઠ સ્વાધ્યાય ૨.૨

નીચેના વ્યવહારોની નોંધ ચોપડામાં કરી શકશો કે નહિં કરી શકાય તે નક્કી કરો.

- વ્યવસ્થાપક નિયામકની તંકુરસ્તી
- રૂ. ૫ કરોડનું કારખાનાનું મકાન ખરીદું.
- રૂ. ૨૦,૦૦૦ ભાડા પેટે ચૂકવ્યા.

નામાની સંકલ્પનાઓ (પારિભાષિક શાન્દ) અને વ્યવહારો

(iv) દાન પેટે રૂ. ૪૦,૦૦૦ નો માલ આયો.

(v) કાચો માલ પહોંચાડવામાં વિલંબ થયો.

૨.૪ ચાલુ એકમની સંકલ્પના (એકમ/પેઢીનું સાતત્ય)

આ સંકલ્પના જગ્યાવે છે કે, ધંધાકીય એકમ અને તેની પ્રવૃત્તિઓ અમાપ સમય (કાયમ) સુધી ચાલુ રહેશે. આનો સાઠો અર્થ એ કે પ્રત્યેક ધંધાકીય એકમ સાતત્યપૂર્ણ જીવન ધરાવે છે. આથી, ધંધાકીય એકમ નજીકના ભવિષ્યમાં સમેરાઈ જવાનો નથી. નામાની આ મહત્વની ધારણા છે કે જે મિલકતની કિમત સરવેયામાં દર્શાવવાનો આધાર પૂરો પાડે છે. ઉદાહરણ તરીકે રૂ. ૧,૦૦,૦૦૦ ના પ્લાન્ટ અને યંત્રોની ખરીદી કંપનીએ કરી અને તેનું આયુષ્ય ૧૦ વર્ષ છે. આ સંકલ્પના મુજબ દર વર્ષ કોઈક રકમ ખર્ચ તરીકે દર્શાવવામાં આવશે અને સિલક રકમને મિલકત ગણવામાં આવશે. આમ, જો કોઈક વસ્તુ કે જેનો ધંધામાં વર્ષોસુધી ઉપયોગ કરવામાં આવનાર છે તેના માટે ખર્ચેલ રકમ તે વસ્તાની ખરીદીના વર્ષની ઉપજમાંથી વસુલવી એ યોગ્ય નથી. તેની કુલ કિમતનો માત્ર થોડો ભાગ ખર્ચ તરીકે ખરીદીના વર્ષમાં દર્શાવવામાં આવે છે અને બાકીની રકમ મિલકત તરીકે દર્શાવાય છે.

મહત્વ

નીચેના મુદ્દાઓ ચાલુ એકમની સંકલ્પનાનું મહત્વ દર્શાવે છે :

- આ સંકલ્પના નાણાકીય પત્રક તૈયાર કરવાની સગવડ પૂરી પાડે છે.
- આ સંકલ્પનાના આધારે સ્થાવર મિલકતો પર ઘસારો લાગુ કરવામાં આવે છે.
- આનાથી રોકાણકારોને મોટી મદદ મળે છે, કારણ કે, તે તેમના રોકાણ પર સાતત્યપૂર્ણ આવકની ખાતરી આપે છે.
- જો આ સંકલ્પના ન અપનાવવામાં આવે તો મિલકતની ખરીદીનો ખર્ચ તેના ખરીદ-વર્ષના ખર્ચમાં એક સામટો ગણવામાં આવે છે.
- આ સંકલ્પનાના કારણે ધંધાની ભવિષ્યમાં નફો કરવાની ક્ષમતા પણ નક્કી કરી શકાય છે.



પાઠ સ્વાધ્યાય ૨.૩

કૌસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.

- (i) ચાલુ એકમની સંકલ્પના જગ્યાવે છે કે, ધંધાકીય એકમ પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખશે. (સીમિત સમયગાળા સુધી, ખૂબ લાંબા સમયગાળા સુધી)

મોડચુલ - ૧
પરિચય અને પાયાની સંકલ્પનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાની સંકલ્પનાઓ (પારિબાધિક શાદી) અને વ્યવહારો

- (ii) સ્થાવર મિલકતો તેમની વરે ચોપડામાં નોંધાયેલી હોય છે. (ખરીદ કિંમત,
બજાર કિંમત)
- (iii) ધંધાકીય એકમ નજીકના ભવિષ્યમાં બંધ થવાનો નથી એ પ્રકારની સંકલ્પના
..... ના નામે ઓળખાય છે. (ચાલુ એકમની સંકલ્પના, નાણાકીય માપની
સંકલ્પના)
- (iv) ચાલુ એકમની સંકલ્પનાના આધારે ધંધો તેના તૈયાર કરે છે. (નાણાકીય
પત્રકો, બેંક પત્રક, રોકડ પત્રક)
- (v) સંકલ્પના જગ્ઘાવે છે કે ધંધાકીય એકમ તેના માલિકથી ભિન્ન એકમ છે.
(ચાલુ એકમની, ધંધાકીય એકમની)

૨.૫ બેવડી અસરની સંકલ્પના

બેવડી અસર એ નામાનો પાયો કે પાયાનો સિધ્યાંત છે. તે ધંધાના વ્યવહારોને નામાના ચોપડામાં નોંધ કરવા માટે પાયાની બાબતો પૂરી પાડે છે. આ સંકલ્પના માને છે કે, દરેક વ્યવહારની બેવડી અસર હોય છે, જેમ કે, તે બે ખાતાં ઓમાંની તેમની સામેની બાજુ પર અસર કરે છે. એટલે કે, વ્યવહારો બે સ્થાને નોંધવામાં આવે છે. આનો અર્થ એ કે, વ્યવહારની બંને અસરોને નામાના ચોપડામાં નોંધવી જ જોઈએ. ઉદાહરણ તરીકે રોકડેથી માલ ખરીધો- વ્યવહારની બે અસરો નીચે મુજબ છે.

- (i) રોકડ ચૂકવવામાં આવે છે.
- (ii) માલ મેળવવામાં આવે છે.

આ બંને અસરોની નોંધ કરાય છે. આમ, બેવડી અસરની સંકલ્પનાને સામાન્ય રીતે નામાના પાયાના હિસાબી સમીકરણ તરીકે દર્શાવાય છે.

$$\text{મિલકતો (Assets)} = \text{દેવાં (Liabilities)} + \text{મૂડી (Capital)} \quad A = L + C$$

ઉપરોક્ત હિસાબી સમીકરણો જગ્ઘાવે છે કે ધંધાની મિલકતો હંમેશા માલિકો કે માલિકો અને બહારની વ્યક્તિઓના હકોના સરવાળા બરાબર હોય છે. માલિકનો હક મૂડી કે માલિકની માલિકી (Equity) અને બહારની વ્યક્તિઓના હકો દેવાં કે દેણારોની માલિકી (Liabilities) તરીકે ઓળખાય છે.

બંને અસરોનું જ્ઞાન વ્યવહારની બંને અસરોને નક્કી કરવામાં મદદ કરે છે. જે નામાના ચોપડામાં વ્યવહારોની નોંધ કરવાના નિયમોને લાગુ કરવામાં મદદ કરે છે. બેવડી અસરની સંકલ્પનાનું

નામાની સંકલ્પનાઓ (પારિભાષિક શાન્દ) અને વ્યવહારો

સૂચન એ છે કે દરેક વ્યવહારની મિલકતો અને દેવાં પરની અસર એક સમાન છે અને અવી રીતે છે કે જેથી કુલ મિલકતો હંમેશાં કુલ દેવાંની બરાબર હોય છે.

ચાલો, બેવડી અસરના અર્થસમજાવતાં બીજા કેટલાંક ઉદાહરણો તપાસીએ :

- અ. ધંધાનો માલિક મૂડી લાવે છે : પહેલી અસર રોકડ મળે છે, બીજી અસર મૂડીમાં વધારો (માલિકની માલિકી) થાય છે.
- બ. એકથી યંત્રોની ખરીદી કરી : પહેલી અસર યંત્રોની માલિકી મળી, બીજી અસર બેન્કની સિલકમાં ઘટાડો થયો.
- ક. રોકડથી માલ વેચ્યો : પહેલી અસર રોકડ પ્રાપ્ત થાય છે, બીજી અસર ગ્રાહક માલ મેળવે છે.
- ડ. જમીન માલિકને ભાડું ચૂકવ્યું : પહેલી અસર ભાડું (ખર્ચ થયો), બીજી અસર રોકડની ચૂકવણી કરી.

એકવાર વ્યવહારની બેવડી અસરની ઓળખ થઈ જાય પછી નામાના નિયમોને લાગુ કરવાનું સરળ બની જાય છે અને નામાના ચોપડાઓમાં નોંધ વ્યવસ્થિત રીતે થાય છે. બેવડી અસરની સમજનું અર્થધટન એ છે કે, પ્રત્યેક વ્યવહારની એકસમાન અસર મિલકતો અને દેવાં પર એ રીતે કરે છે કે જેથી કુલ મિલકતો ધંધાના કુલ દેવાંની બરોબર થઈ રહે છે.

મહત્વ

બેવડી અસરની સંકલ્પનાના નીચેના મુદ્દાઓ તેનું મહત્વ દર્શાવે છે.

- આ સંકલ્પના હિસાબનીશને ભૂલ શોધવામાં મદદ કરે છે.
- આ સંકલ્પના હિસાબનીશને અસરકર્તા બંને ખાતાંઓની સામેની બાજુએ હવાલાની નોંધ કરવા પ્રોત્સાહિત કરે છે.
- ચોકક્સ તારીખે નાણાંકીય સ્થિતિનું પત્રક કે સરવેયું તૈયાર કરવામાં તે મદદ કરે છે.



પાઠ સ્વાધ્યાય ૨.૪

નીચેના વ્યવહારોની બેવડી અસરો લખો.

મોડચુલ - ૧
પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિયય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

અનુક્રમ નં વ્યવહાર

અસર

૧ માલિક ધંધામાં મૂડી લાવે છે.

૨ રોકટેથી માલ ખરીધો

૩ રોકટેથી માલ વેચ્યો

૪ રોકટેથી ફર્નિચર ખરીધું.

૫ શીતલ પાસેથી રોકડ પ્રાપ્ત થઈ

૬ કિરણ પાસેથી શાખ પર યંત્ર ખરીધું

૭ કિરણને ચૂકવ્યા

૮ પગાર ચૂકવ્યો

૯ ભાડુ ચૂકવ્યું

૧૦ વટાવ (કમિશન) મળ્યું

૨.૬ નામાની સંકલ્પનાઓ નો અર્થ

હિસાબી સિધ્યાંતો સર્વસામાન્ય વ્યવહારો છે કે જે ધંધાકીય એકમના હિસાબો લખવામાં અને રજૂ કરવામાં સર્વસ્વીકૃત રીતે અનુસરવામાં આવે છે. આ સિધ્યાંતો સમાજની પ્રણાલિકાઓ, રિવાજો વગેરેની માફક અનુસરવામાં આવે છે. હિસાબી સિધ્યાંતો નિયમિત અને એકસૂત્રતામાં વર્ષોથી નોંધ તૈયાર કરવાની પ્રવિધિઆ (ટેવો) દ્વારા વિકસ્યા છે જે હિસાબો નોંધવાની એકસમાન રીત પૂરી પાડે છે. તેઓ બે અલગ ધંધાકીય એકમના કે એક જ એકમના બે અલગ સમયગાળાના હિસાબી અહેવાલોની તુલના કરવામાં મદદ કરે છે. આ સિદ્ધાંતો વર્ષો બાદ વિકસ્યા છે. આમાના સૌથી મહત્વના સિધ્યાંતો કે જે લાંબા સમયથી વપરાશમાં છે તે નીચે મુજબ છે.

- એકસૂત્રતા (Consistency) નો સિધ્યાંત
- અર્થપૂર્ણતા (Materiality) નો સિધ્યાંત
- રૂઢિયુસ્તતા (Conservatism) નો સિદ્ધાંત

૨.૭ એક સૂત્રતાનો સિધ્યાંત



નોંધ

એકસૂત્રતાનો ખ્યાલ એવું સૂચવે છે કે વરસો વરસ નાણાંકીય પત્રકો તૈયાર કરવામાં એકસરખા નામાના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જોઈએ. હિસાબોમાં એકસૂત્રતાને લીધે જ બે સમાન ધંધાકીય એકમો કે એક જ એકમના બે સમયગાળાના નાણાંકીય હિસાબોની તુલના અર્થપૂર્ણ બની રહે છે. પણ આ ત્યારે જ શક્ય બને જ્યારે ધંધાકીય એકમ દ્વારા અનુસરવામાં આવતી હિસાબી નીતિઓ અને પ્રવિધિઓ (Practices) જે તે સમયગાળા દરમ્યાન એકસમાન અને એકરૂપ રીતે થતી હોય. જો જુદાજુદા વર્ષો માટે જુદીજુદી હિસાબી પ્રક્રિયાઓ અને પ્રવિધિઓનો ઉપયોગ કરાયો હોય તો, તેના પરિણામ તુલનાત્મક હોઈ શકે નથી. સામાન્ય રીતે ધંધાદારી વરસો વરસ એકસરખી પ્રવિધિઓ કે પદ્ધતિઓને હિસાબી ચોપડા તૈયાર કરવા માટે અનુસરે છે.

સ્થાવર મિલકતો પર જ્યારે ઘસારો ગણવામાં આવે કે નહીં વેચાયેલા સ્ટોકની કિંમત આંકવામાં આવે ત્યારે એકવાર જે પદ્ધતિ અપનાવી તે જ પદ્ધતિ ત્યારબાદ વરસોવરસ વાપરવી જોઈએ. ઘસારા પદ્ધતિ અને સ્ટોક-મૂલ્યાંકન પદ્ધતિ વર્ષોવર્ષ એકસમાન રાખવાથી જ નાણાંકીય પત્રકોનું પૃથ્વીકરણ કે તુલના કરી શકાય છે. આનાથી હિસાબનીશાને સ્થાવર મિલકતનો ઘસારો કઈ પદ્ધતિએ ગણવો? સ્થિર હપ્તાની પદ્ધતિએ કે ઘટતી જતી બાકીની પદ્ધતિએ - તેની સૂઝ પડે છે. એ જ રીતે, આખરના સ્ટોકના મૂલ્યાંકન માટે માલની પડતર કિંમત કે માલની બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તેના આધારે કિંમત આંકી શકાશે. જો કે કિંમતની ધાતુઓ જેવી કે સોનું, હીરા, તથા ખનીઓની કિંમતો બજાર કિંમતના આધારે જ આંકવામાં આવે છે.

આમ, આ સિદ્ધાંત મુજબ એકસમાન હિસાબી પદ્ધતિ નાણાંકીય પત્રકો તૈયાર કરવા માટે વર્ષોવર્ષ અપનાવવી જોઈએ. આનો અર્થ એમ પણ નહીં કે, એકવાર જે હિસાબી પદ્ધતિ અપનાવી તેને કદી બદલી ન શકાય. જ્યારે પણ પદ્ધતિને બદલવાની જરૂરિયાત જેભી થાય ત્યારે જે તે વર્ષના નાણાંકીય પત્રકના અંતે હિસાબો સાથેની નોંધોમાં તેની નોંધ કરવી જોઈએ.

મહત્વ :

એકસૂત્રતાના સિધ્યાંતના નીચેના મુદ્દાઓ તેનું મહત્વ દર્શાવે છે.

- તે નાણાંકીય પત્રકોનું તુલનાત્મક પૃથ્વીકરણ કરવાની સગવડ આપે છે.
- તે સ્થાવર મિલકત પર ઘસારો અને આખરના સ્ટોકની કિંમત ગણવામાં એકસૂત્રતાની ખાતરી આપે છે.



પાઠ સ્વાધ્યાય ૨.૫

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાની સંકલ્પનાઓ (પારિબાધિક શાદી) અને વ્યવહારો

નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ/ શબ્દો વડે પૂરો.

- (i) એકસૂત્રતાનો સિધ્યાંતનો અર્� એ છે કે, નાણાંકીય પત્રકો તૈયાર કરવા એકસમાન સિધ્યાંતોનું પાલન કરવું જોઈએ.
- (ii) નહીં વેચાયેલા માલની કિંમત પડતર કિંમત કે પેશી જે હોય તે ગણવામાં આવે છે.
- (iii) કિંમતી ધ્વાતુઓ જેવી કે સોનું, ચાંદી વગેરેની સામાન્ય રીતે કિંમત ગણવામાં આવે છે.
- (iv) સિધ્યાંત મુજબ વર્ષોવર્ષ એક પદ્ધતિથી મિલકતાની કિંમત આંકવામાં આવે છે.

૨.૮ અર્થપૂર્ણતા(Materiality) નો સિદ્ધાંત :

અર્થપૂર્ણતાનો સિદ્ધાંત જણાવે છે કે, નાણાંકીય પત્રકોને અર્થપૂર્ણ રીતે તૈયાર કરવા માટે ફક્ત એવી હક્કિકતો કે જે મહત્વની (અર્થપૂર્ણ) અને પ્રસ્તુત હોય તે જ હિસાબી માછેતીના વપરાશકારોને પૂરી પાડવી જોઈએ. તો અહીં પ્રશ્ન ઉભો થાય છે કે કઈ હક્કિકત અર્થપૂર્ણ કહેવાય ? હક્કિકતની મહત્વાના તેના સ્વરૂપ અને તેની સાથે સંકળાયેલી રકમ પર આધાર રાખે છે. મહત્વનાં સત્યો જે માછેતી દશાવિ છે તે તેના ઉપયોગકર્તાના નિઃખ્ય પર અસર કરે છે. ઉદાહરણ તરીકે, એક ધંધાદારી વીજળીક ઉપકરણની લે-વેચ કરે છે. તે ટી.વી., રેઝિઝરેટર, વોણિંગ મશીન, કમ્પ્યુટર વગેરેની ખરીદી તેના ધંધા માટે કરે છે. આ બધી ખરીદીમાં તે પોતાની મૂડીનો મોટો હિસ્સો વાપરે છે. આ વસ્તુઓ મહત્વની વસ્તુઓ છે, તેથી તેની હિસાબના ચોપડામાં નોંધ કરવી જોઈએ. એ જ સમયે ઓફિસનું રોજેરોજનું કામકાજને સારુ પેન, પેન્સિલ, ડિવાસળી, અગરબતી વગેરે ખરીદે છે. આ ખરીદવામાં ખૂબ નજીવી રકમ મૂડીમાંથી વપરાય છે. પણ આ વસ્તુઓ બિન મહત્વની છે અને તેથી વિગતની નોંધમાં દરેક પેન, પેન્સિલ, ડિવાસળી કે બીજી નાની વસ્તુઓની નોંધ અલગ રીતે થવી જોઈએ. આમ, જે વસ્તુઓ નોંધપાત્ર મહત્વ ધરાવે છે તેની વિગતો નોંધવામાં આવે છે ત્યારે તે વસ્તુઓને મહત્વની વસ્તુઓ અથવા મૂર્ત વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. જે વસ્તુઓ ઓદૃં મહત્વ ધરાવે છે તેને બિનમહત્વનાં સત્યો કે બિનમહત્વની વસ્તુઓ ગણાય છે. આમ, આ સિદ્ધાંત મુજબ મહત્વની અને નોંધપાત્ર બાબતો જે તેમના યોગ્ય મથાળા હેઠળ નોંધવામાં આવે છે અને તમામ બિનમહત્વ કે બિન અગત્યના વ્યવહારો જુદા હિસાબી મથાળા નીચે આવરી લેવામાં આવે છે.

હત્ત્વ

અર્થપૂર્ણતાના સિદ્ધાંતમાં નોંધપાત્ર મુદ્દાઓની જાંખી નીચે મુજબ છે.

- તે ગણતરીમાં ભૂલોનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.
- તે નાણાકીય પત્રકોને વધારે અર્થપૂર્ણ બનાવવામાં મદદ કરે છે.
- તે સમય અને નાણાને બચાવે છે.



પાઠ સ્વાધ્યાય ૨.૬

યોગ્ય શાબ્દ કે શબ્દો વડે ખાલી જગ્યા પૂરો.

- (i)સિદ્ધાંત જગ્યાવે છે કે, નાણાકીય પત્રકોને વધારે અર્થપૂર્ણ બનાવવા વપરાશકારોને કેવળ મહત્વની અને અગત્યની બાબતો જ પૂરી પાડવી જોઈએ.
- (ii) મહત્વનો સિધ્યાંત જગ્યાવે છે કે બિનમહત્વની બાબતોહેઠળ દર્શાવવી જોઈએ.
- (iii)સિધ્યાંત હિસાબનીશ અને મેનેજરને મહત્વની/અગત્યની બાબતો પર જ ધ્યાન રાખવા જગ્યાવે છે.
- (iv)નો અર્થ એવી માહિતી છે કે જે નિષ્ણિય પર અસર કરે છે.

૨.૮ ઇદ્દિયુસ્તતા કે દૂરદર્શિતાનો સિધ્યાંત

“સંભવિત નફો નહિ, પણ તમામ શક્ય નુકસાન (ખોટ) ની માહિતી પૂરી પાડવી.” - સિધ્યાંતના પાયા પર આ સિધ્યાંત કામ કરે છે. હિસાબના ચોપડે તે વ્યવહારોને નોંધવાનું માગદર્શન પૂરું પાડે છે. નફો દર્શાવવામાં સલામત માર્ગ અપનાવવાની નીતિ આ સિધ્યાંતનો પાયો છે. આ સિધ્યાંતનો મુખ્ય ઉદ્દેશ ઓદ્ધામાં ઓદ્ધા નફો દર્શાવવાનો છે. નફો કયારેય વધારે દર્શાવવો જોઈએ નહિ. વાસ્તવ કરતાં વધારે નફો દર્શાવવાથી મૂડીમાંથી ડિવિન્ડ ચૂકવવું પડે તેવી સ્થિતિ સર્જય છે. આ મુજબની નીતિ યોગ્ય નથી. તે ધંધાકીય એકમની મૂડીમાં ઘટાડો કરે છે.

આથી, આ સિદ્ધાંત સ્પષ્ટ જગ્યાવે છે કે જ્યાં સુધી નફો મેળવ્યો ન હોય ત્યાં સુધી નફાની નોંધ કરવી જોઈએ નહિ પરંતુ નજીકના ભવિષ્યમાં કોઈક સંભવિત નુકસાન ધંધામાં થવાનું હોય તો તેની નોંધ હિસાબી ચોપડે કરવાની જોગવાઈ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, આખરના સ્ટોકની

મોડચુલ - ૧
પરિચય અને પાયાની સંકલનાઓ



મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાની સંકલ્પનાઓ (પારિબાધિક શાદી) અને વ્યવહારો

કિમત તેની પડતર કિમત અથવા બજાર કિમત પૈકી જે ઓછું હોય તેને આધારે ગણવી, શંકાશીલ દેવાંની જોગવાઈ જેભી કરવી, દેવાદારો પરનો વટાવ, નહિ લખાયેલી એવી અદશ્ય મિલકતો જેવીકે, પાંચડી, પેટન્ટ વગેરે. અનિશ્ચિતતા અને શંકાના સંજોગોમાં સૌથી ઉપયોગી સાધન દૂરદર્શિતાનો સિધ્યાંત છે.

મહત્વ

રૂઢિયુસ્તતા કે દૂરદર્શિતાના સિધ્યાંતના મહત્વના મુદ્દાની ઝલક નીચે મુજબ છે.

- તે વાસ્તવિક નફો નક્કી કરવામાં મદદ કરે છે.
- તે અનિશ્ચિતતા અને શંકાના સંજોગોમાં ઉપયોગી છે.
- તે મૂડીની વાસ્તવિક કિમત જગવી રાખવામાં મદદ કરે છે.



પાઠ સ્વાધ્યાય ૨.૭

I નીચેના સંજોગો માટે તમારો નિર્ણય જણાવો :

- (i) ધંધામાં વર્ષના અંતે વેચાણ વગરનો સ્ટોક પડયો છે તેની પડતર કિમત રૂ. ૨૦,૦૦૦ અને બજાર કિમત રૂ. ૨૫,૦૦૦ છે. વણવહેંચાયેલા સ્ટોકની કઈ કિમત નોંધવી જોઈએ ?
- (ii) જે ઉપરના જ કિસ્સામાં પડતર કિમત રૂ. ૨૧,૦૦૦ હોય તો તમારો શો નિષય હોઈ શકે ?
- (iii) એક ધંધાદારીને એવી શંકા છે કે રૂ. ૫,૦૦૦ તેના દેવાદાર પાસે વસ્તુલી શકાશે નહિ. તો શું તે આ વ્યવહાર તેના હિસાબી ચોપડે નોંધશે ?

II બહુ વિકલ્પ પ્રશ્નો :

- i) ચાલુ એકમ (એકમનું સાતત્ય) સંકલ્પના પ્રમાણે ધંધાનું શું જોવામાં આવે છે.

- (એ) મયારીદિત આયુષ્ય
(બી) ખૂબ લાંબુ આયુષ્ય
(સી) અનિયતકાળીન આયુષ્ય
(ડી) લાંબુ આયુષ્ય

નામાની સંકલ્પનાઓ (પારિભાષિક શાબ્દ) અને વ્યવહારો

(ii) સ્ટોકનું પડતર કે કુલ કિમતમાંથી જે ઓછું હોય તેના આધારે મૂલ્ય આંકવું એનું ઉદાહરણ છે.

- (એ) એકસૂત્રતાનો સિધ્યાંત
- (બી) રૂઢિયુસ્તતા કે દૂરદર્શિતાનો સિધ્યાંત
- (સી) અર્થપૂર્ખતાનો સિધ્યાંત
- (ડી) ઉપરોક્ત પૈકી એક પણ નથી

(iii) નીચેના પૈકી કઈ સંકલ્પનામાં વ્યવહારની બેવડી અસર નોંધવામાં આવે છે ?

- (એ) મેળવણીની સંકલ્પના
- (બી) નાણાકીય માપનની સંકલ્પના
- (સી) બેવડી અસરની સંકલ્પના
- (ડી) વ્યવહારીતાની સંકલ્પના

(iv) નીચેનામાંથી કઈ હિસાબી સંકલ્પનામાં ધંધાના માલિકને તેની મૂડીમાં વધારો કરનાર દેણાદાર તરીકે જોવામાં આવે છે ?

- (એ) નાણાકીય માપની સંકલ્પના (ખાલ)
- (બી) બેવડી અસરની સંકલ્પના
- (સી) ધંધાકીય એકમની સંકલ્પના
- (ડી) વ્યવહારીતાની સંકલ્પના

(v) હિસાબમાં રૂઢિયુસ્તતા કે દૂરદર્શિતાનો સિધ્યાંત ગજતરીમાં લે છે . . .

- (એ) બધા સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે.
- (બી) બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે.
- (સી) બધા જ સંભવિત નફા અને નુકસાન
- (ડી) બધા જ સંભવિત નફાને તથા નુકસાનને છોડી દેવાય છે.

મોડચુલ - ૧
પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાની સંકલ્પનાઓ (પારિબાધિક શાદી) અને વ્યવહારો



પાઠ્યાંત સ્વાધ્યાય :

- નામાની સંકલ્પનાઓ નામાની પાયાની ધારણાઓ (અનુમાનો) છે કે જે ધંધાના વાસ્તવિક વ્યવહારોની નોંધનો મૂળભૂત આધાર પૂરો પાડે છે.
- મહત્વની હિસાબી સંકલ્પનાઓ (સમજ) ધંધાકીય એકમ, નાણાકીય માપન, ચાલુ (સાતત્યપૂર્ણ) એકમ અને બેવડી અસરની સંકલ્પના છે.
- ધંધાકીય એકમની સંકલ્પના ધારે છે કે હિસાબી હેતુઓને માટે ધંધાકીય એકમ અને તેના માલિક (માલિકો) બંને અલગ એકમો છે.
- નાણાકીય માપનની સંકલ્પના ધારે છે કે, બધા ધંધાકીય વ્યવહારો જે નાણાના એકમમાં માપી શકાય છે તેની નોંધ હિસાબી ચોપડામાં કરવી જ જોઈએ.
- ચાલુ એકમની સંકલ્પના જણાવે છે કે ધંધાકીય એકમ તેની પ્રવૃત્તિનાં અતિ લાંબાગાળાના સમય સુધી ચાલુ રાખશે.
- બેવડી અસરની સંકલ્પના જણાવે છે કે દરેક વ્યવહાર બેવડી અસર ધરાવે છે.
- નામાની સંકલ્પનાઓએ એવી સર્વ સામાન્ય પ્રવિધિઓ છે જે ધંધાની માહિતીને નોંધવામાં અને રજૂ કરવામાં અનુસરવામાં આવે છે.
- એકસૂત્રતાનો સિધ્યાંત જણાવે છે કે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં વર્ષોવર્ષ એકસરખી પદ્ધતિ અપનાવવી જોઈએ.
- મહત્વનો સિધ્યાંત જણાવે છે કે નાણાકીય પત્રકોને અર્થપૂર્ણ રીતે તૈયાર કરવા માટે ફક્ત એવી હકીકતો કે જે મહત્વની (અર્થપૂર્ણ) અને પ્રસ્તુત હોય તે જ નાણાકીય પત્રકોમાં દર્શાવવી જોઈએ.
- દૂરદર્શિતાનો સિધ્યાંત જણાવે છે કે, જ્યાં સુધી નફો મેળવાય નહિ ત્યાં સુધી તેની નોંધ કરવી જોઈએ નહિ, પરંતુ જો ધંધો નજીકના ભવિષ્યમાં નુકસાન થવાની સંભાવના છે તો તેની નોંધ હિસાબના ચોપડામાં કરવાની જોગવાઈ રાખવી જોઈએ.



પાઠ્યાંત સ્વાધ્યાય :

- 1) ચાલુ એકમની સંકલ્પનાનો અર્થ અને મહત્વ સમજાવો.
- 2) ધંધાકીય એકમની સંકલ્પના એટલે શું?

નામાની સંકલ્પનાઓ (પારિભાષિક શાબ્દ) અને વ્યવહારો

- ૩) ધ્યાકીય એકમની સંકલ્પનાનો અર્થ અને મહત્વ સમજાવો.
- ૪) નામાની સંકલ્પનાઓનો અર્થ તમે શું સમજો છો? કોઈપણ ચાર નામાની સંકલ્પનાઓ સમજાવો.
- ૫) એકસૂત્રતાનો સિધ્યાંત ઉદાહરણ સહિત સમજાવો.
- ૬) દૂરદર્શિતાના હિસાબી સિધ્યાંતને ઉદાહરણ સહિત સમજાવો.
- ૭) મહત્વના સિધ્યાંતને સમજાવો.
- ૮) બેવડી (દ્વિ) અસર સંકલ્પનાનો અર્થ અને મહત્વ જણાવો.



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

- ૨.૧ (i) નિયમો (ii) ધ્યાકીય એકમ (iii) રૂપાડ
- ૨.૨ (i) નોંધ નહિ કરાય (ii) નોંધ કરાશે (iii) નોંધ કરાશે (iv) નોંધ કરાશે (v) નોંધ નહિ કરાય.
- ૨.૩ (i) ખૂબ લાંબા સમયગાળા સુધી, (ii) ખરીદ કિંમત, (iii) ચાલુ એકમની સંકલ્પના (iv) નાણાકીય પત્રકો (v) ધ્યાકીય એકમ
- ૨.૪ (૧) રોકડ, માલિકની મૂડી (૨) માલ મયો, રોકડ ઘટી, (૩) રોકડ મળી, માલ વેચાયો (૪) ફર્નિચર ખરીદી, રોકડમાં ઘટાડો (૫) રોકડમાં વધારો, શમાંતુ દેવુ (૬) મશીનની ખરીદી, રમાનુ દેવુ (૭) રોકડ ગુમાવી, દેવુ ઘટયું (૮) રોકડ ગુમાવી, દેવુ ઘટયું (૯) રોકડ ગુમાવી, દેવુ ઘટયું (૧૦) રોકડ વધી મિલકત વધી
- ૨.૫ (૧) વર્ષોવર્ષ (૨) બજાર કિંમત, ઓછી (૩) બજાર કિંમત (૪) એકસૂત્રતા
- ૨.૬ (૧) અર્થપૂર્ણતા (૨) જુદા હિસાબી મથાળા (૩) અર્થપૂર્ણતા (૪) અર્થપૂર્ણતા
- ૨.૭ I (૧) રૂ. ૨૦,૦૦૦ (૨) રૂ. ૨૧,૦૦૦ (૩) છા (૪) અર્થપૂર્ણતા
II (i) સી (ii) બી (iii) સી (iv) સી (v) એ

પ્રવૃત્તિ

વિવિધ ધ્યાકીય એકમો પાસેથી જુદા જુદા નાણાકીય સમયગાળાની યાદી મેળવો અને એક એવી યાદી તૈયાર કરો જે સમયગાળા દરમ્યાન તેઓ એકસમાન નામાની પદ્ધતિઓનો ઉપયોગ નહોતા કરતાં.

મોડચુલ - ૧
પરિચય અને પાયાની સંકલ્પનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિયય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

Journalize	Liabilities	Debit
		Net Income
Credit		Assets

૩

નામાની શબ્દાવલી

દરેક વિષયની મહત્વની, નિશ્ચિત અને મૂળભૂત શબ્દાવલી હોય છે, નામાના મૂળતત્વો પણ આમાંથી બાકાત નથી. આ શબ્દોથી વિષયને સમજવામાં મદદ મળે છે તેથી જ આ પ્રકરણ એ જ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરેલ છે કે તમે થોડાક મૂળભૂત પારિભાષિક શબ્દોને સમજી શકો. નામાના મૂળતત્વોનું સંપૂર્ણ માળખું આ શબ્દો પર આધારિત છે. જે શબ્દોનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ તે છે મિલકતો, જવાબદારી, આવક અને ખર્ચ.



હેતુઓ :

આ પ્રકરણનો અભ્યાસ કર્યા પછી તમે સમજી શકશો

- નામા ના જુદા - જુદા મૂળતત્વો ના પારિભાષિક શબ્દો જેવા કે મૂડી, ઉપાડ, મિલકતો, જવાબદારી, આવક, ખર્ચ, જવક, નફો, બોટ, ખરીદી, વેચાણ, સ્ટોક, દેવાદાર, લેણદાર, મેળવવા પાત્ર, ચૂકવવા પાત્ર, ઉઘાર, જમા વગેરે તેમજ
- વ્યક્તિ અભ્યાસ ના માધ્યમથી તેને ઓળખી શકશો.

૩.૧ નામાના પારિભાષિક શબ્દો

નામાના મૂળતત્વોમાં ઉપયોગમાં લેવામાં આવતા જુદા જુદા શબ્દોનું દરેક વ્યક્તિને જ્ઞાન હોવું આવશ્યક છે. જેનાથી તેને નામાના મૂળતત્વોના જુદા જુદા પાસાઓને સમજવામાં સરળતા રહે અને તે સ્પષ્ટ અને સમજી શકાય તેવો વિષય બની રહે.

મૂડી: આ માલીક દ્વારા ધંધામાં રોકેલ રકમ છે. તેને માલીકની મૂડી પણ કહેવાય છે. માલીકની મૂડી એ તેની ધંધામાં દાવેદારી(લિસ્સેદારી) છે. તે દશાવિએ છે કે તેણે ધંધાની મિલકતમાં કેટલું રોકાણ કર્યું છે.

ઉપાડ : આ એવી રકમ છે જે ધંધાના માલીક દ્વારા તેના અંગત અથવા કૌટંબીક ઉપયોગ માટે રોકડ અથવા માલના સ્વરૂપમાં ધંધામાંથી લેવામાં આવે છે.

મિલકત : કોઈ પણ એવી વસ્તુ કે જે કોઈ વ્યક્તિની અથવા કોઈ પેઢીની અંગત માલીકીની હોય અને જેનું નાણામાં મૂલ્ય આંકી શકતુ હોય તેને મિલકત કહેવાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુ જે ભવિષ્યમાં કોઈ પેઢીને રોકડ અથવા લાભ મેળવવામાં

સહાયરૂપ બને તેને મિલકત કહેવાય. ઉદાહરણ તરીકે જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, સ્ટોક, દેવાદાર, બેંક બેલેન્સ અને રોકડ વગેરે.

મિલકતનું વર્ગીકરણ:

- સ્થાવર મિલકત :** સ્થાવર મિલકત એવી મિલકત છે કે જે પુનઃ વેચાણ માટે નથી હોતી પરંતુ તેમનો ઉપયોગ કરીને ધંધામાં વધુ લાભ મેળવવા માટે અથવા લાભને વધારવા માટે હોય છે. દા.ત. જમીન, મકાન, મશીનરી, કોમ્પ્યુટર, ફર્નિચર, વાહન તથા સ્ટોક વગેરે
- ચાલુ મિલકત :** ચાલુ મિલકત એવી મિલકત છે જેને ધંધામાં એવા ઉદેશ્યથી રોકવામાં આવે છે કે જેને થોડાક સમય એટલેકે એક વર્ષ દરમિયાન રોકડ ના સ્વરૂપમાં ફરવી શકાય છે જેના ઉદાહરણ છે હાથ પરની રોકડ, મળવાપાત્ર બાકી, દેવાદાર, સ્ટોક (માલ) વગેરે
- મૂર્ત મિલકત :** મૂર્ત મિલકત એવી મિલકત છે કે જેને અડી શકાય છે અને જોઈ શકાય છે કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે ઉદાહરણ તરીકે મકાન, મશીનરી, ફર્નિચર, કોમ્પ્યુટર વગેરે
- અમૂર્ત મિલકત :** એવી મિલકત છે જેને જોઈ અડી નથી શકાતી તેમજ જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી એટલે કે ફક્ત અનુભવ જ કરી શકાય છે. ઉદાહરણ તરીકે પાધડી, ડ્રેઝમાર્ક, પેટનટ વગેરે
- ઘસાતી મિલકતો :** ઘસાતી મિલકતો એવી મિલકત જે પ્રાકૃતિક સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે અને જેને કાચા માલ તરીકે અથવા અન્ય રીતે વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘનીજો, ખાણા, તેલના કુવા વગેરે

જવાબદારી (દેવુ): ધંધાની મિલકતો એ માલિક દ્વારા અથવા બહારની કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા ભંડોળ પુરુષ પાડીને મેળવવામાં આવે છે. માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે નાણાનું રોકાણ કરવામાં આવે છે. અન્ય પાસેથી નાણા ઉધાર લઈને પણ ધંધામાં રોકવામાં આવે છે. આ નાણા દ્વારા મિલકતો ખરીદવામાં આવે છે. આમ, ધંધાના માલિકો અથવા બહારની વ્યક્તિઓ ધંધાની મિલકતના હક્કો (દાવેદારી, હિસ્સેદારી) નોંધાવે છે. આ હક્કો (દાવેદારી)ને જવાબદારી કે દેવા તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો એવી કોઈપણ રકમ કે જે માટે પેઢી (ધંધો) માલિક પ્રત્યે કે બહારની વ્યક્તિઓ પ્રત્યે જવાબદાર હોય (દેવુ ધરાવતી હોય) તેને જવાબદારી (દેવુ) કહેવામાં આવે છે. આમ, જવાબદારી (દેવુ) એ ધંધાકીય એકમ દ્વારા ચુકવવાપાત્ર જવાબદારી છે.



મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ



નામાની શાન્દાવળી

જવાબદારી ને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે

- ૧) બાબ્ય જવાબદારી (દેખુ)
- ૨) આંતરિક જવાબદારી (દેખુ)

૧) બાબ્ય જવાબદારી : બાબ્ય જવાબદારી એને કહેવાય કે જેમાં ધંધામાં ઉધાર માલ ખરીદવા માટે અથવા અન્ય ખર્ચ માટે બહારના કોઈ વ્યકિત પાસેથી ઉધાર લેવામાં આવે ઉદાહરણ તરીકે...

- ૩) માલ માટે ના લેણદારો: વિવિધ લેણદારો, ચુકવવાપાત્ર બિલ
ખર્ચ માટેના લેણદારો : ખર્ચ કે જેની ચુકવણી કરવાની છે જેવા કે ચુકવવાનો બાકી પગાર, ચુકવવાની બાકી મજૂરી, ભાડુ કે જે ચુકવ્યું નથી પણ ચુકવવાનો સમય થઈ ગયો છે.
૪) લોન માટેના લેણદારો : બેંક લોન, બેંક ઓવરાઉફટ, ભાગીદારની લોન, અન્ય બહારના વ્યકિતની લોન
- ૨) આંતરિક જવાબદારી : આંતરિક જવાબદારી એને કહેવાય કે જેમાં જવાબદારી ધંધાના માલીક પ્રત્યે હોય છે જેમાં માલીકનો દાવો ધંધાની મિલકત પર હોય છે. અસીત્વ ધરાવતા વેપારની ધારણા કહે છે કે ધંધો માલીકથી અલગ છે કોઈપણ રકમ કે જે ધંધાનો માલીક ધંધામાં લાવે છે તે ધંધાની તેના પ્રત્યેની જવાબદારી (દેખુ) છે. આ જવાબદારીને મૂડી પણ કહેવાય છે. એટલે જ ધંધાના માલીકના મિલકત પર ના દાવાને મૂડી પણ કહેવાય છે વેયકિતક માલીકની પેઢી અથવા એકાકી પેઢીમાં ધંધાના માલીક દ્વારા મૂડી રોકાણ થાય છે ભાગીદારી પેઢીમાં ભાગીદારો દ્વારા અને કંપનીમાં શેરહોલ્ડરો દ્વારા મૂડી રોકાણ થાય છે ધંધામાં જેઓ મૂડી રોકે છે તેઓ ધંધાના માલિકો છે.
તેમના બદલામાં તમને પોતે ઉઠાવેલ જોખમના બદલામાં નફો મળે છે એટલે જ ધંધાના માલીકની ધંધામાં દાવેદારી હોય છે જે ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી (દેખું) બને છે.

ધંધાના માલીકના દાવાને નીચે મુજબ દર્શાવાય છે

- ૧) મૂડી
- ૨) મૂડી પર વ્યાજ (ચુકવવાનું બાકી)
- ૩) ધંધામાંથી મળતો નફો (નાહિ વહેંચેલો)
- ૪) અનામત

એટલે કે મૂડી પર પણ ધંધાકીય એકમની જવાબદારી છે



પાઠ સ્વાધ્યાય ૩.૧

- ૧) ખાલી જગ્યા પૂરો.

નામાની શાંદાવલી

- ૧) પેઢીની મિલકત પર બહારની વ્યક્તિ અને માલીક દ્વારા કરવામાં આવતા દાવાને..... કહે છે.
- ૨) જવાબદારીને બે ભાગમાં વહેંચવામાં આવે છે..... અને.....
- ૩) માલીકનો દાવો..... જવાબદારી છે
- ૪) બહારની વ્યક્તિનો દાવો..... જવાબદારી છે
- ૫) ધંધાની મિલકત પર ના માલીકના દાવાને..... કહે છે
- ૨) નીચે આપેલી માહીતીને આંતરીક અને ખાલ્સા જવાબદારીમાં વર્ગીકૃત કરો
 - ૧) બેંક લોન
 - ૨) મૂડી પર વ્યાજ (ચુકવવાનું બાકી)
 - ૩) મૂડી
 - ૪) ધંધાના વિવિધ લેણદારો
 - ૫) ચુકવવાનું બાકી ભાડુ
 - ૬) નહી વહેંચેલ નફો
 - ૭) ચુકવવાની બાકી બીલ
 - ૮) બેંક ઓવરડ્રાફ્ટ
 - ૯) ચુકવવાનો બાકી પગાર
 - ૧૦) અનામત

ઉપજ : ઉપજ નાણાનો અથવા અન્ય મિલકતોનો આંતરિક પ્રવાહ છે જે વસ્તુઓ કે સેવાઓના વેચાણથી અથવા નાણાના ઉપયોગના ફળ સ્વરૂપે મળે છે આ એવા મળવાપાત્ર અથવા સ્પષ્ટ નાણા છે જે વસ્તુના વેચાણમાંથી મળે છે. મિલકતના વેચાણમાંથી અથવા લોન દ્વારા મેળવેલ નાણા ઉપજ નથી. વ્યાપક અર્થમાં જોઈએ તો ઉપજ એટલે મળેલ ભાડુ, કમિશન, વળતર વગેરે. આ પ્રવાહ નિયમિત હોવો જોઈએ તથા ધંધાના રોજબરોજના વ્યવહારો સાથે સંકળાયેલ હોવો જોઈએ. તેની ગણતરી તે જે સમયે કમાવામાં કે મેળવવામાં આવ્યા હોય તે સમયગાળામાં થવી જોઈએ. ઉદાહરણ તરીકે માલસામાનનું વેચાણ, મળેલ ભાડુ, રોકાણ પર મળેલ વ્યાજ વગેરે.

ઉપજ અને આવક વચ્ચેગેરસમજ ન થવી જોઈએ. આવક ઉપજ અને ખર્ચ વચ્ચેનો તફાવત છે.

ખર્ચ / વ્યય: ખર્ચના અર્થને સમજતાં પહેલા ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. રાકેશની

મોડચુલ - ૧
પરિચય અને પાયાની સંકલ્પનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

ટેક્સ્ટાઇલ મીલ છે તે કાચામાલમાં કપાસ / રૂ ખરીદે છે અને તેનું કાપડ બનાવે છે. આ કામ માટે તેણે કર્મચારીઓ નિયુક્ત કરેલા છે જેને તે દરરોજ વેતન ચૂકવે છે તેની પાસે એક શોરૂમ પણ છે જ્યાં તે તેણે તૈયાર કરેલા કાપડનું વેચાણ કરે છે તેની પાસે ગ્રાન્સ સેલ્સમેન છે જેને તે પગાર ચૂકવે છે. પોતાના ઉત્પાદનનું વેચાણ કરવા માટે તેણે વર્તમાનપત્રો અને દૂરદર્શનમાં જાહેરાત પણ આપી છે. આ બધું જ તેણે નફો કમાવવા માટે કિર્યા છે રાકેશ માટે કપાસ / રૂ ની પડતર કિંમત, વેતન, પગાર અને જાહેરાત ખર્ચ જેવા બધા જ ખર્ચ ઉપજ મેળવવા માટે કરેલ વ્યય છે. ઉપજ મેળવવા માટે કરવામાં આવતા બધા જ ખર્ચ વ્યય છે. આ ખર્ચ એવી સેવા અથવા મીલકત મેળવવા માટે કિર્યા છે જેવી કે વાહન વ્યવહાર ખર્ચ કે જે કાચામાલ કપાસને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા, જેમ કે ગામડામાંથી ફેકટરી સુધી લઈ જવા માટે કિર્યા છે. આ એવા નાણા છે કે જે વસ્તુ / માલસામાન બનાવવા તથા વેચાણ કરવા અને ઉપજ મેળવવાની સેવામાં ખર્ચ થયા. ઉદાહરણ તરીકે કાચામાલની કિંમત, ભાડુ, વેતન, વીમાપ્રીમીયમ, ઓફિસનું ભાડુ વગેરે.

ખર્ચેલ રકમ : ખર્ચેલ રકમ એ વ્યયથી અલગ છે. ખર્ચેલ રકમ એ સામાન્ય રીતે એવી રકમ છે જે મિલકતની ખરીદી માટે ઉપયોગમાં લેવાય છે. તે ધંધાની નફો કમાવાની ક્ષમતા વધારે છે. ઉદાહરણ તરીકે ફર્નિચર ખરીદવું, મશીનરી ખરીદવી વગેરે. જ્યારે વ્યય એ આવક મેળવવા માટે ઉપયોગમાં લેવાતી રકમ છે. વ્યયના કેટલા ઉદાહરણ છે ભાડુ, વેતન, વગેરેની ચૂકવણી કરવી.

બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે વ્યય એ મુખ્ય ખર્ચ (મૂડી ખર્ચ) છે જો તેના માટે અન્ય શબ્દો જેવા કે ભાડા કે પગારમાં થયેલ ઉપજખર્ચ વગેરે શબ્દો ન વાપરવામાં ન આવ્યા હોય. જ્યારે ખર્ચ એ ફક્ત અને ફક્ત ઉપજ ખર્ચ જ હોય છે કારણ કે તે ઉપજ મેળવવા માટે કરવામાં આવે છે.

નફો : આ કોઈ એક સમયે ધંધાના ખર્ચ કરતા ધંધાની આવકમાં થયેલ વધારો દરશાવે છે આ માલીકીની મૂડીમાં વધારો કરે છે

ખોટ : આ ચોખ્ખી મિલકતના મૂલ્યમાં ઘટાડો કરે છે આ વર્ષ દરમ્યાનની ધંધાની આવક કરતા ધંધાના ખર્ચનો વધારો દરશાવે છે તે માલીકની મૂડીમાં ઘટાડો કરે છે.

ખરીદી : ખરીદીનો અર્થ છે માલની ખરીદી, એટલે કે ખરીદીનો અર્થ એવી વસ્તુઓ અથવા સેવાઓની ખરીદી છે કે જેનો પેઢી ધંધો કરે છે ઓટોમોબાઈલનો ધંધો કરનાર ડીલર માટે એક કારની ખરીદી એ ખરીદી છે જ્યારે અન્ય પેઢી માટે આ ખરીદી નથી.

વેચાણ : આનો અર્થ છે કે પેઢી દ્વારા માલ અથવા સેવાનો નાણા કમાવવા માટે કરવામાં આવતો વિનીમ્ય. નફો કમાવવો એ ધંધાનો મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે વસ્તુ અથવા સેવાને તેની પડતરકિંમત કરતા વધુ કિંમતે વેચી આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકાય છે.



નોંધ

સ્ટોક (જથ્થો) : વેપારી માટે સ્ટોક એટલે સામાન્ય રીતે એવી બધી જ વસ્તુઓ કે જે સામાન્યરીતે વેચાણ માટે તૈયાર જ છે. પરંતુ ઉત્પાદક માટે સ્ટોકમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

- ૧) કાચોમાલ જે ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે.
- ૨) અર્ધતૈયાર માલ અથવા ઉત્પાદન (એવો કાચો માલ કે જે હજુ વેચાણ માટે તૈયાર નથી પરંતુ પ્રક્રિયામાથી પસાર થઈ રહ્યો છે એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં છે)
- ૩) તૈયાર ઉત્પાદન/માલ

આમ ધંધામાં સ્ટોક એટલે કે વેપારી માટે તૈયાર માલ કે જે વેચાણ માટે હોય છે અને ઉત્પાદક માટે કાચોમાલ/અર્ધતૈયાર માલ અથવા ઉત્પાદન પ્રક્રિયામાં લેવાતો માલ સ્ટોક કહેવાય છે.

મળવાપાત્ર બાકી : ધંધાના દેવાદારો ઉપરાંત પણ અન્ય લોકો છે કે જેમણે ધંધામાંથી નાણા ઉધાર લીધા છે જે મળવાપાત્ર છે. આ દાવાને મળવાપાત્ર બાકી તરીકે ઓળખવામાં આવે છે. આમાં મળવાપાત્ર બિલનો પણ સમાવેશ થાય છે.

ચૂકવવાપાત્ર બાકી : લેણદારો ઉપરાંત પણ બીજા લોકો છે જેમની પાસેથી ધંધાએ નાણા ઉપર લીધા છે તેમાં ચૂકવવાપાત્ર બાકી બિલનો પણ સમાવેશ થાય છે તેને ચૂકવવાપાત્ર બાકી કહેવાય છે.

દેવાદાર અને લેણદાર : બે બીજી બાબતો જે વ્યવહારની નોંધ કરતી વખતે ધ્યાનમાં લેવાય છે તે છે દેવાદાર અને લેણદાર, આ બંને બાબતોને સંપૂર્ણ રીતે સમજવી ખૂબ જ જરૂરી છે.

દેવાદાર એક એવી વ્યક્તિ છે જેણે ઉધાર લીધા છે. લેણદાર એક એવી વ્યક્તિ છે જેને નાણા આપવાના છે. એક વ્યક્તિ દેવાદાર ત્યારે બને છે જ્યારે તે કોઈ લાભ મેળવે છે. તે નાણા, વસ્તુ અથવા સેવાના સ્વરૂપે હોય છે. એક વ્યક્તિ લેણદાર ત્યારે બને છે જ્યારે તે કોઈ લાભ આપે છે.

ઉદાહરણ - રામ, દાસને માલ ઉધારે વેચે છે.

રામની નજરથી દાસ એક દેવાદાર છે કારણ કે દાસને માલના સ્વરૂપમાં લાભ મળે છે.

દાસની નજરથી રામ એક લેણદાર છે કારણ કે રામે માલના સ્વરૂપમાં લાભ આપ્યો છે.

ઉધાર અને જમા : તમે જોઈ શકશો કે દરેક ધંધાકીય વ્યવહારમાં એક ઉધાર અને એક જમા હોય છે ઉધાર રકમ, જમા રકમ જેટલી જ હોય છે સરખી ઉધાર અને જમા રકમના અભ્યાસને દ્વિનોંધી નામા પદ્ધતિ કહે છે આ પદ્ધતિમાં દરેક વ્યવહારમાં બે બાજુ હોય છે જમા અને ઉધાર વ્યવહારની નોંધ કરતી વખતે એક ઉધાર બાજુ અને બીજી જમા બાજુ નોંધ કરવામાં આવે છે.

૩.૨. વ્યક્તિ અભ્યાસ :

જ્યે તા. ૧/૪/૨૦૧૨ ના રોજ રૂ. ૨૦૦૦૦૦ સાથે ધંધો શરૂ કર્યો તે જ દિવસે બેંકમાં ખાતુ

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાની શાન્દાવળી

ખોલાવી તેમાં રૂ. ૫૦૦૦૦ જમા કરાવ્યા તા. ૨/૪/૨૦૧૨ ના રોજ તેણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ. ૧૦૦૦૦૦ ની લોન લીધી તા. ૩/૪/૨૦૧૨ ના રોજ તેણે રવિ પાસેથી રૂ. ૭૦૦૦૦ નો માલ ઉધાર ખરીદો તે જ દિવસે તેણે રવિને એક બિલ આપ્યું જે બે મહિના પછીનું છે તા. ૧૨/૪/૨૦૧૨ ના રોજ મેસર્સ્ક્રૈલાસ સ્ટોર પાસેથી રૂ. ૫૦૦૦૦ ની મશીનરી શાખ પર ખરીદી. તા. ૧૩/૪/૨૦૧૨ ના રોજ તેણે રામને રૂ. ૧૨૦૦૦ રોકડ અને રૂ. ૮૦૦૦ નો ઉધાર માલ વેચ્યો. તમારા જ્ઞાન પ્રમાણે નામાના મૂળભૂત શબ્દોને ઓળખી બતાવો જે જ્યદ્વારા કરવામાં આવેલા વ્યવહારમાં સમાવિષ્ટ છે.

ઉકેલ :

ઉપરના વ્યક્તિ અભ્યાસમાં નીચેના નામાના મૂળભૂત શબ્દોનો સમાવેશ થાય છે.

	રૂ.
મૂડી	૨,૦૦,૦૦૦
મેંક લોન	૧,૪૦,૦૦૦
લોન (જવાબદારી)	૧,૦૦,૦૦૦
રવિ લેણદાર (જવાબદારી)	૭૦,૦૦૦
ચુકવવાપાત્ર બાકી (લેણદાર રવિની જવાબદારી મુજબ)	૭૦,૦૦૦
મશીનરી (મીલ્કટ)	૪૦૦૦૦
કૈલાશ સ્ટોર (જવાબદારી)	૪૦૦૦૦
વેચાણ (ઉપજ)	૨૧૦૦૦
રોકડ (મીલ્કટ)	૧૨૦૦૦
રામ (દેવાદાર)	૮૦૦૦



પાઠ સ્વાધ્યાય ૩.૨

૧) ખાલી જગ્યા પૂરો

- ૧) માલના વેચાણ દ્વારા થતાં નાણાના આંતરિક પ્રવાહને..... કહેવાય છે
- ૨) નફો મેળવવાના ઉદેશથી નાણાના બાબ્ય પ્રવાહને..... કહેવાય છે
- ૩) ખર્ચ એ કમાવવા માટે કરવામાં આવે છે.
- ૪) મિલ્કટ ખરીદવા માટે કરવામાં આવતા ખર્ચને..... કહેવાય છે

નામાની શાન્દાવલી

- ૨) નીચેની માહિતી પરથી ઉપજ, ખર્ચ અને ખર્ચેલ રકમ અલગ કરો.
- | | |
|--------------------|-------------------------|
| ૧) મળેલ ભાડુ | ૫) મળેલ કમિશન |
| ૨) ચૂકવેલ વેતન | ૬) વીમાપ્રીમિયમ ચૂકવણું |
| ૩) કાચા માલનો ખર્ચ | ૭) મશીનરી ખરીદી |
| ૪) ફર્નિચરની ખરીદી | ૮) જાહેરાત ખર્ચ |
- ૩) નીચેની માહિતીને મીલકત, જવાબદારી, મૂડી, ઉપજ અને ખર્ચમાં વર્ગીકૃત કરો.
૧. હાથ પરનો સ્ટોક
 ૨. ચૂકવેલ ભાડુ
 ૩. જાહેરાત
 ૪. લેઝાદારો
 ૫. ચૂકવવાનો બાકી ખર્ચ (ભાડુ)
 ૬. મળેલ વ્યાજ
 ૭. મૂડી લાવ્યા
 ૮. ફર્નિચર અને ફીટીંગ્સ
 ૯. વીમા પ્રીમીયમ ચૂકવ્યું
 ૧૦. ડિવિડન્ડ મળ્યુ
 ૧૧. દેવાદારો
 ૧૨. બંકમાં રોકડ
 ૧૩. ચૂકવેલ પગાર
 ૧૪. મળેલ કમિશન
 ૧૫. જમીન અને મકાન
 - ૧૬) વૈકલ્પિક પ્રશ્નો
 ૧. મૂડી છે-
 - એ) માલીક સીવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણા
 - બી) માલીક દ્વારા ધંધામાં રોકેલા નાણા


મોડચુલ - ૧
પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાની શરૂઆતલી

- સી) ધંધા એ બેંકમાંથી લીધેલ લોન
 ડી) ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન
૨. નામાનું સમીકરણ દર્શાવે છે-
- એ) મિલકતાએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય
 બી) મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય
 સી) જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય.
 ડી) મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે.
૩. નીચેનામાંથી કયું ધંધાની બાહ્ય જવાબદારી નથી ?
- એ) ચુકવવાનું ભાડું
 બી) બેંક લોન
 સી) મૂડી
 ડી) ચુકવવાનો બાકી પગાર
૪. નીચેનામાંથી કયો ખર્ચ વ્યય ગણાય છે ?
- એ) ચુકવેલ ભાડું
 બી) ચુકવેલ કમિશન
 સી) માલની ખરીદી
 ડી) ફર્નિચરની ખરીદી
૫. નીચેનામાંથી કઈ ઉપજ નથી?
- એ) માલસામાનનું વેચાણ
 બી) મળેલ ભાડું
 સી) જૂના ફર્નિચરનું વેચાણ
 ડી) મળેલ કમિશન



તમે આટલું શીખ્યા :

- મૂડી : ધંધાના માલીક દ્વારા ધંધામાં રોકેલા નાણા

નામાની શબ્દાવલી

- ઉપાડ : ધંધાના માલીક દ્વારા અંગત ઉપયોગ માટે રોકડ અથવા માલ લઈ જવો
- જવાબદારી : ધંધાની જવાબદારી
- બાધ્ય જવાબદારી : ધંધા માટે બહારથી મેળવેલ નાણા
- ઉપજ : માલસામાન અથવા સેવા ના વેચાણ દ્વારા મેળવેલ નાણાનો આંતરિક પ્રવાહ છે
- ખર્ચ : ઉપજ મેળવવા માટે કરવામાં આવતો ખર્ચ
- ખર્ચેલ રકમ : મિલકત ખરીદવા માટે રોકવામાં આવતી રકમ
- નફો : ખર્ચ કરતા ઉપજ વધારે
- ઓટ : ઉપજ કરતા ખર્ચ વધારે
- ખરીદી : જે વસ્તુ કે સેવામાં ધંધો કરે છે તેની પ્રાપ્તિ કરવી
- વેચાણ : ગ્રાહકને રોકડ અથવા ઉધાર આદાન પદાન
- સ્ટોક : વેચાણ માટે ઉપલબ્ધ માલ (વેપારી માલ) અર્થતેયાર માલ અને કાચા માલના મૂલ્યાંકનને સ્ટોક કહે છે.



પા�્યાંત સ્વાધ્યાય :

- નીચેના શબ્દો/પદો સમજાવો
 - મૂડી
 - ઉપાડ
 - દેવાદાર
 - લેણદાર
- જવાબદારી, ઉપજ અને ખર્ચ સમજાવો
- દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે શું ?
- બાધ્ય જવાબદારીના પાંચ ઉદાહરણ આપો
- ઉદાહરણની મદદથી આંતરિક અને બાધ્ય જવાબદારીનો અર્થ સમજાવો
- નીચેના બે-બે ઉદાહરણ આપો
 - માલના લેણદાર

મોડચુલ - ૧
પરિચય અને પાયાની
સંકલનાઓ



નોંધ

મોડચુલ - ૧

પરિચય અને પાયાની
સંકલ્પનાઓ



નોંધ

નામાની શરૂઆતલી

- ખર્ચના લેણદાર
- લોનના લેણદાર



પા�-સ્વાધ્યાયના જવાબો :

3. ૧ ૧. (૧) જવાબદારી (૨) બાબ્ય, આંતરિક (૩) બાબ્ય (૪) માલીકની મૂડી
૨. (૧) બાબ્ય (૨) આંતરિક (૩) આંતરિક (૪) બાબ્ય (૫) બાબ્ય (૬) આંતરિક
(૭) બાબ્ય (૮) બાબ્ય (૯) બાબ્ય (૧૦) આંતરિક
3. ૨ ૧. (૧) ઉપજ (૨) ખર્ચ (૩) નફો (૪) ખર્ચેલ રકમ
૨. (૧) ઉપજ (૨) ખર્ચ (૩) ખર્ચ (૪) ખર્ચ (૫) ખર્ચેલ રકમ (૬) ઉપજ
(૭) ખર્ચ (૮) ખર્ચેલ રકમ (૯) ખર્ચ
૩. (૧) મિલકત (૨) ખર્ચ (૩) ખર્ચ (૪) જવાબદારી (૫) જવાબદારી
(૬) ઉપજ (૭) મૂડી (૮) મિલકત (૯) મિલકત (૧૦) જવાબદારી
(૧૧) મિલકત (૧૨) ઉપજ (૧૩) મિલકત (૧૪) ખર્ચ (૧૫) ઉપજ
(૧૬) મિલકત
૪. (૧) બી (૨) એ (૩) સી (૪) ડી (૫) સી

તમારા માટે પ્રવૃત્તિ

- તમારી આસપાસના કોઈ ધંધાકીય એકમની મુલાકાત લો તેમજ આ પ્રકરણમાં તમે જે અલગ અલગ શરૂઆતો અત્યાસ કર્યો એને ઓળખો.



મોડયુલ - ૨

મહત્તમ ગુજરાત
૨૫

અભ્યાસના કલાક
૬૦

આમ નોંધ અને પેટા નોંધ

આ મોડયુલ વિદ્યાર્થીઓને અને જમાના નિયમો સમજવા અને આ નિયમોને જનરલ વ્યવહારો અને અન્ય પેટા ખાતાના વ્યવહારો સમજવા સક્ષમ કરશે. તે વિદ્યાર્થીને ખાતાઓ જેવા કે રોકડ, ખરીદ, વેચાણ, ખરીદ-પરત અને વેચાણ પરત જેવા ખાતા બનાવવામાં પણ મદદ કરશે.

- | | | |
|----------|---|----------------------|
| પ્રકરણ-૪ | : | હિસાબી સમીકરણ |
| પ્રકરણ-૫ | : | દ્વિનોંધી નામાપક્રતિ |
| પ્રકરણ-૬ | : | આમનોંધ |
| પ્રકરણ-૭ | : | રોકડ મેળ |
| પ્રકરણ-૮ | : | લેંક સિલક મેળ |
| પ્રકરણ-૯ | : | ખરીદ અને વેચાણ નોંધ |

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

૪

હિસાબી સમીકરણ

તમે બેવડી નોંધનો ઘ્યાલ અને નામાના મૂળભૂત પારિભાષિક શબ્દો જેવા કે મિલકતા, જવાબદારી, મૂડી, ખર્ચાને આવક વિષે અગાઉ શીખી ચૂક્યા છો. આ ઘ્યાલ મુજબ ધંધામાં દરેક વ્યવહાર બે રીતે સરખી રકમથી અસર પામે છે. ધારો કે, એક ધંધાદારી રૂ.3,00,000 સાથે ધંધો શરૂ કરે છે. નામાના ચોપડામાં રૂ. 3,00,000 ની નોંધ મિલકતા (રોકડ) સ્વરૂપે થશે તેમજ એટલી જ રોકડ માલિક પ્રત્યે નું દેવું સ્વરૂપે દર્શાવાય છે. આ ઉદાહરણમાં તમે જોયું કે મિલકતા અને દેવું સરખાં છે. આને ગાણિતીક ભાખામાં આ મુજબ દર્શાવી શકાય - મિલકતા = જવાબદારી. આ ગાણિતીક રજૂઆતને હિસાબી સમીકરણ કહેવાય છે.

હિસાબી સમીકરણ પર દરેક વ્યવહારની અસર એવી પડે છે કે જેથી તેની બંન્ને બાજુ સમાન રહે છે. હવે આપણે જુદા જુદા ધંધાકીય વ્યવહારો લઈ અને હિસાબી સમીકરણ પર તેની અસર જોઈશું.



હેતુઓ :-

આ પ્રકરણ ભાષ્યા પછી તમે શીખી શકશો,

- હિસાબી સમીકરણનો અર્થ આપી શકશો.
- હિસાબી સમીકરણના મહત્વને પારખી શકશો.
- હિસાબી સમીકરણમાં પર વ્યવહારની પ્રત્યેક અસર જણાવી શકશો.
- સ્થાપિત કરી શકશો કે મિલકતા, જવાબદારી અને મૂડીના સરવાળા જેટલી છે.
- આપેલ વ્યવહારો પરથી હિસાબી સમીકરણ તૈયાર કરી શકશો.

4.1 હિસાબી સમીકરણ

નામાના ચોપડામાં ધંધાકીય વ્યવહારોની નોંધ એક મૂળભૂત સમીકરણને આધારે થાય છે. જેને હિસાબી સમીકરણ કહેવાય છે. મિલકતના સ્વરૂપે ધંધામાં કે કંઈ પણ હોય છે તે ધંધાના માલિક દ્વારા અથવા તો બહારના અન્ય વ્યક્તિ દ્વારા લીધેલા નાણાં દ્વારા પૂરા પાડેલ હોય છે. આ સમીકરણ એક બાજુ મિલકતો અને બીજુ બાજુ બહારના વ્યક્તિ અથવા ધંધાના માલિકના દાવાની સમાનતા

હિસાબી સમીકરણ

દશાવે છે. આમ, હિસાબી સમીકરણ એવી ગાણિતિક અભિવ્યક્તિ છે જે દશાવે છે કે એક પેઢીની મિલકતો અને દેવું સરખા હોય છે. ગાણિતિક સ્વરૂપમાં

$$\text{મિલકતો} = \text{જવાબદારી} + \text{મૂડી}$$

જ્યારે પણ ધંધામાં કોઈ મિલકત આવે છે તો તેટલું જ દેવું પણ ઉત્પન્ન થાય છે અથવા તો બીજી મિલકતમાં ઘટાડો થાય છે. ધંધા પાસે પોતાની કોઈ રોકડ હોતી નથી. એટલે કે આપણે એમ કહી શકીએ કે ધંધા પાસે પોતાનું કશું જ હોતું નથી. અને તે કોઈનો દેવાદાર પણ નથી. સામાન્ય શબ્દોમાં કહી શકાય કે કોઈ ચોક્કસ તારીખે ધંધાની ના તો કોઈ મિલકત હોય છે અને ના તો કોઈ દેવું.

ધંધાની માલિકી શું છે? ધંધનું ઉધાર શું છે?

આવો હિસાબી સમીકરણ પર ધંધાકીય વ્યવહારોની અસર જોઈએ. આ વ્યવહાર મિલકત, જવાબદારી (દેવું) અને મૂડીમાં વધારો અથવા ઘટાડો કરે છે. દરેક ધંધાની નિશ્ચિત મિલકત હોય છે. ઉદાહરણ તરીકે સુનિતાએ રૂ. 2,00,000 મૂડી લાવી ધંધો શરૂ કર્યો. એવું કહી શકાય કે ધંધામાં રોકડ સ્વરૂપે મિલકત ઉભી થઈ.

$$\begin{array}{lll} \text{એટલે કે,} & \text{રોકડ} & = \text{મૂડી} \\ & \text{`2,00,000} & = \text{`2,00,000} \end{array}$$

ત્યારબાદ સુનીતાએ રૂ. 20,000 નું ફર્નિચર અને રૂ. 60,000 ની મશીનરી ખરીદી. હવે મિલકતની સ્થિતિ નીચે મુજબ છે.

$$\begin{array}{lllll} \text{મૂડી} & = & \text{રોકડ} & + & \text{ફર્નિચર} & + & \text{મશીનરી} \\ 2,00,000 & = & 1,20,000 & + & 20,000 & + & 60,000 \\ & & & & (2,00,000 - 80,000) & & \end{array}$$

ઉપરોક્ત ધંધાકીય લેવડ દેવડ પરથી આપણે આઝ્યું કે,

$$\text{મૂડી} = \text{મિલકત}$$


અથવા

$$\text{મિલકત} = \text{મૂડી}$$

મૂડીમાં વધારો અથવા ઘટાડાના પરિણામે તેની સાથે સંબંધિત મિલકતમાં વધારો અથવા ઘટાડો થશે. ઉદાહરણ તરીકે, સુનીતા વધારાની મૂડી રૂ. 50,000 લાવી.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ



હિસાબી સમીકરણ

$$\begin{array}{rcl}
 મૂડી & = & રોકડ + ફર્નિયર + મશીનરી \\
 2,00,000 & = & 1,20,000 + 20,000 + 60,000 \\
 + 50,000 & & + 50,000 \\
 \hline
 2,50,000 & = & 1,70,000 + 20,000 + 60,000
 \end{array}$$

દરેક ધંધાકીય એકમ પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે બહાર ની વ્યક્તિ/પેઢી પાસેથી રોકડ ઉધાર લે છે. અન્ય શબ્દોમાં કહીએ તો દરેક ધંધાકીય એકમ બહારની વ્યક્તિ/પેઢી નો ઝાણી હોય છે. ધંધાકીય એકમની મિલકત તેના માલિક અને બહારના પક્ષો દ્વારા ધીરેલી હોય છે. બહારના પક્ષોમાં ઉધાર લીધેલી રોકડ જવાબદારી કહેવાય છે.

ઉદાહરણ તરીકે, સુનિલે રૂ. 5,00,000 નું રોકાણ કરીને ધંધો શરૂ કર્યો અને અજ્ય પાસેથી રૂ. 1,00,000 ઉધાર લીધા. એટલે કે મિલકતની કિંમત (રોકડ) રૂ. 6,00,000 થઈ. આ બે વ્યવહારોના હિસાબી સમીકરણ આ પ્રમાણે થશે.

$$\begin{array}{rcl}
 મિલકત (રોકડ) & = & મૂડી + જવાબદારી (અજ્યની લોન) \\
 6,00,000 & = & 5,00,000 + 1,00,000
 \end{array}$$

હકીકતમાં ધંધો પોતાના માલિક અને લેણદારો પાસેથી વિરાણ પ્રાપ્ત કરી તેને અલગ અલગ મિલકતના સ્વરૂપમાં પોતાની પાસે રાખે છે. આ બાબતને એક સમીકરણના સ્વરૂપમાં નીચે મુજબ રજૂ કરી શકાય છે.

$$\begin{array}{rcl}
 મિલકત & = & મૂડી + જવાબદારી & અથવા A = C + L \\
 જવાબદારી & = & મિલકત & - મૂડી & અથવા L = A - C \\
 મૂડી & = & મિલકત & - જવાબદારી & અથવા C = A - L
 \end{array}$$

ચાલો થોડા વધુ ઉદાહરણ જોઈએ :-

રાહુલે રૂ. 3,00,000 ની મૂડી સાથે ધંધો શરૂ કર્યો. તેણે વધુ મૂડી પેટે રૂ. 2,00,000 ઉમેયા જે શેતા પાસેથી ઉધાર લીધા.

$$\begin{array}{rcl}
 મિલકત & = & મૂડી + જવાબદારી (શેતા પાસેથી લોન) \\
 5,00,000 & = & 3,00,000 + 2,00,000
 \end{array}$$

તેણે રોકડથી માલ ખરીદ્યો 50,000/-

$$\begin{array}{rcl}
 મિલકત & = & મૂડી + જવાબદારી \\
 રોકડ + માલ
 \end{array}$$

હિસાબી સમીકરણ

$$\text{જૂનું સમીકરણ} \quad 5,00,000 = 3,00,000 + 2,00,000$$

$$\text{વ્યવહારની અસર} (-) 50,000 + 50,000 = 0$$

$$\text{નવું સમીકરણ} \quad 4,50,000 + 50,000 = 3,00,000 + 2,00,000$$

તેણે શેતાને ચૂકવ્યા 50,000

$$\text{મિલ્કટ} = \text{મૂડી} + \text{જવાબદારી}$$

રોકડ + માલ

$$\text{જૂનું સમીકરણ} \quad 4,50,000 + 50,000 = 3,00,000 + 2,00,000$$

$$\text{વ્યવહારની અસર} (-) 50,000 + 0 = 0 \quad (-) 50,000$$

$$\text{નવું સમીકરણ} \quad 4,00,000 + 50,000 = 3,00,000 + 1,50,000$$

ઉપરોક્ત ઉદાહરણમાં ખર્ચ અને આવકને ગણવામાં આવ્યા નથી પરંતુ તેઓ પણ હિસાબી સમીકરણને અસર કરે છે.

દરેક ધંધાકીય એકમને તેના રોજબરોજ થોડાક નિશ્ચિત ખર્ચાં કરવા પડે છે. જેમકે પગાર ભાડું, વીમા પ્રીમીયમ, ટપાલ ખર્ચ, મજૂરી, મશીનરી મરામત ખર્ચ વગેરે આ ખર્ચાં નિયમિત રીતે ચૂકવવા પડે છે. આ ખર્ચાં ધંધાની ચોખ્ખી આવકમાં ઘટાડો કરે છે કારણકે તે રોકડમાં ચૂકવવામાં આવે છે. ખરેખર ચોખ્ખી આવક એ ધંધાના માલિકની આવક છે. જે મૂડી ખાતામાં દર્શાવાય છે. તેથી બધા જ ખર્ચાં મૂડી ખાતામાંથી ઘટાડાય છે.

તેજ રીતે દરેક ધંધાકીય એકમમાં રોજબરોજના વ્યવહારો દરમિયાન આવક પણ થાય છે. જેવી કે મળેલ ભાડું, મળેલ કમિશન વગેરે રોકડમાં મળેલ આવક રોકડની બાકી માં વધારો કરે છે. આમ, આવક ધંધાની ચોખ્ખી આવકમાં વધારો કરે છે અને તેને મૂડી ખાતામાં દર્શાવાય છે.

હવે, હિસાબી સમીકરણ નીચે મુજબ દર્શાવાય :

$$\text{મિલ્કટ} = \text{મૂડી} + \text{જવાબદારી}$$

$$+ \text{આવક (રોકડ)} = + \text{આવક}$$

$$- \text{ખર્ચાં (રોકડ)} = - \text{ખર્ચ}$$

આ રીતે હિસાબી સમીકરણ પર દરેક ધંધાકીય વ્યવહારની અસર થાય છે. મિલ્કટ, જવાબદારી અને મૂડીમાં વધારો અથવા ઘટાડાને હિસાબી સમીકરણની મદદથી જાણી શકાય છે. હિસાબી સમીકરણ દર્શાવે છે કે દરેક ધંધાકીય વ્યવહાર ના માની હિનોંથી પદ્ધતિની સંકલ્પના પૂર્ણ

મોડચુલ - ૨

આમ નોંધ અને

પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ



હિસાબી સમીકરણ

કરે છે. આ પરિસ્થિતિ પાકું સરવૈયું તૈયાર કરવા માટે આધાર પર પૂરો પાડે છે.



પઠાંતર પ્રશ્નો ૪.૧

I. ખાલી જગ્યા પૂરો :-

- હિસાબી સમીકરણને _____ સમીકરણ પણ કહે છે.
- મિલકત = _____ + જવાબદારી
- હિસાબી સમીકરણ નામાના _____ ઘ્યાલને સંતોષે છે.
- હિસાબી સમીકરણ _____ તૈયાર કરવા માટે આધાર પૂરા પાડે છે.
- મૂડી = મિલકત - _____
- જવાબદારી = _____ - મૂડી

II. વૈકલ્પિક પ્રશ્નો

- હિસાબી સમીકરણમાં મિલકત આના બરાબર હોય છે
 - ફક્ત મૂડી
 - મૂડી + જવાબદારી
 - મૂડી - જવાબદારી
 - જવાબદારી - મૂડી
- નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત મિલકતની છે ?
 - રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી
 - રોકડ, લેણદાર, લોન
 - મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બિલો
 - રોકડ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, ચૂકવવાના બાકી ખર્ચ
- નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત જવાબદારી (દેવા) ની છે.
 - રોકડ, સ્ટોક, દેવાદાર
 - રોકડ, લોન, લેણદાર
 - લેણદાર, લોન, બેંક, ઓવરાફાફ્ટ, ચૂકવવાપાત્ર બિલો

હિસાબી સમીકરણ

d. અગાઉથી ચૂકવેલ ભાડું, પગાર, મેળવવાપાત્ર બાકી બિલો

4.2 હિસાબી સમીકરણ પર વ્યવહારની અસર :-

તમે જાણો છો કે મિલકત, જવાબદારી અને મૂડી દરેક વ્યવહારના ગ્રાફ મૂળ તત્ત્વો છે. તેનો સંબંધ હિસાબી સમીકરણી મદદથી દર્શાવાય છે. જે ગમે તે સમયે સમાન રહે છે. કોઈ પણ મિલકત, જવાબદારી અથવા મૂડીમાં ફેરફાર થઈ શકે છે પણ હિસાબી સમીકરણી બંન્ને બાજુ હુંમેશા સમાન રહે છે, ચાલો, થોડા વધુ ઉદાહરણ દ્વારા આ હકીકતની પરીક્ષા કરી જોઈએ કે કેવી રીતે આ વ્યવહાર હિસાબી સમીકરણને અસર કરે છે.

ધારો કે રજની એ તેનો ધંધો શરૂ કર્યો અને નીચે પ્રમાણેના વ્યવહારો થયા.

1. તેણે મૂડી તરીકે રૂ. 5,00,000 લાવી ધંધો શરૂ કર્યો.

$$\text{મિલકત (રોકડ)} = \text{જવાબદારી} + \text{મૂડી}$$

હિસાબી સમીકરણ પર

$$\text{વ્યવહારની અસર} \quad ^\sim 5,00,000 = 0 + ^\sim 5,00,000$$

આ વ્યવહારનો અર્થ છે કે રજનીએ ધંધામાં રૂ. 5,00,000 રોક્યા. જે એક બાજુ ધંધા માટે મૂડી છે અને બીજુ બાજુ રૂ. 5,00,000. ની મિલકત (રોકડ) છે.

2. તેણે રૂ. 50,000 નું ફર્નિચર ખરીદ્યું

$$\text{મિલકત} = \text{મૂડી} + \text{જવાબદારી}$$

$$\text{Cash} + \text{Furniture}$$

$$\text{જૂનું સમીકરણ} \quad 5,00,000 + 0 = 5,00,000 + 0$$

વ્યવહારની અસર

$$(-) 50,000 + 50,000 = 0 - 0$$

$$\text{નવું સમીકરણ} \quad 4,50,000 + 50,000 = 5,00,000 + 0$$

આ વ્યવહારની અસર ફક્ત મિલકત પર થઈ કારણ કે એક મિલકતના બદલામાં બીજુ મિલકત ખરીદી આ વ્યવહારમાં રોકડના બદલામાં ફર્નિચર ખરીદ્યું. ફર્નિચરને રોકડ બંન્ને મિલકત છે. એટલે કે રોકડ ઘટ્ટી અને રૂ. 50,000 નું ફર્નિચર આવ્યું.

3. તેણે રૂ. 10,000 નો માલ ખરીદ્યો

$$\text{મિલકત} = \text{મૂડી} + \text{જવાબદારી}$$

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



Accounting Concepts : Ownership



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ALORE Acronym	If You	You Must
A/c Type	Dr ↑ Cr ↑ Cr ↑ Cr ↑ Cr ↑ Dr ↑	Cr ↑ Dr ↑ Dr ↑ Dr ↑ Cr ↑
Assets	Dr	Cr
Liabilities	Cr	Cr
Owner's Equity	Cr	Cr
Revenue	Dr	
Expense		Dr

હિસાબી સમીકરણ

રોકડ + ફર્નિચર + માલ	=	મૂડી	+ જવાબદારી
જૂનું સમીકરણ 4,50,000 + 50,000	+ 0	= 5,00,000	+ 0
વ્યવહારની અસર- 10,000 + 0	+ 10,000	= 0	+ 0
નવું સમીકરણ 4,40,000 + 50,000	+ 10,000	= 5,00,000	+ 0

ખરીદેલો માલ એક મિલકત છે. અને તેના બદલામાં ચૂકવેલ રોકડ પણ એક મિલકત છે.

આ પ્રકારે આ વ્યવહારમાં જ્યાં એક મિલકત (માલ) માં વધારો થયો ત્યાં બીજી મિલકત (રોકડ) માં ઘટાડો થયો છે. અને મૂડી અને જવાબદારી પર કોઈ જ અસર નથી થઈ.

4. તેણે રોહિત પાસેથી રૂ. 40,000 નો માલ ખરીદો

મિલકત	=	મૂડી	+ જવાબદારી
રોકડ + ફર્નિચર + માલ	=		લેણદાર (રોહિત)
જૂનું સમીકરણ 4,40,000 + 50,000	+ 10,000	= 5,00,000	+ 0
વ્યવહારની અસર 0 + 0	+ 40,000	= 0	+ 40,000
નવું સમીકરણ 4,40,000 + 50,000	+ 50,000	= 5,00,000	+ 40,000

આ વ્યવહારમાં રોહિત પાસેથી ઉધાર માલ ખરીદો છે. એટલે કે અહિંયા મિલકત (માલ) માં રૂ. 40,000 નો વધારો થયો છે. અને ધંધામાં રોહિતનું દેતું પણ થયું.

કોઈ પણ વ્યવહારમાં જો રોકડ ચૂકવણી વિષે કંઈ પણ માહિતી નથી અને બીજા પણ નામ આપેલ હોય તો આ વ્યવહાર હંમેશા ઉધાર વ્યવહાર ગણાય છે.

5. તેણે રૂ. 15,000 નો માલ રાહુલને 20,000 માં વેચ્યો.

મિલકત	=	મૂડી	+ જવાબદારી
રોકડ + ફર્નિચર + માલ + દેવાદાર		(રાહુલ)	
જૂનું સમીકરણ 4,40,000 + 50,000 + 50,000 + 0		= 5,00,000 + 40,000	
વ્યવહારની અસર 0 + 0 - 15,000 + 20,000		= + 5,000	+ 0
નવું સમીકરણ 4,40,000 + 50,000 + 35,000 + 20,000		= 5,05,000	+ 40,000

આ વ્યવહારમાં રાહુલને ઉધાર માલ વેચ્યો. અહિંયા મિલકત (માલ) માં રૂ. 15,000, નો ઘટાડો થયો અને મિલકત(દેવાદાર) માં રૂ. 20,000 નો વધારો થયો કારણ કે રાહુલ પાસેથી રૂપિયા

હિસાબી સમીકરણ

મળ્યા છે. આ પ્રક્રિયામાં માલિકને રૂ. 5,000 નો ફાયદો થયો. મૂડીમાં ઉમેરી દીધો. કારણ કે લાભ શી મૂડીમાં વધારો થયો છે.

જ્યારે પણ માલનું વેચાણ થાય પણ રોકડ વિષે કંઈ માહિતી આપેલ ન હોય અને જેને માલ વેચ્યો હગોય તેનું નામ આપેલ હોય તે તેવો વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાય છે.

6. તેણે કલાકને રૂ. 12,000 પગાર ચૂકવ્યો.

$$\text{મિલકત} = \text{મૂડી} + \text{જવાબદારી} \text{ (રોહિત)}$$

$$\text{રોકડ} + \text{ફર્નિચર} + \text{માલ} + \text{દેવાદાર} \text{ (રાહુલ)}$$

$$\text{જૂનું સમીકરણ} \quad 4,40,000 + 50,000 + 35,000 + 20,000 = 5,05,000 + 40,000$$

$$\text{વ્યવહારની અસર} 12,000 + 0 + 0 + 0 = -12,000 + 0$$

$$\underline{\text{જૂનું સમીકરણ}} \quad 4,28,000 + 50,000 + 35,000 + 20,000 = 4,93,000 + 40,000$$

આ વ્યવહારમાં કલાકને પગાર ચૂકવ્યો જે ધંધાનો ખર્ચ છે પગારની ચૂકવણી રોકડમાં કરી છે એટલે કે રોકડ સ્વરૂપની મિલકતમાં રૂ. 12,000 નો ઘટાડો થયો અને બધા જ ખર્ચ્યા મૂડી ઘટાડે છે તેથી મૂડીમાં પણ રૂ. 12,000 નો ઘટાડો થયો.

7. રોહિતને 20,000 રૂ. રોકડ ચૂકવ્યા

$$\text{મિલકત} = \text{મૂડી} + \text{જવાબદારી} \text{ (રોહિત)}$$

$$\text{રોકડ} + \text{ફર્નિચર} + \text{માલ} + \text{દેવાદાર} \text{ (રાહુલ)}$$

$$\text{જૂનું સમીકરણ} \quad 4,28,000 + 50,000 + 35,000 + 20,000 = 4,93,000 + 40,000$$

$$\text{વ્યવહારની અસર} 20,000 + 0 + 0 + 0 = 0 - (-) 20,000$$

$$\underline{\text{જૂનું સમીકરણ}} \quad 4,08,000 + 50,000 + 35,000 + 20,000 = 4,93,000 + 20,000$$

આ વ્યવહારમાં લેણદાર (રોહિત)ને રૂ. 20,000 રોકડ ચૂકવ્યા. એટલે રોકડ સ્વરૂપની મિલકતમાં રૂ. 20,000 નો ઘટાડો થયો અને સાથે સાથે લેણદાર (રોહિત)માં રૂ. 20,000 નો ઘટાડો થયો છે.

ઉપરોક્ત વ્યવહારો પરથી તમને સ્પષ્ટ થશે કે દરેક વ્યવહાર હિસાબી સમીકરણની બંન્ને બાજુને વિચાલિત કર્યા વગર હિસાબી સમીકરણની પ્રક્રિયાને અસર કરે છે.

4.3 સમીકરણના સંયોજન :-

મિલકત, જવાબદારી અને મૂડી વચ્ચેના આંતરિક સંબંધોને વિભિન્ન સ્વરૂપમાં સ્પષ્ટ કરી શકાય છે. નવ પ્રકારના સંયોજનો સર્જ શકાય છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને

પેટા નોંધ



નોંધ

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

હિસાબી સમીકરણ

એકમાં વધારો અથવા ઘટાડાની સાથે તેમાં અથવા બીજામાં વધારો અથવા ઘટાડો થાય છે. ચાલો, આવા નવ સંયોજનને ઉદાહરણની મદદથી સમજીએ.

i) મિલ્કતમાં વધારાની સાથે મૂડીમાં પણ વધારો.

ઉદાહરણ : રોકડ લાવી ધંધો શરૂ કર્યો.

ii) મિલ્કતમાં વધારાની સાથે જવાબદારીમાં વધારો.

ઉદાહરણ : ઉદાર માલ ખરીદ્યો.

iii) મિલ્કતમાં ઘટાડાની સાથે મૂડીમાં પણ ઘટાડો.

ઉદાહરણ : માલિકે અંગત ઉપયોગ માટે ધંધમાંથી રોકડ લીધી.

iv) મિલ્કતમાં ઘટાડાની સાથે જવાબદારીમાં પણ ઘટાડો.

ઉદાહરણ : લેણદારને રોકડ ચૂકવ્યા.

v) મિલ્કતમાં વધારો અને ઘટાડો.

ઉદાહરણ : ફર્નિચર રોકાની ખરીદ્યું. માલ રોકાની ખરીદ્યો. વગેરે.

vi) જવાબદારીમાં વધારો અને ઘટાડો.

ઉદાહરણ : બેંકમાંથી લોન લઈ લેણદારોને ચૂકવ્યા.

vii) મૂડીમાં વધારો અને ઘટાડો.

ઉદાહરણ : મૂડી પર વ્યાજ

viii) જવાબદારીમાં વધારો અને મૂડીમાં ઘટાડો

ઉદાહરણ : ચૂકવવાની બાકી મજૂરી, ચૂકવવાનો બાકી પગાર વગેરે.

ix) મૂડીમાં વધારો અને જવાબદારીમાં ઘટાડો.

ઉદાહરણ : માલિક દ્વારા ચૂકવવાની બાકી લોન નું મૂડીમાં પરિવર્તન.

હિસાબી સમીકરણના નિયમો :-

- મૂડી : જ્યારે મૂડીમાં વધારો થાય છે તો તે જમા (+) અને જ્યારે મૂડીનો એક નાનકડો ભાગ ઉપાડી લેવામાં આવે તો તે ઉધાર (-) કરાય છે.
- આવક : આવકની રકમથી માલિકની મૂડીમાં વધારો થાય છે.
- ખર્ચ : ખર્ચની રકમથી માલિકની મૂડીમાં ઘટાડો થાય છે.

હિસાબી સમીકરણ

- iv. બાબુ જવાબદારી: જ્યારે બાબુ જવાબદારીમાં વધારો થાય છે તો બાબુ જવાબદારી જમા (+) કરાય છે.
- v. મિલકત: જ્યારે મિલકત માં વધારો થાય છે તો વધારાની રકમ મિલકત ખાતે ઉધાર (+) કરાય છે અને જો કોઈ ઘટાડો થાય તો ઘટાડેલી રકમ મિલકત ખાતે (-) કરાય છે.
- vi. ચૂકવવાના બાકી ખર્ચની અસર: જવાબદારીમાં વધારો અને મૂડીમાં ઘટાડો.
- vii. નજી સ્વરૂપમાં આવક: મિલકતમાં વધારો અને મૂડીમાં ઘટાડો.
- viii. અગાઉથી મળેલ આવક: મિલકત (રોકડમાં) વધારો અને
- ix. મૂડી પર વ્યાજ:- આ ધંધા માટે ખર્ચ છે એટલે કે લાભમાં ઘટાડો થાય છે અને મૂડીમાંથી બાદ કરાય છે. બીજુ બાજુ મૂડી પર વ્યાજથી માલિકની મૂડી વધે છે. અને તે મૂડીમાં ઉમેરાય છે. અંતમાં આ વ્યવહારની મૂડી પર કોઈ અસર થતી નથી મૂડી યથાવત રહે છે.
- x. મિલકત અને જવાબદારી:- મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની તેમના ઉપર અસર થતી નથી.

ઉદાહરણ 1 : નીચેના વ્યવહારની હિસાબી સમીકરણની અસર દર્શાવો :-

1. શશીએ ધંધો શરૂ કર્યો.

રોકડCash	2,00,000
માલ	1,20,000
મશીનરી	80,000
2. તેણે રોકડથી માલ ખરીદો.	50,000
3. તેણે માલ વેચ્યો. (મૂ. ક્ર. રૂ. 20,000)	25,000
4. તેણે રવિ પાસેથી માલ ખરીદો.	70,000
5. તેણે રવિને ચૂકતે હિસાબે રોકડ ચૂકવ્યા.	69,000
6. તેણે વિકાસને માલ વેચ્યો. (મૂ. ક્ર. 54,000)	60,000
7. વિકાસ પાસેથી રોકડ મળી. તેણે રૂ. 2,000 નો વરાવ આપ્યો.	58,000
8. તેણે પગાર ચૂકવ્યો.	40,000
9. ચૂકવવાનું બાકી ભાડું.	4,000
10. અગાઉથી ચૂકવેલ વિમો	1,000
11. તેને કમિશન મળ્યું.	3,000

મોડચુલ - ૨

આમ નોંધ અને

પેટા નોંધ



નોંધ

મોડિયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

હિસાબી સમીકરણ

અનુદ્દિષ્ટ નામ.	અનુદ્દિષ્ટ વિધાન	શેકડા	+	માલ	+	મશીનશી	+	દ્વારાર	+	અગણિશી	=	જામાના	નોંધ	અનુદ્દિષ્ટ બાજુથી
૧.	કંપની શરૂ કર્યો સાથે રેકડરી. ૨,૦૦,૦૦૦ માલ હો. ૨, ૨૦,૦૦૦ મશીનશી હો. ૮૦,૦૦૦	૨,૦૦,૦૦૦	+	૧,૨૦,૦૦૦	+	૮૦,૦૦૦	+	૮૦,૦૦૦	+	૮૦,૦૦૦	=	૪૫૦૫૬૪૩	૦	૫૫૦,૦૦૦
૨.	કો. ૫૦,૦૦૦ ની માલ ખર્ચથી ન્યૂસમિસ્ટરશી	-૫૦,૦૦૦	+	૫૦,૦૦૦	+	૮૦,૦૦૦	+	૦	+	૦	=	૦	૦	૫૫૦,૦૦૦
૩.	કો. ૨૫૦૦૦ ની માલ વેચ્યો (ક્રેડિટ ડે. ૨૦૦૦૦) ન્યૂસમિસ્ટરશી	૨૫,૦૦૦	-	૨૦,૦૦૦	+	૦	+	૦	+	૦	=	૦	૦	૫૫૦,૦૦૦
૪.	રાખે પાણેથી કો. ૭૦,૦૦૦ ની માલ અટીયો ન્યૂસમિસ્ટરશી	૦	+	૭૦,૦૦૦	+	૦	+	૦	+	૦	=	૭૦,૦૦૦	૦	૫૫૦,૦૦૦
૫.	રાખેને કૂકો હિસાબે હો. ૬૫૦૦૦/- અનુદ્દિષ્ટ ન્યૂસમિસ્ટરશી	-૬૫,૦૦૦	+	૦	+	૦	+	૦	+	૦	=	-૬૦,૦૦૦	૦	૫૫૦,૦૦૦
૬.	કો. ૫૪,૦૦૦ ની માલ વિકસન કો. ૬૦,૦૦૦ માં વેચ્યો.	૦	-	૫૪,૦૦૦	+	૦	+	૬૦,૦૦૦	+	૦	=	૦	૦	૫,૦૦૦
૭.	કો. ૬૫,૫૫,૦૦૦ ન્યૂસમિસ્ટરશી	૧,૦૫,૦૦૦	+	૧,૬૫,૦૦૦	+	૮૦,૦૦૦	+	૬૦,૦૦૦	+	૦	=	૦	૦	૫૫૦,૦૦૦

હિસાબી સમીકરણ

૭.	ફેલાસ પાસેથી રોકડાના માટે તેને ૨૦૦૦૨ રૂ. બાળ આપ્યો. ન્યુઝસમીકરણ	૪૮,૦૦૦ + ૦ + ૦ - ૫૦,૦૦૦ + ૦ = ૦ + ૦ + ૦ + -૨,૦૦૦
c.	ખાર છૂકવ્યે હો. રૂ. ૧૦,૦૦૦ ન્યુઝસમીકરણ	-૪૦,૦૦૦ + ૦ + ૦ + ૦ + ૦ = ૦ + ૦ - ૪૦,૦૦૦
c.	ખચવચાનું બાદી લઈ રૂ. ૪,૦૦૦ ન્યુઝસમીકરણ	૧,૨૪,૦૦૦ + ૧,૬૬,૦૦૦ + ૮૦,૦૦૦ + ૦ + ૦ = ૦ + ૦ + ૩૯૦,૦૦૦
૧૦.	અગાઉની કુદરેલ ડાની રૂ. ૧,૦૦૦ ન્યુઝસમીકરણ	૧,૨૩,૦૦૦ + ૧,૬૬,૦૦૦ + ૮૦,૦૦૦ + ૦ + ૦ = ૦ + ૧,૦૦૦ - ૧,૦૦૦
૧૧.	કન્દિશન મળ્યું રૂ. ૩૦૦૦ ન્યુઝસમીકરણ	૩,૦૦૦ + ૦ + ૦ + ૦ + ૦ + ૧,૦૦૦ = ૦ + ૦ + ૦ + ૦ - ૦
૧૨.	રેક્રોટિયાચા રૂ. ૩૦,૦૦૦ ન્યુઝસમીકરણ	-૩૦,૦૦૦ + ૦ + ૦ + ૦ + ૦ = ૦ + ૦ + ૩૦,૦૦૦
૧૩.	ફૂલપુર માઝ રૂ. ૨,૦૦૦ ન્યુઝસમીકરણ	૮૬,૦૦૦ + ૧,૬૬,૦૦૦ + ૮૦,૦૦૦ + ૦ + ૧,૦૦૦ = ૦ + ૧,૦૦૦ + ૩૩૬,૦૦૦
	કુલ	૩,૪૩,૦૦૦
		૩,૪૩,૦૦૦

મોડ્યુલ - ૨

આમ નોંધ અને

પેટા નોંધ



નોંધ

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

હિસાબી સમીકરણ



પઠાંતર પ્રશ્નો ૪.૨

- | | |
|--------------------------------|--------|
| 12. અંગત ઉપયોગ માટે રોકડ ઉપાડી | 30,000 |
| 13. તેની મૂડી પર વ્યાજ | 2,000 |

વૈકલ્પિક પ્રશ્નો

- રીતુ પાસેથી રૂ. 60,000 અને માલ ખરીદ્યો. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની શું અસર થશે ?
 - મિલ્કતમાં વધારો અને જવાબદારીમાં વધારો
 - મિલ્કતમાં વધારો તથા ઘટાડો
 - જવાબદારીમાં વધારો તથા ઘટાડો
 - મિલ્કતમાં ઘટાડો તથા જવાબદારીમાં ઘટાડો
- ચૂકવવાનું બાકી ભાડું રૂ. 2,000 છે. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની અસર શું થશે ?
 - મિલ્કતમાં વધારો તથા ઘટાડો
 - જવાબદારીમાં વધારો તથા ઘટાડો
 - જવાબદારીમાં વધારો તથા મિલ્કતમાં વધારો
 - જવાબદારીમાં વધારો અને મૂડીમાં વધારો
- ઉપાડ પર વ્યાજ રૂ. 5,000 છે. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની શું અસર થશે ?
 - મિલ્કતમાં વધારો તથા ઘટાડો
 - જવાબદારીમાં વધારો તથા ઘટાડો
 - મૂડીમાં વધારો તથા ઘટાડો
 - મિલ્કતમાં વધારો તથા જવાબદારીમાં વધારો



તમે આટલું શીખ્યા :

- ધ્યાકીય વ્યવહારનો અર્થ છે વસ્તુ અથવા સેવાનો વિનિમય કે જે મૂલ્યના બદલામાં અથવા ધ્યામાં કરવામાં આવતી અન્ય નાણાંકીય કિયા માટે કરવામાં આવે છે.

હિસાબી સમીકરણ

- દરેક ધંધાકીય વ્યવહાર દ્વિનોંધી પ્રદર્શિતની સંકલ્પના પૂર્ણ કરે છે.
- દરેક ધંધાકીય વ્યવહાર હિસાબી સમીકરણને આધારે દર્શાવી શકાય છે.
- મિલકત = મૂડી + જવાબદારી ($A = C + L$)
- હિસાબી સમીકરણએ એક ગાણિતિક અભિવ્યક્તિ છે. જે એક બાજુ મિલકત અને બીજું બાજુ મૂડી અને જવાબદારીના સરવાળામાં સમાનતા દર્શાવે છે.
- હિસાબી સમીકરણ પર દરેક ધંધાકીય વ્યવહારની અસર થાય છે.
- ધંધાનું પોતાનું કશું જ નથી તેમજ તે કોઈનો ઝાણી નથી. ન તો કોઈ તેનો માલિક છે અને ન તો તે કોઈનો ઝાણી છે.
- કોઈ પણ પરિસ્થિતિમાં હિસાબી સમીકરણની સમાનતા સરખી જ રહે છે.
- ખર્ચ અને આવકની અસર હંમેશા મૂડી ખાતા પર પડે છે. ખર્ચ મૂડીમાં ઘટાડો કરે છે અને આવક મૂડીમાં વધારો કરે છે.
- હિસાબી સમીકરણના કોઈ પણ તત્ત્વમાં થતો વધારો અથવા ઘટાડાની સાથે જ તેમાં અથવા કોઈ અન્ય તત્ત્વમાં વધારો અથવા ઘટાડો થાય છે.



પાઠ્યાંત સ્વાધ્યાય :

1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. (1-10 શબ્દોમાં)
 - i. જો ધંધાકીય એકમ કોઈ રકમ ઉધાર લીધી, તો આની હિસાબી સમીકરણ પર શું અસર થશે ?
 - ii. બે ઉદાહરણ આપો - એકની અસર ફક્ત મિલકત પર અને બીજાની ફક્ત જવાબદારી પર પડે.
 - iii. અગાઉથી મળેલ આવક હિસાબી સમીકરણમાં તમે કેવી રીતે દર્શાવશો.
 - iv. જો રૂ. 8,000 નો માલ રૂ. 8,500 માં વેચ્યો તો મૂડી પર શું અસર થશે ?
2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. (30-50 શબ્દોમાં)
 - i. હિસાબી સમીકરણ એટલે શું ?
 - ii. હિસાબી સમીકરણમાં આવક અને ખર્ચની અસર દર્શાવો.
 3. "હિસાબી સમીકરણ દરેક પરિસ્થિતિમાં સમાન હોય છે" થોડાક ઉદાહરણની મદદથી આ વિધાનની સત્યતા લગભગ (100-150 શબ્દોમાં) વર્ણવો.
4. નીચેના વ્યવહારો પરથી હિસાબી સમીકરણ તૈયાર કરો.
 - i. કરણે રૂ. 1,60,000 ની રોકડ થી ધંધો શરૂ કર્યો.
 - ii. તેણે રૂ. 16,000 નું ફન્નીયર ખરીદ્યું.
 - iii. તેણે રૂ. 1,600 ભાડું ચૂક્યું.
 - iv. તેણે રૂ. 24,000 નો માલ ઉધાર ખરીદ્યો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

હિસાબી સમીકરણ

- v. તેણે રૂ. 16,000 નો માલ 40,000 માં રોકટેથી વેચ્યો.
અક્ષયે નીચે પ્રમાણેના વ્યવહાર કર્યા.
- | | | |
|-------|-------------------------------------|----------|
| i. | રોકડ રકમથી ધંધો શરૂ કર્યો. | 2,50,000 |
| ii. | રોકટેથી માલ ખરીદ્યો. | 1,00,000 |
| iii. | પગાર ચૂકવ્યો. | 2,500 |
| iv. | રૂ. 2,00,000 ની કિંમતનો માલ વેચ્યો. | 1,50,000 |
| v. | ચૂકવવાનું બાકી ભાડું | 500 |
| vi. | ઉધાર માલ ખરીદ્યો. | 1,50,000 |
| vii. | મશીનરી ઉધાર ખરીદ્યો | 25,000 |
| viii. | અંગત ઉપયોગ માટે મોટર સાયકલ ખરીદ્યો | 25,000 |
| ix. | રોકટેથી બિલ્ડિંગ ખરીદ્યો | 1,00,000 |
- હિસાબી સમીકરણનો ઉપયોગ કરીને મિલકતા, જવાબદારી અને મૂડી પર ઉપરોક્ત વ્યવહારની અસર દર્શાવો.
6. નીચેના વ્યવહારો પરથી હિસાબી સમીકરણ દર્શાવો.
- | | | |
|-------|--|----------|
| i. | શિવમે ધંધો શરૂ કર્યો.
રોકડા | 5,00,000 |
| | માલ | 2,00,000 |
| ii. | તેણે રોકટેથી થી મશીનરી ખરીદ્યો | 2,50,000 |
| iii. | તેણે રમેશ પાસેથી માલ ખરીદ્યો | 1,00,000 |
| iv. | તેણે સુરેશને રૂ. 25,000 ની કિંમતનો માલ વેચ્યો. | 30,000 |
| v. | વીમા પ્રિમિયમ ચૂકવ્યું | 5,000 |
| vi. | ચૂકવવાનો બાકી પગાર | 10,000 |
| vii. | મશીનરી પર ઘસારો | 25,000 |
| viii. | મૂડી પર વ્યાજ | 3,000 |
| ix. | અંગત ઉપયોગ માટે ઉપાડ્યા | 18,000 |
| x. | ઉપાડ પર વ્યાજ | 900 |
| xi. | અગાઉથી મળેલ ભાડું | 1,500 |
| xii. | રમેશને રોકડા ચૂકવ્યા | 50,000 |
| xiii. | સુરેશ પાસેથી રોકડા મળ્યા | 15,000 |

હિસાબી સમીકરણ



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

- 4.1 I. (i) પાકું સરવૈયું (ii) મૂડી
(iii) દ્વિનોંધી ઘ્યાલ (iv) પાકું સરવૈયું
(v) જવાબદારી (vi) ભિલકત
- II. (i) b (ii) a (iii) c
- 4.2 (i) a (ii) d (iii) c

તમારા માટે પ્રવૃત્તિ

- જુદા જુદા ધંધાકીય એકમોમાં પૂછપરછ કરી વ્યવહારોની નોંધની જુદી જુદી પ્રક્રિયાઓની યાદી તૈયાર કરો.
- દસ ધંધાકીય વ્યવહારોની નોંધ કરો. અને તેમના માટેના હિસાબી સમીકરણ દર્શાવો અને તે દરેક દરેક પગથિયે સરખાં છે કે નહિ તે ચકાસો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

૪

દ્વિનોંધી નામા પદ્ધતિ

અગાઉ જણાવ્યા પ્રમાણે નામું એ લંડડ-દેવડના વ્યવહારોની પદ્ધતિસરની નોંધ રાખે છે. પરંતુ આ પદ્ધતિ કઈ છે. નામાની આ પદ્ધતિ કે જે વૈશ્વિક સ્તરે ઉપયોગનાં લેવાય છે તેને દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ પદ્ધતિની પ્રાથમિક સમજ એટલે કે બેદી અસરની પૂર્વધારણા પર આધારિત છે. આ પ્રકરણમાં તમે નામાના મૂળત્વોની દ્વિનોંધી પદ્ધતિ, ખાતું અને તેના પ્રકાર, નામાના વાઉચર અને વાઉચર બનાવવાની પદ્ધતિ વિશે જાણશો.



હેતુઓ :

આ પ્રકરણનો અભ્યાસ કર્યો પછી તમે :

- નામાના મૂળત્વોની દ્વિનોંધી નામા પદ્ધતિનો અર્થ આપી શકશો.
- દ્વિનોંધી નામા પદ્ધતિના ફાયદા અને મયાર્દાઓ જણાવી શકશો.
- ખાતાનું જુદા-જુદા વિભાગોમાં વિભાજન કરી શકશો.
- ઉધાર અને જમાના નિયમો સમજ શકશો.
- સ્લોટ દસ્તાવેજ ઓળખી શકશો.
- નામાના વાઉચરનો અર્થ સમજ શકશો.
- જુદા - જુદા પ્રકારના વાઉચરો ને સમજ શકશો.
- વાઉચર તૈયાર કરવાની પદ્ધતિ જાણી શકશો.

પ.૧ નામાના મૂળત્વોની દ્વિનોંધી પદ્ધતિનો અર્થ :

નામાના મૂળત્વોની દ્વિનોંધી નામા પદ્ધતિ ને લેવડ દેવડના વ્યવહારોની પદ્ધતિ ના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરી શકાય છે. તેના બે આધારભૂત પાસા છે. એક લાભ મેળવવો અને બીજો લાભ આપવો. આ સિદ્ધાંત પ્રમાણે દરેક વ્યવહારની બે નોંધ કરવામાં આવે છે. આથી તેને દ્વિનોંધી નામા પદ્ધતિ કહે છે.

નામાની દ્વિનોંધી પદ્ધતિના ખ્યાલ મુજબ દરેક વ્યવહારમાં બે ભાગ છે. એક મેળવનાર અને એક આપનાર. જે મેળવે છે તે દેવાદાર છે અને જે આપે છે તે લેણદાર હોય છે. દ્વિનોંધી પદ્ધતિ પ્રમાણે આ બંને પક્ષની ખાતાના સ્વરૂપમાં નોંધ થાય છે. જે ખાતું લાભ મેળવે છે તે ઉધાર અને જે

દ્વિનોંધી નામા પદ્ધતિ

લાભ આપે છે તે જમા બાજુ લખાય છે. આ પદ્ધતિના અંતિમ પરિણામ મુજબ દરેક ઉધારની સામે તેની જમાબાજુ અને દરેક જમાની સામે તેની ઉધારબાજુ હોય છે. એટલે જ કોઈ પણ દિવસે ઉધારબાજુની વિગતનો સરવાળો જમાબાજુની વિગતના સરવાળા જેટલો જ થાય છે.

ઉદાહરણ તરીકે, આપણે ધંધા માટે રૂ. 30000 ની મશીનરી ખરીદી. આથી બે ફેરફાર થશે, મશીનરીમાં રૂ. 30000નો વધારો થશે અને રોકડ રકમ એટલીજ ઓછી થશે નામાના ચોપડામાં આ લેવડ ડેવડની નોંધ કરતી વખતે બંને ફેરફારની નોંધ થશે. નામાની ભાખામાં આ બને ફેરફારને ઉધાર ફેરફાર અને જમા ફેરફાર કહેવાય. આંહિયા મશીનરી ખાતે ઉધાર અને રોકડખાતે જમા લખાશે.

આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે દરેક વ્યવહારની બે નોંધ થશે એક ઉધાર અને બીજી જમા. દરેક ઉધાર વ્યવહાર ની નોંધ જેટલી જ રકમની જમા નોંધ પણ થશે અને તેનાથી ઉલ્લંઘ દરેક જમા વ્યવહારની નોંધ જેટલી રકમની ઉધાર નોંધ પણ થશે. આ પ્રમાણે જે પદ્ધતિમાં દરેક વ્યવહાર ના બંને ફેરફારની સાથે નોંધ કરવામાં આવે છે, તેને નામામાં દ્વિનોંધી પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિ એ સિદ્ધાંત પર આધારિત છે કે દરેક ઉધારનું જમા હોય છ અને દરેક જમાનું ઉધાર હોય છે.

5.2 દ્વિનોંધી પદ્ધતિના ફાયદા અને મર્યાદા :-

દ્વિનોંધી પદ્ધતિના મુખ્ય ફાયદાઓ નીચે પ્રમાણે છે.

૧. વ્યવહારોની ઉપરોક્ત વિગતને આધારે વેપાર અને નફા-નુકશાન ખાતું તૈયાર કરવામાં આવે છે. જેનાથી ચોક્કસ સમયગાળા દરમિયાન ધંધાનો કુલ નફો અને ચોખ્ખો નફો સરળતાથી આણી શકાય છે.
૨. લેણદાર અને દેવાદારના વ્યક્તિગત ખાતા તથા મિલ્કતના ખાતા તૈયાર કરવામાં આવે છે જેનાથી પાકુ સરવૈયું બનાવી શકાય છે.
૩. લેવડ-દેવડની નોંધ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતી હોવાથી ધંધાની વિશ્વસનીય માહિતી પ્રામ થાય છે.
૪. ખાતામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો ખૂબજ મુશ્કેલ હોય છે. જેથી છંતરપીઠિ નિવારી શકાય છે.
૫. આ ધંધાના કોઈપણ એક સરવાળાના વેચાણ, ખરીદી, શરૂનો સ્ટોક, આખર નો સ્ટોક વગેરે માહિતી ને અગાઉના ચોક્કસ સમયગાળાની આ બધી માહિતી સાથે સરખાવી શકાય છે. જેના દ્વારા વેપારી આણી શકે છે. કે તેનો ધંધો પ્રગતિ કરી ગયો છે કે નાહિં.
૬. નામાની નોંધની ગણિતીક સત્યતા ચકાસવા માટે કોઈપણ દિવસે કાચું સરવૈયું તૈયાર કરી શકાય છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને

પેટા નોંધ




નોંધ

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ



દ્વિનોંધી નામા પદ્ધતિ

દ્વિનોંધી પદ્ધતિની મર્યાદાઓ :-

આ પદ્ધતિની મુખ્ય મર્યાદાઓ :-

- આ પદ્ધતિમાં વધુ પ્રમાણમાં નામાના ચોપડાઓ રાખવા પડે છે. જે નામા ધંધાકીય એકમો માટે વ્યવહારું નથી.
- આ પદ્ધતિ ખર્ચણી છે કારણ કે તેમાં ઘણા બધા ચોપડાઓ રાખવા પડે છે.
- કાચું સરવૈયું મળી જવું તેને નામાની ચોક્સાઈ નું પ્રમાણ માનવામાં આવે છે. પણ આ ચોપડાની સંપૂર્ણ ચોક્સાઈની ખાતરી (ગેરંટી) નથી.



પાઠ સ્વાધ્યાય ૫.૧

ખાલી જગ્યા પુરો .

- નામાની દ્વિનોંધી પદ્ધતિ એવા વ્યવહારોની નોંધ છે. જેમાં
- જે મેળવે છે તે અને જે આપે છે તે હોય છે.
- દ્વિનોંધી પદ્ધતિ ને કારણે થતી છેતરપાંડિને રોકે છે.
- કાચું સરવૈયું મળવું એ નામાના ચોપડાની પૂર્ણ ચોક્સાસાઈની નથી.

૫.૩ ખાતાનો અર્થ અને વર્ગીકરણ :-

નામાની પદ્ધતિ નાણાંકીય લેવડ-દેવડનાં પ્રવાહ અને નાણાંકીય સ્થિતિ સાથે જોડાયેલી સૂચના નો અમલ છે, તેને જાળવી રાખે છે અને તેને પુનઃઉપલબ્ધ કરે છે. નાણાંકીય લેવડ-દેવલ નો પ્રવાહ મૂળ અવકનો આંતરિક પ્રવાહ અને ખર્ચના બાબુ પ્રવાહને કારણે થાય છે. નાણાંકીય સ્થિતિના તાતોમાં સંપત્તિ, રોકડ આવક, રોકડ જાવક અને તેના ખર્ચના પ્રાથમિક સમૂહો જેવા કે મિલ્કટ, જવાબદારી અને ઇક્વિટી વગેરેનો સમાવેશ થાય છે.

આ પ્રાથમિક સમૂહમાં દરેક મિલ્કટ જવાબદારી આવક અને ખર્ચ/જાવકનું પ્રતિનિધિત્વ તેનું સંબંધિત ખાતું કરે છે નામું એ ફક્ત નાણાંકીય આવકપ્રવાહ અને જાવકપ્રવાહની નોંધમાત્ર છે જે મિલ્કટ, જવાબદારી મૂરી આવક અને ખર્ચની સાથે સંબંધિત હોય છે.

ખાતું વ્યક્તિ અને વસ્તુ સાથે જોડાયેલા બધાજ ધંધાકીય વ્યવહારોની નોંધ છે નામામાં આપણે દરેક મિલ્કટ જવાબદારી ખર્ચ અને આવક નો અલગ - અલગ હિસાબ રાખાં છીએ અને આ હિસાબ ને મથાળા નીચે દર્શાવાય છે તેને ‘ખાતુ’ કહેવાય છે. જેમકે મદનનું ખાતુ ક્રિજ નું ખાતુ

દ્વિનોંધી નામા પદ્ધતિ

મકાનનું ખાતું ભાડાનું ખાતું, વટાવનું ખાતું વગેરે. મદનની સાથે કરવામાં આવતી દરેક લેવડ - દેવડની નોંધ મદનના ખાતામાં નોંધાય છે. તેવી જ રીતે બ્રિજ સાથે સંબંધિત લેવડ - દેવડ ને બ્રિજના ખાતામાં નોંધાય છે. આમ, ખાતું એ કોઈ વ્યક્તિકે વસ્તુ સાથે જોડાયેલા અને નાણામાં માપી શકાય તેવા વ્યવહારોની વ્યવસ્થિત નોંધ છે જે એક યોગ્ય સમયગાળા દરમિયાન થાય છે. ખાતું એ એક શીષ્ટક છે જેના હેઠળ તેની સાથે સંબંધિત લેવડ દેવડની માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ અને નોંધ થાય છે. દા.ત. વેચાણ ખાતામાં વેચાણની અને આપેલ સેવાઓની નોંધ થાય છે. તેવી જ રીતે નાણીકીય વર્ષ દરમિયાન થયેલા ખર્ચ જે તે ખર્ચ ખાતામાં નોંધાય છે. ખાતાઓનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે.

૧. ડ્રાઇગત વર્ગીકરણ

૨. આધુનિક વર્ગીકરણ

લાક્ષણિકતાના આધારે ખાતાઓનું વર્ગીકરણ અથવા ડ્રાઇગત વર્ગીકરણઃ

પ્રકૃતિ (લક્ષણ)ના આધારે ખાતાઓના નીચે મુજબ ત્રણ પ્રકારો છે

૧. વ્યક્તિગત કે અંગત ખાતા : વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહના નામના ખાતાને વ્યક્તિગત ખાતા કહેવાય છે. દા.ત. રમેશ, મહેશ, મે. એમ.કે.કોમ્પ્યુટર વગેરે .
૨. નામમાત્રના ખાતા :- ખર્ચના ખાતાં :- ખર્ચ અને તુકસાન તથા આવક અને જાવકના ખાતાને નામમાત્રના ખાતા કહેવાય. દા.ત મજૂરીનું ખાતું, મળેલ કમિશનનું ખાતું વગેરે.
૩. વાસ્તવિક ખાતા : મિલકતનાં ખાતાને વાસ્તવિક ખાતાં કહેવાય દા.ત. મકાનનું ખાતું ફર્નિચરનું ખાતું વગેરે.

આધુનિક વર્ગીકરણ :

આ વર્ગીકરણના આધારે ખાતાઓને નીચે મુજબના પાંચ ભાગમાં વિભાજીત કરી શકાય છે.

૧. મુડી ૨. મિલકત ૩. જવાબદારી ૪. ખર્ચાને ૫. આવક

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

Table I Accounting entry rules (double entry method)


Nominal accounts	Debit the expenses Credit the gains	Personal accounts	Debit the receiver Credit the giver	Real accounts	Debit what comes in Credit what goes out
------------------	--	-------------------	--	---------------	---

મોડચુલ - ૨


આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ



દ્વિનોંધી નામા પદ્ધતિ



- ખાતાઓનું વિશેષ વર્ગીકરણ તેમના નાણાંકીય વર્ષના સંદર્ભમાં તેમના આંતરિક પ્રવાહ અથવા બાબુ પ્રવાહના સમયગાળા પર આધારિત છે.
- આવક એ નાણાંકીય વર્ષમાં ત્વરિતનો આંતરિક પ્રવાહ છે.
- ખર્ચ એ નાણાંકીય વર્ષમાં ત્વરિતનો બાબુ પ્રવાહ છે.
- મિલકત એ લાંબા સમયગાળાનો આંતરિક પ્રવાહ છે જેનો પ્રભાવ નાણાંકીય વર્ષ કરતાં વધુ સમય સુધી રહે છે.
- જવાબદારી એ લાંબા સમયગાળાનો બાબુ પ્રવાહ છે જેનો પ્રભાવ એક નાણાંકીય વર્ષ કરતાં વધુ સમય સુધી રહે છે.



પાઠ સ્વાધ્યાય ૫.૨

દ્વિનોંધી નામા પદ્ધતિમાં લેવડ - ટેવડ ના બંને પદ્ધતોની નોંધ થાય છે. દરેક લેવડ ટેવડના બે પદ્ધતિ હોય છે. અને આ પદ્ધતિ પ્રમાણે બંને પદ્ધતોની નોંધ થાય છે. જો ધંધામાં કંઈક પ્રામ થાય છે. તો બદલામાં તેણે કંઈક આપવું પણ પડે છે. દરેક લેવડ-ટેવડની નોંધ કરતી વખતે ઉધાર બાજુ લખેલી કુલ રકમ જમાબાજુની કુલ રકમ જેટલી થવી જોઈએ. ઉધાર બાજુ અને જમા શબ્દ દર્શાવે છે. કે લેવડ-ટેવડ ખાતાની જમણીબાજુ લખાશે કે ડાબી બાજુ સરળ સ્વરૂપમાં ખાતું અંગેજ અક્ષર (ટી) જેવું દેખાય છે.

તમે જોયું કે ટી આકારમાં વસ્તુમાં વધારા અને ઘટાડાની નોંધ કરવા માટે એક ડાબી બાજુ અને બીજી જમણીબાજુ હોય છે. આ વર્ષના અંતે દરેક વસ્તુની અંતિમ સ્થિતિના નિર્ધારણ માં સહાયરૂપ થાય છે. ઉદાહરણ તરીકે જો આ આતું કોઈ માલસામાન પૂરો પાડનારનું છે તો એણે જે માલ પૂરો પાડયો હોય તે જમણી બાજુ, જમા માં દર્શાવશે અને જો બધીજ આવક ડાબી બાજુ ઉપર 'ઉધાર' માં નોંધાશો.

'ટી' આકારના ખાતામાં ડાબીબાજું 'ઉધાર' (ટુંકમાં સામાન્ય રીતે ઊ) અને જમણીબાજુ 'જમા' (ટુંકમાં સામાન્ય રીતે ઊ) તરીકે ઓળખાય છે.

દિનોંધી નામા પદ્ધતિ

ખાતાનું શીષ્ટક

(ડાલીબાજુ)

(જમણીબાજુ)

ટી આકારના - ખાતાનો નમૂનો

નામાના નિયમો :-

ધ્યાકીય લેવડ-દેવડ ની નોંધ કરવાના હેતુથી ખાતાને પાંચ પ્રકારમાં વિભાજાત કરવામાં આવે છે જે આ પ્રમાણે છે.

1. મિલકત 2. જવાબદારી 3. મૂડી 4. ખર્ચ/ખોટ અને 5. આવક/નફો
- ખાતામાં ફેરફારની નોંધ કરવા માટે બે મૂળભૂત નિયમોનું પાલન કરવામાં આવે છે.
6. મિલકત ખર્ચ/ખોટમાં ફેરફારનો નિયમ :-
“મિલકતમાં વધારાને ઉધાર અને મિલકતમાં ઘટાડાને જમાબાજુ લખાશે.”
 7. જવાબદારી મૂડી અને આવક-નફોમાં ફેરફારનો નિયમ :-
“જવાબદારીમાં વધારો જમા બાજુ અને ઘટાડાને ઉધારબાજુ લખાશે.
“મૂડીમાં વધારો જમા બાજુ અને ઘટાડાને ઉધારબાજુ લખાશે.
“ઉપજમાં વધારો જમા બાજુ અને ઘટાડાને ઉધારબાજુ લખાશે.

પાંચ પ્રકારના ખાતા મોટેના નિયમોને નીચે પ્રમાણેના ચાર્ટમાં સંક્ષિમ સ્વરૂપે દર્શાવાશે.

મિલકતો	
વધારો	(ઘટાડો)
+	-
ઉધાર	જમા

ખર્ચ/ખોટ	
(વધારો)	(ઘટાડો)
+	-
ઉધાર	જમા

મૂડી	
(ઘટાડો)	(વધારો)
-	+
ઉધાર	જમા

જવાબદારી	
(ઘટાડો)	(વધારો)
-	+
ઉધાર	જમા

આવક/નફો	
(ઘટાડો)	(વધારો)
-	+
ઉધાર	જમા

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



ASSETS		LIABILITIES		EQUITIES	
Debit	Credit for Increase	Debit for Decrease	Credit for Increase	Debit	Credit for Decrease
↑	↑	↑	↑	↑	↑
↓	↓	↓	↓	↓	↓

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

દિનંગી નામા પદ્ધતિ

૧. મિલકતના ખાતાના નિયમનું વિશ્લેષણ :-

પ્રભુએ રૂ. ૮૦૦૦૦ નું ફર્નિચર ખરીદ્યું

વ્યવહારનું વિશ્લેષણ :- આ વ્યવહારમાં અસર પામતાં બે ખાતાં રોકડ અને ફર્નિચર ખાતું છે. રોકડખાતું એ મિલકતનું ખાતું છે અને તેમાં ઘટાડો થયો છે. નિયમ મુજબ જો મિલકતમાં ઘટાડો થાય તો અસર પામતા ખાતામાં જમાબાજુ લખાશે. તેથી રોકડખાતામાં જમાબાજુ નોંધ થશે. ફર્નિચર પણ મિલકત છે અને તેમાં વધારો થયો છે. નિયમ પ્રમાણે જો મિલકત માં વધારો થાય તો અસર પામતા ખાતામાં ઉધાર બાજુ લખાશે. ફર્નિચર ખાતામાં ઉધારબાજુ નોંધ થશે.

રોકડખાતું	
ઉધાર	જમા (રૂ)
૮૦,૦૦૦	૮૦,૦૦૦

ફર્નિચર ખાતું	
ઉધાર (રૂ) (ઘટાડો)	જમા (રૂ) (વધારો)

૨. જવાબદારીના ખાતાના નિયમનું વિશ્લેષણ :-

એમ. બી. મશીનરી માર્ટ માંથી રૂ. ૬૦,૦૦૦ ની મશીનરી ખરીદી વ્યવહાર નું વિશ્લેષણ :- આ વ્યવહારમાં અસર પામતા બે ખાતાં મશીનરી અને એમ. બી. મશીનરી માર્ટ છે. મશીનરી મિલકત છે. અને તેમાં વધારો થયો છે. આથી મશીનરી ખાતામાં જમા અને ઘટાડો થવાથી ઉધાર બાજુ લખાશે. આથી એમ. બી. મશીનરી માર્ટ ખાતા માં જમા બાજુ લખાશે.

મશીનરી ખાતું	
ઉધાર (રૂ.)	(જમા રૂ.)
૬૦,૦૦૦ (વધારે)	

એમ. બી. એ. મશીનરી ખાતું	
ઉધાર (રૂ.)	જમા (રૂ.)
	૬૦,૦૦૦ (વધારો)

૩. મૂડી ખાતાના નિયમનું વિશ્લેષણ :-

સુમન શર્મા ધંધામાં રૂ. ૫૦,૦૦૦ મૂડી તરીકે લાવ્યા . વ્યવહારનું વિશ્લેષણ :- આ વ્યવહાર માં અસર પામતા બે ખાતાં રોકડ ખાતું અને સુમન શર્માનું ખાતું છે. એક રોકડખાતું મિલકતનું ખાતું છે. જેમાં વધારો થાય છે તેમજ સુમન શર્માએ મૂડી લાવ્યા છે. મૂડી ખાતાનો નિયમ છે. કે જો તેમાં વધારો થાય તો ખાતાની જમા બાજુ નોંધાય અને ઘટાડો થાય તો ઉધાર બાજુ નોંધાય આથી મૂડી ખાતામાં જમાબાજુ નોંધાશે.

રોકડખાતું	
ઉધાર (રૂ)	
૫૦,૦૦૦ (વધારો)	

મૂડી ખાતું સુમનશર્માનું ખાતું	
જમા (રૂ)	ઉધાર (રૂ)
	૫૦,૦૦૦ (વધારો)

દિનોંધી નામા પછતિ

૪. ખર્ચ - ખોટના ખાતાના નિયમનું વિશ્લેષણ :-

કર્મચારીઓને રૂ.૬૦૦૦નું પગાર ચૂકવ્યો. “આવક/નફામાં વધારો જમાબાજુ અને ઘટાડાને ઉધારબાજુ લખાશે.”

૫. આવક / નફાના નિયમનું વિશ્લેષણ :-

વ્યાજના રૂ. ૪૦૦૦ મળ્યા

વ્યવહારનું વિશ્લેષણ :- આ વ્યવહારમાં અસર પામતા બે ખાતા વ્યાજખાતું અને રોકડખાતું છે. વ્યાજખાતું એ આવકનું ખાતું છે. અને રોકડ એ મિલકતનું ખાતું છે. નિયમ મુજબ આવક વધે તો જમા બાજુ લખાશે અને મિલકતમાં વધારો ઉધારબાજુ લખાશે.

રોકડખાતું	
ઉધાર (રૂ)	(ઘટાડો)
૪,૦૦૦	-
(વધારો)	જમા

વ્યાજ ખાતું	
ઉધાર(રૂ)	જમા (રૂ)
૪૦,૦૦૦	(વધારો)



પાઠ સ્વાધ્યાય ૫.૩

(૧) ખાલી જગ્યા પુરો :

૧. રૂટિગત આધારે ખાતાનું વગ્નિકરણ આ પ્રકારે થાય છે.

(A) _____ (B) _____ (C) _____

૨. આધુનિક વગ્નિકરણ મુજબ ખાતાનું વગ્નિકરણ આ પ્રકારે થાય છે.

(A) _____ (B) _____ (C) _____

૩. _____ તરિયે આંતરિક પ્રવાહ અને તરિયે બાબુ પ્રવાહ છે.

(A) _____ (B) _____ (C) _____

(iv) મિલકતમાં વધારો અને મિલકતમાં ઘટાડો હોય છે.

(v) ખાતાની ડાબી બાજુ અને તેની જમણી બાજુ કહેવાય છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

દિનંગી નામા પદ્ધતિ

(II) નીચેના ખાતાના પ્રકાર આપેલા છે. દરેક ખાતુ જેની સાથે સંગલ્ન હોય ત્યાં ✓ કરો.

ખાતાનો પ્રકાર

ખાતાનું નામ	મિલકત જવાબદારી	મૂડી	આવક	ખર્ચ
૧. મજૂરી				
૨. મકાન				
૩. રોકડ				
૪. ગુમા				
૫. શર્મા (માલેક)				
૬. સુગમ (ગ્રાહક)				
૭. વ્યાજ મળ્યું				
૮. કમિશન મળ્યું				
૯. વટાવ આપ્યો.				
૧૦. ભાડું ચૂક્યું.				

ઉદાહરણ : ૧

નીચેના વ્યવહારો પરથી અસર પામતાં ખાતાના નામ, ખાતાના પ્રકાર અને ઉધાર થતા ખાતા અને જમા થતા દર્શાવો.

વ્યવહાર

રૂ.

૧. પ્રકાશો રોકડ લાવી ધંધો શરૂ કર્યો	₹,૦૦,૦૦૦
૨. રોકડેથી માલ ખરીદ્યો.	૮૦,૦૦૦
૩. પગાર ચૂક્યો.	૯૦,૦૦૦
૪. પ્રકાશને ઉધાર માલ વેચ્યો	૬૦,૦૦૦
૫. ઓફિસ નાટે રોકડથી મશીનરી ખરીદી.	૨,૦૦૦
૬. નવિને બેંકમાંથી લોન લીધી.	૩૦,૦૦૦
૭. નવિનને કમિશન મળ્યું	૪,૦૦૦
૮. છાપકામ અને સ્ટેશનરી ના ચૂક્યા,	૪૦૦
૯. ભાડું ચૂક્યું	₹,૦૦૦
૧૦. પ્રકાશ પાસેથી રોકડ મળ્યા	₹૦,૦૦૦

દિનોંધી નામા પછતિ

ઉકેલ :-

ચ્ય. નં.	ખાતાનું		ખાતાનો		ખાતાને લાગુ પડતો નિયમ	
	નામ		પ્રકાર		ઉધાર/જમા અને વધારો/ઘટાડો	
	1	2	1	2	1	2
૧	રોકડ	મૂડી	મિલકત	મૂડી	રોકડ (વધારો)	મૂડી(વધારો)
૨	ખરીદી	રોકડ	ખર્ચ	મિલકત	ખરીદી (વધારો)	રોકડ વધારો
૩	પગાર	રોકડ	ખર્ચ	મિલકત	પગાર (વધારો)	રોકડ (વધારો)
૪	પ્રભુએ	વેચાણ (દેવાદાર)	મિલકત	આવક	પ્રભુએ (વધારો)	વેચાણ (વધારો)
૫	ઓફિસ મશીનરી	રોકડ	મિલકત	મિલકત	ઓફિસ મશીનરી (વધારો)	રોકડ
૬	રોકડ	બંકલોન	મિલકત	જવાબદારી	રોકડ વધારો	બંકલોન
૭	રોકડ	કમિશન	મિલકત	આવક	રોકડ વધારો	કમિશન ઘટાડો
૮	દ્રાપકામ અનેસ્ટેશનરી	રોકડ	ખર્ચ	મિલકત	દ્રાપકામ અને સ્ટેશનરી	કમિશન (વધારો)
૯	ભાડું	રોકડ	ખર્ચ	મિલકત	ભાડું (વધારો)	રોકડ (વધારો)
૧૦	રોકડ	પ્રભુએ	મિલકત	મિલકત	રોકડ વધારો	પ્રભુએ (ઘટાડો)

૫.૫ દસ્તાવેજના સ્થોતો :

નામાની પ્રક્રિયા ધંધાકીય લેવડ-દેવડ ની સાથે જ શરૂ થઈ જાય છે. તેમજ ત્યારબાદ આ લેવડ-દેવડ નું વિશ્લેષણ થાય છે. સૌં પ્રથમ તો એક દસ્તાવેજ હોવો જોઈએ કે જે દશાવિંદી કે નામાની પ્રક્રિયા થઈ છે. આ પ્રકારના દસ્તાવેજ ને સ્થોત દસ્તાવેજ કહે છે. સ્થોત દસ્તાવેજ નામાની પ્રક્રિયા નો આધાર હોય છે. સ્થોત દસ્તાવેજના આધારે નામું લખનાર ધંધાકીય લેવડ-દેવડ નોંધ કરે છે. આના ધંધાકીય દસ્તાવેજ પણ કહેવાય છે. ઉદાહરણ તરીકે ઇનવોઈસ જરૂરી માલસામાન માટેનું પત્રક/ ઓડર ફાર્મ, બેંક સ્ટેટ્યુન્ટ, કેશમેમો, રસીદ વગેરે..

બધાજ ધંધાકીય લેવડ - દેવડ નો આધાર પ્રમાણ સ્વરૂપ દસ્તાવેજ હોય છે. ઉદાહરણ તરીકે સ્થોત દસ્તાવેજ માલનું ઉધાર વેચાણ, રોકડ રસીદ રોકડવેચાણ અને નાણાં લેનાર દારા આપવામાં

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

દિનંગી નામા પદ્ધતિ

આવતી રસીદ રોકડ ચુકવણી બતાવે છે. જે દસ્તાવેજ લેવડ-ફેવડ નું પ્રમાણ છે તે સ્લોટ દસ્તાવેજ કહેવાય છે. આ કોઈપણ ધંધાકીય લેવડ-ફેવડ ના સમર્થન માટેનું પ્રાથમિક પ્રમાણ હોય છે. તેને વાઉચર પણ કહે છે. વાઉચરને બે ભાગમાં વિભાજીત કરી શકાય છે.

૧. સહાયક વાઉચર
૨. નામાના વાઉચર

સહાયક વાઉચર :- જે વાઉચર ધંધાકીય લેવડ-ફેવડનું સમર્થન કરે છે તેને સહાયક વાઉચર કહેવાય છે. આના ઉદાહરણને -ભાડાની રસીદ, કેશ મેમો, ઇનવોઇસ વગેરે.

નામાના વાઉચર :- આ એવા સ્લોટ દસ્તાવેજ છે જેના આધારે લેવડ-ફેવડ ની નોંધ થાય છે. આ એવો લેખિત દસ્તાવેજ છે જેમાં નામાના ચોપડામાં નોંધ કરવાના ઉદ્દેશ્યથી ધંધાકીય લેવડ-ફેવડનું વિશ્વેષણ લખવામાં આવે છે. આ નામું લખનાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આની ઉપર કોઈ જવાબદારીવાળા અધિકૃત વ્યક્તિની સહી હોય છે.

નામાના વાઉચરના લક્ષણો નીચે મુજબ છે.

૧. આ લેખિત દસ્તાવેજ છે.
૨. નામાના ચોપડામાં નોંધ કરવા માટેનો પાયો છે.
૩. આ વ્યવહારોના પ્રમાણના આધારે તૈયાર થાય છે.
૪. આમાં ધંધાકીય લેવડ-ફેવડ નું વિશ્વેષણ કરવામાં આવે છે. જેથી સંબંધિત ખાતું ઉધાર અને જમા થાય છે.
૫. આ નામું લખનાર દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેની ઉપર કોઈ અધિકૃત વ્યક્તિની સહી હોય છે.

5.6 નામાના વાઉચરના પ્રકાર :-

નામાના વાઉચરને રોકડ વાઉચર અને બિન રોકડ વાઉચર એમ બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. રોકડ વાઉચરના બે પ્રકાર હોય છે. (૧) ઉધાર વાઉચર અને (૨) જમા વાઉચર બિન રોકડ વાઉચરને હસ્તાંતરિત વાઉચર પણ કહેવાય છે.

નામાના વાઉચરના પ્રકાર

રોકડ વાઉચર

બિન-રોકડ વાઉચર



ઉધાર વાઉચર

જમા વાઉચર

હસ્તાંતરિત વાઉચર(બિનરોકડ લેવડફેવડ માટે)

નામાના મૂળતત્વો

ઉધાર વાઉચર

ઉધાર વાઉચર રોકડ ચૂકવણીના વ્યવહારોની નોંધ માટે તૈયાર કરવામાં આવે છે. ધંધામાં રોકડ ચૂકવણીમાં લેણદારોને ચૂકવણી, માલની ખરીદી, મિલ્કતની ખરીદી, લોનની ચૂકવણી, બેંકમાં રોકડ જમા કરાવવી, ઉપાડ અને અગાઉથી ચૂકવેલા નાણાં તેમજ ખર્ચ માટે તૈયાર કરવામાં આવે છે.

રોકડ ચૂકવણીમાં એક પક્ષ રોકડ હોય છે અને બીજા અસર પામતા એ ખાતા જે વ્યક્તિને ચૂકવણી કરી છે તે અથવા મિલ્કતની ખરીદી ઉપરનો ખર્ચ કે જેના માટે ચૂકવણી કરવામાં આવી છે તે છે. એક ઉધાર વાઉચરનો નમૂનો નીચે મુજબ છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



ઉધાર વાઉચરમાં નીચે મુજબની માહિતી આપવામાં આવે છે.

૧. સંગઠન નું નામ અને સરનામું
૨. વાઉચર બનાવ્યાની તારીખ.
૩. વાઉચર નો નંબર
૪. ઉધાર થયેલ ખાતાનું નામ
૫. વ્યવહારની ચોખ્યી રકમ
૬. સ્પષ્ટીકરણ એટલે કે વ્યવહારની સંક્ષિપ્ત વિગત.
૭. બનાવનાર વ્યક્તિની સહી.
૮. આધુનિક વ્યક્તિની સહી.
૯. સહાયક વાઉચર નંબર.
૧૦. સમર્થક વાઉચર બદલે એક દસ્તાવેજ

શૈક્ષણિક વિષય : ૨

મે. તરલશ રિટેલર્સના નીટેના વ્યવહારો પરથી ઉધાર વાઉચર તૈયાર કરો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

દિનંગી નામા પદ્ધતિ

૨૦૧૨		રૂ.
જાન્યુ. ૧	રોકડ માલ ખરીદો કેશ મેમો નં. ૨૦	૧૭,૨૦૦
જાન્યુ. ૫	ઉસેભર ૨૦૧૧ના મહિનાની મજૂરી ચુકવી, મજૂરી પત્રક નં. ૩૪	૫,૦૦૦

ઉકેલ :

(i)

મંજુબાધી	મ.તરણ ટીકસ	
	વાઉચર નં. ૨	તારીખ ૫.૧.૨૦૧૨ રકમ (રૂ)
	ક્ષાર : મજૂરી ખાતે (બા.કે.ઉસેભર. ૨૦૧૧ મહિનાની મજૂરી ચુકવી, મજૂરી પત્રક નં. ૩૪)	૫૦૦૦
		૫૦૦૦
	સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ

(ii)

મંજુબાધી	મ.તરણ ટીકસ	
	વાઉચર નં. ૧	તારીખ ૧.૧.૨૦૧૨ રકમ (રૂ)
	ક્ષાર : ખરીદખાતે (બા.કે.રોકડથી માલ ખરીદો. કેશ મેમો નં. ૨૦)	૧૭,૨૦૦
		૧૭,૨૦૦
	સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ

ઉદાહરણ ૩


મ. સુનિલ ટ્રલસિના ના નીચેના વ્યવહારો પરથી ઉધાર વાઉચર તૈયાર કરો.

૨૦૧૨	રકમ રૂ.
જાન્યુ. ૧ રિલેક્સ ફર્નિચરમાંથી રોકડથી ફર્નિચર ખારીદું કેશમેમો નં. ૨૪	૮,૪૦૦
જાન્યુ. ૭ ઉસેભર ૨૦૧૧ મહિનાની મજૂરી ચુકવી મજૂરી પત્રક નં. ૩૦	૩,૪૦૦
જાન્યુ. ૧૦ હરીએન્ડ સન્સ ને રોકડ ચુકવી. રોકડ રસીદ નં. ૭૦	૫,૦૦૦
જાન્યુ. ૧૫ ટ્પાલખર્ચના ચુકવ્યા.	૭૨૦


દિનોંધી નામા પછતિ

ઉકેલ :


(1)

 	મેણ્ડેબલ સ્ટા.	<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <thead> <tr> <th colspan="2" style="text-align: center; padding: 5px;">મે. સુનિલ ટીલર્સ</th></tr> </thead> <tbody> <tr> <td style="padding: 5px;">વાઉચર નં. ૧</td><td style="padding: 5px; text-align: right;">તારીખ ૧.૧.૨૦૧૨ રકમ (રૂ)</td></tr> <tr> <td style="padding: 5px;">ગ્રહાર : કર્નિયર ખાતે (બા.કે.કર્નિયર ખરીએ કેશ મેમો નં. ૨૪)</td><td style="padding: 5px; text-align: right;">૮૫૦૦</td></tr> <tr> <td></td><td style="padding: 5px; text-align: right;">૮૫૦૦</td></tr> <tr> <td style="padding: 5px;">સહી/- મેનેજર</td><td style="padding: 5px; text-align: right;">સહી/- હિસાબનીશ</td></tr> </tbody> </table>	મે. સુનિલ ટીલર્સ		વાઉચર નં. ૧	તારીખ ૧.૧.૨૦૧૨ રકમ (રૂ)	ગ્રહાર : કર્નિયર ખાતે (બા.કે.કર્નિયર ખરીએ કેશ મેમો નં. ૨૪)	૮૫૦૦		૮૫૦૦	સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ
મે. સુનિલ ટીલર્સ												
વાઉચર નં. ૧	તારીખ ૧.૧.૨૦૧૨ રકમ (રૂ)											
ગ્રહાર : કર્નિયર ખાતે (બા.કે.કર્નિયર ખરીએ કેશ મેમો નં. ૨૪)	૮૫૦૦											
	૮૫૦૦											
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ											
મેણ્ડેબલ સ્ટા.												


(2)

	મેણ્ડેબલ સ્ટા.	<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <thead> <tr> <th colspan="2" style="text-align: center; padding: 5px;">મે. સુનિલ ટીલર્સ</th></tr> </thead> <tbody> <tr> <td style="padding: 5px;">વાઉચર નં. ૨</td><td style="padding: 5px; text-align: right;">તારીખ ૭.૧.૨૦૧૨ રકમ (રૂ)</td></tr> <tr> <td style="padding: 5px;">ગ્રહાર : મજૂરી ખાતે (બા.કે.ટિસેમ્બર ૨૦૧૧ મહિનાની મજૂરી ચૂકવી મજૂરી પત્રક નં. ૩૦)</td><td style="padding: 5px; text-align: right;">૩૪૦૦</td></tr> <tr> <td></td><td style="padding: 5px; text-align: right;">૩૪૦૦</td></tr> <tr> <td style="padding: 5px;">સહી/- મેનેજર</td><td style="padding: 5px; text-align: right;">સહી/- હિસાબનીશ</td></tr> </tbody> </table>	મે. સુનિલ ટીલર્સ		વાઉચર નં. ૨	તારીખ ૭.૧.૨૦૧૨ રકમ (રૂ)	ગ્રહાર : મજૂરી ખાતે (બા.કે.ટિસેમ્બર ૨૦૧૧ મહિનાની મજૂરી ચૂકવી મજૂરી પત્રક નં. ૩૦)	૩૪૦૦		૩૪૦૦	સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ
મે. સુનિલ ટીલર્સ												
વાઉચર નં. ૨	તારીખ ૭.૧.૨૦૧૨ રકમ (રૂ)											
ગ્રહાર : મજૂરી ખાતે (બા.કે.ટિસેમ્બર ૨૦૧૧ મહિનાની મજૂરી ચૂકવી મજૂરી પત્રક નં. ૩૦)	૩૪૦૦											
	૩૪૦૦											
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ											
મેણ્ડેબલ સ્ટા.												

(3)

	મેણ્ડેબલ સ્ટા.	<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <thead> <tr> <th colspan="2" style="text-align: center; padding: 5px;">મે. સુનિલ ટીલર્સ</th></tr> </thead> <tbody> <tr> <td style="padding: 5px;">વાઉચર નં. ૩</td><td style="padding: 5px; text-align: right;">તારીખ ૧૦.૧.૨૦૧૨ રકમ (રૂ)</td></tr> <tr> <td style="padding: 5px;">ગ્રહાર : હરી એન્ડ સન્સ ખાતે (બા.કે.રોકડા ચુકવ્યા રોકડ રસ્ટેટ નં. ૭૦)</td><td style="padding: 5px; text-align: right;">૪૦૦૦</td></tr> <tr> <td></td><td style="padding: 5px; text-align: right;">૪૦૦૦</td></tr> <tr> <td style="padding: 5px;">સહી/- મેનેજર</td><td style="padding: 5px; text-align: right;">સહી/- હિસાબનીશ</td></tr> </tbody> </table>	મે. સુનિલ ટીલર્સ		વાઉચર નં. ૩	તારીખ ૧૦.૧.૨૦૧૨ રકમ (રૂ)	ગ્રહાર : હરી એન્ડ સન્સ ખાતે (બા.કે.રોકડા ચુકવ્યા રોકડ રસ્ટેટ નં. ૭૦)	૪૦૦૦		૪૦૦૦	સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ
મે. સુનિલ ટીલર્સ												
વાઉચર નં. ૩	તારીખ ૧૦.૧.૨૦૧૨ રકમ (રૂ)											
ગ્રહાર : હરી એન્ડ સન્સ ખાતે (બા.કે.રોકડા ચુકવ્યા રોકડ રસ્ટેટ નં. ૭૦)	૪૦૦૦											
	૪૦૦૦											
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ											
મેણ્ડેબલ સ્ટા.												

(4)

	મેણ્ડેબલ સ્ટા.	<table border="1" style="width: 100%; border-collapse: collapse;"> <thead> <tr> <th colspan="2" style="text-align: center; padding: 5px;">મે. સુનિલ ટીલર્સ</th></tr> </thead> <tbody> <tr> <td style="padding: 5px;">વાઉચર નં. ૪</td><td style="padding: 5px; text-align: right;">તારીખ ૧૫.૧.૨૦૧૨ રકમ (રૂ)</td></tr> <tr> <td style="padding: 5px;">ગ્રહાર : ટપાલ ખર્ચ ખાતે (બા.કે.ટપાલ ખર્ચ ખાતે ચૂકવ્યા)</td><td style="padding: 5px; text-align: right;">૭૨૦</td></tr> <tr> <td></td><td style="padding: 5px; text-align: right;">૭૨૦</td></tr> <tr> <td style="padding: 5px;">સહી/- મેનેજર</td><td style="padding: 5px; text-align: right;">સહી/- હિસાબનીશ</td></tr> </tbody> </table>	મે. સુનિલ ટીલર્સ		વાઉચર નં. ૪	તારીખ ૧૫.૧.૨૦૧૨ રકમ (રૂ)	ગ્રહાર : ટપાલ ખર્ચ ખાતે (બા.કે.ટપાલ ખર્ચ ખાતે ચૂકવ્યા)	૭૨૦		૭૨૦	સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ
મે. સુનિલ ટીલર્સ												
વાઉચર નં. ૪	તારીખ ૧૫.૧.૨૦૧૨ રકમ (રૂ)											
ગ્રહાર : ટપાલ ખર્ચ ખાતે (બા.કે.ટપાલ ખર્ચ ખાતે ચૂકવ્યા)	૭૨૦											
	૭૨૦											
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ											
મેણ્ડેબલ સ્ટા.												

મોડ્યુલ - ૨

આમ નોંધ અને

પેટા નોંધ



મોડિયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

દિનંગી નામા પદ્ધતિ

જમા વાઉચર :-

આ વાઉચર ફક્ત રોકડના વ્યવહારો માટેજ તૈયાર કરવામાં આવે છે. ધંધામાં જ્યાંથી રોકડ મળે છે તે - માલનું ઉધાર વેચાણ દેવાદાર પાસેથી મળેલ રકમ, મિલકતનું રોકડથી વેચાણ, બંધ માંથી ઓફિસ માટે રોકડ ઉપાડવી વાજ ભાડું વગેરે રોકડમાં મળે, લોન લેવી અને રસીદ તેમજ અગાઉથી ચુકવણી વગેરે. વધીજ મળેલ રોકડમાં એક ખાતું રોકડ હોય છે અને બીજું ખાતું એ વ્યકાતિ અથવા ખાતું છે. જેની પાસેથી રોકડ મળેલ છે અથવા આવકનું એવું સાધન જેના માટે રોકડ મળેલ છે અથવા મિલકત કે જેના વેચાણ માંથી રોક પ્રાપ્ત થઈ. જમા વાઉચરનો નમૂનો નીચે મુજબ છે.

જમા વાઉચર		(3)
વાઉચર નં. ૩૦૨	રામ નારાયણ પ્રિન્ટર્સ ૭, કરોલ બાગ, નવી દિલ્હી	(1)
	તારીખ ૪.૨.૨૦૧૨ રકમ (૩)	(2)
જમા : વેચાણ ખાતે (બા. એ. રોકડથી માલનું વેચાણ કર્યું બિલ નં. ૧૫)	૧૨,૦૦૦	(4)
		(6)
	કુલ	૧૨,૦૦૦
		(5)
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ	(7)
(8)		

જમા વાઉચરમાં નીચેની સૂચના / માહિતી હોય છે.

૧. સંગઠન નું નામ અને સરનામું
૨. વાઉચર બનાવ્યા તારીખ
૩. વાઉચર નંબર
૪. જમા કરેલ ખાતાનું નામ
૫. વ્યવહારની ચોખ્યી રકમ
૬. સ્પષ્ટીકરણ એટલે કે વ્યવહારની સંક્ષિપ્ત વિગત.
૭. બનાવનાર વ્યક્તિની સહી.
૮. અધિકૃત વ્યક્તિની સહી.
૯. સહાયક વાઉચર નંબર.

ઉદાહરણ - ૪

મે.એમ .કે.કોમ્પ્યુટર્સ, પશ્ચિમવિલાર , નવી દિલ્હીના નીચના વ્યવહારો પરથી જમા વાઉચર તૈયાર કરો.

દિનાંદી નામા પછતિ

રૂપાંશુ	રૂપાંશુ	રૂપાંશુ
મે ૫	હાઈડિસ્કનું રોકડેથી વેચાણ કર્યું. કેશ મેમો નં. ૧૦	૭૨,૦૦૦
મે ૧૬	જુના કોમ્પ્યુટર મોનિટરનું રોકડેથી વેચાણ કર્યું કેશ મેમો નં. ૩૪	૭૩,૦૦૦
મે ૩૦	ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી રોકડા ઉપાડવા શેક નં. ૩૦૦૪૦૭	૮,૯૦૦

મોડ્યુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



(i)

એમ.કે.કોમ્પ્યુસ્ટ પાઠ્યમ વિહાર નાની દિલ્હી,	તારીખ :	૫.૫.૨૦૧૨ ૨૫મ (૩)
વાઉચર નં . ૧		
જમા : વેચાણ ખાતે (બા.ઝ. રોકડેથી માલ વેચ્યો કેશ મેમો નં. ૧૦)	૭૨,૦૦૦	
	૭૨,૦૦૦	
સહી/- મેનેજર	સહી/- હિસાબનિશ	

(ii)

એમ.કે.કોમ્પ્યુસ્ટ પાઠ્યમ વિહાર નાની દિલ્હી,	તારીખ :	૧૬.૫.૨૦૧૨ ૨૫મ (૩)
વાઉચર નં . ૨		
જમા : જુના કોમ્પ્યુટર મોનિટર ખાતે (બા.ઝ. જુના કોમ્પ્યુટર મોનિટર રોકડેથી વેચા કેશ મેમો નં. ૧૦)	૭૩૦૦૦	
	૭૩૦૦૦	
સહી/- મેનેજર	સહી/- હિસાબનિશ	

(iii)

એમ.કે.કોમ્પ્યુસ્ટ પાઠ્યમ વિહાર નાની દિલ્હી,	તારીખ :	૩૦.૫.૨૦૧૨ ૨૫મ (૩)
વાઉચર નં . ૩		
જમા : બેંક ખાતે (બા.ઝ. બેંકમાંથી રોકડા ઉપાડવા શેક મેમો નં. ૩૦૦૪૦૭)	૮,૯૦૦	
	૮,૯૦૦	
સહી/- મેનેજર	સહી/- હિસાબનિશ	

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

દિનંગી નામા પદ્ધતિ

ઉદાહરણ : ૫

જીનીયસ લેધર સ્ટોર, મેરઠ ના સહાયક વાઉચરની મદદથી જમા વાઉચર તૈયાર કરો.
બધીજ મળેલ રોકડ માં ખાતુ રોકડ હોય છે.

૨૦૧૨

૨૫મ રૂ.

(૧) જુલાઈ ૫ સોહન એન્ડ કે.પાસેથી રોકડ મળ્યા. ચેક રસીદ નં. ૩૫	૧૨,૦૦૦
(૨) જુલાઈ ૧૦ કમિશન મળ્યું રોકડ રસીદ નં. ૭૪	૩,૪૦૦
(૩) જુલાઈ ૧૫ લેધપ પર્સ રોકડથી વેચ્યા કેરામેમોન નં. ૪૧૨	૪,૪૦૦
(૪) જુલાઈ ૨૪ જુના બે લેધરના રંગના મશીન વેચ્યા કેશ મેમો નં. ૩૭૧૪	૧૨,૪૦૦

ઉકેલ :

(i)

મે.જીનીયસ લેધર સ્ટોર્સ, મેરઠ		તારીખ : ૫.૭.૨૦૧૨ ૨૫મ (૩.)
વાઉચર નં. ૧		
જમા : મે.સોહન એન્ડ કે. (આ.શે.સોહન એન્ડ કે.પાસેથી રોકડ મળ્યા રોકડ રસીદ નં. ૩૫)	૧૨,૦૦૦	
		૧૨,૦૦૦
સાધી/- મેનેજર		સાધી/- હિસાબાનીશ

(ii)

મે.જીનીયસ લેધર સ્ટોર્સ, મેરઠ		તારીખ :
વાઉચર નં. ૨		૨૫મ (૩.)
જમા : કમિશન ખાતે (આ.શે.કમિશનના રોકડ મળ્યા રોકડ રસીદ નં. ૭૪)	૩૪૦૦	
		૩૪૦૦
સાધી/- મેનેજર		સાધી/- હિસાબાનીશ

દિનોંધી નામા પછતિ

મોડચુલ - ૨
આમ નોંધ અને
પેટા નોંધ



(iii)

મે.જન્નીયસ લેખર સ્ટોર્સ , મેરક		તારીખ : ૧૫.૭.૨૦૧૨
વાઉચર નં. ૩		રકમ (રૂ.)
જમા :	વેચાણ ખાતે (બા.કે.રોક્કેથી માલાનું વેચાણ કેશ મેમો નં. ૪૧૨)	૮૪૦૦
		૮૪૦૦
સહી/- મેનેજર		સહી/- ટિક્સાબનીશ

(iv)

મે.જન્નીયસ લેખર સ્ટોર્સ , મેરક		તારીખ : ૨૪.૭.૨૦૧૨
વાઉચર નં. ૪		રકમ (રૂ.)
જમા :	લેખરના રંગના મશીન ખાતે (બા.કે.જુના લેખરના રંગના મશીન રોક્કેથી વેચાણ કેશ મેમો નં. ૩૭૭૪)	૭૨,૪૦૦
		૭૨,૪૦૦
સહી/- મેનેજર		સહી/- ટિક્સાબનીશ

હસ્તાન્તરિત વાઉચર અથવા બિન રોકડ વાઉચર :-

બિન રોકડ વાઉચર એવી લેવડના વાઉચર છે જે રોકડ નથી, આને હસ્તાન્તરણ કરે છે.

આ વાઉચર ધંધાના બિન રોકડ વ્યવહારોની નોંધ કરવા માટે તૈયાર કરવામાં આવે છે જેમ કઉધાર વેચાણ ઉધાર ખરીદી મિલકત પરનો ધસારો, ઉધાર ખરીદેલ માલ પરત ધાલખાદ ઉધાર વેચેલ માલ પરત વગેરે.

આ વાઉચર ઉધાર અને જમાના સાથે જ બનાવાય છે. એક હસ્તાન્તરિત વાઉચરનો નમૂનો નીચે મૂજબ છે.

મોડયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



ၪ

ક્રિનોંધી નામા પદ્ધતિ

ਹਸਤਾਨਤਰਿਤ ਵਾਉਚਰ

<p>રાધિકા પ્લાસ્ટસ સ્ટોર ૮૨, વિકાસનગર લખનૌ</p> <p>વાઉચર નં.</p>	<p>(1)</p> <p>તારીખ ૧.૪.૨૦૧૨</p> <p>૨કમ (૩)</p>
<p>ઉધાર: મશીનરી ખાતે</p>	<p>----- ----- -----</p>
<p>જમા: રમણખાતે _____ (મશીનરી ઘરીઠી કેશ મેમો નં.)</p>	<p>----- ----- -----</p>
<p>સહી/- મેનેજર</p>	<p>સહી/- હિસાબનીશ</p>

એક હસ્તાન્તરિત વાઉચરમાં નીચે મુજબની માહિતી આપવામાં આવે છે.

૧. સંગઠન નું નામ અને સરનામું
 ૨. વાઉચર બનાવ્યાની તારીખ
 ૩. વાઉચર નંબર
 ૪. ૧. ઉધાર ખાતાનું નામ ૨. જમા ખાતાનું નામ
 ૫. લેવડ - ડેવડની ચોખ્યી રકમ
 ૬. સ્પષ્ટીકરણ એટલે કે વ્યવહારની સંક્ષિપ્ત વિગત.
 ૭. વાઉચર બનાવનારની સહી.
 ૮. આધિકૃત વ્યક્તિની સહી.
 ૯. સહાયક / સ્વોત વાઉચર નંબર.

ଓଡାଇସନ୍ - ୯

સની ગારમેન્ટ્સ, કાનપુરના નીચેના વ્યવહારો ઉપરથી હસ્તાન્તરિત વાઉચર તૈયાર કરો.

२०१२

२५८ (३)

જાન્યુઆરી મેં જીમ એન્ડ જોની પાસેથી માલ ખરીદ્યો બિલ નં. ૨૦

89.000

જાન્ય.૮ મે.સીતારામ ને માલ વેચ્યો ૪૧૭૭

93.660

દિનોંધી નામા પછતિ

ઉકેલ:

સની ગારમેન્ટ્સ, કાનપુર	
વાઉચર નં.	તારીખ : ૩.૧.૨૦૧૨ રકમ (રૂ.)
જથીએ : ખરીદ ખાતે	૪૭,૦૦૦
	૪૭,૦૦૦
જમા : મે. જીમ અન્ડ જોની ખાતે (બા. જી. મે. જીમ અન્ડ જોની પાસેથી માલ ખરીદો બિલ નં. ૨૦)	૪૭,૦૦૦
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ

મોડિયુલ - ૨
આમ નોંધ અને
પેટા નોંધ



સની ગારમેન્ટ્સ, કાનપુર	
વાઉચર નં.	તારીખ : ૮.૧.૨૦૧૨ રકમ (રૂ.)
જથીએ : મે સીતારામ ખાતે	૧૫૮૮૦
	૧૩૮૮૦
જમા : વેચાણ ખાતે (બા. જી. મે. સીતારામ પાસેથી માલ ખરીદો. બિલ નં. ૪૧૭૧)	૧૩૮૮૦
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ

ઉદાહરણ - ૭

નીચેના વાઉચર પરથી હસ્તાન્તરિત વાઉચર તૈયાર કરો.			
રતન અન્ડ સાન્સ			
વેચાણ બિલ નં. ૧૨૧			તારીખ : ૧૫.૩.૨૦૧૨
પ્રતિ મે.નરેશ બ્રધર્સ			
જથ્થો	વિગતા	ભાવ (રૂ.)	રકમ (રૂ.)
૧૨૦ નંગા.	જિક્કેટ બોલ	૧૦૦	૧૨,૦૦૦
૭૦ નંગા.	ફુલ સાઈઝ બેટ	૧૦૦૦	૭૦,૦૦૦
			૮૨,૦૦૦
સહી/- રતન અન્ડ સાન્સ			

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

દિનંગી નામા પદ્ધતિ

ઉકેલ:

રતન એન્ડ સન્સ		તારીખ: ૧૫.૩.૨૦૧૨
વાઉચર નં. ૧		રકમ (રૂ)
ઉધાર: મે.નરેશ બ્રાહ્મર્સિયાતે	૮૨,૦૦૦	
	૮૨,૦૦૦	
ઉધાર: વેચાણ યાતે (બા. છે. મે. નરેશ બ્રાહ્મર્સિયાતે વેચ્યો બિલ નં. ૧૨૧)	૮૨,૦૦૦	
	૮૨,૦૦૦	
સહી/- મનેજર		સહી/- હિસાબનીશ

(૧) નીચે આપેલા વાક્યો ખરાં છે રે ખોરાં તે જણાવો.

૧. દરેક વ્યવહારની બે નોંધ થાય છે.
 ૨. જે આપે છે તે દેવાદાર અને જે મેળવે છે તે લેણદાર.
 ૩. આ પદ્ધતિને દિનંગી પદ્ધતિ કહેવાય છે. કારણ કે દરેક વ્યવહાર ની બે ખાતામાં નોંધ થાય છે.
 ૪. કોઈપણ દિસવના ઉધાર વ્યવહારોનો સરવાળો તેની સાથે સંબંધિત જુદા-જુદા ખાતાની જમાબાજુ જેટલો જ હોતો નથી.
- (૨) દરેક વ્યવહાર ની સામે યોગ્ય વાઉચર સામે () ચિહ્ન કરો.

	ઉધાર વાઉચર	જમા વાઉચર	હસ્તાન્તરિત વાઉચર
૧. રોકટેથી ફર્નિચર ખરીદ્યું			
૨. રોકટેથી માલ વેચ્યો			
૩. વિક્રમ ને માલ વેચ્યો			
૪. મકાન પર ઘસારો ગજ્યો			
૫. બેંકમાંથી ઓફિસ ઉપયોગ માટેના નાણાં ઉપાડ્યા			

૩. વૈકલ્પિક પ્રશ્નો:

૧. ક્યો અંગ્રેજ મૂળાઅક્ષર ખાતાના આકાર જેવો હોય છે.
 - a) I
 - b) T
 - c) H
 - d) D

દ્વિનોંધી નામા પદ્ધતિ

૨. એક ખાતામાં કેટલી બાજુ હોય છે.
- એક
 - બે
 - ત્રણ
 - ચાર
૩. કોઈ ખાતાના બધાજ વ્યવહાર ક્યાં લખાય છે?
- વિશેષ ખાતામાં
 - કોઈ પણ ખાતામાં
 - બે થી વધુ ખાતામાં
 - અનેક ખાતામાં
૪. આધુનિક પદ્ધતિ મુજબ ખાતાને કેટલા પ્રકાર માં વિભાજાત કરવામાં આવે છે.
- ૨
 - ૩
 - ૪
 - ૫
૫. મિલકતના ખાતાને ક્યા ખાતાની જેમ લખાય છે.
- ખર્ચ
 - આવક
 - મૂડી
 - જવાબદારી



તમે આટલું શીખ્યા :

- પદ્ધતિ કે જેમાં વ્યવહારની બે નોંધ કરવામાં આવે છે. એક ઉધાર અને જમા. બંનમાં રકમ સરખી હોય છે તેને દ્વિનોંધી પદ્ધતિ કહે છે.
- ખાતું એક શીર્ષક છે. જેમાં વિશિષ્ટ લેવડ ડેવડ, વગીકૃત અને એક્ટિવ કરી નોંધાય છે.
- ખાતાનું પરંપરાગત વગીકરણ છે-વ્યક્તિગત, માલ-મિલકત અને ઉપજ ખર્ચ-
- ખાતાના આધુનિક વગીકરણને આધારે ખાતાને વિભાજાત કરાય છે. મિલકત જવાબદારી આવક અને મૂડી.
- જુદા-જુદા પ્રકારના ખતા ઉપર આધાર અને જમા અસર :

મિલકતો	
ઉધાર (વધારો)	જમા (ઘટાડો)
+	-

ખર્ચ	
ઉધાર (વધારો)	જમા (ઘટાડો)
+	-

મૂડી		જવાબદારી		આવક	
ઉધાર (ઘટાડો)	(વધારો)	ઉધાર (ઘટાડો)	જમા (ઘટાડો)	ઉધાર (વધારો)	જમા (ઘટાડો)
-	+	-	+	-	+

- સ્થોત દસ્તાવેજ અને વાઉચર :- દસ્તાવેજ જે નામામાં બનેલી ઘટનાઓ દર્શાવે છે તે સ્થોત દસ્તાવેજ છે. જેમ કે કેશ મેમો બિલ, રસીદ, ઉપર ચિહ્ની, જમા ચિહ્ની, ચેક અને પે-ઇન - સ્લીપ.
- વાઉચર એ લેવડ-ડેવડને સમર્થન આપતો આધારભૂત દસ્તાવેજ છે. આ રોકડ વાઉચર (ઉધાર અને જમા વાઉચર) અને હસ્તાન્તરિત વાઉચર ઉધાર લેવડ-ડેવડ માટે છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

દિનોંધી નામા પદ્ધતિ



પાઠ્યાંત સ્વાધ્યાય :

૧. દિનોંધી પદ્ધતિ સમજાવો.
૨. દિનોંધી પદ્ધતિના લાભો જણાવો.
૩. દિનોંધી પદ્ધતિના ગેરલાભ / મયાંડાઓ જણાવો.
૪. ખાતું કોને કહેવાય છે.
૫. જુદા - જુદા ખાતાના આધુનિક વગ્ાઈકરણને સંક્ષિમમાં સમજાવો.
૬. જુદા - જુદા ખાતામાં ફેરફાર (વધારો - ઘટાડો)ની નોંધ કરવા માટેના આધારભૂત નિયમોનું વર્ણન કરો.
૭. નામાના વાઉચર એટલે શું? જુદા - જુદા પ્રકારના નામાના વાઉચર સમજાવો.
૮. નીચેના વ્યવહારો પરથી વાઉચર તૈયાર કરો.
 - ૧) રોકડેથી માલ ખરીધ્યો રૂ. ૧૫૦૦૦૦
 - ૨) રાધવને રોકડ ચૂકવી (લોણદાર) રૂ. ૧૦૦૦૦૦
 - ૩) કાર્યાલયખર્ચ માટે ચૂકવ્યા રૂ. ૧૫૦૦૦
૯. નીચેના વ્યવહારો પરથી જમા વાઉચર તૈયાર કરો.
 - ૧) વધારાની મૂડી ઉભી કરી રૂ. ૨૦૦૦૦૦
 - ૨) વિમા કંપની પાસેથી વળતર મેળવ્યુ રૂ. ૫૦૦૦૦
 - ૩) કાર્યાલય માટે બેંકમાંથી ઉપાડ્યા રૂ. ૧૫૦૦૦
૧૦. નીચેના વ્યવહારો પરથી હસ્તાંતરિત વાઉચર તૈયાર કરો.
 - ૧) મહેતા એન્ડ કંપની પાસેથી માલ ખરીધ્યો રૂ. ૨૫૦૦૦
 - ૨) ગ્રાહકો પાસેથી વેચાણ પરત રૂ. ૧૫૦૦
 - ૩) દાન તરીકે માલ આપ્યો રૂ. ૩૦૦૦
૧૧. નીચેના વ્યવહારો પરથી જરૂરી નાણાકીય વાઉચરો તૈયાર કરો.
 - ૧) સલ્માને ઉધારે (શાખ પર) માલ વેચ્યો રૂ. ૮૦૦૦
 - ૨) અંગત વપરાશ માટે રોકડ ઉપાડી રૂ. ૫૦૦૦
 - ૩) ભૂમી પાસેથી રોકડ મેળવી રૂ. ૧૫૦૦૦
 - ૪) પગાર ચૂકવ્યા રૂ. ૫૦૦૦
 - ૫) ઘસારાનો ખર્ચ રૂ. ૭૦૦૦
 - ૬) બેંકમાં રોકડ જમા કરાવી રૂ. ૧૦૦૦૦
૧૨. ફન્ઝીચર ખાતે નીચેનાને યોગ્ય બાજુએ દર્શાવો

ફન્ઝીચર ખરીધ્ય	રૂ. ૨૦૦૦૦
ફન્ઝીચર વેચ્યુ	રૂ. ૧૨૦૦૦

ਕਿਨੋਂਧੀ ਨਾਮਾ ਪਛਤਿ

- | | |
|---|-----------|
| ફન્નિયરનો નિકાલ કર્યો | રૂ. ૧૪૦૦ |
| રૂ. ૫૦૦ ની કિંમતનું ફન્નિયર તૂટી ગયું | રૂ. ૫૦૦ |
| નીચેની માહિતી પરથી માલિક મુડી ખાતુ તૈયાર કરો. | |
| ૧) રોકડેથી ધંધો શરૂ કર્યો | રૂ. ૩૦૦૦૦ |
| ૨) નફા નુકસાન ખાતા મુજબ ચોખ્યુ નુકસાન | રૂ. ૪૦૦૦ |
| ૩) વર્ષ દરમ્યાન ઉપાડ | રૂ. ૪૦૦૦ |
| ૪) વર્ષ દરમ્યાન વધારાની ઉભી કરેલી મુડી | રૂ. ૩૦૦૦ |



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

तमारा भाटे प्रवृत्ति :-

છેલ્લા અઠવાડીયાના તમારા નાણાકીય વ્યવહારોને સાંકળતી પ્રવૃત્તિઓની એક યાદી તૈયાર કરો અને તે વ્યવહારો માટે વાઉચર તૈયાર કરો.

મોડયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

૬

આમ નોંધ

General Journal						
Year	Month	Day	Transaction Details	GL Ref	Debit	Credit
	March	30	Account Name Description Of Transaction	XX	XXXX	XXXX

Diagram annotations:

- Account Name: Points to the 'Account Name' field in the GL Ref row.
- Description Of Transaction: Points to the 'Description Of Transaction' field in the GL Ref row.
- Name of account debited: Points to the 'Name of account debited' field in the GL Ref row.
- Short description of transaction: Points to the 'Short description of transaction' field in the GL Ref row.
- Name of account credited: Points to the 'Name of account credited' field in the GL Ref row.
- General Ledger account number: Points to the 'General Ledger account number' field in the GL Ref row.
- Amounts debited and credited: Points to the 'Amounts debited and credited' field in the GL Ref row.

તમે ધ્યાન વ્યવહારોની નોંધ વિવિધ છિસાબી ચોપડામાં નામાની પદ્ધતિ મુજબ કરવાનું શીખી ગયા. નામું રાખવાની દિનોંથી નામ પદ્ધતિ પણ શીખ્યાં. હવે, તમને જાણવાની ઈચ્છા થશે કે નામાના વિવિધ ખાતાઓના ચોપડા એ શું છે? તે કેવી રીતે તૈયાર કરાય છે? જે તે ચોક્કસ ચોપડામાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? આ ચોપડાઓ પેકી એક ચોપડો આમનોંધ છે. આમનોંધ એ એવો ચોપડો છે જે દરેક નાના મોટા વેપારી-ધ્યાદારી તૈયાર કરે છે. આ ચોપડામાં ધ્યાન વ્યવહારો તારીખના કમમાં અને જે સમયે વ્યવહાર કર્યો તે કમમાં નોંધવામાં આવે છે. આ પ્રકરણમાં તે આમનોંધનો અર્થ, તેનો હેતુ અને આમનોંધને તૈયાર કરવાની પદ્ધતિ વિશે શીખવાના છે.



હેતુઓ :

આ પ્રકરણનાં અભ્યાસ બાદ તમે નીચેની બાબતો શીખશો :

- આમનોંધનો અર્થ તેના હેતુ સાથે સમજાવવી
- આમનોંધ તેના માળખા મુજબ દોરવી (લખવી)
- આમનોંધ નોંધવાની પ્રક્રિયા સમજાવવી
- સાધા અને સંયુક્ત વ્યવહારોની આમનોંધ કરવી અને
- આમનોંધનું ખાસ આમનોંધ અને વ્યક્તિગત આમનોંધમાં વર્ગીકરણ કરવું

6.1 આમ નોંધનો અર્થ

આમનોંધ એ નામપદ્ધતિનો એવો ચોપડો છે કે જેમાં ધ્યાના રોજબરોજના વ્યવહારોની નોંધ કરવાનુસાર એટલે કે વ્યવહારો જે સમયે કરવામાં આવ્યા તે (તારીખ)ના કમમાં કરવામાં આવે છે. આમનોંધમાં જ્યારે વ્યવહારો નોંધવામાં આવે છે ત્યારે તેને 'નોંધ' કહેવાય છે. આમનોંધ 'મૂળચોપડો' (બુનિયાદી કે પાયાનો ચોપડો) કે 'પ્રારંભિક આમનોંધનો ચોપડો' તરીકે પણ ઓળખાય છે.

તમે શીખ્યા કે ધ્યાનમાં જે આર્થિક વ્યવહારો થાય છે તેને નામા પદ્ધતિના અલગ અલગ છિસાબી



પદોમાં વળ્ફકૃત કરવામાં આવે છે. જેવા કે મિલકત, જવાબદારી (દેખું), મૂડી, ઉપજ (revenue) અને જાવક. ધ્યાના બધા વ્યવહારો આ હિસાબી પદો પેકી એક હિસાબી પદ સાથે સંકળાયેલા હોય છે અને તે મુજબ તેની નોંધ આમનોંધમાં કરવામાં આવે છે. આમનોંધના ચોપડામાં વ્યવહારોની નોંધવાની પ્રક્રિયા ‘આમનોંધની નોંધકાળી’ તરીકે ઓળખાય છે.

નાના ધ્યાદારી એકમો સામાન્ય રીતે એક જ આમનોંધનો ચોપડો નિભાવતા હોય છે કે જેમાં ધ્યાના તમામ વ્યવહારોની નોંધ કરવામાં આવતી હોય છે. પરંતુ મોટા ધ્યાદારી એકમોમાં ખૂબ મોટી સંખ્યામાં વ્યવહારો થતાં હોય છે, તેથી આમનોંધ અલગ અલગ ચોપડામાં વિભાજિત કરવામાં આવે છે. જે ‘બાસ આમનોંધ’ તરીકે ઓળખાય છે. આમનોંધમાં અલગ અલગ વ્યવહારો તેના હિસાબી પદ (વ્યવહારની લાક્ષણિકતા) મુજબ નોંધવામાં આવે છે, ઉદાહરણ તરીકે જે માલનું વેચાણ શાખ (ઉધાર) પર કરવામાં આવ્યું છે તે વેચાણના ચોપડામાં નોંધવામાં આવે છે. શાખ (ઉધાર) પર ખરીદવામાં આવેલ માલ ખરીદ ચોપડામાં નોંધવામાં આવે છે. અને રોકડ વ્યવહારો રોકડમેળ (કેશબુક) માં નોંધવામાં આવે છે. અને આ પ્રમાણે બીજા ધ્યાકીય વ્યવહારોની નોંધ કરવામાં આવે છે.

આમનોંધ તૈયાર કરવાનો હેતુ (લાભ)

- ધ્યાના તમામ વ્યવહારોની તારીખના કમમાં નોંધ મળી રહે છે.
- તે કોઈ એક વ્યવહારની પૂરેપૂરી માહિતી અને તેનો ખુલાસો (સમજૂતી) પણ આપે છે.
- દ્વિનોંધી નામપદ્ધતિના સિદ્ધાંતોને સમજવામાં મદદરૂપ બને છે. જેમ કે, આમનોંધના ચોપડામાં આમનોંધો ઉધાર અને જમા એ રીતે વળ્ફકૃત કરવામાં આવે છે.
- આમનોંધના ચોપડામાંની આમનોંધની ખાતાવહીમાં નોંધ કરવાનું કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર અને ખૂબ જ સરળ રહે છે.

6.2 આમનોંધનું માળખું

આમનોંધના ચોપડાના દરેક પાના પર નીચે મુજબનું માળખું હોય છે :

આમનોંધ

તારીખ	વિગત	ખા. પા.	રૂ. રકમ	રૂ. રકમ
(1)	(2)	(3)	(4)	(5)

તમે જુઓ છો કે, આમનોંધનો ચોપડો ઉભા ખાનાવાળો ચોપડો છે. દરેક ઉભા ખાનાના મથાળે ખાનાનું નામ લખેલું છે. આમનોંધના ચોપડાની ખાનાના કમમાં વિગત નીચે મુજબ છે :-

- તારીખ : તારીખના ખાનામાં વ્યવહાર જે તારીખે કરવામાં આવ્યો હોય તે મહિનો અને

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

આમ નોંધ

વર્ષ સહિત નોંધવામાં આવે છે. જે તે વર્ષ અને મહિનામાં કરેલા વ્યવહારો માટે એક જ વખત વર્ષ અને મહિનો લખીને તેની નીચે નોંધવામાં આવે છે.

2. વિગત : નામપદ્ધતિ વ્યવહારથી અસર પામે છે. જેમ કે, નામું જેને ખાતે ઉધારવામાં આવે છે અને જમા લેવામાં આવે છે તેની નોંધ આ જેભા ખાનામાં લખવામાં આવે છે. પહેલી લીટીમાં જેના ખાતે ઉધારવામાં આવ્યું હોય તે ઉધાર બાજુ લખવામાં આવે છે. થોડી જગ્યા થોડી બીજી લીટીમાં જેના ખાતે જમા લેવામાં આવ્યું છે તે જમા બાજુ લખવામાં આવે છે. ‘તે’(To) શબ્દ તેના આરંભમાં લખવાનો હોય છે. એ પદ્ધતિની લીટીમાં સમજૂતી (Narration) લખવાની હોય છે. સમજૂતી એ નોંધવામાં આવેલ આમનોંધનો વીગતવાર ખુલાસો છે. સમજૂતી ટૂંકી, પૂરેપૂરી અને સ્પષ્ટ હોવી જોઈએ. બીજી આમનોંધ લખો એ પહેલાં લીટી દીરો જેથી બંન્ને આમનોંધ અલગ પાડી શકાય.
- નોંધ : નામપદ્ધતિની આધુનિક સંકલ્પના મુજબ આમનોંધમાં જમા ખાતેની આમનોંધ ‘તે’ લખ્યા વગર પણ લખી શકો છો.
- ખાતાવહી પાના નંબર (ખ.પા.) : આમનોંધના ચોપડામાં જે વ્યવહારની નોંધ કરવામાં આવી છે તેની ખતવણી ખાતાવહીમાં કરવામાં આવે છે. ખાતાવહીના જે પાના ઉપર બંન્ને ખાતા લખ્યા છે તે પાના નંબર અહીં લખાય છે.
- ઉધાર રકમ : આ ખાનામાં વિગતના ખાનામાં જે ખાતું ઉધારવામાં આવ્યું હોય તેની બરાબર સામે જ ઉધારના ખાનામાં ઉધારવામાં આવેલી રકમ લખવામાં આવે છે.
- જમા રકમ : આ ખાનામાં વિગતના ખાનામાં જે ખાતું જમા લેવામાં આવ્યું હોય તેની બરાબર સામે જ જમાના ખાનામાં જમા કરવામાં આવેલી રકમ લખવામાં આવે છે.

તમે નીચે આપેલા ઉદાહરણની મદદથી આમનોંધના વ્યવહારની ખતવણી સમજી શકશો :

2012

એપ્રિલ 1 10,000 રોકડથી ધંધો શરૂ કર્યો.

ઉપરોક્ત વ્યવહાર બે ખાતા સાથે સંકળાયેલ છે, મૂડી ખાતું અને રોકડ ખાતું.

આમનોંધ

તારીખ	વીગત	ખ.પા.	ઉ. રકમ	જ. રકમ
2012				
એપ્રિલ 1	રોકડ ખાતે ... તે મૂડી ખાતે (રોકડ મૂડીથી ધંધો શરૂ કર્યો)	૬	10,000	10,000

આમ નોંધ

આમનોંધના દરેક પાના અંતે બંન્ને ખાના (ઉધાર રકમ અને જમા રકમ) નો સરવાળો કરી ‘સરવાળો આગળ લઈ ગયા’ એ શબ્દો લખવા. બીજા પાને સૌ પ્રથમ વિગતના ખાનામાં ‘સરવાળો આગળ લાવ્યા’ લખી સરવાળાની રકમ લખવી.



પાઠ સ્વાધ્યાય ૬.૧

- I. નીચેના અધૂરાં વિધાનો આમનોંધના અર્થને સ્પષ્ટ કરે એ રીતે પૂર્ણ કરો.
 - i. આમનોંધએ નામાપદ્ધતિનો એવો ચોપડો છે કે જેમાં _____.
 - ii. સમજૂતી એટલે _____.
 - iii. ખાતાવહી પાના નંબરનું ખાનું _____ . માટે વપરાય છે.
- II. આમનોંધના સંદર્ભમાં નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે કહો :
 - i. આમનોંધમાં ફક્ત રોકડ વ્યવહારો જ નોંધવામાં આવે છે.
 - ii. આમનોંધના ચોપડાનું બીજું કોઈ નામ નથી.
 - iii. નાના કે મોટા દરેક ધંધાદારી આમનોંધનો ચોપડો લખે છે.

૬.૩ ખતવણીની પ્રક્રિયા

આમનોંધ તૈયાર કરતી વખતે નીચેના પગલાં ભરવામાં આવે છે.

- i) ખાતાંઓ ઓળખો : સૌ પ્રથમ નામાના વ્યવહારો કયાં કયાં ખાતાઓ સાથે સંકળાયેલા છે તે ઓળખો. ઉદાહરણ તરીકે 5000 નો માલ રોકડેથી વેચ્યો એ વ્યવહાર છે. અહીં વેચાણ ખાતું અને રોકડ ખાતું સંકળાયેલા છે.
- ii) ખાતાંઓ નિશ્ચિત કરો : હવે, બંન્ને ખાતાઓ નિશ્ચિત કરવામાં આવે છે, જેવાં કે, માલ મિલકત, જવાબદારી (દિવું), મૂડી, ખર્ચ (expense) કે ઉપજ (revenue). અહીં આપેલ ઉદાહરણમાં રોકડ ખાતું એ માલ મિલકત ખાતું અને વેચાણ ખાતું એ ઉપજ ખાતું (revenue) છે.
- iii) ઉધાર અને જમાના નિયમો લાગુ કરો : તમે ઉધાર અને જમાના નિયમો શીખી ગયા છો. હવે કૃયું ખાતું ઉધારવામાં આવશે અને કૃયું ખાતું જમા લેવામાં આવશે તે નક્કી કરો. અહીં આપણને આપવામાં આવેલ ઉદાહરણમાં જેમ વેચાણ (ઉપજ-આવક)ની વસ્તુ વધે છે તેમ વેચાણ ખાતામાં જમા લેવામાં આવે છે, અને જેમ રોકડ (માલ મિલકત) છે વધે છે તેમ રોકડ ખાતામાં ઉધારવામાં આવે છે.

હવે, આમનોંધની નોંધ કરવામાં આવે છે અને સમજૂતી લખવામાં આવે છે. વિગતના ખાનામાં બંન્ને ખાતાંઓની બરાબર સામે ઉધાર અને જમાના ખાનામાં રકમ લખવામાં આવે છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

આમ નોંધ

ઉપર જણાવેલ વ્યવહારની આમનોંધ નીચે પ્રમાણે લખવામાં આવશે.

આમનોંધ

તારીખ	વીગત	ખા.પા.	ઉ. રકમ	જ. રકમ
	રોકડ ખાતે... તે વેચાણ ખાતે (રોકટેથી માલ વેચ્યો)	Dr.	5,000	5,000

ઉદાહરણ - ૧

નીચે આપેલા વ્યવહારોનું આધુનિક નામ પ્રદાન કરી મુજબ વિશ્લેષણ કરો.

2012

અન્ય 1	શ્રી સાગરે રોકટેથી ધંધો શરૂ કર્યો	50,000
અન્ય 2	બેંકમાં ચૂકવ્યા	20,000
અન્ય 4	રોકટેથી માલ ખરીદ્યો	10,000
અન્ય 8	મશીનરી ખરીદી અને ચેકથી ચૂકવણી કરી	5,000
અન્ય 12	શ્રી પ્રતિકને માલ વેચ્યો	12,000
અન્ય 15	શ્રીમતી ગુજાવંતી પાસેથી માલ ખરીદ્યા	16,000
અન્ય 18	રોકટેથી માલ વેચ્યો	8,000
અન્ય 20	શ્રી પ્રતીક પાસેથી રોકડ મળ્યા	12,000
અન્ય 31	અંગત ઉપયોગ માટે રોકડ ઉપાડ્યા	2,400
અન્ય 31	ભાડું ચૂકવ્યું	2,000

જવાબ :

ચાલો, આપણે સૌ પથમ વ્યવહારોનું વિશ્લેષણ

ધેંધાકીય વ્યવહારોનું કોઠામાં વિશ્લેષણ

તારીખ	વ્યવહાર	સંકળાયેલા ખાતાની	ખાતાના પ્રકારો	વધે છે/ ઘટે છે	ઉધારાયેલ ખાતું	જમા લીધેલ ખાતું
2012 જાન્ય. 1	માલિક શ્રી સાગર પાસેથી રોકડ મળી	રોકડ મૂડી	માલ મિલકત મૂડી	વધે છે વધે છે	રોકડ ખાતું	મૂડી ખાતું
જાન્ય. 2	બેંકમાં ચૂકવ્યા	બેંક રોકડ	મિલકત મિલકત	વધે છે ઘટે છે	બેંક ખાતું	રોકડ ખાતું
જાન્ય. 4	રોકદેથી માલ અરીયા	અરીદ રોકડ	ખર્ચ મિલકત	વધે છે ઘટે છે	અરીદ ખાતું	રોકડ ખાતું
જાન્ય. 8	મશીનરી ખરીદી અને ચેકથી ચૂકવણી કરી	મશીનરી બેંક	મિલકત મિલકત	વધે છે ઘટે છે	મશીનરી ખાતું	બેંક ખાતું
જાન્ય. 12	શ્રી પ્રતીકન માલ વેચ્યો	શ્રી પ્રતીક વેચાણ	શ્રી પ્રતીક (દેવાદાર) વેચાણ (૩૫૪)	વધે છે વધે છે	શ્રી પ્રતીક	વેચાણ ખાતું
જાન્ય. 15	શ્રીમતી ગુણવંતી પાસેથી માલ	અરીદ શ્રીમતી ગુણવંતી	ખર્ચ શ્રીમતી ગુણવંતી (લેણદાર)	વધે છે વધે છે	અરીદ ખાતું	શ્રીમતી ગુણવંતી
જાન્ય. 18	રોકદેથી માલ વેચ્યો	રોકડ વેચાણ	મિલકત ૩૫૪	વધે છે ઘટે છે	રોકડ ખાતું	વેચાણ ખાતું
જાન્ય. 20	શ્રી પ્રતીક પાસેથી રોકડ મળી	રોકડ શ્રી પ્રતીક	મિલકત શ્રી પ્રતીક (દેણદાર)	વધે છે ઘટે છે	રોકડ ખાતું	શ્રી પ્રતીક
Jan. 31	અંગત ઉપયોગ માટે રોકડ ઉપાડી	ઉપાડ રોકડ	મૂડી મિલકત	ઘટે છે ઘટે છે	ઉપાડ ખાતું	રોકડ ખાતું
Jan. 31	ભાડું ચૂકવ્યું	ભાડા રોકડા	ખર્ચ મિલકત	વધે છે ઘટે છે	ભાડા ખાતું	રોકડ ખાતું

મોડચુલ - ૨
આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

મોડિયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

આમ નોંધ

ઉદાહરણ - ૨

ઉપરોક્ત વિશ્લેષણના આધારે નીચે મુજબની આમનોંધ તૈયાર થશે.

શ્રી સાગરની આમનોંધ

તારીખ	વિગત	ખ. પા.	ઉધાર રકમ	જમા રકમ
2012 જાન્ય. 1	રોકડ ખાતે ... મૂડી ખાતે (શ્રી સાગર મારફતે મૂડી લાવવામાં આવી)	૬.	50,000	50,000
જાન્ય. 2	બંક ખાતે ... રોકડ ખાતે (બંકમાં રોકડા ભયી)	૬.	20,000	20,000
જાન્ય. 4	વેચાણ ખાતે ... રોકડ ખાતે (રોકડેથી માલ ખરીદ્યો)	૬.	10,000	10,000
જાન્ય. 8	મશીનરી ખાતે ... બંક ખાતે (મશીનરી ખરીદી કરી અને ચેકથી ચૂકવણી કરી)	૬.	15,000	15,000
જાન્ય. 12	શ્રી પ્રતીક ખાતે... વેચાણ ખાતે (રોકડેથી માલ વેચ્યો)	૬.	12,000	12,000
જાન્ય. 15	ખરીદ ખાતે ... ગુણવંતી ખાતે (માલ રોકડેથી ખરીદ્યો)	૬.	16,000	16,000
જાન્ય. 18	રોકડ ખાતે ... શ્રી વેચાણ ખાતે (રોકડેથી માલ વેચ્યો)	૬.	8,000	8,000
જાન્ય. 20	રોકડ ખાતે ... શ્રી પ્રતીક ખાતે (દેણદાર શ્રી પ્રતીક પાસેથી રોકડા મળ્યા)	૬.	12,000	12,000
જાન્ય. 31	ઉપાડ ખાતે ... રોકડ ખાતે (અંગત ઉપયોગ માટે રોકડ ઉપાડી)	૬.	2,400	2,400
જાન્ય. 31	ભાડા ખાતે ... રોકડ ખાતે (ભાડું ચૂકવ્યુ)	૬.	2,000	2,000
			1,47,400	1,47,400



સ્વાધ્યાય ફ.૨

નીચે કેટલાક વ્યવહારો આપેલા છે. આ વ્યવહારોના તેમના સંકળાયેલા ખાતાના નામ અને પ્રકાર જમા અને ઉધારના ખાનામાં લખો.

વ્યવહાર	ઉધાર		જમા	
	ખાતાનુંનામ	ખાતાનો પ્રકાર	ખાતાનું નામ	ખાતાનો પ્રકાર
i. માલની ખરીદી કરી અને ચેકથી ચૂકવ્યા				
ii. પગાર ચૂકવ્યો.				
iii. દેશદાર શ્રી અર્પણ પાસેથી રોકડા મળ્યા.				
iv. ગીતાને માલ વેચ્યો				
v. અંગત ઉપયોગ માટે રોકડા ઉપાડ્યા				

સંયુક્ત આમનોંધો

આમનોંધમાં શીખ્યા કે આમનોંધ બે ખાતા સાથે સંકળાયેલી હોય છે. એવું પણ બને છે કે આમનોંધ બે કરતાં વધારે ખાતાં સાથે સંકળાયેલી હોય. આ પ્રકારની આમનોંધો ‘સંયુક્ત’ કે મિશ્ર આમનોંધો કહેવાય. સંયુક્ત આમનોંધ એક કરતાં વધારે વખત ઉધાર કે જમા થાય અથવા ઉધાર જમા બંન્ને થતી જોવા મળે છે, ઉદાહરણ તરીકે,

- 2,000 ભાડા પેટે અને 4,000 પગાર પેટે રોકડા ચૂકવ્યા.
- આમનોંધમાં સંકળાયેલા ખાતા ભાડા ખાતું છે. જે ઉધારાય છે અને પગાર ખાતું છે તે પણ ઉધારાય છે. આમ, બંન્ને બાબત ખર્ચ છે. અને ખર્ચ વધે છે.
- રોકડ ખાતું મિલકત છે તેથી રોકડ ખાતું જમા કરાય છે અને તે પગાર અને ભાડાની ચૂકવણી કરતાં ઘટે છે.

આમનોંધ

ભાડા ખાતે	રૂ.	2,000	
પગાર ખાતે	રૂ.	4,000	
રોકડ ખાતે			6,000
(ભાડા અને પગાર પેટે રોકડા ચૂકવ્યા)			

ઉપરની આમનોંધ જેમ શ્રી વરુણ 4900 રોકડા ચૂકવે છે. આપણાને તે 100 વટાવ (Discount) આપે છે. આમનોંધ નીચે મુજબ લખાશો.

મોડિયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

મોડિયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

આમ નોંધ

શ્રી વરુણ ખાતે	૩	5,000	4,900
રોકડ ખાતે			100
વટાવ ખાતે			
(શ્રી વરુણને રોકડ ચૂકવ્યા અને તેણે વટાવ આપ્યો)			


આમ, ઉપરોક્ત ઉદાહરણોને આધારે તમે એક કરતાં વધારે વખત ઉધાર કે જમા થતી આમનોંધો સમજી શક્યા હોય. આ આમનોંધો સંયુક્ત આમનોંધ તરીકે ઓળખાય છે.

૬.૪ આમનોંધનું વર્ગીકરણ

આમનોંધ એ એવો ચોપડો છે કે જેમાં વ્યવહારોની નોંધ સમયાનુક્રમમાં તારીખ પ્રમાણે કરવામાં આવેલી હોય છે. એ માટે જો વ્યવહારોની મોટી સંખ્યા હોય તો બધા જ વ્યવહારોની નોંધ આમનોંધના ચોપડામાં કરવાનું વ્યવહારિક રીતે મુશ્કેલ બની શકે છે. આથી આમનોંધને વિવિધ આમનોંધમાં વિભાજિત કરવાની જરૂર પડે છે. આ પ્રત્યેક અલગ અલગ આમનોંધને પેટાનોંધો કે ખાસ હેતુ માટેનો ચોપડો કહેવાય છે. અને આ આમનોંધ વ્યક્તિગત આમનોંધ તરીકે ઓળખાય છે. એક ધ્યાદારી સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મહત્વની પેટા નોંધો (આમનોંધો) નીચે મુજબ છે.

- રોકડ મેળ (રોકડ સિલ્ક ચોપડો)
- વેચાણ નોંધ
- ખરીદ નોંધ
- વેચાણ પરત નોંધ અથવા માલ પરત જમા નોંધ
- ખરીદ પરત નોંધ અથવા માલ પરત ઉધાર નોંધ
- વ્યક્તિગત આમનોંધ અથવા સામાન્ય આમનોંધ

આમનોંધનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ



કેટલાક મૂળભૂત વ્યવહારો તેમની આમનોંધની સાથે નીચે આપેલ છે.

આમનોંધની નોંધો

વ્યવહારો	આમનોંધની નોંધ
1. શાખ પર માલ ખરીદો	ખરોદ ખાતું ... રૂ સપ્લાયર્સ ખાતું
2. શાખ પર માલ વેચ્યો	ગ્રાહક ખાતું ... રૂ વેચાણ ખાતું
3. મિલકત રોકડેથી ખરીદી	અન્ય પરચૂરણ ખર્ચ ખાતું ... રૂ રોકડ ખાતું
4. મૂડી સામે ધંધો શરૂ કર્યો	રોકડ ખાતું ... રૂ મૂડી ખાતું
5. ગ્રાહક પાસેથી રોકડ/ચેકમાં ઉઘરાણી થવી ચેકમાં ઉઘરાણી થવી જો વટાવ મળ્યો હોય તો)	રોકડ ખાતું/બેંક ખાતું ... રૂ મળેલ વટાવનું ખાતું ... રૂ ગ્રાહક ખાતું
6. રોકડેથી માલ ખરીદો	ખરોદ ખાતું ... રૂ રોકડ ખાતું
7. રોકડેથી વેચાણ	રોકડ ખાતું ... રૂ વેચાણ ખાતું
8. બેંકમાં ખાતું ખોલાવવું	બેંક ખાતું ... રૂ રોકડ ખાતું
9. ધાલખાદ પરત મળી	રોકડ ખાતું ... રૂ ધાલખાદ પરત ખાતું
10. સપ્લાયર્સને રોકડ/ચેક ચેક દ્વારા ચૂકવણી જો કોઈ વટાવ હોય તો	સપ્લાયર ... રૂ રોકડ/બેંક ખાતું (કુલ રકમ) મળેલ વટાવનું ખાતું (વટાવ)
11. ધાલખાદ	ધાલખાદ ખાતું ... રૂ ગ્રાહક ખાતું
12. નમૂના તરીકે મફતમાં માલ વહેંચવો માલ વહેંચવો	મફત નમૂનાનું ખાતું ... રૂ ઝાહેરાતનું ખાતું ... રૂ ખરોદ ખાતું
13. રોકડેથી મશીનરી ખરીદવી	મશીનરી ખાતું ... રૂ રોકડ ખાતું



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

આમ નોંધ

14. સ્થાવર મિલકતનો ઘસારા ખર્ચ	ઘસારા ખાતું મિલકત ખાતું	...Dr.
15. ધંધા માટે બેંકમાંથી રોકડ ઉપાડી	રોકડ ખાતું બેંક ખાતું	...Dr.
16. નફા સાથે જૂની મિલકત વેચવી કે કાઢી નાંખવી	રોકડ ખાતું મિલકત ખાતું નફા સાથે મિલકત વેચાણ ખાતું	...Dr.
17. ધર્માદામાં માલ કે રોકડ આપવી	ધર્માદાનું ખાતું રોકડ ખાતું ખરીદ ખાતું	...Dr.
18. સપ્લાયરને માલ પરત કરવો	સપ્લાયર્સ ખાતું પરત ખાતું	...Dr.
19. ખોટ સાથે જૂની મિલકત વેચવી કે કાઢી નાંખવી	રોકડ બેંક ખાતું ખોટ સાથે મિલકત મિલકત ખાતું	...Dr. ...Dr.
20. ગ્રાહકે માલ પરત કર્યો	વેચાણ માલ પરત ખાતું ગ્રાહકનું ખાતું	...Dr.

ઉદાહરણ ૩

શ્રી પ્રતીકના વ્યવહારોની આમનોંધ તૈયાર કરો.

2012

જાન્યુ. 1 રોકડ મૂડી લાવી ધંધો શરૂ કર્યો.	50,000
જાન્યુ. 3 બેંકમાં ચૂકવ્યા	25,000
જાન્યુ. 5 રોકડેથી ફર્નિચરની ખરીદી કરી	5,000
જાન્યુ. 8 માલ ખરીદો અને ચેકથી ચૂકવ્યા	15,000
જાન્યુ. 8 ગાડીભાડાના ચૂકવ્યા	500
જાન્યુ. 14 શ્રી ગુજરાત પાસેથી માલ ખરીદો	35,000
જાન્યુ. 18 રોકડેથી વેચાણ કર્યું	32,000
જાન્યુ. 20 શ્રી અમૃતલને શાખ પર માલ વેચ્યો	28,000
જાન્યુ. 25 શ્રી ગુજરાતને સેટલમેન્ટ કરી રોકડા ચૂકવ્યા	34,200
જાન્યુ. 28 શ્રી અમૃત પાસેથી રોકડા મળ્યા તેને વટાવ આપવામાં આવ્યો	27,500 500
જાન્યુ. 31 મહિનાનું ખાતું ચૂકવ્યું	2,000
જાન્યુ. 31 અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા	2,500

આમ નોંધ

જવાબ

તારીખ	વિગત	ખ. પા.	ક. રકમ	ક. રકમ
2012				
જાન્ય. 1	રોકડ ખાતે મૂડી ખાતે (રોકડ મૂડીથી ધંધો શરૂ કર્યો)	૩	50,000	50,000
જાન્ય. 3	બંક ખાતે રોકડ ખાતે (રોકડ બંકમાં ભરી)	૩	25,000	25,000
જાન્ય. 5	ફર્નિચર ખાતે રોકડ ખાતે (રોકડથી ફર્નિચર ખરીદું)	૩	5,000	5,000
જાન્ય. 8	ખરીદ ખાતે બંક ખાતે (માલની ખરીદી કરી અને ચેકથી ચૂકવણી કરી)	૩	15,000	15,000
જાન્ય. 8	લારીભાડા ખાતે રોકડ ખાતે (લારીભાડાના રોકડ ચૂકવ્યા)	૩	500	500
જાન્ય. 14	ખરીદ ખાતે શ્રી ગુંજન ખાતે (શ્રી ગુંજન પાસેથી શાખ પર માલ ખરીદો)	૩	35,000	35,000
જાન્ય. 18	રોકડ ખાતે વેચાણ ખાતે (રોકડથી માલ વેચ્યો)	૩	32,000	32,000
જાન્ય. 20	શ્રી અમૃત ખાતે વેચાણ ખાતે (શ્રી અમૃતને શાખ પર માલ વેચ્યો)	૩	28,000	28,000
	C/F		1,90,500	1,90,500

મોડચુલ - ૨
આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

આમ નોંધ

	B/F		1,90,500	1,90,500
જન્ય. 25	શ્રી ગુજરાત ખાતે રોકડ ખાતે વટાવ ખાતે (શ્રી ગુજરાતને રોકડા ચૂકવ્યા અને તેણે વટાવ આયો)	૬.	35,000	34,200 800
જન્ય. 28	ભાડા ખાતે રોકડ ખાતે શ્રી અમૃત ખાતે (શ્રી અમૃત પાસેથી રોકડા મળ્યા અને તેને વટાવ આયો)	૩.	27,500 500	28,000
જન્ય. 31	ભાડા ખાતે રોકડ ખાતે (રોકડા ભાડાના ચૂકવ્યા)	૬	2,000	2,000
જન્ય. 31	ઉપાડ ખાતે બેંક ખાતે (અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડવા)	૬	2,500	2,500
			2,58,000	2,58,000



પાઠ સ્વાધ્યાય ૬.૨

બાબુ વિકલ્પ પ્રશ્નો :-

- આમનોંધનો ચોપડો તૈયાર કરવાનો હેતુ એ છે કે.....
 - તારીખના કમમાં ધંધાના બધા જ વ્યવહારો પૂરા પાડવા
 - ધંધાનો નફો અને ખોટ જાણવાં
 - ધંધાની આર્થિક સ્થિતિ જાણવી
 - ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું
- સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે,
 - આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે
 - આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે

આમ નોંધ

- c) આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જ્મા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે
- d) એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જ્મા લેવામાં આવતી નથી
- iii. આમનોંધનો ચોપડો બીજા નામે પણ જાણીતો છે કે,
- પેટા નોંધનો ચોપડો
 - પ્રારંભિક આમનોંધનો ચોપડો
 - પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો
 - ઉપરનામાંથી એક પણ નહિ
- iv. આમનોંધને વર્ગીકૃત કરી શકાય છે -
- ખાસ આમનોંધ
 - વ્યક્તિગત આમનોંધ
 - ખાસ આમનોંધ અને વ્યક્તિગત આમનોંધ
 - ઉપરનામાંથી એક પણ નહિ
- v. આમનોંધના ચોપડામાં સમજૂતી
- તારીખ
 - વીગત
 ૩. ૨૫મ
 ૪. ૨૫મ



તમે આટલું શીખ્યા :

- આમનોંધનો નામાપદ્ધતિનો એવો ચોપડો છે કે જેમાં ધંધાના રોજબરોજના વ્યવહારોની નોંધ સમયના કમમાં કરવામાં આવે છે.
- આમનોંધના ચોપડામાં વ્યવહારોની નોંધ કરવાની પ્રક્રિયા ખતવણી તરીકે ઓળખાય છે.
- આમનોંધનો ચોપડો જુદી જુદી આમનોંધોમાં વિભાજિત હોય છે. તેને જુદા જુદા ચોપડાઓમાં લખવામાં આવે છે. આ ચોપડાઓ રોકડમેળ, વેચાણ ચોપડો, ખરીદ ચોપડો વગેરે હોઈ શકે.
- આમનોંધના ચોપડાનું માળખું નીચે મુજબ છે.

તારીખ	વીગત	ખા.પા	૩. ૨૫મ	૪. ૨૫મ
			-	-

- વ્યવહારોની ખતવણી કરવાની પ્રક્રિયાનાં સોપાનો :

- વ્યવહારમાં સંકળાયેલા ખાતાં નક્કી કરો.
- ખાતાંનો પ્રકારો નક્કી કરો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

આમ નોંધ

- (iii) ઉધાર અને જમાનો નિયમ લાગુ કરો.
- (iv) રકમ અને સમજૂતી લખો.
- જે આમનોંધ એક કરતાં વધારે વખત ઉધારાય કે જેમા લેવામાં આવે છે તે સંયુક્ત આમનોંધ કહેવાય છે.
- જ્યારે વ્યવહારોની ખૂબ મોટી સંખ્યા હોય ત્યારે આમનોંધને અલગ અલગ આમનોંધના ચોપડામાં વિભાજીત કરવામાં આવે છે. આ આમનોંધો ખાસ આમનોંધ કે ખાસ હેતુ માટેની આમનોંધ કે પેટાનોંધો તરીકે ઓળખાય છે.



પા�્યાંત સ્વાધ્યાય :

1. આમનોંધ એટલે શું?
2. આમનોંધનો ચોપડો શા માટે બુનિયાદી પાયાનો ચોપડો કહેવાય છે?
3. ખતવણી કરવાના વિવિધ સોપાનો સમજાવો.
4. સંયુક્ત આમનોંધ ઉદાહરણ સાથે સમજાવો.
5. શ્રી અરુણના ચોપડામાં નીચેના વ્યવહારોની ખતવણી કરો.

2012

ઓપ્રિલ. 1	રોકડ મૂડી રોકી ધંધો શરૂ કર્યો	80,000
ઓપ્રિલ. 3	બેંકમાં રોકડા ભર્યો	50,000
ઓપ્રિલ. 6	રોકડેથી માલ ખરીદ્યો	20,000
ઓપ્રિલ. 9	ફર્નિચર ખરીદ્યું અને ચેકથી ચૂકવ્યા	15,000
ઓપ્રિલ. 14	શ્રીમતી નેહાને માલ વેચ્યો	18,000
ઓપ્રિલ. 19	શ્રી નિર્મલ પાસેથી માલ ખરીદ્યો	24,000
ઓપ્રિલ. 21	અંગત ઉપયોગ માટે ઉપાડ કર્યો	8,000
ઓપ્રિલ. 24	શ્રીમતી નેહા પાસેથી ચેક મળ્યો	17,600
	તેને વટાવ આપ્યો	400
ઓપ્રિલ. 26	શ્રી નિર્મલને ચેકથી ચૂકવ્યા	16,300
ઓપ્રિલ. 27	શ્રીમતી માયાને રોકડેથી માલ વેચ્યો	80,000
ઓપ્રિલ. 30	ટેલિફોન બિલ ચૂકવ્યું	4,200

આમ નોંધ

6. શ્રી રામ કુમારના આમનોંધના ચોપડામાં નીચેના વ્યવહારોની આમનોંધ લખો.

રોકડ મૂડી લાવી ધંધો શરૂ કર્યો	1,50,000
રોકડથી માલ ખરીદો	1,00,000
શ્રી મોહન પાસેથી શાખ પર માલ ખરીદો	26,000
બેંકમાં જમા કર્યો	15,000
ફર્નિચર ખરીદ્યું	72,000
રોકડથી માલ વેચ્યો	7,000
શ્રી કૌશિકને શાખ પર માલ વેચ્યો	5,000
જૂનું ફર્નિચર વેચ્યું	3,500
શ્રી કમલ પાસેથી મળ્યા	3,000
પગાર ચૂકવ્યો	3,100
ભાડું ચૂકવ્યું	4,200
ટેલિફોન બિલ ચૂકવ્યું	1,800

7. શ્રીમતી શીલાના ચોપડામાં નીચેના વ્યવહારોની આમનોંધ લખો.

રોકડ મૂડીથી ધંધો શરૂ કર્યો	1,30,000
બેંક ચૂકવ્યા	21,000
માલ ખરીદો	1,500
બેંકમાંથી રોકડ ઉપાડી	3,000
શ્રી શામને માલ વેચ્યો	1,000
શ્રી દીપક પાસેથી માલ ખરીદો	1,500
કુ. શારદા પાસેથી રોકડ મળ્યા	3,000
શ્રી મલિકને ચૂકવ્યા	1,475
ભાડું ચૂકવ્યું	2,000
કારકુનને પગાર ચૂકવ્યો	4,500
ટપાલ ખર્ચ ચૂકવ્યો	1,000

8. નીચેના વ્યવહારોની આમનોંધ તૈયાર કરો.

2012

જુલાઈ 1	રોકડ મૂડીથી ધંધો શરૂ કર્યો	2,00,000
જુલાઈ 2	શ્રી વિવેક પાસેથી શાખ પર માલ ખરીદો	1,00,000

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

આમ નોંધ

જુલાઈ 8	રોકટેથી માલ વેચ્યો	22,400
જુલાઈ 9	મે. અંજુ એન્ડ કુ. ને શાખ પર માલ વેચ્યો.	10,000
જુલાઈ 15	મે. બલભીર એન્ડ સન્સને ચૂકવ્યા	11,900
	તેમને વટાવ આપ્યો	100
જુલાઈ 25	મે. બાલક્રિષ્ણ એન્ડ સન્સને માલ વેચ્યો	5,600
જુલાઈ 27	મે. અંજુ એન્ડ કુ. પાસેથી સેટલ મેન્ટ બાદ ચેક મળ્યો	9,750
જુલાઈ 31	વીજળી બિલ ચૂકવ્યું	3,100
જુલાઈ 31	પગાર ચૂકવ્યો	2,000
જુલાઈ 31	ધંધાની માલિક અડું મકાન રહેઠાણ માટે વાપરતા હોવાથી અડધા મકાનનું ભાડું ચૂકવ્યું	5,000
જુલાઈ 31	અંગત વપરાશ માટે ઉપાડ્યા	3,500

9. નીચે શ્રી રણભીર સિંગના ઓગાષ મહિનાના વ્યવહારો આપેલા છે. તેની આમનોંધ તૈયાર કરો.

2012

ઓગષ. 1	રોકડથી ધંધો શરૂ કર્યો	2,80,000
ઓગષ. 1	બેંકમાં રોકડા ચૂકવ્યા	50,000
ઓગષ. 1	રોકડથી સ્ટેશનરી લાવ્યા	300
ઓગષ. 2	રોકડથી માલ ખરીદ્યો	20,000
ઓગષ. 3	ટપાલ ટ્રિકિટ ખરીદી	100
ઓગષ. 5	રોકડથી માલ વેચ્યો	7,500
ઓગષ. 6	ભાગ્ય ફર્નિચર્સ પાસેથી ઓફિસ ફર્નિચરની ખરીદી કરી	25,000
ઓગષ. 11	ભાટિયા ટ્રેડરને માલ વેચ્યો	10,000
ઓગષ. 12	ભાટિયા ટ્રેડર્સ પાસેથી ચેક મળ્યો	10,000
ઓગષ. 14	ભાગ્ય ફર્નિચર્સને ચૂકવ્યા	24,500
ઓગષ. 16	શ્રી ભરત ભાટિયાને માલ વેચ્યો	50,000
ઓગષ. 20	શેઠ એન્ડ બ્રાધર્સ પાસેથી માલ ખરીદ્યો	27,000
ઓગષ. 23	રામનારાયણ એન્ડ કુ. પાસેથી રોકડથી માલ ખરીદ્યો	22,500
ઓગષ. 24	પ્રકાશ ઈલેક્ટ્રોનિક સ્ટોરને માલ વેચ્યો	3,500

આમ નોંધ

ઓગષ. 26	ભાટિયા ટ્રેડર્સ બાકી ખાતામાં ચૂકવ્યા	8,000
ઓગષ. 28	શેઠ એન્ડ બ્રાથર્સ ચેકથી ચૂકતેના હિસાબે ચૂકવ્યા	25,000
ઓગષ. 31	ઓફિસ સ્ટાફને પગાર ચૂકવ્યો	25,000
ઓગષ. 31	દુકાનનું ભાડું ચૂકવ્યું	5,000

10. ૧લી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ શીતલ કિશ્ચિયન ધંધો શરૂ કરે છે. તે મહિનાના વ્યવહારો નીચે મુજબ તેની આમનોંધ તૈયાર કરો.

2012

જાન્યુ. 1	રોકડ મૂડી લાવી ધંધો શરૂ કર્યો	2,50,000
જાન્યુ. 2	બેંકમાં ચૂકવ્યા	35,000
જાન્યુ. 3	પ્રવિષા ચૌહાણ પાસેથી માલ ખરીદો	54,000
જાન્યુ. 3	રાજેશ મકવાણાને માલ વેચ્યો	48,000
જાન્યુ. 7	રામચંદ્ર શાહ પાસેથી માલ ખરીદો	16,450
જાન્યુ. 8	રોકડમાં પગાર ચૂકવ્યો	8,000
જાન્યુ. 8	મનીષ ગાંધીને માલ વેચ્યો	15,000
જાન્યુ. 10	રાજેશ મકવાણા પાસેથી ચેક મળ્યો	47,800
જાન્યુ. 10	બેંકમાં ચૂકવ્યા	10,000
જાન્યુ. 11	રમેશને ચૂકવ્યા	7,000
જાન્યુ. 12	ભાડું ચૂકવ્યું	4,000
જાન્યુ. 13	શાહ એન્ડ શાહ પાસેથી ખરીદી કરી	17,400
જાન્યુ. 15	વીજળી બિલ ચૂકવ્યું	2,800



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

- 6.1 I.**
- i. બધા જ વ્યવહારો સમયનાકમમાં લખાય છે.
 - ii. આમનોંધમાં કરેલ નોંધનું વર્ણન
 - iii. ખાતાવહીમાં આમનોંધની સામે ખાતાનો પાના નંબર લખવામાં આવે છે
- II.**
- i. આમનોંધના ચોપડામાં બધા વ્યવહાર નોંધવામાં આવે છે.
 - ii. આમનોંધનો ચોપડો રોજમેળ તરીકે પણ જાણીતો છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

આમ નોંધ

iii. નાના ધંધાદારીઓ એક જ આમનોંધનો ચોપડો લખે છે જ્યારે મોટા ધંધાદારીઓ
અલગ અલગ ખાસ આમનોંધના ચોપડા રાખે છે.

- 6.2**
- i. ખરીદી-ખર્ચ- બેંક- મિલકત
 - ii. પગાર - ખર્ચ - રોકડ - મિલકત
 - iii. રોકડ - મિલકત - અપૂર્વ - મિલકત
 - iv. માયા - મિલકત - વેચાડા - ઉપજ
 - v. ઉપાડ - મૂરી - રોકડ - મિલકત

- 6.3** i) a, ii) c, iii) b, iv) c, v) b.

તમારા માટે પ્રવૃત્તિ :-

તમારી નજીકની હુકાનની દસ પ્રવૃત્તિનું અવલોકન કરો જેને ધંધાકીય વ્યવહાર ગણી
શકાય. આ વ્યવહારોને આમનોંધના ચોપડા મુજબ લખો...



રોકડમેળ

અગાઉના પ્રકરણમાં તમે જાણી ગયા છો કે ધ્યાકીય લેવડ ડેવડની નોંધ આમનોંધ માં થાય છે. એક લઘુ ઉદ્યોગ કે જેમાં ધ્યાકીય લેવડ-ડેવડ બહુજ ઓછી હોય છે જેથી તેમાં આમનોંધનું કામ ખૂબજ સરળ થઈ જાય છે. જેમ - જેમ ધ્યાનનો વ્યાપ વધતો જાય છે. ધ્યાકીય લેવડ-ડેવડમાં પણ વધારો થાય છે અને કંટાળાજનક બને છે. તેને અલગ-અલગ ચોપડામાં વહેંચવાની આવશ્યકતા ઉભી થઈ. આ ચોપડાઓ લેવડ ડેવડને અનુરૂપ જેવાં કે રોકડમેળ - રોકડ વ્યવહારો માટે, વેચાળ નોંધ માલના ઉધાર વેચાણની નોંધ - ઉધાર ખરીદીની નોંધ માટે અવાજ અન્ય સ્વરૂપના ચોપડાઓ હોય છે. આ પ્રકરણમાં તમે રોકડમેળનો અર્થ અને તે તૈયાર કરવા અંગે અભ્યાસ કરીશું.



હેતુઓ :-

આ પ્રકરણનો અભ્યાસ કર્યા પછી તમે

- રોકડમેળનો ખર્ચ જાણી શકશો.
- રોકડ મેળના અર્થ સમજ શકશો.
- સાદા રોકડ મેળનો અર્થ જાણી તે તૈયાર કરી શકશો.
- બંંખ ખાના વાળો રોકડમેળનો અર્થ સમજ તે તૈયાર કરી શકશો.

૭.૧ રોકડમેળનો અર્થ :

માનીલો કે તમને તમારા નિયોજક પાસેથી તમારો પ્રથમ પગાર રોકડના સ્વરૂપે મળે છે. આના સિસિવાય વધારાની રોકડ મળે છે કે જે તમે તમારા ભિત્રોને ઉધાર આપ્યા હતા. તમે રોકડનો ઉપયોગ તમે મોબાઇલ ફોન ખરીદ્યા, કપડાં ખરીદ્યા અને ભિત્રો સાથે ફિલ્મ જોવા માટે કર્યો. તમે તમારા પિતરાઈ માટે થોડાક રમકડાં ખરીદ્યા, તમારી વાત આદત પ્રમાણે તમે બધીજ આવક અને ખર્ચની નોંધ ડાયરીમાં કરી. તમે મહિનાના અંતમાં ડાયરીમાં વધેલ રોકડની તુલના તમારી પાસે વધેલ રોકડ સાથે કરવા હિસ્થો છો? તમે આવક અને જાવકની અલગ-અલગ નોંધ રાખો છો. આમ રોકડ લેવડ ડેવડની નોંધ જે ચોપડામાં રાખવામાં આવે છે તેને રોકડમેળ કહે છે.



રોકડમેળ નામાનો એવો ચોપડો છે કે જેમાં રોકડની આવક અને ચોપડો છે. ખાતાવહી માં પણ રોકડ ખાતુ અને બંંખાતુ બનાવવામાં આવતું નથી. કારણ કે રોકડમેળ એ રોકડખાતું અને બંંખાતાનું કામ કરે છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

રોકડમેળ

૭.૨ રોકડમેળ : પ્રકાર અને

રોકડ મેળના પ્રકારો નીચે મુજબ છે.

- સાદો રોકડમેળ
- બંકખાતાવાળો રોકડમેળ
- પેટા રોકડ મેળ :-

ફક્ત રોકડ આવક અને રોકડ જાવકની નોંધ આમાં થાય છે. તેમાં બે બાજુ છે ઉધાર અને જમા. રોકડ આવકની નોંધ ઉધારબાજુ ડાબા બાથ બાજુ અને જમા રકમનું એકજ ખાનું હોય છે. સાધ રોકડમેળનો નમૂનો નીચે મુજબ છે.

સાદા રોકડમેળનો નમૂનો

ઉધાર

જમા

આવક					જાવક				
તારીખ	વિગત	વા.નં	ખા.પા.નં	રકમ રૂ	તારીખ	વિગત	વા.નં	ખા.પા	રકમ રૂ.

ખાતાની સમજૂતિ :

તારીખ :-

આ ખાનામાં વ્યવહારનું વર્ષ માટેનો અને તારીખ કમ પ્રમાણે લખવામાં આવે છે.

વિગત :-

આ ખાનામાં કયા ખાતે રોકડ મળી અને કયા ખાતામાંથી નાણાં ચૂકવ્યા તેનું નામ લખવામાં આવે છે રોકડ આવકને લગતા ખાતાની નોંધ ઉધારબાજુ અને રોકડ જાવકને લગતા ખાતાની નોંધ જમાબાજુ કરવામાં આવે છે.

વાઉચર નંબર :-

કોઈપણ વ્યવહાર ને પ્રમાણિત કરનાર પત્ર એટલે વાઉચર સામાન્ય રીતે વાઉચરને નંબર આપેલા હોય છે જે આ ખાનામાં લખવામાં આવે છે.

ખાતાવઢી પાના નંબર :-

રોકડમેળ

આ ખાનામાં ખાતાવહી ના જે પાના નંબર ખતવણી કરવામાં આવે છે તે નંબર લખવામાં આવે છે.

રકમ :-

ઉધાર બાજુના રકમના ખાનામાં મળેલ રકમ અને જમા બાજુના રકમના ખાનામાં ચૂકવેલ રકમ લખવામાં આવે છે.

સાદો રોકડમેળ તૈયાર કરવાના પગથિયાં :-

૧. ઉધારબાજુના વિગતના ખાનામાં જેની પાસેથી રોકડ મળી છે તે ખાતાનું નામ લખાય છે.
૨. જમાબાજુના વિગતના ખાનામાં જેને રોકડ ચૂકવી હોય તે ખાતાનું નામ લખાય છે.
૩. ઉધાર બાજુના રકમના ખાનામાં મળેલ રોકડની નોંધ થાય છે. અને જમાબાજુના રકમના ખાનામાં ચૂકવેલ રોકડની નોંધ થાય છે.
૪. સમયગાળો પૂર્ણ થતાં રોકડમેળની ઉધારબાજુ નો સરવાળો અને જમાબાજુના સરવાળાની સરખામણી કરવામાં આવે છે અને જો કોઈ તફાવત હોય તો તેને જમા બાજુના રકમના ખાનામાં લખવામાં આવે છે. તેમજ વિગતમાં બાકી આગળ લઈ ગયા લખવામાં આવે છે.
૫. સામાન્યરીતે સાદા રોકડમેળમાં ઉધારબાજુનો રકમનો સરવાળો જમાબાજુના રકમ કરતા વધુ હોય છે, કારણ કે મળેલ રોકડ કરતાં વધુની ચૂકવણી કરી શકતી નથી તફાવત ની રકમને રકમના ખાનામાં લખવામાં આવશે જેથી બંને બાજુનો સરવાળો સરખો થાય છે.
૬. જમાબાજુની અંતિમ બાકી રકમ પદ્ધીના સમયગાળા માટેની શરૂની બાકી ગણાશે અને તેને રોકડ મેળની ઉધાર બાજુ આગળ ના સમય માટે બાકી આગળ લાવ્યા તરીકે લખાશે.

ઉદાહરણ : ૧

મં. અશોક ડ્રેસર્સ ના નીચેના વ્યવહારોની રોકડમેળમાં નોંધ કરો.

તારીખ	વિગત	રકમ (રૂ.)
૨૦૧૧		
ડિસેમ્બર ૦૧	હાથ પર રોકડ	૩૦,૦૦૦
કૃષ્ણ. ૦૫	તનવી પાસેથી મળેલ રોકડ	૧૨,૦૦૦
ડિસે. ૦૮	વીમાનું પ્રીમીયમ ચૂકવ્યું	૨,૪૦૦
ડિસે. ૧૦	રોકડથી ફર્નિચર ખરીદ્યું	૭,૦૦૦
ડિસે. ૧૪	રોકડથી સામાન વેચ્યો	૧૬,૪૦૦
ડિસે. ૧૮	મિથુન પાસેથી રોકડથી માલ ખરીદ્યો	૨૬,૦૦૦
ડિસે. ૨૨	પશને રોકડ ચૂકવી	૩,૨૦૦
ડિસે. ૨૫	વિનીતને રોકડથી માલ વેચ્યો	૧૮,૭૦૦
ડિસે. ૨૮	બેંકમાં રોકડ જમા કરાવી	૬,૦૦૦
ડિસે. ૩૦	ભાડું ચૂકવ્યું	૪,૦૦૦
ડિસે. ૩૧	પગાર ચૂકવ્યો.	૭,૦૦૦

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડિયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ClassBook

ઉધાર

મેં. અશોક ટ્રડર્સ નો રોકડ મેળ.

જમા.

આવક					જવક				
તારીખ ૨૦૧૧	વિગત	વા. ન.	ખા.પા. ન.	રકમ (રૂ.)	તારીખ ૨૦૧૧	વિગત	વા. ન.	ખા.પા. ન.	રકમ (રૂ.)
૩.સે.૦૧	હાથ પર રોકડ			૩૦,૦૦૦	ડિસે. ૦૮	વીમા ગ્રોભિયમ ખાતે			
ડિસે.૦૫	તનવી			૧૨,૦૦૦	ડિસે. ૧૦	ફર્નિચર ખાતે			૨,૪૦૦
ડિસે.૧૪	વેચાણ ખાતે			૨૬,૪૦૦	ડિસે. ૧૮	ખરીદ ખાતે			૭,૦૦૦
ડિસે.૨૫	વેચાણ ખાતે			૨૮,૭૦૦	ડિસે. ૨૨	ધશ			૨૬,૦૦૦
					ડિસે. ૨૮	બંક ખાતે			૩,૨૦૦
					ડિસે. ૩૦	ખાડા ખાતે			૬,૦૦૦
					ડિસે. ૩૧	પગાર ખાતે			૪,૦૦૦
					ડિસે. ૩૧	બાકી આગળ લઈ ગયા			૭,૦૦૦
				૭૭,૨૦૦					૨૯,૪૦૦
જાન્યુ.૦૧	બા.આ.લાયા			૨૯,૪૦૦					૭૭,૨૦૦

ઉદાહરણ : ૨

મે. સુરેશ એન્ડ કેં.ના નીચેના વ્યવહારોની નોંધ સાદા રોકડમેળ માં કરો.

તારીખ	વિગત	રકમ (રૂ.)
૨૦૧૨		
જાન્યુ.૦૧	હાથ પર રોકડ	૨૨,૦૦૦
જાન્યુ.૦૫	રમેશ પાસેથી મળ્યા. (૨૦૦ રૂ. વટાવ આપ્યો)	૩,૦૦૦
જાન્યુ.૦૭	ભાડું ચૂકવ્યું	૩૦૦
જાન્યુ.૦૮	માલનું વેચાણ	૩,૦૦૦
જાન્યુ.૧૦	સંજયને ચૂકવ્યા	૭,૦૦૦
જાન્યુ.૨૭	ફર્નિચર ખરીદ્યું	૨,૦૦૦
જાન્યુ.૩૧	પગાર ચૂકવ્યો	૧,૦૦૦

ઉધાર

મે. સુરેશ એન્ડ કેં.નો રોકડ મેળ.

જમા

આવક					જવક				
તારીખ ૨૦૧૨	વિગત	વા. ન.	ખા.પા. ન.	રકમ (રૂ.)	તારીખ ૨૦૧૨	વિગત	વા. ન.	ખા.પા. ન.	રકમ (રૂ.)
જાન્યુ.૦૧	બા.આ.લાયા			૨૨,૦૦૦	જાન્યુ.૦૧	ખાડા ખાતે			૩૦૦
જાન્યુ.૦૫	રમેશ			૩,૦૦૦	જાન્યુ.૧૦	સંજય			૭,૦૦૦
જાન્યુ.૦૮	વેચાણ ખાતે			૩,૦૦૦	જાન્યુ.૨૭	ફર્નિચર ખાતે			૨,૦૦૦
					જાન્યુ.૩૧	પગાર ખાતે			૧,૦૦૦
				૨૮,૦૦૦	જાન્યુ.૩૧	બા.આ.લઈ રૂએ			૧૧,૦૦૦
કુષ્ણ.૦૧	બા.આ.લાયા			૧૧,૦૦૦					૨૮,૦૦૦

નોંધ : જાન્યુ.૦૫ ની વટાવની નોંધ રોકડમેળ માં નહિ થાય પરંતુ તેની અલગ યોગ્ય થશે.

રોકડમેળ

ઉદાહરણ ઉ

જીથેના વ્યવહારો ની નોંધ રનવીતના રોકડમેળમાં કરો અને બાકી દર્શાવો.

તારીખ	વિગત	રકમ (રૂ.)
૨૦૧૨		
ઓક્ટો.૦૧	હાથ પર રોકડ	૨૫,૦૦૦
ઓક્ટો.૦૮	.. પાસેથી રોકડથી માલ ખરીદો	૩,૨૦૦
ઓક્ટો.૧૫	.. ને માલ વેચ્યો	૪,૮૦૦
ઓક્ટો.૨૦	કમિશન મળ્યું	૬૪૦
ઓક્ટો.૨૦	કમિશન ચુક્કયું	૫૫૦
ઓક્ટો.૨૮	સુરેશને ડિસાબ પેટે ચુક્કવ્યા	૭,૧૪૦
ઓક્ટો.૩૧	કમચારીને પગાર ૧૦૦૦ રૂ. અને ઓફિસનું ભાડું ૬૦૦ રૂ. ચુક્કયું	

ઉધાર રનવીત નો રોક મેળ જમા.

આવક					જવાબ				
તારીખ ૨૦૧૨	વિગત	વા. નં.	ખા.પા. નં.	રકમ (રૂ.)	તારીખ ૨૦૧૨	વિગત	વા. નં.	ખા.પા. નં.	રકમ (રૂ.)
ઓક. ૧	બા.આ.લાયા			૨૫,૦૦૦	ઓક. ૮	ખરીદખાતે			૩,૨૦૦
ઓક. ૨૦	કમિશન ખાતે			૬૪૦	ઓક. ૨૦	કમિશન ખાતે			૫૫૦
					ઓક. ૨૮	સુરેશ			૭,૧૪૦
					ઓક. ૩૧	પગાર ખાતે			૧,૦૦૦
					ઓક. ૩૧	ઓફિસ ભાડા ખાતે			૬૦૦
					ઓક. ૩૧	બા.આ.લઈ ગયા.			૭૩,૭૪૦
નાં. ૧	બા.આ.લાયા			૭૩,૭૪૦					૭૪,૬૫૦

નોંધ : ૧૫ ઓક્ટોબરના વ્યવહારની નોંધ રોકડમેળમાં કરેલ નથી કારણ કે તે ઉધાર વ્યવહાર છે.



પાઠ સ્વાધ્યાય ૭.૧

ખાલી જગ્યા પૂરો.

- સાદા રોકડમેળમાં ફક્ત રોકડ તથા રોકડ લખવામાં આવે છે.
- સાદા રોકડમેળમાં બધા ઉધારબાજુ અને બધા જમા બાજુ લખાય છે.
- સાદા રોકડમેળમાં બાજુનો સરવાળો સામાન્ય રીતે બાજુના સરવાળા કરતાં વધુ હોય છે.
- રોકડ મેળની અંતિમ બાકી આગળના સમયની બને છે.

મોડચુલ - ૨
આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

રોકડમેળ રોકડમેળ

ઉદાહરણ : ૪

નીચે આપેલી વિગતો પરથી કુલદીપનો એપ્રિલ ૨૦૧૨નો રોકડમેળ તૈયાર કરો.

તારીખ	વિગત	રકમ (રૂ.)
૨૦૧૨		
એપ્રિલ.૦૧	હાથ પર રોકડ	૨૭,૬૦૦
એપ્રિલ.૦૩	સંતોષ પાસેથી રોકડથી માલ ખરીદો	૭,૪૦૦
એપ્રિલ.૦૬	રોહિતને માલ વેચ્યો	૬,૦૦૦
એપ્રિલ.૧૦	વેતન રોકડથી ચૂકવ્યું	૫૦૦
એપ્રિલ.૧૫	નવીનને રોકડ ચૂકવ્યા	૩,૪૦૦
એપ્રિલ.૧૭	રોકડ વેચાણ	૧૦,૦૦૦
એપ્રિલ.૧૮	કમિશન ચૂકવ્યું	૬૦૦
એપ્રિલ.૨૧	તન્યા પાસેથી રોકડ મળ્યા	૧,૪૦૦
એપ્રિલ.૨૫	ફર્નિચર રોકડથી ખરીદું	૧,૭૦૦
એપ્રિલ.૨૮	ભાડું ચૂકવ્યું	૩,૦૦૦
એપ્રિલ.૩૦	વીજળી બીલ રોકડથી ચૂકવ્યું	૧,૩૦૦

ઉધાર					કુલદીપનો રોકડમેળ					જમા
આવક					જવાબ					
તારીખ ૨૦૧૨	વિગત	વા. ન.	ખા.પા. ન.	રકમ (રૂ.)	તારીખ ૨૦૧૨	વિગત	વા. ન.	ખા.પા. ન.	રકમ (રૂ.)	
એપ્ર. ૧	બા.આ.લાવ્યા			૨૭,૬૦૦	એપ્ર. ૦૩	ખરીદ ખાતે			૭,૪૦૦	
એપ્ર. ૧૭	વેચાણ ખાતે			૧૦,૦૦૦	એપ્ર. ૧૦	વેતન ખાતે			૫૦૦	
એપ્ર. ૨૧	તન્યા			૭,૪૦૦	એપ્ર. ૧૫	નવીન			૩,૪૦૦	
					એપ્ર. ૧૮	કમિશનખાતે			૬૦૦	
					એપ્ર. ૨૫	ફર્નિચરખાતે			૧,૭૦૦	
					એપ્ર. ૨૮	ભાડા ખાતે			૩,૦૦૦	
					એપ્ર. ૩૦	વીજળી બીલ ખાતે			૧,૩૦૦	
					એપ્ર. ૩૦	વા.આ.લઈ ગયા			૧૦,૮૦૦	
એપ્રિલ ૦૧	બા.આ.લાવ્યા			૨૮,૯૦૦					૨૮,૯૦૦	
				૧૦,૮૦૦						

નોંધ : ઉધાર વ્યવહારોની નોંધ રોકમેળમાં કરેલ નથી (દા.ત. એપ્રિલ ૬, ૨૦૧૨ના રોજ રોહિતને રૂ. ૬૦૦૦નું વેચાણ ઉધાર કરેલ છે.)

ઉદાહરણ : ૫

૧ એપ્રિલ ૨૦૧૨ના રોજ નરેશો ૨૦૦૦૦ રૂ. થી કંધો શરૂ કર્યો તેમાંથી ૧૫૦૦૦ રૂ. તેના બેંક ખાતામાં જમા કરાવ્યા અઠવાટિયા દરમિયાનના તેના રોકડના વ્યવહારો નીચે પ્રમાણે છે.

તારીખ	વિગત	રકમ
૨૦૧૨		(રૂ.)
એપ્રિલ.૦૧	રોકડથી સ્ટેશનરી ખરીદી	૫૦૦
એપ્રિલ.૦૧	રોકડથી માલ ખરીદો	૨,૪૦૦

રોકડમેળ

એપ્રિલ.૦૨	રોકડ વેચાણ	9,400
એપ્રિલ.૦૩	શિવ પાસેથી રોકડ ખરીદો	9,000
એપ્રિલ.૦૪	રામને ચૂકવ્યા	2,200
એપ્રિલ.૦૫	જીહેરાત ના ચૂકવ્યા	800
એપ્રિલ.૦૬	રોકડ વેચાણ	9,100
એપ્રિલ.૦૮	જૂની મશીનરી ખરીદી	100

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ઉધાર

નરેશનો રોકડમેળ

જમા

આવક					જાવક				
તારીખ ૨૦૧૨	વિગત	ખા ન.	ખા.પા ન.	રકમ (રૂ)	તારીખ ૨૦૧૨	વિગત	ખા ન.	ખા.પા ન.	રકમ (રૂ)
એપ્રિ. ૦૧	મૂડિયાતે			20,000	એપ્રિ. ૦૧	બંક ખાતે			14,000
એપ્રિ. ૦૨	વેચાણ ખાતે			9,400	એપ્રિ. ૦૧	સ્ટેશનરી ખાતે			900
એપ્રિ. ૦૩	શિવ			9,000	એપ્રિ. ૦૧	ખરીદયાતે			2,400
એપ્રિ. ૦૬	વેચાણ ખાતે			9,100	એપ્રિ. ૦૪	રામ			2,200
					એપ્રિ. ૦૪	જીહેરાત			800
				24,300	એપ્રિ. ૦૬	મશીનરી ખાતે			100
				3,300	એપ્રિ. ૦૬	બા.આ.ઈ.ગયા			3,300
એપ્રિ. ૦૭	બા.આ.વાયા								24,300



પાઠ સ્વાધ્યાય ૭.૨

વૈકલ્પિક પ્રશ્નો.

(૧) સાદો રોકડમેળ સામાન્ય રીતે દરશાવે છે.

૧. ઉધાર અથવા જમા બાકી

૨. જમા બાકી

૩. ઉધાર બાકી

૪. બંને બાકી

(૨) રોકડ મેળ છે.

૧. પેટા નોંધ ૨. પેટા નોંધ અને ખાતું

૩. ફક્ત ખાતું ૪. આમાંથી એકપણ નહીં.

(૩) રોકડ વેચાણની નોંધ થાય.

૧. વેચાણ નોંધ ૨. રોકડ મેળ

૩. આમ નોંધ ૪. આમાંથી એકપણ નહિં.

(૪) રોકડમેળમાં લખાય છે.

૧. બધીજ રોકડ આવક અને જાવક

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

રોકડમેળ

૨. માલનું રોકડ અને ઉધાર વેચાણ.
 ૩. ફક્ત રોકડ જાવક
 ૪. આમાંથી એકપણ નહીં.
 - (૫) રોકડમેળની બાકી હોય છે.
૧. ખર્ચ ૨. નફો ૩. મિલકત ૪. જવાબદારી
- (૬) જો સોનું એ રોકડથી માલ વેચ્યો તો તેની નોંધ માં કરવામાં આવે છે.
૧. રોકડમેળમાં ૨. વેચાણ નોંધમાં ૩. યોગ્યનોંધમાં ૪. આમાંથી એકપણ નહીં.
- (૭) રોકડમેળ હિસ્સો છે.
૧. આમનોંધ ૨. ખાતાવાહી ૩. આમનોંધ અનેખાતા વાહ

ક્રમ.	વ્યવહાર	ઉધારબાજુ	જમાબાજુ
૧.	મુકેશો રોકડ લાવી ધંધો શરૂ કર્યો		
૨.	માલની રોકડથી ખરીદી		
૩.	માલનું રોકડ વેચાણ		
૪.	અંતિમ રોકડ બાકી		
૫.	અંકુર પાસેથી રોકડ મળી		

બેંક ખાનાવાળો રોકડમેળ :-

જ્યારે કોઈ સંસ્થામાં બેંક વ્યવહારો વધુ હોય છે ત્યારે આ વ્યવહારોની નોંધ અલગ ચોપડામાં કરવાની આવશ્યકતા ઉભી થાય છે. એક અલગ એક અલગ ચોપડો બનાવવાની જગ્યાએ સાદા રોકડમેળની બંને બાજુ એક વધુ ખાનું બેંકના બેંકના નામથી બનાવવામાં આવે છે. આ પ્રકારના ચોપડાને બેંક ખાના વાળો રોકડમેળ કહેવામાં આવે છે. બેંકની બધી આવક ઉધારબાજુના બેંકખાનામાં અને બેંક ખાનામાં અને બેંકની બધી જાવક જમા બાજુના બેંક ખાનામાં નોંધાય છે. બેંકખાનાવાળા રોકડમેળનો નમૂનો નીચે મુજબ છે.

ઉધાર

બેંકખાનાવાળા રોકડમેળનો નમૂનો

જમા.

આવક					જવાબ				
તારીખ	વિગત	ખા.પા	રોકડ	બેંક	તારીખ	વિગત	ખા.પા	રોકડ	બેંક
		ન.	(૩)	(૩)			ન.	(૩)	(૩)



નોંધ

નામાના મૂળતત્વોની :

- (૧) રોકડ અથવા ચેક દ્વારા ચુકવણી : ચેક દ્વારા ચુકવણીને બેંકના ખાનામાં લખવી. અને રોકડથી કરેલ ચુકવણીને રોકડમેળની જમા બાજુ રોકડના ખાનામાં લખવી.
- (૨) રોકડ અથવા ચેક મેળવો : મળેલ ચેકની નોંધ બેંકના ખાનામાં કરવી અને જો રોકડ મળેલ હોયતો તેની નોંધ ઉધાર બાજુ રોકડના ખાનામાં કરવી.
- (૩) બેંકમાંથી રોકડ ઉપાડી :- અહીં બે ખાતા અસર પામે છે. પહેલું એ કે જેમાં બેંકમાં રોકડ ઓછી થશે અને બીજું હાથ પરની રોકડ વધશે. તે પહેલાં ઉધાર બાજુ રોકડના ખાનામાં નોંધાશે ત્યારબાદ રોકડમેળની જમાબાજુ બેંકનાખાનામાં નોંધાશે. આવું એટલા માટે છે કે અહિંયા બંને ખાતાને અસર થાય છે, રોકડ મેળનું રોકડખાતું અને બેંકખાતું, દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે એકખાતું ઉધાર થશે અને બીજું ખાતું જમા થશે. હાથ પરની રોકડ વધશે, અને બેંકની રોકડ ઘટશે. તેથી જમાબાજુના વિગતના ખાનામાં રોકડખાતે લખી અને રકમ ખાનામાં નોંધાશે. અને ઉધારબાજુ વિગતના ખાનામાં બેંક ખાતે લખી અને રકમ રોકડખાનામાં નોંધાશે. આને જમા ખર્ચી મેળ કહેવાય છે. રોકડમેળના બંને બાજુના ખાનામાં એક વખત રોકડના ખાનામાં અને એક વખત બેંકના ખાનામાં નોંધ થશે અને બંને બાજુ ખાતાવાહી પાના નંબરના ખાનામાં “ દશાવિવામાં આવશે.
- (૪) રોકડ બેંકમાં જમા કરાવી :- ઉપર જણાવ્યા પ્રમાણે આની પણ જમા ખર્ચી મેળ પ્રમાણે નોંધ થશે. અહિંયા પણ બે ખાતા સંકળાયેલા છે. રોકડખાતું અને બેંકખાતું સૌ પ્રથમ રોકડમેળમાં બંને ખાતા છે. બેંકમાં રોકડ વધશે. એટલે તેની નોંધ ઉપર બાજુ વિગતના ખાનામાં રોકડ ખાતે લખી બેંકના ખાનામાં રકમ લખવી હાથ પરની રોકડ ઘટશે જેથી જમા બાજુ વિગતનાં ખાનામાં બેંક ખાતે લખી રોકડના ખાનામાં રકમ લખવી, આ એક જમા - ખર્ચ મેળ છે. આથી બંને બાજુ ખાતાવાહી પાના નંબરના ખાનામાં “ લખાશે.
- (૫) ચેક નકારાયો :- (ક) જો કોઈપણ ચેક બેંકમાં રજૂ કરવામાં આવે અને તે નકારાય તો તે બેંક દ્વારા પરત કરવામાં આવે છે. અને તે રકમ જમાબાજુ બેંકના ખાનામાં લખાશે. વિગતના ખાનામાં જેની પાસેથી ચેક મળેલ છે તે પેઢી નું નામ લખવામાં આવે છે. (ખ) જો કોઈ ચેક પેઢી દ્વારા તેના લેખણારને આપવામાં આવેલ હોય અને તે નકારાય અને લેખણારને આપવામાં આવેલ હોય અને તે નકારાય અને લેખણાર દ્વારા પરત કરવામાં આવે ત્યારે ‘ઉધારબાજુ’ બેંકના ખાનામાં લખાશે અને વિગતના ખાનામાં લેખણારનું નામ લખવામાં આવશે.
- (૬) બેંક ચાર્ટસ :- બેંક તેની અમુક સેવાઓ માટે અમુ રકમ વસુલે તેને બેંક ચાર્ટસ કહેવામાં આવે છે. દર છ મહિને બેંક દ્વારા અમુક રકમ વસુલવામાં આવે છે. આ રકમની નોંધ જમાબાજુ બેંકના

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

રોકડમેળથી Dash Bo

ખાનામાં કરાય છે. કારણ કે બેંક માં રોકડ ઘટશે વિગતના ખાનામાં બેંક ચાર્જ્સ ખાતે લખાશે.

(૭) મળેલ પરંતુ બેંકમાં રજૂ નહિ કરેલ ચેક :-

આ પ્રકારના ચેકને કોસ કરી અને તેને લોકરમાં રાખવા જોઈએ અને બીજા દિવસે બેંકમાં ભરવા જોઈએ જો કે આ ચેક કોસ કરેલ હોવાથી તેનો હુરૂપયોગ થવાની શંકા નહિવત છે આ એક સારી પદ્ધતિ છે. તેમ છતાં આ ચેકને રોકડ તરીકે ગણી અને તેને એ જ દિવસે જે દિવસે ચેક મળેલ છે તેમ ગણી રોકડના ખાનામાં લખવામાં આવે છે જેનાથી હાથ પર રોકડ વધશે. જે ખરેખર હાથ પરની રોકડમાં તફાવત દર્શાવશે. જે યોગ્ય નથી. તથું ઉપરાંત બીજા દિવસે તેને જેનાથી કામમાં બિનજરૂરી વધારો થાય. તેથી પ્રથમ પ્રયત્ન જ યોગ્ય ગણાય.

(૮) ચેકને શેરો કરવો :-

જો કોઈ મળેલ ચેકનો શેરો કરવાનો હોય તો તેને બેંકખાતામાં જમા કરાવવામાં આવશે નહિ પરંતુ તેને ઉધાર બાજુ રોકડના ખાનામાં લખાશે.

(૯) રોકડમેળની બાકી :-

રોકડખાના અને બેંક ખાનાની બાકી કાઢવામાં આવશે.

(ક) સામાન્ય રીતે રોકડમેળની “ઉધાર બાજુ” ના રોકડખાનાનો સરવાળો જમા બાજુ કરતાં વધુ હોય છે. પહેલા તેનો સરવાળો કરવો જોઈએ અને એટલીજ રકમ જમા બાજુના રોકડખાનામાં લખવી. તફાવતની બાકી નીકળતી રકમ જમા બાજુ સરવાળાની ઉપર “બાકી આગળ લઈ જાય” કરીને લખાશે. આ બાકીને આગળની તારીખે લઈ જવાશે અને ઉધાર બાજુ “બાકી આગળ લાવ્યા” તરીકે લખાશે.

(ખ) બેંકના ખાનામાં કોઈપણ બાજુનો સરવાળો વધુ હોઈ શકે છે. જો બેંકખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો એનો અર્થ એ છે કે બેંકમાં બાકી છે. બાકીની વિગત એવીજ રીતે મેળવીશું જેવી રીતે રોકડખાનામાં કરી છે.

જો બેંક ખાનાના જમાબાજુનો સરવાળો વધુ હોય, તો તેનો અર્થ એ થયો કે બેંક પાસેથી ઓવરડ્રાફ લિધો છે. આ સ્થિતિમાં પહેલા જમાબાજુના બેંકખાતાનો સરવાળો કરવો. પછી તેજ સરવાળો ઉધાર બાજુ બેંકખાતામાં લખવો. આ બંને એક બીજાની સામે લખવા. બાકીની ગણતરી જમા બાજુના સરવાળાથી ઉધારબાજુનો સરવાળો ઓછો ગણીને કરાશે. આ બાકી પછીની તારીખમાં જમા બાજુ વિગતના ખાનામાં બાકી આગળ લાવ્યા તરીકે લખાશે.

રોકડમેળ

ઉદાહરણ : ૬

જૂન મહિનાના નીચેના વ્યવહારોની નોંધ રતનના બેંકખાનાવાળા રોકડમેળમાં કરો.

તારીખ	વિગત	રકમ
૨૦૧૨		(૩)
જૂન ૧	બાકી આગળ લાવ્યા (રોકડ બાકી)	૧૨,૦૦૦
જૂન ૧	બેંકની બાકી	૧,૮૦,૦૦૦
જૂન ૨	ચેક દ્વારા માલની ખરીદી	૧૪,૦૦૦
જૂન ૪	રોકડથી માલની ખરીદી	૮,૦૦૦
જૂન ૫	રોકડ વેચાણ	૨૮,૦૦૦
જૂન ૮	ચેકથી માલનું વેચાણ	૧૦,૦૦૦
જૂન ૮	વેતન રોકડ ચૂકવ્યું	૪૦૦
જૂન ૧૫	ચેકથી પગાર ચૂકવ્યો	૮,૦૦૦
જૂન ૨૦	બેંકમાં રોકડ ભર્યો	૨૦,૦૦૦
જૂન ૨૧	ચેકથી સ્ટેશનરી ખર્ચ ચૂકવ્યો	૧,૨૦૦
જૂન ૨૧	નરેશને ચેકથી ચૂકવ્યા	૧,૨૮૦
જૂન ૨૨	રોકડ ખરીદી	૮,૦૦૦
જૂન ૨૩	ગોપાલ પાસેથી મળેલ ચેક બેંકમાં ભર્યો	૧,૮૮૦
જૂન ૨૪	બેંકમાંથી રોકડ ઉપાડ્યા.	૩૪,૦૦૦
જૂન ૨૬	અંગત વપરાશ માટે રોકડ લીધા.	૪,૦૦૦
જૂન ૨૮	ચેકથી ખરીદી	૮,૪૦૦
જૂન ૨૯	રોહન પાસેથી મળેલ ચેક.	૪,૫૦૦
જૂન ૩૦	મહિનાનું ભર્યું ચેકથી ચૂકવ્યું	૧,૨૦૦

મોડચુલ - ૨
આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

રોકડમેળ

ઉધાર

રતનનો રોકડમેળ

જમા.

આવક					જાવક				
તારીખ ૨૦૧૨	વિગત	ખા.પા. નં	રોકડ (રૂ)	બેંક (રૂ)	તારીખ ૨૦૧૨	વિગત	ખા.પા. નં	રોકડ (રૂ)	બેંક (રૂ)
જૂન૧	બા.આ.લાલ્યા		૧૨,૦૦૦	૧,૮૦,૦૦૦	જૂન૨	ખરોદ ખાતે		---	૧૪,૦૦૦
જૂન૫	વેચાણ ખાતે		૨૮,૦૦૦		જૂન૪	ખરોદ ખાતે		૮,૦૦૦	
જૂન૮	વેચાણ ખાતે			૧૦,૦૦૦	જૂન૮	વેતન ખાતે		૪૦૦	
જૂન૨૦	રોકડ ખાતે	(સી)		૨૦,૦૦૦	જૂન૧૫	પગાર ખાતે			૮,૦૦૦
જૂન૨૩	ગોપાલ			૧,૮૮૦	જૂન૨૦	બેંક ખાતે	(સી)	૨૦,૦૦૦	
જૂન૨૪	બેંક ખાતે	(સી)	૩૪,૦૦૦	૪,૫૦૦	જૂન૨૧	સ્ટેશનરી ખાતે			૧,૨૦૦
જૂન૨૮	સોધન				જૂન૨૨	નરેશ			૧,૨૮૦
			૭૫,૦૦૦	૨૧૬,૪૮૦	જૂન૨૨	ખરોદખાતે		૮,૦૦૦	
			૩૪,૬૦૦	૧૪૫,૩૦૦	જૂન૨૪	રોકડ ખાતે	(સી)		૩૪,૦૦૦
					જૂન૨૬	ઉપાડ ખાતે		૪,૦૦૦	
					જૂન૨૮	ખરોદ ખાતે			૮,૪૦૦
					જૂન૩૦	ભાડા ખાતે			૧,૨૦૦
					જૂન૩૦	બા.આ.લઈ ગયા.			
								૩૪,૬૦૦૧	૪૪,૩૦૦
								૭૫,૦૦૦૨	૧૬,૪૮૦

૭.૪ પેટા રોકડ મેળ :-

જે ધંધાકીય એકમો બેંકખાતા વાળો રોકડમેળ બનાવે છે તેવા એકમો નાના-નાના ખર્ચની નોંધો રાખવા માટે એક અલગ રોકડમેળની જરૂરિયાત ધરાવે છે. મોટી સંખ્યામાં વારંવાર નાના-નાના ખર્ચાઓ જેવા કે પ્રવાસ ખર્ચ, ભાડું, પોસ્ટ ખર્ચ, તારખર્ચ, કુરિયર તેમજ અન્ય ખર્ચાઓ કરવામાં આવે છે. આવા એકમો મુખ્ય કેશિયર ના સહાયકની નિમણુંકુર કરે છે. આ નિમાયેલ સહાયક ને પેટા કેશિયર કહેવાય છે.

તે આ ખર્ચાઓની ચૂકવણી કરે છે. તેમજ આ લેવડ-ફેવડની નોંધ માટે એક અલગ રોકડમેળ તૈયાર કરે છે. આ રોકડમેળ ને પેટા રોકડમેળ કહેવાય છે.

પેટા રોકડમેળ સામાન્ય રીતે એક અંગ્રેઝ આધાર પર બનાવવામાં આવે છે. જેમાં શરૂઆતમાં જ એક ચોક્કસ રકમ પેટાકેશિયરને આપવામાં આવે છે. તે આ રોકડ રકમમાંથી જ નાના - નાના ખર્ચાઓ કરે છે. જ્યારે તે બધીજ રકમ ખર્ચ કરી નાખે છે. ત્યારે ખર્ચના વાઉચર મુખ્ય કેશિયરને સાંપી દે છે તેમજ મુખ્ય કેશિયર, પેટા કેશિયરને ખર્ચ કરેલ રકમ જેટલી જ રકમ તેને ચૂકવી દે છે.

રોકડમેળ

તારીખ	વિગત	રકમ (રૂ)	મુસાફરી ખર્ચ (રૂ)	ભાડું (રૂ)	ટપાલખર્ચ (રૂ)	તાર (રૂ)	નાસ્તા ખર્ચ (રૂ)	કુરીયરખર્ચ (રૂ)	કુલ (રૂ)

ઉદાહરણ : ૭

તારીખ ૧-૧-૨૦૧૨ના રોજ મુખ્ય કેશિયરે ૪૦૦ રૂ. પેટા કેશિયર ને આપ્યા પેટા કેશિયરે નીચે મુજબ ખર્ચ કર્યો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



તારીખ વિગત

૨૦૧૨

જાન્યુ ૧	મુસાફરી ખર્ચ ચૂકવ્યો	૧૩૦
જાન્યુ ૨	નાસ્તા-પાકી ખર્ચ ચૂકવ્યો	૪૪
જાન્યુ ૩	ટપાલ ટિક્ટિક ખર્ચ ચૂકવ્યો	૪૪
જાન્યુ ૧૫	કુરીયર ખર્ચ ચૂકવ્યો	૩૪
જાન્યુ ૧૭	તાર-ટપાલ ખર્ચ ચૂકવ્યો	૨૪
જાન્યુ ૧૮	ભાડાના ચૂકવ્યા	૧૨
જાન્યુ ૨૦	મુસાફરી ખર્ચ ચૂકવ્યો	૨૧
જાન્યુ ૨૧	ભાડાના ચૂકવ્યા	૫૭
જાન્યુ ૨૭	નાસ્તાપાકી ખર્ચ ચૂકવ્યો	૨૮
જાન્યુ ૨૮	કુરીયર ખર્ચ ચૂકવ્યો.	૧૪

પેટા રોકડમેળ તૈયાર કરો.

પેટા રોકડમેળ

તારીખ ૨૦૧૨	વિગત	રકમ (રૂ)	મુસાફરી ખર્ચ (રૂ)	ભાડું (રૂ)	ટપાલ ખર્ચ (રૂ)	તાર (રૂ)	નાસ્તાપાકી (રૂ)	કુરીયર (રૂ)	કુલ (રૂ)
જાન્યુ. ૧	રોકડ	૪૦૦							૧૩૦
જાન્યુ. ૨	મુસાફરી ખર્ચ		૧૩૦						૧૩૦
જાન્યુ. ૨	નાસ્તાપાકી ખર્ચ						૪૪		૪૪
જાન્યુ. ૩	ટપાલ ટિક્ટિક ખર્ચ				૪૪				૪૪
જાન્યુ. ૧૫	કુરીયર							૩૪	૩૪
જાન્યુ. ૧૭	તાર-ટપાલ ખર્ચ					૨૪			૨૪
જાન્યુ. ૧૮	ભાડું			૧૨					૧૨
જાન્યુ. ૨૦	મુસાફરી ખર્ચ				૨૧				૨૧
જાન્યુ. ૨૧	ભાડું						૫૭		૫૭
જાન્યુ. ૨૭	નાસ્તાપાકી ખર્ચ						૨૮		૨૮
જાન્યુ. ૨૮	કુરીયર							૧૪	૧૪
જાન્યુ. ૨૮	કુલ	૪૦૦	૧૩૦	૬૮	૪૪	૨૪	૭૩	૪૮	૪૧૨
	પાકી								૮૮
		૪૦૦							૪૦૦
જાન્યુ. ૨૮	બા. બા. બાયા	૮૮							
કુલ	રોકડ	૪૧૨							



નોંધ



પાઠ સ્વાધ્યાય ૭.૩

યોગ્ય શબ્દ / શબ્દો વડે ખાતી જગ્યા પૂરો

૧. બેંક ખાનાવાળા રોકડમેળમાં બેંક અને ખાનું બંને બાજુ દર્શાવવામાં આવે છે.
૨. બેંક ખાનાવાળા રોકડમેળમાં સાથે સંબંધિત તથા ની નોંધ કરવામાં આવે છે.
૩. નાના વ્યવહારોની નોંધ માટે એક અલગ રોકડમેળ તૈયાર કરવામાં આવે છે. કહે છે.



તમે આટલું શીખ્યા :

રોકડમેળ એક એવો ચોપડો છે કે જેમાં બધી જ રોકડ આવક તથા રોકડ જાવકના વ્યવહારોની નોંધ થાય છે. આ એક અસલ નોંધ નો ચોપડો છે.



સાદો રોકડમેળ :

સાદા રોકડમેળમાં ફક્ત રોકડ આવક અને રોકડ જાવકના વ્યવહારોની જ નોંધ થાય છે.
તેને બે બાજુ ઉધાર અને જમા હોય છે.

બેંક ખાનાવાળો રોકડમેળ :

આ પ્રકારના રોકડમેળમાં બેંક અને રોકડનું ખાનું બંને બાજુ હોય છે.

પેટા રોકડ મેળ :

મોટા વ્યવસાયિક એકમો માં મોટી સંખ્યામાં નાના-નાના ખર્ચઓ જેવા - કે મુસાફરી ખર્ચ, ભાડું તાર-ટપાલ ખર્ચ, અને અન્ય ખર્ચ થાય છે. આવા એકમો મુખ્ય કેશીયર તરીકે ઓળખવામાં આવે છે. આ બધા ખર્ચાની ચૂકવણી કરે છે અને આ લેવડ-દેવડ ની નોંધ કરવા માટે એક અલગ રોકડમેળ તૈયાર કરે છે. આ રોકડમેળને પેટા રોકડમેળ કહે છે.

રોકડમેળ



પાઠ્યાંત સ્વાધ્યાય :

૧. રોકડમેળ એટલે શું ? રોકડમેળના પ્રકારો જણાવો.
૨. બેંક ખાના વાળો રોકડમેળ એટલે શું ? બેંક ખાનાવાળા રોકડમેળ નો નમૂનો તૈયાર કરો.
૩. પેટા, રોકડમેળ એટલે શું ?
૪. વિરોધ નોંધ ઉદાહરણ દ્વારા સમજાવો.
૫. મેસર્સ રોનાર્કટ્રેડર્સના નીચેના વ્યવહારોની નોંધ સાદા રોકડમેળ માં કરો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



તારીખ વિગત

૨૦૧૨

રકમ
(૩)

જૂન. ૦૧	રોક લાવી ધંધો શરૂ કર્યો	૩૦,૦૦૦
જૂન. ૦૨	રોકદેથી માલ ખરીદો	૧૦,૦૦૦
જૂન. ૦૩	ફર્નિચર ખરીદું	૧,૦૦૦
જૂન. ૦૬	રોકદેથી માલ ખરીદો	૭,૦૦૦
જૂન. ૦૮	ભાડું ચૂકવ્યું	૨૦૦
જૂન. ૧૦	ટપાલ ખર્ચ ચૂકવ્યો	૧૦૦
જૂન. ૧૨	રોકડ વેચાણ	૩,૦૦૦
જૂન. ૧૪	અંગત ઉપયોગ માટે રોકડા લીધા	૨,૦૦૦
જૂન. ૧૮	બેંકમાં ભયાર્ફ	૧૦,૦૦૦
જૂન. ૨૨	રોકદેથી માલ ખરીદો	૧૩,૦૦૦
જૂન. ૨૪	પગાર ચૂકવ્યો	૪૦૦
જૂન. ૨૭	ભાડું ચૂકવ્યું	૩,૦૦૦
જૂન. ૨૮	રોકડ વેચાણ	૨,૦૦૦

૬. નીચેના વ્યવહારો પરથી શ્રીનાથનો રોકડમેળ તૈયાર કરી બાકી શોધો.

તારીખ વિગત

૨૦૧૨

રકમ
(૩)

ઓકટો. ૦૧	હાથ પર રોકડ	૨૫,૦૦૦
ઓકટો. ૦૮	એક્સ પાસેથી રોકદેથી માલ ખરીદો	૩,૨૦૦
ઓકટો. ૧૫	વાય ને માલ વેચ્યો	૪,૮૦૦
ઓકટો. ૨૦	કમિશન મળ્યું	૬૫૦
ઓકટો. ૨૦	કમિશન ચૂકવ્યું	૫૫૦

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

રોકડમેઝ બોલ્ડિન

ઓક્ટો. ૨૮ હિસાબ પેટે સુરેશને ચૂકવ્યા	૭,૧૫૦
ઓક્ટો. ૩૧ ઓફિસ કલાર્કનો પગાર ચૂકવ્યો.	૧,૦૦૦
અને ઓફિસનું ભાડું ચૂકવ્યું	૬૦૦
૭. નીચેના વ્યવહારો પરથી સાદો રોકડ મેળ તૈયાર કરો.	
તારીખ વિગત રૂપમાં	(૩)
૨૦૧૨	
માર્ચ. ૦૧ છાથપરની રોકડ	૩૨,૪૦૦
માર્ચ. ૦૮ સુમિતને રોકડા ચૂકવ્યા	૮,૦૦૦
માર્ચ. ૧૨ માલ સામાન ખરીદો	૩,૦૦૦
માર્ચ. ૧૫ નિષિ પાસેથી રોકડા મળ્યા	૨,૦૦૦
માર્ચ. ૧૮ રોકડ વેચાણ	૪,૦૦૦
માર્ચ. ૨૨ વેતન ચૂકવ્યું	૪,૦૦૦
માર્ચ. ૨૫ પગાર ચૂકવ્યો	૩,૦૦૦
માર્ચ. ૨૮ નિતીનને રોકડા ચૂકવ્યા	૩,૪૦૦
માર્ચ. ૩૧ ભાડું ચૂકવ્યું	૨,૪૦૦
૮. નીચેના વ્યવહારો પરથી સાદો રોકડમેળ તૈયાર કરો.	
તારીખ વિગત રૂપમાં	(૩)
૨૦૧૨	
ઓપ્રિલ. ૦૧ છાથ પર રોકડ	૧૫,૦૦૦
ઓપ્રિલ. ૦૫ રોકડ ખરીદી	૧,૦૦૦
ઓપ્રિલ. ૦૮ રોકડ વેચાણ	૮૦૦
ઓપ્રિલ. ૧૦ મનીષ પાસેથી મળ્યા	૧,૦૦૦
ઓપ્રિલ. ૧૫ ફર્નિચર ખરીદું	૫૦૦
ઓપ્રિલ. ૨૨ વેતન ચૂકવ્યું	૨૦૦
ઓપ્રિલ. ૨૫ કમિશન મળ્યું	૧૦૦
ઓપ્રિલ. ૩૦ ભાડું ચૂકવ્યું	૬૦૦
૯. મનોહરના પેટા રોકડ મેળમાં નીચેના વ્યવહારોની નોંધ કરો.	
તારીખ વિગત રૂપમાં	(૩)
૨૦૧૨	
જાન્યુ. ૧ મળ્યા	૧,૦૦૦
જાન્યુ. ૧ ભાડું ચૂકવ્યું	૨૦૦

રોકડમેળ

જાન્યુ ૨	ટપાલ ખર્ચ ચુકવ્યો	૧૦૨
જાન્યુ ૪	મુસાફરી ખર્ચ ચુકવ્યો	૨૨
જાન્યુ ૮	નાસ્તા પાણીનો ખર્ચ ચુકવ્યો	૧૧૫
જાન્યુ ૧૮	કુરીયર ખર્ચ ચુકવ્યો	૨૭
જાન્યુ ૧૦	તાર-ટપાલ ખર્ચ ચુકવ્યો	૧૭
જાન્યુ ૧૨	મુસાફરી ખર્ચ ચુકવ્યો	૩૮
જાન્યુ ૨૦	નાસ્તા પાણી ખર્ચ ચુકવ્યો	૧૨૪
જાન્યુ ૨૧	મુસાફરી ખર્ચ ચુકવ્યો	૧૨૭
જાન્યુ ૨૨	ટપાલ ખર્ચ ચુકવ્યો	૩૪
જાન્યુ ૨૭	ભાડું ચુકવ્યું	૧૨૦

૧૦. સ્પેશિયલ ૨૦૧ રના નીચેના વ્યવહારોની નોંધ મોહનના બેંક ખાનાવાળા રોકડમેળમાં કરો.

તારીખ	વિગત	રકમ
૨૦૧૨		(૩)
સપ્ટે. ૧	રોકડ બાકી	૧,૨૦,૦૦૦
સપ્ટે. ૧	બેંક બાકી	૧,૮૦,૦૦૦
સપ્ટે. ૨	ચેકથી માલ ખરીદો	૧૫,૦૦૦
સપ્ટે. ૪	રોકડથી માલ ખરીદો	૧૮,૦૦૦
સપ્ટે. ૫	રોકડ વેચાણ	૨૮,૦૦૦
સપ્ટે. ૮	ચેકથી માલનું વેચાણ	૭૦,૦૦૦
સપ્ટે. ૮	વેતન રોકડથી ચૂકવ્યું	૧૧,૪૦૦
સપ્ટે. ૧૦	ફર્જિયર ખરીદું અને નાણાં ચેકથી ચૂકવ્યા.	૨૦,૦૦૦
સપ્ટે. ૧૨	સુરેશ પાસેથી રૂ. ૧૦૦૦૦ નો ચેક મળ્યો તેજ વિશે તે ચેક નરેશને શેરો કરી આપ્યો.	૧૦,૦૦૦,
સપ્ટે. ૧૫	દેવાદાર હરીશે બારોબાર ૫૦૦૦ રૂ. આપણા બેંક ખાતામાં જમા કરાવ્યા.	
સપ્ટે. ૨૦	નવી ચેકબુક ઈસ્ટ્યુ કરવાના રૂ. ૨૦૦ બેંક ચાર્ઝસ ના બેંક વસૂલ્યા	
સપ્ટે. ૨૪	રૂ. ૩૦,૦૦૦, નો માલ ગુરુદીપ ને વેચ્યો જેમાં ૧/૩ રકમ રોકડ અને ૨/૩ રકમ ઉધાર થી ચુકવવી.	
સપ્ટે. ૨૫	એક મહિના અગાઉ ચુસુ ને રૂ. ૮,૦૦૦ નો માલ વેચ્યો હતો જેનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો.	
સપ્ટે. ૨૮	ચુસુ પાસેથી મળેલ ચેક નકરાયો જેના બેંક ચાર્ઝસ પેટે રૂ. ૫૦ વસૂલ્યા.	

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

રોકડમેળ રોકડમેળ

૧૧. નીચેના વ્યવહારો પરથી બેંકખાનાવાળો રોકડમેળ તૈયાર કરો :

તારીખ વિગત

૨૫મ

૨૦૧૨

(૩)

માર્ચ. ૧ હાથ પર રોકડ રૂ. ૨૭૮૦ બેંક ઓવરાફટ રૂ. ૩, ૧૨૫

માર્ચ. ૨ પેટા કેશીયર ને રૂ. ૪૦૦નો ચેક આપ્યો.

માર્ચ. ૪ હરિને ઇલેક્ટ્રોનિક રીપેરીંગના રૂ. ૩૫૦ ચૂકવ્યા.

માર્ચ. ૧૨ રોકડ વેચાણ

માર્ચ. ૧૭ એક ચિહ્ની સમય પહેલા શીલા પાસેથી મળી જેમાં રૂ. ૨૦ વટાવા આપ્યા બાદ શીલા પાસેથી રૂ. ૮૫૦ મળ્યા.

માર્ચ. ૨૪ ગિરધારી લાલે તેમને વેચેલ માલના બદલામાં ૨૦૦૦ રૂ. રોકડા અને ૩૦૦ રૂ. ચેકથી ચૂકવ્યા.

માર્ચ. ૨૫ રહીમ પાસેથી ૧૭૦૦ રૂ. નો માલ ખરીદો અને ચેકથી ચૂકવ્યા.

માર્ચ. ૩૦ બેંક ઓવરાફટના રૂ. ૫૦ ચૂકવ્યા.

માર્ચ. ૩૧ બેંકમાં રૂ. ૧૦૦૦ રોકડ ભરાવી.

૧૨. નીચેના વ્યવહારો પરથી બેંક ખાના વાળો રોકડમેળ તૈયાર કરો.

તારીખ વિગત

૨૫મ

૨૦૧૨

(૩)

માર્ચ. ૧ હાથ પર રોકડ રૂ. ૭૦,૦૦૦ અને બેંક માં સિલક રૂ. ૮૦,૦૦૦

માર્ચ. ૫ ચેકથી માલ ખરીદો

૯૦,૦૦૦

માર્ચ. ૧૦ રોકડથી માલ વેચ્યો

૨૦,૦૦૦

માર્ચ. ૧૨ માલ વેચાણનો ચેક મળ્યો

૪૦,૦૦૦

માર્ચ. ૧૫ હરિઓમને ચેક થી ચૂકવ્યા

૭,૦૦૦

માર્ચ. ૧૬ ટેલિફોન બિલ ભર્યું

૨,૦૦૦

માર્ચ. ૧૭ માલતી પાસેથી મળ્યા

૪,૦૦૦

માર્ચ. ૧૮ શેતા પાસેથી ચેક મળ્યો

૮,૦૦૦

માર્ચ. ૨૦ ઓફિસ ઉપયોગ માટે બેંક માંથી ઉપાડચા

૧૨,૦૦૦

માર્ચ. ૨૨ કારીગરોને વેતન ચૂકવ્યું

૧૮,૦૦૦

માર્ચ. ૨૫ શેતા એ આપેલો ચેક નકરાયો

—

માર્ચ. ૨૫ બેંક ચાર્જસના ઉધાર્યા

૧૨૦

માર્ચ. ૩૦ બેંક વ્યાજ જમા કર્યું

૧૮૦

રોકડમેળ

માર્ચ. ૩૧ રોકડ વેચાણ ૪,૦૦૦

૧૩. નીચેના વ્યવહારો પરથી બેંકખાનાવાળો રોકડવાળો તૈયાર કરો.

તારીખ વિગત રકમ

૨૦૧૨ (૩)

જાન્યુ. ૧ હાથ પર રોકડ રૂ. ૨૬,૮૦૦ અને બેંકમાં સિલક રૂ. ૭૨,૪૦૦

જાન્યુ. ૫

જાન્યુ. ૮ ચેકથી માલ ખરીદો ૪,૦૦૦

જાન્યુ. ૧૦ રોકડથી માલ ખરીદો ૭,૦૦૦

જાન્યુ. ૧૩ ચૂકવવાના બાકી બિલના ચેકથી ચૂકવ્યા ૧૨,૦૦૦

જાન્યુ. ૧૫ ધ્યાકીય ખર્ચના રોકડા ચૂકવ્યા ૬,૦૦૦

જાન્યુ. ૧૭ બેંકમાં રોકડા ભર્યા ૧૦,૦૦૦

જાન્યુ. ૧૮ જેકી કે જેને રૂ. ૬૦૦ રૂ. ઉધાર આપ્યા હતા તે નાદાર જાહેર થતાં તેની પાસેથી ૧ રૂપિયે ૫૦ પેસા વસુલ થયા.

જાન્યુ. ૨૦ શાનયંદ પાસેથી મળ્યા, ૪૮૦૦

જાન્યુ. ૨૨ માલિક સિંહને ચૂકવ્યા. ૨૩૮૦

જાન્યુ. ૨૪ ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી રોકડા ઉપાડ્યા ૬,૦૦૦

જાન્યુ. ૨૫ અંગત ઉપયોગ માટે બેંકમાંથી રોકડા ઉપાડ્યા ૭,૦૦૦

જાન્યુ. ૨૮ રોકડથી માલ વેચ્યો ૨૦,૦૦૦

જાન્યુ. ૨૮ માલના વેચાણનો ચેક મળ્યો. ૧૮,૦૦૦

જાન્યુ. ૩૦ લોનના રીફનના રૂ. ૧૫૦૦૦ મળ્યા જેમાંથી રૂ. ૧૩૦૦૦ બેંકમાં ભર્યા

૧૪. નીચેના વ્યવહારો પરથી બેંકખાનાવાળો રોકડમેળ તૈયાર કરો.

તારીખ વિગત રકમ

૨૦૧૨ (૩)

ફેબ્રુ. ૧ હાથ પર રોકડ ૧૦,૦૦૦

ફેબ્રુ. ૧ બેંકમાં સિલક ૪૦,૦૦૦

ફેબ્રુ. ૩ રોકડ વેચાણ ૧૩,૦૦૦

ફેબ્રુ. ૪ બેંકમાં જમા કર્યા ૧૭,૦૦૦

ફેબ્રુ. ૮ જમીએ ચેક આપી હિસાબ ચુકતે કર્યો. ૧૨,૦૦૦

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

રોકડમેળ ઝાસ્ટ બો

ફેઝુ. ૧૨	ચેકથી માલ ખરીદો	૧૦,૦૦૦
ફેઝુ. ૧૫	સ્ટેશનરી રોકડથી ખરીદી	૫,૦૦૦
ફેઝુ. ૨૦	જમીનો ચેક નકરાયો બંંક બંંક ચાર્ઝસના રૂ. ૫૦ વસૂલ્યા.	
ફેઝુ. ૨૦	જાનકીદાસ પાસેથી ચેક મળ્યો	૧૧,૦૦૦
ફેઝુ. ૨૬	ઓફિસ ઉપયોગ માટે બંંક માંદ્ઘી ઉપાડ્યા	૧૬,૦૦૦
ફેઝુ. ૨૮	ચેકથી પગાર ચૂકવ્યો રૂ. ૧૧૨૦૦ અને રૂ. ૭૨૪૦ ભાડું ભાડું રોકડમાં ચૂકવ્યું.	

૧૫. નીચેના વ્યવહારો પરથી બંંકખાનાવાળો રોકડમેળ તૈયાર કરો.

તારીખ	વિગત	રકમ
૨૦૧૨		(૩)
ઓક્ટો. ૧	છાથ પરની રોકડ	૨૭,૧૦૦
ઓક્ટો. ૧	બંંકમાં સિલક	૭૨,૦૦૦
ઓક્ટો. ૬	ચેકથી માલ ખરીદો	૧૪,૦૦૦
ઓક્ટો. ૭	રોકડથી માલ ખરીદો	૧૫,૦૦૦
ઓક્ટો. ૧૫	ધંધાકીય ખર્ચાં ચૂકવ્યા,	૪,૧૪૦
ઓક્ટો. ૧૬	બંંકમાં ભર્યા	૨,૦૦૦
ઓક્ટો. ૧૮	રામ કે જેને ૮૦૦૦ રૂ. ઉધાર આપ્યા હતા તે દાનદાર જાહેર થતાં તેની પાસેથી ૧ થી ૬૦ પેસા વસૂલ થયા.	

ઓક્ટો. ૨૧	માલતી પાસેથી રોકડ મળ્યા.	૫,૮૦૦
ઓક્ટો. ૨૪	બંંકમાંથી રોકડ ઉપાડ્યા	૭,૪૦૦
ઓક્ટો. ૨૫	દાસ એન્ડ કંપનીને રોકડ ચૂકવ્યા	૪,૪૮૦
ઓક્ટો. ૨૮	અંગત ઉપયોગ માટે બંંકમાંથી ઉપાડ્યા	૧૩,૦૦૦
ઓક્ટો. ૨૮	રોકડ વેચાડી	૧૪,૦૦૦
ઓક્ટો. ૨૮	માલ વેચાડાનો ચેક મળ્યો.	૧૦,૦૦૦
ઓક્ટો. ૩૦	લોનના પીઉંડના રૂ. ૧૮૦૦૦ મળ્યા અને તેમાંથી ૬,૦૦૦ રૂ. બંંકમાં ભર્યા.	

ઓક્ટો. ૩૧	બંંક ચાર્ઝસ	૨૫૦
-----------	-------------	-----

૧૬. બંંકખાનાવાળો રોકડમેળ તૈયાર કરો.

તારીખ	વિગત	રકમ
૨૦૧૨		(૩)

રોકડમેળ

એપ્રિલ. ૧ હાથ પર રોકડ રૂ. ૨૬,૫૦૦ અને બેંકના ચાલુખાતામાં જમાબાકી રૂ.

૪૬,૪૦૦

એપ્રિલ. ૩ નિરજસિંહ પાસેથી મળ્યા

૭,૬૦૦

એપ્રિલ. ૧૦ કર્મચારીઓને પગાર ચૂકવ્યો.

૧૮,૦૦૦

એપ્રિલ. ૧૨ રોકડ વેચાશ

૩,૭૫૦

એપ્રિલ. ૧૪ વિવેકને ચેકથી ચૂકવ્યા.

૪,૨૦૦

એપ્રિલ. ૧૬ રોકડ ખરીદી

૩,૩૦૦

એપ્રિલ. ૧૮ ચેકથી બિલના ચૂકવ્યા

૬,૪૦૦

એપ્રિલ. ૧૮ મીનાને ચેકથી ચૂકવ્યા

૧,૬૮૫

એપ્રિલ. ૧૮ રોકડ વેચાશ

૮,૬૮૦

એપ્રિલ. ૧૯ કુલી અને ભાડાના રોકડ ચૂકવ્યા

૪૫૦

એપ્રિલ. ૨૦ ઓફિસ ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડ્યા

૭,૦૦૦

એપ્રિલ. ૨૦ મહિનાનું ભાડું રોકડથી ચૂકવ્યું

૨,૪૦૦

એપ્રિલ. ૨૧ રોકડ વેચાશ

૧૮,૦૦૦

એપ્રિલ. ૨૨ મનિષ પાસેથી ચેક મળ્યો.

૨,૬૮૪

એપ્રિલ. ૨૩ બેંકમાં રોકડ ભર્યા

૩,૪૦૦

એપ્રિલ. ૨૪ સ્કૂટર ખરીદ્યું નાણાં ચેકથી ચૂકવ્યા

૨૬,૮૦૦

એપ્રિલ. ૨૫ બેંક દ્વારા ઉધરાણી

૧૮,૦૦૦

એપ્રિલ. ૨૫ આલોક ગુમા કે જેણે ૮૦૦૦ રૂ.

ચુકવવાના હતા તેણે ચૂકતે રકમનો ચેક આપ્યો

૭,૬૦૦

એપ્રિલ. ૨૫ રોકડ વેચાશ

૨,૭૦૦

એપ્રિલ. ૨૭ બેંક આલોક ગુમાનો ચેક નકરાયો તેની જાણ કરો.

એપ્રિલ. ૨૮ બેંકમાં રોકડ ભર્યા

૫,૪૦૦

એપ્રિલ. ૨૮ વેતન ચૂકવ્યું

૮,૨૦૦

૧૭. નીચેના વ્યવહારોની પેટા રોકડમેળમાં નોંધ કરો.

તારીખ વિગત

રકમ

૨૦૧૨

(૩)

ઓગષ્ટ. ૧ પટાવાળાને વેતન ચૂકવ્યું

૧,૪૦૦

ઓગષ્ટ. ૩ પેન્સિલ અને પેન ખરીદી

૭૦

ઓગષ્ટ. ૫ માલનું ભાડું ચૂકવ્યું

૨૫૦

ઓગષ્ટ. ૧૦ ટપાલ ટીકીટ ખરીદી

૧૩૪

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



ၪ

રોકડમેળ

ઓગષ્ટ. ૧૨	ટેલીગ્રામ અને ટેલિફોન ખર્ચ	૨૯૦
ઓગષ્ટ. ૧૪	અન્ય ખર્ચ	૬૦૦
૧૮.	૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પેટી કેશિયરને રૂ. ૮૦૦૦ મળ્યા આ અઠવાડિયા દરમિયાનના તેના ખર્ચની વિગત નીચે મુજબ છે.	
તારીખ	વિગત	રકમ
૨૦૧૨		(૩)
સપ્ટે. ૧	ટેક્ષી ચાર્જ	૪૦૦
સપ્ટે. ૨	દુટકકામદારને વેતન ચૂકવ્યું	૨૪૦
સપ્ટે. ૪	પટાવાળાને બસ ભાડું ચૂકવ્યું	૨૦
સપ્ટે. ૪	સ્ટેશનરી ખરીદી	૩૦૦
સપ્ટે. ૫	ટપાલ ટીકીટ ખરીદી	૭૫
સપ્ટે. ૫	રેવન્યુ ટીકીટ ખરીદી	૨૫
સપ્ટે. ૫	ફર્નિચર સમારકામ	૧૩૦
સપ્ટે. ૫	વીજળી બિલ ચૂકવ્યું	૧,૪૦૦
સપ્ટે. ૬	કુલીને મજૂરી ચુકવી	૧૪૦
સપ્ટે. ૬	ટેક્ષી ભાડું ચૂકવ્યું	૪૦૦
સપ્ટે. ૬	ટેલીગ્રામ	૮૦
સપ્ટે. ૬	તાળા ચાવી ખરીદી	૭૦
સપ્ટે. ૬	સ્ટેશનરી ખરીદી	૧૪૦
સપ્ટે. ૭	ગ્રાહકોને ચા- નાસ્તો કરાવ્યો તેનો ખર્ચ	૩૪૦



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

- ૭.૧ (૧) આવક, જાવક (૨) આવક, જાવક
 (૩) ઉધાર, ગમા (૪) શરણની બાકી

- ၆၃ I. i) c ii) b iii) b iv) a
v) c vi) a vii) c

- | II. | ક્રમ | વ્યવહાર | ઉધાર | જમા |
|------|--------------------------------|---------|------|-----|
| | | આજુ | આજુ | |
| (i) | મુકેશે રોકાલાવી ધંધો શરૂ કર્યો | ✓ | | |
| (ii) | રોકડેથી માલસામાન ખરીદ્યો | | | ✓ |

રોકડમેળ

- | | | |
|-------|-------------------------|---|
| (iii) | રોકડથી માલસામાન ખરીયો | ✓ |
| (iv) | આખરની રોકડ બાકી | ✓ |
| (v) | અંકુર પાસેથી રોકડ મળ્યા | ✓ |

૭.૩ (i) રોકડ (ii) રોકડ બેંક (iii) પેટા રોકડ મેળ.

૫. આખરની રોકડબાકી રૂ. ૨,૨૦૦
૬. આખરની રોકડબાકી રૂ. ૧૩,૧૪૦
૭. આખરની રોકડબાકી રૂ. ૧૪,૪૦૦
૮. આખરની રોકડબાકી રૂ. ૧૪,૬૦૦
૯. આખરની રોકડબાકી રૂ. ૭૪
૧૦. આખરની રોકડબાકી રૂ. ૧,૨૮,૬૦૦ અને બેંક બાકી રૂ. ૨,૧૮,૭૪૦
૧૧. આખરની રોકડબાકી રૂ. ૧,૦૦૦ અને બેંક બાકી રૂ. ૩,૩૦૪
૧૨. આખરની રોકડબાકી રૂ. ૬૦,૦૦૦ અને બેંક બાકી રૂ. ૬૧,૦૭૦
૧૩. આખરની રોકડબાકી રૂ. ૩૩,૬૦૦ અને બેંક બાકી રૂ. ૮૮,૮૭૦
૧૪. આખરની રોકડબાકી રૂ. ૧૪,૭૬૦ અને બેંક બાકી રૂ. ૨૫,૭૫૦
૧૫. આખરની રોકડબાકી રૂ. ૪૫,૫૬૦ અને બેંક બાકી રૂ. ૫૫,૨૫૦
૧૬. આખરની રોકડબાકી રૂ. ૩૪,૨૮૦ અને બેંક બાકી રૂ. ૨૮,૮૦૮
૧૭. આખરની રોકડબાકી રૂ. ૨,૦૩૪
૧૮. આખરની રોકડબાકી રૂ. ૩,૪૯૦

તમારા માટે પ્રવૃત્તિ :

૧. દરેક વિદ્યાર્થીને તેના માતા - પિતા પાસેથી બિસ્સા ખર્ચ મળે છે અને તેને તે અલગ - અલગ પ્રકારના સામાન ખરીદવામાં ખર્યે છે. . ખર્યવાની નોંધ રાખવાની છે. તમને તમારા દાદા-દાદી અથવા નાના-નાની પાસેથી રૂપિયા મળતા જ હશે. એક નોટબુક / ડાયરી બનાવો જેમાં બધી જ આવક અને ખર્યની નોંધ કરો. અને તમારી આવક અને જાવક ઉપરથી રોકડ મેળ તૈયાર કરો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ




મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



Bank Reconciliation



બેંક સિલાક મેળ

જો તમે એક વ્યવસાયી છો તો તમારું બેંકમાં ખાતું પડા ચોક્કસ હશે. તમે બેંક સાથે જે વ્યવહાર કરો છો તેને રોકડમેળના બેંક ખાતામાં લખો છો. બેંક પડા વ્યવસાયીના દરેક વ્યવહારની નોંધ તેની ખાતાવક્ષીના તેના નામના ખાતામાં કરે છે અને આ નોંધની એક નકલ તેના ગ્રાહકને આપે છે તેને પાસભુક કહેવાય છે. જો તમે તમારા તમામ વ્યવહારોની સાચી નોંધ તમારા રોકડમેળમાં કરી હશે તો તેની અને બેંક તેની ખાતાવક્ષીમાં કરેલી કોઈપણ દિવસની સિલાક સરખી હશે. પડા જો તમને તફાવત જોવા મળે તો તમે શું કરશો? તમે બંનેની સરખામણી કરશો અને તફાવતનું કારણ શોધશો. તફાવત દર્શાવતી બાબતોનું તમે એક પત્રક તૈયાર કરશો અને તેના આધારે સાચી સિલાક મેળવવા પ્રયાસ કરશો. આ પત્રકને બેંક સિલાકમેળ તરીકે ઓળખવામાં આવે છે.

આ પકરણમાં તમે બેંક સિલાક મેળનો અર્થ, તે તૈયાર કરવાના હેતુઓ શીખશો, પાસભુક અને રોકડમેળમાં તફાવતનાં મુખ્ય કારણો જાણશો અને બેંક સિલાક મેળ તૈયાર કરવાનું શીખશો.



હેતુઓ :

આ પકરણનો અભ્યાસ કર્યા પછી તમે,

- બેંક સિલાક મેળનો અર્થ અને જરૂરિયાત સમજી શકશો.
- રોકડમેળ અને પાસભુકની બાકીમાં તફાવતના કારણો જાણી શકશો અને
- બેંક સિલાકમેળ તૈયાર કેવીરીતે થાય છે તે સમજી શકશો.

૮.૧ બેંક સિલાક મેળ - અર્થ અને જરૂરિયાત :

કોઈ નિશ્ચિત તારીખના રોકડમેળના બેંક ખાતા અને પાસભુકની બાકી વચ્ચેના તફાવતને દૂર કરવા જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને બેંક સિલાકમેળ કહે છે. આવા પત્રકો સમયાંતરે તૈયાર કરવામાં આવે છે.

બેંક સિલાકમેળ તૈયાર કરવાની જરૂરિયાત/આવશ્યકતા :

બેંક સિલાકમેળ એવું પત્રક છે જે મુખ્યત્વે પાસભુકની સિલાક અને રોકડમેળની બેંક સિલાક મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. આ પત્રકને તૈયાર કરવાનો ઉદ્દેશ્ય એ બંને સિલાક વચ્ચેના તફાવતના કારણો જાણી અને આ તફાવત દૂર કરવાનો છે.

૮.૨ રોકડમેળ અને પાસભુકમાં તફાવતના કારણો :

રોકડમેળ અને પાસભુકની સિલાકમાં તફાવતના કારણો નીચે મુજબ છે.



નોંધ

- ૧) **લખેલા પરંતુ રજૂ નહિ થયેલ ચેક :** ધ્યાનનો માલિક તેના લેણદારોને ચૂકવવા માટે ચેક લખે છે જેની નોંધ રોકડમેળના બેંક ખાતામાં ચૂકવણી બાજુ થાય છે. જેનાથી રોકડમેળની સિલાક ઘટે/ઓછી થાય છે. પરંતુ બેંક પેઢીના ખાતામાં ત્યારે જ ઉધાર કરશે જ્યારે તે બેંકમાં રજૂ થશે, ચેક લખવો અને તેને બેંકમાં વસૂલ કરવા માટે રજૂ કરવો એ એક સમય માંગી લેતી પ્રક્રિયા છે. આ કારણે જ રોકડમેળની સિલાક અને પાસબુકની સિલાકમાં તફાવત જોવા મળે છે.
- ૨) **બેંકમાં ભરેલ પરંતુ જમા નહિ થયેલ ચેક :** જ્યારે ચેક બેંકમાં ભરવામાં આવે છે ત્યારે તરત જ તેની નોંધ પેઢીના રોકડમેળના ઉધાર બાજું બેંક ખાતામાં થશે. આનાથી રોકડમેળના બેંક ખાતાની સિલાકમાં વધારો થશે. જ્યારે ભરેલા ચેક જમા થવામાં સમય લાગે છે આથી બેંકમાં ભરેલ ચેકની નોંધ તે જ દિવસે પાસબુકમાં થશે નહિ અને સિલાકમાં વધારો થશે નહિ. આ કારણે જ રોકડમેળની સિલાક અને પાસબુકની સિલાકમાં તફાવત જોવા મળે છે.
- ૩) **ગ્રાહક / દેવાદારે સીધી જ બેંકમાં જમા કરાવેલ રકમ:** જ્યારે ધ્યાના દેવાદાર કે ગ્રાહકોને સીધા બેંકમાં પેસા જમા કરાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા હોય અનેજો ધ્યાના માલિકનો કોઈ દેવાદાર કોઈ પણ જાણ કર્યા વગર જ બેંક ખાતામાં સીધા નાણાં જમા કરાવે છે તો તે સંઝેગોમાં બેંક પોતાની ખાતેદાર પેઢીના ખાતામાં નોંધ કરે છે અને પાસબુકની સિલાકમાં વધારો થાય છે. પરંતુ તેની નોંધ તે જ દિવસે રોકડમેળમાં થતી નથી. અને પરિણામે રોકડમેળની સિલાક પાસબુકની સિલાક કરતાં ઓછી થાય છે.
- ૪) **બેંક દ્વારા વસૂલાતા બેંક ચાર્જસ :** બેંક ગ્રાહકને અનેક સેવાઓ આપે છે. જેના બદલામાં બેંક ફી અથવા કમિશન ઉધરાવે છે જેની નોંધ પાસબુકમાં કરે છે. પરંતુ પેઢીના માલિકને આની કોઈ જ માહિતી હોતી નથી. પરિણામે રોકડમેળની સિલાક પાસબુકની સિલાક કરતાં વધુ હોય છે.
- ૫) **બેંક ગ્રાહકનાં બદલામાં વ્યાજ અને ડિવિડન વસૂલ કર્યા :** ડિબેન્ચર પર મળતું વ્યાજ અને શેર પર મળતું ડિવિડન કંપની દ્વારા સીધે સીધું ગ્રાહકના બેંક ખાતામાં બેંકની ECS સેવાના કારણે જમા થાય છે. પરંતુ તેની કોઈ જ નોંધ રોકડમેળમાં થતી નથી કારણે કે પેઢીને આની જાણ બેંક સ્ટેટમેન્ટ મળે પછી જ થાય છે. આથી રોકડમેળમાં આની નોંધ પછી થાય છે. બેંકમાં જે તારીખે નોંધ થઈ હોય તે તારીખે થતી નથી. પરિણામે રોકડમેળ અને પાસબુકની સિલાકમાં તફાવત જોવા મળે છે.
- ૬) **બેંક બારોબાર ગ્રાહકવતી ચૂકવેલ ખર્ચા :** પેઢી વતી અમુક ખર્ચ ચૂકવવાની સત્તા બેંકને આપવામાં આવે છે આથી બે પેઢી વતી અમુક ખર્ચા જેવા કે ટેલિફોન બિલ, ભારું, વીમા પ્રીમીયમ, વેરા વગેરેની સીધેસીધી ચૂકવણી કરે છે. આવા ખર્ચા ચૂકવ્યા બાદ બેંક તેની નોંધ તરત જ પેઢીના ખાતામાં કરે છે. પરંતુ પેઢી તેની નોંધ બેંક તરફથી મળતું બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક દ્વારા માહિતી મળે ત્યારબાદ જ કરે છે. પરિણામે રોકડમેળના બેંક ખાતાની બાકી કરતાં પાસબુકની બાકી ઓછી હોય છે.
- ૭) **બેંકમાં ભરેલ ચેક નકારાયો :** પેઢીને તેના ગ્રાહકો તરફથી ઘણા-બધા ચેક મળે છે પેઢી તે ચેક બેંકમાં ભરે રહે જેમાંથી અમુક એક નકારાય છે. આ સંઝેગોમાં બેંક પેઢીના ખાતામાં ઉધાર રહે છે. પરંતુ પેઢી તેની નોંધ બેંક તરફથી માહિતી મળ્યા બાદ જ કરે છે. પરિણામે રોકડમેળ અને પાસબુકની સિલાકમાં તફાવત જોવા મળે છે.
- ૮) **પેઢી દ્વારા વ્યવહારની નોંધ કરવામાં થતી ભૂલો :** ક્યારેક પેઢી દ્વારા પણ ભૂલો

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

બેંક સિલક મેળ

થાય છે જેમ કે, કોઈ રકમ લખવાની ભૂલી જાય, યેક નકારાય અથવા જમા બાજુ ખોટી નોંધ અથવા રોકડમેળ અને પાસબુકની સિલક કાઢવામાં ભૂલ થવી. આવા તિસ્સામાં રોકડમેળની સિલક અને પાસબુકની સિલકમાં તફાવત જોવા મળે છે.

૬) બેંક દ્વારા વ્યવહારની નોંધ કરવામાં થતી ભૂલો : ગ્રાહકના ખાતામાં થયેલ વ્યવહારોની નોંધ કરવામાં ક્યારેક બેંકની પણ ભૂલ થાય છે. જેમ કે કોઈ રકમ લખવાનું ભૂલી જું, યેક નોંધવામાં ભૂલ વગેરે. પરિણામે રોકડમેળની સિલક અને પાસબુકની સિલકમાં તફાવત જોવા મળે છે.



પાઠ સ્વાધ્યાય ૮.૧

I. વૈકલ્પિક પ્રશ્નો


૧. બેંક સિલક મેળ કોની-કોની વચ્ચે તફાવતના કારણો જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?
 - અ) રોકડમેળના રોકડ ખાતાની સિલક અને પાસબુકની સિલક
 - બ) પાસબુક અને રોકડમેળના બેંક ખાતાની સિલક
 - ક) બંનેમાંથી એક પણ નહિ
૨. બેંક સિલક મેળ છે.
 - અ) એક ખાતાવહી
 - બ) રોકડમેળનો એક ભાગ
 - ક) પાસબુક અને રોકડમેળના બેંક ખાતાની સિલક વચ્ચેના તફાવતના કારણો જાણવા માટે એક અલગ પત્રક બનાવવામાં આવે છે.
૩. બેંક સિલકમેળ કોની મદદથી તૈયાર કરવામાં આવે છે ?
 - અ) બેંક પાસબુક અને રોકડમેળનું બેંક ખાતું
 - બ) બેંક પાસબુક અને રોકડમેળનું રોકડ ખાતું
 - ક) બંને માંથી એક પણ નહિ

ખાલી જગ્યા પૂરો

૧. બેંકની પાસે ગ્રાહકના ખાતાની નકલ કહેવાય છે.
૨. જમા કરેલા યેક રોકડમેળના બેંક ખાતામાં બાજુમાં નોંધાય છે.
૩. બેંક સિલકમેળ પાસબુકની સિલક અને રોકડમેળના બેંક ખાતાની સિલકને માટે તૈયાર કરવામાં આવે છે.

III. નીચે કેટલાક વાક્યો આપેલા છે. તેમાંથી અમુક ખરાં છે અને અમુક ખોટાં છે. ખરા વાક્ય સામે ખરુ અને ખોટાં સામે ખોટું લખો.

૧. બેંકને યેક મળતા તે તરતજ ગ્રાહકના ખાતામાં જમા કરે છે.
૨. બેંક ગ્રાહક વતી તેની સૂચના મુજબના અમુક ખર્ચાં ચૂકવે છે.
૩. બેંક ચાર્જસ ક્યારેય રોકડમેળમાં નોંધવામાં આવતા નથી.
૪. બેંક બારોબાર ગ્રાહક વતી મેળવેલ રકમ પાસબુકની સિલકમાં વધારો કરે છે.



૮.૩ બેંક સિલકમેળ તૈયાર કરવી :

બેંક સિલકમેળ તૈયાર કરતાં પહેલાં આપણે જાડી લેણું જોઈએ કે સિલક ધન છે કે ઝડપ છે.

I. ધનાત્મક બાકી : અહીં બે સંભાવના / શક્યતાઓ છે :

- અ. પાસબુકની જમા સિલક આપેલ છે અને રોકડમેળની સિલક શોધવાની છે.
- બ. રોકડમેળની ઉધારસિલક આપેલ છે અને પાસબુકની સિલક શોધવાની છે.

તમે અગાઉ ભણી ગયા તે મુજબ બેંક સિલકમેળ, પાસબુકને રોકડમેળની સિલકમાં રહેલ તફાવત દૂર કરવા તૈયાર કરાય છે. જો રોકડમેળની ઉધાર સિલક અથવા રોકડમેળ મુજબ સિલક આપેલ હોય તો આપણે પાસબુકની સિલક સાથે મેળવવી પડશે.

રોકડમેળની સિલકને પાસબુકની સિલક સાથે મેળવવા તફાવતના બધા કારણોને જાડી અને પાસબુકમાં જમા કરેલ તમામ સિલકને રોકડમેળની સિલકમાં ઉમેરવી જોઈએ અને પાસબુકમાં ઉધારાયેલ છે પરંતુ રોકડમેળમાં લખેલ નથી તેવી બધી જ રકમને ઘટાડવી જોઈએ જે પાસબુકની બાકી ઓછી દશાવી છે. ઉદાહરણ તરીકે –

૧. ૫૦૦૦ રૂ.નો એક ચેક ઇસ્યુ કર્યો પરંતુ બેંકમાં રજૂ થયો નથી. આનાથી રોકડમેળની સિલક, પાસબુકની સિલક કરતાં ઓછી થશે. આથી રૂ. ૫૦૦૦ રોકડમેળની સિલકમાં ઉમેરવા. જેથી બંને ચોપડાની સિલક સરખી થશે.
૨. બીજી બાજુ એક ગ્રાહકે ખાતેદારની સૂચના મુજબ બેંકમાં રૂ. ૩૦૦૦ જમા કરાવી દીધા. તો પરિણામ એ આવશે કે પાસબુકની સિલક રોકડમેળની સિલક કરતાં વધી જશે. હવે જો રૂ. ૩૦૦૦ રોકડમેળની સિલકમાં ઉમેરીશુ તો બંને ચોપડાની સિલક સરખી થશે.
૩. બેંક ચાર્ચસ વગેરેને લીધે પાસબુકની સિલકમાં ઘટાડો થશે. આ પરિસ્થિતિમાં રોકડમેળ અને પાસબુકની સિલક સરખી કરવા માટે રોકડમેળની સિલક ઘટાડવી પડશે.

ટૂંકમાં, જો રોકડમેળની સિલક આપેલ હોય અને આપણે પાસબુકની સિલક સાથે મેળવવી છે તો બધી જ લેવડ-ફડમાં તફાવતના કારણો શોધવા પડશે. જે બાબતો પાસબુકની સિલકમાં દશાવીલ છે તે રોકડમેળમાં ઉમેરાશે અને જે બાબતો પાસબુકની સિલકમાંથી ઘટાડેલી છે તે રોકડમેળની સિલકમાં પણ ઘટશે. ઉપરના ઉદાહરણ પરથી આ બાબત સ્પષ્ટ થશે.

નોંધ : જો રોકડમેળ મુજબ બેંક ઓવરાફાફ આપેલ હોય તો ફક્ત ઓવરાફાફની રકમ (ઉધારાની રકમ) ઝડપ (-) ખાનામાં લખાશે. બાકી બધું અગાઉની જેમ જ હશે.

જો પાસબુકની જમા સિલક આપેલ હોય અને તેને રોકડમેળ સાથે મેળવવાની હોય તો તેવી સ્થિતિમાં, સિલક મેળવવા માટે ઉલટો નિયમ લેવાશે. ઓવરાફાફની પરિસ્થિતિમાં પાસબુકની સાથે રોકડમેળની સિલક મેળવવા સમાન જ નિયમો લાગશે.

બેંક સિલકમેળનો નમૂનો :

બેંક સિલકમેળ એક પત્રક છે ખાતું નહિ. તેને અલગ-અલગ રીતે તૈયાર કરાય છે. એને તૈયાર કરવા માટે અલગ-અલગ નમૂનાનો ઉપયોગ કરાય છે. એક સામાન્ય નમૂનો નીચે મુજબ છે.



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ



બેંક સિલક મેળ

બેંક સ્ટેટમેન્ટ
..... ના રોજનો બેંક સિલકમેળ

વિગત	ઉમેરો (+) રૂ.	બાદ કરો (-) રૂ.
રોકડમેળ / પાસબુકની સિલક (જે બાકી આપેલ હોય તે) ઉમેરો : (અસર અથવા તફાવતનું નું કારણ બાદ કરો : (ઉમેરો અથવા બાદ કરો)		
કુલ
પાસપુક / રોકડમેળ સિલક		

બેંક સિલકમેળ તૈયાર કરતી વખતે જે રોકડમેળ બેંક સિલકમા અથવા પાસબુક ઉધાર સિલક દર્શાવે તો તે સ્થિતિમાં આપેલ સિલક ઝડપ (-) ખાનામાં દર્શાવાશે.

નીચેના ઉદાહરણોની મદદથી તમે બેંક સિલકમેળને સારી રીતે સમજ શકશો.

ઉદાહરણ ૧ (રોકડમેળ મુજબ બાકી) :

નીચેની માહિતી પરથી મેસર્સ એભીસી લિમિટેડનું તા. ૩૧-૦૭-૨૦૧૨ ના રોજ બેંક સિલકમેળ તૈયાર કરો.

- રોકડમેળ મુજબ બેંક સિલક રૂ. ૬૨,૪૦૦/-
- બેંકમાં જમા કરેલ પરંતુ તા. ૩૧-૭-૧૨ સુધી વસૂલ નહિ થયેલ ચેક રૂ. ૮૮૦૦/-
- લખેલ પરંતુ તા. ૩૧-૭-૧૨ સુધી રજૂ નહિ થયેલ ચેક રૂ. ૧૨,૪૦૦/-
- બેંકે ૫૦૦૦ રૂ. ડિવિડન્ડ જમા કર્યું
- બેંક ઉધારેલ બેંક ચાર્જસ રૂ. ૪૦૦/-

ઉકેલ :

તા. ૩૧-૦૭-૨૦૧૨ ના રોજનો મે એભીસી લિમિટેડને બેંક સિલક મેળ

વિગત	ઉમેરો (રૂ.)	બાદ કરો (રૂ.)
૧. રોકડમેળ મુજબ બાકી	૬૨,૪૦૦	
૨. જમા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક		૮૮૦૦
૩. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક	૧૨,૪૦૦	
૪. મળેલ ડિવિડન્ડ	૪,૦૦૦	

બેંક સિલક મેળ

૫. બેંક ઉધારેલ બેંક ચાર્જસ પાસબુક મુજબ સિલક (ઉમેરોવાળા ખાનાનો સરવાળો બાદ કરો વાળા ખાના કરતાં વધું છે.)		૪૦૦
	કુલ	૭૦,૯૦૦
	૮૦,૦૦૦	૮૦,૦૦૦

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



ઉદાહરણ - ૨ (રોકડમેળ મુજબ બાકી)

નીચેની માહિતી પરથી મે. દીપ ટ્રેડરનું તા. ૩૦-૬-૧૨ના રોજ બેંક સિલકમેળ તૈયાર કરો.

૧. રોકડમેળ મુજબ સિલક રૂ. ૧,૦૦,૦૦૦/- રૂ.
૨. રૂ. ૧૭,૫૪૦ના ચેક બેંકમાં જમા કરેલ પરંતુ હજુ સુધી વસૂલ થયા નથી.
૩. બેંક રૂ. ૫૨૫૦ કેન્ટિકાર્ડની ફી ના વસૂલ કર્યા જેની નોંધ રોકડમેળમાં કરેલ નથી.
૪. પાસબુકમાં નકારાયેલ ચેકના રૂ. ૪૦૦૦૦ ઉધાર કરેલ છે.

ઉકેલ

મે. દીપ ટ્રેડરનો તા. ૩૦-૬-૨૦૧૨ના રોજનો બેંક સિલકમેળ

વિગત	ઉમેરો (રૂ.)	બાદ કરો (રૂ.)
૧. રોકડમેળ મુજબ સિલક	૧,૦૦,૦૦૦	
૨. જમા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક		૧૭,૫૪૦
૩. બેંક ઉધારેલ કેન્ટિકાર્ડની ફી		૫,૨૫૦
૪. નકારાયેલ ચેકની નોંધ ફક્ત પાસબુકમાં જ કરેલ છે. પાસબુક મુજબ સિલક	૪૦,૦૦૦	૩૭,૨૦૦
કુલ	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦

ઉદાહરણ - ૩ (પાસબુક મુજબ બાકી)

નીચેની માહિતી પરથી મે. એક્સવાયરેડ લિમિટેડની તા. ૩૧-૭-૧૨ના રોજ બેંક સિલકમેળ તૈયાર કરો.

૧. શરૂઆતમાં પાસબુકની બાકી રૂ. ૭૦,૭૦૦ રૂ.
૨. બેંકમાં જમા કરેલ પરંતુ તા. ૩૧-૭-૧૨ સુધી વસૂલ નહિ થયેલ ચેક રૂ. ૮૫૦૦/-
૩. લખેલ પરંતુ તા. ૩૧-૭-૧૨ સુધી રજુ નહિ થયેલ ચેક રૂ. ૧૨,૫૦૦/-
૪. બેંક રૂ. ૫૦૦૦ ડિવિડન્ડ જમા કર્યું
૫. બેંક ઉધારેલ બેંક ચાર્જસ રૂ. ૪૦૦/-

ઉકેલ

મોડચુલ - ૨

આમ નોંધ અને
પોટા નોંધ



નોંધ

Cash Book, January					
Day	Details	Inflow	Day	Details	Outflow
1	Bank balance	2,400	1	Jewels	220
2	Hospital	1,900	1	Prints	8
3	Love G.	610	6	Movies	900
14	Baby G.	665	6	Wanderland	200
17	Xmas	2,940	18	News paper	500
21	Gas	70	15	Leisure	111
27	Buy Song	124	24	Post	26
31	Fest	1556	28	Logos	214
	Adjusted balance	540	31	Clothes	540

Bank Statement, January					
Day	Details	Inflow	Outflow	Balance	
2	614	120	-	2,384	
3	Cheques received	1560	-	86	
4	625	48	-	1474	
7	12	1800	-	3174	
7	Cheques received	610	-	3174	
9	527	200	-	419	
11	528	1557	-	252	
13	British way	100	-	1328	
15	Cheques received	665	-	1428	
18	529	311	-	569	
18	Cheques received	2340	-	1666	
22	Cheques received	-	58	1608	
23	BC Way	1000	-	1520	
28	Cheques received	98	-	2548	
	Adjusted Cash Book, January				
31	Bank balance	2400	-	0	
31	BC Way	1000	31	British way	100
31	Adjusted balance	3300			

વિગત

મે.એક્સવાયજેડનો તા. ૩૧-૭-૨૦૧૨ના રોજનો બેંક સિલકમેળ

વિગત	ઉમેરો (રૂ.)	બાદ કરો (રૂ.)
૧. પાસબુક મુજબ સિલક	૭૦,૭૦૦	
૨. જમા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક	૮,૫૦૦	
૩. લખેલ, પરંતુ રજૂ નહિ થયેલ ચેક		૧૨,૪૦૦
૪. મળેલ ડિવિડન્ડ		૫,૦૦૦
૫. બેંક ઉધારેલ બેંક ચાર્જ્સ	૪૦૦	
રોકડમેળ મુજબ સિલક		૬૨,૪૦૦
કુલ	૮૦,૦૦૦	૮૦,૦૦૦

ઉદાહરણ - ૪ (પાસબુક મુજબ બાકી)

મે.ટેલીમેક્સ ઇન્ડસ્ટ્રીઝની બેંક પાસ બુક રૂ. ૧,૨૭,૩૪૦ની ઉધાર બાકી તા. ૩૧-૭-૧૨ના રોજ દરશાવે છે. તેજ દિવસની રોકડમેળ અને પાસબુકની બાકીમાં નીચે મુજબના તફાવત જોવા મળ્યા.

- ૧. તા. ૩૧-૭-૧૨ પહેલા રૂ. ૭૮,૦૦૦ના ચેક લખેલ પરંતુ રજૂ થયા નથી.
 - ૨. બે ચેક રૂ. ૫૦૦૦ અને રૂ. ૩૫૦૦ તા. ૩૧-૭-૧૨ના રોજ બેંકમાં જમા કર્યા જે ઓગણ મહિનામાં ઉધાર થશે.
 - ૩. બેંક બારોબાર વીમા ગ્રીમીયમના રૂ. ૫૦૦૦ ચૂકવ્યા
 - ૪. બેંક ભૂલથી રૂ. ૨૦૦૦ જમા કર્યો.
- તે જુલાઈ ૨૦૧૨ના રોજ બેંક સિલકમેળ તૈયાર કરો.

ઉકેલ

મે.ટેલીમેક્સ ઇન્ડસ્ટ્રીઝનો તા. ૩૦-૭-૨૦૧૨ના રોજનો બેંક સિલક મેળ

વિગત	ઉમેરો (રૂ.)	બાદ કરો (રૂ.)
૧. પાસબુક મુજબ સિલક	૧,૨૭,૩૪૦	
૨. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક		૭૮૦૦૦
૩. બેંકમાં ભરેલ ચેક જે ઓગણમાં જમા થશે.	૮૪૦૦	
૪. બેંક ભરેલ વીમા ગ્રીમીયમ	૪૦૦૦	
૫. ભૂલથી બેંક જમા કરેલ તેના રોકડમેળ મુજબ સિલક	૨૦૦૦	૬૩૮૪૦
કુલ	૧,૪૨,૮૫૦	૧,૪૨,૮૫૦

બેંક સિલક મેળ

II. જ્યારે બેંક ઓવર ડ્રાઇટની પરિસ્થિતિ હોય :

જ્યારે પાસબુક અથવા રોકડમેળ મુજબ ઓવરડ્રાફ્ટ હોય તો તેને ઝણખાનામાં (- ખાનામા) લખાય છે કારણ કે તે ઝણાત્મક બાકી છે. અન્ય બાબતો પણ તે જ પ્રમાણે આપેલ ઓવરડ્રાફ્ટમાંથી ઉમેરવામાં કે બાદ કરવામાં આવશે. એટલે એ નોંધવું જોઈએ કે જ્યારે ઓવરડ્રાફ્ટની સિલક ઝણ નોંધવામા આવે છે ત્યારે ઝણખાનામા (બાદ કરો ખાનામા) લખાય છે અને તે બાજુના ખાનામાં દશવિલ તમામ બાબતો તેમાં ઉમેરાય છે અને જે બાબતો ઉમેરોના ખાનામાં આવશે તે આપોઆપ બાદ થઈ જશે.

ઉદાહરણ - ૫ (રોકડમેળ મુજબ ઓવરડ્રાફ્ટ)

નીચેની માહિતી પરથી માનવ ઈન્સ્ટ્રીજ વર્કસનો બેંક સિલકમેળ તા. ૩૧-૭-૨૦૧૨ના રોજ તૈયાર કરો.

૧. તા. ૩૧-૭-૨૦૧૨ના રોજ તૈયાર કરો.
૨. રૂ. ૧૧૫૧ના ચેક લખેલ પરંતુ તા. ૩૧-૭-૧૨ સુધી રજૂ થયેલ નથી.
૩. રૂ. ૮૫૮ના ચેક બેંકમાં જમા કર્યા પરંતુ તા. ૩૧-૭-૧૨ સુધી વસૂલ થયા નથી.
૪. બેંક બેંક ચાર્જસના રૂ. ૪૦ ઉધાર્યા

ઉકેલ :

માનવ ઈન્સ્ટ્રીયલ વર્કસનો તા. ૩૧-૭-૧૨ના રોજનો બેંક સિલકમેળ

વિગત	રકમ (રૂ.)	રકમ (રૂ.)
રોકડમેળ મુજબ ઓવરડ્રાફ્ટ		
૧. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક	૧૧૫૧	૪,૨૮૮
૨. જમા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક		૮૪૮
૩. બેંક ચાર્જસ જે ફક્ત બેંક પાસબુકમાં નોંધેલ છે રોકડમેળમાં નહિ		૪૦
પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ	૪૦૪૬	
કુલ	૫૧૯૭	૫૧૯૭

ઉદાહરણ ૬ : (પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ)

નીચેની માહિતી પરથી અમન એન્ડ સન્સનો તા. ૩૧-૧૨-૧૨ના રોજ બેંક સિલકમેળ તૈયાર કરો.

	રૂ.
૧. પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ રૂ. ૧૦૦૦૦ (તા. ૩૧-૧૨-૧૨)	૧૦,૦૦૦
૨. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક રૂ. ૬૦૦૦/-	૬,૦૦૦
૩. જમા થયેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક રૂ. ૧૮૦૦/-	૧,૮૦૦
૪. બેંક ઉધારેલા ડિવિડન્ડ રૂ. ૫૦૦ જેની નોંધ રોકડમેળમાં થઈ નથી.	૫૦૦
૫. બેંક ચાર્જસના રૂ. ૨૦૦ પાસબુકમાં જમા કર્યા પરંતુ તેની નોંધ રોકડ	૨૦૦

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

મોડચુલ - ૨

આમ નોંધ અને
પોટા નોંધ



નોંધ

બેંક સિલક મેળ

મેળમાં થઈ નથી.	
૬. અમન દ્વારા ઈસ્યુ કરાવેલ બેંક ડ્રાફ્ટ રૂ. ૧૦૦૦ જેની નોંધ રોકડમેળમાં થઈ નથી.	૧,૦૦૦

ઉકેલ

અમન એન્ડ સન્સનો તા. ૩૧-૧૨-૧૨ના રોજનો બેંક સિલકમેળ

વિગત	રકમ (રૂ.)	રકમ (રૂ.)
પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ		૧૦,૦૦૦
ઉમેરો : ૧. બેંકમાં જમા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક	૧,૮૦૦	
૨. બેંક નોંધેલ બેંક ચાર્ટર્સ	૨૦૦	
૩. બેંક ઈસ્યુ કરેલ ડિમાન્ડડ્રાફ્ટ જેની નોંધ રોકડમેળ નથી કરી	૧,૦૦૦	
બાદ કરો : ૧. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક		૬,૦૦૦
૨. બેંક ઉધારેલ ડિવિડન્ડ		૪૦૦
રોકડમેળ મુજબ બાકી	૧૩,૪૦૦	
કુલ	૧૬,૪૦૦	૧૬,૪૦૦

ઉદાહરણ ૭ : (પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ)

નિયેની માહિતી પરથી બેંકસિલકમેળ તૈયાર કરો.

૧. તા. ૩૧-૧૨-૧૨ના રોજ પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ રૂ. ૫૨૦૦/-	૫,૨૦૦
૨. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક રૂ. ૧૨૦૦/-	૧,૨૦૦
૩. બેંક રૂ. ૫૦૦ વ્યાજ વસૂલ કર્યું.	૫૦૦
૪. ઓવરડ્રાફ્ટનું વ્યાજ વસૂલ કર્યું.	૪૩૦
૫. રોકડમેળના બાજુના બેંક ખાનામાં રૂ. ૧૦૦ વધુ ગણોલ છે.	૧૦૦
૬. રોકડમેળના બાજુના બેંક ખાનામાં રૂ. ૪૦ ઓદ્ધા ગણોલ છે.	૪૦
૭. ગ્રાહકની સૂચના પ્રમાણે બેંક રૂ. ૨૦૦૦નો ડ્રાફ્ટ ઈસ્યુ કર્યો.	૨,૦૦૦
૮. બેંક જમા કરેલ પરંતુ રોકડમેળમાં ભૂલથી નહિ નોંધેલ ચેક રૂ. ૬૦૦/-	૬૦૦

ઉકેલ :

તા. ૩૧-૧૨-૧૨ના રોજનો બેંક સિલકમેળ

વિગત	રકમ (રૂ.)	રકમ (રૂ.)
પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ		૫૨૦૦
ઉમેરો : ૧. ઓવરડ્રાફ્ટનું વ્યાજ બેંક વસૂલ્યું	૪૩૦	
૨. રોકડમેળના બેંક ખાનામાં વધુ ગણોલ રકમ	૧૦૦	

બેંક સિલક મેળ

૩. રોકડમેળના બેંક ખાનામાં ઓછી ગણેલ રકમ	૪૦	
૪. બેંક ઈસ્યુ કરેલ ડિમાન્ડડ્રાફ્ટ	૨૦૦૦	
બાદ કરો: ૧. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક	૧૨૦૦	
૨. બેંક વસૂલેલ વ્યાજ	૫૦૦	
૩. બેંક ઉધારેલ પરંતુ રોકડમેળમાં નહિ નોંધેલ ચેક	૬૦૦	
રોકડમેળ મુજબ ઓવરદ્રાફ્ટ	૪૮૩૦	
કુલ	૭૫૦૦	૭૫૦૦

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



ઉદાહરણ ૮ : (રોકડમેળ મુજબ ઓવરદ્રાફ્ટ)

નીચેની માહિતી પરથી બેંક સિલકમેળ તૈયાર કરો.

૧. ત૧મી માર્ચ ૨૦૧૨ના રોજ રોકડમેળ મુજબ ઓવરદ્રાફ્ટ રૂ. ૨૦૦૦/-
૨. કુલ રૂ. ૨૦૦૦૦ના ચેક લખેલ જેમાંથી રૂ. ૧૩૦૦૦ના ચેક માર્ચમાં બેંકમાં રજૂ થયા હતા. ૪૦૦૦ રૂ. ના ચેક એપ્રિલમાં બેંકમાં રજૂ થયા. બાકીના ચેક હજુ સુધી રજૂ થયા નથી.
૩. બેંકમાં રૂ. ૧૫૦૦૦/-ના ચેક જમા કરેલ જેમાંથી રૂ. ૧૧૫૦૦ના ચેકમાર્ચમાં અને રૂ. ૨૦૦૦ના ચેક એપ્રિલમાં વસૂલ થયા. પરંતુ બાકીના ચેક હજુ સુધી વસૂલ થયા નથી.
૪. બેંક રૂ. ૧૫૦૦ના ઓવરદ્રાફ્ટના વ્યાજ પેટે રૂ. ૧૫૦૦ અને બેંક ચાર્ઝ્સ પેટે રૂ. ૧૦૦ વસૂલ્યાં.
૫. બેંક રૂ. ૧૭૦૦ જામીનગારીના વ્યાજના જમા કર્યા.
૬. એક મળવાપાત્ર બિલના રૂ. ૧૦૦૦ (બેંકમાં વટાવ સાથે જાન્યુઆરીમાં) તા. ત૧મી માર્ચના રોજ નકરાયો (જેની નોંધ હજુ સુધી રોકડમેળમાં થઈ નથી.)

ઉકેલ :

તા. ત૧-ત-૨૦૧૨ના રોજનો બેંક સિલકમેળ

વિગત	રકમ (રૂ.)	રકમ (રૂ.)
રોકડમેળ મુજબ ઓવરદ્રાફ્ટ		૨૦૦૦
૧. લખેલ પરંતુ ત૧મી માર્ચ સુધી રજૂ નહિ થયેલ ચેક	૭૦૦૦	
૨. બેંક જામીનગારી પર વ્યાજ ચૂક્યું	૧૭૦૦	
૩. જમા કરેલ પરંતુ ત૧મી માર્ચ સુધી વસૂલ નહી થયેલ ચેક		૩૪૦૦
૪. બેંક ઓવરદ્રાફ્ટનું વ્યાજ અને બેંક ચાર્ઝ્સ		૧૬૦૦
૫. મળવાપાત્ર બિલનો ચેક નકરાયો		૧૦૦૦
પાસબુક મુજબ ઓવરદ્રાફ્ટ		૬૦૦
કુલ	૮૭૦૦	૮૭૦૦

ઉદાહરણ ૯ : (રોકડમેળ મુજબ ઓવરદ્રાફ્ટ)

રામના રોકડમેળ અને પાસબુકની નવેમ્બર મહિનાની તુલના કરતાં નીચેની બાબતો મળી.

૧. રોકડમેળ મુજબ ઓવરદ્રાફ્ટ રૂ. ૪૫૦૦૦/-
૨. રૂ. ૧૭૫૦૦ નો ચેક બચતખાતાનો હતો જે ચાલુ ખાતામાં દશાવિલ હતો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

બેંક સિલક મેળ

૩. રૂ. ૭૦૦૦૦ના ચેક લખેલ જે રોકડમેળમાં નોંધેલ રજૂ થયા નથી.
૪. રૂ. ૬૦૦૦૦ના ચેક બેંકમાં વસૂલાત માટે મોકલેલ જે હજુ જમા થયા નથી. જેની નોંધ રોકડમેળમાં કરેલ છે.
૫. બેંક ચાર્ટસના રૂ. ૧૭૫૦ની નોંધ રોકડમેળમાં કરેલ નથી.
૬. રોકડમેળની વ્યય બાજુ રૂ. ૧૫૦૦ ઓછા ગણેલ હતા.
૭. બેંક ગ્રાહક વતી રૂ. ૩૫૦૦૦ ડિવિડન્ડ વસૂલ કર્યું.

ઉકેલ

તા. ૩૧-૧૧-૨૦૧૨ના રોજની બેંક સિલકમેળ

વિગત	ઉમેરો (રૂ.)	બાદ કરો (રૂ.)
રોકડમેળ મુજબ ઓવરડ્રાફ્ટ		૪૫,૦૦૦
૧. રોકડમેળની વ્યય બાજુ ઓછા ગણેલા		૧,૫૦૦
૨. બચતખાતામાંથી આપેલ ચેક ભૂલથી ચાલુ ખાતામાં દર્શાવ્યો.	૨૭,૪૦૦	
૩. લખેલ પરંતુ રજ નહિ થયેલ ચેક	૭૦,૦૦૦	
૪. જા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક		૬૦,૦૦૦
૫. બેંક ચાર્ટસ		૧,૭૫૦
૬. બેંક ઉઘરાવેલ ડિવિડન્ડ	૩૫,૦૦૦	
પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ		૧૪,૨૪૦
કુલ	૧,૨૨,૫૦૦	૧,૨૨,૫૦૦

ઉદાહરણ ૧૦ : (પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ)

ત૧મી માર્ચ ૨૦૧૨ના રોજ શ્રી જગદીશકુમારની પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ રૂ. ૧૫૦૦૦/- છે. રોકડમેળ સાથે તુલના કરતા જાણવા મળ્યું.

૧. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ રૂ. ૬૦૦/- વસૂલ્યું.
૨. રૂ. ૮૦૦૦૦ના ચેક લખેલ હતા પરંતુ ફક્ત ૮૦૦૦ રૂ. ના ચેક રજૂ થયા.
૩. રૂ. ૪૫૦૦ના ચેક બેંકમાં જમા કરાવ્યા જેમાંથી ફક્ત રૂ. ૫૦૦નો ચેક જમા થયો.
૪. બેંક રોકાણોનું વ્યાજ રૂ. ૬૦૦ વસૂલ કર્યું. અને એક દેવાદારે ખાતામાં રૂ. ૮૦૦ સીધેસીધા જમા કર્યાં.
૫. જગદીશકુમારને રૂ. ૧૨૦૦નો ચેક મળ્યો જે રોકડમેળમાં નોંધ્યો પરંતુ બેંકમાં ભરવાનો ભૂલી ગયા.

બેંક સિલકમેળ તૈયાર કરો.

બેંક સિલિક મેળ

ઉકેલ :

તા. ૩૧-૩-૨૦૧૨ના રોજનો બેંક સિલિકમેળ

વિગત	ઉમેરો (રૂ.)	બાદ કરો (રૂ.)
પાસબુક મુજબ ઓવરટ્રાફટ		
૧. ઓવરટ્રાફટનું વ્યાજ	૫૦૦	૭૫,૦૦૦
૨. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક (રૂ. ૮૦,૦૦૦ - રૂ. ૮,૦૦૦)		૭૨,૦૦૦
૩. જમા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક (રૂ. ૪,૫૦૦ - રૂ. ૫૦૦)	૪,૦૦૦	
૪. બેંક ઉઘરાવેલ વ્યાજ		૫૦૦
૫. સીધેસીધા બેંકમાં ભરેલ રકમ		૫૦૦
૬. રોકડમેળમાં નોંધેલ પરંતુ બેંકમાં નહિ ભરેલ ભરેલ ચેક	૧,૨૦૦ ૮૨,૭૦૦	
રોકડમેળ મુજબ ઓવરટ્રાફટ (કારણ કે બાદ કરો ખાનાનો સરવાળો ઉમેરો કરતાં વધુ છે.)		
કુલ	૮૮,૪૦૦	૮૮,૪૦૦

ઉદાહરણ ૧૧ : (પાસબુક મુજબ ઓવરટ્રાફટ)

તા. ૩૧મી માર્ચ ૨૦૧૨ના રોજ રજતની પાસબુક મુજબ ઓવરટ્રાફટ રૂ. ૫૦૦૦ છે, રોકડમેળ સાથે તુલના કરતાં નીચેની માહિતી મળી.

૧. ૩૧મી માર્ચ ૨૦૧૨ પહેલાં લખેલ રૂ. ૧૮૦૦ના ચેક બેંકમાં ૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ રજૂ થયા.
૨. રૂ. ૮૨૦૦/- ના ચેક જમા કરેલ પરંતુ ૨-૪-૧૨ સુધી જમા થયા નથી.
૩. ઓવરટ્રાફટનું વ્યાજ રૂ. ૧૫૦૦, પરંતુ રોકડમેળમાં નોંધેલ નથી.
૪. બેંક ઉઘરાવેલ રૂ. ૬૦૦૦ ડિવિડના પાસબુકમાં નોંધેલ છે પરંતુ રોકડમેળમાં તેની નોંધ નથી.
૫. લોકરનું ભાડુ રૂ. ૮૦ રોકડમેળમાં નોંધેલ નથી.
૬. રૂ. ૭૮૦૦નો ચેક નકારાયો જેની નોંધ રોકડમેળમાં નથી.

તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ બેંક સિલિકમેળ તૈયાર કરો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પોટા નોંધ



નોંધ

economical Statement

ઉકેલ :

તા. ૩૧-૩-૨૦૧૨ ના રોજનો બેંક સિલકમેળ

વિગત	ઉમરો (રૂ.)	બાં કરો (રૂ.)
પાસખુક મુજબ ઓવરડ્રાફ્ટ		4,000
૧. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક		1,600
૨. જમા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક	1,200	
૩. ઓવરડ્રાફ્ટનું બાજ	1,400	
૪. બેંક ઉધરાવેલ ડિવિન્ડ		6,000
૫. બેંક લોકરનું ભાડું વસૂલ્યું	10	
૬. નકરાયેલ ચેક	9,600	
રોકડમેળ મુજબ ઓવરડ્રાફ્ટ (ઉમરો ખાનાનો સરવાળો બાં કરો કરતાં વધુ છે)		8,600
કુલ	19,480	19,480

ઉદાહરણ ૧૨ : (રોકડમેળ મુજબ ઓવરડ્રાફ્ટ)

૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ એક વેપારીના રોકડમેળ મુજબ ઓવરડ્રાફ્ટ રૂ. ૭૭૦૦ હતો. જ્યારે તેની તુલના પાસખુક સાથે કરી તો નીચે મુજબ માહિતી મળી.

- રૂ. ૩૫૦૦ના ચેક બેંકમાં વસૂલાત માટે મોકલ્યા જેમાંથી ફક્ત રૂ. ૧૦૦૦ના ચેક વસૂલ થયા.
 - સપ્ટેમ્બર મહિના દરમિયાન રૂ. ૬૫૦૦ના ચેક લખેલ જેમાંથી રૂ. ૨૬૫૦ના ચેક રજૂ થયા હતા.
 - રૂ. ૨૦૦૦ નો ચેક મળ્યો જેની નોંધ રોકડમેળમાં કરી પરંતુ બેંકમાં
 - પાસખુકમાં રૂ. ૬૫ બેંક ચાર્જના તથા રૂ. ૩૫ બાજના ઉધાર દરશાવેલ છે.
 - કોઈ દેવાદારે સીધે સીધા બેંકમાં રૂ. ૨૪૦૦ જમા કરાયા. જેની નોંધ રોકડમેળમાં કરી નથી.
 - વેપારીની સૂચના મુજબ બેંક રૂ. ૧૫૦૦ વીમા પ્રીમીયમ ચૂક્યું.
- ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ બેંક સિલકમેળ તૈયાર કરો.

ઉક્લ

તા. ૩૦-૯-૨૦૧૨ના રોજ નો બેંક સિલકમેળ

વિગત	ઉમેરો (રૂ.)	બાદ કરો (રૂ.)
રોકડમેળ મુજબ ઓવરડ્રાફ્ટ		૭,૭૦૦
૧. જમા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક (રૂ. ૩,૫૦૦ - રૂ. ૧,૦૦૦)		૨,૫૦૦
૨. લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક (રૂ. ૬,૫૦૦ - રૂ. ૨,૬૫૦)	૩,૮૪૦	
૩. રોકડમેળમાં નોંધેલ પરંતુ બેંકમાં નહિ ભરેલ ચેક		૨,૦૦૦
૪. બેંક ચાર્ઝ્સ		૬૪
૫. બેંકે ઉધરાવેલ વ્યાજ		૩૪
૬. ગ્રાહકે સીધેસીધી બેંકમાં ભરેલ રકમ	૨,૪૦૦	
૭. વેપારીની સૂચના મુજબ બેંક ચૂકવેલ વીમા પ્રીમીયમ		૧,૪૦૦
પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ (કારણ કે બાદ કરો ખાનાનો સરવાળો ઉમેરો ખાના કરતાં વધુ હતો).	૭,૫૫૦	
કુલ	૧૩,૮૦૦	૧૩,૮૦૦



પાઠગત પ્રશ્નો ૮.૨

- તમને પાસબુકની બાકી અને રોકડમેળની બાકી આપેલ છે. તમારે બંનેની તપાસ કરવાની છે. બધા જ વ્યવહારોમાંથી એવા વ્યવહાર સામે એ લખો જે પાસબુકની બાકીમાં ઉમેરાશે. અને એવા વ્યવહાર સામે બી લખો જે પાસબુકની બાકીમાંથી બાદ થશે.
 - બેંક ચાર્ઝ્સ
 - લખેલ પરંતુ રજૂ નહિ થયેલ ચેક
 - બેંકમાં જમા કરેલ પરંતુ વસૂલ નહિ થયેલ ચેક
- વૈકલ્પિક પ્રશ્નો**
 - બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન સાચુ છે.
 - તે દરેક મહિને તૈયાર કરાય છે.
 - તે દર દર મહિને તૈયાર કરાય છે.
 - તે વર્ષના અંતે તૈયાર કરાય છે.
 - તે સમયાંતરે તૈયાર કરાય છે.
 - જો રોકડમેળ મુજબની બાકી રૂ. ૮૦૦૦ છે. રૂ. ૫૦૦૦ અને રૂ. ૧૮૦૦૦ના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયા નથી તો સિલકમેળ પછી પાસબુકની સિલક



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

બેંક સિલક મેળ

કેટલી હશે ?

- અ) રૂ. ૮૦૦૦ બ) રૂ. ૧૩૦૦૦
ક) રૂ. ૨૩૦૦૦ દ) રૂ. ૩૯૦૦૦

૩. બેંક સિલક મેળ તૈયાર કરતી વખતે પાસબુકની સિલકમાં નીચેના માંથી કઈ વિગત બાદ થશે.
 અ) ચેક જમા થયેલ પરંતુ વસૂલ નહિ થયેલ
 બ) ચેક લખેલ પરંતુ રજૂ નહિ થયેલ
 ક) બેંક ચાર્જસ ડ) બેંક ચૂકવેલ વીમા પ્રીમીયમ
 ૪. બેંક સિલક મેળના સંદર્ભમાં નીચેના માંથી ક્યું વિધાન સાચું છે.
 અ) તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.
 બ) તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે.
 ક) તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.
 ડ) તે ધ્યાનની નાણાંકિય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે.
 ૫. પાસબુક મુજબની જમા સિલક રૂ. ૪૫૦૦ છે અને ગ્રાહકે બારોબાર બેંકના ખાતામાં રૂ. ૨૦૦૦ ભર્યા. જેની નોંધ રોકડમેળમાં થઈ નથી. રોકડમેળ મુજબની સિલક શોધો.
 અ) રૂ. ૬,૪૦૦ બ) રૂ. ૨,૪૦૦
 ક) રૂ. ૬,૪૦૦ (ઓવરાફટ) ડ) રૂ. ૨,૪૦૦ (ઓવરાફટ)



તમે આટલું શીખ્યા :

- પાસબુકની સિલક અને રોકડમેળની સિલક વચ્ચેનો તફાવત દૂર કરવા માટે એક ચોક્કસ તારીખે, કારણો સાથેનું એક વિવરણ સમયાંતરે તૈયાર કરવામાં આવે છે જેને બેંક સિલક મેળ કહેવાય છે.
- બેંક સિલક મેળ એ બેંકની પાસબુકની સિલક અને રોકડમેળના બેંક ખાતાની સિલક વચ્ચેના તફાવત વચ્ચે મેળ બેસાડવા માટે તૈયાર કરવામાં આવતું પત્રક છે. આ પત્રક તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય બંને ખાતા વચ્ચેના તફાવતના કારણો શોધી તેમને સરખા કરવાનો છે.
- રોકડમેળ અને પાસબુક વચ્ચે તફાવતના કારણો.
 - વેપારી દ્વારા લખેલ ચેક હજુ સુધી રજૂ થયા નથી.
 - ચેક બેંકમાં જમા થયા પરંતુ હજુ સુધી બેંક દ્વારા વસૂલ થયા નથી.
 - ગ્રાહક દ્વારો બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ
 - બેંક દ્વારા વસૂલ કરેલ બેંક ચાર્જસ
 - બેંક દ્વારા ઉધરાવેલ વ્યાજ અને ડિવિડન્ડ
 - ગ્રાહકની સૂચનાથી બેંક ચૂકવેલ ખર્ચ
 - નકારાયેલ ચેક, બિલો
 - પેટી દ્વારા વ્યવહાર નોંધવામાં થયેલ ભૂલ
 - બેંક દ્વારા થયેલ ભૂલ



સ્વાધ્યાયના પ્રશ્નો :

૧. બેંક સિલકમેળ એટલે શું ?
૨. બેંક સિલકમેળ તૈયાર કરવાની આવશ્યકતા / જરૂરિયાત શા માટે છે ?
૩. રોકડમેળ ને પાસબુકની બાકી વચ્ચેના તફાવતના કારણો જણાવો.
૪. નીચેની માહિતી પરથી ત૧ મી ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ બેંકસિલકમેળ તૈયાર કરો.
 - (અ) રોકડમેળ મુજબની સિલક રૂ. ૪૨૦૦ હતી.
 - (બ) રૂ. ૨૦૦૦ના ચેક લખેલ પરંતુ રજૂ થયા નથી.
 - (ક) રૂ. ૩,૦૦૦ ના ચેક જમા કર્યો પરંતુ વસૂલ થયા નથી.
 - (ઢ) બેંક બેંક ચાર્ચસના રૂ. ૨૫૦ ઉધાર્યા.
૫. ત૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજ બેંક સિલક મેળ તૈયાર કરો. મેસર્સ બિરલા ઇન્ડસ્ટ્રીઝની પાસબુક મુજબ તે ડિવસની સિલક રૂ. ૨૭૫૦૦ હતી.
 - (અ) ગ્રાહકે બારોબાર રૂ. ૧૪૦૦૦ના ચેક બેંકમાં જમા કરાવ્યા.
 - (બ) રૂ. ૧૩૫૦૦ના ચેક માર્ચ મહિનામાં લખેલ તેમાંથી રૂ. ૧૫૦૦ના ચેક માર્ચના અંત સુધી રજૂ થયા નથી.
 - (ક) રૂ. ૨૫૦૦નું ડિવિડન્ડ બેંક વસૂલ કર્યું.
 - (ઢ) રૂ. ૧૭૫૦૦ના ચેક બેંકમાં વસૂલ કરવા માટે મોકલ્યા જેમાંથી રૂ. ૮૫૦૦ના ચેક એપ્રિલ મહિનામાં વસૂલ થયા.
૬. નીચેની વિગતો પરથી અદાણી ઇન્ડસ્ટ્રીયલવર્કસની ત૧ જાન્યુઆરી ૨૦૧૨ ના રોજ પાસબુકમાં દર્શાવેલ વિગતોની ચકાસણી કરો.
 - (અ) રોકડમેળ મુજબ ત૧ મી જાન્યુઆરી ૨૦૧૨ ના રોજ રૂ. ૪૦૦૦ સિલક હતી.
 - (બ) રૂ. ૧૦૦૦ના ચેક લખેલ પરંતુ ત૧ મી જાન્યુઆરી, ૨૦૧૨ પહેલાં રજૂ થયા નથી.
 - (ક) રૂ. ૮૦૦ના ચેક બેંકમાં જમા કરેલ પરંતુ ત૧ મી જાન્યુઆરી, ૨૦૧૨ પહેલા વસૂલ થયા નથી.
 - (ઢ) રૂ. ૪૦૦ બેંક ચાર્ચસ પાસબુકમાં ઉધારેલ છે.
૭. ત૧ મી માર્ચ ૨૦૧૨ ની નીચેની માહિતી પરથી બેંકસિલકમેળ તૈયાર કરો.
 - (અ) રોકડમેળ મુજબ ઓવરાઇટ રૂ. ૧૨,૫૦૦ હતું.
 - (બ) રૂ. ૧૮૦૦૦ ના ચેક લખેલ પરંતુ રજૂ થયા નથી.
 - (ક) રૂ. ૨૪૦૦૦ના ચેક બેંકમાં જમા કરેલ પરંતુ ત૧ મી માર્ચ ૨૦૧૨ સુધી વસૂલ થયા નથી.
 - (ઢ) બેંક ચાર્ચસ રૂ. ૧૫૦૦ છે.
૮. ૩૦ મી જૂન ૨૦૧૨ ના રોજ રોકડમેળના બેંક ખાનાની જમા સિલક રૂ. ૧૪૮૦૦૦ હતી. રોકડમેળ અને પાસબુકની તુલના કરતાં નીચે મુજબની માહિતી મળી.
 ૧. શ્યામનો રૂ. ૮૦૦૦નો ચેક અને મોહિનીનો રૂ. ૧૫૦૦૦ નો ચેક જમા કર્યો પરંતુ ૩૦ જૂન ૨૦૧૨ સુધી વસૂલ થયો નથી.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

બેંક સિલક મેળ

૨. રામ એક દેવાઈાર છે. તેણે બારોબાર બેંકમાં રૂ. ૮૦૦૦નો ચેક જમા કર્યો.
 ૩. બેંક વ્યાજના રૂ. ૧૫૦ મંજૂર કર્યા.
 ૪. રૂ. ૧૦૦૦૦ના ચેક રાખેને લખેલ પરંતુ રજૂ થયા નથી.
 ૫. બેંક રૂ. ૮૦૦૦ વીમા પ્રીમીયમ ચૂકવ્યું.
 ૬. બેંક બેક ચાર્ઝસના રૂ. ૭૦૦ ઉધાર કર્યા.
- તમારે તા. ૩૦ જૂન ૨૦૧૨ ના રોજની બેંક સિલકમેળ તૈયાર કરવાની છે.
૭. અરુણની બેંક પાસબુકમાં તા. ૩૧-૩-૧૨ની સિલક શોધવા માટે નીચેની માહિતી પરથી બેંક સિલકમેળ તૈયાર કરો.
 ૧. ૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ રોકડમેળ મુજબ બેંક ઓવરાફટ રૂ. ૬૦,૨૦૦ હતો.
 ૨. પાસબુકમાં ૩૧ મી માર્ચ ૨૦૧૨ના અંતમાં ઓવરાફટ ૫૨૬ માહિનાનું વ્યાજ રૂ. ૧૦૦૦૦ વસૂલવ્યું.
 ૩. રૂ. ૧૩૦૦ બેંક ચાર્ઝસના પાસબુકમાં ઉધાર કર્યા.
 ૪. રૂ. ૧૦,૬૨૦ ચેક લખેલ પરંતુ તા. ૩૧-૩-૧૨ પહેલા રજૂ થયા નથી.
 ૫. રૂ. ૧૬,૪૦૦ ના ચેક બેંકમાં જમા કર્યા પરંતુ ૩૧-૩-૧૨ સુધી વસૂલ થયા નથી.
 ૯૦. નીચેની માહિતી પરથી તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ બેંક સિલકમેળ તૈયાર કરો.
 ૧. તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ પાસબુક મુજબ ઓવરાફટ રૂ. ૧૦૨૬૬ હતો.
 ૨. ૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ રૂ. ૧૨૦, રૂ. ૧૦૨૧૧, રૂ. ૮૮૧ અને રૂ. ૧૧૨૮ના ચેક લખેલ પરંતુ ર એપ્રિલ ૨૦૧૨ સુધી રજૂ થયા નહોતા.
 ૩. બેંક ઓવરાફટનું વ્યાજ રૂ. ૧૫૧૦ રોકડમેળમાં નોંધેલ નથી.
 ૪. રૂ. ૨૧૦૦૦ના બહારગામના ચેક ૩૧ મી માર્ચ બેંકમાં જમા કર્યા પરંતુ તે એપ્રિલમાં વસૂલ થશે.
 ૫. ગ્રાહકની સૂચના મુજબ બેંક ૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ રૂ. ૧૦૦ ચેમ્બર ઓફ કોમર્સના લવાજમના ચૂકવ્યા જેની નોંધ રોકડમેળમાં થઈ નથી.
 ૬. રૂ. ૨૫૦૦ની એક હૂંડી ૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ પાકતી હતી. જેને ૨૮ મી માર્ચના રોજ વસૂલાત માટે બેંકમાં મોકલી જેની નોંધ રોકડમેળમાં કરી હતી. પરંતુ પાસબુકમાં ર જ એપ્રિલ ૨૦૧૨ સુધી જમા થઈ નથી.
 ૭. નીચેની માહિતી પરથી બેંક સિલકમેળ તૈયાર કરો.
- ૩૧ મી ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ રૂ. ૭૫૦નો ઓવરાફટ મારી પાસબુક મુજબ છે. મેં રૂ. ૨૫૦ ના ચેક લખેલા હતા. જેમાંથી માત્ર રૂ. ૨૦૦ના ચેક વસૂલાત માટે રજૂ થયા હતા. રૂ. ૧૦૦ના ચેક ૩૦ મી ડિસેમ્બરે જમા કરાવ્યા હતા. જેમાંથી રૂ. ૭૫ જ પાસબુકમાં જમા થયા હતા. મેં રૂ. ૧૦નો એક ચેક જે મારા રોકડમેળના બેંક ખાનામાં ઉધાર કરી દીધો હતો. પરંતુ બેંકમાં મોકલવાનો ભૂલી ગયો. બેંક રૂ. ૨૫ વ્યાજના પાસબુકમાં ઉધાર કર્યા હતા. ગ્રાહકે બારોબાર રૂ. ૩૦ બેંકમાં જમા કરાવ્યા. બેંક રોકાણોના વ્યાજના રૂ. ૬૦ મારા ખાતામાં જમા કર્યા છે.
૮. રીટા એન્ડ સન્સની પાસબુકમાં તા. ૩૧-૫-૨૦૧૨ના રોજ સિલક રૂ. ૮૫૦૦ હતી. રૂ. ૨૭૫૦ના ચેક ૨૭ મી મે ના રોજ બેંકમાં જમા કરાવ્યા પરંતુ તેમાંથી રૂ. ૫૧૦ નો

બેંક સિલક મેળ

ચેક રજી જુને જમા થયો. અને રૂ. ૧૫૦નો એક ચેક પમી જુને નકારાયો જે પરત આવ્યો. રૂ. ૬૦૦૦ના ચેક લખેલ પરંતુ રજૂ થયા નથી. રૂ. ૧૫૦૦નું એક બિલ બેંક ચૂકવ્યુ જેની નોંધ રોકડમેળમાં થઈ નથી. રોકડમેળમાં બેંક ખાતાની જમા બાજુનો સરવાળો રૂ. ૧૦૦ ઓછો હતો. પ્રીતી બ્રહ્સ્પતી એક પેઢી છે જેને તાર ટ્રાન્સફર મારફતે રૂ. ૪૦૦૦ મોકલવા વિનંતી કરેલ પરંતુ તેણે માત્ર રૂ. ૨૫૦૦ મોકલવાયા જેની રોકડમેળમાં નોંધ થઈ નથી.

રોકડમેળ મુજબ સિલક શોધો અને તા. ૩૧-૫-૨૦૧૨ની રોકડમેળની સાચી સિલક નક્કિ કરો.

૧૩. ત૦મી જૂન ૨૦૧૨ના રોજ એક વેપારીએ તેના રોકડમેળની સિલક રૂ. ૫૮૨૦ સાથે બંધ કરી. જ્યારે તેણે તેના રોકડમેળની સાથે બેંક સ્ટેટમેન્ટની સરખામણી કરી તો જાણવા મળ્યું કે -

૧. રૂ. ૨૨૦૦ના ચેક બેંકમાં જમા કર્યા પરંતુ હજુ સુધી વસૂલ થયા નથી.
૨. રૂ. ૧૬૦૦ના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયા નથી.
૩. બેંક ડિવિડના રૂ. ૩૮૦ વસૂલ/જમા કર્યા પરંતુ રોકડમેળમાં નોંધેલ નથી.
૪. બેંક ચાર્જસના રૂ. ૪૦ રોકડમેળમાં નોંધેલ નથી.
૫. એક બિલના રૂ. ૨૫૦૦ બેંક નોંધા જેની નોંધ રોકડમેળમાં રૂ. ૧૦૦ના વટાવ વગર જ કરેલ છે.

ઉપરોક્ત માહિતી પરથી બેંક સિલકમેળ તૈયાર કરો.

૧૪. નીચેની માહિતી પરથી ત૧મી માર્ચ ૨૦૧૨ના રોજ બેંક સિલકમેળ તૈયાર કરો. અને સાચી સિલક જાણવા માટે રોકડમેળમાં જરૂરી નોંધ કરો.

૧. પાસબુક મુજબ બેંક સિલક (ઓવરડ્રાફ્ટ) રૂ. ૩૦૦૦
૨. રૂ. ૨૦૦૦નો ચેક ૨૮મી માર્ચ ૨૦૧૨ના રોજ પાસબુકમાં જમા થયો હતો ત્યારબાદ ચેક નકારાયો. અને ૧ લી એપ્રિલ ૨૦૧૨ના રોજ પાસબુકમાં ઉધાર થયો. નકારાયેલ ચેકની રોકડમેળમાં આ તારીખોમાં કોઈ જ નોંધ નથી.
૩. બેંક રૂ. ૧૦૦૦ બાજુના વસૂલ કરી પાસબુકમાં જમા કર્યા પરંતુ ત૧મી માર્ચ ૨૦૧૨ સુધી રોકડમેળમાં તેની કોઈ નોંધ નથી.
૪. રૂ. ૨૫૦૦૦ના ચેક બેંકમાં ત૧મી માર્ચના રોજ બહારંચી ગયા જે ત૭મી એપ્રિલ ૨૦૧૨ના રોજ પાસબુકમાં જમા થયા.
૫. ૨૮મી માર્ચ ૨૦૧૨ના રોજ રૂ. ૮૦૦૦નો અને રૂ. ૨૦૦૦નો ચેક લખ્યો જે બેંકમાં ત૭મી એપ્રિલ ૨૦૧૨ના રોજ રજૂ થયો.
૬. બેંક ભૂલથી પાસબુકમાં રૂ. ૫૦૦ જમા અને રૂ. ૨૦૦ ઉધાર કર્યા અને રોકડમેળમાં ત૧મી માર્ચ ૨૦૧૨ સુધી તેની કોઈ નોંધ નથી.



પાઠંતર પ્રશ્નોના ઉત્તર :

૧. ૧. (૧) બ (૨) ક (૩) અ
૨. (૧) પાસબુક (૨) ઉધાર બાજુ (૩) મેળવવા

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

બેંક સિલક મેળ

૩. (૧) ખોડુ (૨) સાચુ (૩) ખોડુ (૪) સાચુ
- ૮.૨ ૧. (૧) એ (૨) બી (૩) એ
 ૨. (૧) d (૨) d (૩) b (૪) c (૫) c



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

૪. પાસબુક મુજબ સિલક રૂ. ૨૮૫૦
૫. રોકડમેળ મુજબ સિલક રૂ. ૧૮૦૦૦
૬. પાસબુક મુજબ સિલક રૂ. ૪૬૦૦
૭. પાસબુક મુજબ ઓવરાફટ રૂ. ૨૦૦૦૦
૮. પાસબુક મુજબ સિલક રૂ. ૧,૩૫,૮૦૦
૯. પાસબુક મુજબ ઓવરાફટ રૂ. ૬૬,૩૮૦
૧૦. રોકડમેળ મુજબ ઓવરાફટ રૂ. ૨,૪૦૪
૧૧. રોકડમેળ મુજબ ઓવરાફટ રૂ. ૮૩૦
૧૨. રોકડમેળ મુજબ સિલક રૂ. ૨૨૬૦
૧૩. પાસબુક મુજબ સિલક રૂ. ૫૪૬૦
૧૪. રોકડમેળ મુજબ સિલક રૂ. ૧૭૩૦૦

તમારી માટે પ્રવૃત્તિ :

- તમારી આજુબાજુની ધંધકીય પેટીઓ જુઓ. તેમની પાસબુક સાથે રોકડમેળના બેંકખાનાની સરખામણી કરો. એવી નોંધો શોધો જે રોકડમેળ માંતો છે પણ પાસબુકમાં નથી અને પાસબુકમાં છે પણ રોકડમેળમાં નથી. આ બધી બાબતોની તેની રકમ સાથેની એક યાદી તૈયાર કરો.



C

ખરીદ અને વેચાણ નોંધ

પાછલા પ્રકરણમાં તમે ભાગી ગયા કે આમનોંધ કે ખાસ આમનોંધ અને મુખ્ય આમનોંધમાં વળ્ણીકૃત કરી શકાય છે. ખાસ આમ નોંધનો ચોપડો વિશિષ્ટ ઉદ્દેશ્ય આમનોંધનો ચોપડો પણ કહેવાય છે. આ પ્રકરણમાં તમે અલગ-અલગ પ્રકારની વિશિષ્ટ આમનોંધ / નોંધ વિષે ભણણો, જેમ કે ખરીદનોંધ, ખરીદપરત નોંધ, વેચાણનોંધ, વેચાણપરત નોંધ, કોઈપણ વ્યવસાયમાં આ આમનોંધને અન્ય જુદી જુદી નોંધમાં જરૂરિયાત મુજબ વિભાગીત કરી શકાય છે. પરંતુ આ બાબત તેની ઉપર આધાર રાખે છે કે સમાન પ્રકૃતિવાળા વ્યવહાર બહુજ મોટી સંખ્યામાં હોય તેમજ આ વ્યવહાર વારંવાર થતા હોય.



હેતુઓ :

આ પ્રકરણનો અભ્યાસ કર્યા પછી તમે :-

- ખરીદ નોંધ અને ખરીદપરત નોંધનો અર્થ જાણી શકશો.
- ખરીદનોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરી શકશો.
- વેચાણ નોંધ અને વેચાણપરત નોંધનો અર્થ જાણી શકશો અને
- વેચાણનોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરી શકશો.

9.1 ખરીદ નોંધ અને ખરીદપરત નોંધનો અર્થ :-

જો તમારી પેઢી ઘણી મોટી માત્રામાં માલની ઉધાર ખરીદી કરે છે તો તમારી પેઢી માટે ઉધાર માલની ખરીદી સાથે સંકળાયેલ બધાજ વ્યવહારોની નોંધ માટે આમનોંધ ના મૂળ ચોપડાના બદલે ખરીદનોંધનો ચોપડો જાળવવો યોગ્ય રહેશે. માલની રોકડ ખરીદીના વ્યવહારોની નોંધ ખરીદનોંધમાં થતી નથી. પરંતુ રોકડમેળમાં થાય છે. તેવી જ રીત વેચાણ માટે નથી ખરીદેલ ઉધાર માલની નોંધ પણ ખરીદનોંધમાં થતી નથી પરંતુ વ્યક્તિગત નોંધમાં નોંધ થાય છે.

જ્યારે માલની ઉધાર ખરીદી કરવામાં આવે છે તો માલ પુરો પાડનાર વેપારી દ્વારા આપવામાં આવેલ ઈનવોઈસ / મળેલ બિલ હોય છે. આ ઈનવોઈસ / બિલમાં વ્યવહાર સાથે સંબંધિત સુચનાઓનું વિસ્તૃત વિવરણ આપવામાં આવેલ છે. તે છે : ખરીદેલ માલનું વિસ્તૃત વિવરણ, ભાવપત્રક, અલગ-અલગ પ્રકારના વટાવ (જો હોય તો), જુદા જુદા ખર્ચ, ચોખ્ખી ચુકવવાની રકમ, તારીખ, ઈનવોઈસ / બિલનો નંબર વગેરે. આનાથી ખરીદનોંધમાં નોંધ કરવા માટેની જરૂરી માહિતી ઈનવોઈસ / બિલમાંથી મળી રહે છે. ખરીદનોંધનો નમૂનો નીચે મુજબ છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ખરીદ અને વેચાણ નોંધ

ખરીદનોંધ

તારીખ નંબર	ઈન્વોઇસ નંબર	વાઉચર નંબર	વિગત (માલ પૂરો પાડનાર વેપારીનું નામ)	ખા.પા. ન.	વિગતો રૂ.	કુલ રૂ.

ખરીદનોંધના ઉપરોક્ત ખાનાઓની સમજૂતી નીચે મુજબ છે.

તારીખ : આ ખાનામાં વ્યવહારની તારીખ, મહિનો અને વર્ષ ક્રમમાં લખાય છે.

ઈન્વોઇસ નંબર : આ ખાનામાં ઈન્વોઇસ / બિલનો નંબર લખાય છે.

વાઉચર નંબર : આ ખાનામાં વાઉચરનો નંબર લખાય છે.

વિગત (વેપારીનું નામ) : આ ખાનામાં જે વેપારી પેઢી પાસેથી માલ ખરીદ્યો છે તેનું નામ લખાય છે. આ નામ ઘાટા અક્ષરે લખાય છે અથવા તો તેને રેખાંકિત કરવામાં આવે છે. તેની નીચે ખરીદેલ માલની ક્રમ મુજબ વિસ્તૃત માહિતી આપવામાં આવે છે.

ખા.પા. ન. : આ ખાનામાં વેપારી પેઢીની ખાતાવહી અથવા ખાતાનો પાના નંબર લખાય છે જે દરેક સંદર્ભના હેતુ માટે હોય છે.

વિગતો : આ ખાનાની કુલ રકમમાંથી વેપારી દ્વારા આપવામાં આવેલા વેપારી વટાવ ને બાદ કરવામાં આવે છે. વેપારી વટાવ (જો હોય તો) બાદ કરીને ચોખ્ખી રકમ મળે તેને આ ખાનામાં લખાય છે.

રકમ : વેપારીને ચૂકવવાની ચોખ્ખી રકમને યોગ્ય અલગાણમાં આ ખાનામાં દર્શાવાય છે, જેવી રીતે ઈન્વોઇસ / બિલમાં દર્શાવેલ હોય છે.

નોંધ : ખરીદીની ચોખ્ખી રકમની ગણતરી કર્યા પછી વેચાણકર્તા દ્વારા લગાડવામાં આવતો વેચાણવેરો / VAT (વેટ)ને પણ ચૂકવવાપાત્ર ચોખ્ખી રકમમાં ઉમેરવામાં આવે છે. જો કોઈ પેકેજનો ખર્ચ વેચાણકર્તા દ્વારા કરવામાં આવ્યો હોય તો તેનો પણ સમાવેશ આ ચોખ્ખી ચૂકવવાપાત્ર રકમમાં કરવામાં આવે છે.

ઉદાહરણ-૧

સોનુ ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ, નવી દિલ્હીના નીચેના વ્યવહારો પરથી ખરીદનોંધ તૈયાર કરો.

2012

જાન્યુઆરી-4 મલિક ડીલર્સ, દિલ્હી પાસેથી ઉધાર માલ ખરીદ્યો

100 ટેબલ ફેન દરેક રૂ.300 લેખે

ખરીદ અને વેચાણ નોંધ

	50 ટયુબલાઈટ દરેક રૂ.25 લેખે
	40 ઈલેક્ટ્રીકની ઈસ્ટ્રી દરેક રૂ.60 લેખે
	વેપારી વટાવ 20%
જાન્યુઆરી 11	જાવા ઈલેક્ટ્રીક સ્ટોર, ગાળિયાબાદ પાસેથી ઉધાર માલ ખરીયો
	20 સિલીગ ફેન દરેક રૂ.500 લેખે
	50 હિટર દરેક રૂ.80 લેખે
	20 મિક્સર દરેક રૂ.1000 લેખે
	વેપારી વટાવ 10%
	વેચાણ વેરો 12%
જાન્યુઆરી 14	જ્યાહિંદ ટ્રેડર્સ, નવી દિલ્હી પાસેથી ઉધાર માલ ખરીયો.
	20 ડાન બલ્બ એક ડાનના રૂ.50 લેખે
	10 ડાન લેમ્પ એક ડાનના રૂ.40 લેખે
	ઉમેરો : પેકિંગ ખર્ચ રૂ.15
જાન્યુઆરી 25	આશા ઈલેક્ટ્રીક ઓપ્લાયન્સીસ, ફરીદાબાદ પાસેથી માલ ખરીયો.
	5 વોશીગ મશીન રૂ.1200 પ્રતિ નંગ લેખે રોકડા ચુક્ક્યા.
જાન્યુઆરી 31	બાબુ ફર્નિચર હાઉસ પાસેથી ઉધાર માલ ખરીયો.
	8 ખુરશી દરેક રૂ.80 લેખે
	2 ટેબલ દરેક રૂ.500 લેખે.

ઉકેલ

ખરીદનોંધ

તારીખ 2012	ઈન્વોર્સ નં.	વાર્ષિક નં.	વિગત(માલ પૂરો પાડનાર વેપારીનું નામ)	ખા.પા. નં.	વિ.વિવરણ (રૂ.)	કુલ રકમ (રૂ.)
જાન્યુ. 04			મલિક કીલર્સ, દિલ્હી 100 ટેબલ ફેન દરેક રૂ.300 લેખે 50 ટયુબલાઈટ દરેક રૂ.25 લેખે 40 ઈલેક્ટ્રીકની ઈસ્ટ્રી દરેક રૂ.60 લેખે બાદ : વેપારી વટાવ 20%		30,000 1,250 2,400 33,650 6,730	26,920

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ખરીદ અને વેચાણ નોંધ

જાન્ય.11		જાવા ઇલેક્ટ્રોિક સ્ટોર, ગાજિયાબાદ 20 સિલીગ ફેન દરેક રૂ.500 લેખે 50 હિટર દરેક રૂ.80 લેખે 20 મિક્સર દરેક રૂ.1000 લેખે બાદ:વેપારી વટાવ 10% ઉમેરો:વેચાણ વેરો 12%		10,000 4,000 20,000 34,000 3,400 30,600 3,672 1,000 400 1,400 15 62,607	
જાન્ય.14		જથીહંદ ટ્રેડર્સ, નવી દિલ્હી 20 ડાન બલ્બ એક ડાનના રૂ.50 લેખે 10 ડાન લેભ્પ એક ડાનના રૂ.40 લેખે ઉમેરો : પેકિંગ ખર્ચ રૂ.15		34,272	
જાન્ય. 31		ખરીદખાતે	3.	1,415	

- નોંધ :
- આ ખરીદનોંધમાં રોકડ ખરીદીની નોંધ કરવામાં આવતી નથી. તેથી જ 25મી જાન્યુઆરી એ જે રોકડેથી માલ ખરીદ્યો છે તેની નોંધ કરી નથી.
 - આ ખરીદનોંધમાં મિલકતની ખરીદીની નોંધ થતી નથી તેથી જ 31મી જાન્યુઆરીએ ખરીદેલ ફર્નિચરની નોંધ આમાં કરી નથી.
 - મિલમાં પેકિંગ, માલનો રવાના ખર્ચ અને અન્ય ખર્ચ ઉમેરાય તે પહેલાં વેપારી વટાવની ગણતરી કરી તેને બાદ કરી દેવો જોઈએ.

ખરીદનોંધ અથવા ખરીદ આમનોંધમાંથી ખાતાવહીમાં ખતવણી :

ખરીદનોંધ / આમનોંધની જરૂરી વિગતોની ખાતાવહીમાં માલ પૂરો પાડનાર વેપારીના ખાતાની જમાબાજુ એ દરરોજ ખતવણી કરવામાં આવે છે, જેમાં ૨૫મ, તારીખ અને વિલનો નંબર લખવામાં આવે છે. તેમજ ખરીદનોંધનો પાના નંબર પણ ખાતાવહીના યોગ્ય ખાનામાં લખાય છે. ખાતાવહીમાં નોંધેલ દરેક વ્યવહારની સંબંધિત વેપારીના ખાતામાં ખતવણી કરવી અનિવાર્ય છે. આમ, ખરીદનોંધમાં નોંધેલ દરેક ઉધાર ખરીદીની સંબંધિત લેણદારના ખાતામાં જમાબાજુ 'ખરીદ ખાતે' લખીને ખતવણી થાય છે. મહિનાના અંતે ખરીદનોંધનો કુલ સરવાળો ખાતાવહીમાં ખરીદખાતાની ઉધારબાજુ વિગતના ખાનામાં 'ખરીદનોંધ મુજબ જુદી જુદી ખરીદી' તરીકે લખાય છે.

ખરીદનોંધની ખાતાવહીમાં ખતવણીને સમજવા માટે અગાઉના ઉદાહરણ-૧ને લઈએ.

ખાતાવહી

ઉધાર		મલિક ગીલર્સ				જમા	
તારીખ	વિગત	ખા.પા. નં.	ર ક મ રૂ.	તારીખ	વિગત	ખા.પા. નં.	ર ક મ રૂ.
2012				2012			

ખરીદ અને વેચાણ નોંધ

જાન્યુ.04 ખરીદ ખાતે

26,920

ઉધાર

જાવા ઈલેક્ટ્રોિક સ્ટોર

જમા

તારીખ	વિગત	ખા.પા. ન.	ર ક મ રૂ.	તારીખ	વિગત	ખા.પા. ન.	ર ક મ રૂ.
2012				2012 જાન્યુ.11	ખરીદ ખાતે		34,272

ઉધાર

જ્ય હિંદ ટ્રેડર્સ

જમા

તારીખ	વિગત	ખા.પા. ન.	ર ક મ રૂ.	તારીખ	વિગત	ખા.પા. ન.	ર ક મ રૂ.
2012				2012 જાન્યુ.31	ખરીદખાતે		1415

ઉધાર

ખરીદ ખાતે

જમા

તારીખ	વિગત	ખા.પા. ન.	ર ક મ રૂ.	તારીખ	વિગત	ખા.પા. ન.	ર ક મ રૂ.
2012 જાન્યુ.31	ખરીદનોંધ મુજબ વિવિધ			2012 ખરીદી			62,607

ખરીદપરત નોંધ અથવા રીટર્ન આઉટવર્ડ બુક અથવા ખરીદ પરત આમનોંધ : કયારેક - કયારેક વેપારી પાસેથી ખરીદેલ માલને જુદા જુદા કારણો જેવા કે, માલ બગડી જવો, રસ્તામાં તુકસાન થવું અથવા ઓર્ડર મુજબનો માલ ન હોય તો માલ પરત કરવામાં ઓ છે. તેના માટે એક ઉધાર ચિઠી તૈયાર કરવામાં આવે છે, જેને વેપારી ને મોકલવામાં આવે છે. તેમાં પરત સંપૂર્ણ અથવા થોડા ભાગમાં કરવામાં આવેલ માલની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. જેના આધારે તે નોંધ કરી શકે છે. જો ખરીદ પરતની સંખ્યા ઓછી હોય તો તેની નોંધ મુખ્ય આમનોંધમાં જ કરવામાં આવે છે. પરંતુ જો ખરીદ પરત મોટી સંખ્યામાં હોય તો તેની નોંધ ખરીદ પરત નોંધમાં કરવામાં આવે છે. ખરીદ પરત નોંધનો નમૂનો આ પ્રમાણે છે.

ખરીદ પરત નોંધ

તારીખ	વિગત	ઉધાર ચિઠી નંબર	ખા.પા. ન.	વિગત રૂ.	કુલ રકમ રૂ.
				રૂ.	રૂ.

ઉપરોક્ત ખરીદ પરત નોંધના ખાના / સંભનું વિવરણ નીચે મુજબ છે.

તારીખ : આ ખાનામાં વ્યવહારોની નોંધ વર્ષ, મહિનો, તારીખ ક્રમાનુસાર કરવામાં આવે છે.

વિગત(વેપારીનું નામ) : આ ખાનામાં જે વેપારીને માલ પરત કર્યો છે તેમનું નામ લખવામાં આવે છે.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડિયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

revenue and sales

ઉધાર ચિઠી નંબર : આ ખાનામાં ઉધાર ચિઠીનો નંબર લખાય છે.

વિગત : આ ખાનામાં વેપારી વટાવ બાદ કર્યા પછી મળતી ચોખ્ખી રકમ લખાય છે. જેના સંદર્ભ માટે નોંધ કરવામાં આવે છે.

રકમ : રકમના ખાનામાં વેપારી પાસેથી વસૂલ કરવાની ખરીદ પરતની ચોખ્ખી રકમ લખાય છે.

ઉદાહરણ - ૨

નીચેના વ્યવહારોની ખરીદપરત નોંધમાં નોંધ કરો.

2012

માર્ચ 09 બાલાજીને માલ પરત કર્યો રૂ.1900

માર્ચ 11 નમૂના મૂજબનો માલ ન હોવાથી કિશનલાલને માલ પરત કર્યો રૂ.1400

માર્ચ 28 બિલમાં ભૂલ હોવાથી મહાવીર એન્ડ બ્રાંડ્સ રૂ.200નો દાવો કર્યો

માર્ચ 31 મદનલાલ એન્ડ સન્સ, દિલ્હીને રૂ.1700નો માલ પરત કર્યો

વેપારી વટાવ ૧૦૮૫

ઉકેલ :

ખરીદપરત નોંધ

તારીખ	વિગત	ઉ.ચિ. નં.	ખા.પા. નં.	વિસ્તૃત વિવરણ રૂ.	કુલ રકમ
2012					
માર્ચ 09	બાલાજી				1900
માર્ચ 11	કિશનલાલ				1400
માર્ચ 28	મહાવીર એન્ડ બ્રાંડ્સ				200
માર્ચ 31	મદનલાલ એન્ડ સન્સ, દિલ્હી			1700	
	બાદ : વેપારી વટાવ			170	
માર્ચ 31	ખરીદ પરત ખાતે	જમા			5030

ખરીદપરત નોંધ / આમનોંધની ખાતાવહીમાં ખતવણી :

ખરીદ પરત નોંધની વિગતો આમ નોંધમાં સંબંધિત વેપારીના ખાતામાં ઉધાર બાજુ જ્યારે માલ પરત કરાય ત્યારે ખતવણી કરવામાં આવે છે. જેમાં રકમ, તારીખ અને ઉધારચિઠી નંબર લખાય છે. ખરીદ પરત નોંધનો પણ ખાતાવહીના સંબંધિત ખાનામાં લખાય છે. મહિનાના અંતે ખાતાવહીમાં 'ખરીદપરત ખાતે જમા બાજુ પર ખરીદપરત નોંધની કુલ રકમની ખતવણી કરવામાં આવે છે. જેની નોંધ વિગતના ખાનામાં 'ખરીદપરત નોંધ મુજબની વિવિધ પરત' લખી કરવામાં આવે છે.

ખાતાવહી

ઉધાર		બાલાજી				જમા	
તારીખ	વિગત	ખા.પા. ન.	રકમ ર.	તારીખ	વિગત	ખા.પા. ન.	રકમ ર.
2012 માર્ચ.09	ખરીદપરત ખાતે		1900	2012			

ઉધાર		કિશનલાલ				જમા	
તારીખ	વિગત	ખા.પા. ન.	રકમ ર.	તારીખ	વિગત	ખા.પા. ન.	રકમ ર.
2012 માર્ચ.12	ખરીદપરત ખાતે		1400	2012			

ઉધાર		મહાવીર એન્ડ બ્રાંડ્સ				જમા	
તારીખ	વિગત	ખા.પા. ન.	રકમ ર.	તારીખ	વિગત	ખા.પા. ન.	રકમ ર.
2012 માર્ચ.28	ખરીદપરત ખાતે		200	2012			

ઉધાર		મદનલાલ એન્ડ સન્સ				જમા	
તારીખ	વિગત	ખા.પા. ન.	રકમ ર.	તારીખ	વિગત	ખા.પા. ન.	રકમ ર.
2012 માર્ચ.31	ખરીદપરત ખાતે		1530	2012			

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડિયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ખરીદ અને વેચાણ નોંધ

ઉધાર

ખરીદ પરત ખાતુ

જમા

તારીખ	વિગત	ખા.પા. ન.	ર ક મ રૂ.	તારીખ	વિગત	ખા.પા. ન.	ર ક મ રૂ.
2012				2012 માર્ચ.31	ખરીદપરત નોંધ મુજબ વિવિધ ખરીદ પરત		5030



પાઠ સ્વાધ્યાય ૮.૧

નીચે આપેલા વ્યવહારોમાંથી ક્યા વ્યવહારની નોંધ ખરીદ નોંધ, ખરીદપરત નોંધમાં થશે અથવા તેમાંથી એકમાં પણ નહિ થાય તે જણાવો.

- મૈ. સૌરભ ફર્નીચરમાંથી ફર્નીચર ખરીદું
- મૈ. કેશવ પાસેથી ખરીટેલો માલ નમૂના મુજબનો નહિ હોવાથી તેમને પરત કર્યો.
- મૈ. વાર્નર બ્રાઇસ પાસેતી રૂ.12000નો માલ રોકડેથી ખરીદ્યો.
- મૈ. પુરી એન્ડ સન્સે રૂ.1500નો માલ ઉધાર
- કવાત્રા પાસેથી રૂ.2000નો માલ ઉધાર ખરીદ્યો.

9.2 વેચાણ નોંધ / વહી : -

તમારી પેઢી મોટી સંઘ્યામાં ગ્રાહકોને ઉધાર વેચાણ કરે છે તો તમારી પેઢી દ્વારા ઉધાર વેચેલ માલના બધા જ વ્યવહારોની નોંધ કરવા માટે મુખ્ય ચોપડા આમનોંધ જેવી જ વેચાણનોંધ રાખવી યોગ્ય રહેશે. રોકડેથી વેચેલ માલની નોંધ વેચાણનોંધમાં કરવામાં આવશે નહિ. તેની નોંધ રોકડમેળમાં કરવામાં આવશે. તેવી જ રીતે એવી વસ્તુઓનું ઉધાર વેચાણ કે જે વ્યવસાય માટેનું ઉધાર વેચાણ નથી તેની નોંધ પણ વેચાણનોંધમાં કરવામાં આવશે નહિ. તેની નોંધ વ્યક્તિત્વમાં નોંધમાં કરવામાં આવશે.

જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે છે ત્યારે ગ્રાહકને આપેલ ઈનવોર્ડિસ / બિલની એક નકલ વિકેતાની પાસે પણ રહે છે જે વેચાણ નોંધમાં નોંધ કરવા માટે પુરાવા તરીકે ઉપયોગી છે. ઈનવોર્ડિસ / બિલની આ નકલમાં વ્યવહાર સંબંધિત વિગત હોય છે જેવી કે વેચેલ માલની માહિતી, વેચાણ કિંમત, જુદા જુદા પ્રકારના વટાવ (જો હોય તો), વેચાણ સાથે સંકળાયેલા ખર્ચ, મળવા પાત્ર ચોખ્ખી રકમ, શરત, તારીખ, ઈનવોર્ડિસ / બિલનો નંબર વગેરે. વેચાણનોંધમાં નોંધ કરવા માટે જરૂરી બધી જ વિગતો ઈનવોર્ડિસ / બિલમાં આપેલ હોય છે.

વેચાણ નોંધનો નમૂનો નીચે મુજબ છે.

ખરીદ અને વેચાણ નોંધ

વેચાણનોંધ

તારીખ	બિલ નં.	વિગત(ગ્રાહકનું નામ)	આ.પા. નં.	વિ.વિવરણ રૂ.	કુલ રકમ રૂ.

વેચાણનોંધના ઉપરોક્ત ખાનાઓનું વિવરણ આ પ્રમાણે છે. :

તારીખ : આ ખાનામાં વ્યવહારની તારીખ, મહિનો અને વર્ષને ક્રમ પ્રમાણે લખાય છે.

બિલ નં. : આ ખાનામાં ઈનવોઈસ / બિલનો નંબર લખાય છે.

વિગત (ગ્રાહકનું નામ) : આ ખાનામાં પેઢી જે ગ્રાહકને માલ વેચે છે તેનું નામ લખવામાં આવે છે અને તેને રેખાંકિત કરાય છે. તેની સાથે જુદી જુદી વસ્તુઓની વિગત અને દર દર્શાવાય છે.

ખાતાવહી પાના નંબર : આ ખાનામાં સંદર્ભ માટે ખાતાવહીનો પાના નંબર અથવા ગ્રાહકનો ખાતા નંબર લખાય છે.

વિગત : વેપારી વટાવ (જો હોય તો)ને બાદ કરી અને ચોખ્ખી રકમ દર્શાવાય છે. કિંમત એજ રહેશે જે પ્રમાણે માલનું વેચાણ કર્યું છે.

રકમ રૂ. : આ ખાનામાં ગ્રાહકને વેચેલ કુલ માલ માટે પ્રાપ્ત થનાર ચોખ્ખી રકમ દર્શાવાય છે. આ રકમ ઈનવોઈસ / બિલમાં દર્શાવેલ ચલણ મુજબ યોગ્ય રીતે દર્શાવેલી હોય છે.

ઉદાહરણ -3

નીચેના મે. કમલ એન્ડ સન્સના વ્યવહારો પરથી વેચાણનોંધ તૈયાર કરો.

મે.ગુપ્તા એન્ડ શર્માને ઉધાર માલ વેચ્યો.

30 શાર્ટ દરેક રૂ.1500 લેખે

20 ટ્રોઉઝર દરેક રૂ.1300 લેખે

બાદ : વેપારી વટાવ 10% લેખે

મે. પાલિક એન્ડ ક.ને જુનું ફર્નિચર રૂ.8000માં વેચ્યું

મે. જોન એન્ડ સન્સને 50 શાર્ટ દરેક રૂ.1600 લેખે ઉધાર વેચ્યા

મે. માહર એન્ડ નાહરને ઉધાર માલ વેચ્યો

100 શાર્ટ દરેક રૂ.1750 લેખે

10 ઓવરકોટ દરેક રૂ.1500 લેખે

બાદ વેપારી વટાવ 10% લેખે.

મોડચુલ - 2

આમ નોંધ અને
પેટા નોંધ



મોડિયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ખરીદ અને વેચાણ નોંધ

ઉકેલ :

વેચાણનોંધ

તારીખ	બિલ નં.	વિગત (ગ્રાહકનું નામ)	ખા.પા. નં.	વિગત રૂ.	કુલ રકમ	
					રૂ.	રૂ.
		મૈ.ગુપ્તા એન્ડ શર્મા 30 શર્ટ દરેક રૂ.1500 લેખે 20 ટ્રોઉઝર દરેક રૂ.1300 લેખે બાદ : વેપારી વટાવ 10% લેખે (બિલ નં....તા....મુજબ વેચાણ) મે. જોન એન્ડ સન્સ 50 શર્ટ દરેક રૂ.1600 લેખે (બિલ નં....તા....મુજબ વેચાણ) મે. માહર એન્ડ નાહર 100 શર્ટ દરેક રૂ.1750 લેખે 10 ઓવરકોટ દરેક રૂ.1500 લેખે બાદ વેપારી વટાવ 10% લેખે. (બિલ નં....તા....મુજબ વેચાણ)		45000 26000 71000 7100 80000 175000 15000 190000 19000	63900 7100 190000 171000 314900	
		વેચાણ ખાતે	જમા			

વેચાણનોંધ / વહીમાંથી ખાતાવહીમાં ખતવણી :

વેચાણનોંધની જરૂરી વિગતોની તેની સાથે સંબંધિત ગ્રાહકના ખાતામાં ઉધારબાજુ દરરોજ ખતવણી થાય છે. જેમાં કમ, તારીખ અને બિલ નંબર લખાય છે. તેમજ વેચાણનોંધના પાનાનંબરને ખાતાવહીમાં ઘોગ્ય જગ્યાએ લખાય છે. મહિનાના અંતે વેચાણનોંધના કુલ સરવાળાની ખાતાવહીના વેચાણ ખાતામાં ખતવણી કરવામાં આવે છે, જેમાં વિગતના ખાનામાં 'વેચાણનોંધ મુજબ વિવિધ વેચાણ' લખાય છે.

ખરીદ અને વેચાણ નોંધ

મે. કમલ એન્ડ સન્સની ખાતાવહી

ઉધાર

તારીખ	વિગત	ખા.પા.	ર ક મ	તારીખ	વિગત	ખા.પા.	ર ક મ	જમા
		નં.	રૂ.			નં.	રૂ.	
	વેચાણ ખાતે		63900					

ઉધાર

મે. જહોન એન્ડ સન્સ

જમા

તારીખ	વિગત	ખા.પા.	ર ક મ	તારીખ	વિગત	ખા.પા.	ર ક મ	જમા
		નં.	રૂ.			નં.	રૂ.	
	વેચાણ ખાતે		80000					

ઉધાર

મે. માહર એન્ડ નાહર

જમા

તારીખ	વિગત	ખા.પા.	ર ક મ	તારીખ	વિગત	ખા.પા.	ર ક મ	જમા
		નં.	રૂ.			નં.	રૂ.	
	વેચાણ ખાતે		171000					

ઉધાર

વેચાણ ખાતું

જમા

તારીખ	વિગત	ખા.પા.	ર ક મ	તારીખ	વિગત	ખા.પા.	ર ક મ	જમા
		નં.	રૂ.			નં.	રૂ.	
					કેષુઆરી મહિના માટે			
					વેચાણ નોંધ મુજબ વેચાણ			314900

વેચાણપરત નોંધ અથવા રીટર્ન ઈનવર્ડ બુક :

ગ્રાહકો પાસેથી જ્યારે માલ પરત આવે છે ત્યારે સામાન્ય રીતે તેને વેચાણપરત નોંધમાં નોંધવામાં આવે છે. તેને વેચાણપરત નોંધ / રીટર્ન ઈનવર્ડ બુક પણ કહેવાય છે. વેચાણ પરત નોંધમાં નોંધ કરવાના એ જ નિયમો છે જે ખરીટપરત નોંધમાં કરવાના છે. આમાં જમાયિઠી તૈયાર કરી ગ્રાહકને આપવામાં આવે છે. જેમાં પરત કરેલ માલની વિસ્તૃત વિગત દર્શાવવામાં આવે છે. જેના આધારે નોંધ થાય છે. જમા ચિઠીમાં આપેલી વિગતના આધારે પરત માલની નોંધ વેચાણ પરત નોંધમાં થાય છે.

વેચાણ પરત નોંધનો નમૂનો નીચે મુજબ છે :

તારીખ	જમાયિઠી નંબર	વિગત(ગ્રાહકનું નામ)	ખા.પા.	વિગત	કુલ રકમ
			નં.	રૂ.	રૂ.

મોડચુલ - ૨

આમ નોંધ અને

પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ખરીદ અને વેચાણ નોંધ

વેચાણપરત નોંધના ઉપરોક્ત ખાનાનું વિવરણ નીચે મુજબ છે :

તારીખ : આ ખાનામાં વેચાણપરત સંબંધિત વ્યવહારની તારીખ, મહિનો અને વર્ષની ક્રમ મુજબ નોંધ કરાય છે.

જમા ચિઠી નંબર : આ ખાનામાં જમાચિઠી નંબર લખાય છે.

વિગત (ગ્રાહકનું નામ) : આ ખાનામાં જે ગ્રાહકે કે પેઢીએ માલ પરત કર્યો હોય તેનું નામ લખાય છે. તેને ઘાટા અક્ષરમાં લખાય છે અથવા રેખાંકિત કરાય છે. તેની બરાબર નીચે પરત કરેલ માલની વિગત લખાય છે, જેમાં માત્રા અને દર લખાય છે.

ખાતાવહી પાના નંબર : આ ખાનામાં ગ્રાહકનો ખાતા નંબર અથવા ખાતાવહી પાના નંબર લખાય છે. જે સંદર્ભ માટે જરૂરી છે

વિગત : વેપારી વટાવ કાપી લીધા બાદની ચોખ્ખી રકમની નોંધ કરાય છે. જે કિંમતે માલનું વેચાણ કર્યું હોય તે જ કિંમત પર અહીં ગણતરી થાય છે.

રકમ : આ ખાનામાં પરત કરેલા માલની ગ્રાહકને ચૂકવવાની ચોખ્ખી રકમ દર્શાવાય છે. જે જમાચિઠીમાં દર્શાવેલ છે તે યોગ્ય રીતે દર્શાવાય છે.

ઉદાહરણ -4

નીચેના વ્યવહારોની લાલ એન્ડ કંપનીની વેચાણપરત નોંધમાં નોંધ કરો.

2012

એપ્રિલ 06: પવન એન્ડ કુ. એ માલ પરત કર્યો

2 ટેબલફેન દરેક રૂ.600 લેખે

બાદ વેપારી વટાવ 15%

એપ્રિલ 12 : લક્ષ્મણ ઓર્ડિલ મિલે રૂ.4250નો માલ નુકશાની હોવાથી પરત કર્યો.

ઉકેલ :

વેચાણપરત નોંધ

તારીખ	જમાચિઠી નંબર	વિગત(ગ્રાહકનું નામ)	ખ.પા.	વિ.વિવરણ	કુ. રકમ
			નં.	રૂ.	રૂ.
2012 એપ્રિલ 6		પવન એન્ડ કુ. 2 ટેબલફેન દરેક રૂ.600 લેખે બાદ : વેપારી વટાવ 15%		1200 180	1020
એપ્રિલ 12		લક્ષ્મણ ઓર્ડિલ મિલ			4250
એપ્રિલ 30		વેચાણ પરત ખાતે	૩.		5270

ખરીદ અને વેચાણ નોંધ

વેચાણપરત નોંધમાંથી ખાતાવહીમાં ખતવણી :

માલ પરત કરનાર દરેક ગ્રાહકના ખાતામાં જમા બાજુ પરત માલની ચોઘ્યી રકમ લખાય છે. એક ચોકક્સ સમય પૂર્ણ થતાં ખાતાવહીના વેચાણપરત ખાતામાં ઉધાર બાજુ વેચાણ પરત નોંધની કુલ રકમની ખતવણી કરવામાં આવે છે.

ઉદાહરણ - 5

નીચેના વ્યવહારોની વેચાણપરત નોંધમાં નોંધ કરો.

2012

જાન્યુ. 01: મૈ. ઘનશ્યામ એન્ડ કે. એ 500 એકમ પરત કર્યા જેનું વેચાણ એકમદીઠ રૂ.50 લેખે કર્યું હતું.

જાન્યુ. 25 : મૈ. નારાયણ એન્ડ કે. એ 300 એકમ પરત કર્યા જેનું વેચાણ એકમદીઠ રૂ.55 લેખે કર્યું હતું.

ઉકેલ :

વેચાણપરત નોંધ

તારીખ નંબર	જમાચિઠી	વિગત(ગ્રાહકનું નામ)	ખા.પા. નં.	વિ.વિવરણ રૂ.	કુલ રકમ રૂ.
2012 જાન્યુ 01		મૈ. ઘનશ્યામ એન્ડ કંપની 500 એકમ એકમદીઠ રૂ.50 લેખે			25000
જાન્યુ.25		મૈ. નારાયણ એન્ડ કે. 300 એકમ એકમદીઠ રૂ.55 લેખે			16500
જાન્યુ.31		વેચાણ પરત ખાતે	૩.		41500

યોગ્ય આમનોંધ :-

અત્યાર સુધી આપણે ચર્ચા કરી તે મુજબ યોગ્ય પ્રકૃતિના વ્યવહારોની નોંધ તે જ ઉદેશ્ય માટે તૈયાર કરેલ વિશિષ્ટ આમનોંધમાં નોંધાય છે.

1. રોકડ લેવડ-દેવડ, રોકડમેળમાં નોંધાય છે.
2. માલ અથવા સામગ્રીની ઉધાર ખરીઠી, ખરીદનોંધમાં નોંધાય છે.
3. માલના ઉધર વેચાણની નોંધ વેચાણનોંધમાં થાય છે.
4. ગ્રાહક પાસેથી પરત મળેલ માલને વેચાણપરત નોંધમાં નોંધાય છે.
5. વેપારીને માલ પરતને ખરીદપરત નોંધમાં નોંધાય છે.

ઉપરોક્ત વ્યવહારો સિવાય પણ અન્ય વ્યવહારો હોય છે જેની નોંધ કરવામાં આવે છે. તેના માટે

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ખરીદ અને વેચાણ નોંધ

વિશિષ્ટ આમનોંધ યોગ્ય છે.

વિશિષ્ટ આમનોંધમાં નીચેનાની નોંધ કરવામાં આવે છે.

- | | |
|--|-----------------------|
| 1. શરૂઆતની નોંધ | 2. આખરી નોંધ |
| 3. ટ્રાન્સફરની નોંધ | 4. હવાલા નોંધ |
| 5. સુધારા નોંધ | 6. મિલકતની ઉધાર ખરીદી |
| 7. નુકસાન થયેલ અથવા જૂની અસ્ક્રયામતોનું ઉધાર વેચાણ | |



પા� સ્વાધ્યાય ૮.૨

1. નીચેનામાંથી ક્યા વ્યવહારો વેચાણનોંધ અને ક્યા વ્યવહારો વેચાણપરત નોંધમાં નોંધાશે તે જગ્યાવો.
જો બંનેમાંથી એકેયમાં નોંધ ન થાય તો તેમાં "આમાંથી એકેય નહિ" તેમ લખો.

- રાધવને એક મહિના માટે ઉધાર માલ વેચ્યો.
- જુનું ફર્નીચર રાજેશને ઉધાર વેચ્યું.
- રોકડેથી માલનું વેચાણ કર્યું.
- મૈ. કપૂર પ્રા.લિ.ને માલ વેચ્યો.
- મૈ. ટેશબંધુ એન્ડ સન્સ લિ.એ માલ પરત કર્યો.
- નુકશાની માલને કારણે રાધવે માલ પરત કર્યો.
- આગથી માલ બળી ગયો.
- સુરેશ પાસેથી વટાવ મળ્યો.
- મૈ.કપૂર પ્રા.લિ. પાસેથી રોકડ મળી.

2. વૈકલ્પિક પ્રશ્નો.

- ક્યા વ્યવહારની કુલ રકમની ખરીદખાતામાં ખતવણી કરાય છે ?

(a) સ્ટેશનરીની રોકડેથી ખરીદી	(b) ખરીદ પરત
(c) ઉધાર ખરીદી	(d) ભશીનરીની ખરીદી
- વેચાણનોંધના દરેક વ્યવહારની
 - કોઈપણ ખાતામાં ખતવણી થતી નથી.
 - દરેક ખાતાની જમા બાજુમાં ખતવણી કરવામાં આવે છે.
 - દરેક ખાતાની ઉધાર બાજુમાં ખતવણી કરવામાં આવે છે.
 - વેચાણ ખાતાની જમા બાજુ ખતવણી કરવામાં આવે છે.

ખરીદ અને વેચાણ નોંધ

- iii. વેચાણપરત નોંધની કુલ રકમની ખતવજી કરવામાં આવે છે :
- (a) વેચાણ ખાતામાં
 - (b) વેચાણપરત ખાતામાં
 - (c) ખરીદપરત ખાતામાં
 - (d) માલ ખાતામાં
- iv. વેચાણનોંધની કુલ રકમની ખતવજી જે ખાતાની ઉધાર બાજુ કરવામાં આવે છે તે છે:
- (a) વેચાણ ખાતું
 - (b) વેચાણપરત ખાતું
 - (c) ખરીદપરત ખાતું
 - (d) માલ ખાતું
- v. ખરીદ નોંધની કુલ રકમની ખતવજી જે ખાતાની ઉધાર બાજુ કરવામાં આવે છે તે છે :
- (a) વેચાણ ખાતું
 - (b) ખરીદ ખાતું
 - (c) માલ ખાતું
 - (d) ખરીદપરત ખાતું

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



તમે આટલું શીખ્યા :

- ખરીદનોંધ (જે ઈનવોઈસ બુક / ખરીદવહી તરીકે પણ ઓળખાય છે) માલ (એવો માલ કે જેમાં ધંધાકીય વ્યવહાર થાય છે.) ની ઉધાર ખરીદીની નોંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બીજા શબ્દોમાં ખરીદનોંધ, પ્રાથમિક નોંધની વહી છે જે ઉધાર ખરીદીની નોંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. રોકડ ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થતી નથી તેને રોકડમેળમાં નોંધાય છે.
- વેચાણનોંધ (જે રોજમેળ બુક / વેચાણવહી ના નામે પણ ઓળખાય છે) માલના ઉધાર વેચાણની નોંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
- ખરીદ પરત નોંધ (જે રીટર્ન આઉટવર્ક બુક તરીકે પણ ઓળખાય છે) ઉધાર ખરીદેલ દરેક માલ જે પરત કરવામાં આવે છે તેની નોંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
- વેચાણપરત નોંધ (જે રીટર્ન ઈનવર્ક બુક તરીકે પણ ઓળખાય છે) ઉધાર વેચેલ માલ પરતની નોંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
- વ્યક્તિગત આમનોંધનો ઉપયોગ એવા વ્યવહારોની નોંધ કરવા માટે થાય છે જેની નોંધ અન્ય વહીઓ જેવી કે (1) રોકડમેળ (2) ખરીદનોંધ (3) વેચાણ નોંધ તેમજ (4) ખરીદપરત નોંધમાં થતી નથી.

વિશિષ્ટ આમનોંધમાં નોંધવામાં આવતી નોંધો જેવી કે :— શરુની બાકી, આખરની બાકી, ટ્રાન્સફર એન્ટ્રી, હવાલાની નોંધ, સુધારા નોંધ, મિલકતની ઉધાર ખરીદી, જૂની આવક નુકસાન પામેલ અસ્ક્રિપ્શનોનું ઉધાર વેચાણ



પાઠ્યાંત સ્વાધ્યાય :

1. ખરીદનોંધનો અર્થ આપી તેનો નમૂનો તૈયાર કરો.

મોડયુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



ၪ

ખરીદ અને વેચાણ નોંધ

- ખરીદપરત નોંધનો અર્થ આપી તેનો નમૂનો તૈયાર કરો.
 - વેચાણ નોંધ શું છે ? તેનો નમૂનો તૈયાર કરો.
 - વેચાણપરત નોંધનો અર્થ આપી તેનો નમૂનો તૈયાર કરો.
 - મૈ. ત્યાગી ફર્નીચરના માલ વેચાણના નીચેના વ્યવહારો પરથી 31મી માર્ચ 2012ના રોજ પૂરા થતા માહિનાની વેચાણનોંધ તૈયાર કરો.

तारीख विगत

2012

માર્ય 4 મૈ. મોના ટ્રેડર્સને બિલ નં. 330 મુજબ ઉધાર માલ વેચ્યો.

(a) બે ડબલ બેડ દરેક રૂ.7100 લેખો

(b) પાંચ ખુરશી દરેક રૂ.260 લેખે

માર્ય 9 મૈ. કિશન ફર્નિચરને બિલ નં.- 238 મુજબ પાંચ ટેબલ દરેક રૂ.1400 લેખે
ઉધાર વેચ્યા

માર્ચ 24 મૈ. દર્શન ઇન્જિનીયરને બિલ નં.- 340 મુજબ 4 સોફાસેટ દરેક રૂ.18000 કેખે
ઉધાર વેચ્યા.

માર્ચ 30 મૈ. ગોપાલ ફર્નિચરને બિલ નં.- 485 મુજબ 6 સિંગલ બેડ દરેક રૂ.6000 લેખે ઉધાર વેચ્યા.

6. જુલાઈ 2012ના નીચેના વ્યવહારોને મૈ. દીપિકા લિ.ની યોગ્ય નોંધમાં નોંધો.

2012

જુલાઈ 01 બિલ નં. 7669 મુજબ કુલદીપ ટ્રોડર્સ પાસેથી ખરીદી કરી

100 નોટબુક દરેક રૂ.20 લેખે

50 જેલપેન દરેક રૂ.10 લેખે

100 પેકેટ રંગીન પેન્સીલ પેકેટ દીઠ રૂ.15 લેખે.

વેપારી વટાવ 10%

જુલાઈ 12 અભિમન્યુ સ્ટેશનર્સ પાસેથી બિલ નં. 3450 મુજબ ખરીદી કરી

100 ફાઈલ દરેક 3.12 લેખ

10 ਰੀਮ ਪੇਪਰ ਰੀਮ ਫਿਲ 3.300 ਲੇਖ

વેપારી વટાવ 5%

જુલાઈ 17 સવિતા ટ્રેડર્સને ઉધાર ચિઠી નં. 281 મુજબ માલ પરત કર્યો

10 પેકેટ રંગીન પેન્સીલ, પેકેટ દીઠ રૂ.15 લેખે

ખરીદ અને વેચાણ નોંધ

વેપારી વટાવ 10%

જુલાઈ 22 માણિક સ્ટેશનરી પાસેથી બિલ નં. 8760 મુજબ માલ ખરીયો.

50 પેકેટ વોટર કલર પેકેટ દીઠ રૂ.50 લેખે

જુલાઈ 31 મે. રીતુ સ્ટેશનર્સ ને ઉધારચિઠી નં. 340 મુજબ માલ પરત કર્યો

3 રીમ પેપર પ્રતિ રીમ દીઠ રૂ.300 લેખે

વેપારી વટાવ 5%

7. નીચેના વ્યવહારો પરથી ખરીદનોંધ તૈયાર કરો અને તેમની ખાતાવહીમાં ખતવણી કરો.

2012

મે 02 ધારિયા એન્ડ કૂં., નોઈડા પાસેથી ખરીદી કરી

110 કિવન્ટલ ચોખા, રૂ.2000 પ્રતિ કિવન્ટલ

115 કિવન્ટલ ખાંડ, રૂ.1500 પ્રતિ કિવન્ટલ

મે 09 અમિતકુમાર એન્ડ કૂં., અલવર પાસેથી માલ ખરીયો.

30 કિવન્ટલ ઘઉં, રૂ.1800 પ્રતિ કિવન્ટલ

20 કિવન્ટલ ચણા, રૂ.1700 પ્રતિ કિવન્ટલ

મે 15 ગોપાલ એજન્સી, હિસાર પાસેથી રોકડેથી માલ ખરીયો.

220 ટન ઘી, રૂ.500 પ્રતિ ટન

મે 20 ભગવતી ફર્નિચર, ભિવાની પાસેથી ફર્નિચર ખરીયું

70 ખુરશી, દરેક રૂ.200 લેખે

20 ટેબલ, દરેક રૂ.1200 લેખે

વેપારી વટાવ 10%

મે 25 ગુપ્તા ટ્રેડર્સ, અંબાલા પાસેથી ખરીદી કરી

440 કિવન્ટલ ચોખા, રૂ.1500 પ્રતિ કિવન્ટલ

210 કિવન્ટલ ખાંડ, રૂ.1400 પ્રતિ કિવન્ટલ

વેપારી વટાવ 10%

વેચાણ વેરો 10%

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ખરીદ અને વેચાણ નોંધ

8. નીચેના વ્યવહારો પરથી જ્ય ઈલેક્ટ્રોનિક્સ, ભિવાનીની ખરીદનોંધ તૈયાર કરો.

2012

જાન્યુઆરી 03 સન ઈલેક્ટ્રોનિક્સ, ગાળિયાબાદ પાસેથી ખરીદી કરી

100 ટયુબલાઈટ, દરેક રૂ.40 લેખે

500 ટેબલેન, દરેક રૂ.500 લેખે

વેપારી વટાવ 10%

જાન્યુઆરી 11 રવિ ઈલેક્ટ્રોનિક્સ કંપની, અમરોહાપાસેથી માલ ખરીદ્યો.

300 બલ્બ, દરેક રૂ.10 લેખે

240 ઈસ્ત્રી, દરેક રૂ.200 લેખે

વેપારી વટાવ 15%

જાન્યુઆરી 15 મોડર્ન ફર્નિચર હાઉસ, દિલ્હી પાસેથી ફર્નિચર ખરીદ્યુ.

10 ખુરશી, દરેક રૂ.1200 લેખે

3 ટેબલ, દરેક રૂ.4000 લેખે

જાન્યુઆરી 20 રફતાર ફેન્સ ઈન્ડિયા, દિલ્હી પાસેથી રોકડેથી ખરીદી કરી.

50 પંખા, દરેક રૂ.1400 લેખે

જાન્યુઆરી 28 રામ એન્ડ લક્ષ્મણ કંપની, દિલ્હી પાસેથી ખરીદી કરી.

250 ટયુબલાઈટ, દરેક રૂ.45 લેખે

9. સુરેશ ચંદ ફર્નિચરનો વેપારી છે. નીચેની માહિતી ઉપલબ્ધ છે.

2012

નવેમ્બર 06 આલોક કુમારને 50 ખુરશી, દરેક રૂ.230 લેખે નમૂના મૂજબ ન હોવાથી પરત કરી.

નવેમ્બર 14 ગુલશન ગ્રોવર, લુધિયાઝાને ડાઈનિંગ ટેબલ રૂ.4300 અને 10 ખુરશી, દરેક રૂ.250 લેખે પોલીશ ન કરેલ હોવાથી પરત કર્યા.

નવેમ્બર 21 અમૃત કૌર એન્ડ કુ., બાઈડાને નમૂના મૂજબનો માલ ન હોવાથી પરત કર્યો.

30 ખુરશી, દરેક રૂ.425 લેખે

25 ડ્રેસિંગ ટેબલ, દરેક રૂ.2200 લેખે

નવેમ્બર 27 સાકી ફર્નિચર, બરોતને 12 સ્ટડી ટેબલ, દરેક રૂ.1500 લેખે નમૂના મૂજબ ન હોવાથી પરત કર્યા.

ઉપરોક્ત વ્યવહારોની નોંધ યોગ્ય નોંધમાં કરો.

એડજુકેશન અને વેચાણ નોંધ

10. નીચેના વ્યવહારોની બળવંતસિહની વેચાણપરત નોંધમાં નોંધ કરો.

2012

સપ્ટેમ્બર 07 સુભાષ એન્ડ સન્મને નમૂના મુજબનો માલ ન હોવાથી રૂ. ૧૨૦૦૦ નો માલ પરત કર્યો.

સપ્ટેમ્બર 18 ગાંધી એન્ડ કંપની દ્વારા બિલમાં ભૂલ હોવાથી રૂ. ૧૦૦૦ નો દાવો કરવામાં આવ્યો.

સપ્ટેમ્બર 21 હરીરામ ગોપીંગં મુંબઈને વેચાવામાં આવેલ માલના કલમાં નુકસાન હોવાથી રૂ. ૧૮૦૦ નો માલ પરત કરવામાં આવ્યો.

સપ્ટેમ્બર 28 કમલ એન્ડ બ્રધર્સ કેરાલા દ્વારા રૂ. ૧૫૦૦ નો માલ પરત કરવામાં આવ્યો વેપારી વટાવ ૧૦%

૧૧. નીચેના વ્યવહારોની વેચાણ પરત નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



જાન્યુઆરી 04 ગોપાલ ફર્નિયર, હરિનગરને 40 ખુરશી, દરેક રૂ.200 લેખે વેપારી વટાવ 10% પરત કરી.

જાન્યુઆરી 11 રીહાન એન્ડ બ્રધર્સ માલ પરત કર્યો.

4 ટેબલ, દરેક રૂ.1800 લેખે

15 ખુરશી, દરેક રૂ.1500 લેખે

જાન્યુઆરી 16 ગોયલ એન્ડ કં. એ નીચે મુજબનો માલ પરત કર્યો.

2 સોફસેટ, દરેક રૂ.13000 લેખે

વેપારી વટાવ 10%

જાન્યુઆરી 21 પ્રેમી ફર્નિયર હાઉસ, નોઈડાને માલ પરત કર્યો.

10 ટેબલ, દરેક રૂ.700 લેખે

20 ખુરશી, દરેક રૂ.1150 લેખે

વેપારી વટાવ 10%

12 નીચેના વ્યવહારોની પેટાનોંધોમાં માં નોંધ કરો.

2012

સપ્ટેમ્બર 01 રિપબ્લિક ફર્નિશિંગ, નોયડાને માલ વેચ્યો.

2 બેડ, દરેક રૂ.500 લેખે

10 ડાઈનીગ ટેબલ, દરેક રૂ.3000 લેખે

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



નોંધ

ખરીદ અને વેચાણ નોંધ

સપ્ટેમ્બર 05 કાવેરી ફર્નીચર્સ, મેરઠ પાસેથી ખરીદી કરી

1 ડ્રેસીંગ ટેબલ, દરેક રૂ.250 ચોખા

સપ્ટેમ્બર 08 મોહન ફર્નીચરે નીચે મુજબ બિલ મોકલ્યું.

1 ઓફિસ ટેબલ રૂ.150

સપ્ટેમ્બર 10 તારચંદ એન્ડ કેન્સ ને માલ પરત કર્યો.

7 બેડરૂમ સેટ, દરેક રૂ.4300 લેખે

5 ડાઈનીંગ ટેબલ, દરેક રૂ.5000 લેખે

સપ્ટેમ્બર 16 ક્રજમોહનને રૂ.5000માં ડાઈનીંગ ટેબલ વેચ્યું.

સપ્ટેમ્બર 18 લલિતા ખના એન્ડ કેન્સ. પાસેથી રૂ.85000માં ડીલીવરી વાન ખરીદી.

સપ્ટેમ્બર 22 રોકડ વેચાણ રૂ.12000

તૈયાર કરો :

(1) ખરીદ નોંધ

(2) વેચાણ નોંધ

(3) ખરીદ નોંધ



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

9.1 (i) આમાંથી એકપણ નહિ.

(ii) ખરીદ પરત નોંધ

(iii) આમાંથી એક પણ નહિ.

(iv) ખરીદ નોંધ

(v) ખરીદ નોંધ

9.2 I

(i) વેચાણ નોંધ

(ii) આમાંથી એક પણ નહિ.

(iii) આમાંથી એક પણ નહિ.

(iv) વેચાણ નોંધ

(v) વેચાણપરત નોંધ

ખરીદ અને વેચાણ નોંધ

- (vi) વેચાણપરત નોંધ
- (vii) આમાંથી એક પણ નહિ.
- (viii) આમાંથી એક પણ નહિ.
- (ix) આમાંથી એક પણ નહિ.

II

- (i) c
- (ii) c
- (iii) b
- (iv) a
- (v) b



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

5. વેચાણ નોંધનો કુલ સરવાળો રૂ.1,18,500
6. કુલ ખરીદ પરત રૂ.990, ખરીદ નોંધનો કુલ સરવાળો રૂ.10,090
7. ખરીદનોંધનો કુલ સરવાળો રૂ.13,42,780
8. ખરીદનોંધનો કુલ સરવાળો રૂ.3,53,200
9. ખરીદપરતનોંધનો કુલ સરવાળો રૂ.1,04,050
10. વેચાણપરત નોંધનો કુલ સરવાળો રૂ.16,150
11. વેચાણપરત નોંધનો કુલ સરવાળો રૂ.53,100 ખરીદ પરત નોંધનો કુલ સરવાળો રૂ. રૂ.74200
12. ખરીદનોંધનો સરવાળો રૂ.400
વેચાણ નોંધનો સરવાળો રૂ.36,000
ખરીદ પરત નોંધનો સરવાળો રૂ.55,100

તમારી માટે પ્રવૃત્તિ :

- તમારા વિસ્તારની ધંધાકીય એકમોની મુલાકાત લો અને તપાસ કરો કે તેઓ ફક્ત આમનોંધ રાખે છે કે અન્ય પેટા નોંધો પણ રાખે છે. તેમના દ્રવ્યવારા રાખવામાં આવતી અન્ય નોંધો તેમના ઉદશ્યો સિદ્ધ કરે છે કે નહિ તે નિશ્ચિય કરો જો તેમ ન હોય તો તમારા સૂચનો આપો.
- તમારા કાકા સ્ટેશનરીના ધંધામાં છે તેવું માનીને તેમની સાથે એક અઠવાડિયા સુધી બેસો. આ એક અડવાડિયામાં થયેલ ખરીદ અને વેચાણની યાદી તૈયાર કરો. આ યાદી પરથી તેમાં થયેલ વ્યવહારોની યોગ્ય નોંધોમાં નોંધ કરો.

મોડચુલ - ૨

આમ નોંધ અને
પેટા નોંધ



મોડયુલ - ૩

ખતવણી અને કાચું
સરવૈયું



નોંદા

મોડયુલ - ૩

મહત્તમ ગુણ

૧૪

અભ્યાસના કલાક

૩૪

ખતવણી અને કાચું સરવૈયું

આ મોડયુલ વિદ્યાર્થીઓને ખાતાવહી અને ડ્રાયલ બોલેન્સ બનાવવાનું કૌશલ્ય વિકસાવવામાં મદદરૂપ થશે. તેઓ વિવિધ એકાઉન્ટિંગ ભૂલો ઓળખવા, તેનું વગીંકરણ કરવા અને ભૂલો સુધારવા માટે સક્ષમ થશે.

પ્રકરણ-૧૦ : ખતવણી

પ્રકરણ-૧૧ : કાચું સરવૈયું અને હિસાબી ભૂલો



નોંધ

૧૦

ખતવણી

વેપારના વ્યવહારોને નામાના જુદા જુદા ચોપડા જેમ કે રોકડમેળ, પરીદનોંધ, વેચાણનોંધ, આમનોંધમાં નોંધવાનું તમે શીખી ચૂક્યા છો, પણ આ નોંધોના વ્યવહારો છૂટા છવાયા હોય છે. નામાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીને આવક, ખર્ચ, દેવાદારો, લેણદારો, મિલકત વગેરેની માહિતી મળે તે છે. આ હેતુને સિદ્ધ કરવા માટે જુદા જુદા ચોપડે નોંધાયેલ વિવિધ વ્યવહારોને એક મથાળા નીચે લાવવું જરૂરી બને છે. આ પ્રક્રિયાને ‘ખતવણી’ કહે છે અને જે ચોપડામાં આવા વિવિધ ખાતાઓ રાખવામાં આવે છે તેને ખાતાવહી કહે છે. આ પાઠમાં તમે ખાતાવહી નો અર્થ અને આવી ખાતાવહી તૈયાર કરવા પાછળના કારણો સમજ શકશો.



હેતુઓ :

આ પાઠ ભાષા પછી તમે શીખશો. :

- ખાતાવહીનો અર્થ અને તેના હેતુઓ જાણવા.
- આમનોંધ અને ખાતાવહી વચ્ચેનો તફાવત
- આમનોંધ માંથી ખાતાવહીમાં ખતવણી કરવી.
- ખાતાવહીના વિવિધ ખાતાઓની બાકીઓ શોધવી.

૧૦.૧ ખાતાવહીનો અર્થ અને હેતુ

એક મથાળા સાથે સંબંધિત વ્યવહારો જુદા જુદા ચોપડે લખાયેલા હોય છે. કોઈ પણ એક ચોક્કસ ખાતાના વ્યવહારોનો જથ્થો કે મૂલ્ય જાણવું હોય તે તેને એક જગ્યાએ નીચે લાવવા પડે છે. નામાનો એવો ચોપડો કે જેમાં બધા જ પ્રકારના ખાતાઓ રાખવામાં આવે છે. તેવા ચોપડાને ખાતાવહી કહે છે. ધંધાક્રિય એકમના ખાતાઓની વિગતો ધરાવે છે. આમનોંધ કે પેટાનોંધ પરથી નામાના નિયમો મુજબ સંબંધિત ખાતાની ઉધાર કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી કહે છે. ખાતાવહીએ દ્વિનોંધી નામા પદ્ધતિઓ મુખ્ય ચોપડો છે. તે બાંધેલ ચોપડા, કાર્ડ પદ્ધતિ કે છૂટા કાગળના સ્વરૂપમાં હોઈ શકે. દરેક ખાતું નવા પાના કે કાર્ડથી ચાલુ થાય છે.



મોડયુલ - 3

ખતવણી અને કાચું
સરવેયું



નોંદિ

અતિવધી

ખાતાવહીના હેતુઓ

- વિવિધ વ્યવહારોની માહિતી જરૂરી જ મળે : ખાતાવહીથી વેપારના વિવિધ વ્યવહારોની માહિતી જરૂરી રીતે મળી જાય છે. કેમકે ખાતાવહી ધંધાકીય એકમ અને ધંધાકીય વ્યવહારો વચ્ચે ખાતાની મદદથી સંબંધ પ્રસ્થાપિત કરે છે.
- વ્યવહારો પર અંકુશ : દરેક વ્યવહારો માટે જુદા જુદા ખાતા હોવાથી તેના પર અંકુશ રહે છે.
- કાચું સરવેયું બનાવવામાં મદદરૂપ થાય : વિવિધ ખાતાની બાકી પરથી કાચું સરવેયું બનાવી શકાય.
- નાણાંકીય પત્રકો બનાવવામાં મદદરૂપ : ધંધાનું પરિણામ મેળવવા માટે જે નાણાંકીય પત્રકો બનાવવામાં આવે છે તેના માટે ખાતાવહી જરૂરી છે.

ખાતાનો નમૂનો :

ખાતું એ અંગ્રેજીમાં આઈ ના આકારનો બનાવાય છે જે બે ભાગોમાં વિભાજાત થાય છે. ડાબી બાજુને ઉધાર અને જમણી બાજુને જમા કહેવાય છે.

..... નું ખાતું

ઉધાર તારીખ	વિગત	નો.પા.	રકમ	તારીખ	વિગત	નો.પા.	રકમ	જમા
			રૂ.					રૂ.

ખાતાની બસે બાજુએ નીચે મુજબની વિગતો લખવામાં આવે છે.

તારીખ : આ ખાનામાં ધંધાકીય વ્યવહારની તારીખ લખાય છે.

વિગત : આ ખાનામાં સંબંધિત વ્યવહારની વિગતો લખવામાં આવે છે. ઉધાર બાજુએ 'તે' અને જમા બાજુએ 'થી' લખાય છે.

નોંધપાના (નો.પા.) : આ ખાનામાં જે ચોપડામાંથી અહીં ખતવણી કરાય છે તેનો પાના નંબર લખાય છે.

૧૦.૨ : ધંધાકીય વ્યવહારની રકમ ખાનામાં લખાય છે.

૧૦.૨ આમનોંધ અને ખાતાવહી વચ્ચે તફાવત

ક્રમ	તફાવતનો આધાર	આમનોંધ	ખાતાવહી
૧.	નોંધ	આમનોંધ એ નામાનો પ્રાથમિક ચોપડો છે.	ખાતાવહી એ નામાનો ગૌણ ચોપડો છે.

ખતવણી

૨.	નોંધકરી	આમનોંધમાં વ્યવહારો તારીખ મુજબ લખાય છે.	ખાતાવહીમાં વ્યવહારો વિશ્વેષણાત્મક રીતે લખાય છે.
૩.	માહિતીનો આધાર	આમનોંધમાં વ્યવહારો વેપારના આર્થિક વ્યવહારો પરથી લખાય છે.	ખાતાવહીમાં વ્યવહારો આમનોંધ પરથી લખાય છે.
૪.	લખવાની પ્રક્રિયા	આમનોંધ લખવાની પ્રક્રિયાને નોંધ કરવું કહે છે.	ખાતાવહીના ખાતાઓમાં નોંધવાની પ્રક્રિયાને ખતવણી કહે છે.

મોડચુલ - ૩
ખતવણી અને કાચું
સરયેચું



નોંધ



પાઠ સ્વાધ્યાય ૧૦.૧

ખાલી જગ્યા ભરો :

૧. નામાનો એવો ચોપડો કે જેમાં બધા જ ખાતા રાખવામાં આવે છે તેને કહે છે.
૨. ખાતાવહી એ દ્વિનોંધી નામા પદ્ધતિનો ચોપડો છે.
૩. ખાતાવહીમાં લખવાની પ્રક્રિયાને કહે છે.
૪. એ ખાતાવહીમાં ખતવણી માટેનો આધાર છે.
૫. ખાતાવહીમાં વ્યવહારો રીતે લખાય છે.

૧૦.૩ આમનોંધમાંથી ખાતાવહીમાં ખતવણી :

ખાતાવહી એ નામાનો મુખ્ય ચોપડો છે. આમાં આમનોંધમાં લખાયેલ તમામ વ્યવહારોની જુદા જુદા ખાનાઓમાં નોંધ કરાય તે જરૂરી છે. મિલકત, ઉપજ, ખર્ચ, દેવુ અને મૂડી આમ પાંચેય પ્રકારના ખાતા ખાતાવહીમાં ખોલવામાં આવે છે. બધા જ વ્યવહારોની ખતવણી થઈ ગયા પછી તે બધી જ માહિતી આપે છે. આમનોંધ એ પ્રાથમિક ચોપડો છે જ્યારે ખાતાવહી એ મુખ્ય ચોપડો છે. તે દરેક ખાતાની કોઈપણ ફેરફાર બાદની છેવટની સ્થિતિ દર્શાવે છે. તે દરેક ખાતાની કોઈપણ ફેરફાર બાદની છેવટની સ્થિતિ દર્શાવે છે. ખતવણી દ્વારા આમનોંધથાં લખાયેલ બધા જ વ્યવહારોને ખાતાવહીમાં નંધવામાં આવે છે.

આમનોંધને બે ભાગમાં વહેચવામાં આવે છે.

- ઉધાર બાજુ જે પહેલા આવે છે.
- જમા બાજુ જે પછી આવે છે.

૧. ઉધારબાજુની ખતવણી :

- અ) ઉધાર બાજુને જે તે ખાતાની ઉધાર બાજુએ નોંધવામાં આવે છે અને તારીખના ખાનામાં તારીખ લખવામાં આવે છે તથા આમનોંધમાં જે ખાતું જમા થયું હોય તેને વિગતના ખાનામાં લખાય છે ખાતાનું નામ લખતા પહેલા 'તે' લખવામાં

મોડયુલ - 3

ખતવણી અને કાચું
સરયેયું



નોંદા

અતિવાળી

આવે છે. રકમના ખાનામાં વ્યવહારની રકમ લખાય છે.

બ) નોંધ પાનાના ખાનામાં આમનોંધના ચોપડામાં જે પાના પર આ વ્યવહારો લખાયો હોય તેનો પાના નંબર અહીં લખાય છે.

૨. જમા બાજુની ખતવણી :

બા) જમા બાજુને જે તે ખાતાની જમા બાજુએ નોંધવામાં આવે છે. તારીખના ખાનામાં તારીખ લખાય છે અને જે ખાતું આમનોંધમાં ઉધાર થયું હોય તે ખાતાને અહીં જમા બાજુના વિગતના ખાનામાં લખાય છે. ખાતાનું નામ લખતા પહેલા ન થી લખવામાં આવે છે. રકમના ખાનામાં રકમ લખાય છે.

બ) નોંધપાનાના ખાનામાં આમનોંધનો પાના નંબર લખાય છે.

ઉદાહરણ : નીચેની આમનોંધની ખતવણી ખાતાવહીમાં કરો.

આમનોંધ

ઉધાર

જમા

તારીખ	વિગત	ખા.ના.	ઉધાર રૂ.	જમા રૂ.
૨૦૧૨ માર્ચ ૨૦	રોકડ ખાતે તે જાનકીદાસ ખાતે (બા. જે જાનકીદાસ પાસેથી રોકડ મળ્યા તેના)	ઉધાર	૨૭૦૦	૨૭૦૦

ખાતાવહી

ઉધાર

રોકડ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ (રૂ.)	તારીખ	વિગત	નો.પા.	રકમ (રૂ.)
૨૦૧૨ માર્ચ ૨૦	જાનકીદાસ ખાતે	૨૭૦૦					

ઉધાર

જાનકી ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ (રૂ.)	તારીખ	વિગત	નો.પા.	રકમ (રૂ.)
				૨૦૧૨ માર્ચ ૨૦	રોકડ ખાતે		૨૭૦૦

ખતવણી

સંયુક્ત આમનોંધની ખાતાવહીમાં ખતવણી

આમનોંધમાં જ્યારે એકથી વધારે ખાતા ઉધાર કે જમા થતા હોય તે તેવી આમનોંધને સંયુક્ત આમનોંધ કહે છે. આમાં આમનોંધ ઉધાર બે ખાતા હોઈ શકે અને જમાબાજુ એક હોઈ શકે અથવા તો ઉધારબાજુ એક ખાતું અને જમા બાજુ બે ખાતા હોઈ શકે છે. આવી સંયુક્ત આમનોંધની ખતવણી કરતી વખતે વધુ ધ્યાન રાખવું પડે છે. ખતવણીના નિયમો આમાં પણ સમાન જ હોય છે.

ઉદાહરણ : નીચેની આમનોંધની ખતવણી ખાતાવહીમાં કરો.

ઉધાર

મોડચ્યુલ - 3

ખતવણી અને કાચું
સરયેચું



નોંધ

જમા

તારીખ	વિગત	ખ.પા.	ઉધાર (રૂ.)	જમા (રૂ.)
૨૦૧૨ મે ૧૫	બેંક ખાતે આપેલ વટાવ ખાતે તે હરિ મોહન ખાતે (બા. જે. કરિ મોહન પાસેથી ચેક મળ્યો અને વટાવ ખાતે).	૩. ૩. ૩.	૨૮,૦૦૦ ૧,૦૦૦ ૧૫,૦૦૦	૩૦,૦૦૦
મે ૧૫	કમળ ખાતે તે બેંક ખાતે તે મળેલ વટાવ ખાતે (બા. જે કમળને ચેકે આપ્યો અને વટાવ મળ્યો તેના)	૩. ૩. ૩.	૧૪,૮૦૦ ૧૦૦	૧૪,૮૦૦

જવાબ

ખાતાવહીમાં ખતવણી

ઉધાર

બેંક ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ મે ૧૫	હરિ મોહન ખાતે		૨૮,૦૦૦	૨૦૧૨ મે ૧૫	કમળ		૧૪,૮૦૦

ઉધાર

હરિ મોહન ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ મે ૧૫	બેંક ખાતે આપેલ વટાવ ખાતે		૨૮,૦૦૦ ૧,૦૦૦

મોડયુલ - 3

ખતવડી અને કાચું
સરયેયું



નોંદા

ખતવડી

ઉધાર

કમળ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ મે ૧૫	બેંક ખાતું મળેલ વટાવ ખાતે		૧૪,૬૦૦ ૧૦૦				
૨૦૧૨ મે ૧૫							

ઉધાર

આપેલ વટાવ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ મે ૧૫	હાર્દિ મોહન ખાતે		૧,૦૦૦				
૨૦૧૨ મે ૧૫							

ઉધાર

મળેલ વટાવ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ મે ૧૫	કમળ ખાતે		૧૦૦

ઉદાહરણ ૧

નીચેના વ્યવહારોની આમનોંધ કરી તેની ખતવડી ખાતાવહીમાં કરો :

તારીખ	વ્યવહાર	રકમ રૂ.
૨૦૧૨		
જાન્યુ. ૧૫	મોહન એન્ડ કંપની પાસેથી રોકડ મળી વટાવ આપ્ય.	૨૫,૬૦૦ ૪૦૦
જાન્યુ. ૧૬	બાબુ પાસેથી ઉધારે (શાખ પર) માલ ખરીદ્યો.	૨૦,૦૦૦
જાન્યુ. ૧૭	બાબુને માલ પરત કર્યો	૫,૦૦૦
જાન્યુ. ૧૮	ઘર વપરાશ માટે લઈ ગયા માલ રોકડ	૧,૦૦૦ ૧,૦૦૦
જાન્યુ. ૨૩	ભાડું ચૂકવ્યું. પગાર ચૂકવ્યું.	૧,૦૦૦ ૧,૦૦૦

ખતવણી

જવાબ:

આમનોંધ

તારીખ	વિગત	ખ.પા.	ઉધાર રૂ.	જમા રૂ.
૨૦૧૨				
જાન્ય. ૧૫	રોકડ ખાતે આપેલ વટાવ ખાતે તે મોછન એન્ડ કંપની ખાતે (બા.જે.રોકડ મળી અને વટાવ આય્યો તેના)	૩.	૨૪,૬૦૦ ૪૦૦	૨૬,૦૦૦
જાન્ય. ૧૬	ખરીદ ખાતે તે બાબુ ખાતે (બા.જે.ઉધાર પર માલ ખરીદ્યો)		૨૦,૦૦૦	૨૦,૦૦૦
જાન્ય. ૧૭	બાબુ ખાતે તે ખરીદ પર ખાતે (બા.જે.બાબુએ માલ પરત કર્યો તેના)	૩.	૪,૦૦૦	૪,૦૦૦
જાન્ય. ૧૮	ઉપાડ ખાતે તે રોકડ ખાતે તે ખરીદ ખાતે (બા.જે.રોકડ અને માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના)	૩.	૨,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦	૧,૦૦૦ ૧,૦૦૦
જાન્ય. ૨૩	ભાડા ખાતે પગાર ખાતે તે રોકડ ખાતે (બા.જે.ભાડા અને પગાર મળ્યા તેના)	૩. ૩.	૧,૦૦૦ ૧,૦૦૦	૨,૦૦૦

ખાતાવણી

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	જમા
૨૦૧૨				૨૦૧૨				
જાન્ય. ૧૫	મોછન એન્ડ કંપની ખાતે		૨૪,૬૦૦	જાન્ય. ૧૮	ઉપાડ ખાતે		૧,૦૦૦	
				જાન્ય. ૨૩	ભાડા ખાતે પગાર ખાતે		૧,૦૦૦ ૧,૦૦૦	

મોડચુલ - ૩
**ખતવણી અને કાચું
સરયેચું**



નોંધ

મોડયુલ - 3

ખતવણી અને કાચું
સરયેયું



નોંદિ

ખતવણી

ઉધાર

આપેલ વટાવ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ જાન્ય. ૧૫	મોહન એન્ડ ક. ખાતે		૪૦૦				

ઉધાર

મોહન એન્ડ કંપની ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ જાન્ય. ૧૫	રોકડ ખાતે આપેલ વટાવ ખાતે		૨૫,૬૦૦ ૪૦૦

ઉધાર

ખરીદ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ જાન્ય. ૧૬	બાબુ ખાતે		૨૦,૦૦૦	૨૦૧૨ જાન્ય. ૧૮	ઉપાડ ખાતે		૧,૦૦૦

ઉધાર

બાબુ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ જાન્ય. ૧૭	ખરીદ પરત ખાતે		૫,૦૦૦	૨૦૧૨ જાન્ય. ૧૯	ખરીદ ખાતે		૨૦,૦૦૦

ઉધાર

ખરીદ પરત ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ જાન્ય. ૧૭	બાબુ ખાતે		૫,૦૦૦

ઉધાર

ઉપાડ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ જાન્ય. ૧૮	રોકડ ખાતે ઉપાડ ખાતે		૧,૦૦૦ ૧,૦૦૦				

ખતવણી

ઉધાર

ભાડા ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ જાન્યુ. ૨૩	રોકડ ખાતે		૧,૦૦૦				

ઉધાર

પગાર ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ જાન્યુ. ૨૩	રોકડ ખાતે		૧,૦૦૦				

ઉદ્દાહરણ ૨

નીચેના વ્યવહારોની આમનોંધ લખી ખાતાવહીમાં ખતવણી કરો.

તારીખ વ્યવહાર

રકમ રૂ.

૨૦૧૨

કેષ. ૧	દિનેશને રોકડ ચૂકવ્યા.		૧૬,૮૦૦
	મળેલ વટાવ		૨૦૦
કેષ. ૨	દિનેશને માલ વેચ્યો		૨૦,૦૦૦
કેષ. ૩	દિનેશે માલ પરત કર્યો		૫૦૦
કેષ. ૪	ઉધાર પર માલ ખરીદો		
	રામ		૧૫,૦૦૦
	હરી		૫,૦૦૦
કેષ. ૬	કમિશન રોકડેથી મળ્યું.		૫૦૦

જવાબ

આમનોંધ

તારીખ	વિગત	ખા.પા.	ઉધાર રૂ.	જમા રૂ.
૨૦૧૨ કેષ. ૧	દિનેશ ખાતે તે રોકડ ખાતે તે મળેલ વટાવ ખાતે (બા. જે દિનેશ પાસેથી રોકડ મળ્યા તેના)	૩.	૧૭,૦૦૦	૧૬,૮૦૦ ૨૦૦

મોડિયુલ - ૩

ખતવણી અને કાયું
સરયેંયું



નોંદા

મોટયુલ - 3

ખતવણી અને કાચું સરદૈયું



၁၄

ખત્રી

ફેલુ. ૨	ઇનેશ ખાતે તે વેચાણ ખાતે (બા. જે માલ વેચ્યો તેના)	રૂ. 6. 	રૂ,000
ફેલુ. ૩	વેચાણ પરત ખાતે તે ઇનેશ ખાતે (બા. જે ઇનેશે માલ પરત કર્યો)	રૂ. 400 	રૂ,000
ફેલુ. ૪	ખરીદ ખાતે તે રામ ખાતે તે હરી ખાતે (બા. જે ઉધાર પર માલ ખરીદ્યો)	રૂ. 6. 	રૂ,000
ફેલુ. ૫	રોકડ ખાતે તે મળેલ કમીશન ખાતે (બા. જે કમીશન મળ્યુ તેના)	રૂ. 6. 	રૂ,000

ખત્રી

ઉધાર		દિનેશ ખાતું				જમા	
તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨				૨૦૧૨			
કેષ. ૧	રોકડ ખાતે		૧૬,૮૦૦	કેષ. ૩	વેચાણ પરત ખાતે		
કેષ. ૧	મળેલ વટાવ ખાતે		૨૦૦				૪૦૦
કેષ. ૨	વેચાણ ખાતે		૨૦,૦૦૦				

ઉધાર		રોકડ ખાતું			જમા		
તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ કેબ. ૬	મળેલ કમિશન ખાતે		૬૦૦	૨૦૧૨ કેબ. ૬	દિનેશ ખાતે		૯૬,૮૦૦

મણેલ વટાવ ખાતું				જમા			
તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨				૨૦૧૨ કેષ. ૧	દિનેશ ખાતે		૨૦૦

અતવાળી

ઉધાર

વેચાણ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ કેષ્ટ. ૨	ઇનેશ ખાતે		૨૦,૦૦૦

ઉધાર

વેચાણ પરત ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ કેષ્ટ. ૩	ઇનેશ ખાતે		૫૦૦				

ઉધાર

ખરીદ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ કેષ્ટ. ૫	રામ ખાતે હરી ખાતે		૧૫,૦૦૦ ૫,૦૦૦				

ઉધાર

રામ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ કેષ્ટ. ૫	ખરીદ ખાતે		૧૫,૦૦૦

ઉધાર

હરી ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ કેષ્ટ. ૫	ખરીદ ખાતે		૫,૦૦૦

ઉધાર

મળેલ કમિશન ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ કેષ્ટ. ૬	રોકડ ખાતે		૬૦૦

મોડયુલ - ૩

અતવાળી અને કાય়
સરયેચુ



નોંધ

મોડયુલ - 3

ખતવણી અને કાયું
સરયેયું



નોંદા

ખતવણી



પાઠ સ્વાધ્યાય ૧૦.૨

નીચે ખતવણીની પ્રક્રિયાનો કમ આપેલ છે, તેને યોગ્ય કર્મમાં ગોઠવો.

- અ) ખાતાવહીમાં ખાતાના નો. પા. ના ખાનામાં આમનોંધનો પાના નંબર લખાય અને આમનોંધના ખા. પા. ના ખાનામાં ખાતાનો પાના નંબર લખાય.
- બ) બે બાજુએ અસરો દર્શાવતું ખાતું ખાતાવહીમાં ખોલો.
- ગ) તારીખ અને ઉધાર ખાતાની રકમ લખો અને જમા ખાતાને ખાતાવહીમાં યોગ્ય ખાનામાં દર્શાવો.

શરૂઆતની આમનોંધની ખતવણી :

દરેક હિસાબી વર્ષની શરૂઆતમાં ચાલુ ધંધાની મિલકત્ટે ને દેવાઓની બાકીઓને આગળના વર્ષના ચોપડામાં લખવા માટે જે આમનોંધ કરાય છે તેને શરૂઆતની આમનોંધ કહે છે. આમ શરૂઆતની આમનોંધની ખતવણી જુદી રીતે થાય છે. બધી જ મિલકતોની બાકીઓ ઉધાર હોય છે તેથી તેના ખાતા ખોલી ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા લખી રકમ લખાય છે તે જ રીતે દેવાઓની જમા બાકી હોય છે તેથી બધા જ દેવાઓના ખાતા ખોલી જમા બાજુએ બાકી આગળ લાવ્યા છે.

આ રીતે શરૂઆતની આમનોંધની ખતવણી કરાય છે, બાકીની આમનોંધની ખતવણી સામાન્ય રીતે જ કરાય છે.

ઉદાહરણ : નીચેની શરૂઆતની આમનોંધની ખતવણી કરો.

આમનોંધ

તારીખ	વિગત	ખા.પા.	ઉધાર રૂ.	જમા રૂ.
૨૦૧૨				
એપ્રિલ ૧	રોકડ ખાતે	૩.	૭૦,૦૦૦	
	યંત્ર ખાતે	૩.	૨,૧૦,૦૦૦	
	બેંક ખાતે	૩.	૭૦,૦૦૦	
	બિપિન (દેવાદાર) ખાતે	૩.	૧,૦૦,૦૦૦	
	તે મૂડી ખાતે			૩,૮૦,૦૦૦
	તે હરિરામ ખાતે			૫૦,૦૦૦
	તે HDFC બેંકની લોન ખાતે			૨૦,૦૦૦
	(શરૂઆતથી પ્રવેશ કરવો)			

ખતવણી

જવાબ :

મોડિયુલ - 3

ખતવણી અને કાચું
સરયેચું



નોંધ

ખાતાવહીમાં ખતવણી

ઉધાર

રોકડ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૭૦,૦૦૦				

ઉધાર

યંત્ર ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૨૧૦૦૦૦				

ઉધાર

બેંક ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૭૦,૦૦૦				

ઉધાર

બિપિન ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૧૦૦૦૦૦				

ઉધાર

મૂડી ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૩૮૦૦૦૦

ઉધાર

હરિરામ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૪૦,૦૦૦

મોડયુલ - 3

ખતવણી અને કાયું
સરયેયું



નોંદા

ખતવણી

ઉધાર

HDFC લોનનું ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૨૦,૦૦૦

૧૦.૪ ખાતાની બાકી શોધવી :

દરેક હિસાબી વર્ષના અંતે દરેક ખાતાની બંને બાજુનો સરવાળો કરી તફાવતની રકમ શોધવામાં આવે છે તેને બાકી કહે છે. આ તફાવતની રકમ જે બાજુ સરવાળો ઓછો આવતો હોય તે બાજુ લખાય છે. સામાન્ય રીતે હિસાબી વર્ષના અંતે ખાતાવહીના તમામ ખાતાઓની બાકી શોધી ખાતાઓને બંધ કરાય છે. ખાતાની બાકી શોધવા નીચે મુજબ પગલાં લેવાય છે.

- ખાતાની બંને બાજુનો સરવાળો કરી બાકીની રકમ શોધવામાં આવે છે.
- જો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુ કરતા વધુ હોય તો તફાવતની રકમ ઉધાર બાજુ લખી બાકી આગળ લઈ ગયા લખાશે.
- જો ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કરતા વધુ હોય તો તફાવતની રકમ જમા બાજુ લખી બાકી આગળ લઈ ગયા લખાશે.
- ખાતાની બંને બાજુનો સરવાળો સરખો લખાશે.
- દરેક ખાતાના સરવાળાની નીચે બે લીટી દોરવી.
- ગયા વર્ષની બાકી આગળ લઈ ગયા તે આ વર્ષે બાકી આગળ લાવ્યા તરીક લખાશે.

ખાતાની બાકી શોધવાની પ્રક્રિયા

ખાતાની બંને બાજુઓનો સરવાળો કરો.

તફાવતની રકમ શોધો

જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો
તફાવતની રકમ જમા બાજુએ લખી
બાકી આગળ લઈ ગયા લખીશું

જો જમા બાજુનો સરવાળો વધુ હોય તો
તફાવતની રકમ ઉધાર બાજુએ લખી
બાકી આગળ લઈ ગયા લખીશું.

ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો કરો

સરવાળાની નીચે બે લીટીઓ દોરો

બીજા દિવસે બાકીઓને આગળ લાવો

ઉધાર બાકીને ઉધાર બાજુ લખી
બાકી આગળ લાવ્યા લખવું

જમા બાકીને જમા બાજુ લખી
બાકી આગળ લાવ્યા લખવું

ખતવણી

ક્યા પ્રકારના ખાતાઓની બાકીઓ શોધવી : સામાન્ય રીતે મૂડી ખાતાં, મિલકતના ખાતા અને જવાબદારીનાં ખાતા બંધ કરી બાકીઓ શોધાય છે, જ્યારે ઉપર અને ખર્ચના ખાતાંઓ ની બાકી શોધવામાં નથી આવતી પરંતુ હિસાબી વર્ષના અંતે તેને બંધ કરી તેની બાકી વેપાર કે નફા નુકશાન ખાતે લઈ જવાય છે.

ઉદાહરણ રૂ

ગુડલક ગારમેન્ટના ચોપડે રૂ. ૧-૪-૧ રના રોજ નીચે મુજબની બાકીઓ છે.

મિલકત : રોકડ રૂ. ૫૮૦૦, સ્ટોક રૂ. ૪૦૦૦, ભીમ રૂ. ૨૫૦૦, દિનેશ રૂ. ૩૨૦૦,
ફર્નિયર રૂ. ૧૬૦૦

જવાબદારી : સુમન પ્રિન્ટર્સ રૂ. ૩,૬૦૦

એપ્રિલ ૨૦૧૨ દરમ્યાન નીચે મુજબના વ્યવહારો થયા.

એપ્રિલ ૨ સત્યનારાયણ પાસેથી રૂ. ૧૦,૦૦૦નો માલ ૧૦% વેપારી વટાવ તથા ૨% રોકડ
વટાવે ખરીયો તેને ૩૦% રકમ તરત જ ચૂકવી.

એપ્રિલ ૬ રોકડથી રૂ. ૮૦૦૦નો માલ વેજયો અને ભીમને રૂ. ૪૬૦૦નો માલ ઉધાર વેચ્યો.

એપ્રિલ ૧૦ સુમન પ્રિન્ટર્સ પાસેથી રૂ. ૪૦૦૦નો માલ રૂ. ૩૮૦૦માં ખરીયો.

એપ્રિલ ૧૬ સુમન પ્રિન્ટર્સને રૂ. ૩૪૦૦ રોકડ ચૂકવ્યાં

એપ્રિલ ૧૮ રૂ. ૧૨૦૦નો માલ કિષણાને રોકડથી વેચ્યો.

એપ્રિલ ૨૫ ભીમે રૂ. ૭૦૦૦ ચૂકવી તેનું ખાતું ચૂકતે કરાવ્યું.

એપ્રિલ ૩૦ ચાલુ માસનો પગાર રૂ. ૭૫૦૦ ચૂકવ્યું.

ઉપરના વ્યવહારોની આમનોંધ કરી ખાતાવહીમાં ખતવજી કરી બાકીઓ શોધો.

જવાબ

ગુડલકના ચોપડે આમનોંધ

મોડચુલ - ૩

ખતવજી અને કાચું
સરયેચું



નોંધ

મોડચુલ - 3

ખતવણી અને કાયું
સરથેયું



નોંદા

અતિવધી

એપ્રિલ ૨	(બા. જે શરૂઆતની આમનોંધ લખી તેના) ખરીદ ખાતે ૩.	૮,૦૦૦	
	તે રોકડ ખાતે		૫,૨૮૨
	તે વટાવ ખાતે		૭૦૮
	તે સત્યનારાયણ ખાતે		૩,૫૦૦
	(બા. જે માલ ખરીદ્યો અને ૬૦% રકમ ૨% રો.વ.ચૂકવી)		
એપ્રિલ ૬	રોકડ ખાતે ૩.	૮,૦૦૦	
	ભીમ ખાતે ૩.	૪,૬૦૦	
	તે વેચાળ ખાતે		૧૨,૬૦૦
	(બા. જે માલ વેચ્યો)		
એપ્રિલ ૧૦	ખરીદ ખાતે ૩.	૩,૮૦૦	
	તે સુમન પ્રિન્ટર્સ ખાતે		૩,૮૦૦
	(બા. જે માલ શાખ પર ખરીદ્યો તેના)		
એપ્રિલ ૧૬	સુમન પ્રિન્ટર્સ ખાતે ૩.	૩,૮૦૦	
	તે રોકડ ખાતે		૩,૮૦૦
	(બા. જે. રોકડ ચૂકવ્યા તેના)		
એપ્રિલ ૧૮	રોકડ ખાતે ૩.	૧,૨૦૦	
	તે વેચાળ ખાતે		૧,૨૦૦
	(બા. જે કિઝાને માલ રોકેથી વેચ્યો)		
એપ્રિલ ૨૫	રોકડ ખાતે ૩.	૭,૦૦૦	
	વટાવ ખાતે.		૭,૦૦૦
	તે ભીમ ખાતે		
	(બા. જે રોકડ વટાવ કાપી રકમ મળી તેના)		
એપ્રિલ ૩૦	પગાર ખાતે ૩.	૭,૪૦૦	
	તે રોકડ ખાતે		૭,૪૦૦
	(બા. જે. પગાર ચૂકવ્યુ તેના)		
	સરવાળો	૬૨,૭૦૦	૬૨,૭૦૦

અતવાણી

ગુડલક ગારમેન્ટની ખાતાવહી

ઉધાર

રોકડ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨				૨૦૧૨			
એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૫,૮૦૦	એપ્રિલ ૨	ખરીદ ખાતે		૫,૨૮૨
એપ્રિલ ૬	વેચાણ ખાતે		૮,૦૦૦	એપ્રિલ ૧૬	સુમન પ્રેન્ટસ		૩,૪૦૦
એપ્રિલ ૧૮	વેચાણ ખાતે		૨,૨૦૦	એપ્રિલ ૩૦	પગાર ખાતે		૭,૪૦૦
એપ્રિલ ૨૫	ભીમ ખાતે		૭,૦૦૦	એપ્રિલ ૩૦	બાકી આગળ લઈ રહ્યા		૫,૮૦૮
			૨૨,૦૦૦				૨૨,૦૦૦
મે ૧	બાકી આગળ લાવ્યા		૫,૮૦૮				

મોડિયુલ - ૩

અતવાણી અને કાયું સરયેચું



નોંધ

ઉધાર

સ્ટોક ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨				૨૦૧૨			
એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૫,૦૦૦	એપ્રિલ ૩૦	વેપાર ખાતે		૫,૦૦૦
			૫,૦૦૦				૫,૦૦૦

ઉધાર

ભીમનું ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨				૨૦૧૨			
એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૨,૪૦૦	એપ્રિલ. ૨૫	રોકડ ખાત		૭,૦૦૦
એપ્રિલ ૬	વેચાણ ખાતે		૪,૬૦૦	એપ્રિલ. ૨૫	વટાવ ખાતે		૧૦૦
			૭,૯૦૦				૭,૯૦૦

ઉધાર

દિનેશ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨				૨૦૧૨			
એપ્રિલ ૧	બાકી આગળ લાવ્યા		૩,૨૦૦	એપ્રિલ ૩૦	બાકી આગળ લઈ		૩,૨૦૦
			૩,૨૦૦				૩,૨૦૦
મે ૧	બાકી આગળ લાવ્યા		૩,૨૦૦				

મોડયુલ - 3

ખતવણી અને કાયું
સરયેયું



નોંદિ

ખતવણી

ઉધાર

ફર્નિચર ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ એપ્રિલ ૧ મે ૧	બાકી આગળ લાવ્યા		૧,૬૦૦	૨૦૧૨ એપ્રિલ ૩૦	બાકી આગળ લઈ		૧,૬૦૦
			૧,૬૦૦				૧,૬૦૦
			૧,૬૦૦				

ઉધાર

સુમન પ્રિન્ટર્સ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ એપ્રિલ ૧૬ એપ્રિલ ૩૦	રોકડ ખાતે બાકી આગળ લઈ		૩,૪૦૦	૨૦૧૨ એપ્રિલ ૧ એપ્રિલ ૧૦ મે ૧	બાકી આગળ લાવ્યા ખરીદ ખાતે બાકી આગળ લાવ્યા		૩,૬૦૦
			૪,૦૦૦				૩,૮૦૦
			૭,૮૦૦				૭,૮૦૦
							૪,૦૦૦

ઉધાર

મૂડી ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ એપ્રિલ ૩૦	બાકી આગળ લઈ		૧૪,૪૦૦	૨૦૧૨ એપ્રિલ ૧ મે ૧	બાકી આગળ લાવ્યા		૧૪,૪૦૦
			૧૪,૪૦૦				૧૪,૪૦૦
							૧૪,૪૦૦

ઉધાર

ખરીદ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ એપ્રિલ ૨ એપ્રિલ ૨ એપ્રિલ ૨ એપ્રિલ ૧૦	રોકડ ખાતે વટાવ ખાતે સસ્તનારાયક ખાતે સુમન પ્રિન્ટર્સ ખાતે		૫,૨૮૨	૨૦૧૨ એપ્રિલ ૩૦	વેપાર ખાતે		૧૨,૮૦૦
			૧૦૮				૧૨,૮૦૦
			૩,૬૦૦				૧૨,૮૦૦
			૩,૮૦૦				૧૨,૮૦૦
			૧૨,૮૦૦				૧૨,૮૦૦

ખતવણી

ઉધાર

વટાવ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ એપ્રિલ ૨૫	ભીમ ખાતે		૧૦૦	૨૦૧૨ એપ્રિલ ૧૨	ખરોદ ખાતે		૧૦૮
એપ્રિલ ૩૦	ન.નુ. ખાતે		૮				૧૦૮
			૧૦૮				૧૦૮

મોડચ્યુલ - ૩

ખતવણી અને કાય়
સરયેચું



નોંધ

ઉધાર

સત્યનારાયણ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨				૨૦૧૨			
એપ્રિલ ૩૦	બાકી આગળ લાવ્યા		૩,૫૦૦	એપ્રિલ ૨	ખરોદ ખાતે		૩,૫૦૦
			૩,૫૦૦				૩,૫૦૦
			૩,૫૦૦	મે ૧	બાકી આગળ લાવ્યા		૩,૫૦૦

ઉધાર

વેચાણ ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨				૨૦૧૨			
એપ્રિલ ૩૦	વેપાર ખાતે		૧૩,૮૦૦	એપ્રિલ ૬	રોકડ ખાતે		૮,૦૦૦
				એપ્રિલ ૬	ભીમ ખાતે		૪,૫૦૦
			૧૩,૮૦૦	એપ્રિલ ૧૮	રોકડ ખાતે		૨,૨૦૦
			૧૩,૮૦૦				૧૩,૮૦૦

ઉધાર

પગાર ખાતું

જમા

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨				૨૦૧૨			
એપ્રિલ ૩૦	રોકડ ખાતે		૭,૪૦૦	એપ્રિલ ૩૦	ન.નુ. ખાતે		૭,૪૦૦
			૭,૪૦૦				૭,૪૦૦

મોડયુલ - 3

ખતવણી અને કાચું
સરયેયું



નોંધ

ખતવણી



પાઠ સ્વાધ્યાય ૧૨.૩

૧. ખાલી જગ્યા ભરો.

૧. મિલકતના ખાતાની બાકી હમેશા હોય છે.
૨. દેવાંઓના ખાતાની બાકી હમેશા હોય છે.
૩. મૂડી ખાતાની બાકી સામાન્યતઃ હોય છે.
૪. ઉપર અને ખર્ચ ખાતાની બાકીઓ ખાતે લઈ જઈ બંધ
કરાય છે.

૧. નીચેના ખાતાની બાકી શોધો.

૩.

જોગીંદર ખાતુ

તારીખ	વિગત	નો.પા.	રકમ	તારીખ	વિગત	નોંધ	રકમ
૨૦૧૨ કેન્દ્રી	વેચાણ ખાતે		(૩) ૬,૦૦૦	૨૦૧૨ કેન્દ્રી ૧૦		રોકડ ૨૦	(૩) ૪,૮૮૦

વરાવ ખાતે ખાતે ૨૦

મળવાપાત્ર ભાડુ ખાતુ

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ કેન્દ્રી				૨૦૧૨ કેન્દ્રી	રોકડ ખાતે		૨૦૦૦

૨. નીચેના ખાતાઓની બાકીઓ શોધો.

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
૨૦૧૨ કેન્દ્રી ૧	વેચાણ ખાતે		૬૦૦૦	૨૦૧૨ કેન્દ્રી ૨૦	રોકડ ખાતે		૪૮૮૦ ૨૦

મળેલ ભાડાનું ખાતુ

તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો.પા.	રકમ રૂ.
				૨૦૧૨ કેન્દ્રી ૨૦	રોકડ ખાતે		૨૦૦૦



નોંધ

૩. બહુવૈકલ્પિક પ્રશ્નો :

- (૧) નામનો એવો ચોપડો કે જેમાં બધાજ ખાતા રાખવામાં આવે છે તે છે.
 (A) રોકડ મેળ (B) ખાતાવહી (C) આમનોંધ (D) દેનિક નોંધ
- (૨) ખાતાવહી બનાવવાનો નીચેના માંથી ક્યો હેતુ નથી ?
 (A) ધંધાના ઢેવાઈએ અને લેણાઈએ જાણવા
 (B) ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા
 (C) સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી
 (D) ધંધાના માલિક કે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું.
- (૩) ખાતાવહી એ ચોપડો છે.
 (A) મૂળ અસર (B) ગૌણ અસર
 (C) બધા રોકડ વ્યવહારો (D) પેટા રોકડ વ્યવહારો
- (૪) ખાતાવહીમાં લખવાની પ્રક્રિયા ને શું કહે છે.
 (A) (B) બાકીઓ શોધવી (C) આમનોંધ (D) ખતવણી
- (૫) મૂળભૂત રીતે ખાતાને બે ભાગ માં વહેચવામાં આવે છે જેની ડાબી બાજુને શું કહે છે
 (A) જમા બાજુ (B) ઉધાર બાજુ (C) ખોટી બાજુ (D) સાચી બાજુ
 (A) - (B) - (C) - (D) -
 (A) - (B) - (C) - (D) -



તમે આટલું શીખ્યા :

- જે ચોપડામાં બધાજ ખાતાઓ રાખવામાં આવે છે તેને ખાતાવહી કહે છે.
- જરૂરી ખાતાઓ ખોલી રોછુંદા, વ્યવહારો ને ખાતાવહીના ખાતાઓ માં લખવાની પ્રક્રિયાને ખતવણી કહેવાય.

ખાતાવહી ઉદ્દેશ્યો :

- વિવિધ વ્યવહારોની માહિતી મેળવવી
- વ્યવહારો પર યોગ્ય અંકુશો રાખવો.
- કાચું સરવેચું બનાવવામાં મદદરૂપ થવું
- નાણાંકીય પત્રકો બનાવવામાં મદદરૂપ થવું.
- આમ નોંધમાં જે ખાતુ જમા થતુ હોય તેને સામેના ખાતાની જમા બાજુએ ખાતવામાં આવે છે.
- આમ નોંધમાં જે ખાતુ જમા થતુ હોય તેને તેના સામેના ખાતાની ઉધાર બાજુએ ખતવામાં આવે છે.

મોડચુલ - 3

ખતવણી અને કાયું
સરયેયું



નોંદા

ખતવણી

- ખાતાવહીમાં ખાતાના નામ વિગતના ખાનામાં લખાય છે.



પાઠ્યાંત સ્વાધ્યાય :

- ખાતાવહી એટલે શું ? શા માટે ખાતાવહી બનાવાય છે ?
- ખાતાવહી ના ખાતાઓનું નમૂનો દોરો.
- આમનોંધ અને ખાતાવહી વચ્ચેનો તફાવત સમજાવો.
- ખાતાની બાકી શોધવી એટલે શું ?
- નીચેના વ્યવહારોની આમનોંધ લખી ખાતાવહીમાં ખતવણી કરી બાકીઓ શોધો.

૨૦૧૨	વિગત	રૂ.
એપ્ર. ૧	રોડ લાવી ધંધો શરૂ કર્યો	૧,૦૦,૦૦૦
એપ્ર. ૩	બેંકમાં જમા કરાવ્યા	૩૦,૦૦૦
એપ્ર. ૪	રોકડેથી ફર્નિચર ખરીદ્યુ	૫,૦૦૦
એપ્ર. ૮	માલ ખરીદ્યો અને ચૂકવણી ચેકથી કરી	૧૫,૦૦૦
એપ્ર. ૧૪	હરિ પાસેથી માલ ખરીદ્યો	૩૫,૦૦૦
એપ્ર. ૧૮	રોકડ વેચાણ	૩૨,૦૦૦

૬.

- | | | |
|-----------|--|----------|
| ઝન્યુ. ૧ | હાથ પર રોકડ | ૧,૫૦,૦૦૦ |
| ઝન્યુ. ૧ | હાથ પર માલ સ્ટોક | ૮૦,૦૦૦ |
| ઝન્યુ. ૧ | મજૂરી ચૂકવવાની બાકી | ૨૦,૦૦૦ |
| ઝન્યુ. ૪ | ધર્મદામાં આચ્યા | ૫૦૯ |
| ઝન્યુ. ૪ | આકાશ પાસેથી માલ ખરીદ્યો | ૨૦,૦૦૦ |
| ઝન્યુ. ૫ | ભાડુઅાત પાસેથી ભાડું મળ્યું | ૫,૦૦૦ |
| ઝન્યુ. ૧૮ | આકાશને રોકડ ટૂકવ્યા | ૧૭,૦૦૦ |
| ઝન્યુ. ૨૨ | લોનનું વ્યાજ મળ્યું | ૧,૭૫૦ |
| ઝન્યુ. ૨૪ | મગને માલ પરત કર્યો | ૧,૨૫૦ |
| ઝન્યુ. ૨૬ | આકાશને માલ પરત કર્યો | ૨,૦૦૦ |
| ઝન્યુ. ૨૮ | રામ કે જેની પાસેથી રૂ. ૪૦૦ લેણા હતા તે દેવાદાર
જહેર થયો તેની પાસેથી રૂપિયા છિં ૪૦ પૈસા રકમ મળી. | |
| ૩૧ | પટેલે પોતાના દિકરા માટે મોટર સાઈકલ ખરીદ્યી | ૪૨,૦૦૦ |
| ૭. | ૧. જૂલાઈ ૨૦૧૨ ના રોજ કિષણાના ચોપડે નીચે મુજબની બાકીઓ હતી હાથ પર રોકડ રૂ. ૨૦૦૦ બેંકમાં રોકડ રૂ. ૧૨૦૦૦ દેવી છૂંડી રૂ. ૪૦૦૦, અશોક(દેવાદાર)રૂ. ૪૦૦૦ અશોક | |

ખતવણી

(દેવદાર) રૂ. ૨૫૦૦, સ્ટોક રૂ. ૧૦૦૦, ચારુ (લોણદાર) રૂ. ૨૦૦૦ માસ દરમ્યાન નીચે મુજબના વ્યવહારો થયાં

રૂઠી	વિગત	રૂ.
જુલાઈ૧	ચારુ પાસેથી માલ ખરીદો	૧૦,૦૦૦
જુલાઈ૨	સુરેશને માલ ખરીદો	૨૧,૦૦૦
જુલાઈ૩	રામ લખન પાસેથી	૧૬,૦૦૦
જુલાઈ૪	પરેશને માલ વેચ્યો	૮,૦૦૦
જુલાઈ૧૨	ચારુને ચેકથી ચૂકવ્યા	૧૬,૦૦૦
જુલાઈ૨૦	સુરેશ પાસેની ચેક મળ્યો તેમને વટાવ આય્યો	૮,૬૦૦ ,૯૦૦
જુલાઈ૨૪	સુરેશને માલ વેચ્યો	૧૮,૦૦૦
જુલાઈ૨૫	ભાડું ચેકથી ચૂકવ્યું	૨,૦૦૦
જુલાઈ૨૫	પરેશને માલ વેચ્યો	૧૫,૦૦૦
જુલાઈ૩૧	પગાર ચૂકવ્યો	૫,૦૦૦

આમ નોંધ લખી ખાતાવહમાં ખતવણી કરો.

- c. નીચે આપેલ વ્યવહારોની શ્રી ગરીબ ચંદ એન્ડ રાન્સના ચોપડે આમનોંધતેયાર કરી તેને ખાતાવહી ખતવણી કરો.

રૂઠી	વિગત	રૂ.
એપ્રિ. ૧	હાથ પર રોકડ	૧૧,૪૦૦
એપ્રિ. ૧	માલ સ્ટોક	૧૨,૪૦૦
એપ્રિ. ૧	બંક સિલક	૨૦,૦૦૦
એપ્રિ. ૧	રમેશ દેવું	૧,૦૦૦
એપ્રિ. ૧	તારા પાસેથી લેણું	૨,૦૦૦
એપ્રિ. ૨	મનમોહનને માલ વેચ્યો	૧૪,૦૦૦
એપ્રિ. ૪	રોકડ વેચાણ	૭,૦૦૦
એપ્રિ. ૭	રાજ પુરોહિતને માલ વેચ્યો	૪,૦૦૦
એપ્રિ. ૮	રમેશ પાસેથી માલ ખરીદો	૧,૨૪૦
એપ્રિ. ૧૫	તારાને માલ વેચ્યો	૨,૦૦૦
એપ્રિ. ૧૮	મજૂરી ચૂકવી	૪૦૦
એપ્રિ. ૨૧	મનમોહન પાસેથી મળ્યા	૬,૦૦૦
એપ્રિ. ૨૮	ધંધાનો માલિક તેનાઅંગત વપરાશ માટે લઈ જ્યો	૧,૦૦૦
એપ્રિ. ૩૦	આવકવેરો ચૂકવ્યો	૫,૦૦૦

મોડચુલ - ૩
ખતવણી અને કાયું
સરયેયું



નોંધ

મોડયુલ - 3

ખતવણી અને કાચું
સરયેચું



નોંદિ

ખતવણી



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

- | | | | |
|------|--|--------------|----------|
| ૧૦. | ૧. ખાતાવહી | ૨. મુખ્ય | ૩. ખતવકૃ |
| | ૪. આમનોંધ | ૫. વૈશ્વલેષણ | |
| ૧૦.૨ | ૬. બ. | ૭. ક | |
| ૧૦.૩ | ૧. ઉધાર | ૨. જમા | ૩. જમા |
| | ૪. વેપાર કે મફાનુકશાન ખાતે | | |
| ૨. | બાકીઆગળ લઈ ગયા (ઉધાર) રૂ. ૧૦૦૦ બાકીઆગળ લઈ (જમા) રૂ. ૨૦૦૦ | | |
| ૩. | ૧. એ | ૨. ઝ | ૩. ઝ |
| | | | ૪. ઝ |

તમારા માટે કાર્ય :

કોઈ શોપિંગ મોલ હુકાનમાં જોઓ ત્યાં કેટલા વ્યવહારો થાય છે તે જોઓ અંદાજીત આકડા વડે તે વ્યવહારોને નોંધો. અંદાજે દસ જેટલા વ્યવહારોની આમ નોંધ લખી ખાતાવહી ખતવકૃ કરો.



નોંધ

૧૧

કાચું સરવેયું અને હિસાબી ભૂલો

તમે ધ્યાના વ્યવહારોને આમ નોંધ કે પેટા નોંધમાં કેવી રીતે નોંધવા તે શીખી ચુકવ્યા છો તેની ખાતાવહીમાં ખતવણી કરવાની પ્રક્રિયા પણ તમે જાણો છો. વ્યવહારો નોંધવાની અને તેની ખતવણી કરવાની પ્રક્રિયા વર્ષ દરમ્યાન ચાલતી જ હોય છે તેથી વર્ષના અંતે વાર્ષિક હિસાબો બનાવતા પહેલા હિસાબી ચોપડાઓને આંકડાકીય રીતે સાચા છે તેની તપાસ કરવા એક પત્રક બનાવવામાં આવે છે તેને કાચું સરવૈયું કહે છે. આ પાઠમાં તમે કાચું સરવૈયું કેવી રીતે બનાવી શકાય તે શીખશો તથા હિસાબોની ચોકસાઈમાં તે કેટલું ભરોસા પાત્ર છે તે સમજશો અને તેના દ્વારા ભૂલો શોધી તે સુધારણા કરવાની પ્રક્રિયા વિશે જાણશો.



હેતુઓ :

આ પાઠ શીખ્યા પછી તમે જાણશો

- કાચા સરવૈયાનો વ્યાખ્યા
- કાચું સરવૈયું બનાવવાના હેતુઓ
- કાચા સરવૈયાનો સરવાળો ન મળવાના કારણો
- કાચા સરવૈયાની અસર કરતી કે અસર ન કરતી ભૂલો શોધવી
- ભૂલો શોધવાની પદ્ધતિઓ શીખશો.
- કાચા સરવૈયાની મયાર્દાઓ વર્ણવી
- કાચું સરવૈયું તેયાર કરવું
- ઉપલક ખાતાનો અર્થ અને તેને દૂર કરવાના ઉપાય

૧૧.૧ કાચા સરવૈયાનો અર્થ

કાચું સરવૈયું એટલે કોઈ નિશ્ચિત સમયને અંતે લખાયેલ હિસાબો ગાણિતિક દખીએ સાચા છે કે કેમ તે તપાસવા માટે ખાતાવહીમાંથી ખાતાની સિલકો ઉપરથી વ્યવસ્થિત રીતે તેયાર કરવામાં આવતું પત્રક.

ERICK AND TONI'S COMPANY
Post-Closing Trial Balance Statement
For the Month of March

	Debit	Credit
Cash	\$ 11,000	
Accounts receivable	8,000	
Inventory	40,000	
Accrued salaries payable	5,000	
Accounts payable	4,000	
Dividends payable	2,000	
Interest payable	1,200	
Notes payable	20,000	
Unearned revenue	10,000	
Capital stock	30,000	
Retained earnings	2,000	
Total Assets	\$ 61,000	
Total Liabilities and Capital	\$ 61,000	

Balance sheet, reflecting the final balance as result of all entries. Total Assets = Total Liabilities + Capital.

મોડ્યુલ - 3

ખતવણી અને કાચું
સરવૈયું



નોંદા



કાચું સરવૈયું અને હિસાબી ભૂલો

દરરોજ ધંધામાં ઘણાબધા વ્યવહારો થતા હોય છે. આ તે વ્યવહારો પહેલા આમ નોંધ કે પેટાનોધોમાં નોંધવામાં આવે છે બધા જ વ્યવહારોને આમનોંધ કે પેટાનોધમાં લખ્યા પછી તેની ખતવણી ખાતાવહીમાં બનેલા ખાતાઓમાં કરવામાં આવે છે ખતવણીની પ્રક્રિયા પૂર્ણ કર્યો પછી બધા જ ખાતાઓની સિલકો શોધી તે ગાણિતિક રીતે સાચા છે કે નહી તે જાણવા એક પત્રક બનાવવામાં આવે છે જેને કાચું સરવૈયું કહીએ છીએ. કાચા સરવૈયામાં બધા જ ખાતાઓની સિલક લખી તેની જમા કે ઉધાર જે સિલક હોય તે પ્રમાણે લખવામાં આવે છે ઉધાર સિલક ઉધારના ખાનામાં અને જમા સિલક જમાના ખાનામાં લખાય છે, પછી બસે ખાનાઓ સરવાળો કરવામાં આવે છે જે સરખો હોવો જોઈએ જો ઉધાર અને જમા ખાનાઓનો સરવાળો સરખો હોય તો હિસાબો ગાણિતિક રીતે સાચા છે તેવું પ્રાથમિક તારણ કાઢી શકાય પણ જો બસે ખાનાઓની સરવાળો સરખો ન થાય તો હિસાબોમાં કાંઈક ભૂલ છે તેવું માનવમાં આવશે.

ચોક્કસ તારીખે ખાતાની સિલક પરથી ઉધાર કે જમા ખાનામાં દરેક ખાતાની રકમ લખી તેની મેળવણી કરવામાં આવે છે તેથી હિસાબો દ્વિનોંધી નામા પદ્ધતિના નિયમો મુજબ જ લખાયા છે તે સાબિત થાય છે કાચું સરવૈયું ખાતાના સરવાળા કે તેની સિલકો પરથી બનાવી શકાય છે.

૧૧.૨ કાચું સરવૈયું તૈયાર કરવાના હેતુઓ

- ૧) ગાણિતિક ચોક્કસાઈ તપાસવા : કાચા સરવૈયાની મદદથી હિસાબની શોએ કોઈ ગાણિતિક ભૂલ કરી હોય તે શોધી શકાય છે. જો હિસાબોમાં ગાણિતિક ભૂલ હશે તો કાચા સરવૈયાનો સરવાળો સરખો નહી આવે તેથી ભૂલ શોધી શકાશે અને તેની સુધારણા કરી શકાશે.
- ૨) ધંધાનો વાર્ષિક હિસાબ તૈયાર કરવા : કાચું સરવૈયું એ વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે આધાર પૂરુ પાડે છે. જો કાચું સરવૈયું બનાવ્યા વગર જ વાર્ષિક હિસાબ તૈયાર કરાય તો કોઈ ક વ્યવહાર નોંધવાનો રહી પણ જાય તેવું બની શકે તેથી ધંધાનો વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે કાચું સરવૈયું જરૂરી છે.
- ૩) દરેક ખાતાનો તુલનાત્મક અભ્યાસ : કાચા સરવૈયા દ્વારા કોઈ ખાતાની ચાલુ વર્ષના ખાતાની સિલકને પાછલા વર્ષની ખાતાની સિલક સાથે સરખાવી શકાય છે તેથી પાછલા વર્ષ કરતા ચાલુ વર્ષની બાકી વધુ છે કે ઓછી તે જાણી નીતી વિધ્યક નિષયો લઈ શકાય તેથી નફાની સ્થિતિ સુધારવા ઘસારાના દરમાં ઘટાડો કરવો કે નહી તે નિષય લઈ શકાય.
- ૪) નાણાકીય અંદાજપત્ર તૈયાર કરવું : પાછલા નાણાકીય વર્ષના આંકડાઓના આધારે આવતા વર્ષનું નાણાકીય અંદાજપત્ર બનાવી શકાય બીજા શબ્દોમાં કહીએતો કાચા સરવૈયાની મદદથી વિવિધ અંદાજપત્રો બનાવી શકાય.



સ્વાધ્યાયના પ્રશ્નો : ૧૧.૧

નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો

- ૧) કાચુ સરવૈયુ એ નામાની પ્રક્રિયાનો અગત્યનો ભાગ છે.
- ૨) કાચુ સરવૈયુ વર્ષમાં એકજ વાર બનાવાય છે
- ૩) જો કાચા સરવૈયાના બને ખાનાઓનો સરવાળો સરખો હોય તો ખતવણી સાચી રીતે થઈ છે તેમ કહેવાય
- ૪) કાચા સરવૈયામાં ખાતાની ઉધાર સિલક ઉધારના ખાનામાં અને જમા સિલક જમાના ખાનામાં લખાય છે
- ૫) મિલકતો અને ખર્ચના ખાતાઓની જમા સિલક હોય છે.

૧૧.૩ કાચુ સરવૈયુ ન મળવાના કારણો

ઉપર જણાવ્યા મુજબનો કાચા સરવૈયાનો સરવાળો ન મળે તો હિસાબી ચોપડામાં કંઈક ભૂલ છે તે જાણી શકાય. હવે કાચા સરવૈયાને અસર કરતી આવી ભૂલો વિષે જાણીએ.

- ૧) એક ખાતામાં ખતવણી કરવાનું જ ભૂલી જવાય : તમે જાણો છો કે ખતવણી કરતી વખતે દરેક વ્યવહારની બેવડી અસરની ખતવણી બને ખાતાઓમાં કરાય છે. ઉધારની ઉધાર બાજુએ અને જમાની બાજુએ જો તમે ઉધાર કે જમામાંથી કોઈ એક ખતવણી કરવાનું ભૂલી જાય તો કાચુ સરવૈયુ મળશે નહીં દા.ત. રૂ. ૨૦૦ રાજ પાસેથી મળ્યા, તેની નોંધ રોકડમેળ માં ઉધાર બાજુ બરાબર કરી છે પણ રાજના ખાતામાં જમા બાજુ તેની ખતવણી કરી નથી તેથી કાચા સરવૈયામાં ઉધાર ખાનાનો સરવાળો જમા ખાનાના સરવાળા કરતા વધારે આવશે અને કાચુ સરવૈયુ મળશે નહીં.
- ૨) એક ખાતામાં બેવાર ખતવણી થાય : જો કોઈ ખાતામાં ઉધાર બાજુ કે જમા કાચા સરવૈયાનો સરવાળો આવશે નહીં દા.ત. રૂ. ૪૦૦૦ અશોક પાસેથી મળ્યા તેની ખતવણી અશોકના ખાતા મે બે વાર કરવામાં આવી હોય તો કાચા સરવૈયાના જમા ખાનાનો સરવાળો રૂ. ૪૦૦૦ વધુ આવશે.
- ૩) ખાતાની ખોટી બાજુએ ખતવણી થાય : જો ખાતામાં ખતવણી કરતી વખતે ઉધાર બાજુએ ખતવણી ન કરતા તેની ખતવણી જમા બાજુએ થાય તો તે ભૂલના કારણે પણ કાચુ સરવૈયુ મળતું નથી. આવી ભૂલના કારણે કાચા સરવૈયામાં બમળી રકમની ભૂલ જોવા મળશે. દા.ત. રૂ. ૩૦૦ ખાન પાસેથી રોકડ મળ્યા જેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુએ થઈ છે પણ ખાનના ખાતામાં જમા બાજુએ નોંધ કરવાની જગ્યાએ તેની નોંધ ઉધાર



નોંધ

મોડયુલ - 3

ખતવણી અને કાચું
સરવૈયું



નોંધ

કાચું સરવૈયું અને હિસાબી ભૂલો

બાજુએ થઈ ગઈ તેના કારણે કાચા સરવૈયામાં રૂ.૬૦૦ જમા બાજુનો સરવાળો વધુ આવશે.

- ૪) ખોટી રકમથી ખતવણી થાય : જો ખાતામાં ખતવણી સાચી બાજુએ થાય પણ તેની રકમ ખોટી લખાય તો પણ કાચા સરવૈયાને અસર થશે ધારો કે ઉપરના ઉદાહરણમાં ખાનના ખાતામાં ખતવણી જમા બાજુએ જ થાય પણ રકમ રૂ. ૨૦૦ લખાય તો કાચા સરવૈયામાં જમા બાજુએ સરવાળો રૂ. ૧૦૦ ઓછો આવશે.
- ૫) પેટાનોંધનો સરવાળો ખોટો થાય : જો પેટાનોંધનો સરવાળો ઓછો કે વધારે ગણાય તો તેની અસર તેના ખાતા પર પણ થશે. દા.ત. વેચાણ નોંધનો સરવાળો રૂ. ૫૬૦૦ થયો જે ભૂલથી રૂ. ૫૩૦૦ લખાય તો તેની ખતવણી પણ રૂ. ૩૦૦ થી ઓછી થશે તેથી કાચું સરવૈયું મળશે નહીં.
- ૬) પેટા નોંધનો સરવાળોની ખતવણી ભૂલાઈ જાય : જો ખાતાવણીના સરવાળાની ખતવણી જે તે ખાતામાં ન થાય તો તેની અસર કાચા સરવૈયા પર થશે અને પાકા સરવૈયાનો સરવાળો વધુ કે ઓછો આવશે. દા.ત. વેચાણખાતામાં ૧૮,૮૦૦ની જમાખાતે ખતવણી કરવાની રહી જાય તો વેચાણ ખાતાનો જમાબાજુનો સરવાળો ૧૮૮૦૦ ઓછો આવશે.
- ૭) ખાતાનો ખોટો સરવાળો કે બાકી : જો ખાતાઓનો સરવાળો ખોટો ગણાય કે તેની બાકી ખોટી લખાયતો તેની અસર કાચા સરવૈયા પર થાય છે દા.ત. શ્યામના ખાતાનો સરવાળો રૂ. ૧૩૦૦ હતો જે ભૂલથી રૂ. ૧૧૦૦ લખાયો તેથી કાચા સરવૈયામાં રૂ. ૨૦૦નો તફાવત આવશે.
- ૮) કાચા સરવૈયામાં કોઈ ખાતું લખવાનું ભૂલાઈ જાય : તમે જાણો છો કે બધા જ ખાતાઓની સિલકો કાચા સરવૈયામાં દર્શાવય છે. જો તેમ કોઈ સિલક કાચા સરવૈયા દર્શાવવાનું ભૂલી જાય તો પણ કાચા સરવૈયાનો સરવાળો મળશે નહીં.
- ૯) ખાતાની બાકી કાચા સરવૈયાના ખોટા ખાતામાં લખાય : જો કોઈ ખાતાની ઉધાર સિલક હોય અને તે કાચા સરવૈયામાં જમા બાજુએ લખાઈ જાય અથવા જમા બાકી હોય તે ઉધાર બાજુએ લખાય તો પણ કાચા સરવૈયાનો સરવાળો જુદો આવશે.
- ૧૦) કાચા સરવૈયાના સરવાળાની ભૂલ : જો કાચા સરવૈયાનો સરવાળો કરતી વખતે ભૂલ થાય તો પણ કાચા સરવૈયાની બને બાજુએ તો સરવાળો જુદો આવશે.
આમ, તમે કાચા સરવૈયાને અસર કરતી જુદી જુદી ભૂલો શીખ્યા કે જેથી કાચા સરવૈયાનો સરવાળો એક સરખો આવશે નહીં.



નોંધ

૧૧.૪ કાચા સરવૈયામાં રજૂન થતી (છતી નથતી) ભૂલો :

જો કાચા સરવૈયાનો સરવાળો મળી જાય તેનો અર્થ એવો નથી કે હિસાબોમાં કોઈ ભૂલ નથી. ઘણીવાર આવી ભૂલો પણ હોય છે કે જે કાચા સરવૈયાને અસર કરતી નથી. તે ભૂલો નીચે મુજબ હોય શકે.

- ૧) વિસરચ્યુકની ભૂલ : જો વ્યવહારો પૂરેપૂરો લખવાનો જ રહી જાય તો તેને વિસરચ્યુકની ભૂલ કહેવાય છે. દા.ત. રૂ. ૬૦૦૦નો માલ રવી પાસેથી ખરીદો જે ચોપડામાં લખવાનો જ રહી ગયો આ વિસરચ્યુકની ભૂલ કહેવાય.
- ૨) ખોટુ લખવાની ભૂલ : આમ નોંધ કે પેટા નોંધ લખનારની બેદરકારીના લીધે જો ખોટી રકમની નોંધ લખાઈ જાય તો તેને ખોટુ લખવાની ભૂલ કહેવાય દા.ત. રૂ. ૧૦,૦૦૦ નો માલ વેચ્યો જે ભૂલથી રૂ. ૧૦૦૦ થી ચોપડે નોંધાયો છે.
- ૩) ભરપાઈ ચુકની ભૂલ : ધારો કે હિસાબનીશ રૂ. ૫૦૦ ખરીદ ખાતાની ઉધાર બાજુએ ઓછી ખતવણી કરે છે અને તે જ સમય વેચાણ ખાતામાં ખતવણી કરતી વખતે પણ રૂ. ૫૦૦ જમા બાજુ ઓછી લખાય છે આમ એક ભૂલની અસર બીજુ ભૂલના કારણે દૂર થાય છે આવી ભૂલને ભરપાઈ ચુક ભૂલ કહેવાય છે.
- ૪) સિદ્ધાંતની ભૂલ : જ્યારે હિસાબી નોંધ લખવામાં આવે ત્યારે નામાના સિદ્ધાંતોને યોગ્ય સમજણ વગર હિસાબો લખાય તો તેને સિદ્ધાંતની ભૂલ કહેવાય છે. દા.ત. જો કોઈ મિલકતની ખરીદી કરવામં આવે અને તેને ખરીદ ખાતે નોંધવામાં આવે તો સિદ્ધાંતની ભૂલ કહેવાય. પણ આ માટે ખરીદખાતે ઉધાર અને સમાપ્ત ખાતે જમા નોંધવામાં આવશે તેથી કાચા સરવૈયામાં કોઈ ભૂલ જણાશે નહિએ.

૧૧.૫ કાચા સરવૈયા દ્વારા જાણવા મળતી ભૂલો

જો કાચા સરવૈયાનો સરવાળો ન મળે તો હિસાબમાં ભૂલ છે તેવું માની શકાય હિસાબનીશ આવી ભૂલોને શોધી તેને કઈ રીતે સુધારવી તે પ્રક્રિયા કરશે કાચા સરવૈયા દ્વારા જાણવા મળતી ભૂલો નીચે મુજબ છે.

- ૧) ખોટો સરવાળો : જો રોકડમેળ કે કોઈ બીજી પેટાનોંધનો સરવાળો ખોટો ગણાય તો કાચુ સરવૈયુ નહી મળે દા.ત. જો ખરીદનોંધનો સરવાળો રૂ. ૨૦૦૦ વધુ ગણાયો હોય તો કાચા સરવૈયાના ઉધાર બાજુના સરવાળામાં રૂ. ૨૦૦૦ વધુ જોવા મળશે અને કાચુ સરવૈયુ નહી મળે.
- ૨) ખાતાની ખોટી બાજુએ ખતવણી : જો ખતવણી કરતી વખતે ખાતાની ઉધાર બાજુ ખતવણી કરવાના બદલે જમા બાજુ કરી દેવામા આવે અથવા જમા બાજુ ખતવણી કરવાના બદલે ઉધાર બાજુ કરવામાં આવે તો પણ કાચા સરવૈયાનો સરવાળો મળશે નહી દા.ત. રૂ. ૨૦૦૦ નો માલ સોહન પાસેથી ખરીદ્યો તેની ખતવણી સોહનના ખાતામાં જમા બાજુ કરવાના

મોડયુલ - 3

ખતવણી અને કાચું
સરવૈયું



નોંદા

કાચું સરવૈયું અને હિસાબી ભૂલો

બદલે ઉધાર બાજુએ કરવામાં આવે તો કાચા સરવૈયાની જમા બાજુનો સરવાળો રૂ. ૪૦૦૦ વધુ આવશે.

- ૩) ખોટી રકમથી ખતવણી : જે ખાતામાં ખોટી રકમથી ખતવણી કરવામાં આવે તો પણ કાચું સરવૈયું નહીં મળે દા.ત. રૂ.૬૦૦ નો માલ અનિલ પાસેથી ખરીયો, તેની નોંધ ખરીદ નોંધ કે ખરીદ ખાતામાં યોગ્ય રીતે થઈ છે પણ અનિલના ખાતે ખતવણી કરતી વખતે જમા બાજુ રૂ. ૬૦૦ ના બદલે રૂ.૬૦ થી ખતવણી થઈ ગઈ આમ કાચું સરવૈયું મળશે નહીં.
- ૪) વ્યવહારની એક બાજુની ખતવણી ભૂલાઈ જાય : દા.ત.રૂ.૫૦૦ શ્યામ પાસેથી મળ્યા તેને રોકડ મેળમાં યોગ્ય રીતે નોંધ થઈ છે પણ શ્યામતના ખાતાના જમા બાજુએ ખતવણી કરવાનું ભૂલી ગયા હોય તો પણ કાચા સરવૈયાનો સરવાળો નહીં મળે.
- ૫) કોઈ રકમની ખાતામાં બે વાર ખતવણી થઈ જાય : દા.ત. રૂ. ૫૦૦ વિનોદ પાસેથી મળ્યા તેની નોંધ રોકડ મેળમાં યોગ્ય રીતે કરેલ છે. પરંતુ વિનોદના ખાતામાં તેની નોંધ બે વાર કરી હોય તો કાચું સરવૈયું મળશે નહિં.
- ૬) ખાતાવહીમાં ખાતાની બાકી કે સરવાળો ખોટો થાય : ખાતાવહીના ખાતાઓની સિલકો શોધતી વખતે કે તેનો સરવાળો કરતી વખતે ભૂલ થઈ શકે ખાતાઓની સિલકો કાચા સરવૈયામાં લઈ જવાય છે કાચું સરવૈયું પણ મળશે નહીં.



સ્વાધ્યાય પ્રશ્નો ૧૧.૨

ખાલી જગ્યા ભરો

- ૧) કાચું સરવૈયું મળી ગયું આમ ત્યારે કહેવાય જયારે તેની..... સરખા હોય
- ૨) કાચું સરવૈયું મળવું એ હિસાબોની ચોક્સાઈનું પ્રમાણ છે
- ૩) કાચા સરવૈયામાં ખાતાની સિલકો માટે.... અને.... બાજુના ખાના હોય છે.
- ૪) હાથ પર રોકડ એ કાચા સરવૈયામાં..... ખાનામાં લખાય છે.

૧૧.૬ ભૂલો શોધવાની પ્રક્રિયા

જે હિસાબી ચોપડામાં ભૂલો હોય તો તેને શોધવી જરૂરી છે કારણ કે ધંધાના પરિણામો પરાએની અસર પડે છે તેથી ભૂલોને શોધી તેને સુધારવાની પ્રક્રિયા કરવી જરૂરી છે ભૂલો શોધવી એ સરળ કાર્યનથી પણ નીચે મુજબના આયોજનબધ્ય પગલા લઈ તેને શોધી શકાય.

- ૧) કાચા સરવૈયાના સરવાળાને ચકાસો
- ૨) ખાતાઓની જે સિલકો કાચા સરવૈયાના લઈ ગયા છે તેને ચકાસો

કાચુ સરવૈયુ અને હિસાબી ભૂલો

- ૩) પેટાનોંધના સરવાળા અને તેની ખતવણી ચકાસો
- ૪) આમ નોંધની ખતવણી વિવિધ ખાતાઓમાં યોગ્ય રીતે થઈ છે કે કેમ તે ચકાસો
- ૫) જો કાચુ સરવૈયુ નથી મળતું એટલે કે તેની ઉધાર બાજુનો સરવાળો તેની જ્મા બાજુના સરવૈયા જેટલો નથી આવતો તો હિસાબમાં ભૂલ છે તેને શોધવા ફરી જ્મા ખાનાનો અને ઉધાર ખાનાનો સરવાળો કરી જુઓ તેમ છતાં સરવાળો સરખો ન આવે તો મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી તફાવતની રકમ શોધી તેની કોઈ નોંધ બાકી તો નથી તે ચકાસો
- ૬) ભૂલ શોધવાની બીજી કેટલીક ખાસ રીતો પડા છે. જો સરવાળો ન હોય તો તફાવતની બે સરખા હિસ્સામાં વહેચી દો ત્યાર બાદ દરેક ખાતામાં તેટલી રકમની ચકાસણી કરો. જો આ તમને મળે તો ભૂલ પડ્યું પડાઈ જાય.
- ૭) ભૂલ શોધવાની અન્ય એક રીત છે અંક - ૭ જો તફાવતની રકમને ૭ વડે ભાગી શકાય તો તમે કરેલી ભૂલ અસરપરસની ભૂલ એટલે કે ખતવણીમાં ખોટી બાજુઅલખવાની ભૂલ કરેલ છે. તેથી તમે દરેક જ્મા અને ઉધાર બાજુ ચકાશો.

મોડચુલ - ૩
ખતવણી અને કાચું સરવૈયું



નોંધ

૧૧.૭ કાચુ સરવૈયુ તૈયાર કરવું

બધા જ નાણાકીય વ્યવહારોની નોંધ આમ નોંધ પેટા નોંધ કે ખાસ આમ નોંધમાં કર્યા પછી તેની ખતવણી ખાતાવહીમાં વિવિધ ખાતાઓ ખોલી કરવામાં આવે છે વર્ષના અંતે આ બધા જ ખાતાઓને બંધ કરી તેની બાકી શોધાય છે આ બધા જ ખાતાની સિલકો ઉપરથી એક પત્રક તૈયાર કરવામાં આવે છે જેમા બધા જ ખાતાના નામ તેમજ તેની ઉધાર કે જ્મા બાકી કાચા સરવૈયાના ઉધાર કે જ્માના ખાનામાં લખાય છે આમ કાચુ સરવૈયુ કે કોઈ ખાતું નથી એ એક પત્રક છે જે વર્ષના અંતે ચોક્કસ તારીખે બધા જ ખાતાની સિલકો પરથી બનાવવામાં આવે છે જે કાચા સરવૈયાનો સરવાળો મળી જાય તો હિસાબો ગાણિતિક રીતે સાચા છે તેમ માની વાર્ષિક હિસાબની પ્રક્રિયા ચાલુ કરાય છે આમ કાચા સરવૈયા દ્વારા એક વાર્ષિક હિસાબના અંત થયો તેમ મનાય છે સામાન્ય રીતે કાચુ સરવૈયુ ખાતાની ઉધાર અને જ્મા સિલકો પરથી બનાવાય છે તેનો નમૂનો નીચે મુજબ છે.

(પેઢીનું નામ) નું તારીખ (તૈયાર કરવાની તારીખ) ના રોજનું કાચુ સરવૈયુ

ખાતાનું નામ	ઉધાર સિલક રૂ.	જ્મા સિલક રૂ.

નીચે આપેલ ઉદાહરણ વડે આને વધુ સારી રીતે સમજશું.

ઉદાહરણ : નીચેના વ્યવહારોને આમનોંધમાં લખો તેની ખાતાવહીમાં ખતવણી કરી સિલકો શોધી કાચુ સરવૈયુ તૈયાર કરો.

મોટાયુલ - 3

ખતવણી અને કાચું સરદૈયું



၁၄

N. Ref.	Total balance as of 1/1/2011
	Balances
Bal. cash	75
Bank overdraft	1130
Accounts receivable	1500
Less: discounts	500
Office equipment	1500
Accounts payable	1700
Mortgage	5000
Business	500
Salaries	5200
Postage	200
Office expenses	1200
Purchases	10000
Sales	35000
Stock	8000
Sales discount	250
Purchases return	200
Sales return	150
Purchases discount	150
Gaming Assets	1495

તારીખ વિગત

2092

ਮੇ ੧ ਕਮਿਸ਼ਨ ਮਾਲੀ

મે ૨ ભાડુ ચૂકવ્યું

મે ૫ વાર મળ્યું

ਮੇ ੭ ਦਲਾਲੀ ਚੂਕਵੀ

જવાબ : આમ નોંધ

કાચુ સરઘેચુ અને હિસાબી ભૂલો

તારીખ	વિગત	રૂપાં
૨૦૧૨		રૂ.
મે ૧	કમિશન મળ્યું	૧૦,૦૦૦
મે ૨	ભાડુ ચુકવ્યું	૫,૦૦૦
મે ૫	વાજ મળ્યું	૬,૦૦૦
મે ૭	દલાલી ચુકવી	૩,૦૦૦

જવાબ : આમ નોંધ

તારીખ	વિગત	આ.પા.	ઉધાર રૂ.	જમા રૂ.
૨૦૭૨				
મે ૧	રોકડ ખાતે તે મળેલ કમિશન ખાતે (આ.જે કમિશન મળ્યુ તેના)	૩	૧૦,૦૦૦	૧૦,૦૦૦
મે ૨	ભાડા ખાતે તે રોકડ ખાતે (આ.જે ભાડુ ચૂકયુ તેના)	૩	૪,૦૦૦	૪,૦૦૦
મે ૫	રોકડ ખાતે તે મળેલ વ્યાજ ખાતે (આ.જે વ્યાજ મળ્યુ તેના)	૩	૬,૦૦૦	૬,૦૦૦
મે ૭	દલાલી ખાતે તે રોકડ ખાતે (આ.જે દલાલીના ચૂકવ્યા તેના)	૩	૨,૦૦૦	૨,૦૦૦

૩૪૧૨

સાડા ખાત

ੴ ਸਤਿਗੁਰ

તારીખ	વિગત	નો. પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો. પા.	રકમ રૂ.
૨૦૧૨ મે ૨	રોકડ ખાતે		૪૦૦૦	૨૦૧૨ મે ૩૧	બાકી આગળ લઈ ગયા		૪૦૦૦
			૪૦૦૦				૪૦૦૦
જૂન ૧	બાકી આગળ લાવ્યા		૪૦૦૦				

કાચુ સરયેયું અને હિસાબી ભૂલો

ઉધાર

કમિશન ખાતું

જમા

તારીખ	વિગત	નો. પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો. પા.	રકમ રૂ.
૨૦૧૨ મે ૩૧	બાકી આગળ લઈ ગયા		૧૦,૦૦૦	મે ૧	૨૦૧૨ રોકડ ખાતે		૧૦,૦૦૦
			૧૦,૦૦૦	જૂન ૧	બાકી આગળ લાવ્યા		૧૦,૦૦૦

મોડચુલ - ૩

ખતવણી અને કાચું
સરયેયું



નોંધ

ઉધાર

મળેલ વ્યાજ ખાતું

જમા

તારીખ	વિગત	નો. પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો. પા.	રકમ રૂ.
૨૦૧૨ મે ૩૧	બાકી આગળ લઈ ગયા		૫,૦૦૦	૨૦૧૨ મે ૫	રોકડ ખાતે		૫,૦૦૦
			૫,૦૦૦	જૂન ૧	બાકી આગળ લાવ્યા		૫,૦૦૦

ઉધાર

દલાલી ખાતું

જમા

તારીખ	વિગત	નો. પા.	રકમ રૂ.	તારીખ	વિગત	નો. પા.	રકમ રૂ.
૨૦૧૨ મે. ૭	રોકડ ખાતે		૨૦૦૦	૨૦૧૨ મે. ૩૧	બાકી આગળ લઈ ગયા		૨૦૦૦
જૂન ૧	બાકી આગળ લાવ્યા		૨૦૦૦				૨૦૦૦

મોડયુલ - 3

ખતવણી અને કાચું
સરવેયું



નોંદા

કાચું સરવેયું અને હિસાબી ભૂલો

ઉધાર

રોકડ ખાતું

જમા

તારીખ	વિગત	નો. પા.	રૂપમણી રૂ.	તારીખ	વિગત	નો. પા.	રૂપમણી રૂ.
૨૦૧૨ મે ૧	કમિશન ખાતે		૧૦,૦૦૦	૨૦૧૨ મે ૨	ભાડા ખાતે		૫,૦૦૦
મે ૫	મળેલ વ્યાજ ખાતે		૮,૦૦૦	મે ૭	દલાલી ખાતે		૨,૦૦૦
			૧૮,૦૦૦	મે ૩૧	બાકી આગળ લઈ ગયા		૮,૦૦૦
જૂન ૧	બાકી આગળ લાવ્યા		૮,૦૦૦				૧૬,૦૦૦

તા. ૩૧-૫-૧૨ ના રોજનું કાચું સરવેયું

ખાતાનું નામ	ઉધાર બાકી રૂ.	જમા બાકી રૂ.
ભાડા ખાતું	૫,૦૦૦	-
દલાલી ખાતું	૨,૦૦૦	-
રોકડ ખાતું	૮,૦૦૦	-
કમિશન ખાતું	-	૧૦,૦૦૦
મળેલ વ્યાજ ખાતું	-	૮,૦૦૦
કુલ	૧૬,૦૦૦	૧૬,૦૦૦

૧૧.૮ કાચા સરવૈયાની મર્યાદા :

- ૧) કેટલીક ભૂલો એવી હોય છે જે કાચા સરવૈયાને અસર કરતી નથી તેથી જ કાચું સરવેયું મળી જવું અથડા બાબતની સાબીતી નથી કે નામું સાચું જ લખાયું છે.
- ૨) કાચું સરવેયું માત્ર ખાતાઓની સિલકો માત્ર બતાવે છે
- ૩) હિસાબી વર્ષના અંતે ધંધાનો નફો કે નુકશાન જાણી શકતું નથી.
- ૪) જો કાચું સરવેયું ચોકસાઈ પૂર્વક ન બનાવ્યું હોય તો તેના પરથી બનાવેલ વાર્ષિક હિસાબ પણ વિશ્વાસપાત્ર રહેશે નહીં
- ૫) પેટાનોંધો સાચી લખાઈ છે તેથી ખાતી આનાથી થતી નથી.
- ૬) આ માત્ર દ્રિનોંધી નામાપદ્ધતિ મુજબ ચોપડા રાખનાર વેપારી માટે જ બનાવાય છે



સાધ્યાય પ્રશ્નોત્તરી ૧૧.૩

રામના ચોપડે કેટલીક ભૂલો નોંધાઈ છે આમા કઈ ભૂલો કાચા સરવૈયાને અસર કરશે તે કારણ સાથે સમજાવો

- ૧) રૂ.૨૫૦૦ નો માલ શ્યામને વેચ્યો જે વિસરચૂકની ભૂલથી ચોપડે લખવાનો રહી ગયો છે
- ૨) ખરોદનોંધનો સરવાળો રૂ.૨૦૦૦ વધુ ગણાયો
- ૩) વેચાણનોંધનો સરવાળો રૂ.૩૦૦૦ ઓછો ગણાયો
- ૪) અનિલને ચૂકવેલ રકમની ખતવણી સુનીલની ચોપડે ઉધાર બાજુએ થઈ.
- ૫) બંક ઓવરાફાઈને કાચાસરવૈયાની ઉધાર બાજુએ લખાયો
- ૬) રોહનને રૂ.૩૦૦૦ નો માલ વેચ્યો જેની નોંધ વેચાણ નોંધમાં રામને વેચ્યુ તે રીતે થઈ
- ૭) યંત્રની ગોઠવણીની મજૂરી ચૂકવી જે મજૂરી ખાતે લખવામાં આવ્યું.

૧૧.૪ ઉપલક ખાતુ

જ્યારે કાચુ સરવૈયુ મળે નહી એટલે કાચા સરવૈયામાં એવી ભૂલો છે કે જે કાચા સરવૈયાને અસર કરે આવી ભૂલો શોધતા પહેલા જો વાર્ષિક હિસાબ બનાવવાનો નિર્ણય લેવામાં આવે તો કાચા સરવૈયામાં તફાવતી રકમ ઉપલક ખાતે લઈ જવામાં આવે છે પછી ભૂલોને ઉપલક ખાતાની મદદથી સુધારવામાં આવે છે. આ રીતે ઉપલક ખાતુ ભૂલો સુધાર્યા પછી બંધ કરવામાં આવે છે.



સ્વાધ્યાયના પ્રશ્નો ૧૧.૪

૧. ખાલી જગ્યા ભરો

- ૧) જો પેટાનોંધના સરવાળામાં ભૂલ હોય તો કાચા સરવૈયાનો સરવાળો.....
- ૨) જો ખાતાની લઈ જતી વખતે ભૂલ થાય તો કાચુ સરવૈયુ મળતુ નથી.
- ૩) જો કાચુ સરવૈયુ મળે તો તે ખતવણી સાચી છે તેની.... થતી નથી
- ૪) જો કાચા સરવૈયાની બને બાજુઓનો સરવાળો સરખો ન થાય તો તફાવતની રકમ..... ખાતે લઈ જઈ કાચુ સરવૈયુ મેળવવામાં આવે છે



નોંધ



૨. બહુવિકલ્પી પ્રશ્નો

- ૧) નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવેયાને અસર કરતી નથી
 - (એ) ખાતાની ખોટી સિલકો શોધાય
 - (બી) રકમ ખોટા ખાતામાં પણ સાચી બાજુએ લખાય
 - (સી) ખાતાનો સરવાળો ખોટો કરાય
 - (ડી) ઉપરમાંથી એક પણ નહીં
- ૨) નીચેમાંથી કયો હેતુ કાચું સરવેયું બનાવાનો મુખ્ય હેતુ નથી ?
 - (એ) ગાણિતિક ચોકસાઈ ચકાસવી
 - (બી) પાકુ સરવેયું (વાર્ષિક હિસાબ) તૈયાર કરવું
 - (સી) દરેક ખાતાનો તુલનાત્મક અભ્યાસ કરવો
 - (ડી) કાચું સરવેયુને કોર્ટમાં એ વ્યવહાર થયાની સાબીતી રૂપે રજૂ કરી શકાય છે
- ૩) આમાંથી કઈ ભૂલ કાચા સરવેયાને અસર કરશે
 - (એ) મકાનના મરામત ખર્ચને મકાન ખાતે ઉધાર કર્યું
 - (બી) ખરીદનોંધનો સરવાળો રૂ. ૧૦૦૦૦ ઓછો ગણાયો
 - (સી) યંત્ર લાવવાનો ખર્ચ લારીભાડા ખાતે ઉધાર કર્યું
 - (ડી) ઉપરમાંથી એક પણ નહીં
- ૪) નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવેયા વડે જાણી શકાય
 - (એ) સંપૂર્ણપણે ભૂલાઈ જાય (વિસરચૂકની ભૂલ)
 - (બી) ખોટો સરવાળો
 - (સી) ભરપાઈ ચૂક ભૂલ
 - (ડી) સિધ્યાંતની ભૂલ
- ૫) નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવેયા વડે જાણી શકતી નથી.
 - (એ) સંપૂર્ણ ભૂલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ)
 - (બી) ખોટી રકમની ખતવણી
 - (સી) ખાતામાં બેવડી રકમથી ખતવણી
 - (ડી) ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ



તમે શું શીખ્યા

- વાર્ષિક હિસાબો બનાવતા પહેલા કાચુ સરવેયુ બનાવવું જરૂરી છે જેથી હિસાબો ગાળિતિક રીતે સાચા છે કે કેમ તેની ચકાસણી થઈ શકે
- જો કાચા સરવેયાનો સરવાળો સરખો ન થાય તેનો અર્થ એ થયો કે હિસાબોમાં ભૂલ છે જેથી તે શોધી શકાય.
- કેટલીક ભૂલો કાચા સરવેયાને અસર કરતી નથી અને કેટલીક ભૂલો કાચા સરવેયાને અસર કરે છે
- વિસરચૂક ભૂલ, સિધ્યાંતની ભૂલ, ભરપાઈ-ચુકની ભૂલ એ એવી ભૂલો છે કે જે કાચા સરવેયાને અસર કરતી નથી.
- કાચા સરવેયાની મર્યાદાએ છે કે તેનાથી હિસાબી વર્ખના અંતે ધંધાનો નફો કે તુકશાન આજી શકાતુ નથી તેથી માત્ર ખાતાઓની સિલક જ આજી શકાય છે.
- ભૂલો
 - ભરપાઈ ચુકની ભૂલ : આ આવી ભૂલોનો સમૂહ છે જેમાં એક ભૂલની અસર બીજી ભૂલની અસરથી દૂર થઈ જાય છે જેથી કાચા સરવેયામાં કોઈ અસર પડતી નથી
 - સિધ્યાંતની ભૂલ : વ્યવહારોની નોંધ કરતી વખતે નામાના મૂળભૂત સિધ્યાંતોનો ભંગ થાય તો તેને સિધ્યાંતની ભૂલ થાય છે
 - વિસરચૂકની ભૂલ : જ્યારે કોઈ વ્યવહાર આમનોંધ કે પેટાનોંધમાં સમગ્ર રીતે નોંધવાનો રહી જાય તો તે ભૂલને વિસરચૂકની ભૂલ કહે છે
 - વ્યવહારની અધૂરી નોંધની ભૂલ : જ્યારે વ્યવહારો ચોપડામાં અધૂરા લખાય એટલે કે અડધો વ્યવહાર લખવાનું ભુલાઈ જાય તો તેને અધુરુ વ્યવહારની ભૂલ કહેવાય છે.
 - ખતવણી અંગેની ભૂલ : વ્યવહારની ખાતાવણીમાં ખતવણી કરતી વખતે કોઈ ભૂલ થાય તો તેને ખતવણીની ભૂલ કહેવાય છે.



નોંધ

મોડયુલ - 3

ખતવણી અને કાચું
સરવૈયું



નોંદા



સ્વાધ્યાયના પ્રશ્નો :

કાચું સરવૈયું અને હિસાબી ભૂલો

- ૧) શા માટે કાચા સરવૈયાને ગાણિતિક ઓક્સાઈનો આધાર માનવામાં આવે છે? કાચા સરવૈયાને અસર કરતી ભૂલોની યાદી બનાવો.
- ૨) જો કાચા સરવૈયાનો સરવાળો ન મળે તો હિસાબોમાં ભૂલ છે તેમ કહી શકાય. ભૂલો શોધવાની પ્રક્રિયા જણાવો
- ૩) કાચાસરવૈયાની મર્યાદાઓ જણાવો
- ૪) શું કાચું સરવૈયું હિસાબો સાચા છે તેની સાવિત્ર છે? કાચા સરવૈયાને અસર ન કરી ભૂલોની ચર્ચા કરો
- ૫) વ્યવહારોની નાંખ કરતી વખતે થનાર વિવિધ પ્રકારની ભૂલોને ઉદાહરણ સાથે સમજાવો
- ૬) કાચું સરવૈયું એટલે શું? કાચું સરવૈયા બનાવવાના હેતુઓ જણાવો
- ૭) ઉપલક ખાતુ એટલે શું? તેને કયા સરવૈયામાં કેવી રીતે દર્શાવાય છે.
- ૮) નીચે આપેલ સિલકો પરથી જ્ય જવાન જ્ય કિસાન એન્ટરપ્રાઇઝનું તા. ૩૧-૧૨-૨૦૧૨ ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો.

ખાતાનું નામ	રકમ રૂ.	ખાતાનું નામ	રકમ રૂ.
છાથ પર રોકડ	૩૧,૦૦૦	વેચાણ ખાતુ	૭૬,૦૦૦
બેંકમાં રોકડ	૧૨,૦૦૦	શરૂનો સ્ટોક	૧૦,૦૦૦
મૂડી ખાતુ	૮૦,૦૦૦	ભાડા ખાતુ	૨,૦૦૦
ઉપાડ ખાતુ	૨૮,૦૦૦	મજુરી ખાતુ	૬,૦૦૦
દેવાદારોનું ખાતુ	૨૦,૮૦૦	આવક માલ ગાડામાટુ	૫૦૦
લેણદારોનું ખાતુ	૧૭,૮૦૦	મશીન ખાતુ	૧૪૦૦
ખરોદ ખાતુ	૬૨,૦૦૦		
આખર માલ સ્ટોક ખાતુ	૫,૦૦૦		
૯) નીચે આપેલ સિલકો પરથી તા. ૩૧-૩-૧૩ ના રોજનું કાચું સરવૈયું તૈયા કરો			
ખાતાનું નામ		રકમ રૂ.	
છાથ પર રોકડ		૩૨૦૦	

કાચુ સરવેયુ અને હિસાબી ભૂલો

બંકમાં રોકડ	₹ 12600
મૂરી ખાતુ	₹ 27840
ફર્નિચર ખાતુ	₹ 12300
મકાન ખાતુ	₹ 4000
મજૂરી ખાતુ	₹ 3400
વેચાણ ખાતુ	₹ 20000
ભડા ખાતુ	₹ 240
બંક ચાર્ટસ ખાતુ	₹ 800
ધસારા ખાતુ	₹ 200

મોડચુલ - 3
ખતવણી અને કાચું
સરવેયું



નોંધ



સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ

- ૧૧.૧ (૧) સાચુ (૨) ખોટુ (૩) ખોટુ (૪) સાચુ (૫) ખોટુ
- ૧૧.૨ (૧) ઉધાર અને જમા બાજુનો સરવાળો (૨) ગાણિતિક
(૩) ઉધાર, જમા (૪) ઉધાર
- ૧૧.૩ ૨, ત અને ૫ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે
- ૧૧.૪ (૧) સરખો નહીં આવે (૨) સિલક (૩) સાબીતી (૪) ઉપલક
૨. (૧) બી (૨) ડી (૩) બી (૪) બી (૫) એ



સ્વાધ્યાયના પ્રશ્નો

૮. કાચા સરવૈયાનો સરવાળો ₹. 193800
૯. કાચા સરવૈયાનો સરવાળો ₹. 47840

તમારા માટે કાર્ય :

- તમારા વાલી પાસેથી ચોક્કસ માસ દરમ્યાન થતા વિવિધ ખર્ચોઓ અને આવકો વિશે માહિતી મેળવો, તેની આમનોંધમાં નોંધ કરી તેની ખતવણી ખાતાવહીમાં કરી બધા જ ખાતાઓની સિલકો શોધો ખાતાની સિલક પરથી કાચુ સરવૈયુ કરી જુઓ કે તેનો બને બાજુનો સરવાળો સરખો થાય છે કે કેમ જો સરખો થાય તો તમારા છિસાબ ગાણિતિક રીતે સાચો છે તેમ કહેવાશે.

મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

મહત્વામ ગુણી

૧૨

અભ્યાસના કલાકો

૩૨

મોડયુલ - ૪

ધસારો અનામત અને જોગવાઈ

આ મોડયુલ વિધાથીઓને ધસારાની સંકલ્પના દ્વારા સ્થિર મિલકતાના ખર્ચનો તેમના ઉપયોગી વખ્તોના સમયગાળામાં વહેંચતા શીખવશે. તેઓ અનામત અને જોગવાઈ ઉભી કરવાની જરૂરીયાતોને અને મહત્વનો પણ સમજી શકશે.

પ્રકરણ-૧૨ : ધસારો

પ્રકરણ-૧૩ : અનામત અને જોગવાઈ



નોંધ

૧૨

ઘસારો

ધંધામાં કરવામાં આવતા વિવિધ પ્રકારના ખર્ચાઓ જેવા કે ફર્નિચર, ફિક્ચરસર્વાને ફિટીંગ, મોટરવાન, મશીન(યંત્ર) અને ઔજારો કે જે માલ પડા નથી અને ખર્ચ પડા નથી. આવા ખર્ચાઓ ધંધામાં લાંબા સમય સુધી તેમની સેવા આપે છે તેથી તેને સ્થિર મિલકતો કહેવાય છે. આવી મિલકતો પાછળ થતા ખર્ચને કોઈ એક વર્ષનો ખર્ચ સમજી તે વર્ષના નફામાંથી બાદ કરવામાં આવે તો તે ખોદું ગણાય, કારણ કે તેનો ફાયદો ધંધાને લાંબા સાયગાળા માટે થાય છે. આવા ખર્ચને તેના ઉપયોગી વર્ષમાં વહેંચી દેવામાં આવે તો જ યોગ્ય કહેવાય. સ્થિર મિલકતની પડતરનો એવો ભાગ કે જે દર વર્ષ ખર્ચ તરીકે નોંધવામાં આવે તેને ઘસારો કહે છે.

આ પાઠમાં તમે ઘસારાનો અર્થ, તેની જોગવાઈની વિવિધ પદ્ધતિઓ અને ઘસારાને કેવી રીતે ચોપડે નોંધી સ્થિર મિલકત ખાતું બનાવવામાં આવે છે તે શીખીશું :



હેતુઓ :

આ પાઠ જણા પછી તમે :

- ઘસારાનો અર્થ અને તેનો સિધ્યાંત સમજી શકશો.
- ઘસારાના કારણો વર્ણવી શકશો.
- ઘસારાના હેતુઓ વર્ણવી શકશો.
- ઘસારાની વિવિધ પદ્ધતિઓ વિશે જાણી શકશો.
- સ્થિર મિલકતનું ખાતું બનાવી દશ વર્ષે ઘસારાની જોગવાઈની રકમ જગ્યાવી શકશો.

૧૨.૧ ઘસારાનો અર્થ

તમે મિલકત અને દેવા જેવા પદોનો અર્થ જાણો જ છો. મિલકતને બે વિભાગોમાં વહેંચી

મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

ધસારો

શકાય ચાલુ મિલકતો (રોકડ, દેવાદારો કે ગ્રાહકો, માલનો સ્ટોક) અને સ્થિર મિલકતો (મકાન, ફર્નિચર અને ફિક્ચર્સ, યંત્રો અને પ્લાન્ટ, મોટરકાર)

સ્થિર મિલકતોને લાંબા ગાળાની મિલકતો પણ કહેવાય છે. કારણ કે તેનો લાભ ધ્યાને લાંબા સમય સુધી મળે છે. આવી મિલકતોની કિંમત તેના ઉપયોગના કારણો કે સમય પસાર થવાથી ઓછી થાય છે. આવી મિલકતોની કિંમત નવી ટેકનોલોજી આવવાથી કે ફેશન બદલવાથી પણ ઓછી થાય છે. તેથી આવી મિલકતોની તેના ઉપયોગી આયુષ્યના અંતે પુનઃસ્થાપના કરવામાં આવે છે. તેથી આવી મિલકતની પડતરને તેના ઉપયોગ આયુષ્યના વર્ષમાં વહેંચી દેવાય છે, આ રીતે દર વર્ષ જે રકમની ખર્ચ તરીકે જોગવાઈ કરવામાં આવે છે તેને ધસારો કહે છે.

દા.ત. ઓફિસનો એક ટેબલ રૂ. ૨૫૦૦ માં ખરોદવામાં આવો તેનું અંદાજિત આયુષ્ય ૧૦ વર્ષ છે. આની પડતર રૂ. □૫૫૫ને કષ વર્ષમાં વહેંચવામાં આવશે. જેની ગણતરી નીચે મુજબ થશે.

$$\text{ધસારો} = \frac{\text{મિલકતની પડતર} - \text{તેની ભંગાર કિંમત}}{\text{અંદાજિત આયુષ્ય}}$$

$$\frac{\text{રૂ. } ૨૫૦૦}{૧૦} = \text{રૂ. } ૨૫૦$$

આમ દર વર્ષ રૂ. ૨૫૦ ધસારો ગણાશે.

આમ, સ્થિર મિલકતની કિંમતમાં દર વર્ષ જે ઘટાડો થાય છે તેને ધસારો કહે છે. જેના કારણો નીચે મુજબ હોઈ શકે :


- મિલકતનો ઉપયોગ થવાથી કે સમય પસાર થવાથી
- ફેશન, સ્વાદ, તકનિક બદલવાથી કે બજાર પરિસ્થિતિમાં ફેરફારના કારણું

૧૨.૨ ધસારાના કારણો

નામાં ધસારાની જોગવાઈના કારણો નીચે મુજબ હોઈ શકે :

(૧) સામાન્ય પરિબળો :

- (અ) વપરાશ કે ઉપયોગ : મિલકતના રોજબરોજના વપરાશને કારણો તેનું ઉપયોગી આયુષ્ય ઘટે છે. મિલકતનો વધુ વપરાશ થવાથી વધુ ધસારો થાય છે. દા.ત. સાઈકલનો ઉપયોગ કરવાથી તેની કિંમતમાં ઘટાડો થાય.
- (બ) સમયના વહેણાને કારણો : હવા, સૂર્ય, વરસાદ જેવા કુદરતી પરિબળોના કારણો સમય પસાર થવાથી પણ મિલકતની કિંમત ઘટે છે ભલે તેનો ઉપયોગ થયો ન હોય. દા.ત. મોટરકારને ખરીદી તેને એક વર્ષ સુધી ન ચલાવો તો પણ એક વર્ષ પછી તેની કિંમત ઘટી જશે.





નોંધ

(૨) વિશિષ્ટ પરિબળો :

- (અ) નવી શોધખોળના કારણો : કેટલીકવાર નવી શોધખોળના કારણો જુની તકનિક કામની રહેતી નથી અને તેના આયુભય પહેલા જતે બેકાર થઈ જાય છે. દા.ત. કોમ્પ્યુટર આવવાથી ટાઇપરાઇટર મશીન જુની થઈ ગઈ છે કે નકામી થઈ ગઈ છે.
- (બ) ફેશન, સ્ટાઇલ, સ્વાદ કે બજાર પરિસ્થિતિના ફેરફારના કારણો : સમયના વહેણની સાથે સાથે લોકોના સ્વાદ ફેશન કે સ્ટાઇલમાં ફેરફાર થાય છે. જેના કારણો જુની ફેશન કે સ્ટાઇલની મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે કારણ કે તેની માંગમાં ઘટાડો થાય છે.

૧૨.૩ ઘસારાના હેતુઓ :

નીચે મુજબના ઘસારાના હેતુઓ હોઈ શકે :

૧. ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ જાણવા : પાક સરવેયામાં મિલકતોની ઘસારા બાદ કિંમત દર્શાવવામાં આવે તો જ તે ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ રજૂ કરે છે. મિલકતોમાંથી ઘસારો બાદ ન કર્યો હોય તેવી પરિસ્થિતિ રજૂ કરે છે. મિલકતોમાંથી ઘસારો બાદ ન કર્યો હોય તેવી રીતે તૈયાર કરેલ પાકું સરવેયું દર્શાવી શકે નાથી.
૨. મિલકતોની પુનઃસ્થાપના માટે : ધંધાનો માલિકી મૂડી તરીકે જે રકમનું રોકાણ કરે છે તેના વળતર તરીકે ધંધામાં જે નફો થાય તેટલી રોકડ રકમ અંગત વપરાશ માટે લઈ જાય છે. જે નફાનુકસાન ખાતે ઘસારાની જોગવાઈ કરવામાં આવી હોય તો નફો એટલો ઓછો આવશે અને તે ઓછી રકમ ધરે લઈ જશે, આમ મિલકતની પુનઃસ્થાપના માટે ધંધામાં ભંડોળ રહેશે.



પાઠ સ્વાધ્યાય ૧૨.૧

- ખાલી જગ્યા ભરો.
- ૧. ઘસારાના કારણો મિલકતની કિંમતમાં થાય છે.
- ૨. ભંગાર કિંમત એ એવી છે કે જે મિલકતના ના અંતે મળે છે.
- ૩. ઘસારાની ગણતરી માટે મિલકતની પડતર કિંમતમાંથી ભંગાર કિંમત બાદ કરી તેને તેના સાથે ભાગવામાં આવે છે.
- ૪. મિલકત બેકાર થવાના કારણોમાં અથવા ફેશન, સ્વાદ અને બજારની પરિસ્થિતિ પરિવર્તન હોઈ શકે.

મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

ધસારો

૧૨.૪ ધસારાને અસર કરતા પરિબળો :

- નીચે દર્શાવેલ પરિબળો ધસારાને અસર કરે છે :
 ૧. મિલકતની પડતર કિંમત : મિલકતની પડતર કિંમતમાં મિલકતની ખરીદ કિંમત અને તેને લાવવા અને લગાડવાના ખર્ચનો સમાવેશ થાય છે. મિલકતના લાવવા અને લગાડવાના ખર્ચમાં લારીભાડું, સ્થાપના ખર્ચ, મજૂરી, વહન ખર્ચ, ઉતારવાનો ખર્ચ, ચઢાવવાનો ખર્ચ જેવા ખર્ચઓનો સમાવેશ થાય છે.
 ૨. મિલકતનો અંદાજીત ઉપયોગી આયુષ્ય : મિલકત જેટલા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાશે તેવા વર્ષોને તેનું ઉપયોગી આયુષ્ય કહેવાય છે. જે અંદાજવામાં આવે છે.



૩. ભંગાર કિંમત : મિલકતના અંદાજીત આયુષ્યના અંતે તેને ભંગાર તરીકે વેચી દેવી પડે છે જેને તેની ભંગાર કિંમત કહે છે.
૪. મિલકતની ધસારા બાદ કિંમત : મિલકતની પડતર કિંમતમાંથી ભંગાર કિંમત બાદ કરતા જે કિંમત મળે તેને મિલકતની ધસારા બાદ કિંમત કહેવાય છે.

ઉદાહરણ - ૧

રૂ. ૫,૦૦,૦૦૦ માં એક યંત્ર ખરીદું. તેને ટ્રકમાં ચઢાવવા માટે રૂ. ૧૫૦૦ કેનવાળાને આય્યા, રૂ. ૭૦૦૦ તેને લાવવાની ગાડીનું ભાડું ચુકવ્યું. તેને ટ્રકમાં ઉતારી ફેક્ટરીમાં લઈ જવાનો ખર્ચ રૂ. ૨૦૦૦ થયો. યંત્રનું આયુષ્ય ૧૦ વર્ષ અંદાજીત થયું અને તેના પછી તેની ભંગારકિંમત રૂ. ૬૦,૦૦૦ ઉપજશે તેવો અંદાજ છે. યંત્રના ધસારા યોગ્ય કિંમત શોધો.

યંત્રની પડતર કિંમત :

ખરીદ કિંમત	રૂ. ૫,૦૦,૦૦૦
ચઢાવવાનો ખર્ચ	રૂ. ૧૫૦૦
ગાડીભાડું	રૂ. ૭૦૦૦
ઉતારવાનો ખર્ચ	રૂ. ૨૦૦૦
કુલ	રૂ. ૫,૯૦,૪૦૦

$$\text{યંત્રની ધસારા યોગ્ય કિંમત} = ૫,૯૦,૪૦૦ - ૬૦,૦૦૦ = ૪,૪૦,૪૦૦$$



નોંધ

૨.૫ ઘસારાની પદ્ધતિઓ :

ઘસારાની બે પદ્ધતિઓ બહુ જ પ્રચાળિત છે. (૧) સરખા હમાની પદ્ધતિ અને (૨) ઘટતી જતી બાકીની પદ્ધતિ

સરખા હમાની પદ્ધતિ :

આ પદ્ધતિમાં દર વર્ષે ઘસારાની રકમ સરખી હોય છે. ધારો કે એક મિલકતની પડતર રૂ. ૧,૦૦,૦૦૦ છે અને તેના ૫૨ ૧૦% ઘસારો ગણાય તો દર વર્ષે રૂ. ૧૦,૦૦૦ ઘસારાની રકમ થશે. તેથી આ પદ્ધતિને સરખા હમાની કે સીધી લીટીની પદ્ધતિ કહે છે. આમા ઘસારાની રકમ નીચેના સૂત્ર દ્વારા ગણાય છે.

$$\text{વાર્ષિક ઘસારોની રકમ} = \frac{\text{મિલકતની પડતર} - \text{તેની ભંગાર કિંમત}}{\text{અંદાજિત આયુષ્યના વર્ષો}$$

દા.ત. એક યંત્ર રૂ. ૧,૨૦,૦૦૦ માં ખરીદવામાં આવ્યું તેનો અંદાજાત આયુષ્ય ૧૦ વર્ષ છે. અંદાજાત આયુષ્યના અંતે તેની ભંગાર કિંમત રૂ. ૨૦,૦૦૦ આંકવામાં આવી. વાર્ષિક ઘસારાની રકમ શોધો.

$$\text{વાર્ષિક ઘસારા} = \frac{\text{રૂ. } ૧,૨૦,૦૦૦ - \text{રૂ. } ૨૦,૦૦૦}{\text{રૂ. } ૧૦} = \text{રૂ. } ૧૦,૦૦૦$$

જો તેની કોઈ કિંમત ન ઉપણે તો :

$$\text{વાર્ષિક ઘસારા} = \frac{\text{રૂ. } ૧,૨૦,૦૦૦}{\text{રૂ. } ૧૦} = \text{રૂ. } ૧૨,૦૦૦$$

આ પદ્ધતિમાં દર વર્ષ ઘસારાની રકમ સરખી જ રહે છે.

ઉદાહરણ-૨

તા.૦૧-૦૧-૨૦૧૧ ના રોજ એક યંત્ર રૂ. ૧,૦૦,૦૦૦ માં ખરીદ્યું. તેનું અંદાજાત આયુષ્ય ૧૦ વર્ષ છે. તેના અંદાજાત આયુષ્યના અંતે તેની કોઈ ભંગાર કિંમત ઉપણે તેમ નથી. જો ૧૦% લેખે સરખા હમાની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે તો તેના અંદાજિત આયુષ્ય દરમ્યાનના દરેક વર્ષની ઘસારાની રકમ શોધો.

મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

ધસારો

વર્ષ	ધસારાનો દર	ધસારાની રકમ રૂ.
2011	10%	10,000
2012	10%	10,000
2013	10%	10,000
2014	10%	10,000
2015	10%	10,000
2016	10%	10,000
2017	10%	10,000
2018	10%	10,000
2019	10%	10,000
2020	10%	10,000

દર વર્ષે ધસારાની રકમ સરખી હોવાથી આ પણતિનું નામ સરખા હમાની પણતિ કે સીધી લીટીની પણતિ છે.

૧૨.૬ સરખા હમાની પણતિના ફાયદા :

- (૧) સરળ : આ પણતિ સમજવામાં સરળ છે. તેથી જ આ પણતિ વધુ પ્રચલિત છે. એકવાર ધસારાની ગણતરી કરી હોય તો પછી દર વર્ષે ગણતરી કરવાની જરૂરિયાત રહેતી નથી. દર વર્ષે તે જ રકમ ધસારા તરીકે નોંધાય છે.
- (૨) મિલકતની સંપૂર્ણ રકમ માંડી વાળવામાં આવે છે : આ પણતિમાં મિલકતની સંપૂર્ણ કિંમત તેના અંદાજીત આયુષ્ય દરમ્યાન માંડી વાળવામાં આવે છે. તેથી અંદાજીત આયુષ્યના અંતે તેની બાકી ચોપડામાં શૂન્ય અથવા તેની ભંગાર કિંમત જેટલી રહે છે.

૧૨.૭ સરખા હમાની પણતિની મર્યાદાઓ :

- (૧) ગણતરીમાં મુશ્કેલી : જ્યારે ધંધામાં વિવિધ પ્રકારના યંત્રો જે જેમનું અંદાજીત આયુષ્ય પણ અલગ અલગ હોય તેવા યંત્રોના ધસારાની ગણતરી કરવી પણ મુશ્કેલ હોય છે. આમા દરેક યંત્ર માટે અલગ ધસારાની રકમ શોધવી પડે છે.
- (૨) અયોગ્ય : સામાન્ય રીતે જેમ જેમ યંત્ર જુનું થતું જાય તેમતેમ તેને વધુ સમારકામ અને જાળવણીની જરૂરિયાત હોય છે. પણ આમા તો દર વર્ષે ધસારાની રકમ સરખી હોય છે જે અયોગ્ય છે.

ઉદાહરણ - ૩

X લિમિટેડ ટા. ૧-૪-૨૦૧૧ ના રોજ રૂ. ૧,૦૦,૦૦૦નું યંત્ર ખરીદું. જેનો અંદાજીત આયુષ્ય ૧૦ વર્ષ છે. અંદાજીત આયુષ્યના અંતે તેની ભંગાર કિંમત રૂ. ૧૦,૦૦૦ છે. દર વર્ષે નફા-નુકસાન ખાતે કેટલી રકમની જોગવાઈ કરશું તે શોધો. ધસારાનો દર શોધો.



જવાબ :

નફા નુકસાન ખાતે ઘસારાની રકમ નીચે મુજબ ગણાશે.

(i)

$$\text{ઘસારાની રકમ} = \frac{\text{યંત્રની પડતર - અંદાજીત ભંગાર કિંમત}}{\text{અંદાજીત આયુષ્યના વર્ષો}}$$

$$= \frac{૧,૦૦,૦૦૦ - ૧૦,૦૦૦}{૧૦}$$

$$= રૂ. ૯૦૦૦$$

(ii)

ઘસારાનો દર :

$$\text{ઘસારાનો દર} = \frac{\text{વાર્ષિક ઘસારાની રકમ}}{\text{પડતર કિંમત}} \times ૧૦૦$$

$$= \frac{૯૦,૦૦૦ - ૧૦૦}{૧,૦૦,૦૦૦}$$

$$= ૮\%$$

ઉદાહરણ,

સલમાન અને ઉસ્માન બ્રાથ્સેસ્ ટા. 1-7-2008ના રોજ રૂ. 70,000ના કિંમતે યંત્ર ખરીદ્યું અને રૂ. 5000 ગોઠવણી ખર્ચ ચુકાવ્યું. યંત્ર પર ૧૦% લેખે સરખા હમાની પદ્ધતિએ ઘસારો ગણાશે. છિસાબી ચોપડા તૃણ ડિસેમ્બરના રોજ બંધ કરવા. યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો.

જવાબ :

યંત્રની ખરીદ કિંમત	રૂ. ૭૦,૦૦૦
ગોઠવણી ખર્ચ	રૂ. ૫,૦૦૦
કુલ પડતર	રૂ. ૭૫,૦૦૦
ઘસારાનો દર ૧૦%	
વાર્ષિક ઘસારાની રકમ	= ૭૫૦૦૦ × ૧૦% = ૭૫૦૦

મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

ધસારો

ઉધાર			ધસારા ખાતું			જમા		
તારીખ	વિગત	નો. રકમ	તારીખ	વિગત	નો. રકમ			
		પા. ર.			પા. ર.			
૨૦૦૮			૨૦૦૮					
ડિસે. ૩૧	યંત્ર ખાતે	૩૭૪૦	ડિસે. ૩૧	નફાનુક્સાન ખાતે				૩૭૪૦
૨૦૦૯			૨૦૦૯					
ડિસે. ૩૧	યંત્ર ખાતે	૭૪૦૦	ડિસે. ૩૧	નફાનુક્સાન ખાતે				૭૪૦૦
૨૦૧૦			૨૦૧૦					
ડિસે. ૩૧	યંત્ર ખાતે	૭૪૦૦	ડિસે. ૩૧	નફાનુક્સાન ખાતે				૭૪૦૦

ઉધાર			ધસારા ખાતું			જમા		
તારીખ	વિગત	નો. રકમ	તારીખ	વિગત	નો. રકમ			
		પા. ર.			પા. ર.			
૨૦૦૮			૨૦૦૮					
જુલાઈ. ૧	બેંક ખાતે	૭૦૦૦૦	ડિસે. ૩૧	ધસારા ખાતે				૩૭૪૦
				(૭૦૦૦૦ × ૧૦/૧૦૦ × ૬/૧૨)				
			ડિસે. ૩૧	બાકી આગળ				૭૭૨૪૦
				લઈ ગયા				૭૪૦૦૦
૨૦૦૯			૨૦૦૯					
આન્ય. ૧	બાકી આગળ	૭૭૨૪૦	ડિસે. ૩૧	ધસારા ખાતે				૭૪૦૦
	લાવ્યા			(૭૪૦૦૦ × ૧૦/૧૦૦)				
			ડિસે. ૩૧	બાકી આગળ				૬૩૭૪૦
				લઈ ગયા				૭૭૨૪૦
૨૦૧૦			૨૦૧૦					
આન્ય. ૧	બાકી આગળ	૬૩૭૪૦	ડિસે. ૩૧	ધસારા ખાતે				૭૪૦૦
	લાવ્યા			(૬૩૭૪૦ × ૧૦/૧૦૦)				
			ડિસે. ૩૧	બાકી આગળ				૫૬૨૪૦
				લઈ ગયા				૬૩૭૪૦



નોંધ

ઉદાહરણ ૫

તા. ૧-૪-૨૦૦૬ના રોજ એક કંપનીએ રૂ. ૧,૦૦,૦૦૦ નું યંત્ર ખરીદું. તા. ૧-૧૦-૨૦૦૮ના રોજ રૂ. ૨૦,૦૦૦માં વધારાનું યંત્ર ખરીદું અને તેનો ગોઠવણી ખર્ચ રૂ. ૨૦૦૦ થયો. છિસાબી ચોપડા ધક્કી માર્યે બંધ થાય છે. વાર્ષિક ઘસારો ૧૦% લેખે ગણવો. સરખા હમાની પદ્ધતિએ પણ વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો.

ઉધાર

યંત્ર ખાતું

જમા

તારીખ	વિગત	નો. રકમ	તારીખ	વિગત	નો. રકમ
		પા. રૂ.			પા. રૂ.
૨૦૦૬			૨૦૦૬		
એપ્રિલ. ૧	બેંક ખાતે	૧૦૦૦૦૦	માર્ચ. ૩૧	ઘસારા ખાતે (૧૦૦૦૦ × ૧૦/૧૦૦)	૧૦૦૦૦
		૧૦૦૦૦૦	માર્ચ. ૩૧	બાકી આગળ લઈ ગયા	૬૦૦૦૦
૨૦૦૭			૨૦૦૭		
એપ્રિલ. ૧	બાકી આગળ લાવ્યા	૬૦૦૦	માર્ચ. ૩૧	ઘસારા ખાતે (૧૦૦૦૦ × ૧૦/૧૦૦)	૧૦૦૦૦
		૬૦૦૦	માર્ચ. ૩૧	બાકી આગળ લઈ ગયા	૬૦૦૦૦
૨૦૦૮			૨૦૦૮		
એપ્રિલ. ૧	બાકી આગળ લાવ્યા	૮૦૦૦	માર્ચ. ૩૧	ઘસારા ખાતે (૧૦૦૦૦૦ × ૧૦/૧૦૦)	૧૧૧૦૦
	બેંક ખાતે	૨૦૦૦		(૨૨૦૦૦ × ૧૦/૧૦૦ × ૬/૧૨)	
	બેંક ખાતે	૨૦૦૦		બાકી આગળ લઈ ગયા	૬૦૮૦૦
		૧૦૨૦૦			૧૦૨૦૦
૨૦૦૯			૨૦૦૯		
એપ્રિલ. ૧	બાકી આગળ લાવ્યા	૮૦૬૦	માર્ચ. ૩૧	ઘસારા ખાતે (૧૦૦૦૦૦ × ૧૦/૧૦૦)	૧૨૨૦૦
		૮૦૬૦		(૨૨૦૦૦ × ૧૦/૧૦૦ × ૬/૧૨)	
		૮૦૬૦		બાકી આગળ લઈ ગયા	૭૮૭૦૦
૨૦૧૦			૨૦૧૦		
એપ્રિલ. ૧	બાકી આગળ લાવ્યા	૭૮૭૦૦	માર્ચ. ૩૧	ઘસારા ખાતે (૧૦૦૦૦૦ × ૧૦/૧૦૦)	૧૨૨૦૦
		૭૮૭૦૦		(૨૨૦૦૦ × ૧૦/૧૦૦ × ૬/૧૨)	
		૭૮૭૦૦		બાકી આગળ લઈ ગયા	૬૬૪૦૦
૨૦૧૧					
એપ્રિલ. ૧	બાકી આગળ લાવ્યા	૬૬૪૦૦			૭૮૭૦૦

મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

ધસારો

ઉદાહારણ હ

તા. ૧-૧-૨૦૦૩ ના રોજ કંપનીએ ૨૦,૦૦૦ ના ખાનટની ખરીદી કરી. તા. ૧-૭-૨૦૦૩ ના રોજ રૂ.૮૦૦૦ ના બીજા ખાનટની ખરીદી કરી અને રૂ.૨૦૦૦ ગોઠવણી ખર્ચ ચુક્યું. ૧-૭-૨૦૦૪, ના રોજ તા. ૧-૧-૨૦૦૩ ના રોજ ખરીદેલ યંત્ર ખરાબ થતા તેને રૂ. ૧૨,૫૦૦માં વેચવામાં આવ્યું. તા. ૧-૧૦-૨૦૦૪ ના રોજ રૂ.૨૮૦૦૦માં એક નવું યંત્ર ખરીદ્યું તે જ તારીખે તા. ૧-૭-૨૦૦૩ ના રોજ ખરીદેલ યંત્ર રૂ.૬૦૦૦ માં વેચ્યું.

ધસારો યંત્રની મૂળ કિંમતના ૧૦% લેખે ગણવામાં આવે છે. વર્ષ ૨૦૦૩ થી ૨૦૦૫નો ખાનટ ખાતું તૈયાર કરો.

ઉધાર

યંત્ર ખતું

જમા

તારીખ	વિગત	નો. રકમ	તારીખ	વિગત	નો. રકમ
		પા. રૂ.			પા. રૂ.
૨૦૦૩			૨૦૦૩		
જાન્ય. ૧	બેંક ખાતે	૨૦૦૦૦	ડિસે. ૩૧	ધસારા ખાતે	
જુલાઈ. ૧	બેંક ખાતે	૮૦૦૦		આખા વર્ષનું ૨૦૦૦	
	રોકડ ખાતે	૨૦૦૦	ડિસે. ૩૧	૪ માસનું ૫૦૦	૨૪૦૦
	(ગોઠવણી ખર્ચ)			બાકી આગળ લઈ ગયા	
		૩૦૦૦૦		(i) ૧૮૦૦૦	૨૭૪૦૦
				(ii) ૮૪૦૦	
૨૦૦૪			૨૦૦૪		૩૦૦૦૦
જાન્ય. ૧	બાકી આગળ લાવ્યા	૨૭૪૦૦	જુલાઈ. ૧	રોકડ ખાતે	૧૨૪૦૦
	(i) ૧૮૦૦૦		ડિસે. ૩૧	ધસારા ખાતે	૧૦૦૦
	(ii) ૮૪૦૦			નફા નુકસાન ખાતે	૪૪૦૦
		૨૭૪૦૦	જુલાઈ. ૧	ધસારા ખાતે (ii)	૧૦૦૦
			ડિસે. ૩૧	બાકી આગળ લઈ ગયા	૮૪૦૦
				(૮૪૦૦-૧૦૦૦)	
૨૦૦૪			૨૦૦૪		૨૭૪૦૦
જાન્ય. ૧	બાકી આગળ લાવ્યા	૮૪૦૦	ઓક્ટો. ૧	રોકડ ખાતે (વેચાણ)	૬૦૦૦
	રોકડ ખાતે (iii)	૨૮૦૦૦	ઓક્ટો. ૧	ધસારા ખાતે (ii)	૭૪૦
				નફા નુકસાન ખાતે	૧૭૪૦
			ડિસે. ૩૧	ધસારા ખાતે (iii)	૭૦૦
				(૨૮૦૦૦*૧૦/૧૦૦*૩/૧૨)	
			ડિસે. ૩૧	બાકી આગળ લઈ ગયા	૨૭૩૦૦
				(૨૮૦૦૦-૭૦૦)	
		૩૬૪૦૦			૩૬૪૦૦



નોંધ

નોંધ:

(૧)	તા. ૧-૧-૦૪ ના રોજ ચોપે કિંમત	૧૮,૦૦૦
	બાદ : ૬ માસનો ઘસારો ($20,000 \times 90/100 \times ૬/૧૨$)	૧૦૦૦
	૧-૭-૦૪, ના રોજ ચોપે કિંમત	૧૭૦૦૦
	બાદ : વેચાણ કિંમત	૧૨૫૦૦
	યંત્ર વેચાણની ખોટ	૪૫૦૦
(૨)	તા. ૧-૧-૦૫ ના રોજ યંત્રની ચોપે કિંમત	૭૫૦
	બાદ : ૮ માસનો ઘસારો ($10,000 \times 90/100 \times ૮/૧૨$)	૭૫૦
	તા. ૧-૫-૦૫ ના રોજની ચોપે કિંમત	૭૭૫૦
	બાદ : વેચાણ કિંમત	૬૦૦૦
	યંત્ર વેચાણની ખોટ	૧૭૫૦



પાઠ સ્વાધ્યાય ૧૨.૨

ખાલી જગ્યા ભરો :

૧. સરખા હમા પદ્ધતિ મુજબ એવી ધારકા કરવામાં આવે છે કે મિલકતના અંદાજીત આયુષ્ય દરમ્યાન ઘસારાની રકમ હોય છે.
૨. સરખા હમાની પદ્ધતિનું બીજું નામ છે.
૩. સરખા હમાની પદ્ધતિમાં અંદાજીત આયુષ્યના અંતે મિલકતની કિંમત અથવા જેટલી થઈ જાય છે.
૪. સરખા હમાની પદ્ધતિમાં અગાઉના વર્ષની તુલનામાં નફાનુકસાન ખાતા પર કુલ ભાર હોય છે.

૧૨.૮ ઘટતી જતી બાકીની પદ્ધતિ

આ પદ્ધતિ મુજબ, મિલકતની કિંમત વર્ષે દર વર્ષે ઘટતી જતી હોય છે. તેથી તેની ઘસારાની કિંમત પણ દર વર્ષે ઘટતી જાય છે. ઘસારાની રકમની ગણતરી માટે ઘસારાનો દર તેની ઘસારા બાકી કિંમત પર ગણવામાં આવે છે. ઘસારો દર વર્ષે તેની શરૂઆતની બાકી પર ગણવામાં આવે છે. આ પદ્ધતિમાં મિલકતની કિંત કયારે પણ શૂન્ય થતી નથી.

ધારો કે મિલકતની પડતર રૂ. ૪૦,૦૦૦ છે. તેના પર ૧૦% લેખે ઘસારો ગણાય છે. તેથી પ્રથમ વર્ષે ઘસારાની રકમ રૂ. ૪૦૦૦ (૪૦,૦૦૦ \times ૧૦%) ગણાશે. તેથી તેના પદ્ધતિના વર્ષે તેની ચોપે કિંમત રૂ. ૩૬,૦૦૦ થશે. તેથી બીજા વર્ષે તેની ઘસારાની કિંમત રૂ. ૩૬૦૦ (૩૬,૦૦૦ \times ૧૦%) થશે. આમ દર વર્ષે ઘસારાની રકમ ઘટતી જશે.



ઉદાહરણ ૭

તા. ૧-૧-૨૦૧૧ ના રોજ રૂ. ૧,૦૦,૦૦૦ ની કિંમતનું યંત્ર ખરીદું, તેનું અંદાજીત આયુષ્ય ૧૦ વર્ષ છે. અંદાજીત આયુષ્યના અંતે તેની ભંગાર કિંમત રૂ. ૪૦૦૦ થશે. યંત્ર પર ૧૦% લેબે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ધસારો ગણો. યંત્રના અંદાજીત આયુષ્યના વર્ષોદરમ્યાનના ધસારાની રકમ શોધો.

વર્ષ	ધસારાનો દર	ધસારાની રકમ
૨૦૧૧	૧૦%	૧૦,૦૦૦
૨૦૧૨	૧૦%	૮,૦૦૦
૨૦૧૩	૧૦%	૮,૯૦૦
૨૦૧૪	૧૦%	૭,૨૮૦
૨૦૧૫	૧૦%	૬,૫૬૧
૨૦૧૬	૧૦%	૫,૮૦૪
૨૦૧૭	૧૦%	૫,૩૭૪
૨૦૧૮	૧૦%	૪,૭૮૩
૨૦૧૯	૧૦%	૪,૩૦૪
૨૦૨૦	૧૦%	૩,૮૭૪

આ પદ્ધતિ મુજબ ધસારાની રકમ દર વર્ષોધર્થી જતી હોવાથી આ પદ્ધતિનું નામ ઘટતી જતી બાકીની પદ્ધતિ રાખવામાં આવ્યું છે.

૧૨.૯ ઘટતી જતી બાકી પદ્ધતિના ફાયદા

૧. નફા નુકસાન ખાતા પર સમાન બોજ :

શરૂઆતના વર્ષોમાં યંત્રની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે. તેથી તે વધુ નફો કરી આપે છે. તેની સામે શરૂઆતના વર્ષોમાં તેની પડતર સામે તેના ધસારાની રકમ પણ વધારે હોય છે.

શરૂઆતના વર્ષોમાં યંત્રની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે. તેથી તે વધુ નફો કરી આપે છે. તેની સામે શરૂઆતના વર્ષોમાં તેની પડતર સામે તેના ધસારાની રકમ પણ વધારે હોય છે.

શરૂઆતના વર્ષોમાં ધસારો વધુ ગણાય છે અને મરામત ખર્ચ ઓદૃષ્ટ થાય છે. જ્યારે પાછળા વર્ષોમાં ધસારો ઓછો અને મરામત ખર્ચ વધુ થાય છે. તેથી ધસારો વત્તા મરામત ખર્ચનો કુલ બોજો નફાનુકસાન ખાતે દર વર્ષોસરખા પ્રમાણમાં પડે છે.

૧૨.૧૦ ઘટતી જતી બાકી પદ્ધતિની મર્યાદાઓ :

- મિલકત સંપુર્ણપણે માંડી વાળવામાં આવતી નથી : આ પદ્ધતિમાં મિલકતની કિંમત કયારેય પણ શૂન્ય થતી નથી.
- ગુચ્છવડો : આ પદ્ધતિમાં ધસારાનો દર નક્કી કરવો એ કઠિન કાર્ય છે.



ખાલી જગ્યા ભરો :

૧. ઘસારો એ મિલકતની કિંમતમાં દર્શાવે છે.
૨. યંત્ર પર ઘસારાની રકમ ખાતે જમા કરાય છે.
૩. સરખા હમાની પદ્ધતિ મુજબ યંત્રની ઉપર ઘસારો ગણાય છે.
૪. ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ ઘસારો યંત્રની ઉપર ગણાય છે.
૫. જો ભંગાર કિંમત ના ઉપજે તો પણ ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ મિલકતની કિંમત કયારેય પણ થતી નથી.

ઉદાહરણ ૮

વિઝન એન્ટરપ્રાઇઝે ૧-૧૦-૨૦૧૨ના રોજ રૂ. ૧,૦૦,૦૦૦ના પ્લાન્ટ અને મશીનરી ખરીદા. ઘસારો ૨૦% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ ગણવામાં આવ્યો. તા. ૧-૧-૨૦૧૫ના રોજ રૂ. ૪૦,૦૦૦માં વધારાની મશીનરી ખરીદવામાં આવી.

૩૧-૩-૨૦૧૬ ના રોજ પૂરા થતા વર્ષ સુધીનો પ્લાન્ટ અને મશીનરી ખાતું બનાવો છિસાબી વર્ષ ૩૧ માર્ચે પુરું થાય છે.

ઉધાર

યંત્ર ખાતું

જમા

તારીખ	વિગત	નો. રકમ	તારીખ	વિગત	નો. રકમ
		પા. રૂ.			પા. રૂ.
૨૦૧૨	ઓક્ટો. ૧	બેંક ખાતે	૨૦૧૨	માર્ચ. ૩૧ ઘસારા ખાતે (૬ માસ)	૧૦૦૦૦
			માર્ચ. ૩૧ બાકી આગળ લઈ ગયા		૮૦૦૦૦
		૧૦૦૦૦૦			૧૦૦૦૦૦
૨૦૧૩	એપ્રિલ. ૧	બાકી આગળ લાવ્યા	૨૦૧૪	માર્ચ. ૩૧ ઘસારા ખાતે	૧૮૦૦૦
		૧૦૦૦૦૦	માર્ચ. ૩૧ બાકી આગળ લઈ ગયા	૭૨૦૦૦	૮૦૦૦૦
		૮૦૦૦૦			
૨૦૧૪	એપ્રિલ. ૧	બાકી આગળ લાવ્યા	૨૦૧૫	માર્ચ. ૩૧ ઘસારા ખાતે (૭૨૦૦૦ પર એક વર્ષનો = ૧૪૪૦૦) (૪૦૦૦૦ પર ત્રણ માસનો = ૨૦૦૦) બાકી આગળ લઈ ગયા	૧૫૪૦૦
૨૦૧૫		૭૨૦૦			૮૪૬૦૦
					૧૧૨૦૦૦

મોડિયુલ - ૪

ઘસારો, જોગવાઈ
અને અનામતો

નોંધ

મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

ધસારો

૨૦૧૫	બાકી આગળ લાવ્યા	૮૫૬૦૦	૨૦૧૬	માર્ચ. ૩૧	ધસારા ખાતે (૮૬૬૦૦ પર એક વર્ષનો)	
૨૦૧૬	બાકી આગળ લાવ્યા	૮૫૬૦૦	૨૦૧૦		બાકી આગળ લઈ ગયા	૭૬૪૮૦ ૮૫૬૦૦

ઉદાહરણ ૮

૧-૦૪-૨૦૦૮ ના રોજ ગંગા બ્રધર્સે રૂ. ૭૫૦૦૦ ના એક એવા બે યંત્રો ખરીદ્યા. ધસારો ઘટતી જતી બાકીની પણતિએ ૧૦ % લાખે ગણાશે. તા. ૩૧-૩-૨૦૧૧ ના રોજ એક યંત્ર પર રૂ. ૫૫૦૦૦ માં વેચ્યું. અને તે જ દિવસે એક આધુનિક યંત્ર રૂ. ૮૦૦૦૦માં ખરીદ્યું. વર્ષ ૨૦૦૮-૧૦ થી ૨૦૧૦-૧૧ નું યંત્ર ખાતું તૈયાર કરો.

જવાબ

તારીખ	વિગત	નો. રકમ	યંત્ર ખાતું		જમા
			પા.	રૂ.	
૨૦૦૮					
ઓક્ટો. ૧	બેંક ખાતે	૧૪૦૦૦૦	૨૦૧૦	માર્ચ. ૩૧	ધસારા ખાતે
		૧૪૦૦૦૦		માર્ચ. ૩૧	બાકી આગળ લઈ ગયા
૨૦૧૦					
એપ્રિલ. ૧	બાકી આગળ લાવ્યા	૧૩૪૦૦૦	૨૦૧૧	માર્ચ. ૩૧	ધસારા ખાતે
		૧૦૦૦૦૦		માર્ચ. ૩૧	બેંક ખાતે
		૨૧૪૦૦૦			નફા નુકસાન ખાતે
					બાકી આગળ લઈ ગયા
૨૦૧૧					૧૪૦૭૪૦
એપ્રિલ. ૧	બાકી આગળ લાવ્યા	૧૪૦૭૪૦			૨૧૪૦૦૦

ઘસારો

યંત્ર વેચાણના ખોટની ગણતરી	
પડતર ટિંમટ	૭૪૦૦૦
ઘસારો	૭૪૦૦
	૬૭૪૦૦
ઘસારો	૬૭૪૦
	૬૦૭૪૦
વેચાણ ટિંમટ	૫૫૦૦૦
ખોટ	૫૭૪૦

ઉદાહરણ ૧૦

૧ ઓક્ટોબર ૨૦૦૮ ના રોજ આકાશ ટ્રાન્સપોર્ટ કંપનીએ રૂ.૮૦૦૦૦ નો એક ટ્રક ખરીદ્યો. ૧ એપ્રિલ ૨૦૧૦ ના રોજ આ ટ્રકને અક્સમાત થતા તેનો સંપુર્ણ નાશ થયો અને વિમા કંપનીએ દાવા પેટે રૂ.૬,૦૦,૦૦૦ આપ્યાં. આ જ દિવસે કંપનીએ એક બીજું ટ્રક રૂ.૧૦,૦૦,૦૦૦માં ખરીદ્યો. કંપની ૨૦% લેખે ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણે છે. ૨૦૦૮થી ૨૦૧૦ સુધીનું ટ્રકનું ખાતું તૈયાર કરો.

જવાબ :

તારીખ	વિગત	ઉધાર		ટ્રક ખાતું		જમા	
		નો. રકમ	પા. રૂ.	તારીખ	વિગત	નો. રકમ	પા. રૂ.
૨૦૦૮				૨૦૦૮			
ઓક્ટો. ૧	બેંક ખાતે			દિસે. ૩૧	ઘસારા ખાતે (૮૦૦૦૦૦X૨૦/૧૦૦X૩/૧૨)	૪૦૦૦૦	
		૮૦૦૦૦૦			બાકી આગળ લઈ ગયા	૭૬૦૦૦૦	
૨૦૦૯				૨૦૦૯			
જાન્યુ. ૧	બાકી આગળ લાવ્યા	૭૬૦૦૦૦		દિસે. ૩૧	ઘસારા ખાતે (૭૬૦૦૦૦X૨૦/૧૦૦)	૧૪૨૦૦૦	
				દિસે. ૩૧	બાકી આગળ લઈ ગયા	૬૦૮૦૦૦	
૨૦૧૦				૨૦૧૦			
જાન્યુ. ૧	બાકી આગળ લાવ્યા	૬૦૮૦૦૦		એપ્રિ. ૩૧	બેંક ખાતે	૬૦૦૦૦૦	

મોડિયુલ - ૪
ઘસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

ધસારો

એપ્રિ. ૧	નફા નુકશાન ખાતે	૨૨૪૦૦		ધસારા ખાતે (૬૦૮૦૦૦૫૨૦/૧૦૦૫૩/૧૨)	૩૦૪૦૦
			ટિસે. ૩૧	ધસારા ખાતે (૧૦૦૦૦૦૫૨૦/૧૦૦૫૬/૧૨)	૧૪૦૦૦૦
		૧૬૩૦૪૦૦	ટિસે. ૩૧	બાકી આગળ લઈ ગયા	૮૪૦૦૦

સરખા હમાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ વચ્ચે તફાવત જણાવો :

આધાર (મુદ્દા)

સરખા હમાની પદ્ધતિ

ઘટતી જતી બાકીની પદ્ધતિ

ગણતરીનો	આ પદ્ધતિમાં દર વર્ષે ધસારો મિલકતની	આ પદ્ધતિમાં દર વર્ષે ધસારો મિલકતની
આધાર	પડતર કિંમત (મૂળ કિંમત) પર ગણાય છે.	ચોપડે કિંમત પર ગણાય છે.
ધસારાની	આ પદ્ધતિમાં દરેક વર્ષ ધસારાની રકમ	આ પદ્ધતિમાં દર વર્ષે ધસારાની રકમ
રકમ	એક સરખી રહે છે.	રકમ ઘટતી જાય છે.
મિલકતની	આ પદ્ધતિમાં ધસારો ગણતાં મિલકતની	આ પદ્ધતિમાં ધસારો ગણતાં મિલકતની
ચોપડે કિંમત	કિંમત પૂરેપૂરી માંડીવાળી શકાય છે એટલે કે શૂન્ય થાય છે.	કિંમત પૂરેપૂરી માંડીવાળી શકાતી નથી એટલે શૂન્ય થતી નથી.
ધસારો અને સમારકામ ખર્ચ	ધસારાની રકમ અને સમારકામ ખર્ચ નો સંયુક્ત બોજો શરૂઆતના વર્ષોમાં ઓછો અને પાછળના વર્ષોમાં વધુ હોય છે.	મિલકતનો ધસારાનો ખર્ચ અને સમારકામ ખર્ચની ભેગી અસર દર વર્ષે લગભગ સરખી રહે છે.



પાઠ સ્વાધ્યાય ૧૨.૪

(૧) નીચેના વાક્યો ખરા છે કે ખોટા જણાવો :

૧. સરખા હમાની પદ્ધતિમાં ધસારાની રકમ દર વર્ષે ઘટતી જાય છે.
૨. ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ધસારાની રકમ દર વર્ષે સરખી રહે છે.
૩. સરખા હમાની પદ્ધતિમાં મિલકતની ચોપડે કિંમત અંતે શૂન્ય થાય છે.
૪. ઘટતી જતી બાકીની પદ્ધતિમાં મિલકતની ચોપડે કિંમત કયારેય શૂન્ય થતી નથી.

(૨) બહુવિકલ્પી પ્રશ્નો:

૧. ઘસારા શેના પર ગણાય ?

 - (a) માલનો સ્ટોક
 - (b) ચાલુ મિલકતો
 - (c) સ્થિર મિલકતો
 - (d) પ્રવાહી મિલકતો

૨. બિન ઉપયોગી શાઢો કયારે વપરાય ?

 - (a) મિલકતની ભાંગફોડ
 - (b) ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવાથી થતો મિલકતની કિંમતમાં ઘટાડો
 - (c) નવી શોધખોળના કારણે
 - (d) મિલકતના ઉપયોગ કે આયુષ્યના કારણે

૩. ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવા માટે નીચેનામાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવાય છે ?

 - (a) મૂળકિંમત
 - (b) ઘસારા બાદ ચોપડે કિંમત
 - (c) ભંગાર કિંમત
 - (d) ચોપડે કિંમત

૪. ઘસારો ગણવા માટે કઈ રકમ ધ્યાનમાં લેવાય.

 - (a) મિલકતની કિંમત વત્તા ભંગાર કિંમત
 - (b) મિલકતની કિંમતમાં ભંગાર કિંમત ન ઉમેરવી
 - (c) મિલકતની પડતર કિંમત બાદ ભંગાર કિંમત
 - (d) ઉપરમાંથી એક પણ નહિ.

૫. નીચેનામાંથી ક્યું ઘસારાનું કારણ નથી.

 - (a) સામાન્ય વપરાશ
 - (b) બિન ઉપયોગી થવું
 - (c) મિલકતની પડતર
 - (d) બજાર કિંમતમાં ઘટાડો કે વધારો

૬. ઘસારો ગણવા ક્યો પદ યોગ્ય છે ?

 - (a) કુલ ઘસારો ત્રણ ગોઠવણી ખર્ચ
 - (b) કુલ પડતર ટે ભંગાર કિંમત અંદાજીત આયુષ્ય
 - (c) કુલ પડતર ટે ભંગાર કિંમત અંદાજીત આયુષ્ય





- (d) ઉપરમાંથી એક પણ નહિ

૮. નીચેનામાંથી કયું પરિબળ વાર્ષિક ઘસારાને અસર કરતું પણ્ણિબળ નથી.

(a) મિલકતની પડતર (b) મિલકતની ભંગાર ટિંમત

(c) મિલકતનો અંદાજીત આયુષ્ય (d) મિલકતનો વાર્ષિક મરામત ખર્ચ

૯. નીચેમાંથી કઈ મિલકત પર ઘસારો ગણાય ?

(a) સ્ટોક (b) દેવાદારો

(c) ધન્ય (d) જમીન

૧૦. નીચેમાંથી કઈ મિલકત પર ઘસારો ગણાતો નથી ?

(a) ધન્ય (b) પ્લાન્ટ

(c) ઝેરોક્ષ મશીન (d) સ્ટોક



તમે આટલું શીખ્યા :

- કોઈપણ મિલકતના વપરાશ, સમયના વહેણ કે નવી શોધખોળના કારણે કે અન્ય કોઈ કારણાસર તેના મૂલ્યમાં કમશા: અને કાયમી ઘટાડો નોંધાય છે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે.
 - ઘસારાના કારણો
 - મિલકતનો વપરાશ કે ઉપયોગ
 - સમયના વહેણના કારણે
 - નવી શોધખોળના કારણે બિનઉપયોગી થવાના કારણે
 - ઘસારાની પદ્ધતિઓ
 - સીધી લીટીની પદ્ધતિ કે સરખા હમાની પદ્ધતિ
 - ઘટતી જતી બાકીની પદ્ધતિ
 - સરખા હમાની પદ્ધતિના ફાયદા
 - સરળ
 - મિલકતની કિંમતને સંપર્કપણે માંડીવાળી શકાય

- સરખા હમાની પદ્ધતિની મર્યાદા
 - ગૃહશરીમાં મુશ્કેલ
 - અયોગ્ય
- ઘગતી જતી બાકીની પદ્ધતિના ફાયદા
 - નફાનુક્સાન ખાતા પર સરખો બોજો
 - મિલકતની ચોપડે કિંમત શૂન્ય ન થાય
- ઘટતી જતી બાકીની પદ્ધતિની મર્યાદાઓ
 - મિલકતની કિંમત સંપૂર્ણપણે માંડીવાળી શકાતી નથી
 - ગુંચવડો



પાઠ્યાંત સ્વાધ્યાય :

૧. ઘસારો એટલે શું? ઘસારાની જોગવાઈના હેતુઓ જણાવો.
૨. ઘસારાની જોગવાઈના કારણો જણાવો.
૩. ઘસારાની કઈ બે પદ્ધતિઓ છે? દરેકના ફાયદા અને મર્યાદાઓ જણાવો.
૪. ઘસારાની જોગવાઈના હેતુઓ જણાવો.
૫. સરખા હમાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ વચ્ચે તફાવત જણાવો.
૬. કિઝામોહન લિમિટેડ ૧ લી ઓટોબર ૨૦૦૮ ના રોજ રૂ.૮૦૦૦૦ ની કિંમતનું એક યંત્ર ખરીદું. જેનો ગોઠવણી ખર્ચ રૂ. ૧૦૦૦૦ થયો. ઘસારો વાર્ષિક ૧૦% દરે તેની મૂળકિંમત પર ગણવામાં આવશે. ત્રણ વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. હિસાબી વર્ષ ૩૧ માર્ચના રોજ પુરું થાય છે.
૭. રાજ પુરોહિત લિમિટેડ ૧ લી ઓપ્રિલ ૨૦૦૮ ના રોજ રૂ.૮૦૦૦૦ માં એક યંત્ર ખરીદું અને તેના સમારકામ અને ગોઠવણી ખર્ચ રૂ. ૨૦૦૦૦ થયો. ૩૦ મી સાંચેભર ૩૦, ૨૦૧૧ ના રોજ આ યંત્ર રૂ. ૬૦૦૦૦ માં વેચ્યું. ૨૦૦૮ થી ૨૦૧૧ સુધીના વર્ષોનું યંત્ર ખાતું તૈયાર કરો. ઘસારો ૧૦% લેખે સીધી લીટીની પદ્ધતિએ ગણવામાં આવે છે.
૮. ૧-૪-૨૦૦૭ ના રોજ અજ્યકુમાર એન્ડ કંપનીએ રૂ. ૨૦૦૦૦નું યંત્ર ખરીદું. યંત્ર પર ૧૦% લેખે સરખા હમાની પદ્ધતિએ ઘસારો ગણવાય છે. ૧-૧૦-૨૦૧૦ના રોજ આ યંત્ર



મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

ધસારો

રૂ.૮૦૦૦ માં વેચ્યું. હિસાબી વર્ષ તૃણ મી માર્ચે પુરં થાય છે. યંત્ર ખાતું તૈયાર કરો.

૮. ૧-૧-૨૦૦૮ ના રોજ એક પ્લાન્ટ રૂ.૮૦૦૦૦માં ખરીદો તેના ૧૦ વર્ષના અંદાજિત આયુષ્યના અંતે તેની ભંગાર કિંમત રૂ.૨૭૮૮૪ છે. ધસારો ૧૦ % લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણવામાં આવે છે. ૪ વર્ષ માટે પ્લાન્ટ ખાતું તૈયાર કરો, હિસાબી વર્ષ તૃણ માર્ચે પુરં થાય છે.
૧૦. ૧ લી જાન્યુઆરી, ૧૯૮૭ ના રોજ યંત્ર ખાતું રૂ.૧૦૦૦૦ બાકી દરશાવે છે. ૧ લી જુલાઈ ૧૯૮૮ ના રોજ એક નવું યંત્ર રૂ.૬૦૦૦માં ખરીદું. ત૦મી જુન ૧૯૯૦ના રોજ ૧ લી જુલાઈ ૧૯૮૮ ના રોજ ખરીદેલ યંત્ર સિવાયનું યંત્ર રૂ.૬૦૦૦માં વેચ્યું. ચાર વર્ષને માટે યંત્ર ખાતું તૈયાર કરો. હિસાબી વર્ષ તૃણ મી ડિસેમ્બરે પુરં થાય છે. ધસારો ૧૦ % લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણવામાં આવે છે.



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

- ૧૨.૧ (૧) ઘટાડો (૨) કિંમત, આયુષ્ય (૩) અંદાજિત આયુષ્ય (૪) નવી શોખખોળ
 ૧૨.૨ (૧) સરખી (૨) સીધી લીટીની પદ્ધતિ (૩) શૂન્ય, ભંગાર કિંમત (૪) વધુ
 ૧૨.૩ (૧) ઘટાડો (૨) યંત્ર (૩) મૂળકિંમત (૪) ચોપડે કિંમત (૫) શૂન્ય
 ૧૨.૪ (૧) ખોદું (૨) ખોદું (૩) સાચું (૪) સાચું

II (1) c (2) c (3) a (4) b (5) c (6) d (7) b (8) d (9) c (10) d

કાર્ય: તમારા વાલીને તમારા ઘરની સ્થિર મિલકતો જેવી કે ટી.વી., ફિઝ, મોટર સાઇકલ, કાર કયારે ખરીદી તે પૂછો. તેનો અંદાજાત આયુષ્ય શોધો દર વર્ષ ધસારાની કેટલી રકમ થશે તેની ગણતરી કરો.



નોંધ

૧૩

અનામત અને જોગવાઈ

તમે જાણો છો કે વેપારી તેના હિસાબો ધંધાના સાતત્યના સિધ્યાંતના આધારે લખે છે. જેમાં એ માનવામમાં આવે છે કે ધંધા એ હંમેશા ચાલુ રહેશે અને નજીકના ભવિષ્યમાં તે બંધ થવાનો નથી. દર વર્ષના અંતે હિસાબો બંધ કરવામાં આવે છે.



હેતુઓ :

આ પાઠ શીખ્યા પછી તમે :

- જોગવાઈની જરૂરિયાત અને અર્થ સમજ શકશો.
- અનામતનો અર્થ સમજશો
- અનામતના પ્રકારો જાણી શકશો.
- અનામત અને જોગવાઈનો તફાવત સમજ શકશો.

૧૩.૧ જોગવાઈ : અર્થ અને જરૂરિયાત

તમે જમણો છો કે આપણા રોજંદા જીવનમાં ભવિષ્યની જરૂરિયાતને પૂરી કરવા કેટલીક વ્યવસ્થા કરવી પડે છે. દા.ત. જો તમારા પિતા તમને ભવિષ્યમાં ડાંકટર કે ઈજનેર બનાવવા માંગતા હોય તો ભવિષ્યમાં આવનારા ઉચ્ચ શિક્ષણ પાછળના ખર્ચ માટે તેમને અત્યારથી જ કેટલીક નાણાં વ્યવસ્થા કરવી પડે તો તેના માટે તમારા પિતાએ શું કરવું પડે? તમે સાચું વિચારી રહ્યા છો, તેમણે અત્યારથી જ બચત કરવી પડશે. તેમજ ધંધામાં ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે અત્યારથી જ કેટલીક નાણાંકીય વ્યવસ્થા કરવી પડે છે. જેને જોગવાઈ કહેવાય છે.

જો કેટલીક ચોકક્સ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તો તે જવાબદારી કહેવાય. દા.ત. જો ઓક્ટોબર માસનું ભાડું રૂ. ૨૦૦૦ ચૂકવવાનું બાકી હોય તો ભાડું ખાતું ઉધાર કરી, ચૂકવવમના બાકી ભાડા ખાતે જમા કરીશું. જો કે કેટલીક જવાબદારીઓ કે ખર્ચની રકમ ચોકક્સ હોતી નથી. તેથી તેની અંદાજીત રકમ નફાનુક્ષાન ખાતે ઉધાર કરવામાં આવે છે, જેને જોગવાઈ કહેવાય છે. આમ, જોગવાઈ એટલે ભવિષ્યના આકસ્મિક ખર્ચું નુકસાન સામે જે રકમ અલગથી રાખવામાં આવે છે તેને જોગવાઈ કહેવાય છે. શક્મંદ લેણા અનામતની જોગવાઈ, દેવાદાર વરાવ અનામતની જોગવાઈ, ધસારાની જોગવાઈ વગેરે જોગવાઈના ઉદાહરણો છે. ક

મોડયુલ - ૪

ધ્યાન, જોગવાઈ
અને અનામતો



નોંધ

અનામતો અને જોગવાઈ

જોગવાઈની જરૂરિયાત : નીચે માટે જોગવાઈ કરાય

૧. ધ્યાન, મિલકતની કિંમતમાં ઘટમણો કે કમી.
૨. જવાબદારી કે જેની રકમ નક્કી કરી શકાય.
૩. નહિ ચૂકવેલ દાવાની રકમ
૪. મિલકતના વેચાણથી થયેલ નુકસાન કે કરવેરાની ચૂકવણી
૫. જવાબદારીની ચૂકવણી

જોગવાઈ ઉભી કરવા માટેના સામાન્ય નિયમો

૧. જોગવાઈ નફાનુકસાન ખાતે ઉધાર થાય છે.
૨. ધ્યાની સંભવિત જવાબદારીને ચૂકવવા જોગવાઈ કરવામાં આવે છે. દા.ત. શકમંદ લેણા અનામતની જોગવાઈ અને ધ્યાન અનામતની જોગવાઈ.
૩. ધ્યાનમાં નફો થાય કે નુકસાન જોગવાઈ કરવામાં જ આવે છે.
૪. શેર હોલ્ડરો ને ડિવિડન્ડ ચૂકવવામાં જોગવાઈનો ઉપયોગ થાય નહિ.
૫. જોગવાઈ ભવિષ્યની આકસ્મિક જવાબદારી પૂરી કરવા ઉભી કરવામાં આવે છે. જેથી દર વર્ષે ચોક્કસ રકમ જોગવાઈ ખાતે લઈ જવાય છે.
૬. ચોક્કસ જવાબદારીને પહોંચી વળવા જોગવાઈ કરાય છે.
૭. સામાન્ય રીતે જોગવાઈને પાકા સરવેયામાં જવાબદારી બાજુએ દર્શાવાય છે.



પાઠ સ્વાધ્યાય ૧૩.૧

૧. જોગવાઈ એટલે ભવિષ્યના અંદાજીત અચોક્કસ અને ને પહોંચી વળવા માટેની રકમ
૨. દાવા માટે પણ જોગવાઈ કરી શકાય.
૩. જોગવાળ માટે ઉધાર કરી ઉભી કરવામાં આવે છે.
૪. જોગવાઈનો ઉપયોગ વચ્ચે ડિવિડન્ડની વહેંચણી માટે કરી શકાય નહીં.
૫. જોગવાઈને પાકા સરવેયામાં બાજુએ દર્શાવવામાં આવે છે.

૧૩.૨ અનામતનો અર્થ :

ભવિષ્ય હંમેશા અચોકક્સ હોય છે. ધંધામાં ઘણી બધી અચોકક્સ જવાબદારીઓ અને ખર્ચાઓ આવે છે. આવી અચોકક્સ જવાબદારીઓને પહોંચી વળવા કે ખર્ચાઓને પૂરા કરવા માટે અલગથી રકમની જોગવાઈ કરવામાં આવે છે. ધારો કે તમારા પિતા દર મહિને રૂ. ૨૦,૦૦૦ કર્માય છે. તેઓ કોઈ રકમની બચત કરતા નથી, જો તમે મહિનાની વચ્ચે બીમાર થયા તો તમારી દવા પાછળ જે ખર્ચ થશે તે તમારા પિતા કઈ રીતે મેળવશે. ચોકક્સ, તે તેમના મિત્રો કે સંબંધીઓ પાસેથી ઉધાર માંગશે પણ જો તેઓ પણ આપવાની ના પડે તો શું થશે? વિચારો.

જો તમારા પિતાએ તેમની આવકમાંથી થોડીક રકમ આવી આકસ્મિક ઘટનાઓ માટે અલગથી રાખી હોત તો આવી પરિસ્થિતિ ઉભી ના થઈ હોત. આમ, ભવિષ્યની આકસ્મિક જવાબદારીઓને પહોંચી વળવા માટે જે અલગથી ભંડોળ ઉભૂ કરવામાં આવે છે તેને અનામત કહેવાય છે.

ધંધામાં ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓને પહોંચી વળવા માટે આયોજન બધ્ય રીતે ભંડોળ ઉભૂ કરવું જરૂરી છે. અનામત એ નફામાંથી અલગ કાઢેલી રકમ છે જે ધંધાની આર્થિક પરિસ્થિતિ સંધર કરવા માટે જરૂરી છે. જો ધંધામાં નફો થયો હોય તો જ અનામત રાખવામાં આવે છે. દા.ત. સામાન્ય અનામત, ડિવિડન્ડ સમતુલા ફંડ, નવિનીકરણ ભંડોળ વગેરે.

૧૩.૩ અનામતના પ્રકારો

ધંધામાં ઘણીવાર ચોકક્સ કે અચોકક્સ જવાબદારીઓ ઉભી થાય છે. તે જવાબદારીઓ પૂરી કરવા માટે ચોકક્સ રકમ ફાળવવામાં આવે છે. તેને અનામત કહેવાય છે. ભવિષ્યા કેટલી આકસ્મિક જવાબદારીઓ માટે અલગથી રકમ ફાળવવામાં આવે છે જે નફાનુકસાન ફાળવણી ખાતેથી ઉભી કરવામાં આવે છે. આને સામાન્ય રીતે પાકા સરવૈયાની જવાબદારી બાજુએ દર્શાવવામાં આવે છે. અનામતના પ્રકારો નીચે મુજબ હોય શકે :

- i. સામાન્ય અનામત
- ii. મૂડી અનામત
- iii. ગુમ અનામત
- iv. મહેસૂલી અનામત
- v. વિશેષ અનામત
- vi. અનામત ભંડોળ

(i) સામાન્ય અનામત : જે રીતે આનું નામ છે તે રીતે સામાન્ય અનામત કોઈ વિશેષ હેતુ માટે ઉભૂ કરવામાં આવતું નથી. આનો ઉપયોગ ભવિષ્ય કે કેટલીક ચોકક્સ કે આકસ્મિક જવાબદારીઓને પૂરી કરવા થાય છે. કાનુની રીતે સામાન્ય અનામત ઉભૂ કરવું ફરજિયાત નથી. આ ત્યારે જ ઉભૂ કરવામાં આવે છે જ્યારે ધંધામાં વધુ નફો હોય. અને નફાનુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવે છે.



મોડયુલ - ૪

ધ્રારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

અનામત અને જોગવાઈ

- આ કોઈ ચોકકસ ઉદેશ્ય માટે ઉભૂ કરાતું નથી.
- ભવિષ્યના નુકસાનને માંડા વાળવા આનો ઉપયોગ થઈ શકે.
- આ ત્યારે જ ઉચ્ચ કરાય જયારે ધંધામાં ભૂરતો નફો હોય.
- આની રકમનો આધાર નફા પર રહેલો છે.
- આને નફા નુકસમા ફાળવણી ખાતાની ઉધાર બાજુએ દર્શાવાય છે.
- આના કારણે માત્ર વહેંચણીપાત્ર નફામાં જ ઘટાડો થાય છે.
- આ અનામત મહેસૂલી નફામાંથી અલગ પાડેલો ભાગ છે. આનો મુખ્ય ઉદેશ્ય ધંધાની આર્થિક સ્થિતિ સધર કરવાનો છે. આનો કોઈ ચોકકસ હેતુ હોતો નથી. ડિવિડન્ડની વહેંચણી માટે પડા આ અનામત ઉપયોગી છે.
- સામાન્ય અનામત એ નફાનો એક ભાગ છે. જો નફો ન હોય તો અનામત પડા ન રાખી શકાય. અનામત એ નહીં વહેંચાયેલો નફો છે. જોગવાઈ એ નફા પર આધારિત નથી. જયારે અનામતએ નફા પર આધારિત છે. અનામત ઉભી કરવી એ ધંધાની સારી આર્થિક સ્થિતિની નિશાની છે. અનામત એ ધંધાની આર્થિક સ્થિતિ સધર બનાવે છે. અનામત વિવિધ હેતુઓ માટે ઉભૂ કરવામાં આવે છે. અનામત ધંધાના વિસ્તરણ માટે, ડિવિડન્ડની સમતુલા જાળવવા માટે, ડિબેન્ચર કે લોન પરત કરવા માટે જેવા હેતુઓ માટે ઉભૂ કરવામાં આવે છે.

૧. મૂડી અનામત : મૂડી નફામાંથી જે અનામત ઉભૂ કરવામાં આવે છે તેને મૂડી અનામત કહેછે. શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે લેવામાં આવેલ પ્રીમિયમ, ધંધો ચાલુ કરતા પહેલાનો નફો, મિલકત કે દેવાંના પુનઃમુલ્યાંકનથી થતો નફો એ મૂડી નફો છે. મૂડી નફાને શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય નહિ. ધંધાની આર્થિક સ્થિતિને સધર કરવા મૂડી અનામત રાખવામાં આવે છે. મૂડી નુકસાન કે અસામાન્ય નુકસાનને માંડી વાળવા માટે પડા મૂડી અનામતનો ઉપયોગ થાય છે.

આમ, મૂડી અનામત

- જે નફો રોકડ ડિવિડન્ડ તરીકે વહેંચાય નહીં તેમાંથી ઉભૂ કરવામાં આવે છે.
- આનો ઉદ્ભબ (i) કંપની અને શેર હોલ્ડરો વચ્ચેના ઇકવીટી બ્યવહારોના કારણે રચ્યાદ ધંધાના જેડાણના કારણે થતો હવાલો (iii) વિદેશી ચલણના બ્યવહારના તફાવતના કારણે (i) મિલકતના પુનઃમુલ્યાંકનના કારણે થતો વધારો (v) નહીં વસૂલ થયેલ નફો કે જે આવકમાં ઉમેરાયેલો નથી.



નોંધ

- મૂડી અનામતમાં, આમેનગળીરી ગ્રીમિયમ, મૂડી પરત અનામત, ધંધાના જોડાણ કે સમાવેશના કારણે થતો મૂડી નફો, મિલકતના પુનઃ મૂલ્યાંકનથી થતો નફો વિગેરે

મૂડી અનામત મૂડી નફામાંથી ઉભુ કરાય છે. મૂડી નફો એ ધંધાની આર્થિક પ્રવૃત્તિના કારણે થતો નફો નથી પણ કેટલાક વ્યવહારોના કારણે થાય છે. મૂડી અનામતને સામાન્ય રીતે ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય નહીં. આ અનામત ધંધાની આર્થિક સ્થિતિ સધર કરવા માટે અથવા મૂડી નુકસાનને પહોંચી વળવા માટે થાય છે. મૂડી નફાના કેટલાક ઉદાહરણો નીચે મુજબ હોય શકે.

૧. સ્થિર મિલકતોના વેચાણથી થતો નફો
૨. સ્થાપના પહેલાનો નફો
૩. ડિબેન્ચર પરતથી થતો નફો
૪. શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે લેવાયેલ ગ્રીમિયમ
૫. શેર જમી થી થતો નફો
૬. ધંધાની ખરીદી થી થતો નફો
૭. ધંધાની સામાન્ય આર્થિક પ્રવૃત્તિથી ન થયેલ નફો

મૂડી અનામતનો ઉપયોગ નીચે મુજબ થઈ શકે

૧. બોનસ શેર બહાર પાડવા
૨. પાંડી માંડી વાળવા
૩. પ્રાથમિક ખર્ચ માંડી વાળવા
૪. શેર / ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ
૫. ધંધાની સ્થાપના પહેલાની ખોટને માંડી વાળવા

(iii) ગુમ અનામત : કેટલીક વાર પેઢી અનામત ઉભુ કરે છે પણ તેને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવતું નથી. તેને ગુમ અનામત કહે છે. આ અનામતના કારણે ધંધાની આર્થિક સ્થિતિ મજબૂત બને છે, જે ગુમ રહે છે. આ અનામત કંપની રાખી શકે નહીં, માત્ર બેંકિંગ, વિમા કે નાણાંકીય કંપનીઓ રાખી શકે.

(iv) મહેસૂલી અનામત : મહેસૂલી નફામાંથી જે અનામત ઉભુ કરવામાં આવે છે તેને મહેસૂલી અનામત કહેવાય છે. મહેસૂલી અનામતનો ઉપયોગ ડિવિડન્ડ ચુકવવા માટે થઈ શકે છે.

મોડચુલ - ૪

ધારારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

અનામત અને જોગવાઈ

(v) વિશિષ્ટ અનામત : જ્યારે અનામત કોઈ ચોક્કસ હેતુ માટે રાખવામાં આવે તેને વિશિષ્ટ અનામત કહેવાય છે. આનો ઉપયોગ માત્ર તે હેતુ માટે જ થઈ શકે છે જે હેતુ માટે તે ઉભુ કરવામાં આવ્યું હોય.

પેઢીને નફો થાય કે નુકસાન વિશિષ્ટ અનામત ઉભુ કરવામાં જ આવે છે, જે નફાનુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવાય છે. ઉદાહરણ : ડિવિડન્ડ સમતુલ્ય ફંડ, રોકાણ વધ્યાં ભંડોળ, ઘસારા ભંડોળ વગેરે.

- (૧) આ વિશિષ્ટ હેતુ માટે ઉભુ કરાય છે.
- (૨) આનો ઉપયોગ જે હેતુ માટે ઉભુ કરાય તે હેતુ માટે જ થાય છે.
- (૩) નફો હોય કે નુકસાન, આને ઉભુ કરવું ફરજિયાત છે.
- (૪) આને નફાનુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવાય છે.
- (૫) આના કારણો ચોખ્યા નફામાં ઘટાડો થાય છે.

આને મહેસૂલી નફામાંથી ઉભુ કરાય છે પણ તે વિશિષ્ટ હેતુ માટે હોય છે. આનો ઉપયોગ વિતરણ માટે કરાય નહિએ. જ્યારે ડિબેન્ચર પરત કરવામાં આવે છે ત્યારે ડિબેન્ચર પરત નિષી ભંડોળને સામાન્ય અનામત ખાતે લઈ જવાય છે.

(i) અનામત ફંડ : જ્યારે નફાના ભાગને અલગ મુકવામાં આવે છે ત્યારે તેને અનામત કહેવાય છે, પણ જો તે અનામત ધંધાની બહાર રોકાણ કરવામાં આવે તો તેને અનામત ફંડ કહેવાય છે. તેનું રોકાણ સુરક્ષિત અને તરત વહેંચી રકમ મેળવી શકાય તેવા રોકાણોમાં થવું જોઈએ. આનો મુખ્ય હેતુ ધંધાની આર્થિક સ્થિતિ વધુ સધ્યર કરવાનો છે. આમાં વપરાયેલ 'ફંડ' શબ્દ સૂચવે છે કે રકમ ધંધાની બહાર રોકાણ કરાયેલ છે. નફાના ભાગને જ્યારે અલગ રાખવામાં આવે છે તેને અનામત કહેવાય છે. પણ જ્યારે આ રકમ પેઢીની બહાર રોકાણ કરવામાં આવે તો તેને ફંડ કહેવાય છે.

૧. આ રોકાણ ચોક્કસ સમયગાળા માટે હોતું નથી.
૨. આને વહેંચણી પાત્ર નફામાંથી ઉભુ કરાય છે.
૩. ફંડના રોકાણ પર મળેલ વાજનું પુનઃ રોકાણ કરવામાં આવતું નથી.

(vii) સિકિંગ ફંડ : લાંબા ગાળાના દેવાં ચૂકવવા તથા કાયમી મિલકતોની પુનઃસ્થાપનાના ઉદ્દેશ્યથી જે અનામત ઉભુ કરવામાં આવે છે તેને સિકિંગ ફંડ કહે છે. સિકિંગ ફંડ વાર્ષિક ફાળામાંથી ઉભુ કરાય છે. સિકિંગ ફંડની રકમને તરત જ વેચાય તેવા રોકાણોમાં રોકવામાં આવે છે. આમ સિકિંગ ફંડના બે મુખ્ય ઉદેશો હોય છે. (i) લાંબા ગાળાના દેવાની ચૂકવણી અને (iii) મિલકતોની પુનઃસ્થાપના.

અનામત અને જોગવાઈ

અનામતની રકમ ધંધાના બધાજ ખર્ચાઓની ચુકવણી પછી જે નફો વધે તેના પર નક્કી કરવામાં આવે છે. અનામત એ ધંધાની વધેલ આવક છે.

1. સિકિંગ ફડના રોકાણો ચોકકસ સમય માટે હોય છે.
2. સિકિંગ ફડ હંમેશા વહેચણીપાત્ર નફામાંથી ઉભુ કરાતું નથી. દા.ત.મિલકતોની પુનઃ સ્થાપના માટે ફડ જો નફો ના હોય તો પણ ઉભુ કરાય છે.
3. સિકિંગ ફડના રોકાણોનું વ્યાજ પુનઃ રોકાણ કરાય છે.

અનામત ઉભું કરવાના સામાન્ય નિયમો :

- (i) આના નફા નુકસાન ખાતે ઉધાર કરી ઉભુ કરવામાં આવે છે.
- (ii) ધંધાની આકસ્મિક જવાબદારી પુરી કરવા, ધંધાની આર્થિક સ્થિતિ મજબુત કરવા અને ડિવિડની સમતુલ્ય જગવવા માટે અનામત ઉભું કરાય છે.
- (iii) ધંધામાં નફો હોય તો જ અનામત ઉભુ કરાય છે.
- (iv) આનો શેરહોલ્ડરો વચ્ચે ડિવિડ તરીકે વહેંચી શકાય છે.
- (v) ડિઝેનર પરત નીધી ફડ સિવાયના અનામતની રકમ ચોકકસ હોતી નથી
- (vi) અનામતની રકમ ધંધાના નફા તથા કંપનીના વહીવટના આધારે નક્કી થાય છે.
- (vii) આને સામાન્ય રીતે પાકા સરવેયામાં જવાબદારી બાજુએ દર્શાવવામાં આવે છે. જો તે વિશિષ્ટ અનામત ન હોય.



પાઠ સ્વાધ્યાય ૧૩.૨

ખાલીજગ્યા ભરો :

- (૧) ભવિષ્યના અનિશ્ચિત ખર્ચને પહોંચી વળવા નફામાંથી અલગ ફાળવેલ રકમ એટલે
(૨) ઉભુ કરવું કાનુની રીતે ફરજીયાત નથી.
(૩) અનામત નફામાંથી ઉભુ કરાય છે.
(૪) મિલકતના વેચાણથી થયેલ નફો એ નફો છે.

મોડચુલ - ૪

ઘસારો, જોગવાઈ
અને અનામતો



મોડચુલ - ૪

ધર્મારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

અનામત અને જોગવાઈ

- (૫) અનામત નાણાકીય પત્રકોમાં દર્શાવતું નથી.
- (૬) નફામુથી અલગ તારવેલ ભાગ ને કહેવાય. જે ધંધામાં ઉપયોગ કરાય.
- (૭) નફામાંથી અલગ તારવેલ ભાગ જે ધંધાની બહાર રોકવામાં આવે તેને કહેવાય.
- (૮) સિટિંગ ફંડનો રોકાણ સમય માટે હોય છે.

૧૩.૪ જોગવાઈ અને અનામત વચ્ચે તફાવત જણાવો.

ક્રમ	જોગવાઈ	અનામત
૧.	જોગવાઈ નફાનુકસાન ખાતે ઉધારીને ઉભુ કરાય છે.	અનામત નફાનુકસાન ફાળવણી ખાતે ઉધારી ઉભુ કરાય છે.
૨.	નફો હોય કે નુકસાન હોય તો પણ જોગવાઈ કરવામાં આવે છે.	નફો હોય તે વર્ષે અનામત ઉભુ કરાય છે.
૩.	જોગવાઈ કર્યા વગર ધંધાનો સાચો નફો જાકી શકાય નથી.	અનામત વગર પણ ધંધાનો સાચો નફો જાકી શકાય છે.
૪.	જોગવાઈનો ઉપયોગ ડિવિડન્ડની વહેંચણી માટે થલ શકે નથી.	અનામતનો ઉપયોગ ડિવિડન્ડની વહેંચણી માટે થઈ શકે.
૫.	ધર્મારો, નવીનીકરણ, કરવેરા ધાલખાદ જેવા હેતુ માટે જોગવાઈ કરવામાં આવે છે.	ધંધાની આર્થિક પરિસ્થિતિ સંધર બનાવવા માટે ઉભુ કરવામાં આવે છે.
૬.	જોગવાઈ કાનુની રીતે અનિવાર્ય છે.	અનામત કાનુની રીતે અનિવાર્ય નથી.
૭.	મિલકતમાંથી બાદ કરીને અથવા બાજુ 'જોગવાઈ'ના શીર્ષક નીચે અલગ છે.	મુડીદેવાં મુડીદેવા બાજુ 'અનામત અને વધારા'ના શીર્ષક નીચે દર્શાવાય છે.
૮.	ખાસ હેતુ માટે કરેલ નાણાકીય વ્યવસ્થાને જોગવાઈ કહે છે.	સામાન્ય હેતુ માટે જે અનામત ઉભુ કરવામાં આવે તેને અનામત કહે છે.
૯.	જોગવાઈ જે હેતુ માટે કરવામાં આવી હોય તે માટે જ તેનો ઉપયોગ થાય છે.	અનામતનો ઉપયોગ કોઈપણ હેતુ માટે કરી શકાય છે.

અનામત અને જોગાવાઈ

૧૦.	જોગવાઈનો હેતુ ચોકકસ ખોટ માંડી વળવા કે કરવેરાની ચુકવણી માટે હોય છે.	આનો હેતુ આર્થિક સધ્યરતા છે.
૧૧.	ભવિષ્યની જવાબદારીને પહોંચી વળવા જોગવાઈ કરવામાં આવે છે.	અનામતના કારણે ચાલુ મૂડીમાં વધારો થાય છે.
૧૨.	જોગવાઈની રકમનો આધાર જવાબદારી પર રહેલો છે.	અનામતની રકમનો આધાર સંચાલન મંડળ પર રહેલો છે.
૧૩.	જોગવાઈ મિલકતના ઘટાડા કે ચોકકસ જવાબદારીની ચુકવણીના કારણે થાય છે.	અનામત એ વધારાનો નફો છે. (ડા.ટ. શેર પ્રીમિયમ કે મૂડી પરત અનામત)
૧૪.	જોગવાઈની રકમ ચોકકસ હોય છે.	અનામતની રકમ અચોકકસ હોય છે.



पाठ स्वाध्याय १३.३

૧. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.
 ૨. નિશ્ચિત નુકસાન ને પહોંચી વળવા માટે જોગવાઈ કરવામાં આવે છે.
 ૩. બધા અનામતો પાકા સરવેયાની જવાબદારી બાજુએ દર્શાવવામાં આવે છે.
 ૪. મૂડી અનામતને નફા તરીકે વહેંચી શકાય.
 ૫. અનામતનો મુખ્ય હેતુ ધંધાની આર્થિક સ્થિતિ સધર કરવાનો હોય છે.
 ૬. જોગવાઈની રકમ ચોકકસ હોય છે, તેથી દર વર્ષે ચોકકસ રકમ ફાળવવામાં આવે છે.

૨. બહુવિકલ્પી પ્રશ્નો :

૧. નીચેનામાંથી કઈ જોગવાઈ નથી.

- (a) ઘાલખાદ અનામત (b) વટાવ અનામતની જોગવાઈ

- (c) ડિવિડન્ડ સમતુલા ભંડોળ (d) ઘસારાની જોગવાઈ

- (૨) નીચેમાંથી ક્યું અનામત નથી.

- (a) સામાન્ય અનામત (b) ડિવિડન્ડ સમતુલ્ય ભંડોળ

- (c) ગુમ અનામત (d) ઘાલખાદ અનામત

મોડયુલ - ૪

ધસારો, જોગવાઈ
અને અનામતો



નોંધ

અનામત અને જોગવાઈ

(૩) નીચેનામાંથી કયું અનામત કોઈ ચોક્કસ હેતુ માટે નહીં પરંતુ ભવિષ્યની અચોક્કસ જવાબદારીને પહોંચી વળવા માટે ઉભુ કરાય છે.

- | | |
|-------------------|----------------|
| (a) સામાન્ય અનામત | (b) મૂડી અનામત |
| (c) વિશેષ અનામત | (d) ગુમ અનામત |

(૪) નીચેમાંથી કયું અનામત બોનસ શેર બહાર પાડવા વપરાય છે ?

- | | |
|-------------------|------------------|
| (a) સામાન્ય અનામત | (b) મૂડી અનામત |
| (c) ગુમ અનામત | (d) સેક્રિંગ ફંડ |

(૫) નીચેમાંથી કયું અનામત નફાનુક્સાન ફાળવણી ખાતેથી ઉભુ કરાય છે ?

- | | |
|------------------|----------------------|
| (a) ધાલખાય અનામત | (b) વટાવ અનામત ભંડોળ |
| (c) કરવેરા અનામત | (d) સામાન્ય અનામત |



તમે આટલું શીખ્યા :

ભવિષ્યના આકસ્મિક નુકસાન કે ખર્ચને પહોંચી વળવા જે રકમ અલગથી ફાળવવામાં આવે છે તેને જોગવાઈ કહે છે. દા.ત. શકમંદ લેણા અનામતની જોગવાઈ, વટાવ અનામતની જોગવાઈ, ધસારાની જોગવાઈ. જોગવાઈ પાકા સરવૈયામાં જવાબદારી બાજુએ દર્શાવવામાં આવે છે.

ભવિષ્યના અચોક્કસ નુકસાનને પહોંચી વળવા માટે નફામાંથી જે રકમ અલગ ફાળવવામાં આવે છે તેને અનામત કહેવાય છે. દા.ત. સામાન્ય અનામત, ડિવિડન્ડ સમતુલ્ય ભંડોળ, સામાન્ય અનામત એ નહીં વહેંચાયેલો નફો છે. જો નફો ન હોય તો અનામત પણ રાખી શકાય નહીં. અનામત ધંધાની આર્થિક સ્થિતિ સંધર કરવા માટે હોય છે. મૂડી અનામત ભૂડી નફામાંથી ઉભુ કરાય છે. દા.ત. મૂડી નફો, શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે પ્રીમિયમ, ધંધા ચાલુ કરતા પહેલાનો નફો વિગેરે. મૂડી અનામતનો ડિવિડન્ડ વહેંચવા માટે ઉપયોગ કરાય નહીં. ગુમ અનામતને પાકા સરવૈયામાં બતાવાય નહીં મહેસુલી અનામતને ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય.



પા�્યાંત સ્વાધ્યાય :

૧. અનામત ફંડ એટલે શું ?
૨. જોગવાઈ એટલે શું ?
૩. અનામતનો અર્થસમજાવો.
૪. જોગવાઈ કરવાના હેતુઓ જણાવો.
૫. શા માટે સંસ્થા અનામત રાખે છે ? ટૂંકમાં સમજાવો.
૬. મૂડી અનામત કયા હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે ?
૭. અનામત અને જોગવાઈ વચ્ચેનો તફાવત જણાવો. (કોઈપણ ચાર મુદા)
૮. ટૂંકમાં જણાવો.
 - (i) ગુમ અનામત
 - (ii) મહેસૂલી અનામત
 - (iii) વિશેષ અનામત
 - (iv) સિંકિંગ ફંડ



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

- ૧૩.૨ (૧) નુકસાન / ખર્ચ (૨) અચોકકસ (૩) નફાનુકસાન (૪) શેર હોલ્ડર / માલિકો
 (૫) જવાબદારી
- ૧૩.૩ (૧) અનામત (૨) સામાન્ય અનામત (૩) મૂડી, મૂડી (૪) મૂડી
 (૫) ગુમ રજાટ અનામત રજાટ અનામત ફંડ રટ્ટે ચોકકસ
- ૧૩.૪ (i) સાચું (ii) સાચું (iii) ખોટું (iv) સાચું (v) સાચું
 II (I) c (ii) d (iii) a (iv) b (v) d

તમારા માટે કાર્ય :

તમારા વાલી તેમની આવકમાંથી કેટલીક રકમ અલગ રાખે છે. તે વિશે જાણો. તેમણે છેલ્લા ત મહિનામાં કયા કયા હેતુઓ માટે જોગવાઈ કરી છે તેની યાદી બનાવો. તેથી તમને જોગવાઈ અને અનામતની યોગ્ય સમજા પડશે.



નોંધ

મોડયુલ - ૫

નાણાકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

મોડયુલ - ૫

મહત્તમ ગુણ

૨૦

અભ્યાસના કલાકો

૪૮

નાણાકીય પત્રકો તૈયાર કરવા

આ મોડયુલ વિધાથીઓને નાણાકીય પત્રકોકે જેને છિસાબી કર્યામાં અંતિમ પરીક્ષામ સ્વરૂપ માનવામાં આવે છે તેનો અર્થ શીખવશે અને તેમને તૈયાર કરવાની જરૂરીયાત સમજાવશે. તેઓ નાણાકીય પત્રકો અને પાકુસરવૈયુ તૈયાર કરવાના પગથિયા શીખશે. વિધાથીઓ વધારાની માહિતીના સ્વરૂપમાં આપેલ હવાલાની વિવિધ વસ્તુઓની ગણતરી કરતાં પણ શીખશે.

પ્રકરણ-૧૪ : નાણાકીય પત્રકો (હવાલા વિના)

પ્રકરણ-૧૫ : નાણાકીય પત્રકો (હવાલા સાથે)



નોંધ

૧૪

નાણાંકીય પત્રકો (ઉવાળા વગાર)

પાછળના પ્રકરણમાં આપણે નામાના જુદાજુદા ચોપડાઓમાં ધંધાકીય વ્યવહારોની નોંધ તેમજ ખાતાવહીમાં તેની ખતવણી કરતાં શીખ્યા. તમે ખાતાની બાકી શોધતા અને કાચું સરવેયું બનાવતા પણ શીખ્યી ગયા છો. નામાનો એક મૂળ ઉદ્દેશ્ય ધંધાના એક ચોકકસ સમયનો નફો અને તુકશાન જાણવા અને એક ચોકકસ તારીખે તેની નાણાંકીય સ્થિતિ જાણવાનો છે.

આ ઉદ્દેશ્ય માટે બધાં જ ધંધાકીય એકમો દરેક વર્ષે આવક પત્રક અને સ્થિતિ પત્રક તૈયાર કરે છે. આવક પત્રકને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે જે નીચે મુજબ છે

૧. વેપાર ખાતું અને

૨. નફા તુકશાન ખાતું

આવક પત્રક ધંધાના ચોકકસ સમયગાળા દરમિયાનનો નફો જાણવા અથવા તે જ સમયગાળા દરમિયાનની ખોટ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે, સ્થિતિ પત્રકને પાંકું સરવેયું પણ કહેવાય છે. જે એક ચોકકસ તારીખે ધંધાની નાણાંકીય સ્થિતિ જાણવા માટે તૈયાર કરાય છે.


આ પ્રકરણમાં તમે શીખશો કે એક નાણાંકીય વર્ષનો નફો જાણવા માટે નાણાંકીય પત્રક કેવી રીતે તૈયાર થશે તેમજ એક ચોકકસ તારીખે તેની નાણાંકીય સ્થિતિ કેવી રીતે જાણી શકાશે.



હેતુઓ :

આ પ્રકરણનો અભ્યાસ કર્યો પદ્ધતી તમે

- નાણાંકીય પત્રકનો અર્થ જણાવી શકશો.
- નાણાંકીય પત્રકના ઉદ્દેશો જણાવી શકશો.
- નાણાંકીય પત્રકને વેપાર ખાતું, નફા તુકશાન ખાતું અને પાકા સરવેયામાં વર્ગીકૃત કરી શકશો.
- વેપાર ખાતું, નફા તુકશાન ખાતું અને પાકા સરવેયું તૈયાર કરી શકશો.



મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા વગર)

૧૪.૧ નાણાંકીય પત્રકનો અર્� :

જેવી રીતે એક વિદ્યાર્થીને તેની વાર્ષિક પરીક્ષાના પરિણામની કાગડોએ રાહ જોવે છે, તેવી જ રીતે દરેક વેપારી એક નિશ્ચિત નાણાંકીય વર્ષમાં ધ્યાનું પરિણામ જાણવાની ખૂબ જ આતુરતાથી રાહ જોવે છે. વેપારી એક ચોકકસ તારીખે તેના ધ્યાનની નાણાંકીય સ્થિતિ જાણવાની હિચા રાખે છે. આ તારીખ સામાન્ય રીતે નાણાંકીય વર્ષની અંતિમ તારીખ હોય છે. જેના માટે ખાતા તૈયાર કર્યા હોય છે. ધ્યાનની નાણાંકીય સ્થિતિ અને ધ્યાના પરિણામ જાણવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે. તેને નાણાંકીય પત્રક કહેવાય છે. પત્રક કે જે કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે, તેને વેપાર ખાતું કહેવાય છે. ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને નફા નુકશાન ખાતું કહેવાય છે. વેપાર ખાતું અને નફા નુકશાન ખાતાને ભેગા કરીને જે પત્રક તૈયાર થાય તેને આવક પત્રક કહેવાય છે. ધ્યાનની નાણાંકીય સ્થિતિ જાણવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પાંકું સરવૈયું અથવા સ્થિતિ પત્રક કહેવાય છે.

૧૪.૨ નાણાંકીય પત્રકના ઉદ્દેશો :

નાણાંકીય પત્રક તૈયાર કરવાના ઉદ્દેશ્ય નીચે મુજબ છે.

- ધ્યાકીય પ્રવૃત્તિઓના પરિણામ જાણવા : નાણાંકીય પત્રકો તૈયાર કરવાનો એક મુખ્ય ઉદ્દેશ્ય આવક જાણવા માટેનો છે. નાણાંકીય પત્રક એક ચોકકસ નાણાંકીય વર્ષ દરમેયાન થનાર નફા કે ખોટ વિશેની સૂચના આપે છે.
- ધ્યાનની નાણાંકીય સ્થિતિ જાણવા : પાંકું સરવૈયું ધ્યાનની એક ચોકકસ તારીખે તેની નાણાંકીય સ્થિતિ વિષેની માહિતી આપે છે.
- ધોળ નિર્ણય લેવા : નાણાંકીય પત્રક ધ્યાના નિર્ણયો લેવામાં ખૂબ જ મદદરૂપ બને છે. નાણાંકીય પત્રકોની માહિતીના આધારે ભવિષ્ય માટેના ધોળ અનુમાન કરી શકાય છે.
- વ્યવસ્થાપકોના દેખાવનો નિર્ણય કરવા : કોઈ ધ્યાકીય એકમના સંસાધનોનો ઉપયોગ અને વ્યવસ્થાપકોના દેખાવ અંગે માહિતી મેળવવામાં નાણાંકીય પત્રક સહાયરૂપ બને છે.
- ધ્યાનની રોકડ સ્થિતિ જાણવા : ધ્યાનમાં લેણાદારો, સખ્ખાયરો વગેરેને રોકડ ચૂકવવા અંગેનો નિર્ણય કરવામાં નાણાંકીય પત્રકો દ્વારા દશાવવામાં આવતી રોકડ સ્થિતિ મદદરૂપ બને છે.

૧૪.૩ નાણાંકીય પત્રકોનું વર્ગીકરણ :

I આવક પત્રક

- વેપાર ખાતું અને

નાણાંકીય પત્રકો (હવાલા વગાર)

(ii) નફો નુકશાન ખાતું

II સ્થિતિ પત્રક અથવા પાકું સરવૈયું

આવક પત્રક :

આવક પત્રક ધંધાની કોઈ એક ચોકકસ તારીખે નફો કે ખોટ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. આવક પત્રક નીચે મુજબના બે ભાગમાં તૈયાર થાય છે.

(a) વેપાર ખાતું અને

(b) નફો નુકશાન ખાતું

(a) વેપાર ખાતું : કોઈ એક ચોકકસ સમય માટેનો ધંધાનો કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે. આ ખાતું તફોર્મમાં તૈયાર કરવામાં આવે છે. વેપાર ખાતાનો નમૂનો નીચે મુજબ છે.

મે. xyz નું તા..... ના રોજ

પુરા થતા વર્ષનું વેપાર ખાતું

ઉધાર જમા

વિગત	રકમ્રૂ.	વિગત	રકમ રૂ.
શરૂનો સ્ટોક	વેચાણ
ખરીદી		(i) રોકડ વેચાણ
(i) રોકડ ખરીદી	(ii) ઉધાર વેચાણ
(ii) ઉધાર ખરીદી	કુલ વેચાણ
કુલ ખરીદી	બાદ : વેચાણ પરત
બાદ : ખરીદ પરત	ચોખ્યું વેચાણ
ચોખ્યી ખરીદી	આખરનો સ્ટોક
પ્રત્યક્ષ ખર્ચ:			
મજૂરી	કાચી ખોટ (નફો નુકશાન ખાતે લઈ ગયા)
પૂરજકાત		
આવક માલ ગાડાભાડું		
બળતણ અને વીજળી		
કારખાનાનું ભાડું		
કાચો નફો (નફો નુકશાન ખાતે લઈ ગયા)

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો તૈયાર કરવા



નોંધ

મોડયુલ - ૫

નાણાંકીય પત્રક
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા વગ)

ઉદાહરણ ૧ :-

મેસર્સ લક્ષ્મી એન્ડ સન્સની ખાતાવહીની નીચે આપેલ બાકી પરથી ૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજ
પૂરા થતા વર્ષનું વેપાર ખાતું તૈયાર કરો.

વિગત	રકમ રૂ.
શરૂનો સ્ટોક	6500
ખરીદી ,	45000
વેચાણ	72000
ખરીદ પરત	500
વેચાણ પરત	1500
માલ વહન ખર્ચ	1200
મજૂરી ,	4800
બળતાણ અને વીજળી	3200
આખરનો સ્ટોક	8000

ઉકેલ : મેસર્સ લક્ષ્મી એન્ડ સન્સનું તા. ૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું
ઉધાર જમા

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
શરૂનો સ્ટોક	6500	વેચાણ	72000
ખરીદી	45000	વેચાણ પરત	1500
ખરીદી પરત	44500	આખરનો સ્ટોક	70500
માલ વહન ખર્ચ	1200		8000
મજૂરી	4800		
બળતાણ અને વીજળી	3200		
કાચો નફો (નફો તુકશાન ખાતે લઈ ગયા)	18300		
			78500
	70500		



၁၄

ଓଡାହରଣ : ୨

મેસર્સ ભાગું બ્રધર્સની ખાતાવહી પરથી નીચેની બાકી મળી તે પરથી ૩૧ મી માર્ચ
૨૦૧૨ ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું તૈયાર કરો.

વિગત	રકમ
૧-૪-૨૦૧૧નો શરૂનો સ્ટોક	32000
ખરોડી	165000
નૂર	4000
વીજળી	6500
કસ્ટમ ડ્યુટી	5500
વેચાણ	80000
તૃણ મી માચ રૂઠી ર ના રોજ આપર સ્ટોક	30000

ઉકેલ: મેસર્સ ભાનુ બ્રધર્સનું તા. ૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું

ଓনলাইন

વિગત	રકમ્ય.	વિગત	રકમ્ય.
શરૂઆતનો સ્ટોક	32000	વેચાડા	80000
ખરોદા	165000	આખરનો સ્ટોક	30000
નૂર	4000	કાચી ખોટ (નફા નુકશાન	103000
વીજળી	6500	ખાતે લઈ ગયા)	
કસ્ટમ ડ્ર્પ્રિટી	5500		
	213000		213000



पाठ स्वाध्याय १४.१

I. યોગ્ય શરૂઆત વડે ખાલી જગ્યા પૂરો.

૧. માલ વહન ખર્ચને = _____ ખતામાં ઉધાર બાજુ લખાય છે.

૨. કુલ વેચાણ વેચાણ પરત = _____

મોડચુલ - ૫

નાણાંકીય પત્રક
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા વગ)

૩. મજૂરીને = _____ ખાતામાં ઉધાર બાજુ લખાય છે.
 ૪. આખર સ્ટોક વેપાર ખાતાની = _____ બાજુ દર્શાવાય છે.
 ૫. કુલ ખરીદી ખરીદ પરત = _____
- (b) નફા નુકશાન ખાતું : વેપાર ખાતું તૈયાર કરી કાચો નફો કે કાચી ખોટ શોધી ત્યારબાદ નાણાંકીય વર્ષ દરમિયાનનો ધંધાનો ચોખ્યો નફો/ચોખ્યી ખોટ શોધવા માટે નફા નુકશાન ખાતું તૈયાર કરવામાં આવે છે. આ ખાતું પણ તફોમંમાં તૈયાર કરવામાં આવે છે. નફા નુકશાન ખાતાનો નમૂનો નીચે મુજબ છે.

મેસસ ABC લિ. નું તા: _____ ના રોજ

પુરા થતા વર્ષનું નફા નુકશાન ખાતું

ઉધાર

જમા

વિગત	રકમ્ય.	વિગત	રકમ્ય.
કાચી ખોટ વેપાર ખાતેથી લાવ્યા	ચોખ્યો નફો વેપાર ખાતેથી લાવ્યા
પગાર	મળેલ કમિશાન
ઓફિસનું ભાડું	લેણદારો પાસેથી મળેલ વટાવ
પ્રેન્ટિંગ અને સ્ટેશનરી	મળેલ ભાડું
વીમા પ્રીમીયમ	મળેલ વ્યાજ
ચૂકવેલ વ્યાજ	ચોખ્યી ખોટ મૂડી ખાતે
જૂર	લઈ ગયા. (બાકી રકમ)	
જાવક માલ ગાડા ભાડું		
ગ્રાહકને આપેલ વટાવ		
પોસ્ટેજ ખચ		
ટેલિફોન ખર્ચ		
ઓફિસ ખર્ચ		
વેચાણ ખર્ચ		
ચોખ્યો નફો મૂડી ખાત		
લઈ ગયા. (બાકી રકમ)			

નાણાંકીય પત્રકો (હવાલા વગાર)

ઉદાહરણ : ૩

મે. સાહિલ બ્રધસર્ની નીચે આપેલ માહિતી પરથી ૩૧-૩-૨૦૧૩ ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકશાન ખાતું તૈયાર કરો.

વિગત	રકમ રૂ.
કાચો નફો	97000
ગ્રાહકોને આપેલ વટાવ	2000
પ્રાન્ટીંગ અને સ્ટેશનરી	2000
ઓફિસનું ભાડું	5000
મરામત ખર્ચ	2400
વીમા ગ્રીમીયમ	5100
ટેલિફોન ખર્ચ	1000
લેણદારો પાસેથી મળેલ વટાવ	3000
વર્ષ દરમ્યાન મળેલ વ્યાજ	5000

ઉકેલ : મે. સાહિલ બ્રધસર્નું તા. ૩૧ મી માય ૨૦૧૨ ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકશાન ખાતું

ઉધાર

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
ગ્રાહકોને આપેલ વટાવ	2000	કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા	97000
પ્રાન્ટીંગ અને સ્ટેશનરી	2000	લેણદારો પાસેથી મળેલ વટાવ	3000
ઓફિસનું ભાડું	5000	વર્ષ દરમ્યાન મળેલ વ્યાજ	5000
મરામત ખર્ચ	2400		
વીમા ગ્રીમીયમ	5100		
ટેલિફોન ખર્ચ	1000		
ચોખ્યો નફો મૂડી ખાતે	87500		
લઈ ગયા. (બાકી રકમ)			

ઉદાહરણ : ૪

મે. સાર્થક ટ્રેડર્સ નીચે આપેલ માહિતી પરથી ૩૧-૩-૨૦૧૨ ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકશાન ખાતું તૈયાર કરો.

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો તૈયાર કરવા



નોંધ

મોડયુલ - ૫

નાણાંકીય પત્રક
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા વગ)

વિગત	રકમરૂ.
કાચો નફો	43000
ગ્રાહકોને આપેલ વટાવ	7000
પગાર	45000
લોન પર ચૂકવેલ વ્યાજ	13000
પોસ્ટેજ ખચ	2400
લેણદારો પાસેથી મળેલ વટાવ	6000
મળેલ કમિશન	1000
વેચાણ ખચ	10000

વિગત	રકમરૂ.	વિગત	રકમરૂ.
ગ્રાહકોને આપેલ વટાવ	7000	કાચો નફો વેપાર ખાતે લાવ્યા,	43000
પગાર,	45000	લેણદારો પાસેથી મળેલ વટાવ	6000
લોન પર ચૂકવેલ વ્યાજ	13000	મળેલ કમિશન	1000
પોસ્ટેજ ખચ	2400	ચોખ્ખી ખોટ મુડી ખાતે લઈ ગયા	27400
	77400		77400



પાઠ સ્વાધ્યાય ૧૪.૨

નીચેના વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.

૧. આવક માલ ગાડા ભાડું ને નફા નુકશાન ખાતામાં દર્શાવાય છે.
૨. ટેલેફોન ખર્ચને વેપાર ખાતામાં દર્શાવાય છે.
૩. જાવક માલ ગાડા ભાડું ને નફા નુકશાન ખાતામાં દર્શાવાય છે.
૪. કાચા નફા ને નફા નુકશાન ખાતેથી વેપાર ખાતે લઈ જવાય છે.

વેપાર ખાતું અને નફા નુકશાન ખાતા વચ્ચેનો તફાવત :-

વેપાર ખાતા અને નફા નુકશાન ખાતા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે.

ક્રમ નં.	વેપાર ખાતું	નફા નુકશાન ખાતું
૧.	આ ખાતું એક નાણાંકીય વર્ષના કાચો નફો અથવા કાચી ખોટ દર્શાવે છે.	આ ખાતું એક નાણાંકીય વર્ષનો ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ દર્શાવે છે.
૨.	ધંધાના બધા જ પ્રત્યક્ષ ખર્ચ આ ખાતાની ઉધાર બાજુ લખાય છે.	ધંધાના બધા જ અપ્રત્યક્ષ ખર્ચ આ ખાતાની ઉધાર બાજુ લખાય છે.
૩.	ધંધાની બધી જ પ્રત્યક્ષ ઉપજ આ ખાતાની જમા બાજુ લખાય છે.	ધંધાની બધી જ અપ્રત્યક્ષ ઉપજ આ ખાતાની જમા બાજુ લખાય છે.
૪.	આ ખાતાની બાકી : કાચો નફો અથવા કાચી ખોટ નફા નુકશાન ખાતે લઈ જવાય છે.	આ ખાતાની બાકી : ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ ધંધાના માલિકના મૂડી ખાતે લઈ જવાય છે.

II. સ્થિતિ પત્રક અથવા પાકું સરવૈયું :-

કોઈ એક ચોકકસ તારીખે ધંધાની નાણાંકીય સ્થિતિ જાળવા માટે સ્થિતિ પત્રક અથવા પાકું સરવૈયું તૈયાર કરાય છે. સામાન્ય રીતે નાણાંકીય વર્ષની અંતિમ તારીખે આ પત્રક તૈયાર કરાય છે. આ પત્રક વેપાર ખાતું અને નફા નુકશાન ખાતું તૈયાર કર્યા પછી તૈયાર કરાય છે.

પાકા સરવૈયાની બે બાજુ હોય છે. ડાબા હાથવાળી બાજુને જવાબદારી બાજુ તરીકે અને જમણા હાથવાળી બાજુને મિલકત બાજુ તરીકે ઓળખાય છે.

જવાબદારી બાજુનો ઉપયોગ ધંધાની જવાબદારી દર્શાવવા માટે થાય છે. જવાબદારીમાં ધંધાની આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારીનો સમાવેશ થાય છે. આંતરિક જવાબદારી એટલે ધંધા દ્વારા તેના માલિકને કરવામાં આવતી ચૂકવણી જ્યારે બાહ્ય જવાબદારી એટલે બહારની વક્તિએને કરવામાં આવતી ચૂકવણી.

આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારીનું વર્ગીકરણ.

આંતરિક જવાબદારી	બાહ્ય જવાબદારી
૧. મૂડી	લેણદારો
૨. ધંધાનો નફો	બેંકલોન અને અન્ય લોન
૩. ધંધાની ઉપજ	ચૂકવવાના બાકી ખર્ચ



મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા વગર)

મિલકત બાજુનો ઉપયોગ ધ્યાની મિલકતો દર્શાવવા માટે થાય છે. મિલકતમાં ધ્યાની ચાલુ મિલકત અને સ્થિર મિલકતનો સમાવેશ થાય છે.

મિલકત નું વર્ગીકરણ.

સ્થિર મિલકત	ચાલુ મિલકત
૧. જમીન અને મકાન	હાથ પર રોકડ
૨. પ્લાન્ટ અને મશીનરી	બંકમાં રોકડ
૩. ફન્નિયર	માલનો સ્ટોક
૪. મોટર વાહન વગેરે	દેવાદારો વગેરે

પાંકું સરવૈયું તૈયાર કરવાના ઉદ્દેશ્ય :

નીચેના ઉદ્દેશો સિધ્ય કરવા માટે પાંકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે.

- (i) ધ્યાની નાણાંકીય સ્થિતિ જાળવા માટે.
- (ii) ધ્યાની આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી જાળવા માટે જેથી તેની ચૂકવણી સમયસર કરવાની વ્યવસ્થા કરી શકાય.
- (iii) સ્થિર મિલકત અને ચાલુ મિલકતની સ્થિતિ જાળવા માટે
- (iv) વર્તમાન નાણાંકીય સ્થિતિના આધારે ભવિષ્યની યોજનાઓનું આયોજન કરવા માટે.

પાકા સરવૈયાનો નમૂનો.

મે. _____ નું તા. _____ ના રોજનું પાંકું સરવૈયું.

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
બંક ઓવરડ્રાઇટ	હાથ પર રોકડ
લેઝદારો	બંકમાં રોકડ
લોન/બંક લોન	દેવાદારો
મૂડી	સ્ટોક
ઉમેરો : ચોખ્યો નફો	રોકાણ
બાદ કરો : ચોખ્યી ખોટ	ફન્નિયર
બાદ કરો : ઉપાડ	મોટર વાહન
પ્લાન્ટ અને મશીનરી
જમીન અને મકાન

નાણાંકીય પત્રકો (હવાલા વગાર)

ઉદાહરણ : ૫

નીચેની માહિતી પરથી મિ. રોશનલાલનું તા. ત૧ માર્ચ ૨૦૧૨ ના રોજનું પાકું સરવૈયું તૈયાર કરો.

વિગત	રકમ રૂ.
મૂડી	50000
ફન્સીચર	15000
દેવાદારો	25000
લેણદારો	30000
ખાન્ટ અને મશીનરી	58000
રોકાણ	5000
હાથ પર રોકડ	1000
બેંકમાં રોકડ	1000
આખરનો સ્ટોક	10000
બેંક ઓવરાફાઈટ	8000
બેંક લોન	20000
ચોખ્ખો નફો	10000
ઉપાડ	3000

ઉકેલ : મિ. રોશનલાલનું તા. તા. ત૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજનું પાકું સરવૈયું

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
બેંક ઓવરાફાઈટ	8000	હાથ પર રોકડ	1000
લેણદારો	30000	બેંકમાં રોકડ	1000
બેંક લોન	20000	દેવાદારો	25000
મૂડી	50000	સ્ટોક	10000
ઉમેરો : ચોખ્ખો નફો	10000	રોકાણ	5000
	60000	ફન્સીચર	15000
બાદ : ઉપાડ	3000	ખાન્ટ અને મશીનરી	58000
	57000		115000
	115000		

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા વગ)

ઉદાહરણ : ૬

નીચે આપેલ માહિતી પરથી મિ. અરુણકુમારનું તા. ૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજનું પાકું સરવૈયું તૈયાર કરો.

વિગત	રકમ રૂ.
લેણદારો	30000
દેવાદારો	35000
હાથ પર રોકડ	24500
બંકમાં રોકડ	27500
સ્ટોક	22500
ફન્ચિયર	25000
લોન	50000
ખાનટ અને મશીનરી	32500
જમીન અને મકાન	52000
મૂડી	137000
ચોખ્ખો નફો	12000
ઉપાડ	10000

ઉકેલ : મિ. અરુણકુમારનું તા. ૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજનું પાકું સરવૈયું

જવાબદારી		રકમ રૂ.	મિલકત	રકમ રૂ.	
લેણદારો		30000	હાથ પર રોકડ	24500	
લોન		50000	બંકમાં રોકડ	27500	
મૂડી	137000		દેવાદારો	35000	
ઉમેરો : ચોખ્ખો નફો	12000		સ્ટોક	22500	
		149000		ફન્ચિયર	25000
બાદ : ઉપાડ	10000	139000	ખાનટ અને મશીનરી	32500	
			જમીન અને મકાન	52000	
				219000	



ખાલી જગ્યા પૂરો.

૧. મિલકતને પાકા સરવેયાની ----- બાજુ દર્શાવાય છે.
૨. મૂડીને ----- ની જવાબદારી બાજુ દર્શાવાય છે.
૩. પાકા સરવેયાની મિલકત બાજુ અને જવાબદારી બાજુનો સરવાળો હંમેશા ----- થાય છે.
૪. સ્ટોક એ ----- મિલકતનું એક ઉદાહરણ છે.
૫. ફનીયર એ ----- મિલકતનું એક ઉદાહરણ છે.

૩ : નીચે દર્શાવેલ મિલકતોનું ચાલુ મિલકત અને સ્થિર મિલકતમાં વર્ગીકરણ કરો.

મિલકત મિલકતનો પ્રકાર (સ્થિર અથવા ચાલુ)

૧. દેવાદારો
૨. જમીન અને મકાન
૩. ઘાન્ટ અને મશીનરી
૪. બેંકમાં રોકડ
૫. મોટર વાહન
૬. હાથ પર રોકડ

ઉદાહરણ : ૭

મે. પાવન સેલ્સની તા. ૩૧-૩-૨૦૧૨ ની નીચાની માહિતી/બાકી પરથી વેપાર ખાતું, નાના નુકશાન ખાતું અને તે તારીખનું પાકું સરવેયું તૈયાર કરો.

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
ઉપાડ	8000	વેચાણ	258000
મૂડી ,	48000	વેચાણ પરત	2000
ધંધાનો લેણદારો	80000	ખરીદ પરત	2200
ધંધાનો દેવાદારો	126000	ઓફિસનો પગાર	18000
મળવાપાત્ર બાકી બિલ	10000	મજૂરી	8000
શરૂઆતનો સ્ટોક	90000	કમિશન	9000
ફિક્ચર્સ અને ફીટિંગ્સ	13000	ભાડું , ,	4400
હાથ પર રોકડ	2000	વેપારના ખર્ચ	5000
મશીનરી	24800	મળેલ વટાવ	8000
બેંક ઓવરડ્રાફ્ટ	10000	ચૂકવવાપાત્ર બાકી બિલ	14000
ખરીદી	100000		



મોડયુલ - ૫

નાણાંકીય પત્રક
તેવાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા વગર)

તા. ૩૧-૩-૨૦૧૨ નો આખર સ્ટોક રૂ. 1,04,000 હતો.

ઉકેલ : મે. પાવન સેલ્સનું તા. ૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકશાન ખાતું

ઉધાર

જમા

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
શરૂઆતનો સ્ટોક	90000	વેચાણ	258000
ખરોદી	100000	બાદ : વેચાણ પરત	2000 256000
બાદ : ખરોદ પરત 2200	97800	આખરનો સ્ટોક	104000
મજૂરી	8000		
કાચોનફો ન.નુ. ખાતેલઈગયા.	164200		
	360000		360000
ઓફિસ ખર્ચ	18000	કાચો નફો વેપાર	164200
કમિશન	9000	મળેલ વટાવ	8000
વેપારના ખર્ચ	5000		
ભાડું	4400		
ચોખ્ખોનફો મૂડી ખાતેલઈગયા	135800		
	172200		172200

મે. પાવન સેલ્સનું તા. ૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજનું પાકું સરવેયું

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
ચૂકવવાપાત્ર બાકી બિલ	14000	હાથ પર રોકડ	2000
ધંધાના લેણદારો	80000	મળવવાપાત્ર બાકી બિલ	10000
બેંક ઓવરડ્રાફ્ટ	10000	ધંધાના દેવાદારો	126000
મૂડી	48000	સ્ટોક	104000
બાદ કરો : ઉપાડ	8000	ફિક્ચર્સ અને ફીટીંગ્સ	13000
	40000	ઉમેરો : ચોખ્ખો નફો 135800	175000
	279800		279800



I. નીચેના વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.

૧. પાકું સરવૈયું ધંધાના આખા વર્ષની નાણાંકીય સ્થિતિ દર્શાવે છે.
૨. નફા નુકશાન ખાતું અને પાકું સરવૈયું બંને સ્થિતિ પત્રક છે.
૩. પાકું સરવૈયાની મિલકત બાજુ ધંધાની ફક્ત સ્થિર મિલકતો દર્શાવે છે.
૪. પાકું સરવૈયાની જવાબદારી બાજુ ધંધાની આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી બંને દર્શાવે છે.

II. વૈકલ્પિક પ્રશ્નો.

૧. નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાનો કાચો નફો જાણવા માટે તૈયાર કરવામાં આવે છે.

- (A) નફા નુકશાન ખાતું (B) વેપાર ખાતું
 (C) પાકું સરવૈયું (D) ઉપરનામાંથી એક પણ નાથું

૨. નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાની મિલકત અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે.

- (A) પાકું સરવૈયું (B) નફા નુકશાન ખાતું
 (C) વેપાર ખાતું (D) ઉપરનામાંથી એક પણ નાથું

૩. કાચો નફો એ બંને વચ્ચેનો તફાવત છે

- (A) કુલ મિલકત અને કુલ જવાબદારી
 (B) વેચાણ અને બધા જ ખર્ચ
 (C) વેચાણ અને અપ્રત્યક્ષ ખર્ચ
 (D) વેચાણ અને વેચેલ માલની કિંમત

૪. નીચેનામાંથી કયો અપ્રત્યક્ષ ખર્ચ નથી છુ

- (A) નૂર (B) આપેલ વટાવ
 (C) ચૂકવેલ ભાડું (D) ચૂકવેલ કમિશન



મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

૫. નીચેનામાંથી કોઈ ચાલુ મિલકત છે જુ

(A) જમીન

(B) મકાન

(C) બેંકમાં રોકડ

(D) મશીનરી



તમે આટલું શીખ્યા :

- નાણાંકીય પત્રક કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાનનો ધંધાનો કાચો નજો અને ચોખ્યો નજો જાણવા અને કોઈ ચોક્કસ તારીખ, સામાન્ય રીતે નાણાંકીય વર્ષની અંતિમ તારીખની મિલકત અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે.
- વેપાર ખાતું ધંધાના ચોક્કસ સમયગાળાનો કાચો નજો અથવા કાચી ખોટ જાણવા અને નજો નુકશાન ખાતું ધંધાના ચોક્કસ સમયગાળાનો ચોખ્યો નજો અને ચોખ્યી ખોટ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. વેપાર ખાતું અને નજો નુકશાન ખાતું એક સાથે તૈયાર કરવામાં આવે તેને આવક પત્રક કહેવાય છે.
- કોઈ ચોક્કસ તારીખે ધંધાની મિલકતો અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે પાકું સરવેયું તૈયાર કરવામાં આવે છે. તેને સ્થિતિ પત્રક પણ કહેવાય છે.
- નાણાંકીય પત્રકો ધંધાકીય પ્રવૃત્તિઓનું પરિણામ જાણવા, ધંધાની નાણાંકીય સ્થિતિ જાણવા, નિઃશ્વર લેવામાં મદદરૂપ થવા, વ્યવસ્થાપકોની પ્રવૃત્તિઓ અંગે નિઃશ્વર લેવા, ધંધાની રોકડ સ્થિતિ જાણવા વગેરે માટે તૈયાર કરવામાં આવે છે.



પાઠ્યાંત સ્વાધ્યાય :

૧. નાણાંકીય પત્રકો એટલે શું ?
૨. નાણાંકીય પત્રકો તૈયાર કરવાના ઉદ્દેશ્યો જણાવો.
૩. પાકું સરવેયું તૈયાર કરવાના ઉદ્દેશ્યો જણાવો.
૪. પ્રત્યક્ષ ખચ અને અપ્રત્યક્ષ ખચ વચ્ચેનો તફાવત લખો.
૫. વેપાર ખાતું અને નજો નુકશાન ખાતા વચ્ચેનો તફાવત લખો.
૬. સ્થિર મિલકત અને ચાલુ મિલકતના પાંચ ઉદાહરણ આપો.
૭. આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારીના ગજ ત્રણ ઉદાહરણ આપો.
૮. નીચેની બાકીઓ પરથી તા. ૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું તૈયાર કરો.

નાણાંકીય પત્રકો (હવાલા વગ)

નાણાંકીય પત્રકો (હવાલા વગાર)

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
શરૂઆતનો સ્ટોક	6000	ખરીદી	11500
ખરીદ પરત	500	વેચાણ	48000
વેચાણ પરત	600	પૂર અને જકાત	500
ખરીદ માલ ગાડા ભાડું	1000	મજૂરી	2500
ફેક્ટરી વીજળી ખચ	600	આયાત કર	900
ઓફિસનું ભાડું	1200	વેચાણ માલ ગાડા ભાડું	3000
કોલસો, ગેસ અને પાણી	800		

૮. નીચે આપેલ માહિતી પરથી તા. ૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકશાન ખાડું તૈયાર કરો.

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
સામાન્ય ખચ	800	કાચો નફો	32100
દાન	100	વેચાણ માલ ગાડા ભાડું	900
વીજળી ખચ	175	ઓફિસ ખચ	650
કાયદાનો ખચ	180	વીમા પ્રીમીયમ	1200
જાહેરાત ખચ	440	ટેલિફોન ખચ	600
કમિશન	870	વેચાણ વેરો	800
ભાડું	1800	સ્થાપના ખચ	700
રોકાણ પર વ્યાજ	700	પરચૂરણ ખચ	750
સાન્દ્રી રસીદ	700	મળેલ વટાવ	1090
અપ્રત્યક્ષ ખચ	340	પ્રવાસ ખચ	300
ગ્રાન્ટિંગ અને સ્ટેશનરી	65	મરામત ખચ	270

૧૦. ગોપાલનાથ એન્ડ સાન્સના નીચેના કાચા સરવૈયા પરથી તા. ૩૧ મી ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાડું તૈયાર કરો. અને તે જ તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો.

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો

તૈયાર કરવા



નોંધ

મોડયુલ - ૫

નાણાંકીય પત્રક
તેચાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા વગર)

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
શરૂઆતનો સ્ટોક	4000	ચૂકવવાપાત્ર બાકી બિલ	1200
ખરીદી	12000	ખરીદ પરત	300
માલ વહન ખર્ચ	1170	ધંધાના લોણદારો	2700
મજૂરી	1000	વેચાણ	20000
વેચાણ પરત	200	મૂડી	30000
ઉપાડ	1500	મળેલ કમિશન	120
ઓફિસ ખર્ચ	250		
પગાર	1600		
વટાવ	300		
મરામત ખર્ચ	1200		
જાહેરાત ખર્ચ	500		
ધંધાના દેવાદારો	6000		
પ્લાન્ટ અને મશીનરી	12000		
મકાન	10000		
હાથ પર રોકડ	600		
બેંકમાં રોકડ	2000		
	54320		54320

તા. ૩૧ મી ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ હાથ પર સ્ટોક રૂ. ૬૦૦૦ છે.



૧૫

નાણાંકીય પત્ર (હવાલા સાથે)

તમે અગાઉના પ્રકરણમાં ભણી ગયા કે વેપારખાતું, નફાનુકસાન ખાતું અને પાકુ સરવેયું કેવી રીતે તૈયાર કરાય છે.

આ નાણાંકીય પત્રકો આપેલ કાચા સરવેયા પરથી તૈયાર કરાય છે. અવું સંભવ છે કે કાચા સરવેયામાં આપેલ ખર્ચ તે જે નાણાંકીય વર્ષ માટે તૈયાર કર્યું હોય તે નાણાંકીય વર્ષના કુલ ખર્ચ જેટલો ન પણ હોય.

તેવી જ રીતે કાચા સરવેયામાં આપેલ ખર્ચનો જોઈએક ભાગ કદાચ ભવિષ્યના વર્ષોસાથે સંબંધિત હોય.

જો નાણાંકીય પત્રક આવા કાચા સરવેયાની મદદથી તૈયાર કરવામાં આવે તો તે ધંધાનું સાચું ચિત્ર નહીં દર્શાવે. આવકપત્રકો સાચા નફાનુકસાન નહીં દર્શાવે. તેજ રીતે પાકુ સરવેયું ધંધાની સાચી નાણાંકીય સ્થિતી નહિ દર્શાવે.

આથી જ નાણાંકીય પત્રક તૈયાર કરતાં પહેલાં એવાં ખર્ચ જાણવા જોઈએ કે જે ચાલુ વર્ષ સાથે સંબંધિત છે, પરંતુ તે ચૂકવેલ નથી.

તેવી જ રીતે એવા ખર્ચ પણ છે કે જે અલગ તારવવા જોઈએ જે ભવિષ્યના વર્ષ સાથે સંબંધિત છે, પરંતુ જેની ચૂકવણી ચાલુ વર્ષમાં કરેલ છે.

તેવી જ રીતે એ પણ જરૂરી છે કે આવક અને ખર્ચના સરવાળા માટે થોડા હવાલા પણ કરી શકાય. આ નાણાંકીય હવાલા કહેવાય છે.



હેતુઓ :

આ પ્રકરણનો અભ્યાસ કર્યું પછી તમે :

નાણાંકીય હવાલાઓની જરૂરિયાત સમજૂ શકશો.

આખરનો સ્ટોક, ચૂકવવાના બાકી ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચાને સ્થિર મિલકત પર ધસારા

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

સંબંધિત હવાલાઓ સમજ શકશો.

ઉપરોક્ત હવાલાઓ સાથે સંબંધિત હવાલાની નોંધ સમજાવી શકશો અને વેપાર ખાતું, નફ્ફા નુકશાન ખાતું અને પાકા સરવૈયા સાથે સંબંધિત હવાલાઓને નામામાં કેવી રીતે લેવાય છે તે સમજ શકશો.

૧૫.૧ નાણાંકીય હવાલાઓની જરૂરિયાત :

નીચેના ઉદ્દેશો/હેતુઓ માટે નાણાંકીય હવાલાઓ જરૂરી છે.

૧. એક નાણાંકીય વર્ષ માટે ધંધાનો સાચો ચોખ્ખો નફ્ફો અથવા ચોખ્ખી ખોટ જાણવા માટે
૨. ધંધાની સાચી નાણાંકીય સ્થિતિ જાણવા માટે.
૩. એવા ખર્ચાઓ નોંધવા કે જે ચૂકવવાના છે પરંતુ તે ચૂકવ્યા નથી.
૪. એવા ખર્ચાઓ નોંધવા કે જે ભવિષ્યના વર્ષોના છે પરંતુ અગાઉથી ચૂકવી દીધા છે.
૫. સ્થિર મિલકતો પર ઘસારાની જોગવાઈ કરવી.

૧૫.૨ હવાલાના પ્રકારો :

દરેક ધંધાકીય એકમમાં હવાલાની પ્રકૃતિ અને સંખ્યા અલગઅલગ હોય છે. આ પ્રકરણમાં તમે નીચે દર્શાવેલ સામાન્ય હવાલાઓનો અભ્યાસ કરશો.

૧. આખરનો સ્ટોક
૨. ચૂકવવાના બાકી ખર્ચ
૩. અગાઉથી ચૂકવેલ ખર્ચ
૪. સ્થિર મિલકત પર ઘસારો

ચાલો આપણે નાણાંકીય પત્રકોમાં ઉપરોક્ત હવાલાની અસર અને તેના નાણાંકીય વ્યવહારોની ચર્ચા કરીએ.

૧. આખરનો સ્ટોક :

આખરનો સ્ટોક એ માલનો સ્ટોક છે, જે નાણાંકીય વર્ષના અંત સુધી વેચાયો નથી. આ રકમને

મોડિયુલ - ૫

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

સામાન્ય રીતે કાચા સરવૈયામાં નથી દર્શાવાતો. આ કાચા સરવૈયાની બહાર આપેલા વધારાની માહિતીમાં દર્શાવાય છે. ઉદાહરણ તરીકે શ્રીમાન એક્સની ખાતાવહીમાં ૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ આખર સ્ટોકની બાકી રૂ. ૩૦૦૦૦ છે. શ્રીમાન એક્સના નાણાંકીય પત્રકોમાં આખરના સ્ટોકની નોંધ નીચે મુજબ થશે.

(A) વર્ષના અંતે નીચે મુજબ હવાલાની અસર આપવામાં આવશે.

તારીખ	વિગત	ઉધાર	જમા
૩૧-૩-૨૦૧૨	આખર સ્ટોક ખાતે તે વેપાર ખાતે (આખરના સ્ટોકને વેપાર ખાતે લઈ ગયા)	૨૫૫ રૂ. ૩૦૦૦૦	૨૫૫ રૂ. ૩૦૦૦૦

(B) શ્રીમાન એક્સનું તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષનું વેપારખાતું.

ઉધાર

જમા

વિગત	રૂ. ૨૫૫	વિગત	રૂ. ૨૫૫
આખરનો સ્ટોક		આખરનો સ્ટોક	૩૦૦૦૦

(C) શ્રીમાન એક્સનું તા. ૩૧-૩-૨૦૧૨ના રોજનું પાકું સરવૈયું.

જવાબદારી	રૂ. ૨૫૫	મિલકત	રૂ. ૨૫૫
આખરનો સ્ટોક			૩૦૦૦૦

નોંધ: જો આખરનો સ્ટોક કાચા સરવૈયામાં આપેલ હોય તો ઉપરોક્ત હવાલાની નોંધ નહીં થાય અને આખર સ્ટોકને વેપાર ખાતામાં જમા બાજુ નહીં દર્શાવાય, આખરના સ્ટોકને ફક્ત પાક સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાશે.

(૨) ચૂકવવાના બાકી ખર્ચ :

એવા ખર્ચ જે ચાલુ વર્ષ સાથે સંબંધિત છે, પરંતુ નાણાંકીય વર્ષના અંતર સુધી ચૂકવણી કરેલ નથી તેને ચૂકવવાના બાકી ખર્ચ કહેવાય છે. જેમ કે, કારખાનાનું ભાડું, મજૂરી, વેતન, ઓફિસનું ભાડું, ટેલીફોન ખર્ચ વગેરે જે ચાલુ વર્ષ સાથે સંબંધિત છે પરંતુ જેની ચાલુ વર્ષમાં ચૂકવણી થઈ નથી. ઉદાહરણ તરીકે શ્રીમાન એક્સની ખાતાવહી દર્શાવે છે કે વર્ષ 2010-12 દરમિયાન

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

રૂ.45000 ની મજૂરીની ચૂકવણી કરી દીધી છે. વર્ષ 2010-12 માટે રૂ.5000ની મજૂરી ચૂકવવાની બાકી છે.

શ્રીમાન એકસની ખાતાવહીમાં ચૂકવવાની બાકી મજૂરીની નોંધ નીચે મુજબ થશે.

(A) હવાલાની અસરની નોંધ

તારીખ	વિગત	ઉધાર	જમા
૩૧-૩-૨૦૧૨	મજૂરી ખાતે તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે (વર્ષ ૨૦૧૦-૧૨ માટે ચૂકવવાની બાકી મજૂરીની નોંધ)	રૂ. 5000 6. 5000	રૂ. 5000

(B) શ્રીમાન એકસનું તા. ૩૧-૩-૨૦૧૨ ના રોજપુરા થતા વર્ષનું વેપાર ખાતી

ઉધાર

જમા

વિગત	રૂ. રૂ.	વિગત	રૂ. રૂ.
મજૂરી + ચૂકવવાની બાકી મજૂરી	૪૫૦૦ ૫૦૦૦		૫૦૦૦૦

(C) શ્રીમાન એકસનું તા. ૩૧-૩-૨૦૧૨ ના રોજનું પાકું સરવેયું :

જવાબદારી	રૂ. રૂ.	મિલકત	રૂ. રૂ.
ચૂકવવાની બાકી મજૂરી	૫૦૦૦		

ચાલો ચૂકવવાના બાકી પગારનું એક અન્ય ઉદાહરણ જોઈએ કે જે ચોખ્યો નફાને અસર કરે છે.

ઉદાહરણ : શ્રીમાન એકસની ખાતાવહીમાં નીચે મુજબ દર્શાવેલ છે.

વર્ષ ૨૦૧૧-૧૨ માં રૂ. ૧૦૦૦૦ પગારની ચૂકવણી કરવામાં આવી છે તે ની માર્ચ ૨૦૧૨ ના રોજવર્ષ ૨૦૧૧-૧૨ રૂ. ૧૦૦૦૦ પગાર ચૂકવવાનો થયો છે. પરંતુ ૩૧-૩-૨૦૧૨ સુધી ચૂકવેલ નથી. શ્રીમાન એકસની ખાતાવહીમાં તેની નોંધ નીચે મુજબ થશે.

(A) હવાલાની અસરની નોંધ :

તારીખ	વિગત	ઉધાર	જમા
૩૧-૩-૨૦૧૨	પગાર ખાતે તે ચૂકવવાની બાકી પગાર ખાતે (વર્ષ ૨૦૧૧-૧૨ માટે ચૂકવવાની બાકી પગાર)	રૂ. ૧૦૦૦૦ ૬. ૧૦૦૦૦	૧૦૦૦૦

નાણાકીય પત્રકો (હવાલા સાથે)

(B) શ્રીમાન એક્સનું તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષનું નફાનુક્સાન ખાતુ

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
પગાર 900000			
+ ચૂકવવાનો બાકી પગાર 90000	990000		

(C) તા. ૩૧-૩-૨૦૧૨ના રોજનું પાકું સરવૈયું :

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
ચૂકવવાનો બાકી પગાર	90000		



પાઠ સ્વાધ્યાય ૧૫.૧

તમારા ઉત્તર માટે યોગ્ય શબ્દ લખો

- (૧) વર્ષના અંતે નહિ વેચાયેલો માલ
- (૨) વસ્તુ કે સેવા જેનો લાભ અગાઉથી જ લીધો છે પરંતુ રકમ ચૂકવી નથી.
- (૩) નહિ વેચાયેલ માલની રકમ કાચા સરવૈયાની બહાર વધારાની માહિતીમાં દર્શાવેલ છે.
- (૪) અંતિમ ખાતા તૈયાર કરતાં પહેલા કાચા સરવૈયાની વધારાની માહિતીમાં દર્શાવેલ લેવડાયકનો કરવામાં આવતો સમાવેશ.

૩. અગાઉથી ચૂકવેલ ખર્ચ :

કયારેક કાચા સરવૈયામાં દર્શાવેલ ખર્ચનો કોઈક ભાગ ભવિષ્યના વર્ષ/વર્ષોસાથે સંબંધિત હોય છે, આ પ્રકારના ખર્ચનો ભાગ, અગાઉથી ચૂકવેલ ખર્ચ અથવા ખર્ચની અગાઉથી ચૂકવણી કહેવાય છે. જેમ કે ચાલુ વર્ષે ચૂકવેલ પગારનો કોઈક ભાગ કદાચ ભવિષ્યના નાણાકીય વર્ષ સાથે સંબંધિત હોઈ શકે છે. તેવી જ રીતે કારખાનાનું ભાડું, મજૂરી, ઓફિસનું ભાડું, વીમા ગ્રીમીયમ, વેરો વગેરે કેટલાક કિસ્સાઓમાં અગાઉથી ચૂકવેલ પણ હોય છે. ઉદાહરણ તરીકે શ્રીમાન એક્સની ખાતાવહીમાં નીચે મુજબ દર્શાવેલ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન કુલ રૂ. ૨૦૦૦૦૦૦ પગાર પેટે ચૂકવ્યા, જેમાંથી રૂ. ૨૫૦૦૦ ભવિષ્યના વર્ષ એટલે કે ૨૦૧૨-૧૩ સાથે સંબંધિત છે. શ્રીમાન એક્સની ખાતાવહીમાં અગાઉથી ચૂકવેલ પગારની નોંધ નીચે મુજબ થશે.

(A) અગાઉથી ચૂકવેલ પગારના હવાલાની અસરની નોંધ નીચે મુજબ થશે :

મોડયુલ - ૫

નાણાકીય પત્રકો

તૈયાર કરવા



નોંધ

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

તારીખ	વિગત	ઉધાર	જમા
		રૂપમ રૂ.	રૂપમ રૂ.
૩૧-૩-૨૦૧૨	અગાઉથી ચુકવેલ પગાર ખાતે	૩.	૨૫૦૦૦
	તેપગાર ખાતે		૨૫૦૦૦
(વર્ષ ૨૦૧૧-૧૨ માટે અગાઉથી પગાર ચુકવ્યો)			

(B) શ્રીમાન એક્સનું તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષનું નફાનુકસાન ખાતુ

વિગત	રૂપમ રૂ.	વિગત	રૂપમ રૂ.
પગાર	૨૦૦૦૦૦		
- અગાઉથી ચુકવેલ પગાર ૨૫૦૦૦	૧૭૫૦૦૦		

(C) શ્રીમાન એક્સનું તા. ૩૧-૩-૨૦૧૨ના રોજનું પાછું સરવેયું :

જવાબદારી	રૂપમ રૂ.	મિલકત	રૂપમ રૂ.
		અગાઉથી ચુકવેલ પગાર	૨૫૦૦૦

૪. સ્થિર મિલકત પર ઘસારો :

સ્થિર મિલકત જેવી કે પ્લાન્ટ અને મશીનરી, મકાન, ફર્નિચર, કોમ્પ્યુટર, ગાડી, વાહન વગેરેના મૂલ્યમાં દરેક વર્ષે તેનો ઉપયોગ અને તૂટકૂટના કારણે ઘટાડો થાય છે. મિલકતની કિંમતમાં થતા આ ઘટાડાને ઘસારો કહેવાય છે.

ઘસારો અન્ય ખર્ચની જેમ જ ધંધાનો એક ખર્ચ જ છે. જુદી જુદી સ્થિર મિલકતો પરનો ઘસારો નફાનુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવાય છે.

ઘસારાની રકમ પાકા સરવેયામાં મિલકત બાજુ સંબંધિત મિલકતમાંથી બાદ કરી દર્શાવાય છે. ઉદાહરણ તરીકે શ્રીમાન એક્સની ખાતાવહીમાં નીચે મુજબ દર્શાવેલ છે.

પ્લાન્ટ અને મશીનરીની ૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ કિંમત રૂ. ૫૦૦૦૦૦ અને ૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ ફર્નિચરની કિંમત રૂ. ૫૦૦૦૦ છે. આ મિલકત પર વાર્ષિક ક્ષેપુ લેખે ઘસારો ગણવાનો છે. શ્રીમાન એક્સના નાણાંકીય પત્રકોમાં ઘસારાની નોંધ નીચે મુજબ થશે.

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

(A) ધસારાની નોંધ નીચે મુજબ થશે :

તારીખ	વિગત	ઉધાર	જમા
૩૧-૩-૨૦૧૨	ધસારા ખાતે તે ખાન્ટ અને મશીનરી ખાતે તે ફર્નિચર ખાતે (ખાન્ટ અને મશીનરી તેમજ ફર્નિચર પર ૧૦% લેબે એક વર્ષના ધસારાની નોંધ)	૨૫૫ રૂ. ૫૫૦૦૦ ૪૦૦૦	૨૫૫ રૂ. ૫૦૦૦૦

(B) શ્રીમાન એકસનું તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષનું નફાનુકસાન ખાતું

વિગત	રૂડ્મ રૂ.	વિગત	રૂડ્મ રૂ.
ધસારો			
ખાન્ટ અને મશીનરી	૫૦૦૦૦		
ફર્નિચર	૪૦૦૦		

(C) શ્રીમાન એકસનું તા. ૩૧-૩-૨૦૧૨ના રોજનું પાંદું સરવેયું :

જવાબદારી	રૂડ્મ રૂ.	મિલકત	રૂડ્મ રૂ.
		ખાન્ટ અને મશીનરી ૫૦૦૦૦૦	
		ધસારો ૪૦૦૦૦	૪૪૦૦૦
		ખાન્ટ અને મશીનરી ૪૦૦૦૦	
		ધસારો ૪૦૦૦	૪૪૦૦૦



પાઠ સ્વાધ્યાય ૧૫.૨

કોલમ 'a' સાથે 'b' જોડો.

'A'

'B'

(1) આખરનો સ્ટોક

(a) મિલકતની કિંમતમાંથી બાદ કરવો

(2) ચૂકવવાનો બાકી ખર્ચ

(b) એવાં ખર્ચ કે હજુ સુધી ચૂકવવાના થતા નથી પરંતુ

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો તૈયાર કરવા



નોંધ

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

(3) ધસારો

(4) અગાઉથી ચૂકવેલ ખર્ચ

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

જેની ચૂકવણી ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કરેલ છે.

(C) એવાં ખર્ચ જે ચૂકવવાના છે પરંતુ ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ચૂકવેલ નથી.

(D) વેપાર ખાતાની જમા બાજુ દર્શાવાય છે.

ઉદાહરણ : ૧

મે.કોશલ ટ્રેડર્સના નીચેના કાચા સરવેયા પરથી ત૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવેયું તૈયાર કરો.

ઉધારબાકી	રકમ રૂ.	જમા બાકી	રકમ રૂ.
૧ એપ્રિલ 2011 – શરૂનો સ્ટોક	16000	મૂડી	80000
ખરીદી	75000	વેચાણ	200000
વેચાણ પરત	5000	ખરીદ પરત	2000
ખરીદમાલ ગાડા ભાડું	1500	વટાવ	500
ખાનાંટ અને મશીનરી	40000	લેઝાદાર	10000
ફર્નિચર અને ફિક્ચર્સ	5000	ચૂકવવાપાત્ર બાકી	1500
કી હોલ મિલકત	45650		
હાથ પર રોકડ	5000		
વેચાણમાલ ગાડાભાડું	400		
મજૂરી / વેતન	30000		
પગાર	18000		
કારખાનાનો વીજળી ખર્ચ	800		
હવાદારો	28000		
પ્રવાસ ખર્ચ	1200		
ભાડું અને વેરો	4800		

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

ઉપાડ	5000
વીમો	450
સામાન્ય ખર્ચ	12200
	294000
	294000

હવાલા :

- ૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ સ્ટોકની કિંમત રૂ.૩૮૦૦૦ (બજાર કિંમત રૂ.૨૦૦૦૦
- ચૂકવવાની બાકી મજૂરી / વેતન રૂ.૨૦૦૦ અને ચૂકવવાનો બાકી પગાર રૂ.૫૫૫૫ છે.
- અગાઉથી ચૂકવેલ વીમો રૂ.૧૫૦
- ખ્લાન્ટ અને મશીનરી પર ૫% અને ફર્નિચર અને ફિક્ચર્સ પર 5% લેખે ઘસારો ગણવો.

ઉકેલ : ૩૧ મી માર્ચ, ૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું

ઉધાર

રૂમા

વિગત	રૂમા રૂ.	વિગત	રૂમા રૂ.
શરૂનો સ્ટોક	16000	વેચાણ	200000
ખરીદી	75000	- વેચાણ પરત	5000
ખરીદ પરત	2000	આખરનો સ્ટોક	20000
આવકમાલ ગાડાભાડુ	1500		
મજૂરી / વેતન	30000		
+ ચૂકવવાનું બાકી	2000		
કારખાનાનો વીજળી ખર્ચ	800		
કાચો નફોન. તુ. ખાતે લઈ ગયા	91700		
			215000
			215000

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો તૈયાર કરવા



નોંધ

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

જવકમાલ ગાડાભાડુ	500		કાચો નફોવેપાર ખાતેથી લાવ્યા	91700
પ્રવાસ	18000		વટાવ	500
ચુકવવાનો બાકી	1500	19500		
પ્રવાસ ખર્ચ			1200	
ભાડું અને વેરો			4800	
વીમો	450			
અગાઉથી ચુકવેલ	150	300		
સામાન્ય ખર્ચાઈ		12200		
ઘસારો :				
ખાનાં અને મશીનરી	2000			
ફર્નિચર અને ફિક્ચર્સ	500	2500		
ચોખ્યો નફોમૂડી ખાતે લઈ ગયા		51300		
		92200		92200

૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજનું પાકું સરવેયું

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
ચુકવવાપાત્ર બાકી	1500	હાથ પર રોકડ	5000
લેણદાર	10000	દેવાદાર	28000
ચુકવવાનીબાકી મજૂરી	2000	આખરનો સ્ટોક	20000
ચુકવવાનો બાકી પગાર	1500	અગાઉથી ચુકવેલ વીમો 5000	150
મૂડી	80000	ફર્નિચર અને ફિક્ચર્સ 500	
ત્રણ ચોખ્યો નફો 51300		ઘસારો	4500
	131300	ખાનાં અને મશીનરી 40000	
ઉપાડ 5000	126300	ઘસારો 2000	38000
દી હોલ મિલકત			45650
	141300		141300

નોંધ : આખરના સ્ટોક માટે બજારકિંમત અને મૂળકિંમત બેમાંથી જે ઓછી હોય તે લખાય છે.

ઉદાહરણ ૨

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

મેસર્સ ગુમા ફન્ડિયર્સના નીચેના કાચા સરવેયા પરથસ ત૧ મી દિસેમ્બર ૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષ માટે હવાલાની અસરની નોંધ લખી વેપારખાતું અને નફાનુકસાન ખાતું અને તે જ દિવસનું પાકું સરવૈયું તૈયાર કરો.

મેસર્સ ગુમા ફન્ડિયર્સનું ત૧ -૧૨-૨૦૧૨નું કાચું સરવૈયું

વિગત	ઉધાર રૂ.	જમા રૂ.
શ્રીમાન ગુમાનું મૂડી ખાતું		80000
હાથ પર રોકડ	540	
બેંકમાં રોકડ	2630	
ખરીદ ખાતું	43120	
વેચાણ ખાતું		78100
મજૂરી / વેતન ખાતું	10480	
બળતણ અને શક્તિ	4730	
વેચાણ માલ ગાડાભાડું	3200	
ખરીદ માલ ગાડાભાડું	2040	
સ્ટોક (૧-૧-૨૦૧૨ નારોજ)	5760	
જમીન અને મકાન ખાતું	40000	
મશીનરી ખાતું	20000	
પગાર ખાતું	15000	
વીમા ખાતું	600	
દેવાદાર ખાતું	20000	
લેણદાર ખાતું		10000
	168100	168100

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો તૈયાર કરવા



નોંધ

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

(૪) ગ્રશ માસનો વીમો અગાઉથી ચુકવેલ છે.

ઉકેલ :

૨૦૧૨ હવાલાની અસર

		રૂ.	રૂ.
ઉિસે. ૩૧	આખરના સ્ટોક ખાતે	રૂ. 5000	
	તે વેપાર ખાતે (આખરના સ્ટોકની નોંધ કરી)		5000
ઉિસે. ૩૧	ઘસારા ખાતે તે મશીનરી ખાતે (મશીનરી પર વાર્ષિક 10% લેખે ઘસારાની ગણતરી કરી)	રૂ. 2000	2000
ઉિસે. ૩૧	પગાર ખાતે તે ચુકવવાના બાકી પગાર ખાતે (ચુકવવાના બાકી પગારની નોંધ કરી)	રૂ. 3500	3500
ઉિસે. ૩૧	અગાઉથી ચુકવેલ વીમા ખાતે તે વીમા ખાતે (અગાઉથી ચુકવેલ વીમાની નોંધ કરી)	રૂ. 150	150

મેસર્સ ગુમા ફર્નિચરનું ઉ ૧ મી ડિસેમ્બર ૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષનું વેપાર ખાતું

ઉધાર

જમા

વિગત	રૂમ રૂ.	વિગત	રૂમ રૂ.
સ્ટોક (1-1-12)	5760	વેચાણ ખાતે	78100
ખરીદ ખાતે	43120	સ્ટોક (31-12-12)	5000
વેતના	10480		
બળતાશ અને શક્તિ	4730		
ખરીદ માલ ગાડા ભાડુ	2040		
કાચો નફો નફા નુકસાન ખાતે	16970		
લદ્યા			
	83100		83100

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

૩૧ મી ડિસેમ્બર ૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષનું નફાનુકસાન ખાતું

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
વેચાણ માલ ગાડા ભાડું 3200		કાચો નફોવેપાર ખાતેથી લાવ્યા	16970
પગાર 15000		ચોખ્ખી ખોટ શ્રીમાન ગુમાના	
ત્રણુકવવાનો બાકી વીમો 3500	18500	મૂડી ખાતે લઈ ગયા	7180
600			
અગાઉથી ચુકવેલ 150	450		
મશીનરીનો ઘસારો	2000		
	24150		24150

મે. ગુમા ફર્નિચર્સ નું ૩૧ મી ડિસેમ્બરના રોજનું પાંકું સરવૈયું

જવાબદારી	રકમ રૂ.	મિલકત	રકમ રૂ.
લેણદાર	10000	હાથ પર રોકડ	540
ચુકવવાનો બાકી પગાર	3500	બેકમાં રોકડ	2630
શ્રીમાન ગુમાનું દેવાદાર			20000
મૂડી ખાતું	80000	આખરનો સ્ટોક	5000
ચોખ્ખી ખોટ 7180	72820	અગાઉથી ચુકવેલ વીમો	150
જમીન અને મકાન			
મશીનરી ખાતું		20000	
		ઘસારો 2000	18000
		86320	86320

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો તૈયાર કરવા



નોંધ



૧. નીચેના વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.

- (૧) હવાલાની અસર આપ્યા વગર તૈયાર કરેલ નાણાંકીય પત્રક ધંધાની સાચી સ્થિતિ દર્શાવતા નથી.
- (૨) હવાલાની અસર ફક્ત પાકા સરવૈયામાં જ થાય છે.
- (૩) હવાલાની અસર ફક્ત વેપાર ખાતા અને નફાનુકસાન ખાતામાં જ થાય છે.
- (૪) હવાલા હંમેશા ભવિષ્ય સાથે સંબંધિત હોય છે.

૨. ખાલી જગ્યા પૂરો

- (૧) આખરનો સ્ટોક પાકા સરવૈયામાં બાજું દર્શાવાય છે.
- (૨) ચુકવવાના બાકી ખર્ચાં પાકા સરવૈયામાં બાજું દર્શાવાય છે.
- (૩) અગાઉથી ચુકવેલ ખર્ચાં પાકા સરવૈયામાં બાજું દર્શાવાય છે.
- (૪) ઘસારો નફાનુકસાન ખાતામાં બાજું દર્શાવાય છે.
- (૫) આખરનો સ્ટોક ની મિલકત બાજું દર્શાવાય છે.
- (૬) સ્થિર મિલકતની કિંમતમાં તેના વપરાશને કારણે થથો ઘટાડો કહેવાય છે.
- (૭) હવાલો ધંધાની સાચી જાણવા માટે દર્શાવાય છે.
- (૮) ચુકવવાની બાકી મજૂરી ની બાજું દર્શાવાય છે.
- (૯) ચુકવવાનું બાકી ઓફિસભાનું ની બાજું અને પાકા સરવૈયાની બાજું દર્શાવાય છે.
- (૧૦) નફાનુકસાન ખતું નાણાંકીય વર્ષનો જાણવા માટે તૈયાર કરવામાં આવે છે.

૧૫.૩ વૈકલ્પિક પ્રશ્નો

- (૧) જ્યારે ચુકવવાની બાકી મજૂરીના હવાલાની અસર ન આપવામાં આવે તો ચોખ્યો નફો

(A) વાસ્તવિક કરતા વધુ	(B) વાસ્તવિક કરતા ઓછો
(C) વાસ્તવિક જેટલો જ	(D) કોઈ અસર થશે નહિ

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

(૨) અગાઉથી ચુકવેલ ખર્ચ એવો ખર્ચ છે જે..

- (A) અગાઉથી ચુકવેલ છે. (B) ચુકવવાનો બાકી ખર્ચ છે.
- (C) ચાલુ વર્ષ માટે કરેલ ખર્ચ છે. (D) પાછલા વર્ષ માટે ચુકવેલ ખર્ચ છે.

(૩) ધસારો ઉધાર થાય છે.

- (A) વેપાર ખાતે (B) નફા નુકસાન ખાતે
- (C) સંબંધિત મિલકત ખાતે (D) ઉપરોક્તમાંથી એક પણ નહિ.

(૪) હવાલાની અંસર દર્શાવાય છે

- (A) ફક્ત વેપાર ખાતામાં (B) ફક્ત નફા નુકસાન ખાતામાં
- (C) ફક્ત પાકા સરવૈયામાં
- (D) વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં



તમે આટલું શીખ્યા :

- ધંધાનો ચોખ્યો નફો અને નાણાંકીય સ્થિતિ જાગવા માટે નાણાંકીય પત્રકો તૈયાર કરતી વખતે જરૂરી હવાલાઓની નોંધ કરવામાં આવે છે.
- એક નાણાંકીય વર્ષના અંતે નહિ વેચાયેલ માલ ને માલનો આખરનો સ્ટોક કહેવાય છે. આ હવાલાની નોંધ વેપારખાતામાં અને પાકા સરવૈયામાં કરાય છે.
- ચુકવવાનો બાકી ખર્ચ ચાલુ વર્ષ સાથે સંબંધિત છે. પરંતુ તેની ચુકવણી ચાલુ વર્ષ દરમિયાન કરવામાં આવી નથી. આ હવાલાની નોંધ વેપારખાતામાં અથવા નફાનુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં કરાય છે.
- અગાઉથી ચુકવેલ ખર્ચ અથવા જે ખર્ચની ચુકવણી અગાઉથી થઈ ગઈ છે તે એવો ખર્ચ છે, જે ભવિષ્યના વર્ષ સાથે સંકળાયેલ છે. આ હવાલાની નોંધ વેપારખાતે અથવા નફાનુકસાન ખાતામાં પાકા સરવૈયામાં કરાય છે.
- ધસારો, સ્થિર મિલકતમાં તેના વપરાશ અને તોડફોડને કારણે થયેલ ઘટાડો દર્શાવે છે. આ હવાલાની નોંધ નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં કરાય છે.

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો તૈયાર કરવા





पाठ्यांत स्वाध्याय :

૧. હવાલાની નોંધ એટલે શું ?

૨. નાણાકીય પત્રકોમાં હવાલાની નોંધ કરવાની જરૂરિયાત શા માટે છે ?

૩. ટૂંકનોંધ લખો.

(A) ચૂકવવાના બાકી ખર્ચ (B) અગાઉથી ચૂકવેલ ખર્ચ

૪. નીચેના હવાલા સમજાવો અને નાણાકીય પત્રકોમાં તેની નોંધ શું થશે તે જણાવો.

(A) આખરનો સ્ટોક (B) ઘસારો

૫. મૈસર્સ સાક્ષી ગારમેન્ટ ના નીચેના કાચા સરવેયા પરથી રૂ ૭ મી માર્ચ ૨૦૧૨ ના રોજ પુરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફાનુક્સાન ખાતું તેમજ તે જ દિવસની સ્થિતિ દર્શાવતું પાકું સરવેયું તૈયાર કરો.

6.

8.

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
સ્ટોક (1-4-2011)	13800	મૂડી	65000
ખરીદી	52000	વેચાણ	74400
મજૂરી / વેતન	4000	ખરીદ પરત	1500
વેચાણ પરત	2400	વટાવ	450
જમીનમકાન	40000	લેણદાર	6500
પ્લાન્ટ અને મશીનરી	24500	વ્યાજ	600
દેવાદાર	5250	કમિશન	700
હાથપર અને બેંકમાં રોકડ	8750	બેંક લોન	26000
ઓફિસનું ભાડું	2200		
પોસ્ટેજ	400		
વીમો	1500		
ભાડું	1400		
બળતણ અને શક્તિ	2450		
ફર્નિચર	4500		
મોટરકાર	12000		
	175150		175150



નોંધ

હવાલા :

- (૧) ૩૧-૩-૨૦૧૨ના રોજ સ્ટોક રૂ. ૨૫૦૦૦
- (૨) ફર્નિચર પર ૧૦% અને પ્લાન્ટ અને મશીનરી પર ૨૦% લેખે ઘસારો ગણો.
- (૩) ચૂકવવાના બાકી ખર્ચ રૂ. ૬૫૦ અને ચૂકવવાનું બાકી ભાડું રૂ. ૨૦૦ છે. આગાઉથી ચૂકવેલ વીમો રૂ. ૩૦૦ છે.
- (૪) મે. પંત બ્રધર્સની ૩૧-૩-૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષની નીચેની માહિતી પરથી ૩૧-૩-૨૦૧૨ના રોજનું વેપાર ખાતું, નફાનુક્સાન ખાતું અને પાકું સરવેયું તૈયાર કરો.

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
મુડી	400000	મુડી	120000
શરૂઆતનો સ્ટોક	85000	ભાડું અને વેરો	40000
ખરીદી	420000	પોસ્ટેજ અને ટેલિગ્રામ	25000
લેણદારો	75000	ચૂકવેલ વ્યાજ	20000
દેવાદારો	120000	ફર્નિચર	200000
વેચાણ	810000	વીમો	100000
મળેલ વટાવ	18000	નૂર	20000
આપેલ વટાવ	16000	હાથ પર રોકડ	50000
ખરીદ પરત	20000	બેંકમાં રોકડ	47000
વેચાણ પરત	10000	મોટરકાર	50000

હવાલા :

૧. ૩૧-૩-૨૦૧૨ના રોજ આખર સ્ટોકની ડિમ્બત રૂ. 170000
૨. ચુકવવાનો બાકી પગાર રૂ. 12000
૩. મોટરકાર પર વાર્ષિક 10% લેખે ઘસારાની ગણતરી કરો.
૪. મે. ભાનુમતી ટ્રેડર્સની નીચેની માહિતી પરથી ૩૧ મી માર્ચ ૨૦૧૨ના રોજ પુરા થતા વર્ષનું વેપારખાતું, નફાનુક્સાન ખાતું અને પાકું સરવેયું તૈયાર કરો.

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નોંધ

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
મૂડી	200000	૧-૪-૧૧ ના રોજ સ્ટોક	62000
ઉપાડ	10000	ખરીદી	140000
ખાન્ટ અને મશીનરી	100000	વેચાણ	230000
પગાર	14000	ખરીદ પરત	2600
પ્રનાંદીંગ અને સ્ટેશનરી	2000	વેચાણ પરત	4200
આપેલ વટાવ	1500		
દેવાદાર	25000	જૂર	1200
		હાથ પર રોકડ	32000
લેણદારો	40000	બેંકમાં રોકડ	50000
વિમો	3000	જમીન મકાન	50000
પોસ્ટેજ	600		
ઓફિસ ભાડું	2600		

હવાલા :

૩૧ મી માર્ચ ૨૦૧૨ ના રોજ ચૂકવવાની બાકી મજૂરી - રૂ.2500

ચૂકવવાના બાકી પગાર - રૂ.700

અગાઉથી ચૂકવેલ વિમો - રૂ.400

આખર સ્ટોક - રૂ.44000

- (i) શ્રીમાન સાહિલ ખાતાવહી પરથી ૩૧-૩-૨૦૧૨ ના રોજ મળેલ માહિતી પરથી તા. ૩૧-૩-૨૦૧૨ ના રોજ પુરા થતા વર્ષનું વેપારખાતું અને નફાનુક્સાન ખાતું તૈયાર કરો. ૩૧-૩-૨૦૧૨ ના રોજનું પાકું સરવેયું તૈયાર કરો.

વિગત	રકમ રૂ.	વિગત	રકમ રૂ.
શરૂનો સ્ટોક	37000	મૂડી	162000
ખરીદી	93500	ઉપાડ	160000
મજૂરી	28000	મળેલ વટાવ	1600
વેચાણ	249000	લેણદાર	43000
પગાર	11000	લોન	30000

નાણાંકીય પત્રકો (હવાલા સાથે)

ભાડું	5500	હાથ પર રોકડ	37300
ચૂકવેલ વ્યાજ	2700	બેંકમાં રોકડ	37300
આપેલ વટાવ	2400	દેવાદાર	86000
પોસ્ટેજ અને ટેલીગ્રામ	2000	ફર્નિચર	21400
પ્રિન્ટિંગ અને સ્ટેશનરી	1800	મોટરકાર	20000
વેચાણ ખર્ચ	2200	મકાન	60000
વીમા પ્રિમીયમ	5500	લાન્ટ અને મશીનરી	16000

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો તૈયાર કરવા



નોંધ

હવાલા :

(૧) આખર સ્ટોકની કિંમત રૂ. 30000

(૨) ઘસારો :

(૩) મકાન પર વાર્ષિક 5%

૧. ફર્નિચર અને ફિક્ચર્સ પર વાર્ષિક 10%

૨. જમીનમકાન પર વાર્ષિક 15%

૩. મોટરકાર પર વાર્ષિક 20%

(૪) ચૂકવવાનું બાકી ભાડું રૂ.1500

(૫) અગાઉથી ચૂકવેલ વીમો રૂ.300



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

15.1 (i) આખરનો સ્ટોક (ii) ચૂકવવાના બાકી ખર્ચ

(iii) આખરનો સ્ટોક (iv) હવાલા

15.2 (i) d (ii) (c) (iii) a (iv) b

15.3 I. (i) સાચું

(ii) ખોટું

(iii) ખોટું

મોડયુલ - ૫

નાણાંકીય પત્રકો
તૈયાર કરવા



નાણાંકીય પત્રકો (હવાલા સાથ)

(iv) ખોટું

- II (i) મિલકત
(ii) જવાબદારી
(iii) મિલકત
(iv) ઉધાર
(v) પાકું સરવેયું
(vi) ઘસારો
(vii) નાણાંકીય સ્થિતિ
(viii) જવાબદારી બાજુ, પાકું સરવેયું
(ix) ઉધાર બાજુ, વેપાર ખાતું, જવાબદારી
(x) નફા નુકસાન

- III (i) a
(ii) a
(iii) a
(iv) d

તમારા માટે પ્રવૃત્તિ :

ધારોકે તમારા પિતા એક ઉદ્યોગપતિ છે, તે એક હુકાન ચલાવે છે. તે પોતે જ માલિક છે અને ધંધાનું નામું પણ જાતે જ લખે છે. નામાનાં વિદ્યાર્થી તરીકે તમને માહિતી મળી કે તમારા પિતાજી જ્યારે ધંધાના વાર્ષિક ખાતા તૈયાર કરે છે ત્યારે તેમણે હવાલાની કોઈ જ નોંધ કરી નથી. તમને વિનંતી છે કે તમારા પિતાજીના ધંધાના નામાના ચોપડામાં વાર્ષિક ખાતા તૈયાર કરતી વખતે જરૂરી હવાલાઓની નોંધ કરો.



નોંધ

મોડયુલ - ૬

મહત્વામ ગુજરાતી

૮

અત્યારસના કલાકો

૭૮

કોમ્પ્યુટર પર નામું

આ મોડયુલ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનો અર્થ લક્ષણો તથા કોમ્પ્યુટરના જુદા જુદા ભાગો અને તેમની મહોનીઓ સમજવામાં મદદરૂપ થશે. તેઓ મોડયુલના એકાઉન્ટનો કોમ્પ્યુટરમાં થતા ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આમાં વિદ્યાર્થીને થતા ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આમાં વિદ્યાર્થીઓને મેન્યુઅલ એકાઉન્ટિંગ અને કોમ્પ્યુટરાઈઝ એકાઉન્ટિંગ વચ્ચેનો તફાવત સમજાશે તથા કોમ્પ્યુટરાઈઝ એકાઉન્ટિંગની મૂલ્ય જરૂરીયાતો પણ જાણવા મળશે. એક વાર તમે કોમ્પ્યુટરાઈઝનો ઉપયોગ અને મહત્વ સમજવા સક્ષમ થઈ જશો તે પછી તમારું Tally ERP 9.0 શરૂ કરવા માટે તેનો અર્થ, લક્ષણો અને મહત્વના પગલા સમજવા પડશે, તેની સાથે Tally માં કઈ રીતે કંપની બનાવવી તે પણ સમજવું પડશે.

પ્રકરણ-૧૬ : કોમ્પ્યુટર પર નામું

પ્રકરણ-૧૭ : ટેલીનો પરિચય



નોંધ

૧૬

કોમ્પ્યુટર પર નામું

વેપારમાં વિસ્તારની સાથે સાથે લેવડ-ફેવની સંખ્યામાં પણ વધારો થયો છે. અને તેના પરિણામે હિસાબો જળવવાની માનવીય પદ્ધતિઓ આપૂરતી અને સંભાળવી મુશ્કેલ જગ્યાય છે. વેપારમાં કોમ્પ્યુટરના આગમનથી જ વેપારની માનવગત પદ્ધતિઓની જગ્યા હવે નવી પદ્ધતિઓ લેવા લાગી છે. ટેટાબેજની તકનીકેતો ધંધાકીય એકમના નાણાં વિભાગમાં કાંતિ લાવી દીધી છે. આ પાઠમાં તમે કોમ્પ્યુટરની વિશેષતાઓ, નામામાં કોમ્પ્યુટરની ભૂમિકા તથા કોમ્પ્યુટરાઈઝ એકાઉન્ટની જરૂરિયાત વિશે અભ્યાસ કરશો.



હેતુઓ :

આ પાઠનો અભ્યાસ કર્યા પછી આપ જાણી શકશો કે....

- કોમ્પ્યુટરનો અર્થ અને વિશેષતાઓનું વર્ણન કરી શકશો.
- કોમ્પ્યુટરના ભાગોનું વર્ણન કરી શકશો.
- કોમ્પ્યુટરની ખામીઓ સમજાવી શકશો.
- નામામાં કોમ્પ્યુટરની ભૂમિકા સમજાવી શકશો.
- ઉસ્તાલિખિત નામું અને કોમ્પ્યુટર દ્વારા લખાયેલા નામાનો બેદ સમજ શકશો.
- કોમ્પ્યુટરાઈઝ નામાની આવશ્યકતાનું વર્ણન કરી શકશો અને...
- કોમ્પ્યુટર નામા આધારભૂત આવશ્યકતાઓનું વર્ણન કરી શકશો અને
- કોમ્પ્યુટરાઈઝ નામા માટેની મૂળભૂત જરૂરીયાતોનું વર્ણન કરી શકશો.

૧૬.૧ : કોમ્પ્યુટર અને તેની વિશેષતાઓ :

કોમ્પ્યુટર એક એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ (સાધન) છે, જેનાથી નિર્ધારિત નિર્દર્શનોના ચોકકસ કરેલા કાર્યક્રમોના આધાર પર વિભિન્ન પ્રકારના કાર્યો કરી શકાય છે તે તેને (માહિતી) તીવ્ર ગતિથી (ખૂબ જ જડપથી) કાર્યરત કરવાવાળું ઇલેક્ટ્રોનિક મશીન છે. તે તમામ જાટિલ સમસ્યાઓના



ઉકેલ પૂરા પડી શકે છે. તે વપરાશકર્તા દ્વારા ડેટા (માહિતી)ને ગ્રહણ કરીને તેને સૂચનામાં પરિવર્તિત કરીને ઈચ્છિત પરિષામ આપે છે. આમ, આપણે કોમ્પ્યુટરને એક એવા સાધનના રૂપમાં વ્યાખ્યામિ કરી શકીએ કે જે સૂચનાને માહિતીમાં પરિવર્તિત કરી શકે છે. ડેટા (સૂચના ગમે તે હોઈ શકે છે જેમ કે વિવિધ વિષયોના ગુણ). તે કોઈ રાષ્ટ્રના વિદ્યાર્થીઓના નામ, વર્ષ, જાતિ, વજન, ઊંચાઈ, બયત, સમૃદ્ધિ વગેરેની જાણકારી માટે પણ હોઈ શકે છે. કોમ્પ્યુટરને તેના કાર્યોના સંદર્ભમાં વ્યાખ્યામિત કરી શકાય છે. કોમ્પ્યુટર એક એવું સાધન છે જે ડેટાનો સ્વીકાર સંગ્રહ અને ઈચ્છા અનુસાર કાર્યરત કરે છે. તે જ્યારે પણ ઈચ્છે ત્યારે ડેટાને પુનઃ ઉત્પાદન અને જેવી રીતે ઈચ્છે તે ફોર્મેટમાં પ્રિન્ટ (છાપકામ) કરી શકે છે.

કોમ્પ્યુટરની વિશેષતાઓ:

કોમ્પ્યુટર મનુષ્ય કરતાં અનેક રીતે ઉત્તમ છે. તેની કેટલીક ખાસીયતો છે, જે આ પ્રમાણે છે.

- ૧) **ગતિ :** (જરૂરી) તે મનુષ્યની તુલનામાં ડેટાને લાખો ગણી જરૂરથી ગ્રહણ અને કાર્યરત કરી શકે છે તે ડેટાને પોતાની મેમરીમાં ગ્રહણ કરી સાથે સાથે તેને કાર્યરત કરી ધાર્યું પરિષામ આપી શકે છે. સાચા અર્થમાં તેનો માહિતી કાર્યરત કરવા માટે પ્રયોગ કરી શકાય છે. કોમ્પ્યુટરના તમામ કાર્યવિદ્યુત પ્રવાહથી થાય છે અને તેની ગતિ પ્રકાશિય ગતિ જેટલી હોય છે મોટા ભાગના આધુનિક કોમ્પ્યુટર ૧૦૦ મિલિયન ગણતરી પ્રતિ સેકન્ડ પ્રમાણે કરી શકે છે.
- ૨) **સંગ્રહશક્તિ :** કોમ્પ્યુટરની સંગ્રહશક્તિ મોટા પ્રમાણમાં છે તેમાં બહોળા પ્રમાણમાં ડેટા અથવા સૂચના સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે તેમાં ઓછી જગ્યામાં ઘણા જ વિશાળ પ્રમાણમાં ડેટાને સંગ્રહિત કરવાની ક્ષમતા હોય છે. (ડેટા) ઉપરાંત આધુનિક કોમ્પ્યુટર ચિત્રો અને અવાજને ડિજિટલ પ્રકારે સંગ્રહિત કરવા માટે સક્ષમ હોય છે.
- ૩) **ચોક્સાઈઝ :** કોમ્પ્યુટરની ચોક્સાઈઝ ખૂબ જ ઊંચા પ્રકારની હોય છે. અને તેની પ્રત્યેક ગણતરી ચોક્સાઈઝ પૂર્વક થતી હોય છે. ખૂબ થાય તો તે પણ મનુષ્યને કારણે જ થાય છે. નહિ કે તકનિકી ખામીને કારણે. આ ખામીઓનું મુખ્ય કારણ વપરાશકર્તા (મનુષ્ય) દ્વારા ખોટા કાર્યક્રમ (પ્રોગ્રામ) અથવા ખોટી માહિતીનો ઉપયોગ હોય છે.
- ૪) **પરિશ્રમ :** કોમ્પ્યુટર થાક અને એકાગ્રતાની સમસ્યાથી મુક્ત (૫૨) છે જો તેને એક કરોડ સુધીની ગણતરી કરવાની હોય તો પણ તે પ્રથમ અને અંતિમ ગણતરી એક સમાન ચોક્સાઈઝ અને ગતિથી જ કરે છે.
- ૫) **વિશેષ પ્રતિભા :** કોમ્પ્યુટર વિભિન્ન પ્રકારનાં કાર્ય જરૂરથી, ચોક્સાઈઝ પૂર્વક અને થાક્યા વિના કરે છે. કોઈ પણ સંસ્થામાં એક જ કોમ્પ્યુટરના વિવિધ ઉપયોગો જેવા કે હિસાબો



નોંધ




કરવા, રમત, ગમત, વીજળીના બિલ તૈયાર કરવા ઇન્ફેલ મોકલવો વગેરે માટે ઉપયોગ કરવામાં આવે છે.

- ૬) **સંચારનું માધ્યમ :** વર્તમાન સમયમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શક્તિશાળી સંચારના સાધનના રૂપમાં કરવામાં આવે છે. કાર્યાલયના તમામ કોમ્પ્યુટર એકબીજાના કેબલ માધ્યમથી જોડાયેલા હોય છે અને કોમ્પ્યુટરના નેટવર્કના માધ્યમથી એકબીજા સાથે વાતચીત કરવી સંભવિત છે.
- ૭) **પ્રોસેસીંગ પાવર :** સાંપ્રત સમયમાં કોમ્પ્યુટર ઘણા વિકસીત બન્યા છે. તેની શરૂઆત ફક્ત પ્રયોગશાળાઓમાં પ્રોટોટાઇપ સ્વરૂપે થઈ ત્યાર પછી વેપાર ધંધાઓમાં ઉપયોગમાં શરૂ થયો અને આજે તો દરેક જગ્યાએ તેનો ઉપયોગ વધી ગયો છે. સમય પરિવર્તન સાથે સાથે કોમ્પ્યુટર હવે ખૂબ જ ઝડપી, નાના, સસ્તા અને વિશ્વનીય તથા પ્રયોગ (કામ) કરવામાં સરળ પડે તેવા બન્યા છે.

૧૬.૨ કોમ્પ્યુટરના ભાગો :

કોમ્પ્યુટરના મુખ્ય ભાગ હોય છે જેમ કે.. ઇનપુટ યુનિટ, મુખ્ય પ્રોસેસીંગ યુનિટ અને આઉટપુટ યુનિટ, રેખાચિત્રના માધ્યમથી તેને આ પ્રકારે દર્શાવી શકાય છે.



ઇનપુટ :

આ ભાગમાં વિભિન્ન સાધનો દ્વારા કોમ્પ્યુટરમાં માહિતી પ્રાપ્ત કરી શકાય છે. મુખ્ય ઇનપુટ સાધનોમાં કી-બોર્ડ, માઉસ અને સ્કેનર છે. અન્ય સાધનોમાં ચુંબકીય ટેપ, ચુંબકીય ડિસ્ક, લાઇન પેન, બારકોડ રીડર, સ્માર્ટ કાર્ડ રીડર વગેરે છે આ ઉપરાંત પણ અન્ય સાધનો છે. કે જે અવાજ અને શારીરિક સ્પર્શ સામે પ્રતિક્રિયા કરે છે. દા.ત. હવાઈ મથકો પર સ્પર્શ પ્રણાલિકી સ્થાપિત કરેલ છે. જેનાથી આગમન અને પ્રસ્થાનની સૂચના ઓનલાઈન પ્રાપ્ત કરી શકાય છે. આ ઇનપુટ ભાગનું કાર્ય ઇનપુટનો સ્વીકાર કરીને તેને બાઈનરી પ્રણાલિકામાં પરિવર્તિત કરવાનો છે.

મુખ્ય પ્રોસેસીંગ યુનિટ : (સીપીયુ.)

સીપીયુ કોઈપણ કોમ્પ્યુટરનું નિયંત્રણ કેન્દ્ર છે તે માર્ગદર્શન આપે છે, નિર્દેશ કરે છે અને તેના

કોમ્પ્યુટર પર નામુ'

પ્રદર્શનને નિયંત્રીત કરે છે. સાચા અર્થમાં તે કોમ્પ્યુટરનું મસ્તીજી છે. કોમ્પ્યુટરના મુખ્ય ભાગમાં મુખ્ય પ્રોસેસીંગ અગત્યનો ભાગ છે. તેનો ઉપયોગ પ્રોગ્રામ, ફોટો, ગ્રાફિક્સ અને ટેટાનો સંગ્રહ કરવાનું છે તથા પ્રોગ્રામના નિર્દેશનું પાલન કરવાનું છે. તેને પણ મુખ્ય ભાગોમાં વિભાજિત કરી શકાય છે.

- નિયંત્રિત એકમ: નિયંત્રીત એકમ કોમ્પ્યુટરના તમામ ઘટકોની ગતિવિધિને નિયંત્રણ તથા તેમની વચ્ચે સમન્વય સ્થાપિત કરે છે.
- સ્મૃતિ એકમ: વાસ્તવમાં આ એકમ ટેટાને પ્રોસેસ (કાર્યરત) કરતા પહેલા સંગ્રહ કરે છે. કોમ્પ્યુટરના સ્મૃતિ વિભાગમાં આ પ્રમાણે સંગ્રહિત ટેટાને સૂચના અનુસાર કાર્યરત કરવામાં આવે છે. આ પ્રકારની સૂચનાઓ પણ કોમ્પ્યુટરના મેમરી વિભાગમાં અગાઉથી (ટેટાની પહેલા) દાખલ કરેલી હોય છે.
- એક ગાણિતિક અને તાર્કિક એકમ: આ એકમ તમામ અંકગાણિતિક અને તાર્કિક ગણતરી જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવા કાર્યોંસંપન્ન કરવા જવાબદાર છે. તેમાં તાર્કિક કાર્યો જેવા કે ચલીત એકમો અને માહિતીની તુલના વગેરે પણ કરે છે.

આઉટપુટ યુનિટ :

આ એકમ ટેટાની પ્રોસેસ (પ્રક્રીયા) પછી મનુષ્યને વાંચી શકાય તેવા સ્વરૂપમાં તેના પરિવર્તનને સુનિશ્ચિત કરે છે. જેનાથી પ્રયોગ કર્તાને સમજ શકે છે. આઉટપુટ સાધનોના રૂપમાં સામાન્ય રીતે પ્રયોગમાં આવવાવાળા ઉપકરણોમાં મોનીટર, પ્લોટર, પ્રિન્ટર અને સ્પીકર વગેરે છે.



પાઠ સ્વાધ્યાય ૧૬.૧

યોગ્ય શાખ મૂકી ખાલી જગ્યાઓ પૂરો :

- કોમ્પ્યુટર તીવ્ર ગતિથી ટેટા..... ઇલેક્ટ્રોનિક મશીન છે.
- કોમ્પ્યુટરના તમામ કાર્યો..... થી થાય છે અને તે પ્રકાશની ગતિ જેટલી ઝડપી ગતિથી કરે છે.
- કોમ્પ્યુટર અને એકાગ્રતાની ખામીથી મુક્ત છે.
- માહિતીના આદાન પ્રદાન માટે કોમ્પ્યુટરનો શક્તિશાળી..... માધ્યમના રૂપમાં પ્રયોગ થઈ રહ્યો છે.
- અધિકાંશ ઇનપુટ ઉપકરણોમાં કી-બોર્ડ..... અને સ્કેનરનો સમાવેશ થાય છે.

મોડચ્યુલ - ૬

કોમ્પ્યુટર પર નામુ'



નોંધ



નોંધ

૬. મુખ્ય પ્રોસેસરીંગ એકમ કોમ્પ્યુટર માટે એવું છે જેમ કે માનવ શરીર માટે.....
૭. સામાન્ય રીતે આઉટપુટ ઉપકરણોમાં.....તથા પ્રિન્ટરનો સમાવેશ થાય છે.

૧૬.૩ કોમ્પ્યુટરની મર્યાદાઓ :

કોમ્પ્યુટરના અવરોધક પરિબળોમાં મુખ્યતા : તેની આસપાસનું વાતાવરણ છે જ્યાં તેને મૂકવામાં આવે છે તેના અન્ય કેટલાક અવરોધકો નીચે પ્રમાણે પણ છે.

૧. અધતન રાખવા માટેની ઉંચી કિંમત : કોમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેરના નવા બદલાતા સમય સાથે તેને અધતન રાખવું આવશ્યક છે. આથી જૂની પદ્ધતિઓના હાર્ડવેર અને સોફ્ટવેરને બદલે નવા ખરીદવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે.
૨. તાલીમનો મોટો ખર્ચ : નામાના હિસાબો માટે કોમ્પ્યુટરનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે નવા નવા હાર્ડવેર અને સોફ્ટવેર ઉપલબ્ધ થઈ રહ્યા છે તેના માટે તાલીમ પણ આવશ્યક છે. કાર્યકર્તાઓને આ તાલીમ આપવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે.
૩. સ્વનિર્ણય સંભવિત નથી: કોમ્પ્યુટર મનુષ્યની જેમ નિર્ણય લઈ શકતો નથી તેને ઉપયોગ કરનાર દ્વારા નિર્દેશિત કરવો પડે છે અને તે ફકત તે જ યુક્તિ પ્રમાણે કાર્ય કરી શકે છે જે પ્રમાણે તેને કામ કરવા માટે પ્રોગ્રામ આપવો પડે છે.
૪. મોંઢી સાર-સંભાળ : કોમ્પ્યુટરની ક્ષમતાને કાયમ રાખવા માટે તેની યોગ્ય સારસંભાળ આવશ્યક છે તેની કાર્યક્રમતા જળવાઈ રહેતે માટે સાફ્ટ, સ્વચ્છ અને નિયંત્રીત તાપમાનની આવશ્યકતા હોય છે તેને કારણે તેની સાર સંભાળ ખૂબ જ મોંઢી બની જાય છે.
૫. સ્વાસ્થ્ય માટે હાનિકારક : કોમ્પ્યુટરના વધારે પડતા ઉપયોગથી કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેમ કે માસપેશીઓમાં દર્દ, આંખોમાં ઝાંખપ અને કમરદર્દદ વગેરે તે કાર્યકુશળતા પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે જેનાથી ચિકિત્સાના પ્રશ્ન વધારો થાય છે.

૧૬.૪ નામામાં કોમ્પ્યુટરનો ઉપયોગ :

નામામાં વ્યવહારો નોંધવાની બાબતમાં સૌથી લોકપ્રીય પદ્ધતિ એ માનવીય પ્રણાલી છે જેમાં ખાતાઓની સારસંભાળ જેમ કે રોજમેળા, રોકડ પત્રક, વિશેષ ઉદ્દેશ્યવાળા પત્રકો, ખાતાવહી વગેરે શામેલ છે. લેખનકાર (વહીવટદારને) લેવડ ડેવડ અને વિવરણોનો માનવીય સારાંશ તૈયાર કરવાની આવશ્યકતા પડે છે. આધુનિક તકનિકીથી વિકસીત કેટલાંક મશીનો હિસાબને લગતા વિભિન્ન કાર્યો કરવામાં સક્ષમ છે. દા.ત. એક બિલીંગ મશીન જેને કોમ્પ્યુટરના સ્વરૂપે ઓળખી શકાય છે આ મશીન યોગ્ય વળતર, વ્યાજનો દર, કુલ રકમનો સરવાળો ઉમેરવા તેમજ અપેક્ષિત સંબંધિત ખાતાઓમાં તેની ખતવજી કરવા અત્યંત સક્ષમ છે.



કોમ્પ્યુટર પર નામુ'

નાણાંકીય વ્યવહારોની સંખ્યામાં વૃધ્ઘની સાથે એક એવું મશીન વિકસીત કરવામાં આવે હતું કે જે હિસાબના તેટાને ઓછા સમયમાં ગ્રહણ અને કાર્યરત કરી શકે છે. આ પ્રકારની પ્રગતિથી ઉદ્યોગોમાં સફળતામાં વૃધ્ઘ થઈ. આ મશીનનું એક નવું સંસ્કરણ (આવૃત્તિ) ઝડપી ગતિ, વધારે સંગ્રહશક્તિ અને પ્રોસેસ (પ્રક્રિયાની) ક્ષમતાની સાથે વિકસીત કર્યું છે. આમાં બધા મશીનો એક કોમ્પ્યુટરથી જોડાયેલા હોય છે. જ્યાંથી તેમનું સંચાલન થાય છે પરિણામ સ્વરૂપે હિસાબી ચોપડાઓની જાળવણી કોમ્પ્યુટર ફૂટ હિસાબી પદ્ધતિ (કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટ)ને કારણે વધુ સુવિધાજનક બની ગઈ.

કોમ્પ્યુટર ફૂટ નામું તેટાબેઝીની સંકલ્પનાનો ઉપયોગ કરે છે. આ હેતુ માટે હિસાબી સોફ્ટવેરનો ઉપયોગ લાગુ કરવામાં આવે છે. તેનાથી રોજમેળ, ખાતાવહી વગેરે તૈયાર કરવાની આવશ્યકતા દૂર થઈ જાય છે. જે હસ્તલીખીત હિસાબોમાં મુખ્ય ભાગો છે. સાધારણ રીતે હિસાબો (નામા)માં પ્રયોગ થવાવાળા મુખ્ય સોફ્ટવેરોમાં ટેલી, કેશ મેનેજર, બેસ્ટ બુક્સ, બીજી વગેરે છે.

હિસાબો (નામા)માં કોમ્પ્યુટરના ઉપયોગ નીચે પ્રમાણે છે.

1. હિસાબી દસ્તાવેજો તૈયાર કરવા : કોમ્પ્યુટર કેશ મેમો, બિલબુક વગેરે હિસાબી કાગળો અને વાઉચર (પ્રમાણકો)ને તૈયાર કરવામાં સહાયતા કરે છે.

2. ધંધાકીય વ્યવહારોની નોંધ જાળવવી : દરરોજ કોમ્પ્યુટર સોફ્ટવેરની સહાયતાથી ધંધાકીય વ્યવહારની નોંધ કરી શકાય છે. ટાઈક યોજનાનો પ્રયોગ કરીને ખાતાઓ અને વ્યવહારોની નોંધ લીપીબધ (કોડબદ્ધ) કરવામાં આવે છે. પ્રત્યેક ખાતા અને લેવડ ડેવડને એક વિશિષ્ટ કોડ આપવામાં આવે છે જેથી આ ખાતું એક સમૂહ વિશેષમાં મૂકી શકાય છે. આ પ્રક્રિયા લેવડડેવડને લીપીબધ કરવાની યુક્તિને સરળ બનાવે છે.

3. કાચુ સરવૈયું અને નાણાકીય પત્રકો બનાવવા : હિસાબી વ્યવહારો (લેવડ ડેવડ)ને લીપીબધ કર્યા પછી તેટા કોમ્પ્યુટર દ્વારા પોતાની જાતે જ તે ખાતામાં સ્થાનાંતર થઈ જાય છે કોમ્પ્યુટર દ્વારા રેકોર્ડને ચોક્સાઈથી તપાસવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચા સરવૈયાની સહાયતાથી વેપાર, લાભ અને નુકશાન તથા સ્થાયી મિલકતનું વિવરણ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

૧૬.૫ કોમ્પ્યુટર ફૂટ નામુ:

લેવડ ડેવડ પ્રક્રિયા પ્રણાલી (Transaction Processing system) (ટીપીએસ) કોમ્પ્યુટર

મોડચ્યુલ - ૬

કોમ્પ્યુટર પર નામુ'



નોંધ



નોંધ

કૃત છિસાબી પ્રણાલિનું પ્રથમ ચરણ છે ટીપીએસ નો ઉદ્દેશ્ય લેવડ ડેવડનો રેકોર્ડ, પ્રક્રિયા કરવી, ખરાઈ કરવી અને સંગ્રહિત કરવાનો છે જે વ્યવસાયના વિભિન્ન કાર્યાત્મક ક્ષેત્રોમાં પુનઃ ઉપલબ્ધ કરી વપરાશમાં લેવામાં આવે છે લેવડ ડેવડની પ્રક્રિયામાં ટીપીએસ ના વિભાગો નીચે પ્રમાણ છે.

ટેટા પ્રવેશ, ટેટાની ખરાઈ પ્રક્રિયા અને પુનઃ ખરાઈ, સંગ્રહ, માહિતી અને રીપોર્ટીંગ આ લેવડ ડેવડની પ્રક્રિયા પ્રણાલી (ટી. પી. એસ.) માંથી એક છે જે નાણાકીય લેવડ ડેવડ સંબંધિત છે. જ્યારે કોઈ પ્રણાલી ફક્ત મનુષ્ય દ્વારા ચલાવવામાં આવે છે ત્યારે તેને માનવીય પ્રણાલી કહેવામાં આવે છે. પરંતુ જ્યારે તેમાં મનુષ્ય અને કોમ્પ્યુટર બજેનો ઉપયોગ થાય છે ત્યારે તે કોમ્પ્યુટર આધ્યારિત પ્રણાલી કહેવાય છે. આ પાસાઓની વ્યાખ્યા બેંક ગ્રાહક દ્વારા સ્વચ્છિત ગણક મશીન એટીએમ ના ઉદાહરણ દ્વારા કરી શકાય છે.

૧. **ટેટા એન્ટ્રી :** ટેટા એન્ટ્રીને પ્રવેશ માનવામાં આવે છે ગ્રાહક એટીએમની સુવિધાનો પ્રયોગ ધનરાશી (રૂપીયા) લેવા માટે કરે છે ગ્રાહક દ્વારા અપનાવેલા પગથીયા (પદ્ધતિ)થી ટેટા તૈયાર થાય છે જે કોમ્પ્યુટર કૃત પોતાના બેંક એકાઉન્ટ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.
૨. **ટેટાની સર્ચાઈ :** આ પૂર્વનિર્ધારિત માનકો અથવા ઉપલબ્ધ ટેટાની તુલના દ્વારા ઇનપુટ ટેટાની શુધ્યતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. આ સર્ચાઈનું નિર્ધારણ એરર ડિટેક્શન અને એરર કનેક્શન પદ્ધતિઓ દ્વારા થાય છે. નિયંત્રણ તંત્ર જેવા ઉપયોગ પૂર્વ નિર્ધારિત માનદંડો દ્વારા ખામીઓનું વિશ્લેષણ કરવા તથા અની સાથે ઇનપુટ ટેટાની તુલના કરવા માટે કરવામાં આવે છે જો કે સાચી પદ્ધતિજ સાચા ટેટા પ્રવેશનો સુઝાવ આપે છે. ગ્રાહકનો વ્યક્તિગત ઓળખાણ કમાંક (પીન) (Personal Identification No) પૂર્વનિર્ધારિત ટેટા સાથે ચકાસવામાં આવે છે. જો તે ખોટો હોય તો પીનને માટે સૂચના આપવામાં આવે છે. પીનની સાચી ખરાઈ કર્યા બાદ ધનરાશીની લેવડ સુનિશ્ચિત કરવા માટે ખરાઈ કરવામાં આવે છે કે જાવક પૂર્વ નિર્ધારિત કરતા વધારે ન હોય.
૩. **પ્રક્રિયા અને પુનઃ ચકાસણી :** જો સાચો ટેટા એન્ટર કર્યો હોય તો ઓનલાઈન વિનિમયના કિસ્સામાં ટેટાની પ્રક્રિયા લગભગ તરત જ શરૂ થઈ જાય છે. આને ઇનપુટની માહિતી ચકાસણી કહે છે. ત્યારબાદ પુનઃ ચકાસણીની પ્રક્રિયા દરમ્યાન સુનિશ્ચિત કરવામાં આવે છે કે પેસાની લેવડ પૂર્ણ થઈ છે કે નહી તેને આઉટ પુટની માહિતીની ચકાસણી કરવાનું કહે છે.
૪. **સંગ્રહ :** ઉપર બતાવ્યા પ્રમાણે, પ્રક્રિયા પામેલ કારણે નાણાકીય લેવડ ડેવડનો ટેટા તૈયાર થાય છે. જેમ કે ગ્રાહક દ્વારા વિશેષ પેસાનો ઉપાડ કોમ્પ્યુટર કૃત વ્યક્તિગત બેંકિંગ પ્રણાલીના માધ્યમથી લેવડ ડેવડ કે ટેટા બેઝમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ



કોમ્પ્યુટર પર નામું

બાબત સ્પષ્ટ કરે છે કે ફક્ત સાચી માહિતીનો જ સંગ્રહ થાય છે.

૫. માહિતી : સંગ્રહિત તેટાનો કવેરી સુવિધાનો ઉપયોગ કરી ઈચ્છીત જાણકારી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી તેનો પ્રયોગ કરવામાં આવે છે.
૬. રીપોર્ટિંગ : આવશ્યક સૂચના સામગ્રીના આધાર પર રિપોર્ટની નિષાયિક ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને જ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.



પાઠ સ્વાધ્યાય ૧૬.૨

સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરો

૧. કોમ્પ્યુટર હાર્ડવેર અને..... યોગ્ય સમયે અઘાતન કરવા આવશ્યક છે.
૨. મનુષ્યની જેમ સ્વયં નિષાય લઈ શકતું નથી.
૩. નેક્શાળતાપૂર્વક કાર્ય કરવા માટે સાઝ, સ્વચ્છ અને નિયંત્રિત તાપમાન જોઈએ.
૪. લેખાંકન, લેવડ ડેવડની અભિલેખનની સૌથી લોકપ્રિય પ્રણાલી છે.
૫. કોમ્પ્યુટરીકૃત હિસાબ (નામુ) ની સંકલ્પના/ખ્યાલનો પ્રયોગ કરે છે.
૬. હિસાબ (નામા)માં નો પ્રયોગ કોમ્પ્યુટરીકૃત નામાને લાગુ કરવા માટે કરવામાં આવે છે.

૧૬.૬ કોમ્પ્યુટર કૃત નામાની આવશ્યકતા અને કોમ્પ્યુટર કૃત નામાની જરૂરિયાત

શુદ્ધતા અને વ્યાવસાયિક લેવડ ડેવડની ઓદશામાં ઓછી દેખરેખને કારણે થઈ છે તેને વિસ્તારપૂર્વક નીચેની રીતે સમજાવી શકાય :

૧. અગણિત લેવડ ડેવડ : કોમ્પ્યુટર કૃત નામા પ્રણાલી મોટી સંખ્યામાં લેવડ ડેવડને ગ્રહયી અને ચોકસાઈ પૂર્વક કરવા માટે સક્ષમ છે.
૨. ત્વરિત રીપોર્ટિંગ : તેની ગ્રાપ અને ચોકસાઈ કારણે કોમ્પ્યુટર કૃત હિસાબ (નામા) દ્વારા ગ્રાપી અને ગુણાત્મક રીપોર્ટ પ્રાપ્ત કરી શકાય છે.
૩. કાગળ પર કરાતા કાર્યોમાં કાપ : માનવીય લેખન પ્રણાલીમાં લેખો/પુસ્તકો અને વાઉચરો/ દસ્તાવેજોને રાખવા માટે વિશાળ ભૌતિક સંગ્રહ સ્થાનની આવશ્યકતા પડે છે સ્ટેશનરી અને લેખો, ચોપડાઓ ઉપરાંત પૂરાવાની આવશ્યકતા ચોકસ સમય સુધીની લેવડ ડેવડની માત્રા સંખ્યા પર નિર્ભર કરે છે. કાગળ પરના કાર્ય ઓદશા કરવાની અને લેખો / ચોપડાઓની માત્રા ઘટાડવાની જરૂર છે. આ ફક્ત કોમ્પ્યુટર કૃત હિસાબી પ્રણાલીના પ્રયોગથી જ સંભવ બને છે.

મોડચ્યુલ - ૬

કોમ્પ્યુટર પર નામું



નોંધ

મોડયુલ - ૬

કોમ્પ્યુટર પર નામું



નોંધ

કોમ્પ્યુટર પર નામું

૪. સુવિધાજનક રીપોર્ટ: માનવીય લેખન પ્રણાલીની તુલનામાં કોમ્પ્યુટર કૃત લેખન પ્રણાલી ઘણી જ સુવિધાજનક છે. માનવીય લેખન પ્રણાલીના રીપોર્ટથી બાકી રકમની જાણકારી સમયાંતરે મળે છે જ્યારે કોમ્પ્યુટર કૃત લેખન પ્રણાલીમાં કોઈ પણ સમય માટે જે હિસાબો તેમાં છે તેનો રીપોર્ટ તૈયાર કરવા તે સક્ષમ છે.
૫. ઓન લાઈન સુવિધા: કોમ્પ્યુટર કૃત લેખન પ્રણાલી લેવડ ડેવડના ડેટાને સંગ્રહીને અને પ્રાક્ટિકા કરવામાં ઓનલાઈન સુવિધા પ્રદાન કરે છે. જેથી સૂચનાનો પ્રયોગ બીજો રીપોર્ટ જોવા માટે અથવા જાણવા માટે બનાવી શકાય છે.
૬. માપન શક્તિ: કોમ્પ્યુટર કૃત હિસાબી પ્રણાલી સંપૂર્ણરીતે વેપાર ધંધાની ખૂબ જ ઝડપથી વધતી લેવડ ડેવડ કે બ્યબહારોને સંપૂર્ણ રીતે સંચાલીત કરવા તૈયાર છે. હિસાબી વિભાગમાં અન્ય કર્મચારીઓની આવશ્યકતા ફક્ત ડેટા ઓપરેટરની પ્રવૃત્તિઓ સુધી સીમીત છે. જેમની જરૂરિયાત વધારાના વાઉચર સંભાળવા માટે છે. તથા આ માટે વધુ ખર્ચ પણ થતો નથી.
૭. ચોક્સાઈ : કોમ્પ્યુટર કૃત લેખન પ્રણાલી દ્વારા તૈયાર માહિતી સૂચના શુદ્ધ હોવાને કારણે ભરોસા પાત્ર હોય છે. માનવીય હિસાબી પદ્ધતિ ખૂબ ભરેલી, વિકૃત અને અશુદ્ધ હોવાની સંભાવના રહે છે. એટલા માટે તે અવિશ્વસનીય હોય છે તેનું કારણ એ છે કે કોઈ વ્યક્તિનો લેવડ ડેવડનો ડેટા ઘણો વિશાળ હોવાને કારણ રિપોર્ટ કરતી વખતે ખૂબ કરી બેસીએ છીએ.
૮. સલામતી: માનવીય હિસાબી પ્રણાલી અંતર્ગત સૂચનાની સલામતી જાળવવી ઘણી કરીન છે કારણ કે તેને તેની સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે. જ્યારે કોમ્પ્યુટરકૃત પ્રણાલીમાં ફક્ત અધિકૃત ઉપયોગ કર્તાઓને જ હિસાબી ડેટાના ઉપયોગનો આદેશ હોય છે માનવીય હિસાબી પ્રણાલીની સુરક્ષાની તુલનામાં કોમ્પ્યુટર કૃત હિસાબી પ્રણાલીની સુરક્ષા ઘણી વધારે સારી છે.

૧૬.૭ કોમ્પ્યુટર કૃત હિસાબી પ્રણાલીની આધારભૂત આવશ્યકતાઓ

કોઈ પણ કોમ્પ્યુટર કૃત હિસાબી પ્રણાલીની આધારભૂત આવશ્યકતાઓ નીચે પ્રમાણે છે.

૧. હિસાબી માળખું : આ કોમ્પ્યુટર કૃત લેખન પ્રણાલીનું માળખું રૂપ રેખા છે. લાગુ પડતી પર્યાવરણની પદ્ધતિ છે. હિસાબી સિધ્યાંતો, કોડિંગ અને સમૂહ પદ્ધતિના સંદર્ભમાં એક સ્વસ્થ હિસાબી માળખું હોવું તે પૂર્વનિર્ધારિત શરત છે.
૨. સંચાલન પ્રક્રિયા : કોમ્પ્યુટરાઇઝેડ એક્સાઇન્ટ્ઝ સિસ્ટમાં કાર્ય કરવા માટે એક યોગ્ય ઓપરેટેરીંગ એન્વાયરમેન્ટની સાથે સાથે સુનિર્ધારિત અને રૂપ રેખીત ઓપરેટેરીંગ પ્રક્રિયા (સંચાલન પદ્ધતિ) જરૂરી છે. કોમ્પ્યુટર કૃત નામું એક ડેટા બેઝ આધારિત પદ્ધતિ છે.

કોમ્પ્યુટર પર નામું

જેમાં લેવડ દેવડનો ટેટા સંગાઠિત ટેટાબેઝમાં સંગ્રહિત કરવામાં આવે છે. ઉપયોગકર્તાની આવશ્યક ઇન્ટરફેસનો ઉપયોગ કરી ટેટાબેઝ સંચાલિત કરે છે તેની સાથે સાથે તે સંગ્રહિત ટેટાને આવશ્યક સૂચનામાં પરિવર્તન કરીને આવશ્યક રીપોર્ટ પ્રાપ્ત કરે છે.

૧૬.૮ માનવીય નામા અને કોમ્પ્યુટર કૃત લેખાંકનમાં તફાવત:

આધાર	માનવીય લેખાંકન	કોમ્પ્યુટર કૃત લેખાંકન
૧. નોંધ/આળવણી	લેવડ દેવડની નોંધ મૂળ નોંધના ચોપડામાં કરવામાં આવેછે.	તેની લેવડ દેવડની નોંધ સુનિયોજીત ટેટાબેઝમાં કરવામાં આવે છે.
૨. વગ્ફાકરણ	પત્રકોમાં મૂળ નોંધ કર્યી બાદ તેને અલગ અલગ ખાતાવહીમાં ખાતાઓમાં લખવામાં આવે છે.	તેમાં ટેટાની કોઈ ખાતાવહી તૈયાર થતી નથી ખાતાવહી તૈયાર કરવા માટે સંગ્રહિત લેવડ દેવડ ટેટાને વગ્ફાકૃત કરવામાં આવે છે તે કારણે તેને રિપોર્ટના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે.
૩. તારણો	અલગ અલગ ખાતાઓના તારણો પરથી કાચુ સરવૈયુ બનાવવામાં આવે છે.	કાચુ સરવૈયું તૈયાર કરવા માટે ખાતા તૈયાર કરવાની આવશ્યકતા નથી.
૪. સમાયોજન	ઇસાબો સરખા કરવા આ સિદ્ધાંતનું પાલન કરવામાં આવે છે	તેમાં ઇસાબી ખામીઓને દૂર કરવા માટે કોઈ ખાસ હવાલા નોંધની જરૂર નથી.
૫. નાણાંકીય પત્રકો	નાણાંકીય પત્રકોને તૈયાર કરતી વખતે કાચા સરવૈયાની આવશ્યકતા રહે છે	નાણાંકીય પત્રકોને સ્વતંત્ર રૂપે તૈયાર કરવામાં આવે છે.

મોડચુલ - ૬

કોમ્પ્યુટર પર નામું



નોંધ



નોંધ



અભ્યાસ પ્રશ્નો ૧૬.૩

૧. યોગ્ય શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો
 ૧. માનવીય હિસાબી પ્રણાલીમાં લેવડ ડેવડ.....ખાતાઓમાં સંગ્રહિત થાય છે
 ૨. કોમ્પ્યુટર કૃત હિસાબી પ્રણાલીમાં ખાતાવહી તૈયાર કરવી..... માટે આવશ્યક શરત નથી.
 ૩. માટે સક્ષમ છે.
 ૪. નામા પ્રણાલી વિશેષ તેમજ તીવ્ર વિવરણ આપવા સક્ષમ છે
 ૫. કોમ્પ્યુટર કૃત હિસાબી પ્રણાલી..... લેવડ ડેવડના તેટા સંગ્રહ કરવાની સુવિધા આપે છે
 ૬. કોમ્પ્યુટર કૃત હિસાબી પ્રણાલી માનવીય લેખન પ્રણાલીથી..... છે.
 ૭. કોમ્પ્યુટર કૃત હિસાબી પ્રણાલી..... અનુકૂળ અનુપ્રયોગ છે.
૨. બહુવિકલ્પિય પ્રશ્નો:
 ૧. નીચેનામાંથી કઈ કોમ્પ્યુટરની વિશેતા નથી.

(ક) ઝડપ	(ખ) કૃત્રિમ બુધ્યમતા
(ગ) સંગ્રહ	(ધ) ચોક્સાઈ
 ૨. સેન્ટ્રલ પ્રોસેસરીંગ યુનિટ (સીપીયુ) માં સામેલ નથી

(ક) નિયંત્રિત એકમ	(ખ) સ્મૃતિ એકમ
(ગ) એકગણિત ટાઇક્સ એકમ	(ધ) આઉટપુટ એકમ
 ૩. કોમ્પ્યુટરની મુખ્ય મર્યાદા છે

(ક) ઝડપ	(ખ) સંગ્રહ
(ગ) સ્વ નિષ્ઠય શક્તિ	(ધ) ચોક્સાઈ
 ૪. મુખ્ય હિસાબી સોફ્ટવેર છે

(ક) ટેલી	(ખ) વિડો
(ગ) ઇંગ્રી બુક્સ	(ધ) કેટિડ મેનેજર

કોમ્પ્યુટર પર નામું



તમે આટલું શીખ્યા :

- કોમ્પ્યુટર એક એવું ઉપકરણ છે જેનાથી ચોક્કસ નિર્દેશોના કાર્યક્રમના આધારે વિવિધ પ્રકારના કાર્યો કરી શકાય છે તે તેઠાને તીવ્ર ગતિથી પ્રસંસ્કરણ કરવાવાળું ઈલેક્ટ્રોનિક મશીન છે તે તમામ જીવીલ સમસ્યાઓનું સમાધાન કરી શકે છે.
 - કોમ્પ્યુટરની વિશેષતાઓ -ગતિ-સંગ્રહ, વિશ્વવનિયતા-ચોક્કસાઈ-વિશિષ્ટ પ્રતિભા-સંચાર-પ્રસંસ્કર-શક્તિ
 - કોમ્પ્યુટર ના અંગો : ઇનપુટ યુનિટ-સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ-આઉટપુટ યુનિટ-નિયંત્રણ એકમ-સ્મૃતિ અંક ગણિત અને ટાઈપ એકમ.
 - કોમ્પ્યુટરના અવરોધો સારસંભાળની વિશેષ જવાબદારી-સ્થાપના-પ્રાશિક્ષણ-સ્વાસ્થ્ય માટે હાનિકારક, સ્વ-નિષેધ સંભવ નથી
 - કોમ્પ્યુટર કૃત નામું: લેણ દેણ પ્રસંસ્કરણ પ્રણાલી (ટીપીએસ) કોમ્પ્યુટર કૃત નામા પ્રણાલિનું પ્રથમ ચરણ છે.
 - કોમ્પ્યુટર હિસાબી આવશ્યકતા-કાગળ પર ના કાર્યોમાં કામ-રીપોર્ટ-ઓનલાઈન સુવિધા-પરિશુદ્ધતા-રેકોર્ડની સુરક્ષા- લેવડ ડેવડની રિપોર્ટીંગ સુવિધા.
 - હસ્તલિખીત નામું અને કોમ્પ્યુટર કૃત નામા વચ્ચે નાણાકીય પત્રકોની નોંધ, વર્ગીકરણ, તારણ અને હવાલાના સંદર્ભમાં તફાવત નક્કી કરવો.



पाठ्यांत स्वाध्याय :

- (૧) કોમ્પ્યુટર એટલે શું
 - (૨) કોમ્પ્યુટરની વિશેષતાઓ જણાવો
 - (૩) કોમ્પ્યુટરના અંગો જણાવો
 - (૪) કોમ્પ્યુટરની મયૂનાઓ જણાવો

મોટયુલ - ૬

કોમ્પ્યુટર પર નામું



મોડયુલ - ૬

કોમ્પ્યુટર પર નામું



નોંધ

કોમ્પ્યુટર પર નામું

- (૫) નામામાં કોમ્પ્યુટરની ભૂમિકા સમજાવો.
- (૬) હસ્તાલિખિત નામા અને કમ્પ્યુટરાઈઝ નામા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
- (૭) કોઈપણ કમ્પ્યુટરાઈઝ એકાઉન્ટીંગ પદ્ધતિ માટેની મૂળજૂત જરૂરિયાતો જણાવો.
- (૮) કમ્પ્યુટરાઈઝ એકાઉન્ટીંગ પદ્ધતિના લાગુકરણને ટૂંકમા સમજાવો.
- (૯) લેવડાફડ પ્રક્રિયા પ્રણાલીના પગથિયા વર્ણવો
- (૧૦) કમ્પ્યુટરાઈઝ એકાઉન્ટીંગ પદ્ધતિની જરૂરીયાત શા માટે છે તે સમજાવો.



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

૧૬.૧ (૧) પ્રક્રિયા (૨) વિધૂતથી ચાલતું (૩) થાક (૪) સંચાર (વાતચીત) (૫) માઉસ
(૬) માસ્ટિષ્ફ (૭) મોનિટર

૧૬.૨ (૧) સોફ્ટવેર (૨) કમ્પ્યુટર (૩) કમ્પ્યુટર (૪) મેન્યુઅલ (૫) ટેલાબેઝ
(૬) સોફ્ટવેર

૧૬.૩ (૧)

(૧) મૂળકોપી (૨) કાચું સરવૈયુ (૩) ખાતા નંબર (૪) કમ્પ્યુટરકૃત (૫) ઓનલાઇન
(૬) સુપીરીયર (ચરીયાતો) (૭) ટેલાબેઝ

૧૬.૩ (૨)

(૧) બી (૨) ડી (૩) સી (૪) એ (૫) ડી

તમારા માટે પ્રવૃત્તિઃ

તમારા ઘરની નજીકની દુકાન કે ધંધાકીય એકમની મુલાકાત લો કે જેમાં હિસાબો રાખવા
માટે કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય અને હસ્તાલિખિત નામા કરતાં કમ્પ્યુટરાઈઝ નામાના
દસ ફાયદાઓ નોંધો.



ટેલીનો પરિચય

અગાઉ આપણે જોઈ ગયા તેમ દીનોંથી નામા પદ્ધતિમાં ખાતાવાહી કેવી રીતે જાળવીએ છીએ. પણ આપણે બધા જાડીએ છીએ તેમ જો થોડોક નાનો તફાવત ખાતાવાહીમાં રહી જાય તો તેને કારણે કેટલો બધો સમય વેડફાય છે. ટેલી પ્રોગ્રામ તે આ બધા પ્રશ્નોનું નિરાકરણ છે. આપણે ટેલીમાં કોઈપણ વ્યવહારની એન્ટ્રી કરીએ તો તેની ખતવણી બે બાજુએ થાય છે એક તો ખાતામાં અને બીજી ટ્રાયલ બેલેન્સ (કાચી ખાતાવાહી) માં થાય છે. આ વ્યવહાર બે બાજુમાં પોછીંગ થાય છે એક તો વ્યાપાર અને નફા-નુકશાન ખાતામાં અને સરવૈયામાં. પણ જો આપણે થોડીક એન્ટ્રી કર્યા પછી કાચી ખાતાવાહી અને સરવૈયુ જોવું હોય તો આપણે ફક્ત થોડીક જ કી દબાવી પડે છે એટલે આપણે કહી શકીએ કે ટેલી આપણા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરે છે.



હેતુઓ :

આ પાઠ વાંચ્યા પછી તમે કરી શકશો

- ટેલીનો અર્થ સ્પષ્ટ કરી શકશો
- ટેલીની વિશાષ લાક્ષણિકતાઓ બતાવી શકશો
- ટેલી શરૂ કરવા પૂર્વના મહત્વના પગલા બતાવી શકશો
- ટેલી શરૂ કરી શકશો
- ટેલી ચાલુ કરવાના મહત્વના પગલા બતાવી શકશો
- કંપની કેવી રીતે ખોલવી
- કંપની માહિતી એટલે શું
- ઝડપી ટેલીમાં કામ થઈ શકે તે માટેની શોર્ટકટ કી

૧૭.૧ ટેલીનો અર્થ

ટેલી તે છિસાબ-કિતાબ (એકાઉન્ટ) નો સોફ્ટવેર પ્રોગ્રામ છે અને તેને એવી રીતે બનાવ્યો છે કે જેનાથી આપના તમામ ધંધાકીય વ્યવહારોને સંગઠીત તથા સ્વયંસંચાલિત (ઓટોમેટેડ) બની જાય. દરેક ધંધામાં અલગ અલગ પ્રકારના નાણાકીય વ્યવહારો તથા તેની સાદી અને જટીલ

પ્રક્રિયા હોય છે. જેમ જેમ તમારા ધ્ંધાનો વિકાસ થાય, તેમાં નવા ગ્રાહકો ઉમેરાય અને ધ્ંધો નવા બજારમાં પ્રવેશ કરે તેમ તેમ તમારે ધ્ંધાના વ્યવહારો અને માલસામાનના બિલો અત્યંત ચોક્સાઈપુણી રીતે તેમજ તદન અધતન રીતે જાળવવા પડે છે. સાથે સાથે તમારે રોજે રોજનો નાણાકીય તથા વસ્તુઓની જથ્થાનો રેકૉર્ડ વ્યવસ્થિત રાખવો પડે છે. એકઉન્ટોગનો આ પ્રોગ્રામ ટેલી આપણા ધ્ંધાના દરેક વ્યવહારોને સાદગીપૂર્ણ અને સુગ્રાયિત બનાવવામાં મદદરૂપ થાય છે અને તેમને સરળ અને ઓછા ખર્ચમાં કાર્યક્રમ બનાવવામાં મદદરૂપ થાય છે. ટેલી ઈ.આર.પી-૮ એ ટેલી પ્રોગ્રામની એકદમ નવી આવૃત્તિ છે કે જેનાથી આપણા ધ્ંધાના બધા જ વ્યવહારો ખુબ જ ઝડપથી અને સહેલાઈથી તથા ધણા બધા નવા વ્યુહ સાથે આપણે કરી શકીએ છે. આ પ્રોગ્રામમાં એક કરતા વધારે કંપનીઓમાં ખાતાઓ એક સાથે રાખી તેમાં કામ થઈ શકે છે તે ધણું જ સાદું અને સરળ છે જેમાં આપણી માહિતી જુદા જુદા ફોર્મેટમાં એન્ટર કરી શકીએ છીએ અને વધારે કંપનીમાં માહિતી કોઈપણ સમયગાળા માટે તથા એક કરતા વધારે નાણાકીય વર્ષ માટેની માહિતી જોઈ શકો છો તેની ખાતાવહી રાખી શકો છો અને રીપોર્ટ મેળવી શકો છો.

૧૭.૨ ટેલીની વિશિષ્ટતા

ટેલીની વિશિષ્ટતા નીચે મુજબ છે

- ૧) તેમાં પ્રાથમિક બધા જ ખાતાના ચોપડાઓ રહી શકે છે જેમ કે કેશ બુક અને બેન્ક બુક
- ૨) ટેલીમાં દરેક નોંધ જાળવી શકાય છે જેમ કે ખરીદ નોંધ, વેચાણ નોંધ અને આમનોંધ
- ૩) ટેલીમાં દરેક નાણાકીય પત્રકો બની શકે છે જેમ કે સરવેયુ, નફા અને નુકશાન ખાતું અને કાચુ સરવેયુ, રોકડ પ્રવાહિતતા (રોકડ પ્રવાહિતતા પત્રકમાં આપણે રોકડ કર્યા જઈ રહી છે તે જોઈ શકીએ છીએ એટલે કે આવેલ અને ગયેલ રોકડ) જથ્થા પત્રક (જથ્થા પત્રકમાં આપણે દરેક વસ્તુઓનો રેકૉર્ડ બરાબર રાખી શકીએ છીએ) અને ગુણાતર પ્રમાણ વિશ્લેષણ
- ૪) ટેલીમાં આપણે બાકી લેણા-દેણાના પત્રકો જાળવી શકીએ છીએ.
- ૫) તેમાં તમારે લેવાના નિકળતા નાણાનો અને આપવાના નિકળતા નાણાની બિલ પ્રમાણે માહિતી મળી શકે છે જેમાં તમને પાર્ટીઓના બનાવેલ ચુપ પ્રમાણે પડા માહિતી મળી શકે છે.
- ૬) તમને જોયતા પત્રકો અહેવાલો કોઈ એક તારીખ માટે અથવા કોઈ તારીખોની સમયગાળા માટે મળી શકે છે
- ૭) તેમાં બેન્ક પત્રક ચોક્સાઈની સવલત પણ ઉપલબ્ધ છે




નોંધ



મોડયુલ - ૬

કોમ્પ્યુટર પર નામું



ટેલીનો પરિચય



પાઠ સ્વાધ્યાય ૧૭.૧

નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જગ્ઘાવો

- ૧) ટેલી એ એકાઉન્ટિંગ માટેનું હાર્ડવેર છે
- ૨) આપણે ટેલીમાં ચીજવસ્તુઓના જથ્થાની માહિતી રાખી શકીએ છીએ.
- ૩) ટેલીમાં બાકી લેણા-ટેણા (આઉટ સ્ટેન્ડિંગ રીપોર્ટ) માટે કોઈ સગવડ નથી
- ૪) ટેલીમાં બેન્ક પત્રક ચકાસણીની સુવિધા ઉપલબ્ધ છે
- ૫) ટેલીમાં બધા જ પ્રાથમિક ચોપડાઓ ખાતાઓ રાખી શકાય છે
- ૬) ટેલીમાં અમુક તારીખ માટેનો રીપોર્ટ મળી શકે છે.

૧૭.૩ ટેલી સાથે કામ કરવાનું શરૂ કરો

સૌથી પ્રથમ આપણે ટેલી ઈ.આર.પી.૮ને તે જે જગ્યાએ અને જેવી રીતે સ્વભાવિક રીતે ઇન્સ્ટોલ થાય છે તેમ ઇન્સ્ટોલ કરો જેમાં ટેલી શરૂઆત કરવા માટેની પ્રોગ્રામ ફાઈલ સેવ થાય છે વપરાશ કરતાં ટેલીના તેટા (માહિતી) અને પ્રોગ્રામ જે ડ્રાઇવમાં રાખવો હોય તે પ્રમાણે તે કરી શકે છે ટેલી ઈ.આર.પી. ૮ ને ઇન્સ્ટોલ કરવામાં એક મીનીટથી પણ વધારે સમય સ્થાનિક હાર્ડડિસ્કમાં લાગતો નથી અને પ્રોગ્રામ ફક્ત ૪૦ એમ. બી. ની જ જગ્યા રોકે છે.

કોમ્પ્યુટરમાં ટેલી ઈ.આર.પી. ૮ ચલાવવા માટે જોઈતા હાર્ડવેરની માહિતી નીચે પ્રમાણે છે.

જરૂરી હાર્ડવેર

લાક્ષણિકતા (કોન્ફીગ્રેશન)

પ્રોસેસર

ઇન્ટેલ પેન્ટ્યુલ ૧૮ અથવા તેનાથી વધારે

મેમરી

૨૫૬ એમ. બી. રેમ અથવા વધારે

હાર્ડડિસ્ક

ઓફામાં અધી ૪૦ એમ. બી. (તેટા વગર)

મોનિટરના રીજયોલયુશન

દર્શાવેલ ૧૦૨૪-૭૬૮ પીકસલ અથવા વધારે

તમે જ્યારે કોમ્પ્યુટરમાં ટેલી ઈ.આર.પી. ૮ ઇન્સ્ટોલ કરો ત્યારે તમારી પાસે આ પ્રોગ્રામ માટે જોઈતા પ્રારંભિક ઉપયોગ કરવાના હક્ક હોવા જોઈએ જેનાથી તમને જોઈતી વસ્તુ અને પત્રકને મળી શકે આ સાથે તમે કોમ્પ્યુટરમાં જે ઓપરેટીંગ સીસ્ટમ વાપરો છે તે ટેલી ઈ.આર.પી. ૮ ને તેની ઘણી ભાષાઓ માટે સપોર્ટ આપે તેવી હોવી જોઈએ.

૧૭.૪ ટેલી ખોલવાના મહત્વના પગલાં

ટેલી ખોલવા માટે નીચે પ્રમાણે કરો


- ૧) ટાસ્કબારમાં સ્ટાટ બટન કલીક કરો, સ્ટાટ મેનુ ખુલશે
- ૨) માઉસથી કરસરને સ્ટાટ મેનુના ઓલ પ્રોગ્રામમાં લઈ જાવ
- ૩) માઉસથી માઉસ પોઇન્ટરને ટેલી ઈ.આર.પી. દા ફોલડરમાં લઈ જઈ કલીક કરો
- ૪) માઉસથી માઉસ પોઇન્ટરને ટેલી ઈ.આર.પી. દા ઓપ્શનમાં લઈ જઈ કલીક કરો


૭.૫ નવી કંપની ખોલવી

ટેલીને સંપૂર્ણ ઇનસ્ટોલ કર્યા પછીનું પ્રથમ કાર્યતે કંપની ખોલવાનું છે. ટેલીમાં કંપની શરૂ કરે છે કે કંપની એટલે એવો એકમ કે જેના માટે તમે છિસાબ જાળવવા માંગો છો. તેમાં મહત્વનું એ છે કે તેમાં તમે કેવા પ્રકારની માહિતી આપવા માંગો છો અને કેવા પ્રકારની માહિતી મેળવવા માંગો છો. આ એક કંપની હોઈ શકે, ભાગીદાર પેઢી હોય, કોઈ ઉત્પાદક કંપની હોય, બ્રાન્ચ ઓફિસ હોય કે લે-વેચની પેઢી હોય તેમાં જોઈતા ખાતા-ચીજવસ્તુ પ્રમાણે કંપની ખોલવી પડે છે.

તો હવે આપણે જોઈએ કે ટેલીમાં કેવી રીતે કંપની ખોલવી

ટેલી સ્ક્રીનના મુખ્ય પાન ઉપર કંપની રચો એવું ઓપ્શન (વિકલ્પ) કંપની ઇનફો ની અંદર દેખાશે.





નોંધ

જ્યારે આપણે કંપની ખોલવી ઓપશનને કલીક કરીશું ત્યારે સ્કીનમાં નીચે દર્શાવ્યા પ્રમાણે વિવિધ વસ્તુઓ દેખાશે.

Company Creation		Ctrl + M	
Directory	C:\Tally.ERP9\Data		
Name			
Mailing & Contact Details		Company Details	
Mailing Name		Currency Symbol	: Rs.
Address		Maintain	<input checked="" type="checkbox"/> Accounts with Inventory
		Financial Year from	: 14-2009
		Books beginning from	: 14-2009
Statutory compliance for	India	Security Control	
State	<input type="checkbox"/> Not Applicable	TallyVault Password (if any)	:
PIN Code		Repeat Password	:
Telephone No.		(WARNING: Forgetting your TallyVault password will render your data unusable!)	
Mobile No.		Use Security Control	? <input type="checkbox"/> No
E-Mail		(Enable Security to avail Tally.NET Features)	
Base Currency Information			
Base Currency Symbol	Rs.	Show Amounts in Millions	? <input type="checkbox"/> No
Formal Name	Indian Rupees	Put a SPACE between Amount and Symbol	? <input type="checkbox"/> Yes
Number of Decimal Places	2	Decimal Places for Printing Amounts in Words	? <input type="checkbox"/> 2
Is Symbol SUFFixed to Amounts ?	<input checked="" type="checkbox"/> No		
Symbol for Decimal Portion	paise		

કેટલીક મહત્વની વસ્તુઓનાં વર્ણન નીચે પ્રમાણે કરેલ છે

નામ : અહીંયા તમારે જે કંપનીનાં રચવી હોય તેનું નામ ટાઇપ કરો. તમે અગાઉ કોઈ નામ લખ્યું હશો તો તે આવી જશે, છતા તમારે તેમાં ફેરફાર કરવો હોય તો કરી શકો છો.

પત્રવ્યવહારનું નામ : આ ઉપર મુજબ જ હોય છે.

સરનામું : અહીંયા તમે પત્ર વ્યવહાર માટેનાં સરનામું લખી શકો છો તેમાં ગમે તેટલી લાઈનનો ઉપયોગ કરી શકો છો

રાખી શકો છો : ટેલીમાં તમે છિસાબો બે જુદી રીતે રાખી શકો છો

- ફક્ત નાણાકીય છિસાબો
- નાણાકીય છિસાબો સાથ. ચીજ-વસ્તુઓની માહિતી

નાણાકીય છિસાબમાં તમે ફક્ત નાણાકીય વ્યવહારો જ રાખી શકો છો તેમાં ચીજ વસ્તુઓની માહિતી મળતી નથી અને બીજા ઓપશન (રીત) માં તમે બધા જ નાણાકીય તેમજ ચિજવસ્તુઓનો છિસાબ રાખી શકો છો.

સલામતીનો ઉપયોગ : આ ઓપશનના ઉપયોગથી તમારા કોમ્પ્યુટરના છિસાબોની માહિતી તમે વિવિધ પાસવર્ડ આપી તે પાસવર્ડના કટાને તેનો ઉપયોગ કરવા દઈ શકો છો

ટેલીનો પરિચય

જરૂરી બધી જ માહિતી ભર્યા પછી તમે એન્ટર દબાવો તેમાં બીજી વિન્ડોસ ખુલશે અને તમે ભરેલ માહિતીના સર્વથન માટે પુછશે

સ્વકાર્ય છે

તા/ના

ઓકે બટન દબાયા પછી અથવા એન્ટર બટન દબાયા પછી કંપની ખુલી જશે.

મોડચ્યુલ - ૬

કોમ્પ્યુટર પર નામું



નોંધ

૧૭.૭ કંપની માહિતી (કંપની ઈ-

આપણે કંપની ખોલી લઈશુ તરત જ કંપની ઈન્ફોના મેન્યુમા નવા ઓપેશન જોવા મળશે આ ઓપેશનનો નીચે પ્રમાણે છે

- કંપની સીલેક્ટ કરો - આ ઓપેશનમાં તમારે જે કંપનીમાં કામ કરવું હોય તેના ઉપર ક્લિક કરો આ કંપની ભલે તમે પહેલા ખોલી હોય તમે જેટલી કંપની ખોલવી છો તે દરેક તેમાં દેખાશો
- કંપની બંધ કરવી - આ ઓપેશન તમને કામ કરતી કંપનીમાંથી બહાર નિકળવાની સવલત આપે છે
- કંપની ખોલવી - (આગળ દર્શાવ્યા પ્રમાણે અને તે જ હેરેંગ પ્રમાણે)
- ફેરફાર (ઓફ્ટર) તમારી ખોલેલી કંપનીમાં ફેરફાર કરવા માટે તમને મંજુરી આપે છે જેનાથી તમે પહેલા ખોલેલી કંપનીમાં ફેરફાર કરી શકો છો.
- સલામતી માટેના તેટામાં ફેરફાર - આ માટે તમે પાસવર્ડ બદલી શકો છો.
- કંપનીના તેટા સ્પીલ કરવા (તેટાના ભાગ કરવા) એક કંપનીમાંથી બે કંપનીઓમાં વહેંચણી કરવી આ ઓપેશનમાં વપરાશ કરીએ આપેલ માહિતી પ્રમાણે કંપની બે ભાગમાં વહેંચાય છે જેમાં પ્રથમ કંપનીનું અંતિમ બેલેન્સ બીજી કંપની માટે પ્રથમ (ઓપનીંગ) બેલેન્સ બને છે
- બેંક અપ (માહિતી લેવી) / રીસ્ટોર (માહિતી નાખવી) આ ઓપેશનમાં વપરાશ કરી તેમણે નાખેલી માહિતી સ્થાનિક હાઇસ્ક્રમાં અથવા બહારના સંશોધન (મીડીયા) માં લઈ શકો છો એક કરતા વધારે કંપનીની માહિતી એક ડિરેક્ટરીમાં લઈ શકે છો

૧૭.૮ શોર્ટ કટ (ઝડપી) કી

ટેલીમાં ઘડી બધી શોર્ટ કટ કી છે આ કીના ઉપયોગથી આપણે સમય બચાવી શકીએ છીએ કેટલીક કી નો વપરાશ નીચે પ્રમાણે છે

મોડયુલ - ૬

કોમ્પ્યુટર પર નામું



ટેલીનો પરિચય

F1 - કંપની સીલેક્ટ કરવા અથવા બંધ કરવા

F2 - તારીખ અને સમયગાળા માટે

F3 - કંપની માટે અને કંપનીની માહિતી માટે

F11 - વિશિષ્ટતાઓ માટે

F12 - લાખણિકતા (કોનફિગાર) માટે

કંપની ખોલ્યા પદ્ધી આપણે આપણું કામ કરી શકીશું તેના માટે પ્રથમ આપણે ખાતા ખોલવા પડશે ત્યાર પદ્ધી તમારે તે ખાતાનો પ્રકાર નાંખવો પડશે તમારે તમારા બધા અંગત અને અંગતની હોય તેવા બધા ખાતા ખોલવા પડશે ટેલીમાં આપણે ફક્ત વાવચરની એન્ટ્રી કરી શકીએ છે કાચુ સરવૈયુ લે-વેચ અને નફા તથા નુકશાન ખાતું સરવૈયુ તેની જાતે જ તૈયાર થાય છે આપણે જ્યારે જોઈએ ત્યારે કાચુ સરવૈયુ અને સરવૈયુ જોઈ શકીએ છે



પાઠ સ્વાધ્યાય ૧૭.૨

યોગ્ય ઓપશન પસંદ કરી જવાબ આપો

- ૧) આપણે કંપનીની માહિતી બદલવી હોય તો ક્યો કમાન્ડ છે ?

(અ) ફેરફાર (ઓલ્ટર) કમાન્ડ (બ) એટિટ કમાન્ડ
 (ક) એન્જ કમાન્ડ (ઢ) કીએટ કમાન્ડ
- ૨) વિશિષ્ટતા ઓપશનમાં જવા માટે કઈ શૉર્ટ કી વાપરશો ?

(અ) F1 (બ) F12 (ક) F3 (ઢ) F11
- ૩) લાખણિકતા (કોનફિગાર) માટે કઈ શૉર્ટ કી વાપરશો ?

(અ) F3 (બ) F2 (ક) F3 (ઢ) F12
- ૪) કંપની સીલેક્ટ અને બંધ કરવા કઈ શૉર્ટ કી વાપરશો ?

(અ) F1 (બ) F2 (ક) F3 (ઢ) F12
- ૫) તારીખ અને સમયગાળા માટે કઈ શૉર્ટ કી વાપરશો ?

(અ) F1 (બ) F2 (ક) F3 (ઢ) F11

ટેલીનો પરિચય



તમે આટલું શીખ્યા :

ટેલી એ નાણાકીય ખાતાઓ માટેનો પ્રોગ્રામ છે જે ટેલી સોલ્યુશન કંપનીએ ડિઝાઇન કરી બનાવેલ છે મુખ્ય રીતે નાના અને મધ્યમ કદના વ્યાપાર અને હુકાનો માટે ટેલી પ્રોગ્રામનો ઉપયોગ ૮૦ દેશોમાં ર મીલીયન વપરાશ કરો કરી છે. ટેલીમાં દરેક ખાતાના પત્રકો બને છે જ્ઞાન સરવૈયુ, નફા અને નુકશાનનું કાચુ સરવૈયુ, રોકડ પ્રવાહિતતા, ચિજવસ્તુ પત્રક અને ગુણાંતર પ્રમાણ વિશ્લેષણ તેમાં જોઈતી કોઈ એક તારીખ અથવા જોઈતા કોઈ તારીખોના સમયગાળા માટે રીપોર્ટ (અહેવાલ) મળી શકે છે જેમાં પ્રોગ્રામ ફાઈલ હોય અને તેમાં રહેલ પ્રોગ્રામોને ચલાવી શકાય તેમ હોય તેવી સહજ ફ્રાઇંમાં ટેલી ઈ.આર.પી.લ ને ઇનસ્ટોલ કરવામાં આવે છે વપરાશ કર્તા તેની જોઈતી ફ્રાઇંમાં અથવા ડિરેક્ટરીમાં તેનો તેટા અને પ્રોગ્રામ ઇનસ્ટોલ કરી શકે છે ટેલી ઇનસ્ટોલ કર્યા પછી પ્રથમ કાર્ય કંપની ખોલવાનું છે ટેલીમાં સૌથી પ્રથમ કંપનીને લગતી અને જોઈતી વેધાનિક માહિતી અને ખાતાઓની જાળવણીની પ્રાથમિક જરૂરીયાતો કંપની માહિતી (કંપની ઈન્ફો.) માં નાખવી પડે છે.

- કેટલીક મહત્વની કી આ પ્રમાણે છે. F1, F2, F3, F11 અને F12



પાઠ્યાંત સ્વાધ્યાય :

- ટેલીને વર્ણવો
- તમે ટેલી ઈ.આર.પી. લ એટલે શું માનો છો ?
- ટેલીની કોઈપણ ચાર વિશિષ્ટતાઓ વર્ણવો
- ટેલી ઈ.આર.પી. લ માટે મુખ્ય જરૂરી હાઈવેરની લાક્ષણિકતા કઈ છે?
- ટેલીમાં કંપની કઈ રીતે ખોલશો તે વિગતવાર વર્ણવો



પાઠ-સ્વાધ્યાયના જવાબો :

૧૭.૧ (૧) ખોટુ (૨) સાચુ (૩) ખોટુ (૪) સારુ (૫) સાચુ (૬) સાચુ

૧૭.૨ (૧) બ (૨) ક (૩) ઙ (૪) અ (૫) બ

તમારા માટે કાર્ય

- ટેલી પ્રોગ્રામનો ઉપયોગ કરી કંપની ખોલો અને પાછળના પાઠમાંથી તમે શીખેલી વસ્તુની ૧૦ એન્ટી તમે કરો અને તેના આધારે તેમાં પ્રેક્ટીસ કરી તમે કૌશલ્ય પ્રાપ્ત કરો.

મોડચુલ - ૬

કોમ્પ્યુટર પર નામું



નોંધ

નમૂળાજુ આદર્શ પ્રેરણપત્ર

વિષય : નામું

ધોરણ : ૧૦

મહત્વમાન ગુણ : ૧૦૦

સમય : તે કલાક

૧. ગુણભાર

હેતુ	ગુણ	કુલ ગુણના %
જ્ઞાન	૩૦	૩૦
સમજ	૪૦	૪૦
ઉપયોગ	૨૦	૨૦
૧૦૦		૧૦૦

૨. પ્રેરણનો પ્રકાર મુજબ ગુણભાર

પ્રેરણનો પ્રકાર	પ્રેરણો	પ્રેરણદીઠ ગુણ	કુલ ગુણ	અપેક્ષિત સમય
બહુવિકલ્પી પ્રેરણો	૬	૧	૬	
એક વાક્યના જવાબો	૫	૩	૧૫	
ટૂંકા જવાબો	૨	૪	૮	
લાંબા જવાબો	૫	૫	૨૫	
લાંબા જવાબો	૬	૬	૩૬	
નિબંધ પ્રકાર જવાબો	૧	૧૦	૧૦	
૨૫			૧૦૦	૧૬૫+૧૫=૧૮૦

૩. પાઠદીઠ ગુણભાર

પાઠ	ગુણ
૧. નામાનો પરિચય	૨૦
૨. આમનોંધ અને પેટાનોંધ	૨૫
૩. ખાતાવહી, કાચું સરવૈયું, ભૂલ સુધારણા	૧૪
૪. ઘસારો, ઓગવાઈ અને અનામત	૧૨
૫. નાણાંકીય પત્રકો	૨૦
૬. કોમ્પ્યુટરમાં નામા પદ્ધતિ	૮

નમૂળાનું પ્રશ્નપત્ર

નામાના મૂળતત્વો

માદ્યમિક અભ્યાસક્રમ

મહત્વમાં ગુણ : ૧૦૦

समय : ३ क्लास

૧. નીચેના માંથી કઈ સ્થિર મિલકત છે? (૧)
 (a) રોકડ (b) યંત્ર (c) લેણદારો (d) મૃડી

૨. ક્યાં ખાતાની બાકી હંમેશા જમા હોય છે? (૧)
 (a) મિલકત (b) જવાબદારી (c) ખર્ચ (d) વ્યક્તિગત ખાતા

૩. કાચું સરવેયું શું દર્શાવે છે? (૧)
 (a) બસે જમા અને ઉધાર બાકીઓ (b) માત્ર ઉધાર બાકીઓ
 (c) માત્ર જમા બાકીઓ (d) ઉપરના બધાજ

૪. ઘસારા થવાનો કોણ (૧)
 (a) સમયનો વહેણ (b) બજાર કિંમતમાં ઘટાડો
 (c) નાણાના મૂલ્યમાં ઘટાડો (d) ઉપરના બધાજ

૫. જૂની મોટરકારના વેચાણથી થતું નૂકશાન ક્યાં ઉધાર થશે? (૧)
 (a) નફા નૂકશાન ખાતે (b) મોટરકાર ખાતે (c) ઘસારા ખાતે (d) વેપાર ખાતે

૬. નીચેનામાંથી ક્યું ઇનપુટ ડીવાઇસ નથી? (૧)
 (a) સ્કેનર (b) કિબોર્ડ (c) પ્રિન્ટર (d) લાઇટ પેન

૭. નીચેની માહિતી પરથી ખુટ્ટી વિગતો શોધો $A = L + C$ (૧)
 (a) રૂ. ૧૦,૦૦૦ = રૂ. ૭૫૦૦ + ?
 (b) -રૂ. ૧૦,૦૦૦ = રૂ. ૨૫૦૦ + ?
 (c) રૂ. ૫૦૦૦ = ? + રૂ. ૪૦૦૦

૮. નીચેનાને મિલકત, જવાબદારી, ઉપજ અને ખર્ચ વચ્ચે વર્ગીકૃત કરો. (૧)
 (a) યંત્રો (b) ખરીદ (c) સ્ટોક
 (d) વેચાણ (e) પગાર (f) વેચાણ

૯. નીચેનામાં વધારો થાય તો કઈ બાજુએ લખાય? (૧)
 (a) યંત્ર ખાતું (b) લેણદારોનું ખાતું (c) મોહન (માલીક)
 (d) પગાર (e) વેચાણ (f) રોકડ

૧૦. વેપાર ખાતાં અને નફાનુખાન ખાતા વચ્ચે તફાવત જણાવો (કોઈપણ ત્રણ) (3)
૧૧. તમે કઈ રીતે ટેલી ERP9 ખોલશો ?
૧૨. ધંધાના અલગ અસ્તિત્વ અને સાતત્યના સિદ્ધાંતને સમજાવો.
૧૩. નીચેના વ્યવહારોને રોકડમેળના બેંક ખાતામાં નોંધો.

૨૦૦૮	રૂ.
અન્ય - ૧ હાથ પર રોકડ	૧૨,૦૦૦
અન્ય - ૫ રામ પાસેથી મળ્યા	૩,૦૦૦
અન્ય - ૭ ભાડું ચુકવ્યું	૩૦૦
અન્ય - ૭ બેંકમાં ભર્યા	૧૦,૦૦૦
અન્ય - ૧૦ શ્યામને ચુકવ્યા	૩,૦૦૦
અન્ય - ૨૭ રોકડથી ફર્નિચર ખરીદ્યું	૭,૦૦૦
અન્ય - ૨૭ ધર વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા	૫,૦૦૦
અન્ય - ૩૧ મોહન બ્રધર્સ પાસેથી ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભર્યો	૨૦,૦૦૦

૧૪. નીચેના વ્યવહારો જાવેદની પેટાનોંધમાં લખો.

૨૦૦૮	રૂ.
ઓગષ - ૧ રૂ. ૧૦૦૦૦ ની મૂળ કિંમતનો માલ ૧૦% વેપારી વટાવે મોહન પાસેથી ખરીદ્યો.	
ઓગષ - ૨ રૂ. ૨૦૦૦૦નો મૂળકિંમતનો માલ ૩૦% વેપારી વટાવે સુકેતા પાસેથી ખરીદ્યો.	
ઓગષ - ૩ રૂ. ૫૦૦૦ની મૂળ કિંમતનો માલ ૫% વેપારી વટાવે માનસને વેચ્યો	
ઓગષ - ૪ રૂ. ૭૦૦૦નો મૂળ કિંમતનો માલ શંકર પાસેથી ૨૫% વેપારી વટાવે ખરીદ્યો .	
ઓગષ - ૫ રૂ. ૪૦૦૦નો મૂળ કિંમતનો માલ ૧૦% વેપારી વટાવે રવિને વેચ્યો.	
ઓગષ - ૬ રૂ. ૩૦૦૦ની મૂળ કિંમતનો માલ પરત કર્યો.	
ઓગષ - ૭ રૂ. ૫૦૦ની મૂળકિંમતનો માલ પરત કર્યો.	
ઓગષ - ૮ રૂ. ૫૦૦ની મૂળકિંમતનો માલ પરત કર્યો.	
ઓગષ - ૯ શંકરને રૂ. ૨૦૦ની મૂળકિંમતનો માલ પરત કર્યો.	
ઓગષ - ૧૦ મનમોહને રૂ. ૮૦૦ની મૂળકિંમતનો માલ પરત કર્યો.	

૧૫. શ્રી પાલના ચોપડે તા. ૩૧-૩-૨૦૦૯ ના રોજની બાકીઓ આપેલ છે. તેના પરથી કાચું સરવૈયું તૈયાર કરો. બાકીની રકમ મૂડી ખાતે લઈ જવાની છે.

વિગત

રૂ.

ખરીદ	૭૭,૦૦૦
સ્ટોક (૧-૪-૦૮)	૨૪,૦૦૦
વેચાણ	૧,૦૪,૦૦૦
દેવાદારો	૨૩,૮૦૦
મળેલ વટાવ	૩,૪૦૦
આવકમાલ ગાડા ભાડુ	૭૦૦
હાથ પર રોકડ	૩,૪૦૦
યંત્રો	૧,૨૪,૪૦૦
ઘસારાની જોગવાઈ	૨૪,૨૦૦
ઉપાડ	૭,૭૦૦
ખરીદ માલ પરત	૩,૪૦૦
મફાન	૪,૨૮,૦૦૦
લેણદારો	૧૬,૯૦૦
આપેલ વટાવ	૨,૮૦૦
આવકમાલ ગાડા ભાડું	૧,૪૦૦
બેંકમાં રોકડ	૧૭,૪૦૦
સામાન્ય ખર્ચ	૨,૯૦૦
માંડી વાળેલ ઘાલખાદ	૪,૪૪૦
શકમંદ લેણા અનામત	૨,૩૮૦
મૂડી (તફાવતની રકમ)	૭,૬૦,૭૭૦

૧૬. હિસાબી ભૂલો એટલે શું? કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોને ટૂંકમાં સમજાવો.

૧૭. રામ બ્રધર્સ તા. ૧-૭-૨૦૦૯ના રોજ રૂ. ૧,૪૦,૦૦૦માં એક યંત્ર ખરીદું. તેને ગોઠવણી ખર્ચ રૂ. ૧૦,૦૦૦ થયો ઘસારો યંત્રની મૂળકિંમતના ૧૦% લેખે ગંય છે. હિસાબી વર્ષ ૩૧ મી ડિસેમ્બરે પૂરું થાય છે. ત્રણ વર્ષ માટે યંત્ર ખાતું અને ઘસાપા ખાતું બનાવો. (૫)

૧૮. હાથથી લખાયેલ નામ અને કોમ્પ્યુટરથી લખાયેલ નામા પદ્ધતિ વચ્ચે તફાવત જણાવો? (૬)

૧૯. નીચેના સમજાવો.

૧. સાતત્યનો સિક્રાંત
૨. રૂઢિયુસ્તતાનો સિક્રાંત
૩. મહત્વતાનો ઘ્યાલ

૨૦. નીચેના વ્યવહારોની હિસાબી સમીકરણ મુજબ અસર તપાસો

૧.	મોષને રોકડ લાવી ધંધો ચાલુ કર્યો	૪૦,૦૦૦
૨.	રોકડથી માલ ખરીદો	૩૦,૦૦૦
૩.	ગોવિંદ પાસેથી ઉધાર પર માલ ખરીદો	૨૦,૦૦૦
૪.	રોકડથી માલ વેચ્યો	૧૨,૦૦૦
૫.	કપિલ પાસેથી ઉધાર પર ફર્નિચર ખરીદું	૨,૦૦૦
૬.	લેશદાર ગોવિંદને ચૂકવ્યાં	૧૪,૦૦૦

૨૧. નીચેના વ્યવહારો વિશાળની આમનોંધમાં નોંધો. (૬)

૨૦૧૦

મે. ૧.	રોકડ લાવી ધંધો ચાલુ કર્યો	૫,૦૦,૦૦૦
મે. ૨.	મોષન પાસેથી રોકડથી માલ ખરીદો	૪૦,૦૦૦
મે. ૩.	અજય પાસેથી માલ ખરીદો.	૧,૨૦,૦૦૦
મે. ૪.	અજયને માલ પરત કર્યો	૨૦,૦૦૦
મે. ૧૫.	રાવજીને માલ વેચ્યો	૪,૦૦૦
મે. ૨૫.	પગાર ચૂકવ્યો	૪૦૦

૨૨. નીચેની માહિતી પરથી મેસર્સ જીનિયસ લેધર સ્ટોર્સનાં જમાં વાઉચર તૈયાર કરો. (૬)

૨૦૧૨

૧.	જુલાઈ ૫ સોષન એન્ડ કંપની પાસેથી રોકડ મળી. રોકડ પાવતી નં. ૩૫	રૂ. ૧૨,૦૦૦
૨.	જુલાઈ ૧૦ કમિશન મળ્યું રોકડ પાવતી નં. ૭૪	રૂ. ૩,૪૦૦
૩.	જુલાઈ ૧૫ લેધર પર્સ વેચ્યો રોકડ પાવતી નં. ૪૧૨	રૂ. ૪,૪૦૦
૪.	જુલાઈ ૨૪ બે લેધર કલર મશીન વેચ્યા. રોકડ પાવતી નં. ૩૭૧૪	રૂ. ૧૨,૪૦૦

૨૩. જોગવાઈ એટલે શું? જોગવાઈ અને અનામત વચ્ચેના તફાવતના બે મુદ્દાઓ જમાવો. (૬)
૨૪. નાણાંકીય પત્રકોનો અર્થ સમજાવી તેના હેતુઓ જણાવો. (૬)
૨૫. નીચે આપેલ કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક છિસાબી તૈયાર કરો. (૧૦)

તા. ૩૧-૩-૧ રના રોજનું કાચું સરવૈયું

વિગત	ઉધાર	જમા
રાજનની મૂડી		રૂ,૮૦,૦૦૦
રાજનનો ઉપાડ	૭,૬૦૦	
ખરીદ અને વેચાણ	૮,૮૦૦	૧,૪૦,૦૦૦
વેચાણ અને ખરીદ પરત	૨,૮૦૦	૪,૪૦૦
સ્ટોક (૧-૪-૨૦૦૮)	૧૨,૦૦૦	
મજૂરી		૮,૦૦૦
મકાન		રૂ,૨૦,૦૦૦
નૂર અને ભાડું	૨૦,૦૦૦	
વેપાર ખર્ચ	૨,૦૦૦	
જહેરાત	૨,૪૦૦	
મળેલ વ્યાદ		૩,૪૦૦
કર અને વિમો	૧,૩૦૦	
દેવાદારો અને લેણદારો	૬૪,૦૦૦	૧૨,૦૦૦
લેણીહૂંડી અને દેવી હૂંડી	૧૪,૦૦૦	૭,૦૦૦
બંકમાં રોકડ	૧૨,૦૦૦	
હાથ પર રોકડ	૧,૮૦૦	
પગાર		૮,૦૦૦
	<hr/> <u>૪,૬૭,૦૦૦</u>	<hr/> <u>૪,૬૭,૦૦૦</u>

હવાલા:

- આખર માલ સ્ટોકની કિંમત તા. ૩૧-૩-૨૦૦૮ના રોજ રૂ. ૧૪,૦૦૦ છે.
- અગાઉથી ચૂકવેલ વીમો રૂ. ૪૦૦

૩. ચૂકવવાની બાકી જવાબદારી : પગાર રૂ. ૨૦૦૦, કરવેરા રૂ. ૧૩૦૦
૪. મકાન પર ૨% લેખે વાર્ષિક ઘસારો ગણો.

અથવા

- i) પાકું સરવૈયું બનાવવાના ઉદેશ્યો જણાવો.
- ii) મેમર્સ્ રામ એન્ડ સન્સના તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ પૂરા થતા વર્ષ માટે છવાલાનોંધ તૈયાર કરો.
 ૧. આખર સ્ટોક રૂ. ૫૦૦૦
 ૨. યંત્ર પર રૂ. ૩૦૦ ઘસારો ગણો
 ૩. ચૂકવવાનો બાકી પગાર રૂ. ૧૦૦૦
 ૪. વીમામાં રૂ. ૫૦૦ અગાઉના વર્ષના છે.
 ૫. ચૂકવવાની બાકી મજૂરી રૂ. ૨૦૦૦ છે.

cccii

ગુણ પ્રદાન યોજના

નામાના મૂળતત્વો

માદ્યાભિક અભ્યાસક્રમ

પ્રશ્ન ક્રમાંક	સમવિષ્ટ મુદ્દા	જ્ઞાન
૧.	ચંત્ર	(૧)
૨.	જવાબદારી	(૧)
૩.	ઉધાર અને જમા બાકી બતે	(૧)
૪.	સમયના વહેણ	(૧)
૫.	નફા નુકસાન ખાતે	(૧)
૬.	ઇપન્ટર	(૧)
૭.	૧. રૂ. ૨૫૦૦ ૨. રૂ. ૭,૫૦૦ ૩. રૂ. ૧૦૦૦	
૮.	(a) મિલકતો (b) ખર્ચાઓ (c) મિલકતો (d) જવાબદારી	
૯.	(a) ઉધાર બાજુ (b) જમાબાજુ (c) જમાબાજુ (d) ઉધારબાજુ	
	(e) જમાબાજુ (f) ઉધારબાજુ	
૧૦.		

૧૦.

ક્રમ	વેપાર ખાતુ	નફાનુકસાન ખાતુ
૧.	આ ખાતુ વર્ષના અંતે થયેલ કાચો નફો કે કાચી ખોટ દર્શાવે છે.	આ ખાતું વર્ષના અંતે થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ દર્શાવે છે.
૨.	ધંધાની ઉંઘી સીધી પ્રત્યક્ષ ઉપજ આ ખાતાની જમા બાજુ દર્શાવાય છે.	ધંધાની બધીજ પ્રત્યક્ષ ઉપજ આ ખાતાની જમા બાજુ એ દર્શાવાય છે.
૩.	ધંધાના પ્રત્યક્ષ ખર્ચાઓ આ ખાતાની ઉધાર બાજુએ દર્શાવાય છે.	ધંધાના પ્રરોક્ષ ખર્ચાઓ આ ખાતાની ઉધાર બાજુએ દર્શાવાય છે.

૧૧. ટેલી ERP 9 નો ઉપયોગ કરવા નીચે મુજબની પ્રક્રિયા કરો. (૩)

૧. ટાસ્કબાર પરથી સ્ટાર્ટ બટનને કલીક કરો, તેથી મેનુ ચાલુ થઈ જશે.

૨. સ્ટાર્ટ મેનુમાં ઓલ પ્રોગ્રામ ઓપ્શનપર માઉસ પોઇન્ટર લઈજાઓ.
૩. માઉસ પોઇન્ટરને ટેલી ERP 9 પર લઈ જઈ કલીક કરો.
૪. ટેલી ERP 9 સ્ક્રીન પર ખુલ્લી જશે.

૧૨. ૧. ધંધાના અલગ અસ્તિત્વનો ઘ્યાલ :

૨. સાતત્યનો સિદ્ધાંત

૧૩. ઉધાર રોકડ મેળ જમા

તારીખ	આવક	બંક	રોકડ	તારીખ	જાવક	બંક	રોકડ
૨૦૦૮	બા.આ.લાયા	-	૧૨,૦૦૦	૨૦૦૮	ભાડા ખાતે		૩૦૦
૫	રામ	-	૩૦૦૦	૭	બંક ખાતે		૧૦,૦૦૦
૭	રોકડ	૧૦,૦૦૦	-	૧૦	શ્યામ ખાતે		૧૦૦૦
૮	વેચાણ ખાતે	-	૩૦૦૦	૨૭	ફર્નિચર ખાતે		૨૦૦૦
૩૧	મોહન બધસ્યા ખાતે	૨૦,૦૦૦		૩૧	ઉપાડ ખાતે	૪૦૦૦	-
		૩૦૦૦૦	૧૮૦૦૦	૩૧	પગાર ખાતે	-	૧૦૦૦
					બા.આ.લઈ	૨૪૦૦૦	૭,૭૦૦
કેષ.	બા.આ.લાયા	૨૪૦૦૦	૭૭૦૦			૩૦૦૦૦	૧૮,૦૦૦

ખરીદ નોંધ

તારીખ	વિગત	ખ.પિ.	રૂમ	રૂમ
૨૦૧૨	મોહન		૧૦,૦૦૦	
ઓગ. ૧	-વ-વર્તાવ ૨૦%		૨૦૦૦	૮૦૦૦
૨	અકતા		૨૦,૦૦૦	
	-વ-વર્તાવ ૩૦%		૬૦૦૦	૧૪૦૦૦
૪	શિકર		૭૦,૦૦૦	
	-વ-વર્તાવ ૨૫%		૧૭૪૦	૫૨૪૦
	ખરીદ ખાતે	૩.		૨૭૨૪૦

વેચાણ નોંધ

૨૦૧૨ ઓગષ્ટ-૩ ૫ ૬	માનસ		૪૦૦૦	૪૭૪૦
	-વે-વટાવ ૫%		૨૪૦	૪૭૪૦
	રવિ		૮૦૦૦	
	-વે-વટાવ ૧૦%		૮૦૦	૩૬૦૦
	મનમોહન		૩૦૦૦	
	-વે-વટાવ ૫%		૧૪૦	૨૮૪૦
વેચાણ ખાતે ૪મા.				૧૧૨૦૦

ખરીદ પરત નોંધ

૨૦૧૨ ઓગષ્ટ-૭ ૯	મોહન		૪૦૦	
	-વે-વટાવ ૨૦%		૧૦૦	૪૦૦
	શિક્ષ		૨૦૦	
	-વે-વટાવ ૨૫%		૪૦	૧૪૦
	ખરીદ પરત ખાતે ૪મા			૫૪૦

વેચાણ પરત નોંધ

૨૦૧૨ ઓગષ્ટ-૮ ૧૦	રવિ	.	૪૦૦	
	-વે-વટાવ ૧૦%		૪૦	૪૪૦
	મનમોહન		૮૦૦	
	-વે-વટાવ ૫%		૪૦	૭૬૦
	વેચાણ પરત ખાતે ૪ધાર			૧૨૯૦

તા. ૩૧-૩-૨૦૦૮ના રોજનું કાચું સરવૈયું

વિગત	ઉધાર બાકી રૂ.	જમા બાકી રૂ.
ખરોડ	૭૭,૦૦૦	-
સ્ટોક (૧-૪-૨૦૦૮)	૨૪,૦૦૦	-
વેચાણ	-	૧,૦૪,૦૦૦
દેવાદારો	૨૩,૮૦૦	-
મળેલ વટાવ	-	૩,૪૦૦
આવકમાલ ગાડા ભાડું	૭૦૦	
છાથ પર રોકડ	૩,૪૦૦	-
ધૂત્રો	૧,૨૪,૪૦૦	-
ઘસારાની જોગવાઈ	-	૨૪,૨૦૦
ઉપાડ	૭,૭૦૦	
વેચાણ પરત	૩૪૦૦	
મકાન	૫,૨૮,૦૦૦	-
લેણદારો	-	૧૬,૧૦૦
આપેલ વટાવ	૨૮૦૦	-
આવક માલ ગાડા ભાડું	૧૪૦૦	-
બંકમાં રોક	૧૭૪૦૦	-
સામાન્ય ખર્ચ	૨૧૬૦	
માંડીવાળેલ ઘાલખાધ	૨૪૪૦	
શંકમંદ લેણાં અનામત	-	૨૩૮૦
મૂડી	-	૧,૫૦,૭૭૦
	૮,૯૯,૮૪૦	૮,૯૯,૮૪૦

૧૬. હિસાબો લખતી વખતે જે ભૂલો થાય તેને હિસાબી ભૂલો કહેવાય છે.

કાચાં સરવૈયાંને અસર ન કરતી ભૂલો નીચે મુજબ છે.

૧. વિસરચૂકની ભૂલ
૨. સિદ્ધાંતની ભૂલ
૩. ખોટા ખાતે લખવાની ભૂલ
૪. ભરપાઈચૂક ભૂલ

૧૭.

યંત્રખાતુ

તારીખ	વિગત	રૂમ	તારીખ	વિગત	રૂમ
૨૦૦૬	બેંક ખાતે	૧,૪૦,૦૦૦	૨૦૦૬	ઘસારા ખાતે	૭૫૦૦
જુલાઈ ૧	રોકડ ખાતે	૧૦,૦૦૦	દિસે. ૩૧	૧૪૦,૦૦૦+૧૦૫	
		૧૪૦,૦૦૦	દિસે. ૩૧	આ.આ.લઈ.ગયા	૧,૪૨,૫૦૦
					૧,૪૦,૦૦૦
૨૦૦૭			૨૦૦૭		
જાન્યુ ૧	આ.આ.લાવ્યા	૧,૪૨,૫૦૦	દિસે. ૩૧	ઘસારા ખાતે	૧૪,૦૦૦
		૧,૪૨,૫૦૦		આ.આ.લાવ્યા	૧,૨૭,૫૦૦
					૧૪,૨,૫૦૦
૨૦૦૮			૨૦૦૮		
જાન્યુ ૧	આ.આ.લાવ્યા	૧,૨૭,૫૦૦	દિસે. ૩૧	ઘસારાખાતે	૧૪૦૦૦
		૧,૨૭,૫૦૦		આ.આ.લઈ.ગયા	૧,૧૨,૫૦૦
					૧,૨૭,૫૦૦
૨૦૦૯					
જાન્યુ ૧	આ.આ.લાવ્યા	૧,૧૨,૫૦૦			

ઘસારા ખાતું

તારીખ	વિગત	રકમ	તારીખ	વિગત	રકમ
૨૦૦૬			૨૦૦૬		
દિસે. ૩૧	યંત્ર ખાતે	૭૪૦૦	દિસે. ૩૧	ન. નુ. ખાતે	૭૪૦૦
૨૦૦૭			૨૦૦૭		
	યંત્ર ખાતે	૧૫૦૦૦	દિસે. ૩૧	ન. નુખાતે	૧૫૦૦૦
૨૦૦૮			૨૦૦૮		
દિસે. ૩૧	યંત્ર ખાતે	૧૫૦૦૦	દિસે. ૩૧	ન. નુખાતે	૧૫૦૦૦

૧૮. કોમ્પ્યુટર હિસાબી પ્રણાલી અને હસ્તલિખિત હિસાબી પ્રણાલી વચ્ચે તુલના

૧. હિસાબી વ્યવહારોની ઓળખ : બજે પ્રક્રિયામાં હિસાબી સિદ્ધાંતો અને ખ્યાલો સરખા છે.
 ૨. નોંધ) હિસાબોની નોંધ આમનોંધમાં કરી તેની ખતવજી કરી સરવેચું બનાવાય છે.
 ૩. વર્ગીકરણ : હિસાબો લખતી વખતે ખતવજી કરવી પડે છે જ્યારે કોમ્પ્યુટરમાં ખતવજી આતે જ થઈ જાય છે.
 ૪. અવલોકન : હિસાબી પ્રણાલીમાં અવલોકન આતે કરવું પડે છે. જ્યારે કોમ્પ્યુટરમાં આ પ્રક્રિયા ઝડપથી થઈ જાય છે.
 ૫. હવાલાનોંધ : કોમ્પ્યુટરમાં હવાલા નોંધ સરળતાથી કરી શકાય છે.
૧૯. હિસાબની બેવડી અસર : નામાંમાં દરેક હિસાબની બેવડી અસર થાય છે.
૧. વેચાણ : માલની ઉધાર કે રોકડથી જાવક એટલે વેચાણ.
 ૨. અલગ અસ્તિત્વનો સિદ્ધાંત : ધંધો અને ધંધાનો માલિક હિસાબી દર્ખિઓ અલગ અસ્તિત્વ ધરાવે છે.
 ૩. નાણાંનાં મૂલ્યનો સિદ્ધાંત : નામાંમાં બધાજ વ્યવહારો નાણાંમાં લખાય છે.

૨૦.

ક્રમ	વ્યવહાર	મિલકતા	દેવા + મૂડી
૧	મોહને ધંધો ચાલુ કર્યો	રોકડ+સ્ટોક+ફર્નિચર, ૪૦,૦૦૦	૦+૪૦,૦૦૦
૨	માલ ખરીદો	૫૦૦૦૦-૩૦૦૦૦+૦	૦+૪૦,૦૦૦
૩	ઉધાર પર માલ ખરીદો	૨૦૦૦૦+૨૦૦૦૦+૩૦૦૦૦+૦	૨૦,૦૦૦+૪૦,૦૦૦
૪	રોકડથી માલ વેચ્યો	૨૦૦૦૦+૪૦,૦૦૦+૦	૨૦,૦૦૦+૪૦,૦૦૦
૫	ફર્નિચર ઉધારપર ખરીદો	૩૨૦૦૦+૩૮૦૦૦+૦	૨૦,૦૦૦+૪૦૦૦૦+૨૦૦૦
૬	લેણદારોને આય્યા	૩૨૦૦૦+૩૮૦૦૦+૨૦૦૦૦+૪૦૦	૨૨૦૦૦+૪૦૦૦૦-૧૪૦૦૦
		૧૭૦૦૦+૩૮૦૦૦+૨૦૦૦૦	૭૦૦૦+૪૦,૦૦૦

૨૧.

ક્રમ	વિગત	ઉધાર	જમા
૧	રોકડ ખાતે તે મૂડી ખાતે (બાજે. રોકડલાવી ધંધો ચાલુ કર્યો)	૩. ૪૦,૦૦૦	૪૦,૦૦૦
૨	રોકડ ખાતે તે મૂડી ખાતે (બાજે. રોકડ થી માલ ખરીદો)	૩. ૪૦,૦૦૦	૪૦,૦૦૦
૩	રોકડ ખાતે તે અજય ખાતે (બાજે. માલ ખરીદો)	૩. ૧,૨૦,૦૦૦	૧,૨૦,૦૦૦
૪	રોકડ ખાતે તે ખરીદ પરત ખાતે (બાજે. માલ પરત કર્યો)	૩. ૨૦,૦૦૦	૨૦,૦૦૦
૫	અજય ખાતે તે વેચાણ ખાતે (બાજે. માલ વેચ્યો)	૩. ૪૦૦૦	૪૦૦૦
૬	પગાર ખાતે તે રોકડ ખાતે (પગાર ચુકવ્યો)	૩. ૪૦૦	૪૦૦
		૬,૮૪,૪૦૦	૬,૮૪,૪૦૦

૨૨. (૧) મેસર્સ જનિયસ લેધર સ્ટોર્સ

બિલ નં. ૨	તારીખ : ૧૦-૭-૨૦૧૨ રકમ (રૂ)
જમા : કમિશન ખાતે (બા. જે. કમિશનના રોકડ મળ્યા બિલ નં. ૭૪)	૩૫૦૦
	૩૫૦૦
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ

(૨)

મેસર્સ જનિયસ લેધર સ્ટોર્સ

બિલ નં. ૩	તારીખ : ૧૫-૭-૨૦૧૨ રકમ (રૂ)
જમા : કમિશન ખાતે (બા. જે. રોકડથી વેચાણ કર્યું રોકડ બિલ નં. ૪૧૨)	૪૫૦૦
	૪૫૦૦
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ

(૩)

મેસર્સ જનિયસ લેધર સ્ટોર્સ

બિલ નં. ૪	તારીખ : ૨૪-૭-૨૦૧૨ રકમ (રૂ)
જમા : યંત્ર ખાતે (બા. જે. બે લેધર કલર કરવાની મશીન રોકડથી વેચ્યા તેના રોકડ બિલ નં. ૩૭૧૪)	૧૨૫૦૦
	૧૨૫૦૦
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ

(૪)

મેસર્સ જનિયસ લેધર સ્ટોર્સ

બિલ નં. ૧	તારીખ : ૫-૭-૨૦૧૨ રકમ (રૂ)
જમા : મેસર્સ સોઝન થક.	૧૨૦૦૦
(બા. જે. રોકડ રકમ મળી રોકડ બિલ નં. ૩૫)	૧૨૦૦૦
સહી/- મેનેજર	સહી/- હિસાબનીશ

૨૩. ભવિષ્યના ચોક્કસ ખર્ચ કે નુકશાન ને પહોંચી વળવા જે અલગથી ભંડોળ રાખવામાં આવે છે તેને જોગવાઈ કહેવાય છે.

ક્રમ	જોગવાઈ	અનામત
૧.	જોગવાઈ નફા નુકશાન ખાતેથી ઉભી કરાય છે.	અનામત નફાનુકશાન ફાળવણી ખાતેથી ઉઘારાયછે.
૨.	નફો હોય કે નુકશાન જોગવાઈ કરવી ફરજીયાત છે.	ફક્ત નફો હોય તો જ અનામત રાખવામાં આવે છે.

૨૪. ધંધાનું પરિણામ અને ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પત્રકો બનાવવામાં આવે છે તેને નાણાંકીય પત્રકો કહે છે તેના હેતુઓ નીચે મુજબ છે.

- | | |
|---|-------------------------------|
| ૧. ધંધાની પ્રવૃત્તિઓનું પરિણામ જાણવા | ૨. મેનેજરને કાર્યક્ષમતા જાણવા |
| ૩. ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા | ૪. ધંધાની રોકડ સ્થિતિ જાણવા |
| ૫. સાચા નિષ્ણયો લેવા | |
| ૨૫. રાજનાનું તા. ૩૧-૩-૨૦૦૮ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર અને નફા નુકશાન ખાતું. | |

ઉધાર

જમા

વિગત	રૂ.	વિગત	રૂ.	
શરૂનો સ્ટક		૧૨,૦૦૦	વેચાણ	૧,૪૦,૦૦૦
ખરીદ	૮૮૦૦૦		વેચાણ પરત	- ૨૮૦૦
ખરીદ પરત	૪૫૦૦	૮૪૦૦	આખર સ્ટોક	૧૪૦૦૦
મજૂરી		૮,૦૦૦		
ભાડું અને નૂર		૨૦,૦૦૦		
કાચો નફો		૩૭૯૦૦		
		૧,૬૨,૨૦૦		૧,૬૨,૨૦૦
વેચાણ નફો		૨૦૦૦	કાચો નફો	૩૭,૯૦૦
જાહેરાત ખર્ચ		૨૪૦૦	મળેલ વ્યાજ	૩૪૦૦
વીમો અને વેરો	૧૩૦૦			
+ ચૂ. બાકી	૧૩૦૦			
- અગાઉ થી ચૂકવેલ	૧૩૦૦			
		૨૨૦૦		

પગાર	2000		
+ ચૂ. બાકી	<u>2000</u>	90,000	
મિલકતનો ધસારો		8800	
ચોખ્યો નફો		20,000	
		89200	89200

રાજનું તા. ૩૧-૩-૨૦૦૮ના રોજનું પાકું સરવૈયુ

મૂડી - દેવાં	રૂ.	મિલકત- લેણાં	રૂ.
ચાલુ જવાબદારી		હાથ પર રોકડ	૧૮૦૦
લેણદારો	૧૨,૦૦૦	બેંકમાં રોકડ	૧૨૦૦૦
દેવી હુંડી	૭૦૦	લેણીછૂંડી	૧૪,૦૦૦
ચૂ. બાકી જવાબદારી		દેવાદારો	૬૪,૦૦૦
કરવેરા	૧૩૦૦	અગાઉથી ચૂકવેલ વીમો	૪૦૦
પગાર	<u>2000</u>	આપર સ્ટોક	૧૪,૦૦૦
મૂડી	<u>2,૬૦,૦૦૦</u>	સ્થિર મિલકતો	
+ ચો. નફો	<u>૨૦,૦૦૦</u>	મકાન	૨,૨૦,૦૦૦
- ઉપાડ	<u>૭૬૦૦</u>	- ધસારો	૮૮૦૦
		ચાલુ મિલકતો	
			૩,૨૪,૬૦૦
			૩,૨૪,૬૦૦

અથવા

૧. નીચેના હેતુઓ માટે પાકું સરવૈયું તૈયાર કરાય છે.
- અ) ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે.
- બ) ધંધાની આંતરિક અને બ્રાહ્ય જવાબદારીઓ જાણવી કે જેથી સમયસર તેની ચૂકવણી કરી શકાય.
- ક) ધંધાની સ્થિર અને ચાલુ મિલકતોની સ્થિતિ જાણવા.
- ઢ) વર્તમાન પરિસ્થિતિઓના આધારે ભવિષ્યની પ્રવૃત્તિઓનું આયોજન કરવા.

૨. વર્ષના અંતે નીચે મુજબની હવાલા અસર આપવામાં આવશે.

અ)	૩૧-૩-૧૨ 	આખર માલ સ્ટોક ખાતે રૂ. તે વેપાર ખાતે (બા.જે આખરમાલ સ્ટોક ખાતું વેપાર લઈ ગયા તેના)	૪૦૦૦ 	૪૦૦૦
બ)	૩૧-૩-૧૨ 	ઘસારા ખાતે રૂ. તે યંત્ર ખાનાં ખાતે (બા.જે. યંત્ર પર ઘસારો ગણ્યો તેના)	૩૦૦૦ 	૩૦૦૦
ક)	૩૧-૩-૧૨ 	પગાર ખાતે રૂ. તે બાકી પગાર ખાતે (બા.જે. પગાર ચૂકવવાનું બાકી તેના)	૧૦૦૦ 	૧૦૦૦
ઝ)	૩૧-૩-૧૨ 	અગાઉથી ચૂકવેલ પ્રીમીયમ ખાતે રૂ. તેના વિમા પ્રીમીયમ ખાતે (બા.જે. વિમા પ્રીમીયમ અગાઉથી ચૂકવ્યું તેના)	૪૦૦ 	૪૦૦
દ)	૩૧-૩-૧૨ 	મજૂરી ખાતે રૂ. તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે (બાજે. મજૂરી ચૂકવવાની બાકી તેના)	૨૦૦૦ 	૨૦૦૦